

ઉચ્ચતર હિસાબી પદ્ધતિ-૨

એફ. વાય. બી. કોમ.



સરદાર પટેલ યુનિવર્સિટી
વલલભ વિદ્યાનગર

NAAC ACCREDITED GRADE 'A' WITH 3.25 CGPA

(23-01-2017 to 22-01-2022)

First Edition : June 2019

Copies : 1000

Price : Rs 110/-

**© Sardar Patel University
Vallabh Vidyanagar - 388 120**

ISBN : 978-93-81386-75-0

The book is strictly written according to the new syllabus available at the time of printing.

Every possible efforts have been made to avoid errors and omissions in this publication by the authors and the Publisher. Inspite of this efforts, some typographical errors might have crept in. Any mistake, error or discrepancy noted may be brought to our notice which shall be taken care of in the forthcoming edition. It is hereby notified that neither the Authors nor the Printer or seller will be liable for any damage or loss to anyone, in any manner there from. It is suggested that to avoid any doubt the reader should cross-check all the facts, law and contents of the publication with original Government publication or notifications wherever applicable. The text of this publication, or any part thereof, may not be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording, storage in an information retrieval system, or reproduced on any disc, tape, perforated media or other information storage device, etc., otherwise, without the prior written permission of the University. No key to this book can be prepared without the prior written permission of the publiser. Any violation will invite prosecution legal action under the Indian Copyright Act.

This book is sold subject to the condition that it shall not by way of trade or otherwise. However it can be lent, resold, hired out or circulated in the wider interest of student community.

For binding mistakes, misprints or for missing pages, etc., the printer liability is limited to replacement within one month of purchase by similar edition. All expenses in this connection are to be borne by the purchaser.

All disputes are subject to jurisdiction of Anand only.

**Published by : Registrar, Sardar Patel University,
Vallabh Vidyanagar - 388 120**

**Available at : Store Section - Room No: 108,
Sardar Patel University, Vallabh Vidyanagar - 388 120**

**Printed by : University Press, Sardar Patel University,
Vallabh Vidyanagar - 388 120**

પ્રસ્તાવના

લેખકોના લાંબા ગાળાના શૈક્ષણિક અનુભવને આધારે આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. હિસાબી પદ્ધતિનો વિસ્તાર અને વિકાશએ ધેંધાના સતત વિકાશ સાથે સંકળાયેલ છે. આ પુસ્તક તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ તેના ઉપયોગકર્તા-ખાસ કરીને વિધાર્થીઓ માતૃભાષામાં વિષયને સારી અને સરળ ભાષામાં સમજું શકે અને તૈયાર થાય તે રહેલો છે.

હિસાબી પદ્ધતિને ધેંધાની ભાષા કહેવામાં આવે છે. ભાષાનું મહત્વનું કાર્ય માહિતી સંચારનું છે. હિસાબી પદ્ધતિ પણ ધેંધાની સાથે સંકળાયેલ હિતધારકોને ધેંધાની માહિતી પહોંચાડવાનું કાર્ય કરે છે.

ધેંધો એટલે નજીના ઉદ્દેશી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ, ધેંધાકીય સંસ્થા અને બિન-ધેંધાકીય સંસ્થાઓના આર્થિક વ્યવહારોની નોંધણી અને રજૂઆત જે કાયદેસર માન્ય હિસાબી પદ્ધતિના આધારે કરવામાં આવે છે તેને નાણાકીય હિસાબી પદ્ધતિ તરીકે ઓળખાય છે.

આ પુસ્તકમાં ધેંધાના વિશિષ્ટ પ્રકારના જુદા જુદા સ્વરૂપોને લગતા હિસાબો તૈયાર કરવાની પદ્ધતિની રજૂઆત કરવામાં આવેલ છે. આ પુસ્તક એક.પાય.બી.કો.મ. ના ઉર્ચયતર હિસાબી પદ્ધતિ-૨ સંબંધિત વિષયના સૂચિત વૈકલ્પિક કોર્સના આઠ એકમ/પ્રકરણનો સમાવેશ થયેલ છે. આમ, આ પુસ્તકમાં ભાડે ખરીદ પદ્ધતિના હિસાબો, આડતમાલના હિસાબો, સંયુક્ત સાહસના હિસાબો, એકનોંધી હિસાબી પદ્ધતિ, શાખાના હિસાબો, કૃષિના હિસાબો, વ્યવસાયી વ્યક્તિના હિસાબો અને બિન વેપારી સંસ્થાના હિસાબોનો સમાવેશ થાય છે. વિધાર્થીઓ અને અધ્યાપક મિત્રોની જરૂરીયાતને દ્યાનામાં રાજીને ગુજરાતની અગ્રાંધી યુનિવર્સિટીઓંના પૂછુંથામાં આવેલ ઉદાહરણોની ઉત્તાર સહિત વિગતવાર રજૂઆત કરવામાં આવેલ છે અને સ્વાદ્યાયમાં પણ દાખલાઓ જવાબ સહિત સમાવેશ કરવામાં આવેલ છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના વિધાર્થીઓને ગુજરાતી ભાષામાં અધ્યતન સાહિત્ય ઉપલબ્ધ થાય અને વિષયનું જ્ઞાન સરળ અને સમજાય તે રીતે મળી રહે તે માટે આપણી યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી પ્રોફેસર શિરીષ કુલકણી સાહેબ ખાસ અંગત રસ લઈ જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડેલ છે તે માટે અમે સૌ તેમના ખૂબ ખૂબ આભારી છીએ. ડૉ. જયેશ કે. પંડ્યા, ઓસોક્સિએટેક પ્રોફેસર, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ વિલાગ, કોમર્સ ફેકલ્ટી તરીકે કાભગીરી બજાવેલ છે. યુનિવર્સિટીના વહીવટી વિભાગના કર્મચારી ભાઈઓ અને અધિકારીશ્રી જયંતબાઈ મેકવાન પણ ઉમદા કાભગીરી બજાવેલ છે. આ પુસ્તક તૈયાર કરવામાં લેખકોએ બધાજ પ્રકારની ચોક્કસાઈ રાખેલ છે. તેમ હતાં અમૂક ક્ષતિઓ અને છાપકામની ભૂલો રહી ગયેલ હોય તે વાંચકમિત્રો અમારા દ્યાન પર લાવશો તો અમે સહર્ષ સ્વીકારીશું અને આપના તરફથી સૂચનો અને માર્ગદર્શન પણ આપકાર્ય છે.

અંતમાં, આ પુસ્તક તૈયાર કરવા અંગે અમારામાં વિશ્વાસ મુક્કો તથા અમને સર્વ પ્રકારની સહાય અને પ્રોત્સાહન આપ્યું એવા અમારી યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી, માનનીય કુલસચિવકી, પ્રેસ વિલાગના કર્મચારીશ્રીઓ પગરેનો આભાર વ્યક્ત કરીએ છીએ.

તા. જૂન, ૨૦૧૮
પદ્ધતિના વિદ્યાનગર

- ડૉ. જયેશ કે. પંડ્યા

ઉચ્ચતર હિસાબી પદ્ધતિ-૨

અનુકૂળભાષા

પ્ર. ૧	પ્રેફરન્સ શેરમૂડીના નાણાં પરત કરવા - ડૉ. હસન રાણા, આસીસ્ટન્ટ પ્રોફેસર, શ્રી આર.પી. આર્ટ્સ, કે.બી. કોમર્સ એન્ડ બી.સી.જે. સાયન્સ કોલેજ, શ્રી બી.ડી. રાય કોલેજ કેન્પસ, બેઠક રોડ, ખંભાત	૧
પ્ર. ૨	ડિલેન્ચરને બહાર પાડવા અને પરત કરવા - ડૉ. હસન રાણા, આસીસ્ટન્ટ પ્રોફેસર, શ્રી આર.પી. આર્ટ્સ, કે.બી. કોમર્સ એન્ડ બી.સી.જે. સાયન્સ કોલેજ, શ્રી બી.ડી. રાય કોલેજ કેન્પસ, બેઠક રોડ, ખંભાત	૨૫
પ્ર. ૩	હિસાબી ધોરણો - ડૉ. યજોશ એમ. દલવાડી, પ્રોફેસર, અનુસ્નાતક બિઝનેસ સ્ટડીઝ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર	૭૭
પ્ર. ૪	ગુણોત્તર વિશ્લેષણ - ડૉ. યજોશ એમ. દલવાડી, પ્રોફેસર, અનુસ્નાતક બિઝનેસ સ્ટડીઝ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર	૧૦૦
પ્ર. ૫	પાધડીનું મૂલ્યાંકન - શ્રી ચિંતન ચાવડા, આસીસ્ટન્ટ પ્રોફેસર, સેંટ સ્ટીફન ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, આણંદ	૧૮૯
પ્ર. ૬	શેરનું મૂલ્યાંકન - શ્રી ચિંતન ચાવડા, આસીસ્ટન્ટ પ્રોફેસર, સેંટ સ્ટીફન ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, આણંદ	૨૩૪
પ્ર. ૭	આગાના દાવાના હિસાબો - ડૉ. વી. એમ. વનાર, પ્રિન્સિપાલ, આણંદ કોમર્સ કોલેજ, આણંદ	૨૯૨
પ્ર. ૮	જનરલ (સામાન્ય) ઇન્સ્યુરન્સ કંપનીઓના હિસાબો - ડૉ. સમીર એમ. વોરા, આસીસ્ટન્ટ પ્રોફેસર, બી.જે.વી.એમ. કોલેજ, વલ્લભ વિદ્યાનગર	૩૦૨

સંપાદક : ડૉ. જ્યેશ કે. પંડ્યા

એસોસિએટ પ્રોફેસર

ડિપાર્ટમેન્ટ ઓફ એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ

એમ. એસ. યુનિવર્સિટી

વડોદરા

પ્રકરણ - ૧

પ્રેફરન્સ શેરમૂડીના નાણાં પરત કરવા

- ૧.૧ પ્રસ્તાવના
- ૧.૨ પ્રેફરન્સ શેર અને રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું ?
- ૧.૩ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાની કંપનીદારા ૨૦૧૩ ની જોગવાઈઓ
- ૧.૪ રીડીમેબલપ્રેફરન્સ શેર અને બોનસ શેર અંગેના અગત્યના મુદ્દા
- ૧.૫ રીડી.પ્રેફરન્સશેર પરત કરવા ભાટેના વહેચણી પાત્ર અને બિન વહેચણી પાત્ર નજીબુનુ વર્ગીકરણ
- ૧.૬ રીડીમેબલપ્રેફરન્સ શેર ના ઉદાહરણો
- ૧.૮ લધુતમ રોકડ સિલક રાખવાની હોથ ત્યારે રોકડ ખાતાનો પરિશિષ્ટ
- ૧.૯ સ્વાધ્યાય

પ્રકરણ - ૧

પ્રેફરન્સ શેરમૂડીના નાણાં પરત કરવા

૧.૧ પ્રસ્તાવના

કંપની ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એમ બે પ્રકારના શેર જાહેર જનતા માટે બહાર પાડે છે. રીડીમેબલ પ્રેફરન્સ શેર એ શેરનો એક પ્રકાર છે જેની આપણે વિગતે ચર્ચા આ પ્રકરણમાં કરવાની છે.

૧.૨ પ્રેફરન્સ શેર અને રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું ?

પ્રેફરન્સ શેર એટલે શું ?

પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હ્યાતી દરમિયાન પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ મેળવવા માટે હક્કદાર છે. તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઈક્વિટી શેર ધરાવતા સભ્યો કરતાં અગ્ર હક્ક ધરાવે છે.

રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું ?

પ્રેફરન્સ શેર ધરાવતા શેરહોલ્ડરને જો પ્રેફરન્સ શેરની રકમ અમૃક નક્કી કરેલા સમય બાદ અથવા ચોંઘ નોટીસ આપ્યા બાદ પરત કરવામાં આવે તેને રીડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે.

કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તેને ઈર રીડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. કંપનીધારા ૨૦૧૩ના અમલ બાદ શેરથી મર્યાદિત કંપની પ્રેફરન્સ શેર પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી.

૧.૩ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાની કંપનીધારા ૨૦૧૩ ની જોગવાઈઓ

રીડીમેબલપ્રેફરન્સશેરના નાણાં પરત કરવાની કંપનીધારા ૨૦૧૩ની જોગવાઈઓ:

૧. કંપનીધારા ૨૦૧૩ પ્રમાણે રીડીમેબલપ્રેફરન્સશેરના નાણાં પરત કરવાની પ્રક્રિયા આઇક્લસ ઓફ એસોસિયેશન પ્રમાણે થશે.
૨. કંપનીધારા ૨૦૧૩ પ્રમાણે શેરથી મર્યાદિત કોઈપણ કંપની ઈર રીડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકે નહીં.
૩. રીડીમેબલપ્રેફરન્સશેર તેના બહાર પાડયા તારીખથી ૨૦ વર્ષમાં પરત કરવાના હોય છે. ફાયનાન્સ અને ઈન્જિનિયરિંગ કંપની માટે આ સમય મર્યાદા ૩૦ વર્ષ સુધી છે.
૪. કંપની ધારાની કલમ ૧૦ પ્રમાણે રીડીમેબલપ્રેફરન્સશેર ૩૦ વર્ષથી વધારે મુદ્તના ના હોવા જોઈએ અને આવા શેર દર વર્ષ ઓછામાં ઓછા ૧૦% પરત કરવાના હોય છે.
૫. રીડીમેબલપ્રેફરન્સશેર પુર્ણ ભરપાઈ હોવા જોઈએ. અર્થાત જો અંશતઃ ભરપાઈ રીડીમેબલપ્રેફરન્સશેર હોય તો બાકીના હસાની રકમ મંગાવી તેને પુર્ણ ભરપાઈ કરવા પડે. જો શેર પર મળવાના બાકી હસા હોય તો આવા શેર પરત કરી શકાય નહીં.
૬. રીડીમેબલપ્રેફરન્સશેરએ માત્ર વહેંચાણી પાત્ર નફામાંથી અથવા નવા શેર બહાર પાડીને પરત કરી શકાય.

૧.૪ રીડીમેબલપ્રેફરન્સ શેર અને બોનસ શેર અંગેના અગત્યના મુદ્દા

અગત્યના મુદ્દાઓ

૧. રીડીમેબલ પ્રેફરન્સ શેર પૂરા ભરપાઈ થયેલા હોય તો ૪ તે પરત કરી શકાય. આ શેર પર હપતો મંગાવવાનો બાકી હોય તો પહેલા હપતો મંગાવવો જોઈએ અને ત્યાર પછી તેને પરત કરવા જોઈએ.

૨. કંપની ડિવિડન્ડ વહેચવા ચોન્ય નફામાંથી અથવા આવા શેર પરત કરવા માટે બહાર પાડેલા નવા શેરના નાણાં માંથી જ રિડી પ્રેફ શેરના નાણાં પરત કરી શકે.
૩. જો દાખલામાં નવા બહાર પાડેલા શેરનો ઉત્ત્લભ કરવામાં આવ્યો ન હોય તો ન.નું ખાતામાંથી શેર પરત કર્યા છે. તેમ માની લેપુ અને તેટલી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવી.
૪. જો રિડીમેબલ પ્રેફ.શેર પ્રીમિયમે પરત કરવાના હોય અને ન.નુ. ખાતાનો ઉપયોગ કરવાનો હોય તો પ્રેફરન્સ શેરની મૂળ કિંમત જેટલી જ રકમ નફામાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવી પ્રીમિયમની રકમ લેવી નહીં.
૫. રિડી. શેર પ્રીમિયમે પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ ન.નુ ખાતે અથવા જામગીરી પ્રીમિયન ખાતે ઉધારી માંડી વાળવી
૬. રિડીમેબલ પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ લખી વાળવા માટે જામીનગીરી પ્રીમિયમની જૂની બાકી તેમજ નવા બહાર પાડેલા જમીનગીરી પ્રીમિયમ ખાતાની બાકીનો ઉપયોગ થઈ શકે.
૭. રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણા પરત કરવામાં આવે ત્યારે નીચેની ત્રણ આમનોંધ થાય છે. તે દ્યાનમાં રાખવું.
 (અ) રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણા પરત કરવામાં આવે.
 રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતું બંધ કરી પ્રેફરન્સ શેરહોલ્ડરો ખાતે લઈ જવું.
 (બ) તેના નાણા પરત કરવાની જોગવાઈ કરવી તે માટે
 (૧) નવા શેર બહાર પાડવાની નોંધ કરવી અને
 (૨) જો નફામાંથી તેના નાણા પરત કરવાના હોય તો જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવી
 (ક) હેવે પ્રેફરન્સ શેરહોલ્ડરોને રકમ ચૂકવી આપવી.

બોનસ શેરઅંગે

૮. જ્યારે કપની બોનસ શેર બહાર પાડે ત્યારે સૌ પ્રથમ બોનસ શેર અંગે જોગવાઈ કરવી પડે આ માટે જે ખાતામાંથી જોગવાઈ કરવાની હોય તે ખાતું ઉધારવામાં આવે છે. દા.ત. સામાન્ય અનામતમાંથી કે નફાનુક્સાન ખાતામાંથી કે મૂડી પરત અનામત ખાતામાંથી બોનસની જોગવાઈ કરવાની હોય તો આ ખાતે જોગવાઈની રકમ ઉધારવામાં આવશે અને શેરહોલ્ડરના બોનસ ખાતે જમા કરવામાં આવે છે.
૯. જો બોનસ શેર બહાર પાડવાના હોય તો બોનસનો ઉપયોગ કરવા માટે શેરહોલ્ડરના બોનસ ખાતે ઉધારવામાં આવે અને શેર બહાર પાડવા માટે ઈકિવટી શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે જો આવા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો સાથે જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ જમા કરવામાં આવે છે.
૧૦. જો બોનસનો ઉપયોગ અશતઃ ભરપાઈ થયેલા શેર ને પૂરા ભરપાઈ થયેલા બનાવવા માટે કરવામાં આવે તો બે આમનોંધ કરવામાં આવે છે.
 (અ) પ્રથમ નોંધમાં શેર પર મળવાની બાકી રકમનો હપ્તો મંગાવવામાં આવે ત્યારે શેર પર છેલ્લા હસાનું ખાતું ઉધારવામાં આવે છે અને ઈકિવટી શેરમૂડી ખાતું જમા કરવામાં આવે છે.
 (બ) બીજું નોંધમાં બોનસમાંથી આ હપ્તો ભરપાઈ કરી દેવામાં આવે છે. તે માટે શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધારવામાં આવે છે અને શેર પર છેલ્લા હસા ખાતે જમા કરવામાં આવે છે.
૧૨. જ્યારે બોનસ શેર અને રિડીમેબલ પ્રેફરન્સ શેરનો સંયુક્ત દાખલો આપવામાં આવ્યો હોય ત્યારે પ્રથમ રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાની આમનોંધ કરવી કારણ કે તેમાં મૂડી પરત અનામત ખાતું ઉભુ કરવામાં આવે છે. જેનો ઉપયોગ બોનસ માટે કરવામાં આવે છે.

૧૩ બોનસ શેર બહાર પાડવા અંગેના ‘સેબી(SEBI)’ના માર્ગદર્શક સૂચનો અનુસાર કંપની હક્કના શેર કે જાહેર ભરણા માટે શેર બહાર પાડે પછી ૧૨ માસ સુધી તે બોનસ શેર બહાર પાડી શકે નહીં.

૧.૫ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટેના વહેંચણી પાત્ર અને બિનવહેંચણી પાત્ર નફાનું વર્ગીકરણ

વહેંચણી પાત્ર નફો નીચે પ્રમાણે છે: <ul style="list-style-type: none"> - નફા નુકશાન ખાતાનો નફો. - સામાન્ય અનામત. - અનામત ભંડોળ. - ડિવિડન્ડ સમતુલા ભંડોળ. - વીમા ભંડોળ/વીમા અનામત. - કારીગર વળતર ભંડોળ. 	બિન-વહેંચણી પાત્ર નફો નીચે પ્રમાણે છે: <ul style="list-style-type: none"> - શેર પ્રીમિયમ - મૂડી અનામત - નોંધણી પહેલાનો નફો - શેર જસ્તીખાતું - પુનઃમૂલ્યાંકન અનામત - સ્થિર મિલકત/રોકાણ વેચાણ નફો - ડિનેન્યર પરતનિધિ
--	--

૧.૬ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરતી વખતે નોંધવામાં આવતી આમનોંધી

૧. જ્યારે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે

(અ) જો રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂળ કિંમતે પરત કરવાના હોય

રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ૬.

તે રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે

(બ) જો રીડીમેબલ પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે

રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ૬.

રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ૬.

તે રીડી પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે.

૨. રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા નાણાંકીય જોગવાઈ કરવામાં આવે ત્યારે

(અ) જો નવા શેર મૂળકિંમતે બહાર પાડવાના હોય.

બેંક ખાતે ૬.

તે શેર મૂડી ખાતે.

તે જામીનગીરી પ્રીમિયમ ખાતે.

(ક) જો નવા શેર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે

બેંક ખાતે ૬.

શેર વટાવ ખાતે ૬.

તે શેર મૂડી ખાતે

(૩) રીડીમેબલ પ્રેફરન્સ શેરનું પ્રીમિયમ માંડીવાળાવા આવે ત્યારે

(અ) જો પ્રીમિયમ સામે પ્રીમિયમ માંડી વાળવાનું હોય ત્યારે

શેર પ્રીમિયમ ખાતે ૬.

તે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે.

(બ) જો ન.નુ. ખાતેથી પ્રીમિયમ માંડીવાળવામાં આવે
ન.નુ. ખાતે ઉ.

તે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે

(૪) જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરના નાણાં ચૂકવવામાં આવે ત્યારે
રીડીમેબલપ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે ઉ.
તે બેંક ખાતે

૧.૭ રીડીમેબલ પ્રેફરન્સ શેરના ઉદાહરણો

ઉદાહરણ ૧. ‘અ’ લિ. કંપની ૧૦૦૦૦ રીડીમેબલ પ્રેફરન્સ શેર ₹ ૧૦૦નો એક એવા ૫% પ્રીમિયમ થી પરત કરવા માગે છે. જરૂરી નફા-નુકશાનનો ઉપયોગ કરી આમનોંધ લખો.

આમનોંધ

ક્રમ	વિગત	ખા. પા.	ઉધાર (₹)	જમા (₹)
૧.	રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે તે રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે	૬.	૧,૦૦,૦૦૦ ૫,૦૦૦	૧,૦૫,૦૦૦
૨.	નફા-નુકશાન ખાતે તે મૂડી પરત અનામત ખાતે	૬.	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦
૩.	નફા-નુકશાનખાતે તે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રિ. ખાતે	૬.	૫,૦૦૦	૫,૦૦૦
૪.	રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે તે બેંક ખાતે	૬.	૧,૦૫,૦૦૦	૧,૦૫,૦૦૦

ઉદાહરણ ૨. એક કંપની ૨૦૦૦ રીડીમેબલ પ્રેફરન્સશેર ₹ ૧૦૦નો એક એવા ૫% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કરે છે. આ હેતુ માટે ૨૦૦૦ નવા ઈક્વિટી શેર ૧૦%ના પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા છે. આવા બધા શેર પર પુરેપુરા નાણાં મળી ગયેલ છે તો આ વ્યવહારોની આમનોંધ લખો.

નોંધ-૧: પરત કરવાની રકમ ₹

$$\text{મૂળ કિંમત} = 2000 \times 100 = 2,00,000$$

$$\text{પ્રીમિયમ} = 2000 \times 5 = \underline{\underline{10,000}}$$

$$\text{કુલ પરત કરવાની} \quad \underline{\underline{2,10,000}}$$

નોંધ-૨: નવી બહાર પાડેલ શેર મૂડી ₹

$$2000 \text{ ઈ.શેર.} \times 100 \text{ ₹} = 2,00,000$$

$$2000 \text{ ઈ.શેર.} \times 10 \text{ પ્રિમિ} = \underline{\underline{20,000}}$$

$$2,20,000$$

જરૂરી આમનોંધ

ક્રમ	વિગત	ખા.પા.	ઉદાર (₹)	જમા (₹)
૧.	રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ૬. રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ૬. તે રીડી પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે (બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેર ૫ % પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું તેના)		૨,૦૦,૦૦૦ ૧૦,૦૦૦	૨,૧૦,૦૦૦
૨.	બેન્ક ખાતે ૬. તે ઈક્વિટી શેર મૂડી ખાતે તે ઈક્વિટી શેર પ્રીમિયમ ખાતે (બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા નવા ઈક્વિટી શેર પ્રીમિયમથી બહાર પાડવા તેના)		૨,૨૦,૦૦૦	૨,૦૦,૦૦૦ ૨૦,૦૦૦
૩.	ઈક્વિટી શેર પ્રીમિયમ ખાતે ૬. તે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે (બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરનું પ્રીમિયમ ઈક્વિટી શેર પ્રીમિયમ ખાતેથી ચૂકવ્યું તેના)		૧૦,૦૦૦	૧૦,૦૦૦
૪.	રીડીમેબલ પ્રેફરન્સ શેર ખાતે ૬. તે બેન્ક ખાતે (બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડરોને નાણાં પરત કર્યા તેના)		૨,૧૦,૦૦૦	૨,૧૦,૦૦૦

ઉદાહરણ ૩. અદિતિ લિમિટેડ ૧,૦૦૦, ૫ % ના રીડીમેબલ પ્રેફરન્સ શેર ₹ ૧૦૦નો એક એવા પૂર્ણ ભરપાઈ થયેલા બહાર પાડે છે. નક્ષા-નુકશાનખાતું ₹ ૭૦,૦૦૦/- ની જમા બાકી દર્શાવે છે. કંપની રીડી પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાનું નક્કી કરે છે. અને આ હેતુ માટે ૪૦૦ નવા ઈક્વિટી શેર ₹ ૧૦૦ નો એક એવા બહાર પાડે છે. કંપનીના ચોપકે જરૂરી આમનોંધ લખો.

જવાબ: અહીં ઉપરોક્ત ઉદાહરણમાં પરત અનામત ખાતે લઈ જવાની રકમ શોધવા માટે નીચેના સુત્રનો ઉપયોગ થશે.

મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ = રીડીમેબલ પ્રેફરન્સ શેરની મૂળ કિંમત - નવા બહાર પાડેલ શેરની મૂળાક્ષિકિમત

અદિતિ લિ.ના ચોપકે આમનોંધ

ક્રમ	વિગત	ખા.પા.	ઉદાર (₹)	જમા (₹)
૧.	૫%ના રીડીમેબલપ્રેફરન્સ શેર મૂડી ખાતે ૬. તે રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે (બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાનું નક્કી કર્યું.)		૧,૦૦,૦૦૦	- ૧,૦૦,૦૦૦
૨.	બેન્ક ખાતે ૬.		૪૦,૦૦૦	

	તે ઈક્સિટી શેર મૂડી ખાતે			૪૦,૦૦૦
(બા.જે. ૪૦૦ ઈક્સિટી શેર રૂ. ૧૦૦ના ભાવે બહાર પાડવા)				
૩. નફા. નુકશાન ખાતે	૬.		૫૦,૦૦૦	
તે મૂડી પરત અનામત ખાતે				૫૦,૦૦૦
(બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરના બાકી નાણાનું આચોજન નફા-નુકશાન ખાતેથી કરવામાં આવ્યું તેના)				
૪. રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે	૬.		૧,૦૦,૦૦૦	
તે બેન્ક ખાતે				૧,૦૦,૦૦૦
(બા.જે. પ્રેફરન્સ શેરહોલ્ડરને નાણા ચૂકવ્યા)				
કુલ સરવાળો			૩,૦૦,૦૦૦	૩,૦૦,૦૦૦

ઉદાહરણ ૪. રાધા લિમિટેડનું તા. ૩૧-૩-૨૦૧૮ના રોજની કાચા સરવૈયાની બાકીઓ નીચે પ્રમાણે છે.

વિગત	ઉધાર	જમા
ઈ.શેર મૂડી (૨૬૦૦ ઈ.શેર રૂ. ૧૦૦નો એક)	-	૨,૬૦,૦૦૦
રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી (૧૦૦૦ શેર રૂ. ૧૦૦નો એક, ૭૫% મંગાવેલી મૂડી)	-	૭૫,૦૦૦
સામાન્ય અનામત		૫૦,૦૦૦
શેર પ્રીમિયમ		૨૫,૦૦૦
બેંક બેલેન્સ		૨૦,૦૦૦

કંપનીએ રીડીમેબલ પ્રેફરન્સ શેર ૫% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. કાચાની જરૂરી જોગવાઈઓનું પાલન કરી રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા તથા નવા કેટલા શેર બહાર પાડવા પડશે તે શોધો અને કંપનીના ચોપડે આમનોંધ લખો.

જવાબ: અહીં પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાની કાચાની જોગવાઈ પ્રમાણે પ્રેફરન્સ શેર પુરેપુરા ભરાયેલા હોવા જોઈએ. એટલે કે પ્રેફરન્સ શેરને પૂર્ણ ભરપાઈ શેર કરવા પડશે. એટલે શેરટીઠ બાકીના ₹ ૨૫/- મંગાવવા પડશે.

હવે સંપૂર્ણ ભરપાઈ થેથ્યા રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટે ₹ ૧,૦૦,૦૦૦ પૂર્ણ ભરાયેલ નાણાંની જરૂરિયાત રહેશે. પણ અહીં દાખલામાં વહેંચણી પાત્ર નહો એટલે કે સામાન્ય અનામત ₹ ૫૦,૦૦૦/- આપેલી છે આમ, નવા ₹ ૪૦,૦૦૦ના શેર બહાર પાડવાની જરૂરિયાત ઉભી થશે.

નવા શેર બહાર પાડવાની રકમ = રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી - મૂડી પરત અનામત ખાતે લઇ ગયાની રકમ

રીડીમેબલપ્રેફરન્સ શેર પરત પ્રિમિયમની રકમ શેર પ્રીમિયમમાંથી પરત કરવાની રહેશે.

રાધા લિમિટેડના ચોપડે આમનોંધ.

ક્રમ	વિગત	ખા.પા.	ઉધાર ₹	જમા ₹
૧.	રીડીમેબલ પ્રેફરન્સ શેરના બાકી હસ્ત ખાતે	૬.	૨૫,૦૦૦	-
	તે રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે			૨૫,૦૦૦

	(બા.જે. આખરી હસાની રકમ લેણી થઈ તેના)			
૨.	બેંક ખાતે	૩.	૨૫,૦૦૦	
	તે રીડીમેબલ પ્રેફરન્સ શેરના આખરી હસા ખાતે		૨૫,૦૦૦	
	(બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરના આખરી હસાની રકમ મળી તેના)			
૩.	રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે	૩.	૧,૦૦,૦૦૦	-
	રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે	૩.	૫,૦૦૦	-
	તે રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે			૧,૦૫,૦૦૦
	(બા. જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાનું નક્કી કર્યું તેના)			
૪.	સામાન્ય અનામત ખાતે	૩.	૫૦,૦૦૦	
	તે મૂડી પરત અનામત ખાતે			૫૦,૦૦૦
	(બા.જે.સામાન્ય અનામતનો ઉપયોગ મૂડી પરત અનામત ખાતે લઈ જવા માટે કર્યો તેના)			
૫.	બેંક ખાતે	૩.	૪૦,૦૦૦	
	તે શેર મૂડી ખાતે			૪૦,૦૦૦
	(બા.જે. ૪૦૦ શેર ડા. ૧૦૦નો એક એવા મૂડી પરત કરવાના હેતુથી બહાર પાડવા)			
૬.	શેર પ્રીમિયમ ખાતે	૩.	૫૦૦૦	
	તે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે			૫૦૦૦
	(બા.જે. શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી રીડીમેબલ પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ પરત કર્યું તેના)			
૭.	રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે	૩.	૧,૦૫,૦૦૦	
	તે બેંક ખાતે			૧,૦૫,૦૦૦
	(બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડરને નાણાં ચૂકવ્યા તેના)			

ઉદાહરણ પ એક કંપનીઓ પોતાના રૂ ૧૦૦ નો એક એવા ૫,૦૦૦ રીડીમેબલ પ્રેફરન્સ શેર ૧૦% પ્રીમિયમથી પરત કરવા માંગે છે. જો ચોપડે જામીનગરી પ્રીમિયમની બાકી રૂ ૧૦,૦૦૦ છે: નફા-નુકશાન જાતાની બાકી રૂ ૧૦૦૦૦૦/- છે. અને નવા શેર પ% ના પ્રીમિયમે બહાર પાડવાના છે. તો કંપની ધારા જોગવાઈના પ્રમાણે કેટલી કિંમતના નવા શેર બહાર પાડવા જોઈએ.

જવાબ:

(અ) સાઢી ગાણતરી મજુબ. અહીં ૫૦૦૦૦૦/- ના રીડીમેબલ પ્રેફરન્સ શેર અને ૧૦% લેખે પ્રીમિયમ રૂ ૫૦,૦૦૦/-મળી કુલ ૫,૫૦૦૦૦/- પરત કરવાના છે. જ્યારે જામીનગરી પ્રીમિયમ ૧૦,૦૦૦/- અને નફા-નુકશાન જાતાની બાકી ૧,૦૦,૦૦૦/- બંને મળી કુલ રૂ ૧,૧૦,૦૦૦/- છે. તેથી બાકીના રૂ ૪,૪૦,૦૦૦/- નવી શેરમૂડી છારા ઉભા કરવાના છે. નવો શેર રૂ ૧૦૦/- નો હોય તેના પર રૂ પ પ્રીમિયમ હોય એટલે કે ૧ શેર બહાર પાડીએ તો રૂ ૧૦૫ મળે. જ્યારે રૂ ૪,૪૦,૦૦૦ મેળવવાના છે. તેથી $4,40,000 \times 1/105 = 4,141$ નવા શેર બહાર પાડવા પડે. આ શેરમાંથી મૂડી પટે $4,141 \times 100 = 4,14,100$ રૂ મળે + પ્રીમિયમ પેટ $4,141 \times 5 = રૂ 20,705$ મળે = કુલ રૂ ૪,૩૪,૮૦૫ મળે.

ઉદાહરણ ક રીડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી રૂ 5,00,000 હોય અને 10% પ્રીમિયમે પરત કરવાની હોય તથા ન.નુ.ખાતે રૂ 1,12,500 હોય અને જામીનગીરી પ્રીમિયમ ખાતામાં રૂ 10,000 બાકી હોય તેવા સંજોગોમાં નવા શેર પદ્ધતિ વટાવે બહાર પાડવા હોય તો ઓછામાં ઓછા કેટલા શેર બહાર પાડવા પડે ?

જવાબ:

રીડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી	રૂ 5,00,000 શેરમૂડી
+ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ	રૂ 40,000
કુલ પરત કરવાની રકમ	રૂ 5,40,000

બાદ: જામીનગીરી પ્રીમિયમ	10,000
ન.નુ.ખાતુ	1,12,500
નવા શેર દ્વારા ઉભી કરવાની રકમ	4,27,500

રૂ 65 મેળવવા 1 શેર બહાર પાડવો પડે તો રૂ 4,27,500 મેળવવા કેટલા શેર બહાર પાડવા પડે.

$$4,27,500 / 65 = 6500 \text{ શેરની સંખ્યા}$$

$$6500 \times 100 \text{ શેરમૂડી } 650,000$$

બાદ: 6500 x 5 વટાવ	=	22,500
		4,27,500

ઉદાહરણ 7 આર.એસ.લિ.નુ 31-3-2018 ના રોજનું પાકું સરવૈચુ નીચે મુજબ છે.

પાકું સરવયું

જવાબદારીઓ	રૂ	મિલકતો	રૂ
ઇક્વિટી શેરમૂડી		કાથમી મિલકતો	3,43,000
રૂ 10 નો એક એવા		રોકડ	1,00,000
30,000 શેર પુરેપૂરા			
ભરપાઈ થયેલા	3,00,000		
રિડી. પ્રેફ. શેરમૂડી			
રૂ 10 ના એક એવા			
8000 શેર પૂરેપૂરા			
ભરપાઈ થયેલા	20,000		
ન.નુ. ખાતે	24,000		
સામાન્ય અનામત	32,000		
જામીનગીરી પ્રીમિયમ	5,000		
			4,43,000
	4,43,000		

કંપની રિડી પ્રેફ.શેર 20% ના પ્રીમિયમથી પરત કરવા માગે છે.

- (૧) જો કપની નવા શેર મૂળ કિંમતે બહાર પાડે તો નવા કેટલા શેર બહાર પાડવા પડે?
- (૨) જો કંપની નવા શેર 10% ના પ્રીમિયમે બહાર પાડે તો નવા કેટલા શેર બહાર પાડવા પડે?

જવાબ:

સાદી ગણતરી કરતા પરત કરવાની રકમ $\text{₹ } 20,000 + 20\% \text{ પરત પ્રીમિયમ } = \text{₹ } 65,000$ છે. જ્યારે મળી શકતી રકમ જામનગરી પ્રીમિયમ 5,000 + ન.નુ ખાતે. 25,000 + સા. આના. ખાતે 32,000 = ₹ 53,000 છે. તેથી ખૂટ્ટી રકમ ₹ 65,000 - 53,000 = ₹ 33,000 ના શેર મૂળ કિંમતે બહાર પાડવા પડે. એટલે કે. 10 નો એક એવા 3,300 શેર બહાર પાડવા પડે.

જો સૂત્ર મૂકીને ગણતરી કરીએ તો

પરત કરવાની કુલ રકમ = જામનગરી પ્રીમિયમ + ન.નુ ખાતે થી + નવી શેરમૂકી

$$\text{₹ } 20,000 + \text{₹ } 15,000 = \text{₹ } 5,000 + (\text{₹ } 25,000 + 32,000) + x$$

$$\therefore \text{₹ } 65,000 = \text{₹ } 53,000 + x$$

$$\therefore x = 33,000$$

જો કંપની નવા શેર 20% પ્રીમિયમે બહાર પાડે તો

રિડીમેબલ પ્રેફરન્સ શેરમૂકી પરત પ્રીમિયમ = જામનગરી પ્રીમિ + ન.નુ ખાતે + નવી શેરમૂકી + પ્રીમિયમનો દર

$$\text{₹ } 20,000 + 15,000 = \text{₹ } 65,000 \text{ પરત કરવાની રકમ}$$

પરત કરવા માટે જરૂરી ભંડોળ

$$\text{નફા-નુકશાન ખાતે} = 25,000$$

$$\text{સામાન્ય અનામત ખાતે} = 32,000$$

$$\begin{aligned} \text{જામનગરી પ્રીમિય ખાતે} &= \underline{\underline{5000}} \\ &= 53,000 \end{aligned}$$

હવે, કુલ રિડીમેબલ પ્રેફરન્સ શેરમૂકી રૂ. ₹ 65,000 ને ઉપલબ્ધ ભંડોળ રૂ 53,000 સામે માંડીવાળવામાં આવે તો, હજુ પણ કંપનીએ રૂ. 33,000ના ભંડોળની જરૂરિયાત રહે છે.

આ ભંડોળ માટે જો નવા ઈડિયટી શેર 10%ના પ્રીમિયમથી બહાર પાડવાના હોથ તો 10નો એક એવા શેર રૂ. 3,300 ના ભાવે બહાર પાડવા પડશે.

$$33,000 / 11 = 3,000 \text{ શેરની સંખ્યા}$$

$$\text{શેરમૂકી } 3,000 \times 10 = 30,000 \text{ અને શેર પ્રીમિયમ } 3,000 \times 1$$

ઉદાહરણ ૮ નીચેના સંજોગોમાં ‘મૂકી પરત અનામત ખાતે’ કેટલી રકમ લઈ જવાશે તે જણાવો.

	રિડીમેબલ પ્રેફ શેર		નવા બહાર પાડવાના શેર
૧.	રૂ ૫,૦૦,૦૦૦ મૂળકિમતે પરત કરવાના	૧.	નવા શેર રૂ ૩,૦૦,૦૦૦ ના બહાર પાડવાના
૨.	રૂ ૫,૦૦,૦૦૦ ના ૫% પ્રીમિયમે પરત કરવાના	૨.	નવ શેર રૂ ૩,૦૦,૦૦૦ ના બહાર પાડવાના

3.	₹ ५,००,००० ना भूग किमते परत	3.	₹ ३,००,००० ना २०% प्रीमियमे
४	₹ ५,००,००० ना भूग किमते परत	४	₹ ३,००,००० ना २०% वटावे
५	₹ ५,००,००० ना ५% प्रीमियमे परत करवाना।	५	₹ ३,००,००० ना शेर १०%ना प्रीमियमे

જવાબ:

(૧) (૨), (૩) અને (૫) માં મૂડી પરત અનામત ખાતે ₹ २,००,००० લઈ જવાશે. કારણ કે દરેકમાં નવા બહાર પાડેલા શેરમાંથી ₹ ३,००,००० મળે છે. પરંતુ (૪) માં ૧૦% વટાવે શેર બહાર પાડતા ₹ ૩૦,૦૦૦ ઓછા % મળે છે. એટલે નવા શેર બહાર પાડવાની ઉપજ ₹ ૨,૭૦,૦૦૦ ગણાય. તેથી મૂડી પરત અનામત ખાતે ₹ ૨,૩૦,૦૦૦ લઈ જવાશે.

રોકડની જોગવાઈ: જ્યારે રીડીમેબલ પ્રેફરન્સ શેરપરત કરવા હોય છે. ત્યારે રોકડા નાણાની જરૂર પડે છે. જો હાથ પર પૂરતાં નાણા ન હોય. તો ખૂટતા નાણાની વ્યવસ્થા કરવી પડે છે. ચાદ રાજો કે કંપની ધારાની કલમ મુજબ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા નાણાની જોગવાઈ કરવાની છે. તે બાબતે રોકડની જોગવાઈ સાથે કઈ સંબંધ નથી.

પૂરતી રોકડ હાથ પર હોય તો પણ કંપની ધારાની કલમ મુજબ (૧) જરૂરી રકમ નફામાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવી પડે અથવા (૨) નવા શેર બહાર પાડીને જોગવાઈ કરવી પડે પૂરતી રોકડ હાથ પર ન હોય અને કંપની રોકાણો વેચી રોકડ ની જોગવાઈ કરે ત્યારે પણ ઉપર મુજબ કપની ધારા કલમ મુજબ નફામાંથી મૂડી પરત અનામત ખાતે રકમ લઈ જવી જ પડે અથવા શેર બહાર પાડવાજ પડે.

જ્યારે દાખલામાં પાંક સરવૈયું આપ્યું ન હોય અથવા રોકડ સિલક વિશે કોઈ ઉલ્લેખ ન હોય ત્યારે એમ માની લેવાનું છે કે કંપની પાસે હાથ પર રોકડ પૂરતી છે. એટલે ફક્ત કલમ મુજબની જ જોગવાઈ કરવી પડે.

જો હાથ પર જરૂરી રોકડ ન હોય તો તેની વ્યવસ્થા કરવા (૧) કાં તો કંપની કોઈ મિલકત વેચે અથવા તો (૨) નવાશેર બહાર પાડે અથવા તો (૩) બેન્કમાંથી લોનની વ્યવસ્થા કરે. કેટલી રોકડની જોગવાઈ કરવી તે જણાવ્યું ન હોય તે નીચે મુજબ રોકડ ખાતું બનાવીને રોકડ રકમ શોધી શકાય.

રોકડ ખાતું

૬.

૭.

વિગત	₹	વિગત	₹
શરૂઆતની સિલક	પ્રેફ.શેરલ્ડરોને પરત
રોકાણોનું વેચાણ	પરત કરવાની રકમ
નવા શેરની ઉપજદ્વારા મેળવવાની રોકડ (આ રકમ શોધવાની હોય છે.)	આખર સિલક

ઉદાહરણ ૬. ‘એચ’ કંપની લિમિટેડનું ૩૧ મી માર્ચ ૨૦૧૮ના રોજનું પાકુસરવૈયુ જીચે પ્રમાણે છે.

મૂડી-ટેવા	₹	મિલકતો-લેણાં	₹
શેરમૂડી: સત્તાવાર: ૨૦,૦૦૦ શેર		કાયમી મિલકતો: જમીન અને મકાન ૭૫,૦૦૦	

દરેક રૂપા નો	૨,૦૦,૦૦૦	સાંચા અને ચંત્રો	૪૫,૦૦૦	૧,૨૦,૦૦૦
ભરાયેલી:				
૧૦,૦૦૦ શેર દરેક ૧૦નો	૧,૦૦,૦૦૦	ચાલુમિલકતો		
૩૦૦૦ ૫% ના રિડીમેબલ		પરચૂરણ દેવાદારો	૩૫,૦૦૦	
પ્રેફરન્સ શેર દરેક રૂ. ૧૦ નો	૩૦,૦૦૦	સ્ટોક	૨૫,૦૦૦	
અનામત અને વધારો:		હાથ પર સિલક	૨૦૦૦૦	
મૂડી અનામત	૨૦,૦૦૦			૮૦,૦૦૦
સામાન્ય અનામત	૧૨,૦૦૦			
ન.નુ. ખાતાની બાકી	૧૫,૦૦૦			
ચાલુ જવાબદીઓ અને				
જોગવાઈઓ:				
પરચૂરણ લેણાદારો	૨૩૦૦૦			
	૨,૦૦,૦૦૦			૨,૦૦,૦૦૦

કંપનીએ નક્કી કર્યું કે દરેક રૂ. ૧૦ નો એવા ૨૦૦૦ ઈક્વિટી શેર રૂ. ૨ ના પ્રીમિયમે રોકડા લઈને આપવા અને ૩,૦૦૦ ૫% ના રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં મૂળકિમતે પાછા આપવા.

આમનોધ આપો અને ઉપરની યોજના તા.૧ લી એપ્રિલ ૨૦૧૮ ના રોજપૂરી કર્યા પછીનું પાકું સરવૈચું બનાવો

જવાબ:

કંપનીના ચોપડામાં આમનોધ

	વિગત	ઉધાર રૂ	જમા રૂ
૧ પ્રીમિયમ ના રીડી.પ્રેફ.શેરમૂડી ખાતે	૬.	૩૦,૦૦૦	
તે પ્રેફ.શેરહોલ્ડર ખાતે		૩૦,૦૦૦	
(બા.જે. ૩૦,૦૦૦ રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના થયા તેના)			
૨ બેન્ક ખાતે	૬.	૨૪,૦૦૦	
તે ઈક્વિટી શેરમૂડી ખાતે		૨૦,૦૦૦	
તે જામીગારી પ્રીમિયમ ખાતે		૪,૦૦૦	
(બા.જે. રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટે નવા ૨૦૦૦ ઈક્વિટી શેર રૂ. ૧૦નો ઓક એવા રૂ. ૨ના પ્રીમિયમે બહાર પાડ્યા)			
૩ ન.નુ.ખાતે	૬.	૧૦,૦૦૦	
તે મૂડી પરત અનામત ખાતે		૧૦,૦૦૦	
(બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરમૂડીના રકમ ની જોગવાઈ નફા.નુકસાન ખાતેથી કરી તેના)			
૪ રીડીમેબલ પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે	૬.	૩૦,૦૦૦	
તે બેન્ક ખાતે		૩૦,૦૦૦	
(બા.જે. રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કર્યા તેના)			

નોંધ :

દ્વારાનમાં રાખો કે ઈક્વિટી શેર બહાર પાડતા ઉપજેલી રકમ રૂ. ૨૦,૦૦૦ ગણીને રૂ. ૧૦,૦૦૦ ન.નુ. ખાતેથી લાવવી. આ હેતુ માટે શેરની ઉપજ પ્રીમિયમ સહિત ગણાય નહીં. એટલે કે રૂ. ૨ પ્રીમિયમ દ્વારાનમાં લીધા

વિના નવા શેરની ઉપજ રૂ 20,000 ગણાવી. અને રૂ 10,000 ન.નું ખાતેથી લાવવા કરણાકે. જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ રિડી.પ્રેફરન્સશેરના નાણાં પરત કરવા થઈ શકે એવો કોઈ ઉત્તેખ કંપની ધારામાં નથી. વળી રિડીમેબલ પ્રેફરન્સ શેરનાં નાણાં વહેચણી પાત્ર નફામાંથી પરત થઈ શકે. જામીનગીરી પ્રીમિયમ વહેચણી પાત્ર નશો નથી તેનો ઉપયોગ રિડીમેબલ પ્રફે. શેરના નાણાં પરત કરવા માટે થઈ શકે નહીં.

તા ૧ લી એપ્રિલ ૨૦૧૮ ના રોજનું એચ કંપની નું પાકુ સરવૈચુ

મૂડી-દેવા	₹	મિલકત-લેણા	₹
શેર થાપણા:			
સત્તાવાર: ૨૦,૦૦૦ ઇક્કિયરી		કાયમી મિલકતો:	
શેર દરેક રૂ ૧૦ નો	૨,૦૦,૦૦૦	જમીન-મકાન ૭૫,૦૦૦	
ભરાયેલી		સાંચા અને પંત્રો ૪૫,૦૦૦	૧,૨૦,૦૦૦
૧૨,૦૦૦ ઇક્કિયરી શેર		ચાલુ મિલકતો લોન અને ઘિરાણા:	
રૂ ૧૦. નો પૂરા ભરાયેલ	૧,૨૦,૦૦૦	પરચુરણ દેવાદાર ૩૫,૦૦૦	
અનામત અને વધારો		સ્ટોક ૨૫,૦૦૦	
મૂડીઅનામત ૨૦૦૦૦		હાથ પર સિલક ૧૪,૦૦૦	૭૪,૦૦૦
જા.પ્રીમિયમ ૪૦૦૦			
મૂડી પરત.અનામત ૧૦,૦૦૦			
સામાન્ય અનામત ૧૨,૦૦૦			
ન-નું ખાતુ ૫,૦૦૦	૫૧,૦૦૦		
ચાલુ જવાબદારી			
પરચુરણ લેણાદાર	૨૩,૦૦૦		
કુલ સરવાળો	૧,૬૪,૦૦૦	કુલ સરવાળો	૧,૬૪,૦૦૦

ઉદાહરણ ૧૦. નીચેના ઉદાહરણ દ્વારા રોકક-બેંક ખાતું બનાવી નવા કેટલા શેર બદાર પાડવા પડશે તે શોધો.
તા.૩૧-૩-૧૮ ના રોજનું તેજસ કંપની લિ.નું પાકુ સરવૈચું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
ઇક્કિયરી શેરમૂડી દ્રેક		કાયમી મિલકતો	૧૬,૫૦,૦૦૦
રૂ ૧૦ નો શેર દીછ રૂ ૮	૬,૦૦,૦૦૦	રોકાણો	૨,૦૦,૦૦૦
ભરપાઈ		બેંક સિલક	૫,૦૦,૦૦૦
૧૨% ના રિડીમેબલ પ્રેફરન્સ		અન્ય ચાલુ મિલકતો	૮,૦૦,૦૦૦
શેર મૂડી, દરેક રૂ ૧૦ નો શેર			
દીછ રૂ ૮ ભરપાઈ	૪,૦૦,૦૦૦		
૧૪% ના રિડી પ્રેફ શેરમૂડી			
દરેક રૂ નો ૧૦ નો પૂરા			
ભરપાઈ	૩,૦૦,૦૦૦		
સામાન્ય અનામત	૧૫,૦૦,૦૦૦		
નફા-નુકશાન ખાતું	૫૦,૦૦૦		
જામીનગીરી પ્રીમિયમ	૫૦,૦૦૦		
લેણાદારો	૨,૫૦,૦૦૦		
	૩૪,૫૦,૦૦૦		૩૪,૫૦,૦૦૦

કંપની ધારાની જરૂરી જોગવાઈઓનું પાલન કર્યા બાદ ૧૨% ની રિડી.પ્રેફ.શેર મૂડી ૧૦% પ્રીમિયમે તથા ૧૪% ની રીડી.પ્રેફ.શેર મૂડી ૫% પ્રીમિયમે પરત કરવાનું નકકી કર્યું રોકાણો રૂ ૧,૫૦,૦૦૦ ની કિંમતે વેચી દીધાં. છેવટની બેંકસિલક રૂ ૫૦,૦૦૦ રાખવાની છે. બંને પ્રકારના રિડી.પ્રેફ.શેર પરત કરવાના હેતુથી જરૂર જણાય તેટલી સંખ્યામાં ૧૫% ના કચુભુલેટીવ પ્રેફરન્સ શેર ૧૦% ના પ્રીમિયમે બહાર પાડવાનું નકકી કર્યું. ત્યારાબાદ તે જ તારીખ અપૂર્ણ ભરાયેતા ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ થયેતા કરવા બોનસ તથા દર બે ઇક્વિટી શેરે એક બોનસ શેર આપવાનો છે.

તેજસ કંપની લિ.ના ચોપડામાં જરૂરી આભનોંધ લખો.

જવાબ:

અહીં જણાવ્યું છે કે છેવટની બેંક સિલક રૂ ૫૦,૦૦૦ રાખવાની છે. જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે $\text{C},૦૦,૦૦૦ + ૮૫,૦૦૦$ પ્રીમિયમ = $\text{C},૮૫,૦૦૦$ ની જરૂર છે. જ્યારે બેંક સિલક ફક્ત રૂ ૫૦,૦૦૦ છે. તેથી બેંક ખાતું બનાવીએ.

બેંક ખાતું

૬.

૭.

વિગત	₹	વિગત	₹
શરૂઆતાની સિલક	૫,૦૦,૦૦૦	રિડીમેબલ પ્રેફ. શેર પરતઃ	
૧૨ % રિડી.પ્રેફ.શેર		૧૨%ના ૫,૦૦,૦૦૦	
પર હપ્તો ૫૦૦૦૦×૨	૧,૦૦,૦૦૦	+ પ્રીમિયમ ૫૦,૦૦૦	
રોકાણોની ઉપજ	૧,૫૦,૦૦૦	૧૪% ના ૩,૦૦,૦૦૦	
નવા શેરની ઉપજ (?)	૧,૮૫,૦૦૦	+ પ્રીમિયમ ૮૫,૦૦૦	
		આખરની સિલક	
		૮૮૫,૦૦૦	
	૮૮૫,૦૦૦	૫૦૦૦૦	
			૮૮૫,૦૦૦

આમ નવા શેર બહાર પાડવાથી રૂ ૧,૮૫,૦૦૦ મળવા જોઈએ. નવો શેર ૧૫% ના કચુભુલેટીવ પ્રેફરન્સ શેર દરેક રૂ નો ૧૦ છે. અને તે ૧૦% પ્રીમિયમે એટલે કે શેરટીચ રૂ ૧ ના પ્રીમિયમે બહાર પાડવાનો છે, તેથી ૧ શેર બહાર પાડતા રૂ ૧૧ મળે, તેથી કુલ શેરની સંખ્યા રૂ ૧,૮૫,૦૦૦ ÷ ૧૧ = ૧૫,૦૦૦ શેર

$$\text{નવા સેરની ઉપજ} = \text{શેરમૂડી} ૧૫,૦૦૦ \times ૧૦ = ૧,૫૦,૦૦૦$$

$$\text{પ્રીમિયમ } ૧૫,૦૦૦ \times ૧ = \frac{૧૫,૦૦૦}{૧,૫૦,૦૦૦}$$

અહીં સૂત્રનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે કંપની પાસે મહેસૂલી નથી (સામાન્ય અનામત ખાતામાં) રૂ ૧૫.૫૦.૦૦૦ છે. તેથી નવા શેર બહાર પાડવાની જરૂર જ નથી. પરંતુ બેંક સિલક રૂ ૫૦.૦૦૦ રાખવા નવા શેર બહાર પાડવા જરૂરી છે

હવે મૂડી પરત અનામત ખાતે:-

$$\text{શેરમૂડી } ૫,૦૦,૦૦૦ + ૩,૦૦,૦૦૦ = ૮,૦૦,૦૦૦$$

$$\text{બાદ: નવા શેરોની કિંમત} = \underline{૧,૫૦,૦૦૦}$$

સામાન્ય અનામત ખાતેથી ₹, 50,000

પરંતુ પ્રીમિયમ ₹ ૫૦,૦૦૦ ની જોગવાઈએ

= ₹ ૫૦,૦૦૦ જામીનગીરી પ્રીમિયમ + ૧૫,૦૦૦ નવું પ્રીમિયમ

કુંપળીના ચોપડે આમલોંધ

	વિગત	ઉધાર ₹	જમા ₹
૧	રિડી.પ્રેફ શેર છેલ્લા હપ્તા ખાતે ઉ તે ૧૨% ના રિડી. પ્રેફ શેર ૫૦,૦૦૦ (બા.જે.પ્રેફ.શેર ના પર છેલ્લો હસો મંગાવ્યો તેના)	૧,૦૦,૦૦	૧,૦૦,૦૦૦
૨	બેંક ખાતે ઉ તે રિડી.પ્રેફ શેર છેલ્લા હપ્તા ખાતે (બા.જે.૧૨% ના રિડી પ્રેફ.શેર ૫૦૦૦૦ પર ₹ ૨ લેખે હસો મળ્યો.)	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦
૩	બેંક ખાતે ઉ નફાનુકસાન ખાતે ઉ તે રોકાણો ખાતે	૧,૫૦,૦૦૦ ૫૦,૦૦૦	૨,૦૦,૦૦૦
૪	૧૨% રિડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી ખાતે ઉ ૧૪% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમીયમ ખાતે ઉ તે પ્રેફરન્સ શેરહોલ્ડરો ખાતે (બા.જે બંને પ્રકારના રિડી. પ્રેફ શેરના નાણાં પ્રીમિયમે ચૂકવવાનાં થયા)	૫૦૦,૦૦૦ ૩,૦૦,૦૦૦ ૫૫,૦૦૦	૮,૫૫,૦૦૦
૫	બેંક ખાતે ઉ તે ૧૫% ની કચું. પ્રેફ શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમીયમ ખાતે (બા.જે.રિડી.પ્રેફ.શેર પરત કરવા નવા ૧૫૦૦૦ કચું. પ્રેફશેર દરેક ₹ ૧૦ નો એવા ૧૦% પ્રીમીયમે બહાર પાડયા.)	૧,૫૫,૦૦૦ ૧,૫૦,૦૦૦ ૧૫,૦૦૦	
૬	સામાન્ય અનામત ખાતે ઉ તે મૂડી પરત અનામત ખાતે (બા.જે.રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રૂમ સા.અ.ખાતેથી મૂડી પરત અના ખાતે લઈ ગયા.)	૫,૫૦,૦૦૦	૫,૫૦,૦૦૦
૭	જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉ તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે (બા.જે. રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ જામીનગીરી પ્રીમિયમ જાતામાંથી કરી)	૫૫,૦૦૦	૫૫,૦૦૦
૮	પ્રેફરન્સ શેરહોલ્ડરો ખાતે ઉ	૮,૫૫,૦૦૦	

	તે બેંક ખાતે (બા.જે રિડીમેન્યુલ પ્રેફરન્સ શેરના નાણાં ચૂકવ્યાં)		૮,૬૫,૦૦૦
૯	મૂડી પરત અનામત ખાતે શ	૫,૦૦,૦૦૦	
	સામાન્ય અનામત ખાતે શ	૧,૦૦,૦૦૦	
	તે શેરહોલ્ડરોના બોનસ ખાતે		૧,૦૦,૦૦૦
	(બા.જે ૧,૦૦,૦૦૦ ઈક્વિટી શેર પર ₹ ૧ ના હપ્તો બોનસ તરીકે ભરપાઈ કરવા અને ૫૦,૦૦૦ ઈ.શેર બોનસ શેર તરીકે આપવા જોગવાઈ કરી)		
૧૦	ઇક્વિટી શેર હપ્તા ખાતે તે ઈક્વિટી શેર મૂડી ખાતે	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦
	(બા.જે. ૧,૦૦,૦૦૦ ઈ. શેર પર ₹ ૧ લેઝે હપ્તા હપ્તો મંગાવ્યો)		
૧૧	શેર હોલ્ડરોના બોનસ ખાતે શ	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦
	તે ઇક્વિટી શેર હપ્તા ખાતે		
	(બા.જે. ૧,૦૦,૦૦૦ ઈ.શેર પર ₹ ૧ નો હપ્તો બોનસમાંથી જમા કર્યા)		
૧૨	શેરહોલ્ડરોના બોનસ ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે	૫,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦
	(બા.જે ૧,૦૦,૦૦૦ ઈ.શેર પર બે શરે ૧ શેર લેઝે ૫૦,૦૦૦ ઈક્વિટી શેર બોનસ શેર તરીકે આપ્યો.)		

નોંધ :

મૂડી પરત અનામતમાંથી ફક્ત પૂર્ણ ભરપાઈ બોનસ શેર આપી શકાય. તેથી અંશતઃ ભરપાઈ શેરને
પૂર્ણ ભરપાઈ કરવા ₹ ૧,૦૦,૦૦૦ સામાન્ય અનામતમાંથી બોનસ આપવા જોગવાઈ કરી છે.

ઉદાહરણ ના ૧૨ એક લિમિટેડ કંપની જેની બહાર પાડેલી શેરમૂડી તા. ૩૧ માર્ચ, ૨૦૧૮ ના રોજ ₹ ૧૦૦ નો
એક એવા ૩,૦૦૦, ૭% ના રિડીમેન્યુલ પ્રેફરન્સ શેર પુરા ભરાયેલા અને ₹ ૧૦૦ નો એક એવા ૧૦,૦૦૦
ઇક્વિટી શેર, શેર ડીછ ₹ ૮૦ ભરાયેલાની બનેલી હતી. તેણે પ્રેફરન્સ શેર, શેર ડીછ ₹ ૧૦ ના પ્રીમિયમે પરત
કરવાનું નકદી કર્યું. કંપનીનું તા. ૩૧મી માર્ચ, ૨૦૧૮ ના રોજનું પાંકું સરવૈયું ₹ ૪,૫૦,૦૦૦નું મહેસૂલી
બંડોળ અને ₹ ૪૨,૫૦૦નું મૂડી અનામત બતાવે છે. પરત કરવા માટે જોઈતી રકમ થોડી નફાની બાકીમાંથી
અને થોડી ₹ ૧૦૦ નો એક એવા ૧૫૦૦, ૧૨% ના કયુમ્યુલેટીવ પ્રેફરન્સ શેર જે ₹ ૨૫ ના પ્રીમિયમે બહાર
પાડવામાં આવ્યા તેની ઉપજમાંથી મેળવવામાં આવી.

તા.૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ કંપનીએ એની સામાન્ય સભામાં હરાવ કર્યો કે એ તારીખે મૂડી
અનામતની પૂરેપૂરી રકમ અને મહેસૂલી બંડોળની થોડી રકમ નીચે પ્રમાણે વાપરવી:

૧. ઇક્વિટી શેરને પૂરા ભરાયેલા બનાવવા શેરડીછ ₹ ૨૦ નું બોનસ આપવું.
૨. ઇક્વિટી શેરહોલ્ડરોને ૪ શેર ડીછ ૧ શેરના પ્રમાણે બોનસ શેર આપવો.

જરૂરી આમનોંધ લખો.

જવાબ:

કંપનીના ચોપડામાં આમનોંધ

	વિગત	ઉદાર ₹	જમા ₹
૧	૭% ના રીડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી ખાતે રીડી. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે તે રીડી. પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે	૬ ૬ ૬	૩,૦૦,૦૦૦ ૩૦૦૦૦ ૩,૩૦,૦૦૦
૨	બેંક ખાતે તે કયુભ્યુલેટિવ પ્રેફરન્સ શેરમૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે	૬	૧,૮૭,૫૦૦ ૧,૫૦,૦૦૦ ૩૭.૫૦૦
૩	જામીનગીરી પ્રીમિયમ ખાતે તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયત ખાતે	૬	૩૦,૦૦૦ ૩૦૦૦૦
૪	મહેસૂલી ભંડોળ ખાતે તે મૂડી પરત અનામત ખાતે	૬	૧,૫૦,૦૦૦ ૧,૫૦,૦૦૦
૫	પ્રેફરન્સ શેરહોલ્ડરો ખાતે તે બેંક ખાતે	૬	૩,૩૦,૦૦૦ ૩,૩૦,૦૦૦
૬	મૂડી પરત અનામત ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે મૂડી અનામત ખાતે મહેસૂલી ભંડોળ ખાતે તે શેર હોલ્ડરોના બોનસ ખાતે	૬ ૬ ૬ ૬	૧,૫૦,૦૦૦ ૭૫૦૦ ૪૨,૫૦૦ ૨,૫૦,૦૦૦ ૪,૫૦,૦૦૦
૭	ઇક્વિટી શેર હપ્તા ખાતે તે ઇક્વિટી શેરમૂડી ખાતે	૬	૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦
૮	શેરહોલ્ડરોના બોનસ ખાતે તે ઇક્વિટી શેરહપ્તા ખાતે	૬	૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦
૯	શેરહોલ્ડરોના બોનસ ખાતે તે ઇક્વિટી શેરમૂડી ખાતે	૬	૨,૫૦,૦૦૦ ૨,૫૦,૦૦૦

ઉદાહરણ ૧૩ તા. ૩૧મી માર્ચ, ૨૦૧૮ ના રોજ વિજય લિમિટેડનું પાકુ સરવૈચ્યું નીચે મુજબ છે.

જવાબદારીઓ	₹	મિલકતો	₹
૨૦૦ ઇક્વિટી શેર દરેક		જમીન	૧,૦૦,૦૦૦
₹ ૧૦૦ નો પૂર્ણ ભરપાઈ	૨,૦૦,૦૦૦	મકાન	૮૨,૫૦૦
૫૦૦, ૭% રીડીમેબલ		સાંચા-યંત્રો	૫૦,૦૦૦
પ્રેફરન્સ શેર દરેક ₹ ૧૦૦		રોકાણો	૩૫,૦૦૦
નો દીઠ ૮૦ નિરપાઈ	૪૦,૦૦૦	સ્ટોક	૫૦,૦૦૦
૫૦૦, ૮% ના રીડીમેબલ		દેવાદારો	૪૫,૦૦૦
પ્રેફરન્સ શેર, દરેક ₹ ૧૦૦		રોકડ સિલક	૨૭,૫૦૦
નો પૂરા ભરપાઈ	૫૦,૦૦૦		

જામીનગીરી પ્રીમિયમ	૫૦,૦૦૦		
સામાન્ય અનામત	૩૭,૫૦૦		
નફા-નુકસાન ખાતું	૧૭,૫૦૦		
લેણાદારો	૪૦,૦૦૦		
	૩,૬૦,૦૦૦		૩,૬૦,૦૦૦

બધાજ પ્રકારના પ્રેફરન્સ શેરને, આ તારીખે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા બાદ ૧૦%ના પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું.

આ હેતુ માટે જરૂરી સંખ્યામાં ઈક્વિટી શેર, દરેક ₹ ૧૦૦ની મૂળાડું બહાર પાડવામાં આવ્યા. ધંધામાં રોકડ સિલાક, ₹ ૧૫,૦૦૦ રાખવાની છે. બધાં જ રોકાણો ₹ ૩૦,૦૦૦માં વેચી દેવામાં આવ્યા. બધા પ્રેફરન્સ શેરહોલ્ડરોને પૂરી રકમ ચૂકવી દેવામાં આવી. કંપનીએ ત્વાર બાદ રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરતા, ઉદ્ભવેલા અનામતનો ઉપયોગ તેના ઈક્વિટી શેરહોલ્ડરોને પુરા ભરપાઈ બોનસ શેર આપવાનું નક્કી કર્યું.

વિજય લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ લખો.

જવાબ:

- કંપની ધારાની કલમ મુજબ જ્યારે પ્રેફરન્સ શેર પરત કરવાના હોય ત્વારે તે શેર અધ્યા ભરપાઈ હોય તો તે શેર ને પૂરા ભરપાઈ કરવા બાકી હપ્તો ભગવાવો પડે તે પૂરે પૂરો ભરપાઈ થયેલા હોવા જોઈએ.
- હાથ પર રોકડ ₹ ૨૭,૫૦૦ છે કે જેમાં રોકાણોના વેચાણાની રકમ ₹ ૩૦,૦૦૦ + ૭% ના પ્રેફરન્સ શેર પર હપ્તાની રકમ ₹ ૧૦,૦૦૦ = ₹ ૫૭,૫૦૦ મળશે, જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરોને ₹ ૧,૧૦,૦૦૦ આપવાના છે. (૭% ના પ્રેફરન્સ સામે ₹ ૫૦,૦૦૦ + ૮% ના પ્રેફરન્સ રેટ ₹ ૫૦,૦૦૦ + ૧૦ પ્રીમિયમ ₹ ૧૦,૦૦૦ અને ₹ ૧૫,૦૦૦ રોકડ હાથ ઉપર રાખવાની છે. તેથી કુલ ₹ ૧,૨૫,૦૦૦ જોઈએ.) જ્યારે હાથ ઉપર રોકડ ₹ ૫૭,૫૦૦ છે તેથી બાકીની રકમના ₹ ૫૭,૫૦૦ ના નવા શેર બહાર પાડવા પડશે. અથવા ઉપરની વિગતો રોકડ ખાતામાં ખૂટી વિગત તરીકે ₹ ૫૭,૫૦૦ રોકડ ખાતામાંથી મેળવવા.
- ₹ ૧,૦૦,૦૦૦ પ્રેફરન્સ શેર પરત કરવાના છે. તે માટે ₹ ૫૭,૫૦૦ ના નવા શેર બહાર પાડવામાં આવશે. તેથી બાકીની રકમ ₹ ૨,૫૦૦નું (પ્રેફરન્સ શેર) મૂડી પરત અનામત ઊભું કરવું પડશે. જે માટે સામાન્ય અનામતમાંથી ₹ ૩૭,૫૦૦ અને બાકીના ₹ ૫,૦૦૦ માટે નફા-નુકસાન ખાતેથી જોગવાઈ કરવી પડશે.

ચાદ રાખો કે પ્રેફરન્સ શેર પરત કરવા જો રોકાણો વેચ્યા તે રોકડ ની જોગવાઈ કરવા માટે છે. તેને કલમમાં જણાવેલ જોગવાઈ સાથે સંબંધ નથી. તેથી કલમ ની જોગવાઈ માટે ₹ ૧,૦૦,૦૦૦ ની જોગવાઈ નફા નુકસાન ખાતેથી અને/અથવા વધારાના શેર બહાર પાડી કરવી ફરજિયાત છે. તેને રોકાણોના વેચાણ સાથે સંબંધ નથી.

ક્રમ	વિગત	ઉધાર ₹	જમા ₹
૧	૭ % ના રિડી પ્રેફરન્સ શેર છેલ્લા હસા ખાતે ઉત્તે ૭% ના રિડી પ્રેફરન્સ શેરમૂડી ખાતે	૧૦,૦૦૦	૧૦,૦૦૦

૨	બેન્ક ખાતે તે ૭% ના રિડી. પ્રેફ. શેર છેલ્લા હપ્તા ખાતે	૩	૧૦,૦૦૦	૧૦,૦૦૦
૩	૭% ની રિડી.પ્રેફ. શેર મૂડી ખાતે ૮% ની રિડી. પ્રેફ. શેર મૂડી ખાતે રીડી. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે તે રીડી. પ્રેફરન્સ શેરહોલ્ડર ખાતે	૩ ૩ ૩	૪૦,૦૦૦ ૪૦,૦૦૦ ૧૦,૦૦૦	૧,૧૦,૦૦૦
૪	બેંક ખાતે ન.નુ.ખાતે તે રોકાણો ખાતે	૩ ૩	૩૦,૦૦૦ ૫,૦૦૦	૩૫,૦૦૦
૫	બેંક ખાતે તે ઈક્વિટી શેરમૂડી ખાતે	૩	૫૭,૫૦૦	૫૭,૫૦૦
૬	સામાન્ય અનામત ખાતે ન.નુ. ખાતે તે મૂડી પરત અનામત ખાતે	૩ ૩	૩૭,૫૦૦ ૫,૦૦૦	૪૨,૫૦૦
૭	ન.નુ. ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે રીડી. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે	૩ ૩	૫,૦૦૦ ૫,૦૦૦	૧૦,૦૦૦
૮	પ્રેકરન્સ શેરહોલ્ડર ખાતે તે બેન્ક ખાતે	૩	૧,૧૦,૦૦૦	૧,૧૦,૦૦૦
૯	મૂડી પરત અનામત ખાતે તે શેરહોલ્ડરના બોનસ ખાતે	૩	૪૨,૫૦૦	૪૨,૫૦૦
૧૦	શેર હોલ્ડરના બોનસ ખાતે તે ઈક્વિટી શેરમૂડી ખાતે	૩	૪૨,૫૦૦	૪૨,૫૦૦

૧.૬ સ્વાદ્યાચ:

૧. રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના નાણાં પરત કરવાં એક કંપની ૧૦૦૦, રીડીમેબલપ્રેફરન્સશેર ₹૧૦૦નો એક એવા પ% પ્રીમિયમથી પરત કરવાનું નકકી કર્યું. જરૂરી રકમ નશો-નુકશાન ખાતેથી લેવી ઉપરોક્ત બાબતની જરૂરી આમનોંધ લખો.
૨. એક કંપનીએ ૧૦૦૦ રીડી પ્રેફરન્સશેર ₹ ૧૦૦નો એક એવા પ% પ્રીમિયમથી પરત કરવાનું નકકી કર્યું. આ હેતુ માટે કંપનીએ નવા ૧૦૦૦ ઈ.શેર ₹ ૧૦૦નો એક એવા ૧૦% પ્રીમિયમથી બહાર પાડે છે, જરૂરી આમનોંધ લખો.
૩. એક કંપની પાસે ૮૦૦૦ રીડી પ્રેફરન્સશેર ₹ ૧૦૦નો એક એવા પુરેપુરા ભરપાઈ થયેલા હતા. કંપનીઓ આ શેર ૭% પ્રીમિયમથી પરત કરવાનું નકકી કર્યું. કંપની પાસે પુરતો નશો નશો-નુકશાન ખાતે હતો પરંતુ શેરની રકમ પરત કરવા નીચેના નવા શેર બહાર પાડયા.
 અ) ૩૦૦૦ ક%ના ડિઝેન્યર ₹ ૧૦૦નો એક ₹ ૧૦૫ના ભાવે.
 બ) ૨૦૦૦, ઈક્વિટી શેર ₹ ૧૦૦નો એક ₹ ૧૦૦નો એક ₹ ૧૧૧ ના ભાવે જરૂરી આમનોંધ લખો.

૪. ધૈર્ય કેમિકલ્સ લીમિટેડનું તા.૩૧-૧૨-૨૦૧૮નું પાંકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવા	₹	મિલકતો-લેણાં	₹
૫૦૦૦ ઈક્સ્પીરી શેર, દરેકના ₹ ૧૦૦ સંપૂર્ણ ભરપાઈ થયેલ ૧૨૫૦, ૫% રિડમેબલ પ્રેફરન્સ શેર,	૫,૦૦,૦૦૦	જમીન	૨,૫૦,૦૦૦
₹ ૧૦૦નો એક, ₹ ૮૦ ભરપાઈ થયેલ ૧૨૫૦, ૧૦% રિડમેબલ પ્રેફરન્સ શેર, દરેકના ₹૧૦૦ સંપૂર્ણ ભરપાઈ થયેલ		મકાન	૨,૧૨,૫૦૦
શેર પ્રીમિયમ		ચંત્રો	૧,૨૫,૦૦૦
સામાન્ય અનામત	૧,૦૦,૦૦૦	સ્ટોક	૧,૨૫,૦૦૦
નફા-નુકશાન	૧,૨૫,૦૦૦	દેવાદારો	૧,૧૨,૫૦૦
લેણાદારો	૧,૦૦,૦૦૦		
	૬,૭૫,૦૦૦		૬,૭૫,૦૦૦

આ દિવસે કંપનીએ બને પ્રકારનાં પ્રેફરન્સ શેર ૧૦% પ્રીમિયમથી, કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા બાદ પરત કરવાનું નક્કી કર્યું. આ માટે જરૂરી ઈક્સ્પીરી શેર દરેક ₹ ૧૦૦નો મૂળ કિંમતે બહાર પાડયા. કંપની ₹ ૩૭,૫૦૦ની રોકડ સિલક ધંધામાં રાખી. તમામ રોકાણો ₹ ૭૫,૦૦૦માં વેરચા. તમામ પ્રેફરન્સ શેર પૂરા ભરપાઈ છે.

કંપનીએ મૂડી પરત અનામત પૂરા ભરપાઈ બોનસ શેરમાં વાપરવાનું નક્કી કર્યું. જરૂરી આમનોંધ પસાર કરો અને પાંકું સરવૈયું તૈયાર કરો.
(સ.પ.યુ. એપ્રિલ-૨૦૧૪ પર આધારીત)

૫. શિવમ લીમિટેડનું તા.૩૧-૧૨-૨૦૧૮ના રોજનું પાંકું સરવૈયું.

મૂડી-દેવા	₹	મિલકતો-લેણાં	₹
ઇક્સ્પીરી શેરમૂડી દરેક ₹ ૧૦નો શેરટીચ ૩૮ ભરપાઈ	૬,૦૦,૦૦૦	કાયમી મિલકતો	૧૬,૫૦,૦૦૦
૧૨%ના રીડમેબલપ્રેફરન્સ શેરમૂડી દરેક ૩૧૦નો શેર દીઠ ₹ ૮ ભરપાઈ	૪,૦૦,૦૦૦	રોકાણો	૨,૦૦,૦૦૦
૧૪% રીડમેબલ પ્રેફરન્સ શેરમૂડી દરેક ૩૧૦નો પૂરા ભરપાઈ	૩,૦૦,૦૦૦	બેંક સિલક	૫,૦૦,૦૦૦
સામાન્ય અનામત	૧૫,૦૦,૦૦૦	અન્ય ચાલુ મિલકતો	૮,૦૦,૦૦૦
નફાનુકશાન ખાતું	૫૦,૦૦૦		
શેર પ્રીમિયમ	૫૦,૦૦૦		
લેણાદારો	૨,૫૦,૦૦૦		
	૩૪,૫૦,૦૦૦		૩૪,૫૦,૦૦૦

કંપની ધારાની જરૂરી જોગવાઈઓનું પાલન કર્યા બાદ ૧૨% રીડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી ૧૦%ના પ્રીમિયમે તથા ૧૪%ની રીડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી ૫% ના પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું. રોકાણો રૂ ૧,૫૦,૦૦૦ની કિંમતે વેચી દીધા છેવટની બેન્ક સીલક રૂ ૫૦,૦૦૦ રાખવાની છે. બન્ને પ્રકારના રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના હેતુથી જરૂર જાણાય તેટલી સંખ્યામાં નવા પ્રેફરન્સ શેર ૧૦% ના પ્રીમિયમ બહાર પાડવાનું નક્કી કર્યું

ત્યારબાદ તેજ તારીખે અપૂર્ણ ભરાયેલ ઈક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ થયેલા કરવા બોનસ તથા દર બે ઈક્વિટી શેરે એક બોનસ શેર આપવાનો છે. જરૂરી આમનોંધ લખી પાકું સરવૈયું તૈયાર કરો.

(સ.પ.યુ એપ્રિલ-૨૦૧૩ પર આધારીત)

૬. નીચે આપેલ માહિતી પરથી જરૂરી નવા ઈક્વિટી શેર રૂ ૧૦/- લેખે બહાર પાડે છે તે શોધો અને પ્રેફરન્સ શેરહોલ્ડરને નાણાં પરત કરવાની જરૂરી આમ નોંધ લખો.

૧. ૧૦% પ્રેફરન્સ શેર પરત કરવાની મૂડી ₹ ૩,૦૦,૦૦૦
૨. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ૧૦%.
૩. નીચે મુજબની બાકીઓ પાકા સરવૈયામાં હતી,

નફા-નુકશાન ખાતું(જમા બાકી)	₹ ૫૦,૦૦૦
શેર પ્રીમિયમ	₹ ૧૦,૦૦૦

કંપનીના નવા ઈક્વિટી શેર પરથી ૫%ના પ્રીમિયમથી બહાર પાડે છે. (સ.પ.યુ એપ્રિલ-૨૦૧૫ પર આધારીત)

૭. HP લિ. નું તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

જવાબદારીઓ	₹	મિલકતો	₹
રૂ. ૧૦૦/-નો એક એવા ૨૦૦૦ ઈક્વિટી શેર	૨,૦૦,૦૦૦	જમીન	૧,૦૦,૦૦૦
રૂ. ૧૦૦/-નો એક એવા ૫૦૦ ૭%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર, રૂ ૮૦/- ભરપાઈ થયેલ,	૪૦,૦૦૦	મકાન	૮૨,૫૦૦
રૂ. ૧૦૦/-નો એક એવા ૫૦૦ ૮%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર, સંપૂર્ણ ભરપાઈ થયેલ	૫૦,૦૦૦	રોકાણો	૩૫,૦૦૦
શેર-પ્રીમિયમ	૫,૦૦૦	સ્ટોક	૩૫,૦૦૦
સામાન્ય અનામત	૩૭,૫૦૦	દેવાદારો	૫૦,૦૦૦
નફા-નુકશાન ખાતું	૧૭,૫૦૦	રોકડ	૨૭,૫૦૦
લેણાદારો	૪૦,૦૦૦		
	૩,૬૦,૦૦૦		૩,૬૦,૦૦૦

આ દિવસે કંપનીએ બન્ને પ્રકારનાં પ્રેફરન્સ શેર ૧૦% પ્રીમિયમથી કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા બાદ પરત કરવાનું નક્કી કર્યું. આ માટે જરૂરી ઈક્વિટી શેર દરેક રૂ ૧૦૦ની મૂળાંકિંગને બહાર પાડ્યા. કંપની રૂ ૧૫,૦૦૦ની રોકડ સિલક ધંધામાં રાખે છે. તમામ રોકાણો રૂ ૩૦,૦૦૦માં વેચ્યાં. તમામ પ્રેફરન્સ શેર પૂરા ભરપાઈ છે.

કંપનીએ મૂડી પરત અનામત પૂરા ભરપાઈ બોનસ શેરમાં વાપરવાનું નક્કી કર્યું.

જરૂરી આમનોંધ પસાર કરી અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં પરત કર્યા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો.

(સ.પ.યુ-૨૦૧૫ પર આધારીત)

૮. દધની લિમિટેડનું તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજ પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવા	₹	મિલકતો-લેણાં	₹
૫,૦૦૦ ઇક્વિટી શેર ₹ ૧૦નો તેવા પૂરા ભરપાઈ	૫,૦૦,૦૦૦	સ્ટોક	૨,૫૦,૦૦૦
૨,૦૦૦, ૧૦% પ્રેફરન્સ શેર દટેક ₹ ૧૦૦નો તેવા પૂરા ભરપાઈ ₹૨૦૦૦, ૮% પ્રેફરન્સ શેર	૨,૦૦,૦૦૦	દેવાદારો	૧,૫૦,૦૦૦
દટેક ₹ ૧૦૦ના તેવા ₹ ૮૦ ભરપાઈ	૧,૫૦,૦૦૦	રોકડ અને બેન્ક	૨,૧૦,૦૦૦
શેર-પ્રીમિયમ	૫,૦૦૦	સાંચા અને ચંત્રો	૫,૦૦,૦૦૦
સામાન્ય અનામત	૧,૦૦,૦૦૦	રોકાણો	૧,૦૦,૦૦૦
નફ-નુકશાન ખાતું	૧,૦૦,૦૦૦		
લેણાદારો	૧,૦૦,૦૦૦		
	૧૨,૧૦,૦૦૦		૧૨,૧૦,૦૦૦

૧. એપ્રિલ ૨૦૧૮ના રોજ કંપનીએ ૧૦%ના પ્રેફરન્સ શેર ૧૦% પ્રીમિયમથી પરત કર્યા. આ માટે કંપનીએ નીચે મુજબ કાર્યવાહી કરી.

- (૧) રોકાણો ₹ ૮૦,૦૦૦માં વેચ્યાં.
- (૨) સાચા ચંત્રો જેની ઘટતી જતી બાકી ₹ ૧,૫૦,૦૦૦ છે. તે ₹ ૧,૨૦,૦૦૦ માં વેચ્યાં.
- (૩) બેંકમાંથી વાર્ષિક ૧૨%ના દરે ₹ ૧,૦૦,૦૦૦ લોન લીધી.
- (૪) સામાન્ય આનામતમાંથી ઓછામાં ઓછી રકમ વાપરો.
- (૫) નવાં ₹ ૫,૦૦૦ ઇક્વિટી શેર, દટેક ₹ ૧૦નો એક સંપૂર્ણ ભરપાઈ થયેલ બહાર પાડ્યા.

(સ.પ.યુ એપ્રિલ-૨૦૧૪ પર આધારીત)

૯. બોનસ શેર બહાર પાડવા માટેના પ્રાસિ સ્થાનો લખો.

૧૦. પ્રેફરન્સ શેર પરત કરવા અંગેની કંપનીધારાની જોગવાઈઓની ચર્ચા કરો.

૧૧. સીપલા લિમિટેડનું તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતુ.

જવાબદારીઓ	₹	મિલકતો	₹
બહાર પાડેલી ભરાયેલી અને વસુલ આવેલી મૂડી:		સ્થિર (કાયમી) મિલકતો	૪૫,૦૦,૦૦૦
૧૨% ના ૧૦૦૦૦ રિડિમેબલ પ્રેફરન્સ શેર ₹ ૧૦૦/-નો પૂર્ણ ભરપાઈ થયેલ ૩૦૦૦૦૦ ઇક્વિટી શેર ₹ ૧૦/-નો એક તેવા	૧૦,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦		
અનામત અને વધારો:		રોકાણો	૧,૫૦,૦૦૦
શેર-પ્રીમિયમ	૧,૦૦,૦૦૦	અન્ય ચાલુ મિલકતો	૧૫,૦૦,૦૦૦
સામાન્ય અનામત	૫,૦૦,૦૦૦	બેંક બાકી	૧૩,૫૦,૦૦૦
ચાલુ જવાબદારી	૨૮,૦૦,૦૦૦		
	૭૫,૦૦,૦૦૦		૭૫,૦૦,૦૦૦

તારીખ: ૧-૦૪-૨૦૧૮ના રોજ ૧૨%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર ૧૦% પ્રીમિયમ સહિત પરત કરવાના છે. કંપની પાસે પ્રેફરન્સ શેર પરત કરવા માટે પૂર્તી અનામત ન હોવાથી કંપનીએ જરૂરી એક એવા ૧૩%ના કચુભ્યુલેટિવ પ્રેફરન્સ શેર દરેક રૂ ૧૦૦નો એક એવા મૂળ કિંમતે બહાર પાડવા. બધા જ શેર વસુલ આવેલા અને પૂર્ણ ભરપાઈ થયેલ છે.

રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કર્યા પછી કંપનીએ દર પાંચ ધાક્યિટી શેર દીઠ એક ધાક્યિટી શેર રૂ ૧૦નો પૂર્ણ ભરપાઈ થયેલ બોનસ તરીકે આપવાનો ઢરાવ કર્યો.

ઉપરના વ્યવહારો નોંધવા માટે જરૂરી આમનોંધ લખો અને પ્રેફરન્સ શેર પરત કર્યા પછીનું પાકું સરવૈયું અનાવો.

(સ.પ.ચુ એપ્રિલ-૨૦૧૨ પર આધારીત)

૧૨. આર કે. લિમિટેડનું તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

જવાબદારીઓ	₹	મિલકતો	₹
૮% ના રિડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી, રૂ. ૧૦૦/-નો એક એવા રૂ ૮૦ ભરપાઈ થયેલ શેર	૨,૨૫,૦૦૦	પાદડી	૧,૫૦,૦૦૦
ધાક્યિટી શેર રૂ ૧૦/-નો એક એવા પૂર્ણ ભરપાઈ શેર	૫,૦૦,૦૦૦	જમીન- મકાન	૩,૪૦,૦૦૦
અનામતો	૭,૫૦,૦૦૦	સાંચા-ચંત્રો	૪,૫૦,૦૦૦
૫ %ના ડિલેન્યર	૧,૫૦,૦૦૦	ટેવાદારો	૨,૦૦,૦૦૦
લેણાદારો	૫૦,૦૦૦	સ્ટોક	૩,૦૦,૦૦૦
		રોકડ - બેંક સિલિક	૨,૨૫,૦૦૦
	૧૫,૭૫,૦૦૦		૧૫,૭૫,૦૦૦

તારીખ: ૦૧-૦૪-૨૦૧૮ના રોજ સંચાલક મદલે નીચે મુજબ નિર્ણયો લીધા.

- ૧) ધાક્યિટી શેરધારકોને ૧૦% ડિવિડન્ડ ચુકવું. ડિવિડન્ડ કર દ્યાનાં લેવાનો નથી.
- ૨) કાનુની જોગાવાઈઓનું પાલન કર્યા પછી રિડીમેબલ પ્રેફરન્સ શેરનાં નાણા પ૫% પ્રીમિયમ સહિત પરત કરવા.
- ૩) ડિલેન્યરના નાણા ૩%ના પ્રીમિયમ સહિત પરત કરવા.
- ૪) રોકડ-બેંક ખાતાની બાકી રૂ ૨૫૦૦૦ જાળવવી અને માત્ર જરૂરી સંખ્યામાં રૂ ૧૦નો એક એવા નવા ધાક્યિટી શેર ૧૦% પ્રીમિયમથી બહાર પાડવા.
- ૫) વર્તમાન શેરધારકોને દર બે શેરે એક શેર બોનસ તરીકે આપવા.

ઉપર મુજબનાં નિર્ણયોની અસર આપ્યા પછીનું પાકું સરવૈયું બનાવો અને જરૂરી આમનોંધ લખો.

(સ.પ. ચુ એપ્રિલ-૨૦૧૫ પર આધારીત)

૧૩. “શક્તિ” લિ. નું તારીખ: ૩૧-૧૨-૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
૨,૦૦૦ ધાક્યિટી શેર દરેક રૂ ૧૦૦નો પૂર્ણ ભરપાઈ	૨,૦૦,૦૦૦	જમીન	૧,૦૦,૦૦૦
૫૦૦, ૭% ના રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂ ૧૦/-	૪૦,૦૦૦	મકાન	૮૨,૫૦૦

નો શેરટીંડ રૂ ૮૦ ભરપાઈ			
૫૦૦, ૮% ના રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂ ૧૦૦નો પૂરા ભરપાઈ	૫૦,૦૦૦	સાંચા-યંત્રો	૩૫,૦૦૦
શેર પ્રીમિયમ	૫,૦૦૦	રોકાણો	૫૦,૦૦૦
સામાન્ય અનામત	૩૭,૫૦૦	દેવાદારો	૪૫,૦૦૦
નફા-નુકશાન ખાતુ	૧૭,૫૦૦	રોકડ	૨૭,૫૦૦
લેણદારો	૪૦,૦૦૦		
	<u>૩,૬૦,૦૦૦</u>		<u>૩,૬૦,૦૦૦</u>

બધાજ પ્રકારના પ્રેફરન્સ શેરને તે જ તારીખે કંપની ધારાની જોગાવાઈઓનું પાલન કર્યા બાદ ૧૦% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું. આ હેતુ માટે જરૂરી સંખ્યામાં ઈડિયટી શેર દરેક રૂ ૧૦૦ની મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા. ધંધામાં રોકડ સિલક રૂ ૧૫,૦૦૦ રાખવાની છે. બધાજ રોકાણો રૂ ૩૦,૦૦૦માં વેચી દેવામાં આવ્યા. બધા પ્રેફરન્સ શેરહોલ્ડરોને પુરી રકમ ચુકવી દેવામાં આવી. કંપનીએ ત્યારબાદ રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરતા ઉદભવેલ અનામતનો ઉપયોગ તેના ઈડિયટી શેરહોલ્ડરોને પુરા ભરપાઈ બોનસ શેર આપવા કરવાનું નક્કી કર્યું. જરૂરી આમનોંધ લખી પાકું સરવૈયું તૈયાર કરો.

(સ.પ.શુ એપ્રિલ-૨૦૧૫ પર આધારીત)

૧૪. એક કંપની તેની રિડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી રૂ ૫,૦૦,૦૦૦, ૧૦% પ્રીમિયમે પરત કરવા દીઠ્છે છે. જો નફા-નુકશાન ખાતે (જમા બાકી) રૂ ૧,૧૨,૫૦૦ હોય અને શેર પ્રીમિયમ ખાતામા રૂ ૧૦,૦૦૦ લાકી હોય અને રૂ ૧૦નો એક એવા નવા શેર પ્રકાર વટાવે બહાર પાડવા હોય તો ઓછામાં ઓછા કેટલા શેર બહાર પાડવા પડે?

૧૫. રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે કંપની ધારાની જોગાવાઈઓની ચર્ચા કરો.

૧૬. બોનસ શેર ક્યા ક્યા સાધનોમાંથી આપી શકાય ?

(સ.પ.શુ એપ્રિલ-૨૦૧૫ પર આધારીત)

|

પ્રકરણ - ૨

ડિલેન્યર બહાર પાડવા અને પરત કરવા

- ૨.૧ પ્રસ્તાવના
- ૨.૨ ડિલેન્યર એટલે શું ?
- ૨.૩ ડિલેન્યર અંગે અગત્યના મુદ્દા
- ૨.૪ ડિલેન્યરના પ્રકારો
- ૨.૫ ડિલેન્યર બહાર પાડવા અંગેની વિધિ
- ૨.૬ ડિલેન્યર બહાર પાડવા અંગેની હિસાબી અસરો
- ૨.૭ શેર-ડિલેન્યર વચ્ચેનો તફાવત
- ૨.૮ ડિલેન્યર પર વ્યાજ
- ૨.૯ ડિલેન્યરના નાણાં પરત કરવા અંગે
- ૨.૧૦ પરત કરી શકાય તેવા ડિલેન્યર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો
- ૨.૧૧ જ્યારે ડિલેન્યર મૂળકિમતે કે પ્રિમીયમથી કે વટાવથી બહાર પાડયા હોય અને આ ડિલેન્યર પ્રિમીયમથી પરત કરવાના હોય ત્થારે
- ૨.૧૨ કંપનીના પાકા સાખ્યેયામાં સ્થાન
- ૨.૧૩ ડિલેન્યર વટાવ માંડીવાળવો
- ૨.૧૪ ડિલેન્યર પરત કરવાની પદ્ધતિઓ
- ૨.૧૫ ઝૃપાંતરપાત્ર ડિલેન્યર પરત
- ૨.૧૬ સ્વાધ્યાય

પ્રકરણ - ૨

ડિબેન્ચર બહાર પાડવા અને પરત કરવા

૨.૧ પ્રસ્તાવના

સામાન્ય રીતે કંપની લાંબાગાળાના ભંડોળ (ફેન)ની જરૂરિયાત શેરમૂડી બહાર પાડીને મેળવે છે. કેટલીકવાર કંપનીને શેરમૂડી ઉપરાંત વધારે ભંડોળ (રકમ)ની જરૂરિયાત હોય તો આ ભંડોળ લોન કે ઉછીની રકમ દ્વારા મેળવે છે. નાણાકીય સંદર્ભના ઘરાવતી કંપનીઓ લાંબા ગાળાની લોન બેન્ક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે છે. ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ઘિરાણ મેળવવાના બદલે અથવા તે ઉપરાંત કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ મેળવી શકે છે. આવી જામીનગીરી (સિક્યોરીટી) ડિબેન્ચર કે બોન્ડ તરીકે પ્રચલિત છે.

ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાની ગર્ભિત સર્તા છે. આ ગર્ભિત સર્તાના આધારે કંપની જાહેર જનતા પાસેથી આ રીતે લાંબા ગાળાના નાણાં ઉછીના મેળવે છે. આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતાં દસ્તાવેજ રોકાણકારને આપે છે. આ દસ્તાવેજ (Certificate)ને ડિબેન્ચર (Debenture) કહેવામાં આવે છે.

જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓને ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર (Debenture holder) કહેવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક ગણાતા નથી.

૨.૨ ડિબેન્ચર એટલે શું ?

ડિબેન્ચર એ કંપનીના દેશું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ દર્શાવતો દસ્તાવેજ છે, જે કંપનીની સામાન્ય મહોર (Seal) સાથે બહાર પાડવામાં આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલી શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપશે, જે કંપની માટે ખર્ચ થશે અને ડિબેન્ચરહોલ્ડર માટે આવક થશે. આ ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલ નાણાં ભવિષ્યમાં ડિબેન્ચરહોલ્ડરને પરત કરશે.

કંપની ડિબેન્ચરહોલ્ડરને જે દસ્તાવેજ (સાઇટિક્યુન્ટ) આપે છે કે જેમાં- ડિબેન્ચર હોલ્ડરના નામ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, ડિબેન્ચરને આપેલ કમાંક નંબર, વ્યાજની ચૂકવણીનો દર, વ્યાજ ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં કાચારે પરત કરવામાં આવશે તેનો ઉદ્દેશ કરવામાં આવે છે.

વર્તમાન સંજોગોમાં ડિબેન્ચરનો દસ્તાવેજ ડિબેન્ચરહોલ્ડરને બૌતિક સ્પર્ધે (Physical copy) આપવાના બદલે વીજાણું નોંધ (Dematerialization) સ્પર્ધે આપવામાં આવે છે. એટલે કે ડિબેન્ચરની ખરીદી ડિબેન્ચર હોલ્ડરના ડિમેટ ખાતામાં રીધી જમા થઈ જાય છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને મંજૂરીપત્ર દ્વારા તેમના કેટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે તેની સંખ્યા અને રકમ તેમજ ડિબેન્ચર અંગેની શરતોની જાણ કરવામાં આવે છે.

૨.૩ ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા

- (૧) ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ (સાઇટિક્યુન્ટ) છે એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર.
- (૨) ડિબેન્ચર ચોક્કસ વ્યાજદર ઘરાવતી એક જામીનગીરી છે. જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું પડે છે. કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તોપણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે.

- (૩) ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. દા.ત. ડિબેન્ચર પર ૮% લેખે વાર્ષિક વ્યાજ આપવાનું હોય તો તે ૮% ના ડિબેન્ચર તરીકે ઓળખાશે કે લખારો.
- (૪) ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદ્દત માટે બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદ્દતના અંતે ડિબેન્ચરનાં નાણાં પરત કરવામાં આવે છે.
- (૫) કંપની ધારા, ૨૦૧૩ મુજબ કોઈપણ કંપની ૧૦ વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહિં. જો કે જે કંપની ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે ૧૦ વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકાય. પરંતુ વધુમાં વધુ ૩૦ વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય.
- (૬) ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે. મિલકતો પરનો બોજ એટલે કે ગીરો અધિકાર.
- (૭) ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેરબજારમાં નોદાયેલ (Listed) ડિબેન્ચરનું ખરીદ-વેચાણ શેરબજારમાં (સ્ટોક ઓક્સચેન્ઝમાં) કરવામાં આવે છે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મુલાકીમત જેટલી કે તેથી ઓછી કે વધુ હોઈ શકે છે.
- (૮) ડિબેન્ચર, ભરણાંની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં ઝ્રાંતર કરી શકાય છે.
- (૯) ડિબેન્ચર કંપનીના પાકા સરવૈચામાં ‘ધીક્ષિયટી અને દેવાં’ તરીકે ‘બિન-ચાતુ દેવાં’ ના શીર્ષક હેઠળ લાંબાગાળાના દેવાં તરીકે દર્શાવવામાં આવે છે.
- (૧૦) ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈપણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી.
- (૧૧) જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હસાની રકમ ન ભરે, તો ડિબેન્ચર જસ કરી શકતા નથી.
- (૧૨) કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને, શેરહોલ્ડરને ચુકવણી કરતાં પહેલાં વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવે છે.

૨.૪ ડિબેન્ચરના પ્રકાશો

ડિબેન્ચરનું વર્ગીક્રણ નીચે મુજબ કરવામાં આવે છે.

(અ) જામીનગીરીના આધારે :

(૧) તારણવાળાં કે ગીરવી ડિબેન્ચર

આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની અમુક કે બધી મિલકતો ગીરવે મુકવામાં આવે છે. એટલે કે મિલકતો પર બોજ ઉભો કરવામાં આવે છે. આ બોજ બે પ્રકારના હોય છે. : સ્થિર બોજ (Fixed Charge) જેમાં કંપનીની અમુક મિલકતોજ ગીરવે મુકવામાં આવે છે. અને અસ્થિર બોજ કે તરતો બોજ (Floating Charge) જેમાં સામાન્ય કંપનીની બધી જ મિલકતો ગીરવે મુકવામાં આવે છે. જો કંપની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ચુકવે નહિ તો આ મિલકતો વેચીને ડિબેન્ચર હોલ્ડર્સને તેમનાં નાણાં ચૂકવી દેવામાં આવે છે.

જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર પ્રથમ રકમનો ગીરો અધિકાર હોય, તેને પ્રથમ બોજના ડિબેન્ચર (First mortgage Debentures) કહેવાય છે.

જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર બીજા રકમનો ગીરો અધિકાર હોય (પ્રથમ રકમના બોજવાળા ડિબેન્ચર પછી) તેને દ્વિતીય બોજના ડિબેન્ચર (Second Mortgage Debentures) કહેવાય છે.

(૨) તારણવગરના કે સાદા ડિબેન્ચર

કંપનીની કોઈપણ મિલકત ગીરવે મુક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ ડિબેન્ચર રોકાણકારની વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચરને બિનસલામત લેણાદારો ગણવામાં આવે છે.

(બ) ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે

(૧) રણ્ણિસ્ટર્ડ ડિબેન્ચર

કંપની ડિબેન્ચર હોલ્ડર્સનું રજુસ્ટર રાખે છે. જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, સરનામું, તેમજ અન્ય વિગતો નોંધવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે ચોંઘ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપનીના રજુસ્ટરમાં નોંધણી કરાવવી જરૂરી છે. કંપનીના રજુસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેને જ વ્યાજ અને ડિબેન્ચરની મુળ રકમ મળશે.

(૨) બેરર ડિબેન્ચર

આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવા કંપનીના ચોપડે કોઈ નોંધણી કે વિધિ કરવાની હોતી નથી. ખરીદનારે નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લેવાનાં હોય છે. આમ, બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવાં છે, જેની સાદા હસ્તાંતર દ્વારા ફેરબદલી થઈ શકે છે. આવા ડિબેન્ચર જેના કબજામાં હોય તે તેનો અધિકાર ધરાવે છે. આ પ્રકારના ડિબેન્ચર પર નિયત મુદ્દતે ચૂકવવાપાત્ર થતા વ્યાજ માટે ડિબેન્ચર સાઠીફિકેટની સાથે વ્યાજની કુપનો આપવામાં આવે છે. આવી દરેક કુપન ડિબેન્ચર પરના ચૂકવવાપાત્ર વ્યાજની તારીખ દર્શાવતી ચેક કે ઓર્ડર જેવી હોય છે. જેના પર ડિબેન્ચર હોલ્ડર કંપનીએ નિર્દેશ કરેલી બેંક દ્વારા વ્યાજ મેળવી શકે છે.

(ક) પરત કરવાની શરત મુજબ

(૧) પરત કરવા પાત્ર કે રીડિમેબલ ડિબેન્ચર

જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદ્દત પછી પરત કરી શકાય તેવી શરતે બહાર પાડવામાં આવે છે. જેણી રીડિમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. આ રકમ એકસાથે અથવા હસે હસે પરત કરવામાં આવે છે. નાણાં પરત કરવાનો સમય ડિબેન્ચરમાં કે ટ્રસ્ટ કીડમાં જણાવવામાં આવે છે.

(૨) કાયમી (પરત ન કરવા પાત્ર) કે ઈશ્રીડિમેબલ ડિબેન્ચર

કંપની પોતાના જીનવકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચર પરત કરતી નથી. સામાન્ય રીતે આ પ્રકારના ડિબેન્ચર કંપનીના વિસર્જન સમયે જ પરત કરવામાં આવે છે.

(૬) ઝ્યાંતરની શરત પ્રમાણે

(૧) ઝ્યાંતરપાત્ર કે કન્વાટિબલ ડિબેન્ચર

જે ડિબેન્ચર અમુક મુદ્દત બાદ કંપનીએ આપેલા વિકલ્પ પ્રમાણે કે ડિબેન્ચર હોલ્ડર નક્કી કરેલા વિકલ્પ પ્રમાણે ઈડિયટી કે અન્ય જામીનગીરીમાં ઝ્યાંતરપાત્ર કરવામાં આવે તો તેવા ડિબેન્ચર ઝ્યાંતરપાત્ર કહેવામાં આવે છે. જે ડિબેન્ચરની અમુક રકમનો ભાગ જ ઈડિયટી શેરમાં ઝ્યાંતર કરવામાં આવે તો તેને અંશતઃ ઝ્યાંતર ડિબેન્ચર (Partly Convertible Debenture) કહેવાય છે. જ્યારે જે ડિબેન્ચરની પૂરી રકમને ઈડિયટી શેરમાં ઝ્યાંતર કરવામાં આવે તો તેને સંપૂર્ણ ઝ્યાંતરિત ડિબેન્ચર (Fully Convertible Debenture) કહેવાય છે.

વર્તમાન સમયમાં આ પ્રકારના ડિબેન્ચર વધુ પ્રચલિત છે. કારણકે તે ડિબેન્ચરહાઉસને રોકડની પ્રવાહિતા, સલામતી મુડીનો વધારો અને રકમ પરત મેળવવાની ખાતરી રહેતી છે.

(૨) બિનકૃતાંતરપાત્ર કે નોન કન્વાટિબલ ડિબેન્ચર

આ પ્રકારના ડિબેન્ચરનું શેરમાં અન્ય કોઈ જામીનગીરીમાં તુપાંતર કરવામાં આવતું નથી.

૨.૫ ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ

- (૧) કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડવાનું નક્કી કરે છે ત્યારે કંપનીના કિરેકટર્સ દ્વારા તેમની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સભામાં ડિબેન્ચર બહાર પાડવા અંગે હાચ પસાર કરે છે. આ હાચમાં ડિબેન્ચરની સંખ્યા ડિબેન્ચર દીઠ રકમ તેમજ ડિબેન્ચર દ્વારા બહાર પાડવાની કુલ રકમ, તેના પર વ્યાજનો દર, ડિબેન્ચર પરત કરવાની મુદ્દત તેમજ ડિબેન્ચરને લગતી અન્ય શરતો નક્કી કરવામાં આવે છે.
- (૨) ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીધારાની તેમજ સેબીની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપનીએ જાહેર પ્રજાને ડિબેન્ચર ખરીદવા અંગે આમંત્રણ આપવા માટે ચોંગ્ય માહિતી સાથેનું વિજ્ઞાપનપત્ર અથવા વિજ્ઞાપનપત્રના બદલાનું નિયેદન બહાર પાડવું પડે છે.
- (૩) ઈક્સ્પીટી શેર બહાર પાડવાની વિધિ જેવી જ વિધિ ડિબેન્ચર બહાર પાડવા અંગેની છે. કંપનીએ જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટે એક અલગ અરજીપત્ર (Application Form) તૈયાર કરવું પડે છે.
- (૪) અરજી દ્વારા મળેલ ડિબેન્ચરની સંખ્યાની સામે જેટલા ડિબેન્ચર બહાર પાડવા હ્યો તેટલા જ ડિબેન્ચર મંજૂર કરવામાં આવશે. આ માટે કંપનીએ કોઈપણ શિલ્ડચુલ્ડ બેંકમાં અલગથી ખાતું ખોલાવવું પડશે.
- (૫) કંપનીધારા, ૨૦૧૩ના નિયમ પ્રમાણે આંધોમાં ઓછુ ૬૦ % ભરણું ભરાવું જરૂરી છે.
- (૬) કંપની ડિબેન્ચર પર એકસાથે અરજી વખતે અથવા હસે નાણાં મંગાવી શકે છે.
- (૭) ડિબેન્ચર જાહેર ભરણાં દ્વારા બહાર પાડવામાં આવે ત્યારે તેના પર મળેલા નાણાં શિલ્ડચુલ્ડ બેંકમાં એક અલગ ખાતામાં રાખવામાં આવે છે. આમ, શેર ભરણાંની જેમ ડિબેન્ચર ભરણાં વખતે અરજી પર મળેલાં નાણાં સીધા બેંકમાં જ રાખવામાં આવે છે. ભરણું બંધ થયા પછી જે અરજદારને ડિબેન્ચર મંજૂર કર્યા હોય તેમને મંજુરીપત્ર (Allotment Letter) મોકલવામાં આવે છે. અને જે અરજદારને ડિબેન્ચર નામંજૂર કર્યા હોય તેમને ડિબેન્ચર અરજીનાં નાણાં પરત કરવામાં આવે છે.
- (૮) ડિબેન્ચર મુળાક્ષિમતે, પ્રિમીયમથી કે વટાવથી બહાર પાડી શકાય છે. સ્ટેટ ઈક્સ્પીટી સિવાય શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. પરંતુ ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય છે પ્રિમીયમ અને વટાવનો દર કિરેકટર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે.

૨.૬ ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો :

ડિબેન્ચર બહાર પાડવા અંગેની રીત કે વ્યવહારો તેમજ ખાતાનાં નામ લગાભગ શેરમૂડીનો લગતા વ્યવહારો જેવા જ રહે છે. જેમ કે, ડિબેન્ચર અરજી ખાતું, ડિબેન્ચર મંજૂરી ખાતું, ડિબેન્ચર હસા ખાતું વગેરે.

ડિબેન્ચરની આગળ હંમેશા તેના પર વ્યાજનો દર દર્શાવવામાં આવે છે.

જુદા-જુદા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવા અંગે કંપનીના ચોપડે નીચે મુજબની હિસાબ નોંધ પસાર કરવામાં આવે છે.

(અ) ડિબેન્ચર મૂળકિમતે બહાર પાડવા

જ્યારે ડિબેન્ચર પરની રકમ એકસાથે મંગાવવામાં આવે ત્યારે :

(૧)	બેંક ખાતે	૬
	તે %ના ડિબેન્ચર અરજુ ખાતે	
(૨)	%ના ડિબેન્ચરઅરજુ ખાતે	૬
	તે %ના ડિબેન્ચર ખાતે	

દા.ત. : એક કંપની રૂ ૧૦૦ નો એક ઓવા ૬ % ના ૮૦૦૦ ડિબેન્ચર બહાર પાડ્યા. જેણા પરની રકમ એકસાથે અરજુ વખતે મંગાવવામાં આવી હતી. જે મળી ગઈ.

તારીખ	વિગત	આ. પા.	ઉધાર રૂ	જમા રૂ
(૧)	બેંક ખાતે	૬	૮,૦૦,૦૦૦	
	તે ૬ %ના ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે			૮,૦૦,૦૦૦
	(બા.કે. રૂ૧૦૦ નો એક ઓવા ૮૦૦૦ ડિબેન્ચર બહારપાડા પૂરેપૂરી રકમ મળી તેના.)			
(૨)	૬ %ના ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે	૬	૮,૦૦,૦૦૦	
	તે ૬ %ના ડિબેન્ચર ખાતે			૮,૦૦,૦૦૦
	(બા.કે. અરજુના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના.)			

નોંધ: જ્યારે કંપની છાર ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજુ વખતે જે મંગાવવામાં આવે ત્યારે તે રકમ ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે જમા કરવામાં આફશે.

(બ) જ્યારે ડિબેન્ચર પર રૂમેથી નાણાં મંગાવવામાં આવે ત્યારે

ડિબેન્ચર બહાર પાડતા બીચે મુજબની આમનોંધો પણાર કરવામાં આવશે. (આહી ડિબેન્ચર પર પ્રયાજનો દર ૬ % છે તેવી ધારણા કરેલ છે.)

તા. ના.	વિગત	આ. પા.	ઉધાર રૂ	જમા રૂ
(૧)	જ્યારે અરજુના નાણાં મળે ત્યારે, બેંક ખાતે	૬	---	
	તે ૬ % ના ડિબેન્ચરઅરજુ ખાતે			---
	(બા.કે.: ડિબેન્ચર અરજુના નાણાં મળ્યા તેના.)			
(૨)	અરજુના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા એટલે કે ડિબેન્ચર મંજૂર કર્યા ત્યારે,			
	૬ % ના ડિબેન્ચર અરજુ ખાતે	૬	---	
	તે ૬ % ના ડિબેન્ચર ખાતે			---
	(બા.કે.: ડિબેન્ચર મંજૂર કર્યા તેના)			
(૩)	નામંજૂર કરેલાં અરજુનાં નાણાં અરજદારોને પરત કર્યા ત્યારે			

	₹ % ના ડિબેન્ચર અરજી ખાતે	₹	---	
	તે બેન્ક ખાતે			---
	(બા.જે.: નામંજૂર કરેલ અરજીના નાણાં અરજદારને પરત કર્યા તેના)			
(૪)	અંશતઃ સ્વીકારેલ અરજી પરનાં અરજીના વધારાના નાણાં મંજૂરી ખાતે લઈ ગયા ત્યારે			
	₹ % ના ડિબેન્ચર અરજી ખાતે	₹	---	
	તે ₹ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે			---
	(બા.જે.: અરજી પરના વધારાના નાણાં મંજૂરી ખાતે લઈ ગયા તેના)			
(૫)	જ્યારે મંજૂરીની રકમ લેણી થઈ ત્યારે			
	₹ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે	₹	---	
	તે ₹ % ના ડિબેન્ચર ખાતે			---
	(બા.જે.: મંજૂરીની રકમ લેણી થઈ તેના)			
(૬)	મંજૂરીનાં નાણાં મળ્યા ત્યારે			
	બેન્ક ખાતે	₹	---	
	તે ₹ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે			---
	(બા.જે.: મંજૂરીની નાણાં મળ્યાં તેના)			
(૭)	જ્યારે હસા પરની રકમ મંગાવવામાં આવે ત્યારે			
	₹ % ના ડિબેન્ચર હસા ખાતે	₹	---	
	તે ₹ % ના ડિબેન્ચર ખાતે			---
	(બા.જે.: ડિબેન્ચર પર જે તે હસાની રકમ મંગાવી કે લેણી થઈ તેના.)			
(૮)	જ્યારે હસાની પરની રકમ મળે ત્યારે			
	બેન્ક ખાતે	₹	---	
	તે ₹ % ના ડિબેન્ચર ખાતે			---
	(બા.જે.: ડિબેન્ચરના હસાની રકમ મળી તેના.)			

ઉપરની આમનોંધો નીચેના ઉદાહરણ દ્વારા સમજુઓ.

ઉદાહરણ ૧. મયુર મિલ્સ લિમિટેડ ₹ ૧૦૦નો એક એવા ₹૧૦૦૦ ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા ડિબેન્ચર પર વાર્ષિક ₹ ટકા લેણે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યાં હતાં.

અરજી સાથે ₹ ૩૦

મંજૂરી વખતે ₹ ૪૦

હસા વખતે ₹ ૩૦

કંપનીને ૧૦૦૦૦ ડિબેન્ચરની અરજીઓ મળી. ₹૧૦૦૦ ડિબેન્ચર મંજૂર કરી વધારાની ડિબેન્ચર અરજીઓ નામંજૂર કરી અરજીદારોને નાણાં પરત કર્યા. ડિબેન્ચર પર મંગાવેલ મંજૂરી અને હસાની રકમ પૂરેપૂરી મળી ગઈ.

કંપનીના નામે જરૂરી આમનોંધ લખો.

જવાબ

મધુર મિલ્સ લિમિટેડના ચોપડામાં આમનોંધ.

તારીખ	વિગત	આ.પા.	ઉધાર રૂ	જમા રૂ
૧	બેન્ક ખાતે તે ૮ % ના ડિબેન્ચરઅરજી ખાતે (બા.જે.: ૧૦,૦૦૦ લેખે અરજુના નાણાં મળ્યા તેના)	૬	3,૦૦,૦૦૦	3,૦૦,૦૦૦
૨	૮ % ના ડિબેન્ચરઅરજી ખાતે તે ૮ % ના ડિબેન્ચર ખાતે તે બેન્ક ખાતે (બા.જે.: મંજૂર કરેલા ૮૦૦૦ ડિબેન્ચરના નાણાં ડિબેન્ચર ખાતે, જ્યારે નામંજૂર કરેલ ૨૦૦૦ ડિબેન્ચરના નાણાં પરત કર્યા તેના)	૬	3,૦૦,૦૦૦ 2,૪૦,૦૦૦ 50,૦૦૦	
૩	૮ % ના ડિબેન્ચરમંજૂરી ખાતે તે ૮ % ના ડિબેન્ચર ખાતે (બા.જે.: ૮૦૦૦ ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂ ૪૦ લેખે નાણાં મંગાવ્યા તેના)	૬	3,૨૦,૦૦૦	3,૨૦,૦૦૦
૪	બેન્ક ખાતે તે ૮ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે (બા.જે.: મંજૂરીના નાણાં પૂરેપૂરા ભળી ગયા તેના)	૬	3,૨૦,૦૦૦	3,૨૦,૦૦૦
૫	૮ % ના ડિબેન્ચર છસા ખાતે તે ૮ % ના ડિબેન્ચર ખાતે (બા.જે.: ૮૦૦૦ ડિબેન્ચર પર છસાની રકમ એટ ડિબેન્ચર દીઠ રૂ ૩૦ લેખે નાણાં મંગાવ્યા તેના)	૬	2,૪૦,૦૦૦	2,૪૦,૦૦૦
૬	બેન્ક ખાતે તે ૮ % ના ડિબેન્ચર છસા ખાતે (બા.જે.: ડિબેન્ચર પર મંગાવેલ છસાની રકમ પૂરેપૂરા ભળી ગયા તેના)	૬	2,૪૦,૦૦૦	2,૪૦,૦૦૦
કુલ સંખ્યાણો			૧૭,૨૦,૦૦૦	૧૭,૨૦,૦૦૦

(૮) ડિબેન્ચર પ્રિમીયમથી બહાર પાડવા

જ્યારે કંપની પોતાના ડિબેન્ચર તેની દર્શાનિક કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર પ્રિમીયમથી બહાર પાડવા કહેવાય. દા.ત. રૂ ૧૦૦નો એક ડિબેન્ચર, રૂ ૧૩૦માં બહાર પાડવામાં આવે, તો આ ડિબેન્ચર રૂ ૩૦ના પ્રિમીયમથી બહાર પાડવા છે તેમ કહેવાય.

કંપની ધારા, ૨૦૧૩ મુજબ ડિબેન્ચર પરના પ્રિમીયમની રકમ, જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે લઈ જવામાં આવશે.

ડિબેન્ચર પરનું પ્રિમીયમ, ઈક્સ્પીટી શેર પરના પ્રિમીયમની જેમ મૂડી નશો છે, જેથી તેનો ઉપયોગ ડિવિડનની વહેચણી તરીકે નહિ પરતુ મૂડી નુકશાનને માંડી વળવા (જેવા કે ડિબેન્ચર બહાર પાડતાં આપેલો વટાવ, ડિબેન્ચર પરત પરનું પ્રિમીયમ, પ્રાથમિક ખર્ચ, પાધડી, પેટન્ટ વગેરે) માટે કરવામાં આવે છે.

જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતું કંપનીના પાકા સરવૈચાભાં ઈક્સ્પીટી અને દેવાં બાજુ અનામત અને વધારા ના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે.

જ્યારે ડિબેન્ચરની રકમ એકસાથે મંગાવવામાં આવે ત્યારે.

દા.ત.: એક કંપનીએ ₹ ૧૦૦નો એક એવા ૧૦ ટકાના ₹૫૦૦૦ ડિબેન્ચર, ડિબેન્ચર દીઠ ₹ ૨૦ ના પ્રિમીયમને બહાર પાડયા. બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી જે કંપનીને મળી ગઈ. કંપનીના ચોપડે નીચે મુજબ આમનોંધ થશે.

તારીખ	વિગત	આ.પા.	ઉદાર ₹	જમા ₹
૧	બેંક ખાતે	૩	૭,૨૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે			૭,૨૦,૦૦૦
	(બા.જે.: ₹૫,૦૦૦ ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹ ૧૨૦ લેખે અરજુના નાણાં મળ્યા તેના)			
૨	૧૦ % ના ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે	૩	૭,૨૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર ખાતે			૫,૦૦,૦૦૦
	તે જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે			૧,૨૦,૦૦૦
	(બા.જે.: અરજુના નાણાં ડિબેન્ચરના ખાતે, અને પ્રિમીયમ ખાતે લઈ ગયા તેના)			

જ્યારે ડિબેન્ચરની રકમ હેઠેથી મંગાવવામાં આવે ત્યારે:

ઉદાહરણ ૨. અમુલ લિમિટેડ ₹ ૨૦૦નો એક એવા ૧૦ % ના ૫૦૦૦ ડિબેન્ચર ૨૦ % ના પ્રિમીયમે બહાર પાડયા. જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા.

અરજુ સાથે	₹ ૯૦
મંજૂરી વખતે	₹ ૧૦૦ (પ્રિમીયમ સહિત)
આખરી હસ્ત વખતે	₹ ૮૦

કુલ ₹૫૦૦૦ ડિબેન્ચર માટે અરજુઓ આવી હતી. જેમાંથી વધારાની અરજુઓ નામંજૂર કરી તેના પરના નાણાં પરત કરવામાં આવ્યા હતા. મંજૂરી અને હસ્ત વખતે મંગાવેલ પૂરેપૂરી રકમ મળી ગઈ હતી.

કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો.

તારીખ	વિગત	આ.પા.	ઉદાર (₹)	જમા (₹)
૧	બેંક ખાતે	૩	૪,૮૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર અરજુ ખાતે			૪,૮૦,૦૦૦
	(બા.જે.: ₹૫૦૦૦ ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹ ૯૦			

	લેખઅરજુના નાણાં મળ્યા તેના)			
૨	૧૦% ના ડિબેન્ચર અરજુ ખાતે	૬	૪,૮૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર ખાતે			૩,૦૦,૦૦૦
	તે બેન્ક ખાતે			૧,૮૦,૦૦૦
	(બા.જે.: મંજૂર કરેલા ૫૦૦૦ ડિબેન્ચર પરનાં નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા અને નામંજૂર કરેલ. ૩૦૦૦ ડિબેન્ચરના નાણાં અરજદારોને પરત કર્યા તેના)			
૩	૧૦ % ના ડિબેન્ચરમંજૂરી ખાતે	૬	૫,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર ખાતે			૩,૦૦,૦૦૦
	તે જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે			૨,૦૦,૦૦૦
	(બા.જે.: મંજૂરી વખતે પ્રિમીયમ સહિતી લેણી થતી રકમ ડિબેન્ચર દીઠ રૂ ૧૦૦ લેખે નાણાં મંગાવ્યા તેના)			
૪	બેન્ક ખાતે	૬	૫,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે			૫,૦૦,૦૦૦
	(બા.જે.: મંજૂરી વખતે મંગાવેલી રકમ પૂરેપૂરા મળી ગયા તેના)			
૫	૧૦ % ના ડિબેન્ચર આખરી હસ્તા ખાતે	૬	૪,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર ખાતે			૪,૦૦,૦૦૦
	(બા.જે.: આખરી હસ્તા વખતે ડિબેન્ચર દીઠ રૂ ૮૦ મંગાવ્યા તેના)			
૬	બેન્ક ખાતે	૬	૪,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર હસ્તા ખાતે			૪,૦૦,૦૦૦
	(બા.જે.: હસાની રકમ પૂરેપૂરા મળી ગઈ તેના)			
	કુલ સરવાળો		૨૭,૫૦,૦૦૦	૨૭,૫૦,૦૦૦

(૫) ડિબેન્ચર વટાવથી બહાર પાડવા

કંપની પોતાના ડિબેન્ચર તેની દર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે, તે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા છે તેમ કહેવાય. દા.ત.: રૂ ૧૦૦ની દર્શનિક કિંમતનો એક ડિબેન્ચર રૂ ૮૦ માં બહાર પાડવામાં આવે તો અહીં રૂ ૧૦ વટાવ ગણાશે.

ડિબેન્ચર પરના વટાવની રકમને ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે.

- કંપની ધારામાં ડિબેન્ચર મહત્વમાં કેટલા વટાવથી બહાર પાડી શકાય તે માટે કોઈ નિયત્રણ નથી. કંપનીના આઇકલ્સમાં જો કોઈ નિયત્રણ ના હોય તો કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકે છે.

જો કોઈ સ્પષ્ટતા ના હોય તો ડિબેન્ચર પરના વટાવ અંગેની નોંધ ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે આપવામાં આવે છે.

- ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાનની રકમ કંપનીના નફા-નુકશાન ખાતામાં જે તે વર્ષે ઉદ્ઘારી દેવામાં આવે છે. અથવા તો તેને આવનારા વર્ષોમાં માંડી વાળવામાં આવે છે. સમય મર્યાદા કંપની પોતે નક્કી કરે છે. નહીં માંડી વાળેલ રકમ પાકા સરવૈયામાં અન્ય બિનચાલુ મિલકતાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે.
- ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગે.

ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાનને મૂડી ખોટ ગણવામાં આવે છે. આ મૂડી ખોટ શક્ય હોય તેટલી ઝડપથી માંડી વાળવામાં આવે છે. પરંતુ આ સમય ડિબેન્ચરના જીવનકાળથી વધુ હોવો જોઈએ નહિ. દા.ત.: છ વર્ષ પછી પરત કરવાની શરતે ડિબેન્ચર વટાવથી બહાર પાડેલ હોય તો કુલ વટાવ માંડી વાળવાનો સમય છ વર્ષથી વધુનો હોવો જોઈએ નહિ. સામન્ય રીતે આ રકમ જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે કે નફા-નુકશાનના પત્રક સામે માંડી વાળવામાં આવે છે. આ માટે નીચેની આમનોંધ પસાર કરવામાં આવે છે.

	જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે	૭		---
	અથવા નફા-નુકશાનના ખાતે	૭		---
	તે ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાન ખાતે			---

- જ્યારે ડિબેન્ચરની રકમ એકસાથે મંગાવવામાં આવે ત્યારે.

દા.ત.: એક કંપનીએ રૂ ૧૦૦નો એક એવા ૮% ના ૨૦૦૦ ડિબેન્ચર, ડિબેન્ચર દીઠ રૂ ૮૦ ના ભાવે બહાર પાડ્યા. જેના પર પૂરોપૂરી રકમ મંગાવી જે મળી ગઈ હતી.

કંપનીના ચોપડે નીચે મુજબ આમનોંધ થશે.

તારીખ	વિગત	આ.પા.	ઉદ્ઘાર રૂ	જમા રૂ
૧	બેન્ક ખાતે	૬	૧,૫૦,૦૦૦	
	તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે			૧,૫૦,૦૦૦
	(બા.જે.: ૨,૦૦૦ ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂ ૮૦ લેખે અરજીના નાણાં મળ્યા તેના)			
૨	ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે	૬	૧,૫૦,૦૦૦	
	ડિબેન્ચર વટાવ ખાતે	૬	૪૦,૦૦૦	
	તે ૮% ના ડિબેન્ચર ખાતે			૨,૦૦,૦૦૦
	(બા.જે. : રૂ ૧૦૦ના એક એવા ૮ ટકાના ૨૦૦૦ ડિબેન્ચર રૂ ૨૦ના વટાવથી બહાર પાડ્યાં તેના)			

- જ્યારે ડિબેન્ચરની રકમ હસેથી મંગાવવામાં આવે ત્યારે.

ઉદાહરણ 3. અંકલેશ્વર ઓર્ડિન લિમિટેડ રૂ ૧૦૦નો એક એવા ૧૦ ટકાના ૮૦૦૦ ડિબેન્ચર ૧૦%ના વટે બહાર પાડ્યા. ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના છે.

અરજી સાથે	રૂ ૩૦
મંજૂરી વખતે	રૂ ૪૦ (વટાવ બાદ)
હસા વખતે	રૂ ૨૦

કુલ ૮૦૦૦ ડિબેન્ચર અરજીઓ મળી. કંપનીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ. જ્યારે હસા વખતે ૩૦૦ ડિબેન્ચર સિવાય બાકીના બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી.

કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો.

તારીખ	વિગત	ખા.પા.	ઉધાર રૂ	જમા રૂ
૧	બેન્ક ખાતે	૬	૨,૪૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર અરજી ખાતે			૨,૪૦,૦૦૦
	(બા.જે.: ૮૦૦૦ ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂ ૩૦ લેખઅરજીના નાણાં મળ્યા તેના)			
૨	૧૦% ના ડિબેન્ચર અરજી ખાતે	૬	૨,૪૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર ખાતે			૨,૪૦,૦૦૦
	(બા.જે.: અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના)			
૩	૧૦ % ના ડિબેન્ચરમંજૂરી ખાતે	૬	૩,૨૦,૦૦૦	
	ડિબેન્ચર વટાવ ખાતે	૬	૮૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર ખાતે			૪,૦૦,૦૦૦
	(બા.જે.: મંજૂરી નાણાં રૂ ૧૦ના વટાવ બાદ ડિબેન્ચર દીઠ રૂ ૪૦ના લેખાંથી તેના)			
૪	બેન્ક ખાતે	૬	૩,૨૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે			૩,૨૦,૦૦૦
	(બા.જે.: મંજૂરી વખતે મંગાવેલી રકમ પૂરેપૂરા મળી ગયા તેના)			
૫	૧૦ % ના ડિબેન્ચર આખરી હસા ખાતે	૬	૧,૫૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર ખાતે			૧,૫૦,૦૦૦
	(બા.જે.: ૮૦૦૦ ડિબેન્ચર પર, ડિબેન્ચર દીઠ રૂ ૨૦ લેખે હસાની રકમ મંગાવી તેના)			
૬	બેન્ક ખાતે	૬	૧,૫૪,૦૦૦	
	ડિબેન્ચર બાકી હસા ખાતે	૬	૫,૦૦૦	
	તે ૧૦ % ના ડિબેન્ચર હસા ખાતે			૧,૫૦,૦૦૦
	(બા.જે.: ૩૦૦ ડિબેન્ચર સિવાય બાકીના ૭૭૦૦ ડિબેન્ચર પર હસાની રકમ મળી ગઈ તેના)			
	કુલ સરવાતો		૧૫,૨૦,૦૦૦	૧૫,૨૦,૦૦૦

ઉદાહરણ ૪. રાજ્યસ્થાન લિમિટેડ રૂ ૧૦૦નો એક એવા ૧૧%ના ૨૫૦૦૦ ડિબેન્ચર બહાર પાડયા. જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે ભરવાના હતા.

અરજુ સાથે	₹ ૩૦
મંજૂરી વખતે	₹ ૩૫
પ્રથમ અને આખરી હસા વખતે	₹ ૩૫

બધાજ ડિબેન્ચર માટે અરજુઓ આવી હતી. ૮૦૦ ડિબેન્ચર ધારણા કરનાર જોગિન્દ્રે, મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી. જ્યારે ૨૦૦ ડિબેન્ચર ધારણા કરનાર હરજુતસિંહ મંજૂરી અને હસાની રકમ ચૂકવી શક્યા નથિ.

બાકીના બધાજ ડિબેન્ચર પર સમયસર મંજૂરી અને હસાની રકમ મળી ગઈ હતી.

ઉપરના વ્યવહારોની કંપનીના કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો.

રાજ્યસ્થાન લિમિટેડ કંપનીના ચોપડામાં આમનોંધ

તારીખ	વિગત	ખા.પા.	ઉધાર ₹	જમા ₹
૧	બેન્ક ખાતે તે ૧૧ % ના ડિબેન્ચર અરજુ ખાતે	૬	૭,૫૦,૦૦૦	૭,૫૦,૦૦૦
	(બા.જે.: ૨૫૦૦૦ ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹ ૩૦ લેખ અરજુના નાણાં મળ્યા તેના)			
૨	૧૧% ના ડિબેન્ચર અરજુ ખાતે તે ૧૧ % ના ડિબેન્ચર ખાતે	૬	૭,૫૦,૦૦૦	૭,૫૦,૦૦૦
	(બા.જે.: ડિબેન્ચર પરના અરજુના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના)			
૩	૧૧ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે તે ૧૧ % ના ડિબેન્ચર ખાતે	૬	૮,૭૫,૦૦૦	૮,૭૫,૦૦૦
	(બા.જે.: મંજૂરી વખતે લેણી થતી રકમ ડિબેન્ચર દીઠ ₹ ૩૫ લેખે મંગાવી તેના)			
૪	બેન્ક ખાતે ડિબેન્ચર પર મળવાના બાકી હસા ખાતે	૬	૮,૬૫,૦૦૦	૮,૬૫,૦૦૦
	તે ૧૧ % ના ડિબેન્ચર મંજૂરી ખાતે તે અગાઉથી મળેલ હસા ખાતે			૨૮,૦૦૦
	(બા.જે.: મંજૂરી પર ૨૪,૮૦૦ ડિબેન્ચરનાં નાણાં મળ્યા તેના તેમજ ૮૦૦ ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹ ૩૫ લેખે હસાની રકમ અગાઉથી મળી તેના)			
૫	૧૧ % ના ડિબેન્ચર પ્રથમ અને આખરી હસા ખાતે તે ૧૧ % ના ડિબેન્ચર ખાતે	૬	૮,૭૫,૦૦૦	૮,૭૫,૦૦૦
	(બા.જે.: હસા વખતે લેણી થતી રકમ ડિબેન્ચર દીઠ ₹ ૩૫ લેખે મંગાવી તેના)			
૬	બેન્ક ખાતે મળવાના બાકી હસા ખાતે	૬	૮,૪૦,૦૦૦	૮,૦૦૦

	અગાઉથી મળેલ હસા ખાતે	૬	૨૮,૦૦૦	
	તે ૧૧ % ના ડિલેન્યર પર પ્રથમ અને આખરી હસા ખાતે			૮,૭૫,૦૦૦
	(બા.જે. આખરી હસા વખતે ₹૧૦૦ ડિલેન્યર પર અગાઉથી મળેલ હસાની રકમ બાદ કરતાં તેમજ ₹૨૦૦ ડિલેન્યર પર હસાની રકમ નહિ ભરતાં બાકીની રકમ મળી ગઈ તેના)			
	કુલ સરવાળો		૫૦,૨૮,૦૦૦	૫૦,૨૮,૦૦૦

ઉદાહરણ ૫. રામકિશા લિમિટેડ ડિલેન્યર દીઠ ₹ ૫૦૦ની મુજાહિમતના ૧૦%ના ₹૦,૦૦૦ ડિલેન્યર, ૧૦ ટકાના પ્રિમીયમથી બહાર પાડ્યા. રકમ નીચે મુજબ ચૂકવવાની હતી. અરજુ વખતે ₹ ૨૫૦ (પ્રિમીયમ સહિત) અને બાકીની રકમ મંજૂરી વખતે.

આ ડિલેન્યર ₹ વર્ષ પછી પરત કરવાના છે. કંપનીને ₹૧,૦૦,૦૦૦ ડિલેન્યરની અરજુઓ મળી, જેમાંથી પ્રમાણસર ફાળવણી ક્રાંતા ₹૦,૦૦૦ ડિલેન્યર મંજૂર કર્યા.

અરજુ પરની વધારાની રકમ મંજૂરી ખાતે લઈ જવાબાં આવશે. મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ. ડિલેન્યર બહાર પાડતી વખતે કંપનીના ચોપકે થતી અસરોની આમનોંધ આપો.

રામકિશા લિમિટેડ કંપનીના ચોપડાબાં આમનોંધ

નાંસીખ	વિગત	ખા.પા.	ઉધાર ₹	જમા ₹
૧	બેન્ક ખાતે	૬	૨,૫૦,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિલેન્યર અરજુ ખાતે			૨,૫૦,૦૦,૦૦૦
	(બા.જે.: ₹૧,૦૦,૦૦૦ ડિલેન્યરની અરજુ પર ડિલેન્યર દીઠ ₹ ૨૫૦ લેખ નાણાં મળ્યા તેના)			
૨	૧૦ % ના ડિલેન્યર અરજુ ખાતે	૬	૨,૫૦,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિલેન્યર ખાતે			૧,૫૦,૦૦,૦૦૦
	તે જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે			૪૦,૦૦,૦૦૦
	તે ૧૦ % ના ડિલેન્યર × મંજૂરી ખાતે			૫૦,૦૦,૦૦૦
	(બા.જે.: ડિલેન્યર અરજુ પરના નાણાં ડિલેન્યર ખાતે અને પ્રિમીયમ ખાતે લઈ ગયાં તેમજ વધારાની અરજુ પરના નાણાં ડિલેન્યર મંજૂરી ખાતે લઈ ગયા તેના)			
૩	૧૦ % ના ડિલેન્યરમંજૂરી ખાતે	૬	૨,૪૦,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિલેન્યર ખાતે			૨,૪૦,૦૦,૦૦૦
	(બા.જે.: ₹૦,૦૦૦ ડિલેન્યર પર ડિલેન્યર દીઠ ₹ ૩૦૦ લેખ મંજૂરીના નાણાં મંગાવ્યા તેના)			
૪	બેન્ક ખાતે	૬	૧,૬૦,૦૦,૦૦૦	
	તે ૧૦ % ના ડિલેન્યર મંજૂરી ખાતે			૧,૬૦,૦૦,૦૦૦
	(બા.જે.: મંજૂરી પર રકમ મળી ગઈ તેના)			
	કુલ સરવાળો		₹૩૦,૦૦,૦૦૦	₹૩૦,૦૦,૦૦૦

(ક) રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા

શેરની જેમ જ ડિબેન્ચર પણ રોકડ સિવાયના અવેજથી અમુક સંજોગોમાં બહાર પાડવામાં આવે છે. દા.ત. જમીન-મકાન, પ્લાન્ટ અને મશીનરી વગેરે જેવી મિલકતો ખરીદીની સામે વેચનારને ડિબેન્ચર આપવા. તે જ રીતે કોઈ ધંધાની ખરીદી વખતે, ધંધો વેચનારને ધંધાની ખરીદકિંમત પેટે કંપનીના ડિબેન્ચર અપાવા. આ ડિબેન્ચર વેચનારને મૂળકિંમતે પ્રિમિયમ ડે વટાવ ઢ્રારા આપવામાં આવે છે.

આ સંજોગોમાં નીચે પ્રમાણે આમનોંધ પસાર કરવામાં આવે છે.

૧	જ્યારે કોઈ ધંધો ખરીદવામાં આવે ત્યારે			
	(૧) પસ્યુરણ મિલકતો ખાતે (ધંધાની લીધેલ મિલકતો)	૬	----	
	તે ધંધો વેચનાર ખાતે (ધંધાના લીધેલ દેવા) (બા.જે.: ધંધાની ખરીદી વખતે ધંધાની મિલકતો અને દેવા લીધા તેના)		----	
	(૨) ધંધો વેચનાર ખાતે (ધંધાની લીધેલ મિલકતો)	૬	----	
	તે ડિબેન્ચર ખાતે (બા.જે.: ખરીદ કિંમત પેટે કંપનીએ ડિબેન્ચર આપ્યા તેના)		----	
૨	જો કોઈ મિલકત ખરીદવામાં આવે ત્યારે			
	(૧) મિલકતની ખરીદી વખતે મિલકત ખાતે (ધંધાની લીધેલ મિલકતો)	૬	----	
	તે વેચનાર ખાતે (બા.જે.: મિલકતની ખરીદી કરવામાં આવે તેના)		----	
	(૨) વેચનાર ખાતે (ધંધાની લીધેલ મિલકતો)	૬	----	
	તે ડિબેન્ચર ખાતે (બા.જે.: વેચનારને મિલકત પેટે ડિબેન્ચર આપ્યા તેના)		----	

ઉદાહરણ ક. દિપિકા લિમિટેડ રૂ ૫,૦૦,૦૦૦ ની મશીનરી સુમન મેન્યુ. લિમિટેડ પાસેથી તારીખ: ૧-૧૨-૨૦૧૭ના રોજ ખરીદી રૂ ૨,૦૦,૦૦૦ તરત જ ચૂકવી દીધા. અને બાકીની રકમ પેટે દિપિકા લિમિટેડના રૂ ૩,૭૦,૦૦૦ના ૧૧% ના ડિબેન્ચર આપ્યા. દિપિકા લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો જો દિપિકા લિમિટેડ બાકીની રકમ પેટે રૂ ૪,૦૦,૦૦૦ના ૧૧%ના ડિબેન્ચર આપેતો તેની આમનોંધ કેવી રીતે લખાશો?

દિપિકા લિમિટેડ કંપનીના ચોપડામાં આમનોંધ

તારીખ	વિગત	ખા.પા.	ઉધાર રૂ	જમા રૂ
૨૦૧૭				
કિસે.૧	મશીનરી ખાતે તે સુમન મેન્યુ. લિમિટેડ ખાતે	૬	૫,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦

	(બા.જે.: સુમન મેન્યુ. લિમિટેડ પાસેથી ભસીનરી ખરીદી તેના)			
ડિસ.૧	સુમન મેન્યુ. લિમિટેડ ખાતે રૂ		૨,૦૦,૦૦૦	
	તે બેન્ક ખાતે			૨,૦૦,૦૦૦
	(બા.જે.: ભસીનરી ખરીદ સામે ₹ ૨,૦૦,૦૦૦ તરત જ ચૂકવી દીધા તેના)			
ડિસ.૧	સુમન મેન્યુ. લિમિટેડ ખાતે રૂ		૪,૦૦,૦૦૦	
	તે ૧૧% ના ડિબેન્ચર ખાતે			૩,૭૦,૦૦૦
	તે જામનગરી પ્રિમીયમ અનામત ખાતે			૩૦,૦૦૦
	(બા.જે.: ₹ ૪,૦૦,૦૦૦ની બાકી રકમની સામે ₹ ૩,૭૦,૦૦૦ના ડિબેન્ચર આપતાં તશીવતની રકમ પ્રિમીયમ ખાતે લઈ ગયા તેના)			

ઉદાહરણ ૭. પેટેલ ટ્રેડર્સની મિલકતો ₹ ૮,૮૦,૦૦૦માં અને દેવાં (લેણાદારો) ₹ ૧,૫૦,૦૦૦માં ખરીદી લીધાં. ખરીદ કિંમત પેટે ₹ ૭,૯૮,૦૦૦ ચૂક્યવાનું નક્કી કર્યું. પિયુષ મેટલ્સ લિમિટેડ ખરીદકિંમત ₹ ૧૦૦ નો એક એવા ૧૨% ના ડિબેન્ચર ૨૦% પ્રિમીયમથી આપ્યા.

કુંપનીના ચોપડે આમનોંધ પસાર કરો.

જવાબ:

ખરીદ કિંમત = ₹ ૭,૯૮,૦૦૦ જે આપેલ છે.

ચોખ્ખી મિલકત = કુલ મિલકતો - દેવાં

$$= ₹ ૮,૮૦,૦૦૦ - ₹ ૧,૫૦,૦૦૦$$

$$= ₹ ૭,૨૦,૦૦૦$$

ખરીદ કિંમત - ચોખ્ખી મિલકત = પાધડી

$$₹ ૭,૯૮,૦૦૦ - ₹ ૭,૨૦,૦૦૦ = ₹ ૮૮,૦૦૦ \text{ (પાધડી)}$$

અહીં ₹ ૭,૯૮,૦૦૦ની ખરીદી કિંમત પેટે ₹ ૧૦૦નો એક એવા ૧૨% ના ડિબેન્ચર, ૨૦% પ્રિમીયમથી આપે છે. ડિબેન્ચર સંખ્યા આપેલ નથી.

$$\begin{aligned} \text{ડિબેન્ચરની સંખ્યા} &= \frac{\text{ખરીદ કિંમત}}{\text{ડિબેન્ચર દીઠ રકમ}} = \frac{₹ ૭,૯૮,૦૦૦}{૧૨૦ (૧૦૦ + ૨૦)} \\ &= \underline{\text{ડિબેન્ચર સંખ્યા } ૬,૪૦૦} \end{aligned}$$

કુંપનીના ચોપડામાં આમનોંધ

તારીખ	વિગત	આ.પા.	ઉધાર ₹	જમા ₹
૧	પરચૂરણ મિલકતો ખાતે રૂ		૮,૮૦,૦૦૦	
	પાધડી ખાતે રૂ		૮૮,૦૦૦	

	તે ટેવાં (લેણદારો) ખાતે			૧,૬૦,૦૦૦
	તે પટેલ ડ્રેક્સર્સ ખાતે			૭,૬૮,૦૦૦
	(બા.જે.: પટેલ ડ્રેક્સર્સના મિલકતો અને ટેવાં ખરીદાં તેના)			
૨	પટેલ ડ્રેક્સર્સ ખાતે	૩	૭,૬૮,૦૦૦	
	તે ૧૨ ટકાના ડિબેન્ચર ખાતે			૬,૪૦,૦૦૦
	(૬,૪૦૦ ડિબેન્ચર \times ₹ ૧૦૦)			
	તે જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે			૧,૨૮,૦૦૦
	(૬,૪૦૦ ડિબેન્ચર \times ₹ ૨૦)			
	(બા.જે.: ખરીદક્રમત પેટે ૬,૪૦૦ ડિબેન્ચર ૨૦% પ્રિમીયમથી આપ્યા તેના)			

(૬) આનુષાંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર.

કંપની જ્યારે બેન્ક કે કોઈ વ્યક્તિ પાસેથી લોન મેળવે ત્યારે મુખ્ય જામીનગીરી ની સાથે ગૌણ કે દ્વિતીય જામીનગીરી તરીકે પોતાના ડિબેન્ચર આપે છે. આ રીતે આપેલ ડિબેન્ચરને આનુષાંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર કહેવાય છે.

જો કંપની સમયસર લોનનાં નાણાં ભરી દે તો બેન્ક કંપનીને ડિબેન્ચર પરત કરે છે અને આ રીતે પરત મળેલ ડિબેન્ચર કંપની રદ કરે છે.

પરંતુ જો કંપની લોનનાં નાણાં કે તેના પરનું વ્યાજ ચોગ્ય સમય મર્યાદામાં ચૂકવે નહિ તો બેન્ક કે લોન આપનાર સૌ પ્રથમ મુખ્ય જામીનગીરી વેચીને રકમ મેળવશે. જો મુખ્ય જામીનગીરીમાંથી લોનની પૂરી રકમ વસુલ ન થાય તો લોન આપનારને દ્વિતીય જામીનગીરી પર મળેલ ડિબેન્ચર પર ડિબેન્ચર હોલ્ડર તરીકેના બધા છકો મળે છે. એટલે કે લોન આપનાર ડિબેન્ચર વેચીને બાકીની રકમ વસુલ કરી શકે છે. આ રીતે બહાર પાડેલા ડિબેન્ચરને હિસાબમાં દર્શાવવા બે પદ્ધતિ છે.

પદ્ધતિ-૧ : જામીનગીરી તરીકે બેન્કને આપેલ ડિબેન્ચર એ ફક્ત લોનની રકમની સલામતી માટે છે. હિસાબના ચોપડામાં ડિબેન્ચર અંગે કોઈ નોંધ કરવામાં આવતી નથી. બેન્ક લોન અંગેની જ આમનોંધ આપવામાં આવે છે. પાકા સરવૈચામાં ટેવાં બાજુ બિન-ચાલુ ટેવાં કે જબાબદારીઓ ના શીર્ષક હેઠળ લાંબા ગાળાના ટેવાંથી નીચે દર્શાવવાચ છે. ઉદારણ માં આ દર્શાવિલ છે.

પદ્ધતિ-૨ : આ પદ્ધતિમાં કંપની ચોપડામાં આનુષાંગિક જામીનગીરી તરીકે આપેલ ડિબેન્ચરની નોંધ કરવામાં આવે છે. આ નોંધ નીચે મુજબ થશે.

	ડિબેન્ચર ઉપલક ખાતે	૩		---
	તે ડિબેન્ચર ખાતે			---
	(બા.જે. બેન્ક લોનની સામે આનુષાંગિક ડિબેન્ચર તરીકે ડિબેન્ચર્સ આપ્યા તેના)			

પાકા સરવૈચામાં દ્વારા અને ટેવાં બાજુ, ડિબેન્ચરની રકમમાંથી ડિબેન્ચર ઉપલક ખાતું બાદ કરવામાં આવશે. જો બેન્ક લોન કંપની દ્વારા ચૂકવી ટેવામાં આવે તો બેન્ક પાસેથી પરત મળેલ ડિબેન્ચર કંપની દ્વારા રદ કરવામાં આવશે. અને ઉપરની આમનોંધ ઉત્તાપવામાં આવશે.

ઉદારણ માં એક કંપની તારીખ ૧ એપ્રિલ, ૨૦૧૭ના રોજ બહાર પાડેલા ₹ ૧૪,૦૦,૦૦૦ના ૧૧% ના ડિબેન્ચર ધરાવે છે. વર્ષ દરમિયાન કંપનીએ તારીખ: ૧૫ જુલાઈ, ૨૦૧૭ના રોજ ₹ ૩,૦૦,૦૦૦ની બેન્ક

લોન લીધી જેણી સામે કંપનીએ આનુષાંગિક જામીનગીરી તરીકે નવા રૂ 2,00,000ના ૧૧ % ડિબેન્ચર આપ્યા.

ઉપરના વ્યવહારોને લગતી જરૂરી આમનોંધ બંને પદ્ધતિ હેઠળ કંપનીના ચોપડામાં પસાર કરો. તદ્વારાંત ડિબેન્ચર અને બેન્ક અંગેની વિગતો તારીખ ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ કંપનીના પાકા સરવૈયામાં દર્શાવો.

જવાબ: (પ્રથમ પદ્ધતિ પ્રમાણે)

બેન્ક ખાતે	૩		3,00,000	
તે બેન્ક લોન ખાતે				3,00,000
(બા.જે. બેન્ક લોન લીધી તેના)				

આ પદ્ધતિમાં લોનની સામે ડિબેન્ચર જામીનગીરી તરીકે આપ્યા છે. તેની કોઈ નોંધ થશે નહિં.

તારીખ: ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજનું પાંકું સરવૈયું.

વિગત	નોંધ નં.	૩૧ માર્ચ ૨૦૧૮	૩૧ માર્ચ ૨૦૧૭
ઇક્સ્પ્રીટ અને જવાબદારી			
શેરહોલ્ડર્સ બંદોળ			
બિનચાલુ જાબાદારીઓ			
લાંબા ગાળાના ટેવાં			
૧૧ ટકાના ડિબેન્ચર (આ ઉપરાંત રૂ 2,00,000ના ડિબેન્ચર આનુષાંગિક જામીનગીરી તરીકે આપ્યા)		૧૪,૦૦,૦૦૦	
બેન્ક લોન (રૂ 2,૦૦,૦૦૦ના ડિબેન્ચર આનુષાંગિક જામીનગીરી તરીકે આપ્યા)		3,00,000	

(બીજી પદ્ધતિ પ્રમાણે)

કંપનીના ચોપડે આમનોંધ

તારીખ	વિગત	ખા.પા	ઉધાર રૂ	જમા રૂ
૧	બેન્ક ખાતે તે બેન્ક લોન ખાતે (બા.જે. બેન્ક લોન લીધી તેના)	૩	3,00,000	3,00,000
	ડિબેન્ચર ઉપલક ખાતે તે ૧૧% ના ડિબેન્ચર ખાતે	૩	2,૦૦,૦૦૦	2,૦૦,૦૦૦
	(બા.જે. બેન્કમાંથી લીધેલ લોન સામે આનુષાંગિક જામીનગીરી તરીકે રૂ 2,૦૦,૦૦૦ ના ૧૧% ના ડિબેન્ચર આપ્યા તેના)			

વિગત	જોધ નં	૩૧ માર્ચ ૨૦૧૮	૩૧ માર્ચ ૨૦૧૭
ઇક્સ્પીટી અને જવાબદારી:			
શેરહોલ્ડર્સ બંડોળ:			
બિનચાતુ જબાદારીઓ:			
લાંબા ગાળાના ટેવાં:			
૧૧ ટકાના ડિબેન્ચર ₹ ૧૪,૦૦,૦૦૦		૧૪,૦૦,૦૦૦	
૧૧ %ના ડિબેન્ચર આનુષાંગિક ₹ ૨,૦૦,૦૦૦ જામીનગીરી તરીકે આપેલ			
બાદ: ડિબેન્ચર ઉપલક ખાતે ₹,૦૦,૦૦૦			
બેન્ક લોન (₹ ૨,૦૦,૦૦૦ના ડિબેન્ચર આનુષાંગિક જામીનગીરી તરીકે આપ્યા)		3,૦૦,૦૦૦	

૨.૭ શેર-ડિબેન્ચર વર્ચ્યેનો તફાવત

અનું.ન.	તફાવતના મુદ્દાઓ	શેર	ડિબેન્ચર
૧	મૂડીનો પ્રકાર	શેર એ માલિકીહક દર્શાવતી મૂડી છે. તેને માલિકીપણાની જામીનગીરી કહેવાય છે. શેરહોલ્ડર કંપનીનો માલિક ગણાય છે.	ડિબેન્ચર એ ઉછીની લીધેલી મૂડી છે. તેને લેણાદારોની જામીનગીરી કહેવાય છે. ડિબેન્ચર હોલ્ડર કંપનીનો લેણાદાર ગણાય છે.
૨	વળતરની ખાતરી	કંપની જો નશો ના કરે તો શેરહોલ્ડરને કોઈ વળતર જહેર કરે તો જ શેરહોલ્ડરને વળતર મળે છે. આમ વળતરની કોઈ ચોક્કસ ખાતરી નથી.	કંપની નશો કરે કે ખોટ કરે, ડિબેન્ચરહોલ્ડરને ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલ શરત મુજબ નિશ્ચિત વ્યાજ ચૂકવવું પડે છે.
૩	ગીરો કે બોજ	શેર એ માલિકીપણાની જામીનગીરી હોવાથી મિલકતો ગીર્યે મુકવાની જરૂર નથી.	ડિબેન્ચર એ લેણાદારોની જામીનગીરી હોવાથી તેના માટે કંપની દ્વારા સામાન્ય રીતે તેની સામે કંપનીના મિલકતો પર સ્થિર કે તરતો બોજ ઉભો કરવામાં આવે છે.
૪	અધિકાર	શેરહોલ્ડરને કંપનીના વહીવઠી કામકાજમાં ભાગ લેવા તેમજ મતદાન કરવાનો અધિકાર મળે છે.	ડિબેન્ચર હોલ્ડરને કંપનીના વહીવઠી કામકાજમાં ભાલ લેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર મળતો નથી.
૫	વટાવથી બહાર પાડવા અંગે નિયમન	સ્વેટ ઇક્સ્પીટી સિવાય શેર વટાવથી બહાર પાડી શકાતા નથી (કંપની ધારા ૨૦૧૩ મુજબ)	ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય છે.
૬	ઝ્યાંતરિત	ડિબેન્ચરમા ઝ્યાંતર કરી શકાય તેવા	ડિબેન્ચરનું શેરમાં ઝ્યાંતર કરી શકાય

		શેર બહાર પાડવામાં આવતા નથી.	તેવા ડિલેન્ચર બહાર પાડી શકાય છે.
૭	પરત કરવા અંગે	શેરના નાણાં કંપનીએ પોતાના જીવનકાળ દરમિયાન પરત કરવાનાં હોતા નથી.	સામાન્ય સંજોગોમાં ડિલેન્ચર નાણાં કંપનીએ નક્કી કરેલી મુદ્દતમાં પરત કરે છે.
૮	વિસર્જન સમયે	કંપનીના વિસર્જન સમયે શેરહોલ્ડર્સને બધા દેવા ચૂકવ્યાં બાદ રકમ વધે તો જ ચૂકવાય છે.	કંપનીના વિસર્જન સમયે ડિલેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતાં પહેલા રકમ ચૂકવવામાં આવે છે.

૨.૮ ડિલેન્ચર પર વ્યાજ

સામાન્ય રીતે ડિલેન્ચર પરંતુ વ્યાજ અર્ધવાર્ષિક ચૂકવવામાં આવે છે. ડિલેન્ચર પરંતુ વ્યાજ કંપનીના નફો નુકશાન પત્રકમાં નોંધવામાં આવે છે. વ્યાજને નફો સામેનો ખર્ચ છે. તેથી કંપની ખોટ કરે કે પૂરતો નફો ન કમાય તોપણ ડિલેન્ચર પરંતુ વ્યાજ નિયમિત રીતે ચૂકવલું ફરજિયાત છે. ડિલેન્ચર શબ્દ સાથે જે વ્યાજનો દર જોડાયેલ હોય તે દરે ડિલેન્ચર પર વ્યાજ આપવામાં આવે છે. દા.ત. ૬% ના ડિલેન્ચર અહીં ડિલેન્ચર પર ૬% ના દરે ગણાશે.

આવકવેરા ધારા મુજબ, ડિલેન્ચર હોલ્ડર્સને ડિલેન્ચર પર વ્યાજ ચૂકવતાં પહેલાં કંપની ધ્વારા વ્યાજની કુલ (ગ્રોસ) રકમ પર નિર્ધારિત દરે આવકવેરો બાદ કરી બાકીની રકમ ડિલેન્ચર હોલ્ડર્સને ચૂકવવાની હોય છે. આ રકમ ડિલેન્ચર હોલ્ડર્સ વતી કંપનીએ આવકવેરા વિભાગમાં જમા કરવાની હોય છે. જેને મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરા કહેવામાં આવે છે. (T.D.S)

જ્યારે કંપની ધ્વારા હિસાબી સમય પુરો થયા બાદ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે તારીખના તફાવતના કારણે ડિલેન્ચર પર લેણું થયેલું કે ચેદેલું વ્યાજ અંગેની અસરો આપવી પડે છે.

લેણું થયેલ કે ચેદેલ વ્યાજ અંગેની રીત:

(૧) ચેદેલું વ્યાજ અને ચૂકવવાપાત્ર

દા.ત.: જો કંપની ડિલેન્ચર પર વ્યાજ ૩૦મી જુન અને ૩૧મી ડિસેમ્બર એમ અર્ધ-વાર્ષિક ચૂકવતી હોય અને પાંચ સરવેચું ૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ તૈયાર કરવામાં આવે ત્યારે ૩૧મી માર્ચ, ૨૦૧૭નું અર્ધવાર્ષિક વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો તેને ચેદેલું કે લેણું થયેલ વ્યાજ અને ચૂકવવાપાત્ર એમ કહેવાશે.

(૨) ચેદેલું વ્યાજ પરંતુ ચૂકવવાપાત્ર નહિ

ઉપર આપેલ (૧) માં તારીખ ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીનું ડિલેન્ચર પરંતુ વ્યાજ ચેદેલું વ્યાજ પરંતુ ચૂકવવાપાત્ર નહિ તેમ ગણાશે.

ઉદાહરણ ૬. બિનોય લિમિટેડના ૧ એપ્રિલ, ૨૦૧૭ ના રોજ રૂ ૧૦૦ની મૂળકિંમતના ૧૧% ના ૧૫,૦૦૦ ડિલેન્ચર બહાર પાડ્યા. જેના પર ૩૦ સપ્ટેમ્બર અને ૩૧ માર્ચના રોજ વ્યાજ ચૂકવવાનું છે. તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષ માટે ઉપરના વ્યવહારો અંગેની આમનોંધ પસાર કરો. ધારોકે આવકવેરાનો દર ૨૦% છે.

બિનોથ લિમિટેડ કંપનીના ચોપડામાં આમનોંધ

તારીખ	વિગત	ખ.પા	ઉદ્યાર રૂ	જમા રૂ
૧-૪-૨૦૧૭	બેંક ખાતે ૬ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે (બા.કે. ૧૫,૦૦૦ ડિબેન્ચર પર, ડિબેન્ચર દીઠ રૂ ૧૦૦ના નાણાં મળ્યા તેના)	૬	૧૫,૦૦,૦૦૦	૧૫,૦૦,૦૦૦
૧-૪-૨૦૧૭	ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ૬ તે ૧૧% ના ડિબેન્ચર ખાતે (બા.કે. ડિબેન્ચર અરજી વખતે મળોલ રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના)	૬	૧૫,૦૦,૦૦૦	૧૫,૦૦,૦૦૦
૩૦-૬-૨૦૧૭	ડિબેન્ચર પર વ્યાજ ખાતે ૬ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે તે મૂળ સ્થાનેથી કપાયેલ ચુક્કવવાપાત્ર આવકયેરા ખાતે (બા.કે. ૩૦ સપ્ટેમ્બરે ૧૧ %ના ડિબેન્ચર પર વ્યાજ લેણું થયું તેમાં આવકયેરો બાદ કર્યો તેના)	૬	૮૨,૫૦૦	૫૫,૦૦૦
૩૦-૬-૨૦૧૭	ડિબેન્ચર હોલ્ડર ખાતે ૬ તે બેંક ખાતે (બા.કે. વ્યાજ ચુક્કવ્યું તેના)	૬	૫૫,૦૦૦	૫૫,૦૦૦
૩૦-૬-૨૦૧૭	મુણ સ્થાનેથી કપાયેલ ચુક્કવવાપાત્ર આવકયેરા ખાતે ૬ તે બેંક ખાતે (બા. જે. આવકયેરાની રકમ આવકયેરા વિભાગમાં ભરી તેના)	૬	૧૫,૫૦૦	૧૫,૫૦૦
૩૧-૩-૨૦૧૮	ડિબેન્ચર પર વ્યાજ ખાતે ૬ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે તે મૂળ સ્થાનેથી કપાયેલ ચુક્કવવાપાત્ર આવક વેરા ખાતે (બા.જે. ૩૧ માર્ચના રોજ ડિબેન્ચર પર વ્યાજ લેણું થયું અને તેમાંથી આવકયેરો બાદ કર્યો તેના)	૬	૮૨,૫૦૦	૫૫,૦૦૦
૩૧-૩-૨૦૧૮	ડિબેન્ચર હોલ્ડર ખાતે ૬ તે બેંક ખાતે (બા.કે. વ્યાજ ચુક્કવ્યું તેના)	૬	૫૫,૦૦૦	૫૫,૦૦૦
૩૧-૩-૨૦૧૮	મુણ સ્થાનેથી કપાયેલ ચુક્કવવાપાત્ર આવકયેરા ખાતે ૬ તે બેંક ખાતે (બા.કે. આવકયેરાની રકમ આવકયેરામાંથી ભરી તેના)	૬	૧૫,૫૦૦	૧૫,૫૦૦
૩૧-૩-૨૦૧૮	નફા-નુકશાન પત્રક ખાતે ૬ તે ડિબેન્ચર પરના વ્યાજ ખાતે	૬	૧,૫૫,૦૦૦	૧,૫૫,૦૦૦

(બા.જે. પૂર્ણ વર્ષની વ્યાજની રકમ નક્શા-નુકશાન પત્રક ખાતે લઈ ગયા તેના) (૮૨,૫૦૦ + ૮૨,૫૦૦)			
	કુલ સંખ્યાઓ	૩૪,૯૫,૦૦૦	૩૪,૯૫,૦૦૦

૨.૬ ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે

ડિબેન્ચરનાં નાણાં પરત કરવામાં આવે ત્યારે નીચેની આમનોંધ પસાર થાય છે.

(૧)	ડિબેન્ચરના નાણાં પરત કરવાના સમયે ડિબેન્ચર ખાતું બંધ કરી ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવું.			
	ડિબેન્ચર ખાતે	૩		---
	તે ડિબેન્ચર હોલ્ડર ખાતે			---
(૨)	જ્યારે શેર હોલ્ડરને નાણાં પરત કરવામાં આવે ત્યારે			
	ડિબેન્ચર હોલ્ડર ખાતે	૩		---
	તે બેંક ખાતે			---

૨.૧૦ પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો

ડિબેન્ચર મૂળકિંમતે, પ્રિમીયમથી કે વટાવથી બહાર પાડી શકાય છે. પરંતુ જ્યારે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર મૂળકિંમતથી કે પ્રિમીયમથી જ પરત કરી શકાય છે. વટાવથી ડિબેન્ચર પરત કરી શકતાં નથી.

જ્યારે ડિબેન્ચર તેની મુળકિંમતે પરત કરવાના હોય, તેવા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડતી કોઈ વધારાની અસર સાથે આમનોંધ પસાર કરવામાં આવતી નથી. આ બાબતોનો નીચેના ટેબલ દ્વારા અભ્યાસ કરી શકાશે.

પરિસ્થિતિ (શરત)	ડિબેન્ચર બહાર પાડતી વખતે નોંધ	ડિબેન્ચર પરત કરી વખતે નોંધ	ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવે નોંધ
(૧) ડિબેન્ચર મૂળકિંમતે બહાર પાડી મૂળકિંમતે પરત કરવાના હોય ત્યારે	(૧) બેંક ખાતે.... ૬ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે (૨) ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે.... ૬ તે ડિબેન્ચર ખાતે	ડિબેન્ચર ખાતે..... ૬ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે	ડિબેન્ચર હોલ્ડર ખાતે.. ૬ તે બેંક ખાતે
(૨) ડિબેન્ચર પ્રિમીયમથી બહાર પાડી મૂળકિંમતે પરત કરવાના હોય ત્યારે	(૧) બેંક ખાતે.... ૬ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે (૨) ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે.... ૬ તે ડિબેન્ચર ખાતે તે જામીનગરી પ્રિમીયમ અનામત ખાતે	ડિબેન્ચર ખાતે..... ૬ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે	ડિબેન્ચર હોલ્ડર ખાતે.. ૬ તે બેંક ખાતે

(3) ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળકિમતે પરત કરવાના હોય ત્યારે	(૧) બેન્ક ખાતે..... ઉ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે (૨) ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે.... ઉ ડિબેન્ચર વટાવ ખાતે ... ૬ તે ડિબેન્ચર ખાતે	ડિબેન્ચર ખાતે..... ઉ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે	ડિબેન્ચર હોલ્ડર ખાતે... ઉ તે બેક ખાતે
--	--	--	---------------------------------------

૨.૧૧ જ્યારે ડિબેન્ચર મૂળકિમતે કે પ્રિમીયમથી કે વટાવથી બહાર પાડ્યા હોય અને આ ડિબેન્ચર પ્રિમીયમથી પરત કરવાના હોય ત્યારે

ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રિમીયમ એ કંપની માટે ખોટ (મૂડી નુકશાન) છે. તેથી આ પરતના પ્રિમીયમની રકમ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાન ખાતે ઉધારવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાનને ડિબેન્ચર પરતનાં નુકશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ ભવિષ્યમાં આપવાનું થતું આ પ્રિમીયમ એ કંપની માટે દેવું છે. જેથી પ્રિમીયમની રકમ ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે જમા કરવામાં આવે છે.

અહીં વિદ્યાર્થીઓએ દ્વારાનાં રાખવાનું કે ડિબેન્ચર બહાર પાડતી વખતે મંગાવેલ પ્રિમીયમ જે જામિનગીરી પ્રિમીયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. તે કંપની માટે નશે છે. જ્યારે ડિબેન્ચર પરત કરતી વખતે ચૂકવવાનું થતું પ્રિમીયમ જે ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે લઈ જવામાં આવે છે. તેને કંપની માટે દેવું કહે છે.

જ્યારે ડિબેન્ચર પ્રિમીયમથી પરત કરવાના હોય ત્યારે જુદીજુદી પરિસ્થિતિમાં નીચે પ્રમાણે આમનોંધ લખાશે.

(૧) જ્યારે ડિબેન્ચર મૂળકિમતથી બહાર પાડ્યા હોય, તે પ્રિમીયમથી પરત કરવાના હોય ત્યારે,

(અ) ડિબેન્ચર બહાર પાડતી વખતે.

(૧) બેન્ક ખાતે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે	૬	(ડિબેન્ચરની મૂળ કિમત) (ડિબેન્ચરની મૂળ કિમત)
(૨) ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાન ખાતે તે ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે	૬ ૬	(ડિબેન્ચરની મૂળ કિમત) (પરત કરતી વખતે થતી પ્રિમીયમની રકમ) (ડિબેન્ચરની મૂળ કિમત) (પરત કરતી વખતે થતી પ્રિમીયમની રકમ)

(બ) ડિબેન્ચર પરત કરતી વખતે.

ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે	૬ ૬	(ડિબેન્ચરની મૂળ કિમત) (પરત પ્રિમીયમની રકમ) (કુલ ચૂકવેલ રકમ)
--	--------	---

(ક) ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવે ત્યારે

ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે તે બેન્ક ખાતે	૬	(કુલ ચૂકવેલ રકમ)
---	---	------------------

(૨) જ્યારે ડિબેન્ચર પ્રિમીયમથી બહાર પાડ્યા હોય, તે પ્રિમીયમથી પરત કરવાના હોય ત્યારે,
(અ) ડિબેન્ચર બહાર પાડતી વખતે.

(ફ) બેન્ક ખાતે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે	૩	(મૂળ કિંમત + પ્રિમીયમની રકમ)
(બ) ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાન ખાતે	૩	(મૂળ કિંમત + પ્રિમીયમની રકમ) (ડિબેન્ચર પરત કરતી વખતે થતી પ્રિમીયમની રકમ) (ડિબેન્ચરની મૂળ કિંમત) (ડિબેન્ચર બહાર પાડતી ભણેલ પ્રિમીયમ) (ડિબેન્ચર પરત કરતી વખતે થતી પ્રિમીયમની રકમ)
તે ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે તે ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે	૩	

ડિબેન્ચર પરત કરતી વખતે અને ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરતી વખતે થતી આમનોંધ ઉપર પ્રમાણો ૧
(બ) અને ૧ (ક) મુજબ જ થશે.

૨.૧૨ કંપનીના પાકા સરવૈયામાં સ્થાન

ડિબેન્ચર વટાવ ખાતાની રકમ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાન ખાતાની રકમમાંથી ડિબેન્ચરની મુદ્દત પ્રમાણે દર વર્ષે અમુક રકમ જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતાની સામે કે નફા-નુકશાનના પત્રકમાં માંડી વાળવામાં આવે છે.

નફા નુકશાનના પત્રક ખાત	૩	---	---
કે જામીનગીરી પ્રિમીયમ અનામત ખાતે	૩	---	---
તે ડિબેન્ચર વટાવ ખાતે			---
તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાન ખાતે			---

ડિબેન્ચર વટાવ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકશાન ખાતે આ બંને ખાતાની બાકી રહેતી રકમ દર વર્ષે પાકા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિનચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે.

જ્યારે ડિબેન્ચર પરત પ્રિમીયમખાતું એ વ્યક્તિ ખાતું છે. જેની જમા બાકી હોય છે. કંપની માટે આ એક પ્રકારની જવાહદારી છે જે પાકા સરવૈયામાં દિક્ષિટી અને જવાહદારી બાજુ બિનચાલુ જવાહદારી (ના શીર્ષક હેઠળ અન્ય લાંબાગાળાના દેવા ની નીચે જ્યાં સુધી ડિબેન્ચર પરત ના થાય ત્યાં સુધી દર્શાવવામાં આવે છે.

જ્યારે ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતું ઉધાર કરી ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા કરીને આ ખાતું બંધ કરી દેવામાં આવે છે.

ઉદારણ ૧૦ નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખો.

(બાબત જે વગર)

(૧) ₹ ૧૦૦ની મૂળ કિંમતના ૧૦ ટકાના ૫૦૦૦ ડિબેન્ચર મૂળકિંમતે જ બહાર પાડ્યા, જે મૂળકિંમતે પરત કરવાના છે.

(૨) ₹ ૧૦૦ની મૂળ કિંમતના ૧૦ ટકાના ૫૦૦૦ ડિબેન્ચર ૫ ટકાના વટાવે બહાર પાડ્યા, જે મૂળકિંમતે પરત કરવાના છે.

(3) ₹ 100ની મૂળ કિંમતના 10 ટકાના 4000 ડિબેન્ચર રુ ટકાના પ્રિમીયમને બહાર પાડયા, જે મૂળ કિંમતે પરત કરવાના છે.

કંપનીની આમનોંધ

(1) ડિબેન્ચર દીઠ બહાર પાડયા કિંમત ₹ 100 પરત કિંમત ₹ 100

તારીખ	વિગત	ખા.પા	ઉધાર ₹	જમા ₹
(i)	બેન્ક ખાતે ૩ તે ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે		4,00,000	
				4,00,000
(ii)	ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે ૩ તે 10 ટકાના ડિબેન્ચર ખાતે		4,00,000	
				4,00,000

(2) ડિબેન્ચર દીઠ બહાર પાડયા કિંમત ₹ 65 પરત કિંમત ₹ 100.

તારીખ	વિગત	ખા.પા	ઉધાર ₹	જમા ₹
(i)	બેન્ક ખાતે ૩ ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે ૩ તે ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે		4,75,000 25,000	
				4,00,000
(ii)	ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે ૩ તે 10 ટકાના ડિબેન્ચર ખાતે		4,00,000	
(iii)	બેન્ક ખાતે ૩ તે ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે તે જામનગરી પ્રમિયમ અનામત ખાતે ડિબેન્ચર અરજુ અને મંજૂરી ખાતે ૩ તે 10 ટકાના ડિબેન્ચર ખાતે		4,80,000 4,00,000 4,000 4,00,000	
				4,00,000

૨.૧૩ ડિબેન્ચર વટાવ માંડી વાળવો :

ડિબેન્ચર બહાર પાડતી સમયે આપેલ વટાવ એ કંપની માટે ખોટ નુકશાન છે. પરંતુ તે વર્ષે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે છે. તે જ વર્ષે તેને માંડીવાળવામાં આવતો નથી. પરંતુ કમશા: કંપનીને ડિબેન્ચરનો લાભ જેટલા વર્ષ સુધી મળવાનો છે તે વર્ષોના ગુણોત્તરમાં માંડી વાળવામાં આવે છે.

ડિબેન્ચર વટાવ નીચેની પદ્ધતિઓ માંડી વાળી શકાય છે.

- જે ડિબેન્ચર ચોક્કસ મુદ્દે પરત કરવાના હોય તો આપેલી મુદ્દતના સમયગાળામાં સરખે ભાગે વટાવ માંડીવાળી શકાય.
- જો ડિબેન્ચર દર વર્ષે અમૃક વ્યાજ લેખે માંડીવાળવાના હોય તો બાકી રહેતી ડિબેન્ચરની ચૂકૃવાળી રકમના પ્રમાણામાં માંડીવાળી શકાય.
- જો ડિબેન્ચર પરત ન કરી શકાય તેવા પ્રકારના હોય તો વટાવ ચોંગ્ય સમય મર્યાદામાં માંડીવાળી શકાય.

ઉદાહરણ નું. ધારો કે આલ્ફા કંપનીઓ તારીખ: ૦૧-૦૧-૨૦૧૪ના રોજ રૂ ૧૦,૦૦,૦૦૦(દસ લાખ)ના ડિબેન્ચર ૧૨% ના વટાવના દરે બહાર પાડ્યા છે. અને દર વર્ષે રૂ ૨,૦૦,૦૦૦ પરત કરવાના છે. આ સમયે ડિબેન્ચરનો વટાવ ડેલી રીતે માંડીવાળી શકાય.

ઉપરોક્ત ઉદાહરણની ગણતરી કરીએ તો

$$\text{ડિબેન્ચર વટાવની રકમ} = ૧૦,૦૦,૦૦૦ \times ૧૨ \% \text{ વટાવ} = ૧,૨૦,૦૦૦ \text{ વટાવ}$$

હવે દર વર્ષે ૨,૦૦,૦૦૦ પરત ચુકવવામાં આવે છે. એટલ દર વર્ષે ડિબેન્ચર ચુકવવાની જબાવદારી ઘટે છે. તેમ તેના વટાવની જવાબદારી પણ નફા- નુકશાન ખાતે ઘટ્યી જોઈએ. આમ નીચે પ્રમાણે ગણતરી શક્ય બને.

તારીખ	₹	વિગત (ચૂકવણી બાકી)
૦૧-૦૧-૨૦૧૪	૧૦,૦૦,૦૦૦	ડિબેન્ચરની રકમ
૩૧-૧૨-૨૦૧૪	૨,૦૦,૦૦૦	ચુકવેલ રકમ
૦૧-૦૧-૨૦૧૫	૮,૦૦,૦૦૦	ચૂકવવાની બાકી
૩૧-૧૨-૨૦૧૫	૨,૦૦,૦૦૦	ચૂકવેલ રકમ
૦૧-૦૧-૨૦૧૬	૬,૦૦,૦૦૦	ચૂકવવાની બાકી
૩૧-૧૨-૨૦૧૬	૨,૦૦,૦૦૦	ચૂકવેલ રકમ
૦૧-૦૧-૨૦૧૭	૪,૦૦,૦૦૦	ચૂકવવાની બાકી
૩૧-૧૨-૨૦૧૭	૨,૦૦,૦૦૦	ચૂકવેલ રકમ
૦૧-૦૧-૨૦૧૮	૨,૦૦,૦૦૦	ચૂકવવાની બાકી
૩૧-૧૨-૨૦૧૮	૨,૦૦,૦૦૦	ચૂકવેલ રકમ
૦૧-૦૧-૨૦૧૯	---	

હવે ૧,૨૦,૦૦૦ રૂપિયાના વટાવને ડિબેન્ચરની ચુકવવાની બાકી રકમના પ્રમાણમાં માંડી વાળવા માટે તેનું પ્રમાણ નીચે જણાવ્ય મુજબ ગણી શકાય.

૩૧-૧૨-૨૦૧૪	$1,20,000 \times \frac{10}{30}$	૪૦,૦૦૦
૩૧-૧૨-૨૦૧૫	$1,20,000 \times \frac{08}{30}$	૩૨,૦૦૦
૩૧-૧૨-૨૦૧૬	$1,20,000 \times \frac{05}{30}$	૨૪,૦૦૦
૩૧-૧૨-૨૦૧૭	$1,20,000 \times \frac{04}{30}$	૧૬,૦૦૦
૩૧-૧૨-૨૦૧૮	$1,20,000 \times \frac{02}{30}$	૮,૦૦૦

ઉપરોક્ત વટાવને ડિબેન્ચર વટાવાય તો નીચે પ્રમાણે નોંધી શકાય.

ડિબેન્ચર વટાવખાતું

૬.			૪.		
તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૦૧-૦૧-૨૦૧૪	ડિબેન્ચર ખાતે	૧,૨૦,૦૦૦	૩૧-૧૨-૨૦૧૪	ન. નુકશાન ખાતે	૪૦,૦૦૦
				બા. આ. લઈ ગયા	૮૦,૦૦૦
		૧,૨૦,૦૦૦			૧,૨૦,૦૦૦
૦૧-૦૧-૨૦૧૫	બા.આ. લાવ્યા	૮૦,૦૦૦	૩૧-૧૨-૨૦૧૫	ન.નુકશાન ખાતે	૩૨,૦૦૦
				બા.આ.લઈ ગયા	૪૮,૦૦૦
		૮૦,૦૦૦			૮૦,૦૦૦
૦૧-૦૧-૨૦૧૬	બા.આ. લાવ્યા	૪૮,૦૦૦	૩૧-૧૨-૨૦૧૬	ન.નુકશાન ખાતે	૨૪,૦૦૦
				બા.આ.લઈ ગયા	૨૪,૦૦૦
		૪૮,૦૦૦			૪૮,૦૦૦
૦૧-૦૧-૨૦૧૭	બા.આ. લાવ્યા	૨૪,૦૦૦	૩૧-૧૨-૨૦૧૭	ન.નુકશાન ખાતે	૧૬,૦૦૦
				બા.આ.લઈ ગયા	૮,૦૦૦
		૨૪,૦૦૦			૨૪,૦૦૦
૦૧-૦૧-૨૦૧૮	બા.આ. લાવ્યા	૮,૦૦૦	૩૧-૧૨-૨૦૧૮	ન.નુકશાન ખાતે	૮,૦૦૦
		૮,૦૦૦			૮,૦૦૦

૨.૧૪ ડિબેન્ચર પરત કરવાની પદ્ધતિઓ

ડિબેન્ચરના નાણાં નીચે મુજબ મુખ્ય ચાર રીતોએ પરત થાય છે.

- (૧) ભવિષ્યમાં અમુક ચોક્કસ તારીખે નાણાં પરત કરવાઃ રિડીમેન્ચર ભવિષ્યમાં અમુક નિશ્ચિત તારીખે પરત કરવાના હોય ત્યારે ડિબેન્ચર સાઇફિકેટની પાછળ જણાવેલી શરતોમાં તેનો ઉદ્દેશ હોય છે. કેટલીક વાર અગાઉથી તારીખ નક્કી કરવામાં આવતી નથી. પરંતુ કંપની અમુક સમય પછી અમુક મુદ્દાની નોટિસ આપી ડિબેન્ચરના નાણાં પરત કરે છે.
- (૨) ખુલ્લા બજારમાંથી ખરીદીઃ કંપનીને પોતાના ડિબેન્ચર ખરીદવાની છુટ છે. ડિબેન્ચર બહાર પાડતી વખતે કેટલીક વાર એવી જોગવાઈ કરવામાં આવે છે કે કે કંપની ખુલ્લા બજારમાંથી બજાર ભાવે ડિબેન્ચર ખરીદી તે ર૯ કરી શકશે. ખાસ કરીને જ્યારે ડિબેન્ચરનો બજાર ભાવ ઓછો હોય ત્યારે કંપનીને ફાયદો થાય છે.
- (૩) દર વર્ષે અમુક સંખ્યામાં ડિબેન્ચર પરત કરવાઃ કંપની ડિબેન્ચર બહાર પાડવાની શરતોમાં એવી જોગવાઈ કરી શકે કે દર વર્ષે અમુક ડિબેન્ચર પરત કરી શકશે. આ માટે દર વર્ષે કેટલી સંખ્યામાં ડિબેન્ચર પરત કરવાં તે અગાઉથી નક્કી કરે છે અથવા ચિહ્નાઓ ઉપાડી નક્કી કરે છે.
- (૪) ડિબેન્ચર હોલ્ડરો પાસેથી પાછા ખરીદીને કેટલીક વાર કંપની ડિબેન્ચર બહાર પાડવાં પછી એવી જોગવાઈ રાજે છે કે ડિબેન્ચર બહાર પાડવા પછી એક વર્ષનીની મુદ્દા પુરી થયે દર વર્ષે અમુક કિંમત સુધીમાં ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડરને પરત કરવા માગે તો પાછા લઈ લેશે. અને તેની મૂળ કિંમત તે ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે. પરંતુ બજારમાં આવો ડિબેન્ચર મૂળ કિંમતથી ઓછી કિંમતે વેચાતાં હોય તો કોઈ વ્યક્તિ તેની ખરીદી કર્યા બાદ કંપની પાસે પૂરી કિંમત વસુલ કરી તેનો દુરપયોગ કરી શકે. તેથી એવી જોગવાઈ કરવામાં આવે છે કે આ રીતે જે ડિબેન્ચર હોલ્ડર પોતાનાં ડિબેન્ચરના નાણાં કંપની પાસેથી આ રીતે પરત મેળવવા ભાગતો હોય તેણે તે ડિબેન્ચર ઓછામાં ઓછા એક વર્ષ માટે ધારણ કરેલાં હોવાં જોઈએ.

આ અંગે હિસાબી નોંધ હંમેશા મુજબ જ થાય છે. પ્રથમ નોંધમાં પરત કરવાની રકમથી ડિબેન્ચર ખાતું ઉધારી ડિબેન્ચર હોલ્ડરનું ખાતું જમા થાય છે અને બીજું નોંધ ખરેખર નાણાં ચુકવવા અંગે થાય છે.

ડિબેન્ચર પરત કરવાની રીતો



ભવિષ્યમાં નક્કી તારીખે પરત	ખુલ્લા બજારમાંથી ખરીદીને ર૯ કરવાં	દર વર્ષે અમુક ડિબેન્ચર પરત કરવાં	પુનઃ ખરીદી ઢારા પરત	ઝ્યાંતર ઢારા પરત
----------------------------	-----------------------------------	----------------------------------	---------------------	------------------

૨.૧૫ ડિબેન્ચર પરત માટેની નાણાંની જોગવાઈ

નિશ્ચિત મુદ્દે નાણાં પરત કરવાનાં હોય ત્યારે કંપનીને અગાઉથી ખબર હોય છે કે કેટલાં વર્ષ પછી ડિબેન્ચરના નાણાં પરત કરવાનાં છે. એટલે કે તે દર વર્ષે નિશ્ચાંથી થોડી રકમ અલગ રાખી એક ભડોળ ઉભું કરે છે. જો આમ કરવામાં નહિ આવે તો જે વર્ષ ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય તે વર્ષ ધંધાની કાર્યર્થીલ મૂડી ખુબ ઘટી જશો. જે ચોંગ નથી. આ માટે બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

- (૧) ફૂબતનિધિ અથવા ડિબેન્ચર પરત નિધિ ની રીતે
(૨) વીમા પોલિસીની રીતે અથવા ડિબેન્ચર પોલિસીની રીતે

(૧) ડિબેન્ચર પરત નિધિની રીત

આ પદ્ધતિ મુજબ કંપની દર વર્ષે પોતાના નફામાંથી અમુક રકમ જુદી કાઢે છે. આ રકમ ફૂબત નિધિના તૈયાર કોણાઓ પરથી નક્કી થાય છે. આ રકમ એટલી હોવી જોઈએ કે વર્ષો વર્ષ મળતા વ્યાજ સાથે કુલ રકમ મુદ્દત પૂરી થતાં સુધીમાં ચુકવવાની રકમ જેટલી થઈ રહે. દર વર્ષે નફામાંથી અલગ રાજેલી રકમ ફૂબત નિધિ ખાતે જમા કરવામાં આવે છે અને દર વર્ષે તેનું રોકાણ કરવામાં આવે છે. આ રોકાણ પર વ્યાજ મળે તે પણ દર વર્ષે રોકવામાં આવે છે. આમનોંધ નીચે મુજબ થાય છે.

પ્રથમ વર્ષને અંતે

- (૧) નફામાંથી નક્કી કરેલી રકમ જુદી રાખવા માટે

નફા નુકશાન ફાળવણી ખાતે.....	૩	***	
તે ડિબેન્ચર પરત નિધિ ખાતે			***

- (૨) આ રકમનું રોકાણ કરવા અંગે

ડિબેન્ચર પરત નિધિ રોકાણ ખાતે.....	૩	***	
તે બેંક ખાતે			***

બીજા વર્ષને અંતે

- (૧) ગયાં વર્ષના રોકણો પર વ્યાજ મળે ત્યારે

બેંક ખાતે.....	૩	***	
તે ડિબેન્ચર પરત નિધિ ખાતે			***

- (૨) નફામાંથી નક્કી કરેલી રકમ જુદી રાખવા માટે

નફા નુકશાન ફાળવણી ખાતે.....	૩	***	
તે ડિબેન્ચર પરત નિધિ ખાતે			***

- (૩) નફામાંથી ફાળવેલ રકમ થતા રોકણો પર વ્યાજની મળેલ રકમનું રોકાણ કરવા અંગે

ડિબેન્ચર પરત નિધિ રોકાણ ખાતે.....	૩	***	
તે બેંક ખાતે			***

ચાદ રાખો કે : ડિબેન્ચર પરત નિધિના રોકણો પર મળેલ વ્યાજ ડિબેન્ચર પરત નિધિ ખાતે જમા થાય છે. નફા નુકશાન ખાતે નહિ.

આ રીતે દર વર્ષે ઉપર મુજબ જ આમનોંધ થશે. ડિબેન્ચર પરત નિધિ પાકા સરવૈચામાં ટેવાં બાજુ અને ડિબેન્ચર પરત નિધિ રોકણો મિલકત બાજુ દર્શાવવામાં આવશે. બંને ખાતામાં લગભગ સરખીજ બાકીઓ રહેશે.

ઉદાહરણ ૧૨. આલ્ફા હોટલ્સ કંપની લિમિટેડ ૧ લી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ રૂ ૧૦૦નો એવાં ૧૫ %ના ૧૦૦૦ ડિબેન્ચર બહાર પાડ્યા છે. તેના નાણાં ૧૦%ના પ્રિમીયમે પરત કરવાનાં છે. ડિબેન્ચર બહાર પાડવાની શરતોમાંથી એક શરત મુજબ કંપનીએ ત્રણ વર્ષને અંતે ડિબેન્ચરો પરત કરવામાં આવે ત્યાં સુધી ડિબેન્ચર પરત નિધિ ઉલ્લું કરવું જોઈએ અને તેનું એવી રીત રોકાણ કરવું જોઈએ કે જેથી રોકાણો પર પક્ષ વ્યાજ મળે. આ માટે ડિરેક્ટરોએ દર વર્ષ રૂ ૩૪,૮૮૩ પરત નિધિ ખાતે લઈ જવા છાય્યું. ત્રીજા વર્ષને અંતે જામીનગીરીઓ રૂ ૭૧,૫૮૦માં વેચવામાં આવી અને ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવ્યા.

ઉપરના વ્યવહારો પરથી ડિબેન્ચર પરત નિધિ તેમજ ડિબેન્ચર પરત નિધિ રોકાણોના ખાતાં તૈયાર કરો.

જવાબ:

ડિબેન્ચર પરત નિધિ ખાતું

૬.	૭.				
તારીખ ૨૦૧૫ ડિસે, ૩૧	વિગત બાકી આગળ લઈ ગયા	રૂ ૩૪,૮૮૩	તારીખ ૨૦૧૫ ડિસે, ૩૧	વિગત નફા નુકશાન ફાળવણી ખાતે	રૂ ૩૪,૮૮૩
૨૦૧૬ ડિસે, ૩૧	બાકી આગળ લઈ ગયા	<u>૩૪,૮૮૩</u> <u>૭૧,૫૩૧</u>	જાન્યુ. ૧	બાકી આગળ લાવ્યા	<u>૩૪,૮૮૩</u>
		<u>૭૧,૫૩૧</u>	ડિસે. ૩૧	બેંક ખાતે (વ્યાજ) નફા નુકશાન ફાળવણી ખાતે	૧,૭૪૫ <u>૩૪,૮૮૩</u>
૨૦૧૭ ડિસે, ૩૧	સામાન્ય અનામત ખાતે	૧,૧૦,૦૫૦	૨૦૧૭		<u>૭૧,૫૩૧</u>
		<u>૧,૧૦,૦૫૦</u>	જાન્યુ. ૧ ડિસે. ૩૧ ડિસે. ૩૧ ડિસે. ૩૧	બાકી આગળ લાવ્યા બેંક ખાતે (વ્યાજ) નફા નુકશાન ફાળવણી ખાતે ડિબેન્ચર પરત નિધિ રોકાણો ખાતે (નફા)	૭૧,૫૩૧ ૩,૫૭૭ <u>૩૪,૮૮૩</u> ૪૮ <u>૧,૧૦,૦૫૦</u>

ડિબેન્ચર પરત નિધિ રોકાણોનું ખાતું

૮.	૯.				
તારીખ ૨૦૧૫ ડિસે, ૩૧	વિગત બેંક ખાતે	રૂ ૩૪,૮૮૩	તારીખ ૨૦૧૫ ડિસે, ૩૧	વિગત બાકી આગળ લઈ ગયા	રૂ ૩૪,૮૮૩
		<u>૩૪,૮૮૩</u>			<u>૩૪,૮૮૩</u>
૨૦૧૬	બાકી આગળ લઈ ગયા	૩૪,૮૮૩	૨૦૧૬		
જાન્યુ. ૧		૩૪,૫૩૧	ડિસે. ૩૧	બાકી આગળ લઈ ગયા	૩૪,૫૩૧

કિસે. ૩૧	બેંક ખાતે	૩૬,૬૩૮			
		૭૧,૫૩૧			૭૧,૫૩૧
૨૦૧૭			૨૦૧૭		
જાન્યુ. ૧	બાકી આગળ લાવ્યા	૭૧,૫૩૧	કિસે. ૩૧	બેંક ખાતે વેચાણ	૭૧,૫૮૦
કિસે. ૩૧	ડિબેન્ચર પરત નિધિ ખાતે (નશો)	૪૯			
		૭૧,૫૮૦			૭૧,૫૮૦

ઉદાહરણીઃ તારીખ: ૩૧ મી માર્ચ, ૨૦૧૮ના રોજ શ્યામ લિમિટેડના ચોપડામાં નીચે પ્રમાણોની બાકીઓ હતી.

વિગત	₹
૧૦%ના ગીરો ડિબેન્ચર્સ	૨,૫૦,૦૦૦
ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર મળેલ વ્યાજ	૧૦,૦૦૦
ડિબેન્ચર બહાર પાડતા આપેલ વટાવ	૨૫,૦૦૦
ડિબેન્ચર પરત નિધિ	૨,૨૫,૦૦૦
૪.૫%ની ગુજરાત સરકારની લોન (મૂળ કિંમતે ખરીદેલ)	૧,૦૦,૦૦૦
૫%ના નેશનલ ડિફેન્સ બોન્ડ (દાર્શનિક કિંમત ₹ ૧,૪૦,૦૦૦)	૧,૨૫,૦૦૦

તે જ દિવસે નીચે મુજબ રોકાણો વેચવામાં આવ્યા. (૧) ગુજરાત સરકારની લોન ₹ ૮૭ના ભાવે અને (૨) નેશનલ ડિફેન્સ બોન્ડ ₹ ૧૦૨ ના ભાવે ૧૮૧ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ₹ ૧,૫૦,૦૦૦ના ડિબેન્ચર ૧૦%ના પ્રિમીયમે પરત કરવામાં આવ્યાં. તે જ દિવસે ₹ ૫૦,૦૦૦ની કેન્દ્ર સરકારની જામીનગરીઓ ૨% ના પ્રિમીયમે ખરીદવામાં આવી. ડિબેન્ચર પરત અંગેનો વાર્ષિક ફાળો ₹ ૨૫,૦૦૦ હતો.

કંપનીના ચોપડામાં ઉપરના વ્યવહારો નોંધવા જરૂરી આમનોંધ પસાર કરો.

જવાબ

(૧) ડિબેન્ચર પર નિધિનાં રોકાણો પર મળેલ વ્યાજ ₹ ૧૦,૦૦૦ ડિબેન્ચર પરત નિધિ ખાતે જમા થશે.

(૨) ડિબેન્ચર પરત નિધિના રોકાણો વેચતા નીચે મુજબ રકમ ઉપજુ

(૧) ગુજરાત સરકારની લોન ₹ ૧,૦૦,૦૦૦ X ૮૭/૧૦૦ =	₹ ૮૭,૦૦૦
(૨) નેશનલ ડિફેન્સ બોન્ડ ₹ ૧,૪૦,૦૦૦ X ૧૦૨/૧૦૦ =	₹ ૧,૪૨,૮૦૦
કુલ ઉપજ	₹ ૨,૩૮,૮૦૦
તે રોકાણોની ચોપડે કિંમત	
ગુજરાત સરકારની લોન	₹ ૧,૦૦,૦૦૦
નેશનલ ડિફેન્સ બોન્ડ	₹ ૧,૨૫,૦૦૦
	₹ ૨,૨૫,૦૦૦
નશો	₹ ૧૪,૮૦૦

- (3) કુલ ₹ ૨,૫૦,૦૦૦નાં ડિબેન્ચર પૈકી ₹ ૧,૫૦,૦૦૦ના ડિબેન્ચરો પરત કરી દેવામાં આવે છે. જેથી તેના પર પ્રમાણસર ડિબેન્ચર વટાવ પણ માંડી વાળવો પડશે.

$$\text{જે } ૨૫,૦૦૦ \times ૧,૫૦,૦૦૦ / ૨,૫૦,૦૦૦ = ₹ ૧૫,૦૦૦ \text{ થશે. આ રકમ ડિબેન્ચર પરતનિધિ ખાતે ઉદ્યારાશે. અને ડિબેન્ચર બહાર પાડતાં આપેલ વટાવ ખાતે જમા થશે.}$$
- (4) ₹ ૧,૫૦,૦૦૦ ના ડિબેન્ચર પરત કર્યા હોવાથી તેટલી રકમ ડિબેન્ચર પરતનિધિ ખાતેથી સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવશે.
- (5) દર વર્ષ ₹ ૨૫,૦૦૦નો ફાળો ડિબેન્ચર પરતનિધિ ખાતે જમા કરવામાં આવશે. આમ દર વર્ષ તેટલે અંશો ડિબેન્ચર પરતનિધિ વધતું જશે.

૧૦ % નાં ગીરો ડિબેન્ચરસનું ખાતું

૩.

જ.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૧-૪-૨૦૧૮	ડિબેન્ચર હોલ્ડર ખાતે	૧,૫૦,૦૦૦	૩૧-૩-૨૦૧૮	બાકી આગામ લાવ્યા	૨,૫૦,૦૦૦
	બાકી આગામ લઈ ગયા	૧,૦૦,૦૦૦			
		૨,૫૦,૦૦૦			૨,૫૦,૦૦૦

ડિબેન્ચર પરતનિધિ રોકાણોનું ખાતું

૬.

જ.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮ માર્ચ, ૩૧	બાકી આગામ લાવ્યા:		૨૦૧૮ માર્ચ, ૩૧	બેંક ખાતે:	
	લોન ૧,૦૦,૦૦૦			ગુજરાત સરકારની લોન	૮૭,૦૦૦
	બોન્ડ ૧,૨૫,૦૦૦	૨,૨૫,૦૦૦		નેશનલ ડિફેન્સ બોન્ડ	૧,૪૨,૮૦૦
માર્ચ ૩૧	ડિબેન્ચર પરતનિધિ ખાતે (નફો)	૧૪,૮૦૦	એપ્રિલ ૨૧	બાકી આગામ લઈ ગયા	૫૧,૦૦૦
એપ્રિલ ૧	બેંક ખાતે (ખરીદી)	૫૧,૦૦૦			
		૨,૬૦,૮૦૦			૨,૬૦,૮૦૦

ડિબેન્ચર પરતનિધિ ખાતું

૬.

જ.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮			૨૦૧૮		
એપ્રિલ ૧	ડિબેન્ચર પરત પ્રિ. ખાતે	૧૫,૦૦૦	માર્ચ, ૩૧	બાકી આગામ લાવ્યા	૨,૨૫,૦૦૦
	ડિબેન્ચર બહાર પાડતા આપેલ વટાવ ખાતે	૧૫,૦૦૦		ડિબેન્ચર પરતનિધિ રોકાણનું વ્યાજ	૧૦,૦૦૦
	સામાન્ય અનામત ખાતે	૧,૫૦,૦૦૦		ડિબેન્ચર પરતનિધિના રોકાણો ખાતે (નફો)	૧૪,૮૦૦
	બાકી આગામ લઈ ગયા	૮૪,૮૦૦		નફો નુકશાન ફાળવણી ખાતે	૨૫,૦૦૦
		૨,૭૪,૮૦૦			૨,૭૪,૮૦૦

ડિલેન્ચર હોલ્ડરોનું ખાતું

૬.

૭.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૧-૪-૨૦૧૮	બેંક ખાતે	૧,૫૫,૦૦૦	૧-૪-૨૦૧૮	ડિલેન્ચર ખાતે	૧,૫૦,૦૦૦
				ડિલેન્ચર પરત પ્રિ. ખાતે	૧૫,૦૦૦
		૧,૫૫,૦૦૦			૧,૭૫,૦૦૦

ડિલેન્ચર પરત પ્રિમીયમ ખાતું

૬.

૭.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૧-૪-૨૦૧૮	ડિલેન્ચર હોલ્ડરો ખાતે	૧૫,૦૦૦	૧-૪-૨૦૧૮	ડિલેન્ચર પરતનિધિ ખાતે (ટ્રાન્સફર)	૧૫,૦૦૦
		૧૫,૦૦૦			૧૫,૦૦૦

કંપનીના ચોપડે આમનોંધ

૬.

૭.

તારીખ	વિગત	ખ.પા	₹	₹
૩૧-૩-૨૦૧૮	બેંક ખાતે	૬	૨,૩૬,૮૦૦	
	તે ડિલેન્ચર પરતનિધિના રોકાણો ખાતે (બા.જે. રોકાણોનું વેચાણ)			૨,૩૬,૮૦૦
૩૧-૩-૨૦૧૮	ડિલેન્ચર પરતનિધિના રોકાણો ખાતે	૬	૧૪,૮૦૦	
	તે ડિલેન્ચર પરતનિધિ ખાતે (બા.જે. રોકાણો વેચતાં થયેલ નફો)			૧૪,૮૦૦
૧-૪-૨૦૧૮	૧૦ % ના ગીરે ડિલેન્ચર ખાતે	૬	૧,૫૦,૦૦૦	
	ડિલેન્ચર પરતનિધિ પ્રિમીયમે ખાતે	૬	૧૫,૦૦૦	
	તે ડિલેન્ચર હોલ્ડર ખાતે (બા.જે. ડિલેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકૃવધાના થયા)			૧,૫૫,૦૦૦
૧-૪-૨૦૧૮	ડિલેન્ચર હોલ્ડરો ખાતે	૬	૧,૫૫,૦૦૦	
	તે બેંક ખાતે (બા.જે. ડિલેન્ચરના નાણાં પરત કર્યો)			૧,૫૫,૦૦૦
૧-૪-૨૦૧૮	ડિલેન્ચર પરતનિધિના રોકાણોના વ્યાજ ખાતે	૬	૧૦,૦૦૦	
	તે ડિલેન્ચર પરતનિધિ ખાતે (બા.જે. વ્યાજ પરતનિધિ ખાતે જમા કર્યુ.)			૧૦,૦૦૦
૧-૪-૨૦૧૮	ડિલેન્ચર પરતનિધિ ખાતે	૬	૧૫,૦૦૦	
	તે ડિલેન્ચર પરતનિધિના પ્રિમીયમ ખાતે (બા.જે. પરત પ્રિમીયમ માંડી વાળ્યુ)			૧૫,૦૦૦

૧-૪-૨૦૧૮	ડિલેન્ચર પરતનિધિ ખાતે	૩		૧૫,૦૦૦	
	તે ડિલેન્ચર વટાવ ખાતે (બા.જે. ડિલેન્ચર વટાવ માંડી વાયો)				૧૫,૦૦૦
૧-૪-૨૦૧૮	નફ્સ નુકશાન ફાળવણી ખાતે	૩		૨૪,૦૦૦	
	તે ડિલેન્ચર પરતનિધિ ખાતે (બા.જે. વાષ્પિક હમાના જમા કર્યા.)				૨૪,૦૦૦
૧-૪-૨૦૧૮	ડિલેન્ચર પરતનિધિ ખાતે	૩		૧,૫૦,૦૦૦	
	તે સામાન્ય અનામત ખાતે (બા.જે. પરત કરેલ ડિલેન્ચર જેટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ ગયા)				૧,૫૦,૦૦૦
૧-૪-૨૦૧૮	ડિલેન્ચર પરતનિધિના રોકાણો ખાતે	૩		૫૧,૦૦૦	
	તે બેંક ખાતે (બા.જે. કેન્ઝ સરકાની જામીનગીરી ખરીદી)				૫૧,૦૦૦

ઉદાહરણ ૧૪.

(અ) H કંપનીના ચોપડામાં તારીખ: ૧-૧-૨૦૧૮ના રોજની બાકીઓ નીચે મુજબ હતી.

વિગત	₹
૧૨%ના ડિલેન્ચર્સ	૩,૦૦,૦૦૦
ડિલેન્ચર પરતનિધિ	૨,૨૫,૦૦૦
૮ % ના ડિલેન્ચર પરતનિધિના રોકાણો	૨,૨૫,૦૦૦

ઇં કંપની દર વર્ષે ₹ ૨૫,૦૦૦ ડિલેન્ચર પરતનિધિ ખાતે ફાળવે છે. રોકાણો પર વ્યાજ મેળવ્યા બાદ તારીખ: ૩૧-૧૨-૨૦૧૮ના રોજ કંપનીએ રોકાણો ૨૦ ટકા નફ્સ લઈ વેચી દીધા અને ₹ ૨,૪૦,૦૦૦ ના ડિલેન્ચરો ૧૦ ટકાના પ્રિમીયમે પરત કર્યા.

ઇં કંપનીના ચોપડે તારીખ: ૩૧-૧૨-૨૦૧૮ના રોજ આમનોંધ લખો.

(બ) S લિમિટેડના પોતાના ૧૨% ના ૧૦,૦૦૦ ડિલેન્ચર્સ દરેક ₹ ૧૦૦નો એક એવા પાંચ ટકાના પ્રિમીયમે પરત કરવા ડિલેન્ચર હોલ્ડર્સને નીચેના વિકલ્પો આપેલ છે.

	વિકલ્પો	ધારકોએ અપનાવેલ
૧	૧૦%ના પ્રેફરન્સ શેરો દરેક ₹ ૧૦૦નો ₹ ૮૦ લેખે ભરાવેલ ₹ ૧૨૦ના ભાવે	૫૦૦૦ ડિલેન્ચર્સ
૨	૧૫%ના નવા ડિલેન્ચર્સ દરેક ₹ ૧૦૦નો ૫ %ના વટાવે	૩૮૦૦ ડિલેન્ચર્સ
૩	રોકડમાં ચૂકવણી	૧૨૦૦ ડિલેન્ચર્સ

S લિમિટેડના ચોપડામાં ડિલેન્ચર પરત કરવા માટેની જોંધ લખો.

જવાબ:

(અ) H લિમિટેડના ચોપડામાં

૧૨ %નાં ગીરો ડિલેન્યર્સનું ખાતું

જ.

૬.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૩૧-૧૨-૨૦૧૮	ડિલેન્યર હોલ્ડર ખાતે	૨,૪૦,૦૦૦	૧-૧-૨૦૧૮	બાકી આગળ લાવ્યા	૩,૦૦,૦૦૦
૩૧-૧૨-૨૦૧૮	બાકી આગળ લઈ ગયા	૫૦,૦૦૦			
		૩,૦૦,૦૦૦			૩,૦૦,૦૦૦

ડિલેન્યર હોલ્ડરનું ખાતું

જ.

૭.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૩૧-૧૨-૨૦૧૮	બેંક ખાતે	૨,૫૪,૦૦૦	૩૧-૧૨-૨૦૧૮	ડિલેન્યર ખાતે	૨,૪૦,૦૦૦
				ડિલેન્યર પરત પ્રિ. ખાતે	૨૪,૦૦૦
		૨,૫૪,૦૦૦			૨,૫૪,૦૦૦

ડિલેન્યર પરત પ્રિમીયમ ખાતું

જ.

૮.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૩૧-૧૨-૨૦૧૮	ડિલેન્યર હોલ્ડર ખાતે	૨૪,૦૦૦	૩૧-૧૨-૨૦૧૮	ડિલેન્યર પરત નિધિ ખાતે	૨૪,૦૦૦
		૨૪,૦૦૦			૨૪,૦૦૦

ડિલેન્યર પરતનિધિ ખાતું

જ.

૯.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૩૧-૧૨-૨૦૧૮	ડિલેન્યર પરત પ્રિ. ખાતે	૨૪,૦૦૦	૧-૧-૨૦૧૮	બાકી આગળ લાવ્યા	૨,૨૫,૦૦૦
	સામાન્ય અનામત ખાતે	૨,૪૦,૦૦૦	૩૧-૧૨-૨૦૧૮	નશી નુકશાન ફાળવણી ખાતે	૨૫,૦૦૦
	બાકી આગળ લઈ ગયા	૪૮,૦૦૦		બેંક ખાતે (ડિલેન્યર પરતનિધિ રોકાણનું વ્યાજ)	૧૮,૦૦૦
				ડિલેન્યર પરતનિધિના રોકાણ ખાતે (નશી)	૪૫,૦૦૦
		૩,૧૩,૦૦૦			૩,૧૩,૦૦૦

ડિબેન્ચર પરતનિધિ રોકાણોનું ખાતું

૬.

૯.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૧-૧-૨૦૧૮	બાકી આગળ લાવ્યા	૨,૨૪,૦૦૦	૩૧-૧૨-૨૦૧૮	બેંક ખાતે	૨,૭૦,૦૦૦
૩૧-૧૨-૨૦૧૮	ડિબેન્ચર પરતનિધિ ખાતે (નફો)	૪૫,૦૦૦			
		૨,૭૦,૦૦૦			૨,૭૦,૦૦૦

H કંપનીના ચોપડે આમનોંધ

૬.

૯.

તારીખ	વિગત	મા.પા	₹	₹
૩૧-૧૨-૨૦૧૮	બેંક ખાતે	૬	૧૮,૦૦૦	૧૮,૦૦૦
	તે ડિબેન્ચર પરતનિધિ ખાતે			૧૮,૦૦૦
	(બા.જે. ₹ ૨,૨૪,૦૦૦ના ૮%ના રોકાણો પર ૧ વર્ષનું વ્યાજ મળ્યું)			
૩૧-૧૨-૨૦૧૮	નફો નુકશાન ફાળવણી ખાતે	૬	૨૪,૦૦૦	૨૪,૦૦૦
	તે ડિબેન્ચર પરતનિધિ ખાતે			૨૪,૦૦૦
	(બા.જે. વાર્ષિક હસાની રકમ નફો નુકશાન ફાળવણી ખાતેથી ડિબેન્ચર પરતનિધિ ખાતે લઈ ગયા)			
૩૧-૧૨-૨૦૧૮	બેંક ખાતે	૬	૨,૭૦,૦૦૦	૨,૭૦,૦૦૦
	તે ડિબેન્ચર પરતનિધિ રોકાણો ખાતે			૨,૭૦,૦૦૦
	(બા.જે. ₹ ૨,૨૪,૦૦૦ના ૨૦% નફો વેચી દીધા.)			
૩૧-૧૨-૨૦૧૮	ડિબેન્ચર પરતનિધિના રોકાણો ખાતે	૬	૪૫,૦૦૦	૪૫,૦૦૦
	તે ડિબેન્ચર પરતનિધિ ખાતે			૪૫,૦૦૦
	(બા.જે. ડિબેન્ચર પરતનિધિ રોકાણો વેચતાં થયેલ નફો ટ્રાન્સફર કર્યો)			
૩૧-૧૨-૨૦૧૮	ડિબેન્ચર ખાતે	૬	૨,૪૦,૦૦૦	૨,૪૦,૦૦૦
	ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે	૬	૨૪,૦૦૦	૨૪,૦૦૦
	તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે			૨,૫૪,૦૦૦
	(બા.જે. ₹ ૨,૪૦,૦૦૦ના ડિબેન્ચર ૧૦% પ્રિમીયમ પરત કરવાના હરાપ કર્યો તેના)			
૩૧-૧૨-૨૦૧૮	ડિબેન્ચર હોલ્ડરો ખાતે	૬	૨,૫૪,૦૦૦	૨,૫૪,૦૦૦
	તે બેંક ખાતે			૨,૫૪,૦૦૦
	(બા.જે. ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂક્યા)			
૩૧-૧૨-૨૦૧૮	ડિબેન્ચર પરતનિધિ ખાતે	૬	૨૪,૦૦૦	૨૪,૦૦૦

તે ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે				
(બા.જે. રૂ ૨૪,૦૦૦ના ડિબેન્ચર પરત કરતાં આપેલ પ્રિમીયમ ડિબેન્ચર પરતનિધિ ખાતે માંડી વાળું)				રૂ૪,૦૦૦
૩૧-૧૨-૨૦૧૮	ડિબેન્ચર પરતનિધિ ખાતે	૬	૨,૪૦,૦૦૦	
	તે સામાન્ય અનામત ખાતે			૨,૪૦,૦૦૦
(બા.જે. રૂ ૨૪,૦૦૦ના ડિબેન્ચર પરત કરતાં તેટલી રકમ ડિબેન્ચર પરતનિધિ ખાતેથી સામાન્ય અનામત ખાતે લઈ ગયા)				

જવાબ: (બ) ડિબેન્ચર હોલ્ડરોને જુદા જુદા અયેજ નીચે પ્રમાણે ચુકવાશે.

(૧) ૧૦%ના પ્રેફરન્સ શેર

$$\text{ચુકવાની રકમ } ૫૦૦૦ \times ૧૦૫ = રૂ ૫,૨૫,૦૦૦$$

રૂ ૧૨૦ ચુકવાના હોથ તો ૧ પ્રેફરન્સ શેર.

રૂ ૫,૨૫,૦૦૦ ચુકવાના હોથ તો (?)

$$૫,૨૫,૦૦૦ \times \frac{1}{120} = ૪૩૭૫ \text{ શેર}$$

(૧) ૪૩૭૫ શેરની મુળાક્ષિકા ૪૩૭૫ \times રૂ ૮૦ = રૂ ૩,૪૦,૦૦૦

(૨) ૪૩૭૫ શેર પર રૂ ૪૦ લેખે પ્રિમીયમ = રૂ ૧,૭૫,૦૦૦
રૂ ૫,૨૫,૦૦૦ ચુકવાના હોથ તો (?)

(૨) ૧૫%ના નવાં ડિબેન્ચર્સ

$$\text{ચુકવાની રકમ } ૩૮૦૦ \times ૧૦૫ = રૂ ૩,૬૬,૦૦૦$$

રૂ ૮૫ ચુકવાના હોથ તો ૧ નવો ડિબેન્ચર

રૂ ૩,૬૬,૦૦૦ ચુકવાના હોથ તો (?)

$$૩,૬૬,૦૦૦ \times \frac{1}{૮૫} = ૪૨૦૦ \text{ ડિબેન્ચર}$$

(૧) ૪૨૦૦ ડિબેન્ચરની મુળાક્ષિકા રૂ ૧૦૦ = રૂ ૪,૨૦,૦૦૦

(૨) ૪૨૦૦ ડિબેન્ચર પર ૫% લેખે વટાવ = રૂ ૨૧,૦૦૦
રૂ ૩,૬૬,૦૦૦

(૩) રોકડમાં

$$\text{ચુકવાની કુલ રકમ } ૧૨૦૦ \times ૧૦૫ = રૂ ૧,૨૬,૦૦૦$$

(૪) ચુકવાની કુલ રકમ (૧૦,૦૦૦ \times ૧૦૫)

$$\text{ચુકવાની કુલ રકમ } ૧૨૦૦ \times ૧૦૫ = રૂ ૧૦,૫૦,૦૦૦$$

પ્રેફરન્સ શેર ૫,૨૫,૦૦૦

નવા ડિબેન્ચર ૩,૬૬,૦૦૦

રોકડ ૧,૨૬,૦૦૦ = રૂ ૧૦,૫૦,૦૦૦

H લિમિટેડના ચોપડે આમનોંદ્ય

૬.

જ.

નં.	વિગત	ખા.પા	ઉધાર ₹	જમા ₹
૧	૧૨%ના ડિબેન્ચર ખાતે ૬ ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે ૬ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે (બા.જે. ૧૨%ના ₹ ૧૦૦નો એક એવા ₹ ૧૦,૦૦૦ ડિબેન્ચરના નાણાં ૫% પ્રિમીયમે ચુકવવાના થયા)		૧૦,૦૦,૦૦૦ ૫૦,૦૦૦ ૧૦,૫૦,૦૦૦	
૨	ડિબેન્ચર હોલ્ડર ખાતે ૬ તે ૧૦% પ્રેફરન્સ શેરમૂડી ખાતે તે જામીનગીરી પ્રિમીયમ ખાતે (બા.જે. ₹ ૧૦૦નો એક એવા ₹ ૪૦૦ ડિબેન્ચર સામે ₹ ૧૦૦નો એક એવા ₹ ૪૭૫ પ્રેફરન્સ શેર દરેક ₹ ૮૦ ભરાયેલ રૂ ૧૨૦ લેખે આપ્યા)		૫,૨૫,૦૦૦ ૩,૫૦,૦૦૦ ૧,૭૫,૦૦૦	
૩	ડિબેન્ચર હોલ્ડર ખાતે ૬ ડિબેન્ચર વટાવ ખાતે ૬ તે ૧૫%ના ડિબેન્ચર ખાતે (બા.જે. ₹ ૧૦૦નો એક એવા ₹ ૮૦૦ જુના ડિબેન્ચર પરત કરવા રૂ ૧૦૦ એક એવા ₹ ૪૨૦ ૧૫%નાં નવા ડિબેન્ચર ૫%ના વટાવે આપ્યા)		૩,૬૬,૦૦૦ ૨૧,૦૦૦ ૪,૨૦,૦૦૦	
૪	ડિબેન્ચર હોલ્ડર ખાતે ૬ તે બેંક ખાતે (બા.જે. ₹ ૧૦૦નો એક એવા ૧૨%ના ડિબેન્ચર ૫% પ્રિમીયમે રોકડેથી ચુકવ્યા)		૧,૨૬,૦૦૦ ૧,૨૬,૦૦૦	

ઉદાહરણ ૧૫. (બજારમાંથી ખરીદીને ડિબેન્ચર રદ કરવાને લગતાં ઉદાહરણો)

૧લી, જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ કંપનીએ ₹ ૧૦૦નો એક એવા ૫%ના ૫૦૦૦ ડિબેન્ચર ₹ ૬૪ના ભાવે
બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડતી વખતે જણાવવામાં આવ્યું હતુ કે ૨૦૧૮ થી શરૂ કરી દર વર્ષે ₹
૨૦,૦૦૦ના ડિબેન્ચરના નાણા કાંતો ખુલ્લા બજારમાંથી ખરીદીને અથવા ચિહ્નું ખેંચીને પરત કરી શકાશે.
૨૦૧૭ એ ૨૦૧૮ ના વર્ષમાં ડિબેન્ચર વટાવમાંથી ₹ ૪૦૦ દર વર્ષે માંડી વાળવામાં આવ્યા હતા. ૨૦૧૮માં
કંપની એ ₹ ૫૦૦૦ની મૂળ કિંમતના ડિબેન્ચર ₹ ૬૪ની કિંમતે ખરીદીને અને ₹ ૧૪,૦૦૦ ના ડિબેન્ચર ₹
૬૨ની કિંમતે ખરીદીને રદ કર્યા હતા. નાણાં પરત કરવાની આમનોંદ્ય લખો.

જવાબ:

કંપનીના ચોપડામાં આમનોંધ

તારીખ	વિગત	ખ.પા	ઉદાર ₹	જમા ₹
૨૦૧૭ ૧, જાન્યુ	બેંક ખાતે	૬	૪,૭૦,૦૦૦	
	ડિલેન્ચર વટાવ ખાતે	૬	૩૦,૦૦૦	
	તે ૫% ડિલેન્ચર ખાતે			૫,૦૦,૦૦૦
	(બા.જે. ₹ ૧૦૦ના એવા ૫૦૦૦ ડિલેન્ચર ₹ ૮૪ના ભાવે બહાર પાડ્યા)			
૨૦૧૭ ૩૧, ડિસે	નશા નુકશાન ખાતે	૬	૪,૦૦૦	
	તે ડિલેન્ચર વટાવ ખાતે			૪,૦૦૦
	(બા.જે. ₹ ૪૦૦ના ડિલેન્ચર વટાવ નશા નુકશાન ખાતે લઈ જઈ માંડી વાલ્યો)			
૨૦૧૮ ૩૧, ડિસે	નશા નુકશાન ખાતે	૬	૪,૦૦૦	
	તે ડિલેન્ચર વટાવ ખાતે			૪,૦૦૦
	(બા.જે. ₹ ૪૦૦૦ના ડિલેન્ચર વટાવ નશા નુકશાન ખાતે લઈ જઈ માંડી વાલ્યો)			
૨૦૧૮ ૩૧, ડિસે	૫%ના ડિલેન્ચરો ખાતે	૬	૨૦,૦૦૦	
	તે બેંક ખાતે			૧૮,૫૨૦
	તે ડિલેન્ચર પરતના નશા નુકશાન ખાતે			૧,૪૮૦
	(બા.જે. નક્કી કર્યા મુજબ ડિલેન્ચરની રકમ પરત કરવા મુખ્ય બજારમાંથી ડિલેન્ચરો ખરીદા)			
૨૦૧૮ ૩૧, ડિસે	ડિલેન્ચર પરતના નશા નુકશાન ખાતે	૬	૧,૪૮૦	
	તે મૂડી અનામત ખાતે			૧,૪૮૦
	(બા.જે. પરત નશા નુકશાનની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા)			
૨૦૧૮ ૩૧, ડિસે	નશા નુકશાન ફાળવણી ખાતે	૬	૨૦,૦૦૦	
	તે સામાન્ય અનામત ખાતે			૨૦,૦૦૦
	(બા.જે. ડિલેન્ચર પરત કરતાં તેની મૂળ કિંમત જેટલી રકમ નશા નુકશાન ફાળવણી ખાતેથી સામાન્ય અનામત ખાતે લઈ ગયા)			

ઉદાહરણ ૧ક. ક લિમિટેડ ૨૦૧૦માં ₹ ૫,૦૦,૦૦૦ના ક ટકાના ડિલેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યાં, જે ૩૦ મી જુન, ૨૦૧૮ના રોજ ₹ ૧૦૨ના ભાવે પરત કરવાના હતા. દર વર્ષે અમૃત રકમ રાખીને એક સિક્કિંગ ફંડ ઉભું કરવામાં આવ્યું હતું. અને તેટલી જ રકમ દર વર્ષે ૩૦મી જુનના રોજ આવા રોકાણો પર દર વર્ષ દરમિયાન મળેલી આવક સહિત રોકવામાં આવતી હતી. ટ્રસ્ટીઓને એવી સત્તા હતી કે તેઓ મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે મળે તે ડિલેન્ચર ખરીદીને રદ કરી શકે અને તે હેતુ માટે સિક્કિંગ ફંડનાં રોકાણો વેચી શકે.

૧લી જુલાઈ, ૨૦૧૭ના રોજ નીચેના બાકી ચોપડે હતી.

- (અ) સિકિંગ ફંક રૂ 3,૫૨,૫૦૦ જેની પાસે તેટલી જ રકમના રોકાણો હતા.
- (બ) ક ટકાના ડિબેન્ચરો રૂ 3,૫૦,૦૦૦ના ૩૦ મી જુન, ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન નીચેના વ્યવહારો થયા.
- (૧) રૂ ૨૮,૫૦૦ની પડતર કિંમતના રોકાણો તારીખ: ૧ લી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ વેચવામાં આવ્યા, જેના રૂ ૩૦,૧૫૦ ઉપજયા અને રૂ ૮૮ના ભાવે રૂ ૩૦,૦૦૦ના ડિબેન્ચર ખરીદી રદ કરવામાં આવ્યા.
- (૨) બાકીના રોકાણો રૂમી જુન, ૨૦૧૮ના રોજ રૂ 3,૩૦,૫૦૦માં વેચવામાં આવ્યા.
- (૩) સિકિંગ ફંડના રોકાણો પર મળેલી આવક રૂ ૨૦,૮૫૦ રોકવામાં આવી ન હતી.
- (૪) ૩૦મી જુન, ૨૦૧૮ના રોજ ડિબેન્ચરો પરત કરવામાં આવ્યાં.
તમારે તારીખ: ૩૦-૦૫-૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષેના નીચેના ખાતાંઓ તૈયાર કરવાનાં છે.:
૧) ક ટકાના ડિબેન્ચરનું ખાતું
૨) સિકિંગ ફંડના રોકાણોનું ખાતું
૩) સિકિંગ ફંક ખાતું.

જવાબ:

ક% નાં ડિબેન્ચરનું ખાતું

જ.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮			૨૦૧૭		
૧, જાન્યુ	ડિબેન્ચર હોલ્ડર ખાતે	૩૦,૦૦૦	૧ જુલાઈ	બાકી આગામ લાવ્યા	૩,૫૦,૦૦૦
૨૮, જુન	ડિબેન્ચર હોલ્ડર ખાતે	૩,૩૦,૦૦૦			
		<u>૩,૫૦,૦૦૦</u>			<u>૩,૫૦,૦૦૦</u>

સિકિંગ ફંક (ડિબેન્ચર પરત નિધિ) ખાતું

જ.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮			૨૦૧૭		
૩૦, જુન	ડિબેન્ચર પરત પ્રિ. ખાતે	૫,૫૦૦	૧, જુલાઈ	બાકી આગામ લાવ્યા	૩,૫૨,૫૦૦
	સામાન્ય અનામત ખાતે	૩,૭૫,૫૦૦	૨૦૧૮		
			૧, જાન્યુ	સિકિંગ ફંક રોકાણો ખાતે	૬૦૦
			૨૮, જુન	સિકિંગ ફંક રોકાણો ખાતે	૭,૩૫૦
			૩૦, જુન	બેંક ખાતે (વ્યાજ આવક)	૨૦,૮૫૦
				ડિબેન્ચર પરત નશી નુકશાન ખાતું	૫૦૦
		<u>૩,૮૨,૨૦૦</u>			<u>૩,૮૨,૨૦૦</u>

૬.

સિકિંગ ફંડના રોકાણો

૪.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮			૨૦૧૭		
૧, જુલાઈ	બાકી આગળ લાવ્યા	૩,૫૨,૫૦૦	૧, જાન્યુ	બેંક ખાતે વેચાણ પડતર(₹ ૨૬,૨૫૦)	૩૦,૧૫૦
૨૦૧૮			૨૬, જુન	બેંક ખાતે પડતર (₹ ૩,૨૩,૨૫૦)	૩,૩૦,૫૦૦
૧, જાન્યુ	સિકિંગ ફંડ ખાતે (નફો)	૬૦૦			
૨૬, જુન	સિકિંગ ફંડ ખાતે (નફો)	૭,૩૫૦			
		<u>૩,૫૦,૭૫૦</u>			<u>૩,૩૦,૭૫૦</u>

ડિલેન્ચર હોલ્ડરોનું ખાતું

૬.

૪.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮			૨૦૧૮		
૧, જાન્યુ	બેંક ખાતે પરત	૨૬,૪૦૦	૧, જાન્યુ	ડિલેન્ચર્સ ખાતે	૩૦,૦૦૦
	ડિલેન્ચર પરત નફો-નુકશાન ખાતે	૫૦૦	૨૬, જુન	ડિલેન્ચર્સ ખાતે	૩,૩૦,૦૦૦
	બેંક ખાતે (પરત) (૩,૩૦,૦૦૦x૧૦૨/૧૦૦)	૩,૩૭,૬૦૦		ડિલેન્ચર પરત પ્રિમીયમ ખાતે	૫,૬૦૦
		<u>૩,૬૬,૬૦૦</u>			<u>૩,૩૬,૬૦૦</u>

ડિલેન્ચર પરત નફો નુકશાન ખાતું

૬.

૪.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮			૨૦૧૮		
૩૦, જુન	સિકિંગ ફંડ ખાતે	૫૦૦	૧, જાન્યુ	ડિલેન્ચર હોલ્ડર ખાતે	૫૦૦
		<u>૫૦૦</u>			<u>૫૦૦</u>

ડિલેન્ચર પરત નફો નુકશાન ખાતું

૬.

૪.

તારીખ	વિગત	₹	તારીખ	વિગત	₹
૨૦૧૮			૨૦૧૮		
૨૬, જુન	ડિલેન્ચર હોલ્ડર ખાતે	૫,૬૦૦	૩૦, જુન	સિકિંગ ફંડ ખાતે	૫,૬૦૦
		<u>૫,૬૦૦</u>			<u>૫,૬૦૦</u>

૨.૧૫ ઝ્પાંતરપાત્ર ડિબેન્ચર પરત

હેઠા કેટલાક વર્ષો દરમિયાન ભારતીથ કંપનીઓ કન્વાટિબલ ડિબેન્ચરો બહાર પાડે છે. જેની શરત મુજબ, અમૃક મુદ્દત કંપની ડિબેન્ચર હોલ્ડરોને તેમનાં ડિબેન્ચરોના બદલામાં કંપનીના ઈક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને કંપનીના શેરના ભાવો બજારમાં ઉંચા બોલાતા હોય ત્યારે રોકાણકારોને આવાં ડિબેન્ચરો આકર્ષે છે. રિલાયન્સ ઇન્કસ્ટ્રીડ આ રીતે કેટલીક વાર કન્વાટિબલ ડિબેન્ચર બહાર પાડ્યાં છે.

આવાં ડિબેન્ચરનું ઝ્પાંતર કંપનીના ઈક્વિટી શેરમાં કરવામાં આવે ત્યારે નીચેની આમનોંધ કરવામાં આવે છે.:

ડિબેન્ચર ખાતે

૩

તે ઈક્વિટી શેરમૂડી ખાતે

આ અંગે નીચેના કેટલાક મુદ્દાઓ નોંધપાત્ર છે.

(૧) કંપનીએ જ્યારે પાકાચા તારીખ પહેલાં ડિબેન્ચરનું ઈક્વિટી શેરમાં ઝ્પાંતર કરવાનું હોય ત્યારે તે એવી રીતે થધું ન જોઈએ કે જેથી શેર વટાવે બહાર પાડવાની કંપની ધારાની જોગવાઈએનો ભંગ થાય. એટલે કે ઝ્પાંતર કરતાં જે શેર આપવામાં આવે તે વટાવે બહાર પાડ્યા ન શકાય. દા.ત. એક કંપનીએ ₹ ૧૦૦નો એક એવા કન્વાટિબલ ડિબેન્ચર ૧૦% ના વટાવે બહાર પાડ્યા છે. અહીં કંપનીએ દરેક ડિબેન્ચર દીઠ ₹ ૬૦ મળ્યા છે. હવે જો કંપની આ ડિબેન્ચર સામે ₹ ૧૦૦નો એક ઈક્વિટી શેર આપે તો તેનો અર્થ એ થચો કે કંપની જે ₹ ૬૦ મળ્યા હતા તેના બદલામાં કંપનીએ ₹ ૧૦૦ નો એક શેર આપ્યો. આમ શેર વટાવે આપ્યા ગાણાય અને કંપની ધારા પ્રમાણેની શરતોએ જ શેર વટાવે બહાર પાડી શકાય. જો કંપનીએ આ રીતે બહાર પાડેલ ડિબેન્ચર સામે ₹ ૧૦૦નો ઈક્વિટી શેર આપવો હોય તો તે ₹ ૬૦ ભરપાઈ થયેલ ગાણીને આપી શકે. તેને પુરો ભરપાઈ થયેલ ગાણીને આપી ન શકાય.

ઉદાહરણ ૧૭. ૧લી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ફ્લ્યોડકટ્સ લિમિટેડ ₹ ૧૦૦નો એક એવા ૧૦% નાં ૫૦૦૦ ઝ્પાંતરપાત્ર ડિબેન્ચર ૫%ના વટાવે બહાર પાડ્યા. આ ડિબેન્ચરના ધારકોને એવો હક હતો કે તેઓ ત વર્ષ પછી પોતાનાં ડિબેન્ચરના બદલામાં ₹ ૧૦૦ નો એક એવા ઈક્વિટી શેર ૨૫% ના પ્રિમીયમ મેળવી શકાશે.

તારીખ: ૨૧મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ૨૦૦૦ ડિબેન્ચરના ધારકોએ ડિબેન્ચરના બદલામાં ઈક્વિટી શેર લેવાનું પસંદ કર્યું. જરૂરી આમનોંધ આપો.

જ્યાબ:

૧૦ના ડિબેન્ચર બહાર પાડતાં મળેલ રકમ

$$5\% \text{ ના વટાવે} = 5000 \times ૬૫ = ₹ ૪,૭૫,૦૦૦$$

ઝ્પાંતર કરતાં આપવાના ઈક્વિટી શેર

$$2000 \text{ ડિબેન્ચર} \times ₹ ૬૫ = ₹ ૧,૬૦,૦૦૦$$

ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત = ₹ ૧૦૦

$$+ ૨૫\% \text{ પ્રિમીયમ} \quad \frac{₹ ૨૫}{₹ ૧૦૦}$$

ઈક્વિટી શેરની ઈસ્ટ્યુ કિંમત ₹ ૧૨૫

$$\diamond \quad \text{ઈસ્ટ્યુ કરવાના ઈક્વિટી શેરની } \frac{₹ ૧,૬૦,૦૦૦}{₹ ૧૨૫} = ૧૩૬૦ \text{ શેર} \\ \text{સંખ્યા} \quad ₹ ૧૨૫$$

આ અંગે આમનોંધ નીચે મુજબ થશે.

તારીખ	વિગત	ખ.પા	₹	₹
૧-૧-૨૦૧૫	બેં ખાતે ૬		૪,૭૫,૦૦૦	
	ડિલેન્યર ખાતે ૩		૨૫,૦૦૦	
	તે ૧૨%ના ડિલેન્યર ખાતે			૫,૦૦,૦૦૦
	(બા.જે. ₹ ૧૦૦ના એક એવા ૧૨%ના ૫૦૦૦ ડિલેન્યર ૫% વટાવે બહાર પાડ્યા)			
૩૧-૧-૨૦૧૮	૧૨%ના ડિલેન્યર ખાતે ૬		૨,૦૦,૦૦૦	
	તે ડિલેન્યર હોલ્ડરો ખાતે			૧,૬૦,૦૦૦
	તે ડિલેન્યર વટાવ ખાતે			૧૦,૦૦૦
	(બા.જે. ૧૨%ના ડિલેન્યર પૈકી ૨૦૦૦ ડિલેન્યર ઝ્યાંતર પાત્ર બન્યાં)			
૩૧-૦૧-૨૦૧૮	ડિલેન્યર હોલ્ડરો ખાતે ૬		૧,૬૦,૦૦૦	
	તે ઇક્સ્ટિશ્યન્સ શેરમુકી ખાતે			૧,૫૨,૦૦૦
	તે જામીનગીરી પ્રિમીયમ ખાતે			૩૮,૦૦૦
	(બા.જે. ૧૨%ના ૨૦૦૦ ડિલેન્યરના બદલામાં ૨૫% પ્રિમીયમ ઇક્સ્ટિશ્યન્સ શેર આવ્યા)			

(૨) ઝ્યાંતરની તારીખે ડિલેન્યરનું ઝ્યાંતર

જ્યારે બહાર પાડેલ વિજ્ઞાપનપત્ર મુજબ ઝ્યાંતરની તારીખે ડિલેન્યરનું શેરાં ઝ્યાંતર કરવાનું હોય ત્યારે બહાર પાડવાની જે શરતો હોય તો તે શરતોએ જ તેનું ઝ્યાંતર થઈ શકે છે. અહીં જો ડિલેન્યર બહાર પાડવાની શરતોમાં જણાવ્યું હોય કે ડિલેન્યરની દર્શનિક કિંમત જેટલી જ દાર્શનિક કિંમતના શેર આપવામાં આવશે. તો તે કાયદેસર ગણાશે અને તેમાં કંપનીધારાની કલમ જણ્ણનો બંગ થાય છે. એમ ગણાશે.

ઉદાહરણ ૧૮. ૧ લી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ ટાટા લિમિટેડ ૨૫૦ ૫%ના કન્વાટિબલ ડિલેન્યર, દ્વેક રૂ ૧૦૦૦ નો રૂ ૮૫૦ ના ભાવે બહાર પાડ્યાં. ડિલેન્યર હોલ્ડરોને એવો વિકલ્પ આપવામાં આવ્યો કે તેઓ પ વર્ષ પછી પોતાના ડિલેન્યરની મુલકિંમત તેના બદલામાં રૂ ૧૦ નો એક એવા ઇક્સ્ટિશ્યન્સ શેર, ૨૫%ના પ્રિમીયમે મેળવી શકશે.

૧લી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ બધા ડિલેન્યર ધરાવનારાઓએ આ વિકલ્પનો અમલ કરવા માગણી કરી. ડિલેન્યરના ઝ્યાંતરની મુદ્દત ૧ લી જાન્યુઆરી, ૨૦૦૪ હતી.

જુરી આમનોંધ આપો.

જ્યાબાં: અહીં કંપનીને ડિલેન્યર બહાર પાડતા મળેવ રકમ

$$૨૫૦ \times ૮૫૦ = રૂ ૨,૩૭,૫૦૦$$

$$\text{આ અંગે આપેલ વટાવ} = ૨૫૦ \times ૫૦ = રૂ ૧૨,૫૦૦$$

$$૨૫૦ ડિલેન્યરની દાર્શનિક કિંમત = રૂ ૨,૫૦,૦૦૦$$

$$\text{ઇક્સ્ટિશ્યન્સ શેરની દાર્શનિક કિંમત} = રૂ ૧૦$$

$$+ ૨૫\% \text{ પ્રિમીયમ} = \underline{\text{રૂ } ૨.૫૦}$$

ઈકિયટી શેરની ઈસ્ટિયુ કિંમત ₹ ૧૨.૫૦
 ❖ ઈસ્ટિયુ કરવાના ઈકિયટી શેરની ₹ ૨,૫૦,૦૦૦ = ૨૦,૦૦૦ શેર
 શેરની સંખ્યા ₹ ૧૨.૫૦

આ અંગે આમનોંધ નીચે મુજબ થશે

તારીખ	વિગત	ખ.પાં	ઉદાર ₹	જમા ₹
૧-૧-૨૦૧૩	બેંક ખાતે ૬	.	૨,૩૭,૫૦૦	
	ડિબેન્ચર વટાવ ખાતે ૬	.	૧૨,૫૦૦	
	તે ૫%ના ડિબેન્ચર ખાતે			૨,૫૦,૦૦૦
	(બા.જે. ₹ ૧૦૦ના એક એવા ૫%ના ૨૫૦ ડિબેન્ચર ₹ ૬૫૦ની કિમતે બહાર પાડવા)			
૧-૧-૨૦૧૮	૫%ના ડિબેન્ચર ખાતે ૬		૨,૫૦,૦૦૦	
	તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે			૨,૫૦,૦૦૦
	(બા.જે. ₹ ૧૦૦ એક એવા ૫%ના ૨૫૦ ડિબેન્ચર મુળકિમતે ઢ્યાંતર કરવાના થશે.)			
૧-૧-૨૦૧૮	ડિબેન્ચર હોલ્ડરો ખાતે ૬		૨,૫૦,૦૦૦	
	તે ઈકિયટી શેરમૂડી ખાતે			૨,૦૦,૦૦૦
	તે જામીનગારી પ્રિમીયમ ખાતે			૫૦,૦૦૦
	(બા.જે. ૨૫૦ ડિબેન્ચરના ધારણ કરનારાઓની શરતો મુજબ ₹ ૧૦નો એક એવા ૨૦,૦૦૦ ઈકિયટી શેર ૨૫%ના પ્રિમીયમે આપ્યા)			
૧-૧-૨૦૧૮	નફા નુકશાન ખાતે ૬		૧૨,૫૦૦	
	તે ડિબેન્ચર વટાવ ખાતે			૧૨,૫૦૦
	(બા.જે. ઢ્યાંતર કરેલ ડિબેન્ચર પરનો વટાવ માંડી વાળ્યો)			

ઉદાહરણ ૧૬. કન્વાર્ટિબલ લિમિટેડ નું તારીખ: ૩૦મી જુન, ૨૦૧૮ના રોજનું સંક્ષિપ્ત પાછું સરવૈચું નીચે મુજબ હતું.

જવાબદારીઓ	₹
શેરમૂડી: દરેક ₹ ૧૦નો એવા ૫,૦૦,૦૦૦ ઈકિયટી	૫૦,૦૦,૦૦૦
શેર પુરેપુરા ભરાયેલા	૭૫,૦૦,૦૦૦
સામાન્ય અનામત	૫૦,૦૦,૦૦૦
ડિબેન્ચર પરત નિધિ	
૧૩.૫%ના કન્વાર્ટિબલ ડિબેન્ચર	
દરેક ₹ ૧૦૦નો એવા ૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦,૦૦૦
અન્ય લોન	૫૦,૦૦,૦૦૦
ચાલુ જવાબદારીઓ અને જોગવાઈઓ	૧,૨૫,૦૦,૦૦૦
મિલકતો	
સ્થાયી મિલકતો બાદ ઘસારો	૧,૫૦,૦૦,૦૦૦

ડિબેન્ચર પરતનિધિના રોકાણો	૪૦,૦૦,૦૦૦
રોકડ અને બેંક સિલક	૫૦,૦૦,૦૦૦
અન્ય ચાલુ જબાવદારીઓ	૨,૦૦,૦૦,૦૦૦
	૪,૫૦,૦૦,૦૦૦

ડિબેન્ચરો તારીખ: ૧ લી જુલાઈ, ૨૦૧૮ના રોજ પરત થયા પાત્ર છે. ડિબેન્ચર બહાર પાડવાની શરતોમાં જોગવાઈ હતી કે ડિબેન્ચર ૫% ના પ્રભીયમે પરત કરવાના હતા અને તેના ડિબેન્ચર હાઉદરોને એવો વિકલ્પ આપવામાં આવ્યો હતો કે તેઓ તેમણે ધારણા કરેલાં ડિબેન્ચર ૨૦% ઈક્વિટી શેરમાં ઝ્યાંતર કરી શકશે. જેની અગાઉથી નિર્ધારિત કિંમત શેરદીઠ રૂ ૧૫,૭૫ નક્કી કરવામાં આવી હતી અને બાકીની રકમ રોકડમાં આપવાની હતી.

એમ ધારો કે,

- (૧) ૨૫૦૦૦ ડિબેન્ચરો ધરાવનારા ૧૦૦ ડિબેન્ચર હોઉદરો સિવાય બાકીના બધાએ વધુમાં વધુ ડિબેન્ચરનું ઝ્યાંતર વિકલ્પ સ્વીકાર્યો.
- (૨) રોકાણો વેચતાં રૂ ૪૪ લાખ ઉપજથ્યાં.
- (૩) બધા વ્યવહારો ૧ લી જુલાઈ, ૨૦૧૮ના રોજ જ પુરા થયા છે.

ઉપરના વ્યવહારો મુજબ જરૂરી આમનોંધો લખીને નાણાં પરત થઈ ગયા પછીનું પાંચ સરવેચું બનાવો. નાણાં પરત અંગે કેટલા ઈક્વિટી શેર આપવામાં આવશે અને કેટલી રોકડની જરૂર રહેશે તેની ગણતરી બતાવો.

જવાબ:

પ્રથમ આપણે જરૂરી ગણતરી કરી લઈએ

- (૧) ઝ્યાંતર અંગે કેટલા ઈક્વિટી શેર આપવા

કુલ ડિબેન્ચરની સંખ્યા	૧,૦૦,૦૦૦
બાદ: ઝ્યાંતર નહિ માગતા ડિબેન્ચર	૨૫,૦૦૦
	<u>૭૫,૦૦૦</u>

૭૫,૦૦૦ પૈકી ૨૦% ઈક્વિટીશેર આપશે = $75,000 \times 20\% = 15,000$ ડિબેન્ચર
આ અંગે આપવાના શેરની સંખ્યા

$$15,000 \text{ ડિબેન્ચર અંગે આપવાની કુલ રકમ} = 15,000 \times \text{રૂ } 105 \\ = \text{રૂ } 15,75,000$$

રૂ ૧૫,૭૫,૦૦૦ પરત કરવા માટે રૂ ૧૫,૭૫ની કિંમતે શેર આપવાના છે. તેથી આપવાના શેરની સંખ્યા:

$$\text{શેરની સંખ્યા} = \frac{\text{રૂ } 15,75,000}{15.75} = 1,00,000 \text{ શેર}$$

- (૨) ચુક્કવાની કુલ રોકડની ગણતરી

કુલ ડિબેન્ચરની સંખ્યા	૧,૦૦,૦૦૦
બાદ: શેરમાં ઝ્યાંતર કરવાનાં ડિબેન્ચર	<u>૧૫,૦૦૦</u>

રોકડમાં ઝ્પાંતર કરવાના ડિબેન્ચર ₹4,000
 ચુક્કવાની કુલ રોકડ = ₹4,000 × ₹ 104 = ₹ 86,24,000

(3) રોકડ સિલકની ગણતરી	
હાથ પર રોકડ	₹ 40,00,000
+ રોકાણો વેચતાં ઉપજ્યાં	₹ 44,00,000
	₹ 64,00,000
- ડિબેન્ચર અંગે ચુક્કવા	₹ 86,24,000
બાકી સિલક	₹ 4,74,000

ડિબેન્ચર પરતની આભનોધ

તારીખ	વિગત	ખા.પા	ઉધાર ₹	જમા ₹
૨૦૧૮ જુલાઈ, ૧	૧૩.૫%ના ડિબેન્ચર ખાતે ૬		૧,૦૦,૦૦,૦૦૦	
	ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે ૬		૫,૦૦,૦૦૦	
	તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે			૧,૦૫,૦૦,૦૦૦
	(બા.જે. ૧૩.૫%ના ₹ ૧૦૦નો એક એવા ૧૦૦૦૦૦ ડિબેન્ચર પરત કરવાનાં થયાં)			
૨૦૧૮ જુલાઈ, ૧	ડિબેન્ચર હોલ્ડરો ખાતે ૬		૧૫,૭૫,૦૦૦	
	તે ઈક્વિટી શેરમૂડી ખાતે			૧૦,૦૦,૦૦૦
	તે જામીનગીરી પ્રિમીયમ ખાતે			૫,૭૫,૦૦૦
	(બા.જે. ₹ ૧૫૦૦ ડિબેન્ચર ધારણ કરનારાઓને ₹ ૧૦નો એક એવા ઈક્વિટી શેર, શેર દીઠ રૂ ૫.૭૫ના પ્રિમીયમે આપ્યાં)			
૨૦૧૮ જુલાઈ, ૧	બેંક ખાતે ૬		૪૪,૦૦,૦૦૦	
	તે ડિબેન્ચર પરતનિધિના રોકાણો ખાતે			૪૦,૦૦,૦૦૦
	તે ડિબેન્ચર પરતનિધિ ખાતે			૪,૦૦,૦૦૦
	(બા.જે. ડિબેન્ચર પરતનિધિના રોકાણો વેચ્યાં અને તેનો નષ્ટો ડિબેન્ચર પરતનિધિ ખાતે લર્દ ગયા)			
૨૦૧૮ જુલાઈ, ૧	ડિબેન્ચર હોલ્ડરો ખાતે ૬		૮૬,૨૫,૦૦૦	
	તે બેંક ખાતે			૮૬,૨૫,૦૦૦
	(બા.જે. ₹૫૦૦૦ ડિબેન્ચર ધારણ કરનારાઓને ૫% પ્રિમીયમે રોકડ નાણા આપ્યા)			
૨૦૧૮ જુલાઈ, ૧	સામાન્ય અનામત ખાતે ૬		૫,૦૦,૦૦૦	
	તે ડિબેન્ચર પરત પ્રિમીયમ ખાતે			૫,૦૦,૦૦૦
	(બા.જે. ડિબેન્ચર પરત પ્રિમીયમ રકમ સામાન્ય અનામત સામે માંડી વાળી)			
૨૦૧૮ જુલાઈ, ૧	ડિબેન્ચરની પરતનિધિ ખાતે ૬		૫૪,૦૦,૦૦૦	

	તે સામાન્ય અનામત ખાતે			૫૪,૦૦,૦૦૦
	(બા.જે. ડિલેન્યર પરત થઈ જતાં ડિલેન્યર પરતનિધિ ખાતાની બાકી સામાન્ય અનામત ખાતે લઈ ગયા)			

તારીખ: ૧ લી જુલાઈ, ૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું
(ડિલેન્યર પરત પછીનું)

ટેવા	₹	મિલકતો	₹
શેરમૂડી:		કાચમી મિલકતો:	
₹ ૧૦ નો એક એવા ૫૦૦૦૦૦ ઇક્વિટી શેર પુરેપુણ ભાશાયેલા	૫૦,૦૦,૦૦૦	(મૂળકિંમત બાદ ઘસારો)	૧,૫૦,૦૦,૦૦૦
અનામત અને વધારો:		ચાલુ મિલકતો, લોન અને ઘિરાણાઃ	
જામીનગરી પ્રિમીયમ	૫,૭૫,૦૦૦	ચાલુ મિલકતો	૨,૦૦,૦૦,૦૦૦
સામાન્ય અનામત	૧,૨૪,૦૦,૦૦૦	રોકડ અને બેંક	૪,૭૫,૦૦૦
તારણા વગરની લોન			
અન્ય લોન	૫૦,૦૦,૦૦૦		
ચાલુ ટેવાં અને જોગવાઈઓ	૧,૨૫,૦૦,૦૦૦		
	૩,૬૪,૭૫,૦૦૦		૩,૬૪,૭૫,૦૦૦

૨.૧૬ સ્વાદ્યાય

૧. નીચેની પરિસ્થિતિઓમાં આમનોંધ લખો.

- A. ૧૫%ના ₹૧૦૦નો એક એવા ૧,૦૦૦ ડિલેન્યર મૂળ કિંમતે બહાર પાડી ૧૦% પ્રિમીયમ
 - B. ૧૫%ના ₹૧૦૦નો એક એવા ૧,૦૦૦ ડિલેન્યર ૧૦% વટાવથી બહાર પાડી ૧૦% પ્રિમીયમથી પરત કરવા.
 - C. ૧૫%ના ₹૧૦૦નો એક એવા ૧,૦૦૦ ડિલેન્યર ૧૦% પ્રિમીયમથી બહાર પાડી ૧૦% પ્રિમીયમથી પરત કરવા.
૨. તારીખ: ૦૧/૦૧/૨૦૧૨ના રોજ અજ્ય લિમિટેડ ૮%ના €,૦૦૦ ડિલેન્યર ₹૧૦૦નો એક એવા ૧૦% વટાવે બહાર પાડ્યા. આ બધા ડિલેન્યર પાંચ વર્ષ પછી ૧૦%ના પ્રિમીયમથી પરત કરવાના છે. કંપનીના ચોપકે આમનોંધ લખો.
૩. વિરપ્પન લિમિટેડ ૧૦%ના ૫૦૦૦ ડિલેન્યર ₹૧૦૦નો એક એવા ૧૦% વટાવથી તારીખ: ૦૧/૦૧/૨૦૧૨ના રોજ બહાર પાડે છે. ડિલેન્યરની રકમ નીચે પ્રમાણો પરત કરવામાં આવે છે.

તારીખ: ૩૧-૧૨-૨૦૧૨	₹૧,૨૦,૦૦૦
તારીખ: ૩૧-૧૨-૨૦૧૩	₹૧,૮૦,૦૦૦
તારીખ: ૩૧-૧૨-૨૦૧૪	₹ ૬૦,૦૦૦

તારીખ: ૩૧-૧૨-૨૦૧૫	₹ ૧,૫૦,૦૦૦
તારીખ: ૩૧-૧૨-૨૦૧૬	₹ ૫૦,૦૦૦

ઉપરોક્ત વિષયના સંદર્ભે ડિબેન્ચર વટાવ ખાતું તૈયાર કરો.

૪. સ્વારીન ટેક્સ ટાઇલ્સે ૧,૦૦૦, ૧૧% ના ડિબેન્ચર ₹૧૦૦નો એક એવા ૧૦% વટાવથી બહાર પાડ્યા. બધા શેર ૨% પ્રિમીયમથી પાંચ વર્ષ પછી નીચે પ્રમાણે પરત કરવાના છે.
- A. ૪,૦૦૦ શેર માટે રોકડ નાણાં ચૂકવવા.
B. ૬,૦૦૦ શેર માટે નવા પ્રેફરન્સ શેર ₹૧૦૦નો એક એવા ₹૧૨૦ના ભાવે બહાર પાડવા.
કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો.
૫. આલ્ફા લિમિટેડના ૫,૦૦૦ ૮%ના ડિબેન્ચર ₹૧૦૦નો એક એવા ૫% પ્રિમીયમથી નીચેના વિકલ્પો પ્રમાણે પરત કરવાના છે.
- ૧) રોકડમાં ચૂકવણી
૨) ૧૦% રીડી પ્રેફરન્સ શેર ₹૧૨૦ના ભાવે બહાર પાડવા (મૂળ કિંમત ૧૦૦)
૩) ૮% ના નવા ડિબેન્ચર ₹૧૦૦નો એક એવા ૧૦% વટાવથી બહાર પાડવા.
૨૦૦ ડિબેન્ચર ધારણા કરવનાઓએ ૧૦%ના પ્રેફરન્સ શેર સ્વીકાર્યા, ૧,૮૦૦ ડિબેન્ચર સ્વીકાર્યા જ્યારે બાકીના ડિબેન્ચર ધારણા કરનારાઓએ રોકડ સ્વીકારી.
ઉપરોક્ત માહિતી પરથી ડિબેન્ચર પરત કરવાની આમનોંધ લખો.
૬. દટ લિમિટેડ તારીખ: ૦૧/૦૧/૨૦૧૨ના રોજ ૫૦૦૦ ૧૦%ના ડિબેન્ચર ₹૧૦૦નો એક એવા ૧૦%ના વટાવથી બહાર પાડે છે. જે ૫% ના પ્રિમીયમથી પરત કરવાના છે. આ હેતુ માટે દર વર્ષ નફામાંથી ₹૧૩૨૦૦૦ ડિબેન્ચર પરત નિધિ ખાતે લઈ દ્યાનમાં આવશે. (વર્ષના અંતે) અને તેનું ડિબેન્ચર પરતનિધિના રોકાણોમાં ૧૦% વ્યાજના દરે રોકાણ કરવામાં આવશે. તારીખ: ૩૧/૧૨/૨૦૧૫ના રોજ કંપની બધા રોકાણો ₹૫,૧૮,૦૦૦માં વેચીને ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે.
ઉપરોક્ત માહિતી પરથી આમનોંધ લખી ડિબેન્ચર પરત નિધિ ખાતું તથા ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું ખાતું તૈયાર કરો.
૭. તારીખ: ૩૧/૦૩/૨૦૧૫ના રોજ આરવ લિમિટેડના ચોપડે નીચે મુજબની બાકીઓ હતી.

૧૦% મોર્ગેજ ડિબેન્ચર (ગીરો ડિબેન્ચર)	₹૫,૦૦,૦૦૦
ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર મળેલ વ્યાજ	₹ ૨૦,૦૦૦
બહાર પાડેલ ડિબેન્ચર વટાવ	₹ ૫૦,૦૦૦
ડિબેન્ચર પરતનિધિ	₹૪,૫૦,૦૦૦
ડિબેન્ચર પરતનિધિના રોકાણો	
૪.૫% ગુજરાત ગર્વમેન્ટ લોન (ખરીદ કિંમત)	₹ ૨,૦૦,૦૦૦

૮% નેશનલ ડિફેન્સ બોન્ડ (મૂળ કિંમત)	₹ ૨,૫૦,૦૦૦	
---------------------------------------	------------	--

આથી તારીખે રોકાણો નીચે પ્રમાણે વેચવામાં આવ્યા.

- ગુજરાત ગવર્નેન્ટ લોન ₹ ૬૭ના ભાવે
- ૫% નેશનલ ડિફેન્સ બોન્ડ ₹ ૧૦૨ના ભાવે.

તારીખ: ૦૧/૦૪/૨૦૧૨ના રોજ ₹૩,૦૦,૦૦૦ના ડિબેન્ચર ₹૧૦૫ના ભાવે પરત કરવામાં આવ્યા તથા આ જ દિવસે સેન્ટ્રલ ગવર્નેન્ટ સીક્યુરીટી ₹૧,૦૦,૦૦૦ની ૨% પ્રિમિયમે જરીદ્વામાં આવી. ડિબેન્ચર પરતનિધિમાં વાર્ષિક ₹૫,૦૦૦ ફાળવવામાં આવે છે.

જરૂરી આમનોંધ આપી ખાતા તૈયાર કરો.

- c. રવિ કંપની લિમિટેડએ દરેક ₹૧૦૦નો એક તેવા ૮%ના ₹૦૦૦ ડિબેન્ચર ફર્દું વટાવે તારીખ: ૦૧/૦૪/૨૦૧૪ના રોજ બહાર પાડ્યા. તારીખ: ૩૧/૦૩/૨૦૧૫થી કંપની ૧૦ વર્ષે ₹૨૦૦૦ ડિબેન્ચર ૪ વર્ષ સુધી પરત કરશે.

દરેક વર્ષ ૩૧ માર્ચ પુરુથાય છે તેવું માની ડિબેન્ચર વટાવ ખાતું તૈયાર કરો.

- e. વિધિત લિ. એ તારીખ: ૦૧/૦૧/૨૦૧૪ના રોજ ₹૧૦૦નો એક એવા ૮% ના ₹૫૦૦ ડિબેન્ચર ૧૦% ના વટાવે બહાર પાડ્યા. આ ડિબેન્ચરના નાણાં દર વર્ષ ₹ ૬૦,૦૦૦ લેખે પરત કરવાના છે. ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ આપો અને કંપનીની ખાતાવાહીમાં ડિબેન્ચરના સમયગાળાનું વટાવ ખાતું તૈયાર કરો.

૧૦. શિવમ લિ. ૧૦%ના ₹૫૦૦ ડિબેન્ચર દરેક ₹૧૦૦નો એક એવા ૮%ના વટાવે બહાર પાડ્યા. જે ૫ વર્ષ બાદ ૧૦%ના પ્રિમિયમે પરત કરવાના છે. જરૂરી આમનોંધ આપો.

ડિબેન્ચર પરત કરવા માટે ડિબેન્ચર પરતનિધિની રીત સમજાવો.

(સરદાર પટેલ યુનિ. એપ્રિલ ૨૦૧૫)

૧૧. વિજય લિ. એ ૧૨% ૧૦૦૦ ડિબેન્ચર દરેક ₹૧,૦૦૦ની દાર્શનિક કિંમતના તારીખ: ૦૧/૦૧/૨૦૧૧ ના રોજ ૩% ના વટાવે બહાર પાડ્યા. આ ડિબેન્ચર નીચે પ્રમાણે પરત કરવાના હિતા.

વર્ષ	ડિબેન્ચરની સંખ્યા
૩૧-૧૨-૨૦૧૨ના રોજ	૪૦૦ ડિબેન્ચર
૩૧-૧૨-૨૦૧૩ના રોજ	૩૦૦ ડિબેન્ચર
૩૧-૧૨-૨૦૧૪ના રોજ	૨૦૦ ડિબેન્ચર
૩૧-૧૨-૨૦૧૫ના રોજ	૧૦૦ ડિબેન્ચર

ઉપરની માહિતી પરથી વિજય લિ. ના ચોપડે ડિબેન્ચર વટાવ ખાતું તૈયાર કરો.

૧૨. તારીખ: ૦૧-૦૧-૨૦૧૦ન રોજ રીચા કંપની લિ. એ ₹૬,૦૦૦ ૮%ના ડિબેન્ચર રૂ૯૦૦ના ૧૦%ના વટાવે બહાર પાડ્યા અને આ ડિબેન્ચરના નાણાં ૫ વર્ષ પછી ૫%ના પ્રિમીયમથી પરત કરવાનું નક્કી કર્યું. રીચા કંપનીના ચોપડે આમનોંધ લખો.

(સરદાર પટેલ ચુનિ. માર્ચ ૨૦૧૬)

૧૩. રવિ કંપની લિ.એ દેશેક રૂ૯૦નો તેવા ૧૨૦૦૦ , ૮% ના ડિબેન્ચર ૧૦% ના વટાવે તારીખ: ૦૧-૦૪-૨૦૦૭નાં રોજ બહાર પાડ્યા. ડિબેન્ચર ઇંદ્ર રૂ૪ અરજી વખતે રૂ૪ ફાળવણી વખતે અને બાકીની રકમ છેલ્ખા હસ્ત વખતે મંગાવવાનું નક્કી કર્યું.

કંપનીને ૧૫૦૦૦ ડિબેન્ચરની અરજી મળી વધારાની અરજીઓ નકારવામાં આવી, તમામ વ્યવહારો પૂર્ણ થયા. ૧૦ વર્ષ પછી કંપનીએ ડિબેન્ચર ૧૦% પ્રિમીયમથી પરત કરવાનું નક્કી કર્યું. ડિબેન્ચર હોલ્ડરને અલગ વિકલ્પો આપવામાં આવ્યા. જેમા નીચે મુજબ સંમતિ મળી.

- (૧) ૫૦૦૦ ડિબેન્ચર હોલ્ડરને દેશેક રૂ૧૦ના તેવા ઇક્વિટી શેર ૧૦% પ્રિમીયમે સ્વાક્ષાર્યા.
- (૨) ૩૫૦૦ ડિબેન્ચર હોલ્ડરને દેશેક રૂ૧૦ના તેવા ૬% પ્રેફરન્સ શેર ૧૦% પ્રિમીયમે સ્વીકાર્યા.
- (૩) બાકીનાં રોકડ સ્વીકાર્યા.

ઉપરના વ્યવહારો માટે કંપનીના ચોપડે આમનોંધ લખો.

(સરદાર પટેલ ચુનિ. એપ્રિલ ૨૦૧૪)

૧૪. પ્રિયાના ચોપડામાં તારીખ: ૩૧-૦૩-૨૦૧૫ના રોજ નીચેની બાકીઓ હતી.

(૧) ૧૮%ના ડિબેન્ચર	₹ ૧૫,૦૦,૦૦૦/-
(૨) ડિબેન્ચર પરત નિધિ	₹ ૧૫,૮૦,૦૦૦/-
(૩) ડિબેન્ચર પરત નિધિના રોકાણો:	
(અ) ૧૨%ના કંડલા પોર્ટ ટ્રૂસ્ટના બોન્ડ (દાર્શનિક કિંમત ₹૬,૦૦,૦૦૦/-)	₹ ₹૬,૪૦,૦૦૦/-
(બ) ૧૦%ની કેન્દ્ર સરકારની લોન (દાર્શનિક કિંમત ₹૫,૭૦,૦૦૦/-)	₹ ૫,૦૦,૦૦૦/-

તારીખ: ૩૧-૦૭-૨૦૧૫ના રોજ ૧૨%ના કંડલા પોર્ટ ટ્રૂસ્ટ બોન્ડ ૧૦%ના પ્રિમીયમથી વેચ્યા અને ૧૦%ની કેન્દ્ર સરકારની લોન ₹૨૦,૦૦૦/- ના ખોટથી વેચ્યા. તે જ તારીખ ડિબેન્ચરના નાણાં ૧૦%ના પ્રિમીયમથી પરત કર્યા જેમા ચોપડે વ્યાજ સહિત પરત કર્યા.

કંપનીના ચોપડામાં જરૂરી ખાતાં તૈયાર કરો.

(સરદાર પટેલ ચુનિ. માર્ચ ૨૦૧૬)

૧૫. સાક્ષી લિમિટેડના ચોપડે તારીખ: ૩૧-૦૩-૨૦૧૧ના રોજ નીચેની બાકીઓ હતી.

જવાબદારીઓ	₹
૧૨%ના ગીરો ડિબેન્ચર્સ	૧૦,૦૦,૦૦૦
ડિબેન્ચર પરત નિધિ	૧૦,૦૦,૦૦૦
ડિબેન્ચર પરત નિધિના રોકાણો:	
(૧) ૫%ની ગુજરાત સરકારની લોન (મૂળ કિંમતે ખરીદેલ)	૫,૦૦,૦૦૦
(૨) ૫%ની નેશનલ ડિફેન્સ બોન્ડ (દાર્શનિક કિંમત રૂ૪,૦૦,૦૦૦/-)	૩,૮૦,૦૦૦
	૯,૮૦,૦૦૦

તારીખ: ૩૧-૦૪-૨૦૧૧ના રોજ ૫%ની ગુજરાત સરકારની લોન રૂ૧૦૦ ના ભાવે તથા ૫%ના નેશનલ ડિફેન્સ બોન્ડ રૂ૮૮ના ભાવે વેંચવામાં આવ્યા. એ જ દિવસે ડિબેન્ચર રૂ૧૦૫ના ભાવે ચૂકવવાના બાકી વ્યાજ સહિત પરત કરવામાં આવ્યા. ડિબેન્ચર પર વ્યાજ તારીખ: ૩૧-૦૩-૨૦૧૧ સુધી ચુકવેલ છે.

(સરદાર પટેલ ચુનિ. એપ્રિલ ૨૦૧૨)

૧૬. વૃંદા લી.ના ચોપડે તારીખ: ૩૧-૧૨-૨૦૧૦ના રોજ નીચેની બાકીઓ મળે છે.

૧૫%ના તારણવાળા ડિબેન્ચર	૮,૦૦,૦૦૦
ડિબેન્ચર પરત નિધિ	૮,૮૦,૦૦૦
<u>ડિબેન્ચર પરત નિધિના રોકાણો</u>	
(૧) ૧૦%ની સરકારી લોન	૫,૦૦,૦૦૦
(૨) ૮%ના રાષ્ટ્રીય સુરક્ષા બોન્ડસુ	૨,૮૦,૦૦૦

તારીખ: ૩૧-૦૩-૨૦૧૧ના રોજ ૧૦% સરકારી લોન રૂ૧૧૦ના ભાવે અને રાષ્ટ્રીય સુરક્ષા બોન્ડ રૂ૮૮ના ભાવે વેંચ્યા. ભેગા થચેલ વ્યાજ સહિત ડિબેન્ચર રૂ૧૦૮ના ભાવે પરત કર્યા ડિબેન્ચર પર ૩૧-૧૨-૨૦૧૦ સુધી વ્યાજ ચૂકવવામાં આવ્યું.

વૃંદા લિ.ના નીચેના ખાતા તૈયાર કરો.

- (૧) ડિબેન્ચર ખાતું (૩) પરત નિધિ ખાતું
- (૨) ડિબેન્ચર હોલ્ડર ખાતું (૪) પરત નિધિ રોકાણ ખાતું

(સરદાર પટેલ ચુનિ. એપ્રિલ ૨૦૧૪)

૧૭. અમી લિ. ના ચોપડે તારીખ: ૩૧-૧૨-૨૦૧૪ના રોજ નીચેની બાકીઓ હતી.

૧૦%ના ગીરો ડિબેન્ચર ₹ ૧૬,૦૦,૦૦૦

ડિબેન્ચર પરતનિધિ ₹ ૧૭,૦૦,૦૦૦

ડિબેન્ચર પરતનિધિ રોકાણો :

૮% ની ગુજરાત સરકારી લોન ₹ ૫,૫૦,૦૦૦ (મૂળ કિંમતે ખરીદેલ)

૧૦%ના નેશનલ ડિફેન્સ બોન્ડસ ₹ ૯,૫૦,૦૦૦ (દાર્શનિક કિંમત ₹ ૧૦,૦૦,૦૦૦)

તારીખ: ૩૧-૦૩-૨૦૧૫ના રોજ ૮%ની ગુજરાત સરકારની લોન રૂ ૧૧૦ના ભાવે અને ૧૦%
બેશનાલ ડિફેન્સ બોન્ડ્સ રૂ ૯૮ના ભાવે વેચવામાં આવ્યા. તે જ તારીખે ડિફેન્સ રૂ ૧૦૫ લેને
બાકી વ્યાજ સાથે ચૂકવી દીધા.

ડિફેન્સ પર તારીખ: ૩૧-૧૨-૨૦૧૪ સુધીનું વ્યાજ ચૂકવ્યું છે.

કંપનીનાં ચોપડે જરૂરી ખાતાં તૈયાર કરો.

(સરદાર પટેલ ચુનિ. એપ્રિલ ૨૦૧૫)

પ્રકરણ - 3
હિસાબી ધોરણો

- 3.૧ પ્રસ્તાવના
- 3.૨ હિસાબી ધોરણોનો અર્થ
- 3.૩ હિસાબી ધોરણોની ઉપયોગીતા
- 3.૪ હિસાબી ધોરણો બહાર પાડવાની પ્રક્રિયા
- 3.૫ હિસાબી ધોરણ-૧ હિસાબી નીતિઓની રજુઆત
- 3.૬ હિસાબી નીતિઓમાં વપરાશકર્તાઓ
- 3.૭ હિસાબી નીતિઓની સામાન્ય લાક્ષણિકતાઓ
- 3.૮ હિસાબી ધોરણ-૨
- 3.૯ હિસાબી ધોરણ-૨૯

પ્રકરણ - 3

હિસાબી ધોરણો

3.૧ પ્રસ્તાવના

દંડાના વ્યવહારો, હિસાબો તથા નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે હિસાબી ધોરણો, સિદ્ધાંતો, ખ્યાલો કે પ્રણાલિકાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત આર્થિક વિકાસ માટે વિશ્વની ઉભરતી અર્થશાસ્ત્રીની પરિસ્થિતિમંનો એક ભાગ છે. ભારતના રોકાણના વાતાવરણને સરળ બનાવવા માટે વિદેશી સીધા રોકાણોની જરૂર છે, જેથી વિશ્વના બાકીના અર્થશાસ્ત્ર સાથે તેના નાણાકીય પત્રકોની તુલના કરવાની જરૂર પડે, જેથી બહારથી રોકાણકારો નાણાકીય પરિસ્થિતીની પ્રશંસા કરશે તેથી કંપનીનું પરિણામ અને નાણાકીય સ્થિતિ અન્ય દેશમાં તૈયાર કરવામાં આવેલા નાણાકીય પત્રકો સાથેની તુલનામાં એકરૂપતા અને સુસંગતા પ્રદાન કરશે.

હિસાબનીશો અનેક બાબતો અંગે જુદા જુદા અભિપ્રાયો ધરાવતા હોય છે તેથી એક જ વ્યવહારની નોંધ જુદી-જુદી સ્વીકૃત પદ્ધતિ મુજબ અલગ અલગ રીતે કરવામાં આવે તેવું શક્ય છે.

દા.ત. ઘસારો ગાણવા માટે સીધી લિટીની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય કે ઘટતી જતી બાકીની પદ્ધતિનો ઉપોયુગ થઈ શકે કે અન્ય ડોઇં પણ પદ્ધતિ અપનાવી શકાય સ્ટોકનું મૂલ્યાંકન FIFO (ફિઝો) પદ્ધતિ મુજબ થઈ શકે કે LIFO (લિઝો) પદ્ધતિ મુજબ થઈ શકે. જુદા જુદા વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ અપનાવો તે સંચાલકોની નીતિ અનુસાર નક્કી કરવામાં આવે છે. જુદા જુદા એકમો એક જ હિસાબી બાબત અંગે જુદી જુદી નીતિ અપનાવે તો હિસાબોની તુલના થઈ શકે નહિ. પરિણામે હિસાબો પરથી ઉપયોગી તારણો મેળવી શકાય નહી. તેથી હિસાબી પત્રકો કેવી રીતે તૈયાર કરવા અને તેની રજુઆત કરવામાં એકરૂપતા લાવી શકાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ હિસાબી ધોરણોની ર્યાના તેને બહાર પાડવા માટેના પ્રયત્નો શરૂ થયા. તેના માટે ૧૯૭૭ ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ (International Accounting standard committee /IASC) ની સ્થાપના કરવામાં આવી. ધ ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ (IASB) દ્વારા ૧-૪-૨૦૦૧ થી આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બનાવવની જવાબદારી સ્વીકારી છે.

ભારતમાં ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ધાન્ડિયા [ICAI] દ્વારા હિસાબી ધોરણો તૈયાર કરવા માટે ૨૧ એપ્રિલ ૧૯૭૭ ના રોજ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ [Accounting Standard board ASB] ની ર્યાના કરવામાં આવી.

➤ શા માટે હિસાબી ધોરણોને લખવામાં આવે છે ?

હિસાબી ધોરણો હિસાબી વ્યવસ્થાની સંસ્થા [ICAI] દ્વારા બહાર પાડવામાં આવતા લખેલા સમાન હિસાબી નિયમો અને માર્ગદર્શક વિધાનો છે જે નાણાકીય પત્રકો લખતી વખતે કે તેને રજુઆત કરતી વખતે દ્યાનમાં લેવામાં આવે છે. હિસાબી ધોરણોમાં આપવામાં આવેલા નિયમો કે માર્ગદર્શન સામાન્ય રીતે નાણાકીય પત્રકોમાં આપવામાં આવતી હિસાબી માહિતીની માપણી, મુલ્યાંકન અને રજુઆત અંગેના હોય છે.

ભારતમાં મધ્યસ્થ સરકારે 'નેશનલ એડવાઇઝરી કમિશન ઑન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ [NACAS]' સાથે ચર્ચા કરીને તા. ૧૫-૦૨-૨૦૧૫ ના રોજ તા.૦૧-૦૪-૨૦૧૫ થી અમલમાં આવે એ રીતે કંપનીઝ (હિસાબી ધોરણો) નિયમો, ૨૦૧૫ બહાર પાડેલ છે. આ નિયમો મુજબ તેમાં જણાવેલ કંપનીઓ તેના ઓડિટરોએ તેમાં જણાવેલ ભારતીય હિસાબી ધોરણો [IND AS] નું પાલન અનુક્રમે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં અને તેના ઓડિટ માટે કરવાનું છે. જો હિસાબી ધોરણો ના હોય તો દ્રેક ધ્યાકીય એકમો ધારા તૈયાર કરવામાં આવેલ નાણાકીય પત્રકો જુદા-જુદા પ્રકારના હોવાથી તેમની વરચ્યે હિસાબી ધોરણોની એકસૂત્રતા જળવાતી ન હોવાથી ધંધાકીય એકમના સંબંધીત લોકોને સચોટ અને અર્થપૂર્ણ માહિતી મળતી નથી.

આમ છતાં હિસાબી ધોરણો જડ નથી, તે પરિવર્તનશીલ પણ છે. તે વિવિધ પ્રાચ્ય પદ્ધતિઓમાંથી વૈકલ્પિક પદ્ધતિ અપનાવાની છૂટ પણ આપે છે. હિસાબી ધોરણો વર્તમાન ઘંધાનું વાતાવરણ અને દેશના કાયદાઓને દ્વારાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. આથી જ્યારે ઘંધાના વાતાવરણમાં કે કાયદામાં ફેરફાર કરવામાં આવે ત્યારે હિસાબી ધોરણોમાં પણ ફેરફાર કરવો જોઈએ.

૩.૨ હિસાબી ધોરણોનો અર્થ:

હિસાબી ધોરણોએ સમાન અને સુસંગત નાણાકીય પત્રકોની તૈયારી માટે અને હિસાબી ભાહિતીના વિવિધ વપરાશ કરતાઓને અસર કરતી અન્ય જાહેરાતો માટે એકાઉન્ટિંગ સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ નિયમો અને દિશાનિર્દ્દશનો (Guidelines) આપતા લેખિત નિપેદનો છે.

દરેક ઘંધામાં તથા કંપનીઓના હિસાબોની નીતિ અને નાણાકીય પત્રકોમાં એકરૂપતા/સુસંગતા સમજવા માટે FASB (Financial Accounting Standard Board) અને IASB (International Accounting Standard Board) જેવી નિયમનકારી સંસ્થાઓ દ્વારા પ્રસ્થાપિત થયેલા નિતિનિયમો છે.

વ્યાખ્યા:

પ્રો. પી. એન. અબ્રોલન 'ડિક્ષનરી ઓફ એકાઉન્ટિંગ' મુજબ હિસાબી ધોરણો એ હિસાબી નિયમો અને હિસાબી પ્રક્રિયાઓ દર્શાવે છે. જે જે તે દેશની હિસાબી સંસ્થાઓ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી (ASC) દ્વારા હિસાબી બાબતોનાં માપન, મૂલ્યાંકન અને પ્રગતીકરણ સાથે સંબંધિત છે. એમ આપણે કહી શકીએ છીએ. હિસાબી સિદ્ધાંતો કે ધોરણોએ હિસાબનિશ દ્વારા તૈયાર કરવા અપનાવેલ સર્વ સ્વીકૃત નિતી નીયમો છે. જે માણસો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. સામાન્ય રીતે હિસાબી ધોરણો કે સિદ્ધાંતોની સર્વ સ્વીકૃતનો આધાર મૂળભૂત રીતે ત્રણ બાબતો પર આધારિત છે.

૧. ઉપયોગીતા
૨. હેતુલક્ષી
૩. શક્ય

આવા સિદ્ધાંતો તો જ ઉપયોગી નીવકે છે જ્યારે ઘંધાકીય એકમ ભીહિતી મેળવવા માગતા પક્ષકારોને જોઈતી ભાહિતી પૂરી પાડે શકે.

હિસાબી સિદ્ધાંતો બનાવનાર પક્ષકારના પક્ષપાત કે તેની વ્યક્તિગત માન્યતાથી મુક્ત હોવા જોઈએ. આવા હિસાબી ધોરણો તો જ હેતુલક્ષી કે ઉદ્દેશ્યલક્ષી ગણાશે જે તે સંપૂર્ણ પણ ખરેખર હકીકતોથી સમર્થન પામતી હોય.

હિસાબી ધોરણોના ઉદ્દેશો:

એકાઉન્ટિંગને ઘણીવાર વ્યવસાયની ભાષા માનવામાં આવે છે, કેમ કે તે અન્ય લોકોની કંપનીની નાણાકીય સ્થિતિ સાથે વાતચીત કરે છે, અને દરેક ભાષાની જેમ ચોક્કસ વાક્ય રચના અને વ્યાકરણ નિયમો સમાન છે તેવીજ રીતે એકાઉન્ટિંગના કિસ્સાઓમાં આ નિયમો એ હિસાબી ધોરણો છે. (AS- Accounting Standard) તે દેશના નાણાકીય પત્રકો બનાવવા માટેના નિયમો અને નિયમોનું માળજું છે.

આ ધોરણો બવાવવા માટેના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ હોય.

૧. વિશ્વસનીયતાઃ નાણાકીય પત્રકોની વિશ્વસનીયતામાં સુધારો કરવો એ મુખ્ય ઉદ્દેશ છે હવે કારણ કે નાણાકીય પત્રકોના ધોરણોને અનુસરવા પડશે, જેથી વપરાશ કરતાઓ તેમના પર આધાર રાખી શકે. જો કંપનીઓના નાણાકીય પત્રકો આ ધોરણોને અનુરૂપ ન હોય તો કંપની માટે ગંભીર પરિણામો હોઈ શકે.

2. તુલના: આ ધોરણોને અનુસરવાથી આંતરીક અને આંતરાણિક તથા આંતરિક અને બાહ્ય રીતે તેની તુલના કરવામાં આવે છે. આ ધોરણોને અનુસરવાથી બજારમાં પેઢીની પરિસ્થિતિ અને તેની પ્રગતિ તપાસવામાં મદદગ્રહ થાય છે.

3. નિતિ અને મૂલ્યાંકનની પદ્ધતિ: હિસાબી ધોરણો એ નિતિઓનો એક સેટ પણ પ્રદાન કરે છે જેમાં નાણાકીય પત્રકો બનાવવાની જરૂરી માહિતી અને વિવિધ નાણાકીય વ્યવહારોની મૂલ્યાંકન પદ્ધતિઓ આપવામાં આવે છે.

3.3 હિસાબી ધોરણોની ઉપયોગીતા:

હિસાબી ધોરણોના પરિણામે વિવિધ ધંધાકીય એકમોના હિસાબોમાં એકરૂપતા અને સમાનતા જળવાય છે. આમ, સમાન ધોરણો થતા હિસાબી પેઢીને અન્ય પેઢીના હિસાબો સાથે તેમ જ એક જ પેઢીના એક વર્ષના હિસાબોને અન્ય વર્ષના હિસાબી સાથે સરખામણી કરવી શક્ય બને છે.

આવા તુલનાટક અભ્યાસને આધારે પેઢીની નબળાઈ શોધી તે દૂર કરવાના પગલા લર્ધ શકાય છે.

હિસાબી ધોરણોએ એકાઉન્ટિંગની દુનિયામાં સત્તાધિકાર છે તે ખાતરી કરે છે કે સંભવિત રોકાણકારોને આપવામાં આવેલી માહિતી કોઈપણ રીતે ગેરમાર્ગ દોરતી નથી. આવા હિસાબી ધોરણો સરકાર તેમજ અન્ય સંખ્યાઓને પણ હિસાબી કાયદા બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરુ પાડે છે.

૧. નાણાકીય પત્રકોની એકરૂપતા

૨. નાણાકીય પત્રકોની વિશ્વાસનીયતામાં સુધારો

૩. હિસાબોમાં હેરફાર કે ગોલમાલ અટકાવે

૪. ઓડિટર માટે સહાયરૂપ

૫. તુલનાટકતા

૬. વ્યવસ્થાપક જવાબદારી નિશ્ચિત

૭. હિસાબી સિદ્ધાંતોની ભૂતો સુધારવા

૮. હિસાબી ધોરણોના અમલ અને હિસાબોની ગુણવત્તામાં સુધારો

૧. નાણાકીય પત્રકોની એકરૂપતા: હિસાબી ધોરણોએ વ્યવહારને લખવા માટેના નિયમો પૂરા પાડે છે. જેને કારણે હિસાબનીશોને હિસાબો તૈયાર કરવામાં સરળતા રહે છે. હિસાબી ધોરણોના અભાવે હિસાબનીશોમાં હિસાબો તૈયાર કરવા અને તેની રજુઆતમાં એકરૂપતા જોવા મળશે નહીં. જેથી હિસાબોનું અર્થાદન કરી નિર્ણય લેવામાં મુશ્કેલી સર્જાય. આમ હિસાબી ધોરણો હિસાબનીશોને હિસાબો તૈયાર કરવા માટે ચોક્કસ નિતિ નિયમો પૂરા પાડે છે. જે અનુસાર તેમણે હિસાબો તૈયાર કરવાના હોય છે. જેથી હિસાબોમાં એકરૂપતા જળવાઈ રહે છે.

૨. નાણાકીય પત્રકોની વિશ્વાસનીયતામાં સુધારા: કંપનીમાં ધણા હિસ્સેદારો હોય છે અને તેઓ તેમની માહિતી માટે નાણાકીય પત્રકો પર આધાર રાખે છે. આમાના ધણા હિસ્સેદારો આ નાણાકીય પત્રકો દ્વારા પ્રદાન કરેલા આંકડા પર તેમના નિર્ણયોનો આધાર રાખે છે. કંપનીના ધણા એના સંભવિત રોકાણકારો તેમના રોકાણોના નિર્ણયોના નાણાકીય પત્રકો પર આધાર રાખે છે. તેથી આ પત્રકો કંપનીના નાણાકીય સ્થિતિની સાચી અને સચોટ ચિત્ર રજુ કરે તે જરૂરી છે. હિસાબી ધોરણો (AS) એ ખાતરી આપી છે કે પત્રકો ભરોસાપાત્ર અને વિશ્વસનીય છે.

૩. હિસાબોમાં હેરફાર કે ગોલમાલ અટકાવે: હિસાબી ધોરણો (AS) એ નાણાકીય પત્રકો માટેના સિદ્ધાંતો અને પ્રક્રતિઓને નક્કી કરે છે. જે બધી સંસ્થાઓને અનુસરવાની રહેશે. જેને લીધી કોઈ

પણ સંચાલન નાણાકીય આંકડા સાથે ચેડા કરી શકતું નથી. આ ધોરણોને અનુસરવા વૈકલ્પિક નથી, તે ફરજીયાત છે.

તેથી કોઈપણ ધંધાકીય પેઢી કોઈપણ નાણાકીય માહિતી જોઈ રીતે રજુઆત કરી શકે નહીં અને જો કોઈ પણ ધંધાકીય કપટ કે ખોટી રજુઆત કરે તો આ હિસાબી ધોરણો તેમના માટે મુશ્કેલી બનાવે છે.

૪. ઓડિટર માટે સહાયકૃપા: ધંધાકીય પેઢી તથા વેપારી પેઢીઓના હિસાબોનું ઓડિટ કરતા ઓડિટરો માટે આ હિસાબી ધોરણો પદદર્શક દીવાદાંડી જેવા છે. કારણ કે હિસાબી ધોરણોએ લેખિત માળખામાં નક્કી કરેલા નિતિ નિયમો પ્રમાણે દર્શાવવામાં આવેલ છે. જો ઓડિટ કર્યા બાદ જો તેમાં ભૂલો કે ગોટાળા જોવા મળે તો ઓડિટર તે અંગે જવાબદાર બને છે અને તેની પ્રતિક્ષા જોખમાય છે. તેથી જો ઓડિટર તપાસ કરે કે નિતિઓ યોગ્ય રીતે અનુસરવામાં આવી છે તો તે જાતરી આપી શકે છે કે નાણાકીય નીચેદનો સાચા અને વ્યાજળી છે.
૫. તુલનાત્મકતા: હિસાબી ધોરણોનું બીજું એક આ મુખ્ય ઉદ્દેશ છે. જેના કારણે દેશની તમામ કંપનીઓ હિસાબી ધોરણોના સમાન સમૂહને અનુસરે છે અને તેમનું નાણાકીય ખાતું અમુક અંશે તુલનાત્મક બને છે. નાણાકીય, નીચેદનોના વપરાશ કર્તાઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા વિવિધ કંપનીઓના નાણાકીય પ્રકાર્શનનું વિશ્લેષણ અને તુલના કરી શકે છે.
૬. ઉપરાંત સમાન કંપનીના જુદા-જુદા વર્ધના બે નીચેદનની તુલના કરી શકાય છે જેથી કંપનીનો વિકાસ તેના વપરાશ કર્તાઓને બતાવી શકાય.
૭. વ્યવસ્થાપક જવાબદારી નિશ્ચિતા: હિસાબી ધોરણો એ પેઢીના સંચાલનની કામગીરીને માપવામાં સહાય કરે છે. તે ધંધાની નફાકારતા વધારવા, પેઢીની તરતતા જાળવી રાખવા અને વ્યવસ્થાપક મંડળની આવશ્યક નાણાકીય ફરજોને સંચાલિત કરવાની ક્ષમતા માપવામાં સહાય કરી શકે છે. વ્યવસ્થાતંત્રએ કુશળતા પૂર્વક તેમની એકાઉન્ટિંગ નિતીઓ પસંદ કરવી આવશ્યક છે. જો હિસાબી નિતીઓમાં સતત ફેરફારો કરવામાં આવે તો નાણાકીય વપરાશ કર્તાઓ માટે તે મુંજવણ તરફ દોરી જાય છે.
૮. હિસાબી સિદ્ધાંતોની ભૂલો સુધારવા: હિસાબી ધોરણો કે સિદ્ધાંતોના અભાવને કારણે દરેક હિસાબનીશ દ્વારા તૈયાર કરેલ હિસાબોમાં ખામીઓ અને વિવિધતા પણ જોવા મળતું હતું પરંતુ ૨૦ મી સદીના અંતમાં હિસાબી ધોરણોમાં આવેલી સુધારણાને પરિણામે હિસાબી સિદ્ધાંતોમાં રહેલી ભૂલો દુર થઈ છે જેને કારણે હિસાબો પ્રયોગ વિવિધ પક્ષકારોની વિશ્વાસનીયતામાં વધારો થયો છે.
૯. હિસાબી ધોરણોના અમલ અને ગુણવત્તામાં સુધારો કરવાઃ ઓડિટર દ્વારા રજૂ કરાયેલા ઓડિટર અહેવાલમાં ચકાસવું જરૂરી બને છે અને જો હિસાબી ધોરણોનું પાલન ન થયું હોય તો ઓડિટરે પોતાના અહેવાલમાં તે અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે છે. જેથી વિવિધ પક્ષકોરોનું હિત જળવાઈ રહે. શરૂઆતના તબક્કે હિસાબી ધોરણો ફક્ત ભલામણ સ્વરૂપે જ હતા. પરંતુ હવે હિસાબી ધોરણો અંગે સભાનતા વધતા હિસાબી ધોરણોનું પાલન કરવું જરૂરી બન્યું છે.

૩.૪ હિસાબી ધોરણો બહાર પાડવાની પ્રક્રિયા:

હિસાબી ધોરણોએ વિશિષ્ટ એકાઉન્ટિંગ નિતીઓ અને નાણાકીય પત્રકોની તૈયારી અને રજુઆત માટે સંસ્થા દ્વારા અપનાવામાં આવેલી નિતીઓને લાગુ કરવાની પદ્ધતિઓ છે. નાણાકીય પત્રકોની તૈયારીમાં નાણાકીય માહિતી ઓળખ, માપ, પુરાવાના સંબંધના નિયમો છે. ઉચ્ચે ગુણવત્તાવાળા હિસાબી ધોરણો અનિશ્ચિતતાને ઘટાડે છે અને સંપૂર્ણ નાણાકીય કાર્ય ક્ષમતા અને રોકાણકારોના આત્મવિશ્વાસમાં વધારો કરે છે તે જરૂરી છે કે નાણાકીય અહેવાલો ઉપયોગી, પ્રદાનપાત્ર, તુલનાત્મક અને પારદર્શક ઉપયોગી માહિતી પ્રદાન કરે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ (ASB) દ્વારા દેશને લાગુ પડતા કાયદા, રિવાજ તથા વ્યવસાયના સ્વરૂપને

દ્વાનમાં લઈને ભારતીય હિસાબ ધોરણો ઘડતી વખતે આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો તથા આંતરાષ્ટ્રીય એકાઉન્ટિંગ રીપોર્ટીંગ સ્ટાન્ડર્ડ ને દ્વાનમાં લે છે. હિસાબી ધોરણો બહાર પાડવાની પ્રક્રિયા હૂંકમાં નીચે મુજબ વર્ણવી શકાય.

૧. હિસાબી ધોરણોની જરૂરિયાત નક્કી કરવી
 ૨. અભ્યાસ જૂથનું નિર્માણ
 ૩. સૂચિત ધોરણોનો પ્રાથમિક ફ્રાફટ તૈયાર કરવો
 ૪. વિવિધ હિસાબી સંસ્થાઓ સમક્ષ પ્રાથમિક ફ્રાફટની રજુઆત
 ૫. ફ્રાફટનું વિશ્લેષણ
 ૬. ફ્રાફટનું પ્રસારણ
 ૭. ફાઇનલ ફ્રાફટ અંગે ટીકાઓ અને સૂચનો મેળવવા
 ૮. ફ્રાફટમાં જરૂરી સુધારા કરી અંતિમ સ્વરૂપ આપવું
 ૯. હિસાબી ધોરણો બહાર પાડવા
૧. હિસાબી ધોરણોની જરૂરિયાત નક્કી કરવીઃ પ્રથમ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ડ્રારા (ASB) એવા વિશાળ ક્ષેત્રોને નક્કી કરવામાં આવે છે જેમાં હિસાબી ધોરણો બનાવવાની જરૂર છે.
 ૨. અભ્યાસ જૂથનું નિર્માણઃ અભ્યાસ જૂથની સ્થાપના એ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા ડ્રારા નક્કી કરવામાં આવે છે. જે હેતુઓને દ્વાનમાં રાખીને આ નિર્ધારાંત વ્યક્તિત્વોનું જૂથ રચવામાં આવે છે તે પ્રમાણે તેઓને સતત પણ આપવામાં આવે છે.
 ૩. સૂચિત ધોરણોનો પ્રાથમિક ફ્રાફટ તૈયાર કરવોઃ અભ્યાસ જૂથ સૂચિત ધોરણોના ફ્રાફટ તૈયાર કરે છે. જેમાં નીચેની વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
 - (૧) હિસાબી ધોરણોનો ઉદ્દેશ્ય
 - (૨) હિસાબી ધોરણોની વ્યાપકતા
 - (૩) હિસાબી ધોરણોમાં આવતા વિશિષ્ટ પદોની સમજુતિ
 - (૪) લાગુ પડતા સિક્ઝાંતોની વ્યાપ્તા અને શરત
 - (૫) રજુઆત અને પ્રસ્તુતિ કરણાની જરૂરિયાત
 અભ્યાસ જૂથ દ્વારા તૈયાર કરેલ ફ્રાફટ (ASB) ચકાસે છે તથા જરૂર જણાય ત્યાં સુધારા પણ સૂચવે છે.
 ૪. વિવિધ હિસાબી સંસ્થાઓ સમક્ષ પ્રાથમિક ફ્રાફટની રજુઆતઃ આ પગલામાં એ.એસ.બી.(ASB) ભારતના ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યુટના કાઉન્સિલના સભ્યોને (ASB) ફ્રાફટનું પ્રસારણ કરે છે અને નીચે આપેલી ટિપ્પણીઓ માટે સંસ્થાઓને સ્પષ્ટ કરે છે.
 - (૧) ઇન્સ્ટિટ્યુટ ઓફ પડક્સ એન્ડ કોર્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા
 - (૨) ભારતના કંપની સચિવોની સંસ્થા
 - (૩) કંપની બાબતોના મંત્રાલય
 - (૪) ભારતના કંટ્રોલર અને ઓડિટ જનરલ
 - (૫) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ

- (૬) જોહેર સાહસોની સ્થાવી સમિતિ
- (૭) ભારતીય રિકર્ડ બેંક
- (૮) ઇન્ડિયા બેંક એસોસિયેશન
- (૯) સિંગ્યુરિક્ટીજ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
- (૧૦) એસોસિએટ ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન કોન્ફરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
- (૧૧) એ.એસ.બી. દ્વારા સંબંધિત કોઈપણ અભ્યાસના
૫. ફ્રાફટનું વિશ્વેષણા: આ તબકામાં એ.એસ.બી અભ્યાસ જીથ દ્વારા તૈયાર કરાયેલ પ્રારંભિક ફ્રાફટને દ્યાનમાં લે છે. અને જો હિસાબી ધોરણ કરતાં કંઈપણ સુધારા કરવાની જરૂર જણાશે. તો નીચે મુજબ પગલાં લેશો.
- (૧) એ.એસ.બી. તેનું સંશોધન કરે છે. (૨) એ. એસ.બી. એ અભ્યાસ ગુપ માટે સમાન છે.
૬. ફ્રાફટનું પ્રસારણા: સૂચિત ધોરણના પ્રસ્તુતિકરણના ફ્રાફટને આઈ.સી.એ.આઈ. અને જાહેર સભ્યોની ટિપ્પણીઓ માટે જારી કરવામાં આવે છે.
૭. ફાઈનલ ફ્રાફટ અંગે ટીકાઓ અને સૂચનો મેળવવા: ફ્રાફટ હિસાબી ધોરણો ઉપર તેમના મંતવ્યો નક્કી કરવાના હેતુસર ઉપરોક્ત સંસ્થાના પ્રતિનિધીઓ સાથે બેઠક ધરાવે છે. ચર્ચાના વિશ્વેષણના આધારે એ.એસ.બી સૂચિત હિસાબી ધોરણોના ફ્રાફટને અંતિમ સ્વરૂપ આપે છે.
૮. ફ્રાફટમાં જરૂરી સુધારા કરી અંતિમ સ્વરૂપ આપવું: પ્રામ કરેલી ટિપ્પણીઓ તથા આઈ.સી.એ.આઈ.ની કાઉન્સિલ અંતિમ સુદાઓને હિસાબી ધોરણો દ્યાનમાં લે છે અને જો જરૂરી હોય તો એ.એસ.બી.ની સલાહ સાથે તેને સુધારે છે અને એ.એસ.બી. સૂચિત ધોરણોના ફ્રાફટને અંતિમ સ્વરૂપ આપે છે.
૯. હિસાબી ધોરણો-૧ હિસાબી નીતિઓની રજૂઆત
- આ હિસાબી ધોરણ નીજી માં ICAI (ધ ઇન્સિસ્ટટ્યુટ ઓફ ચાર્ટર્ડ એક્ઝાઇન્ટન્સ ઓફ ઇન્ડિયા) દ્વારા બહાર પડાવામાં આવ્યું છે.
 - આ હિસાબી ધોરણો નાણાકીય પત્રકો તૈયાર કરવા અને રજૂ કરવા એકમે અપનાયેલ ચોક્કસ હિસાબી નીતિઓ અને સિદ્ધાંતોની દર્શાવે છે.
 - ધંધાકીય એકમનાં નાણાકીય પત્રકોમાં દર્શાવિલ નશ કે નુકશાનને ધંધાકીય એકમે અપનાયેલ હિસાબી નીતિઓ અને સિદ્ધાંતોથી અસર પામે છે. આવી હિસાબી નીતિઓ એકમે બદલાય છે.
 - કેટવાક સંજોગોમાં કાયદાકીય રીતે ધંધાકીય એકમે પત્રકો તૈયાર કરવા અને રજૂ કરવા જે તે હિસાબી નીતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો છે તે દર્શાવવું જરૂરી હોય છે.
 - ICAI દ્વારા રજૂ કરવામાં આવેલ ધોરણોમાં અમૃક નીતિઓના પ્રગતિકરણની ભલામણ કરવામાં આવી છે.
- દા.ત. વિદેશી ચલણાના સંદર્ભમાં વિદેશી ચલણા ફેરબદલીની નીતિ

- હાલના સમયમાં ભારતમાં કેટલાક એકમો પોતાના વાર્ષિક અહેવાલમાં અલગથી ઉપયોગમાં લીધેલ હિસાબી નીતિઓ અંગેનું પત્રક રજુ કરે છે.
- સામાન્ય રીતે નાણાકીય પત્રકોમાં સંપૂર્ણ કે નિયમિત રીતે હિસાબી નીતિઓ રજુ કરવામાં આવતી નથી. કેટલાક ધંધાકીય એકમો પોતાના હિસાબોમાં પેટાનોંધ તરીકે દર્શાવે છે. અથવા અમુક મહત્વની હિસાબી નીતિઓનો જ ઉલ્લબ્ધ કરે છે.
- હાલમાં કેટલાક ધંધાકીય એકમો પોતાનાં વાર્ષિક હિસબોમાં અલગ પત્રક તરીકે હિસાબી નીતિઓનું પત્રક દર્શાવે છે. જ્યારે કેટલાક સંજોગોમાં આવી હિસાબી નીતિઓ વાર્ષિક હિસાબોના જ એક ભાગ ગાણાય છે. જ્યારે અન્ય ડિસ્ટ્રિક્ટમાં આવી નીતિઓ પૂરક માહિતી તરીકે દર્શાવાય છે.
- આ હિસાબી ધોરણોનો મુખ્ય હેતુ હિસાબી નીતિઓ અંગેની જરૂરી સમજ પૂરી પાડવાનો છે. આ ઉપરાંત અન્ય હેતુ ધંધાકીય એકમો વચ્ચે નાણાકીય પત્રકોનો તફાવતને સમજવામાં ઉપયોગી નીવડે છે.

હિસાબી નીતિઓનું કાર્યક્ષેત્ર:

આ માળખું નીચેના મુદ્દાઓને દ્વારાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

- હિસાબી નીતિઓનો ઉદેશ
- ગુણાત્મક લાક્ષણિતાઓ જે હિસાબી નીતિઓની માહિતીની ઉપયોગીતા નક્કી કરે છે.
- વ્યાખ્યા, સમાધાન અને ભાપદંડ જેનાથી નાણાકીય પત્રકો બનાવવામાં આવે છે.
- મૂડી અને મૂડી જાળવણીના સિદ્ધાંતો

માળખાકીય રૂપરેખા મૂળભૂત પ્રરૂપના શૈણીના જવાબ આપે છે કે

1. હિસાબી નીતિઓ શું છે ?
2. તે કોના માટે છે ?
3. તેઓ કોણા છે ?
4. તેઓ માટે હિસાબી નીતિઓ કઈ રીતે ઉપયોગી છે ?

3.૬ હિસાબી નીતિઓમાં વપરાશકર્તાઓ:

હિસાબી નીતિઓના વપરાશકર્તાઓમાં વર્તમાન અને સંભવિત રોકાણકારો, લેણદારો, ગ્રાહકો અને સરકાર તથા સરકારી એજન્સીનો સમાવેશ થાય છે.

હિસાબી નીતિઓના વપરાશકર્તાઓ અને તેમની માહિતી:

નંબર	વપરાશકર્તાઓ	જરૂરિયાત
૧.	રોકાણકારો	ધંધાને જોખમી મૂડી પૂરી પાડનાર રોકાણકારો તેમના દ્વારા રોકવામાં આવેલી મૂડી પર વળતર સાથે સંકળાયેલા છે. તેમને હિસાબી નીતિઓની માહિતીની જરૂરીયાત છે કારણ કે તેના પરથી તેઓ શેરને વેચવા, પકડી રાખવા કે ખરીદવા તેની માહિતી મેળવી શકે છે. સાથે સાથે કંપનીની ડિવિડન્ડ ચૂકવવાની ક્ષમતાને પણ માપી શકે છે.
૨.	કર્મચારીઓ	કર્મચારી અને તેમના પ્રતિનિધિ જૂથને તેમના માલિકની અથવા તો ધંધાદારી પેઢીની સ્થિરતા અને નફાકારતામાં વિશેષ રસ હોય છે જેના પરથી તેઓ તેમને સંસ્થાના ગિવૃત્તિના લાભો અને રોજગારીની તક પૂરી પાડવા માટે કંપનીની સ્થિતિને માપી શકે.

૩.	નાણાં ધીરજાર	કંપનીને ઉછીની મૂડી આપનારને માહિતીમાં રૂચિ હોય છે કે જેનાથી તેઓએ આપેલી લોન અને વ્યાજની ચુકવણી કરવામાં આવશે કે નહિ.
૪.	સપ્લાયર અને અન્ય વેપારી લેણદારો	સપ્લાયર અને અન્ય લેણદારોને માહિતીમાં રૂચિ હોય છે કારણ કે તેમણે આપેલી રકમની ચુકવણી કરવામાં આવશે કે નહિ ? જ્યારે વેપારી લેણદારોને ટુકાગાળા માટે કંપનીમાં રસ હોય છે જો કંપની તેમના મુખ્ય ગ્રાહક બને.
૫.	ગ્રાહક	ગ્રાહકોને કંપનીના અસ્ટિટ્યુન્ડ સાથે સંકળાયેલી બાબત માટે હિસાબી નીતિઓમાં રસ હોય છે કારણ કે તેઓ લાંબાં ગાળાથી કંપની સાથે સંકળાયેલા હોય છે.
૬.	સરકાર અને સરકારી એજન્સી	સરકાર અને સરકારી એજન્સી હિસાબી નીતિની માહિતીમાં રસ ધરાવે છે કારણ કે તેના પરથી કરવેરાની નીતિ, અને રાષ્ટ્રીય આવક નક્કી કરવામાં આવે છે.

હિસાબી નીતિઓનો ઉદેશ:

હિસાબી નીતિનો મુખ્ય ઉદેશ એ પેઢીની નાણાકીય સ્થિતિની રજુઆત અને નાણાકીય પત્રકો બહાર પાડવાનો છે. કોઈ પણ પેઢી કે કંપનીની નાણાકીય સ્થિતિ, નાણાકીય કામગીરી અને રોકડ પ્રવાહ વિશેની માહિતી તેના ઉપરોક્ત વપરાશકર્તાઓ માટે ઉપયોગી છે.

આ હેતુંને પહોંચાયા માટે નાણાકીય પત્રકો નીચેની માહિતી પૂરી પાડે છે.

૧. મિલકતો
૨. જવાબદારી
૩. દિક્કિયટી
૪. લાલ અને નુકશાન
૫. માલિકો તરીકે તેમની ક્ષમતામાં માલિકો દ્વારા યોગદાન અને વહેચણી
૬. રોકડપ્રવાહ

૩.૭ હિસાબી નીતિઓની સામાન્ય લાક્ષણિકતાઓ:

ભારતીય હિસાબી ધોરણ-૧ એ તેમને વધુ સુસંગત અને વિશ્વાસનીય બનાવવા માટે નીચેની સુવિધા અને નાણાકીય પત્રકોની લાક્ષણિકતાઓ સૂચવ્યાં છે.

૧. હિસાબી ધોરણ સાથેની સાચી અને ચોગ્ય પ્રસ્તુતિ અને પાલન
 ૨. ચાલુ પેઢીનો ખ્યાલ
 ૩. ડિપજ-ખર્ચનું સંપાદન
 ૪. મહત્વતા
 ૫. પૂર્ણ રજુઆત
 ૬. હિસાબી સમય
૧. હિસાબી ધોરણ સાથેની સાચી અને ચોગ્ય પ્રસ્તુતિ અને પાલન:
 ૨. ચાલુ પેઢીનો ખ્યાલ: આ ખ્યાલ મુજબ જ્યારે ધંધો ચાલુ કરવામાં આવે છે ત્યારે એવું અનુમાન કરવામાં આવે છે કે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેશે.

- ૧) કાયમી મિલકતો પાકા સરવૈયામાં તેની ધસારા બાદ કિમતે દર્શાવાય છે. ટૂકમાં તેની બજાર કિમતે દર્શાવવામાં આવતી નથી, કાયમી મિલકતો દર્ઘામાં લાભાં સમય સુધી ઉપયોગ માટે ખરીદવામાં આવે છે અને તે પુનઃવેચાણ માટે ખરીદવામાં આવતી નથી.
- ૨) ચાલુ પેઢીના આધારે અગાઉથી ચૂકવેલ ખર્ચ પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવે છે કારણ કે ધંધો લાભાં સમય સુધી ચાલુ રહેવાનો છે અને એની અપેક્ષા છે કે આવા અગાઉથી ચૂકવેલ ખર્ચનો લાભ બિવિધમાં મળશે.
- ૩) પ્રસારિત મહેસુલી ખર્ચ ધારી વખતા પાકા સરવૈયામાં મિલકત બાજુ પર દર્શાવવામાં આવે છે. કારણ કે ચાલુ પેઢીના ધારણા મુજબ ધંધો લાભાં સમય સુધી ચાલુ રહેવાના છે અને એકમને આવા ખર્ચનો લાભ બિવિધમાં મળશે.
- ૪) અર્દ્ધ તૈયાર માલનું મુલ્યાંડન તેના માટે થયેલ પડતરણા આધારે કરવામાં આવે છે પણ તેની ઉપજ ચાર્ય કિમતના આધારે કરવામાં આવતું નથી. જો ધંધા બંધ થાય તો આવા અર્દ્ધ તૈયાર માલની ખૂલ ઓછી કિમત ઉપજે, પરંતુ ચાલુ પેઢીની ધારણા મુજબ એવું અનુમાન થાય કે ઉત્પાદન પ્રક્રિયા માલ સંપૂર્ણ પણો તૈયારી થઈ જાય ત્યાં સુધી ચાલસે.
- ૫) ચાલુ પેઢીની ધારણાને આધારે ખર્ચને મૂડી ખર્ચ અને મહેસુલી ખર્ચ એમ બે વિભાગમાં વહેચવામાં આવે છે. દ્વાનમાં રાખો કે નીચેના સંજોગોમાં ચાલુ પેઢીની ધારણા દ્વાનમાં લેવાશે નાંનિ:
- માસ હેતુ માટે સ્થપાયેલ ધંધાકીય એકમનું ધ્યેય પૂરું થાય કે અતિ ટૂકા ગાળામાં તે પૂરું થવાની શકતા હોય .
 - જ્યારે ઔદ્ઘોગિક એકમને માંદું એકમ જાહેર કરવામાં આવે.
 - જ્યારે ધંધાકીય એકમ તીવ્ર નાણાંકીય મુશ્કેલીમાં હોય અને ટૂકા સમયમાં તેનું વિસર્જન થવાની શક્યતા હોય.
 - જ્યારે કંપનીનું વિસર્જન કરવા માટે લિકલીડિટરની બિમાયૂક કરવામાં આવી હોય.
૩. ઊપજ-ખર્ચનું સંપાદન: આ સિદ્ધાંત ઊપજ અને ખર્ચ ક્યારે સંપાદિત થયેલ ગણાય તે જણાય છે. આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ જે સમયને લગતી ઊપજ કે ખર્ચ હોય તે સમયની આવક કે ખર્ચ ગણવા જોઈએ પછી ભલે તે સમયમાં રોકડ ન મળી હોય કે ન ચૂકવાઈ હોય. આમ, ઊપજ કે ખર્ચ જે સમયગાળાને લગતા હોય તે સંમયગાળામાં તેનું સંપાદન થયેલ છે તેમ ગણાયું. આ સિદ્ધાંત મુજબ આવકનું સંપાદન ત્યારે થયેતું ગણાયું જ્યારે તે કમાઈ લીધી હોય અથવા મળવાપત્ર થઈ હોય. પછી ભલે તે માટે રોકડ મળી હોય કેન મળી હોય, એ જ રીતે ખર્ચ થઈ ગયો હોય અથવા ચૂકવવાપત્ર થાય પછી ભલે તે માટે રોકડ ચૂકવાઈ હોય કે ન ચૂકવાઈ હોય.
- આ સિદ્ધાંત બે પદ્ધતિ પર આધાર રાખે છે (૧) રોકડના આધારે અને (૨) સંપાદન ના આધારે રોકડના આધારે આવક ત્યારે જ નોંધવામાં આવે છે જ્યારે રોકડ મળી ગઈ હોય અને ખર્ચ ત્યારે નોંધવામાં આવે જ્યારે તે ખરેખર ચૂકવવામાં આવે. નીચેના ઉદાહરણો પરથી આ સિદ્ધાંતને સમજવામાં મદદદિય થશે.
- (૧) જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલી ગણાય છે. ભલે રોકડ મળી ન હોય પરંતુ ઉધાર વેચાણ થાય ત્યારે આવક સંપાદિત થયેલી ગણાય.
- (૨) માર્ચ, ૨૦૧૮ ના માસ માટે ચૂકવવાનો પગાર ભલે અપ્રિલ ૨૦૧૮ માં ચૂકવાય તો પણ તે માર્ચ ૨૦૧૮ ના માસ માટેનો જ ખર્ચ ગણવામાં આવે છે. કારણ કે માર્ચ મહિનામાં કર્મચારીઓની

સેવાઓનો લાભ લીધો હોય છે. સંપાદનના સિદ્ધાંતના આધારે આ ખર્ચ માર્ય ૨૦૧૮ માટે કરવામાં આવેલ હોવાથી જે સમયને લગતો આ ખર્ચ છે તે જ સમયમાં તેને ધ્યાનમાં લેવામાં આવશે.

(3) માલના વેચાણ અંગે અગાઉથી રોકડ મળી ગઈ હોય તો પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી અથવા જ્યાં સુધી આ ઓર્ડર સામે માલ પરો પાડવાસાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલ ગણાતી નથી. સંપાદનના સિદ્ધાંતના આધારે આવક ત્યારે જ સંપાદિત થયેલ ગણાય જ્યારે તે કમાયેલ હોય કે મળવાપાત્ર થઈ હોય.

૪. મહત્વતા: આ ખ્યાલ પૂર્ણ રજુઆતના ખ્યાલ સાથે પણ સંકળાયેલ છે. પૂર્ણ રજુઆતના ખ્યાલ મુજબ બધી જ મહત્વની બાબતોની રજુઆત નાણાકીય પત્રકોમાં કરવી જોઈએ. કઈ બાબત મહત્વની છે અને કઈ બાબત મહત્વની નથી તે માટે કોઈ ચોક્કસ નિયમો ન આપી શકાય. તેનો આધાર હિસાબોમાં તેનું પ્રમાણ કે રકમ, સુસંગતા કે વ્યવહાર કે માહિતીનું ધંધામાં અગત્યતા ઉપર રહેલો છે.

૫. પૂર્ણ રજુઆત: કેટલાક લેખકો દ્વારા આ ખ્યાલને રજુઆતનો ખ્યાલ અથવા પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ કહેવામાં આવે છે. આ ખ્યાલ મુજબ નાણાકીય પત્રકોમાં બધી જ મહત્વની બાબતોની પૂર્ણ રજુઆત કરવી જોઈએ. નાણાકીય પત્રકોના ઉપયોગ કરેનાર માહિતી આધારિત આર્થિક નિર્ણય લઈ શકે તે માટે સંબંધિત બધી જ જરૂરી માહિતી નાણાકીય પત્રકોમાં પૂરી પાડવી જોઈએ. સામાન્ય રોકાણકારોના હિતને લગતી મહત્વની કોઈ માહિતી નાણાકીય પત્રકોમાં દર્શાવવાની રહી ન જરૂરી જોઈએ કે છુપાવવી ન જોઈએ.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૧૮ (૧) હેઠળ નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવતા હોવા જોઈએ. કંપની ધારાની કલમ ૧૩૩ મુજબ જાહેર કરેલાં હિસાબી ધોરણોની જોગવાઈ મુજબના હોવા જોઈએ અને પરિસ્થિતિ ત્ર માં આપેલા નંબુના પ્રમાણો હોવા જોઈએ. આ ખ્યાલને લગતી ઉદાહરણો આ મુજબ છે. (૧) ધસારાની પદ્ધતિમાં ફેરફાર એ મહત્વની બાબત છે. કારણ કે તેનાથી નફા-નુકશાન પર અસર થાય છે અને કાયમી મિલકતની પાકા સરવૈયામાં દર્શાવતી ચોપકે કિંમત પર પણ અસર થાય છે. (૨) સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફાર અંગેની માહિતી તેની અસર સાથે નાણાકીય પત્રકોમાં દર્શાવવી જોઈએ.

૬. હિસાબી સમય: અમુક લેખકો આ સિદ્ધાંતને હિસાબી મુદ્દત નો ખ્યાલ કહે છે. આ ખ્યાલ ચાલુ પેઢીના ખ્યાલ સાથે સંકળાયેલ છે. ચાલુ પેઢી અથવા ધંધાના સાતત્યના ખ્યાલ મુજબ અન્ય કે વિરુદ્ધ સુચનાને અભાવે ધંધો ખૂબ લાંબાં સમય સુધી અથવા અનિસ્થિત મુદ્દત સુધી ચાલુ રહેશે. તેથી ધંધાના આયુષ્યને ચોક્કસ હિસાબી સમય કે મુદ્દતમાં વહેચી દેવામાં આવે છે. આવા સમયગાળાને હિસાબી સમય કે હિસાબી મુદ્દત કહેવામાં આવે છે આવા દરેક હિસાબી સમયના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે હિસાબી સમય ૧૨ મહિનાનો હોય છે. હિસાબો મુજબ ધંધાના પરિણામો પણ દર વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે.

આ ખ્યાલ ઉપર આધારિત કેટલાંક ઉદાહરણો આ મુજબ છે. (૧) હિસાબી સમય કે હિસાબી મુદ્દતના ખ્યાલના આધારે નફા-નુકશાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. (૨) ધંધાનું આયુષ્ય ખૂબ લાંબાં સમય સુધી અથવા અનિસ્થિત સમય સુધીનું હોય છે તે ધારણાના લીધે આલુ આયુષ્ય અમુક અનુકૂળ હિસાબી સમયમાં વહેચી દેવામાં આવે છે કે જેથી એકમની આવી દરેક હિસાબી મુદ્દત માટે પરિણામ અને પરિસ્થિતિ જાણી શકાય.

૭. હિસાબી ધોરણ સાથેની સાચી અને યોગ્ય પ્રસ્તુતિ અને પાલન:

➢ હિસાબી નિતિએ પાકા સરવૈયાનું, નફા-નુકશાન ખાતાનું અને રોકડ પ્રવાહનું સાચું અને યોગ્ય દર્શય રજુ કરે છે.

- જો કોઈપણ કંપનીનું નાણાકીય પત્રક ભારતીય હિસાબી ધોરણો સાથે તૈયાર કરવામાં આવે તો તેણે રૂપણ અને બિન શરતી ધોખણા કરવી જોઈએ કે તૈયાર કરવામાં આવેલા પત્રકો ભારતીય હિસાબી ધોરણો મુજબ કરેલા છે.
- કોઈ પેઢી ખોટી હિસાબી નીતિઓને સાચી જહેર કરી શકતી નથી કે તેની સમજૂતી નોંધમાં આપેલી છે. દા.ત. જો આખર માલની તેની મૂળિક્ષમતે ગણવામાં આવ્યો હોય અને બજાર ડિમ્બત કે મૂળિક્ષમત બંને માંથી ઓછી કિંમતે ગણવામાં ન આવ્યો હોય તો માહિતી કે ગણતરીની વ્યાજબી ગણવામાં આવતી નથી અને તેને નોંધમાં પણ દર્શાવી શકાતું નથી.
- નીચે જણાયેલ અમુક સંજોગમાં જો ભારતીય હિસાબી ધોરણ સાથેનું અનુપાલન ગેરમાર્ગ દોરતું હોય તો ભારતીય હિસાબી ધોરણમાંથી પ્રસ્થાન કરવા માટે સાચી અને યોગ્ય પ્રસ્તુતિ જરૂરી બને છે. જો નીચે જણાયેલ મુજબ છે.

(૧) સંચાલને તારણ કાઢ્યું છે કે નાણાકીય નિવેદન એ પેઢીની નાણાકીય સ્થિતિનું પ્રદર્શન અને રોકડ પ્રવાહની સાચી અને યોગ્ય દાખિ રજૂ કરે છે. (૨) હિસાબી ધોરણનું માળખું અને તેનો નંબર કે જેનામાંથી તે રદ બાતલ થયા છે. (૩) જો કોઈ ધોરણ રદબાતલ અથવા તો નિકાળવામાં આવે તો તેની મિલકતો, જવાબદારી, નફા કે નુકશાન અને રોકડ પ્રવાહ પર શી અસર થશે અને સાથે સાથે દેરેક સમયગાળા માટે તેની શી અસર થશે તે બતાવવું જરૂરી છે.

નાણાકીય નીતિઓનું પ્રગતિકરણ:

નાણાકીય પત્રકોને સંપૂર્ણ રીતે સમજવા માટે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે અને રજુઆત વખતે ઉપયોગમાં લીધેલ મહત્વની હિસાબી નીતિઓનું નાણાકીય પત્રકોમાં ઉલ્લેખ કરવો જરૂરી છે.

- આવી નાણાકીય નીતિઓની રજુઆત નાણાકીય પત્રકોના એક ભાગ સ્વરૂપે હોવી જોઈએ.
- આવી હિસાબી નીતિઓ નાણાકીય પત્રકોમાં જુદા જુદા પત્રક, શીડચુલ કે નોંધો સ્વરૂપ જુદા જુદા સ્થાને દર્શાવવા કરતાં કોઈ એક જ જગ્યાએ આવી નીતિઓનું પ્રગતિકરણ કરવામાં આવે તો વપરાશ કર્તા માટે મદદરૂપ નિવંડે છે.
- અપનાયેલ હિસાબી નીતિઓ અંગે જરૂરી જણાય ત્યાં જરૂરી ખુલાસા આપવા જોઈએ.
- જો કોઈ હિસાબી નીતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો હોય જે ધંધાની ભૌતિક બાબતોને અસર કરતી હોય તો તેનો પણા ઉલ્લેખ કરવો જોઈએ. અને જો આવી હિસાબી નીતિમાં કરેલ ફેરફાર ચાલુ વર્ષની હિસાબી કે ધંધાકીય બાબતો પર ન પડતી હોય અને ભવિષ્યમાં પડવાની હોય તો તેનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.

અગત્યના હિસાબી સિદ્ધાંતો:

- નાણાકીય પત્રકોની તૈયારી અને રજૂઆત કરતી વખતે ઉપયોગમાં લીધેલ તમામ મહત્વની હિસાબી નીતિઓનું પ્રગતિકરણ કોઈ એક જ જગ્યાએ કરવું જોઈએ.
- આવી હિસાબી નીતિઓનું પ્રગતિકરણ એ નાણાકીય પત્રકોનો એક ભાગ છે. અને આવી હિસાબી નીતિઓનું પ્રગતિકરણ કોઈ એક જ જગ્યાએ કરવું જોઈએ.
- પાચાના હિસાબી ધોરણો જેવા કે ચાલુ પેઢીનો ખ્યાલ સુસંગતા અને ઉપાજનનો આધાર વગેરેનું પાલન નાણાકીય પત્રકોમાં થતું હોય તો તેનો અલગથી નાણાકીય પત્રકોમાં ઉલ્લેખ કરવો જરૂરી નથી. પરંતુ જો આવી પાચાની ધારણાઓનું પાલન હિસાબો તૈયાર કરતી વખતે થતું ન હોય તો તેનો ઉલ્લેખ નાણાકીય પત્રકોમાં કરવો જરૂરી છે.

ભારતીય હિસાબી ધોરણ મુજબ નાણાકીય નિવેદનો તૈયાર કરવાની સામાન્ય સૂચનાઓ:

- (૧) દરેક ભારતીય કંપની જે હિસાબી ધોરણોને અનુસરે છે તેમણે પોતાના નાણાકીય નિવેદનો આ અનુસાર અથવા અમુક સંજોગોમાં આપશ્યક ફેરફાર સાથે તૈયાર કરવા પડે છે.
- (૨) નાણાકીય નિવેદનમાં કંપનીના સંસ્થાપન પછી કંપની સમક્ષ મૂકવામાં આવેલ પ્રથમ નાણાકીય નિવેદન સિવાયની નોંધો તથા નાણાકીય નિવેદનમાં દર્શાવિલ બધી વિગતો માટે તાત્કાલિક અગાઉના પત્રકની અવેજી અનુઝ્પ રકમ દર્શાવવામાં આવે છે.
- (૩) નાણાકીય નિવેદનમાં એ તમામ માહિતી તથા વિગતો દર્શાવવામાં આવે છે જે તેના વપરાશકર્તાઓને વ્યક્તિગત રીતે અથવા સામુહિક રીતે અમુક ચોક્કસ સંજોગોમાં નિર્ણય લેવા માટે આધાર રૂપ નીવડે છે.
- (૪) અમુક નિશ્ચિત હેતુ માટે વાપરવામાં અથવા તો ઉપયોગમાં લેવામાં આપેલા શબ્દો કે વ્યાપ્તાનો અર્થ ભારતીય હિસાબી ધોરણો અનુસાર બદલાવવો જોઈએ નથી.
- (૫) જ્યારે કોઈપણ કાયદાને અથવા નિયમોને કંપનીના નાણાકીય પત્રકોમાં વિશિષ્ટ જાહેરાતની આપશ્યકતા જરૂરી હોય છે ત્યારે આ માળખું અંતર્ગત લોકોની જરૂરિયાત ઉપરાંત જણાવ્યું છે.

ભાગ-૧ પાકુ સરવૈયું

	વિગત	નોંધ	તારીખ ના રોજ
૧.	મિલકતો <ul style="list-style-type: none"> ૧. બિન ચાલુ મિલકતો <ul style="list-style-type: none"> ૧. સંપત્તિ, પ્લાન્ટ અને સાધનો ૨. કાર્યશીલ મૂડી ૩. રોકાણો ૪. પાધડી ૫. અન્ય દશ્ય મિલકતો ૬. અદશ્ય મિલકતો વિકાસ હેઠળ ૭. જૈવિક સંપત્તિ ૮. નાણાકીય સંપત્તિ <ul style="list-style-type: none"> ➤ રોકાણો ➤ વેપારી લેણાં ➤ લોન ➤ અન્ય મિલકતો ૯. કર સંપત્તિ (ચોખ્ખી) ૧૦. અન્ય બિન ચાલુ મિલકતો 		
૨.	ચાલુ મિલકતો <ul style="list-style-type: none"> ૧. માલ સાખ્રગી ૨. નાણાકીય સંપત્તિ <ul style="list-style-type: none"> ➤ રોકાણો ➤ વેપારી લેણાં ➤ રોકડ અને રોકડ સમકક્ષ 		

	<ul style="list-style-type: none"> ➤ બેંક સિલક ➤ ટુંકાગાળાની લોન ➤ અન્ય મિલકતો <p>૩. કર સંપત્તિ</p> <p>૪. અન્ય ચાલુ મિલકતો</p> <p>કુલ</p>		
--	--	--	--

	વિગત	નોંધ	તારીખના રોજ
	<p>ઇક્ષિપટી અને જવાબદીરીઓ</p> <p>ઇક્ષિપટી</p> <p>૧. ઇક્ષિપટી મૂડી</p> <p>૨. અન્ય મૂડી</p>		
૧.	<p>જવાબતારીઓ:</p> <p>બિનચાલુ જવાબદારીઓ</p> <p>૧. નાણાકીય જવાબદારીઓ</p> <ul style="list-style-type: none"> ➤ ઉધીના નાણાં ➤ વેપારી દેવાં ➤ અન્ય નાણાકીય જવાબદારી <p>૨. અનામત</p> <p>૩. કર માટેની જવાબદારી</p> <p>૪. અન્ય બિન ચાલુ જવાબદારી</p>		
૨.	<p>ચાલુ જવાબદારીઓ</p> <p>૧. નાણાકીય જવાબદારીઓ</p> <ul style="list-style-type: none"> ➤ ઉધીના નાણાં ➤ વેપારી દેવાં ➤ અન્ય નાણાકીય દેવાં <p>૨. અન્ય ચાલુ જવાબદારીઓ</p> <p>૩. અનામતો</p> <p>૪. કર માટેની જવાબદારીઓ</p>		
	કુલ : ઇક્ષિપટી અને જવાબદારીઓ		

૩.૮ હિસાબી ધોરણ-૨

માલસામગ્રીનું મૂલ્યાંકન: હિસાબી ધોરણ-૨ એ ઇન્વેન્ટરી (સ્ટોક)નું મૂલ્યાંકન કરવા માટે ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાર્ટ એક્ઝાઉન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ઉદ્દેશ: આ હિસાબી ધોરણ એ ઇન્વેન્ટરી કે સ્ટોકનું મૂલ્યાંકન નક્કી કરવાની અલગ અલગ પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિને અપનાવવી તથા આખર સ્ટોક કે ઇન્વેન્ટરી કઈ કિંમતે પાકા સરવૈચામાં બતાવવની છે તે નક્કી કરવાનું છે. જ્યાં સુધી આખર સ્ટોક વેચાતો નથી ત્યાં સુધી તેને કઈ પદ્ધતિથી બતાવવો એ નક્કી કરવામાં આવે છે. અને જ્યારે ખરેખરમાં સ્ટોક વેચાય છે ત્યારે તેને આવક તરીકે ઓળખવવામાં આવે છે.

વ्याख्या: ઈન્વેન્ટરી/માલની વ्यાપ્તિઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેસ થાય છે.

1. તૈયાર માલ: જે વસ્તુઓને ધંધાકીય બજારમાં વેચાણ હેતુના ઉદેશથી મુક્કવામાં આવે છે. તેને તૈયાર માલ તરીકે ઓળખવામાં આવે છે.
2. ચાલુ કામ (અર્થ તૈયાર માલ): જે કાચો માલ ધંધામાં હોય એ અથવા તો એવો માલ કે જે ઉત્પાદ પ્રક્રિયામાં છે તેની ગણતરી માલની વ्यાપ્તિઓમાં કરવામાં આવે છે.
3. કાચો માલ સામાન: ઉત્પાદનની પ્રક્રિયામાં અથવા તો અમુક સેવાઓમાં વપરાતા કાચા માલના પુરવણાને પણ તે ગણતરીમાં ગણવામાં આવે છે. (સ્ટોર, વધારાના કાચા માલની ગણતરી)

હિસાબી ધોરણા-૨ નું કાર્યક્ષેત્ર:

હિસાબી ધોરણા-૨ નીચેની બાબતોમાં ઈન્વેન્ટરીના મૂલ્યાંકન વખતે દ્યાનમાં લેવામાં આવતા નથી.

1. જે માલ કોઈ અન્ય વ્યાપાર સાથે ચાલુ બાંધકામમાં કરાર તરીકે જોડાયેલાં હોય. (ઉત્પાદન પ્રક્રિયામાં)
2. નાણાકીય સાધનો જેને ધંધાના માલ તરીકે ગણવામાં આવ્યા છે જેમ કે શેર, ડિલેન્યર્સ, બોન્ડ વગેરે (હિસાબી ધોરણા ૧૦૮ માં દર્શાવ્યા મુજબના)
3. સેવા પૂરી પાડનારા ધંધાકીય એકમના સંદર્ભમાં ઉદ્દેભવતો ચાલુ કામનો સ્ટોક (દા.ત. દાકતરી સારવાર ચાલુ હોય)
4. જૈવિક સંપત્તિ: જૈવિક સંપત્તિ જેવી કે ફોર-ફાંખર, ખેત-પેદાસો, જંગલના ઉત્પાદક ખનીજ તત્ત્વો, કાચી ધાતુ, ગેસ વગેરે જેવી બાબતો પર હિસાબી ધોરણા-૨ લાગુ પડતું નથી.

હિસાબી ધોરણા-૨ ના માપદંડ નીચેના કિસ્સાઓમાં લાગુ પડતા નથી.

1. કૃષિ અને વન ઉત્પાદનો, કૃષિ ઉત્પાદકો (લળણી પઢીના), ખનિજો અને ખનિજ ઉત્પાદનો તેટલી હણ સુધી માન્ય રાખવામાં આવે છે, કે તેમની કિંમત ચોખ્ખી વાસ્તવિક મૂલ્યાંકનને આધારે માપવામાં આવે છે અને પદ્ધતિઓ વ્યવસાય દ્વારા નક્કી કરવામાં આવી છે.
જે આવા માલ/સ્ટોકને તેમની ચોખ્ખી વાસ્તવિક કિંમત પર માપવામાં આવે છે. ત્યારે તેના મૂલ્યમાં કે સાચી કિંમતમાં થતા ફેરફારને એ સમય ગાળાનો નશો કે નુકશાન તરીકે ગણવામાં આવે છે.
2. વેપારી દલાલો જે પોતાના માલને વેચવા માટે તેની મૂળ કિંમત કરતા વાજબી કિંમતે નક્કી કરી તેની વાજબી કિંમતે વેચે છે એવા કિસ્સાઓમાં વસ્તુને વેચવાની મૂળ કિંમત અને વાજબી કિંમતના પરિવર્તન નશો કે નુકશાનમાં પ્રાપ્ત થાય છે અને માલના/સ્ટોકના આવા મૂલ્યાંકનને આ ધોરણમાં ગણવામાં આવતા નથી.

હિસાબી ધોરણા-૨ માં ગણવામાં/દ્યાનમાં લેવામાં આવતી શરતો

1. ઈન્વેન્ટરી/માલ સામગ્રીને મિલકતો તરીકે દર્શાવવાની આવ:

- જ્યારે ધંધાના સામાન્ય કોર્સમાં વેચાણ માટે રાખવામાં આવે
- વેચાણ કરવા માટે માલ ઉત્પાદનની પ્રક્રિયા હોય
- ઉત્પાદન પ્રક્રિયામાં કે અમુક સેવાઓમાં કાર્યરત વપરાયેલી સામગ્રી કે પુરવણો.

આ ઉપર દર્શાવેલ બાબતોમાં તેને મિલકતો તરીકે ગણવામાં આવે છે.

2. ચોખ્ખુ ઉપજવા પાત્ર મૂલ્ય:

- ચોખ્ખુ ઉપજવાપાત્ર મૂલ્ય એ સામાન્ય/વ્યાજબી રકમનો ઉત્સલખ કરે છે જે કોઈ સામાન્ય ધંધાના વ્યવસાયમાં ઈન્વેન્ટરીના વેચાણમાંથી પ્રાપ્ત થવાની અપેક્ષા રાજે છે.

- વાજબી કિંમત એ બજારની જાણકાર અને ઈચ્છિત ખરીદદારો અને વેચનાર વરચે સમાન સૂચિનું વિનીમય કરી શકે તે રકમને પ્રતિલિંગિત કરે છે.
- ચોખ્ખું ઉપજવાપાત્ર મૂલ્ય એ માલસામગ્રીના વેચાણ માટે વાજબી મૂલ્ય જેટંઠું ઓછું મૂલ્ય હોઈ શકે નથી.

3. માલસામગ્રીમાં રિટેલ માટે ખરીદી અને રાખવામાં આવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે રિટેલ દ્વારા ખરીદવામાં આવતી માલસામાન અને પુનઃપ્રાપ્ત માટે અથવા જમીન અને અન્ય મિલકતને પુનઃપ્રાપ્ત કરવા માટે રાખવામાં આવે છે. માલસામગ્રીમાં તૈયાર માલનો પણ સમાવેશ થાય છે. અથવા ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલી સામગ્રી અને પુરવણાનો સમાવેશ કરવામાં આવે છે.

ઇન્યેન્ટરીનું ભાપ અથવા મૂલ્ય નક્કી કરવા માટેના પગલાં:

સામાન્ય રીતે ઇન્યેન્ટરીનું મૂલ્ય તેની પડતર તથા ચોખણા ઉપજવાપાત્ર મૂલ્ય પેડી ઓછું હોય તે કિંમતે આંકવું જોઈએ.

૧. માલસામગ્રીનું મુલ્યાંકનઃ માલસામગ્રીના મુલ્યાંકનમાં ખરીદીના ખર્ચ, પરિવર્તનની કિંમત અને તેના વર્તમાન સ્થાન અને શરત પરના ઇન્યેન્ટરીને લાવવામાં આવતી અન્ય ખર્ચ શામેલ હશે. ખરીદીની પડતરમાં નીચેનાનો સમાવેશ થાય છે.

- કચુટી કરવેરા
- માલ લાવવાનું ગાડા ભાડું
- અન્ય ખર્ચ

૨. ખરીદીની કિંમતઃ ખરીદીની કિંમતમાં ઉપર દશવિલ ખર્ચમાંથી વેપારી વટાવ, વળતર અને અન્ય સમાન વસ્તુઓને કાપી લેવામાં આવે છે.

૩. ઝુપાંતરની પડતરઃ સામાન્ય અર્થમાં ઝુપાંતરની કિંમત એટલે માલસામાન ખરીદ્યા પછી સાહસ દ્વારા કરવામાં આવતા બધા ખર્ચ ઝુપાંતર પડતરમાં નીચેનાનો સમાવેશ થાય છે.

- પ્રત્યક્ષ માલ સામાન
- પ્રત્યક્ષ મજુરી (સીધી મજુરી)
- પ્રત્યક્ષ ખર્ચાઓ
- પ્રત્યક્ષ શિરોપરી ખર્ચાઓ
- અન્ય ખર્ચઃ જે ખર્ચ ઇન્યેન્ટરીને તેના વર્તમાન સ્થાન અને સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવે છે તેને અન્ય ખર્ચ કહે છે.

નીચેના ખર્ચાઓ ઇન્યેન્ટરીની પડતરમાં સમાવવામાં આવતા નથી:

- બગડેલ માલ સામાન
- સંગ્રહણના ખર્ચ
- વહીવટી શિરોપરી ખર્ચ
- વેચાણ અને વિતરણ ખર્ચ
- વ્યાજ અને ઉછીના નાણાંને લગતા ખર્ચ

૪. પ્રત્યક્ષ ઉત્પાદનની કિંમત એ સામાન્ય વ્યવસ્થાના ખર્ચાઓ અને ઉત્પાદનની સુવિધાઓની સામાન્ય ક્ષમતા પર આધારિત છે. સામાન્ય ક્ષમતાએ સામાન્ય સંજોગોમાં સરેરાશ સમયગાળા અથવા મોસમ દરમિયાન સામાન્ય રીતે પ્રાપ્ત થવાની ધારણા છે.
- ઉત્પાદનની વાસ્તવિક સપાઈનો ઉપયોગ જો સામાન્ય ક્ષમતાને અંદાજે કરવામાં આવે તો તેનાં ઉપયોગ થઈ શકે છે. ઓછા ઉત્પાદન અથવા નિષ્ઠિય પ્લાન્ટના પરિણામે ઉત્પાદનના દરેક એકમને ફાળવવામાં આવેલ નિયત સામાન્ય વ્યવસ્થાના ખર્ચમાં વધારો થયો નથી.
 - ન ફાળવવામાં સામાન્ય વ્યવસ્થાના ખર્ચ જે સમયગાળા દરમાન કરવામાં આવે છે તે સમયગાળમાં તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
 - અસામાન્ય રીતે ઉચ્ચ ઉત્પાદનની અવધિમાં સ્થિર સામાન્ય વ્યવસ્થા ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. જેથી ઉત્પાદનના પ્રત્યેક એકમાં ઘટાડો થાય છે જેથી ઈન્ફેન્ટરીનો ખર્ચ તેની કિંમત કરતા વધારે આંકડામાં આવે નથી.
 - અસ્થિર સામાન્ય વ્યવસ્થાના ખર્ચને ઉત્પાદન સુવિધાના વાસ્તવિક ઉપયોગના આધારે ઉત્પાદનના પ્રત્યેક એકમમાં ફાળવવામાં આવે છે.
૫. ઉત્પાદની પ્રક્રિયાને પરિણામે એક કરતા વધુ ઉત્પાદન એક સાથે થઈ શકે છે. દા.ત. જ્યારે કોઈ મુખ્ય ઉત્પાદન અને બાય પ્રોડક્ટ હોય છે ત્યારે દરેક ઉત્પાદનની ઝૂપાંતરણની ફાળવણી તર્કસંગત અને સુસંગત ધોરણે ફાળવવામાં આવે છે.
૬. નીચેના આપેલા ઉદાહરણમાં ઈન્ફેન્ટરી કિંમતને સામાન્ય ખર્ચ તરીકે લેવામાં આવે છે. તેને ઈન્ફેન્ટરીના ખર્ચ તરીકે ગણવામાં આવતા નથી.
- નકામી સામગ્રી શ્રમ આથવા અન્ય ઉત્પાદનમાં સામાન્ય પ્રમાણ ખર્ચ
 - સંગ્રહના ખર્ચ, (સિવાય કે તે ઉત્પાદનમાં તે ખર્ચ આવશ્યક હોય વધુ ઉત્પાદન તબક્કા પહેલાની પ્રક્રિયામાં
 - વહિવટી સામાન્ય વ્યવસ્થા ખર્ચ કે જે ઈન્ફેન્ટરીઝને તેમના વર્તમાન સ્થાન અને શરતમાં લાવવા માટે ફાળો આપતા નથી
 - વેચાણ ખર્ચાઓ
૭. કોઈ કંપની સ્થળિત સમાધાન શરતો પર ઈન્ફેન્ટરીઝને ખરીદી શકે છે, જ્યારે વ્યવસ્થામાં અસરકારક રીતે ફાઈનાન્સિંગ તત્વ હોય છે. તે તત્વ ઉદાહરણ તરીકે સામાન્ય ઉદ્ઘારણી શરતો અને ખરીદી માટે ચૂકુવણીની રકમ વચ્ચેનો તકાવત ધ્યાણના સમયગાળા દરમાન વ્યાજ ખર્ચ તરીકે ઓળખાય છે.

સ્ટોકની પડતર દર્શાવતું પત્રક:

ખરીદીની પડતર	રકમ (₹)
ખરીદની કિંમતઃ	
ઉમેરો: માલસામાન લાવવાનું ભાડું	xxxx
ઉમેરો: ખરીદીને લગતી અન્ય સીધી પડતરો	xxxx
બાદ: વેપારી વટાલ	xxxx
બાદ: વેરાઓ (વેરા વિભાગમાંથી પરત મળવાપાત્ર)	xxxx
ઝૂપાંતરીત પડતર:	
ઉમેરો: પ્રત્યક્ષ માલ સામાન	xxxx
ઉમેરો: પ્રત્યક્ષ મજૂરી	xxxx
ઉમેરો: પ્રત્યક્ષ શિરોપરી ખર્ચાઓ	xxxx

ઉમેરો:	સ્થિર અને ચલિત શિરોપદિત ખર્ચાઓ	xxxx
અન્ય પડતર:		
ઉમેરો:	સ્ટોકને ચાલુ સ્થળ અને સ્થિતિમાં લાવવા માટે જરૂરી પડતર	xxxx
	સ્ટોકની પડતર	xxxx

ચોખ્યું ઉપજવા પાત્ર મૂલ્યઃ એટલે ધંધાના સામાન્ય સંજોગોમાં અંદાજીત વેચાણ કિંમત બાદ કામ પૂર્ણ થવાની અંદાજીત પડતર અને વેચાણ કરવા માટે જરૂરી અંદાજીત પડતર

અન્ય શબ્દોમાં ચોખ્યું ઉપજ એટલે

	ખરીદીની પડતર	રકમ (₹)
બાદ:	અંદાજીત વેચાણ કિંમત	xxxx
બાદ:	કામપૂર્ણ કરવાની અંદાજીત પડતર	xxxx
બાદ:	વેચાણ માટે જરૂરી અંદાજીત પડતર	xxxx
		xxxx

ખર્ચ માપવા માટેની તકનીકો: પરિણામોની કિંમત માપવાની તકનીકો જેમ કે પ્રમાણભૂત ખર્ચ પદ્ધતિ અથવા રીટિલ પદ્ધતિ, જો અનુકૂળ ખર્ચની જોગવાઈ માટે સુવિધા માટે ઉપયોગી થઈ શકે છે.

- માનક ખર્ચમાં માલસામાનના સ્તરો દ્યાનામાં લે છે અને તે સૂચવે છે કે શ્રમ, કાર્યક્ષમતા અને ક્ષમતાની ઉપયોગીતા તેમની નિયમિત સમિક્ષા કરવામાં આવે છે. અને જો જરૂરી હોય તો વર્તમાન પરિસ્થિતિના પ્રકાશમાં તેને સુધારેલ છે.
- છૂટક પદ્ધતિનો ઉપયોગો મોટા ભાગે ઝડપથી બદલાતી વસ્તુઓની ઇન્વેન્ટરીઝને માપવા માટે સમાન માર્જિન સાથે કરવામાં આવે છે. જેના માટે અન્ય કિંમતી પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે અયોગ્ય છે.
- ઇન્વેટરીના ખર્ચને કુલ માર્જિનની યોગ્ય ટકાવારી દ્વારા વેચાણના મૂલ્યને ઘટાડી શકાય છે.
- ઉપયોગમાં લેવાયેલી ટકાવારી દ્યાનમાં લેવાયેલી ઇન્વેન્ટરીને દ્યાનમાં લે છે જો તેની મૂળ વેચાણ કિંમત તળિયે રાખવામાં આવી છે. દરેક છૂટક વિભાગ સરેરાશ ટકાવારીનો ઉપયોગ કરે છે.

પડતરનું સુત્ર: વસ્તુઓની સુચિની કિંમત જે સામાન્ય રીતે વિનિમયક્ષમ અને સાર્વજનિક પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદિત અને અલગ કરવામાં આવતી વસ્તુઓ અથવા સેવાઓને તેમના વ્યક્તિગત ખર્ચની વિશિષ્ટ ઓળખનો ઉપયોગ કરીને સોપવામાં આવે છે.

હિસાબી ધોરણ-૨ નીચેની પડતર ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.

૧. પડતરની ચોક્કસ ઓળખ
૨. ફિઝો પદ્ધતિ
૩. ભારિત સરેરાશની પદ્ધતિ
૪. પ્રમાણ પડતર
૫. છૂટક વેપારની પદ્ધતિ

ઉદાહરણ તરીકે જોઈએ તો, એક ઓપરેટીંગ સેગમેન્ટમાં વપરાયેલી ઇન્વેન્ટરીઝમાં અન્ય ઓપરેટીંગ સેગમેન્ટમાં વપરાતી સમાન પ્રકારની ઇન્વેન્ટરીઝથી અલગ કંપનીનો ઉપોયા હોઈ શકે. જો કે ઇન્વેન્ટરીઝના ભૌગોલિક સ્થાન (અથવા સંબંધિત કર નિયમોમાં) તફાવત વિવિધ ખર્ચ ફોર્મ્યુલાના ઉપયોગને જ્યાદી ઠેરવવા માટે પૂરતો નથી.

- કિંદો ફોર્મ્યુલા એ દશાવિ છે કે ખરીદિલી કે ઉત્પાદિત કરેલી પ્રથમ વસ્તુઓને પહેલી વેચી દેવી અને પરિણામે તે સમયગાળાના અંતે ઈન્ફેન્ટરીમાં બાકી રહેલી વસ્તુઓ તે હશે જે તાજેતરમાં ખરીદિલી અથવા તો ઉત્પાદિત કરેલી હશે.
- સરેરાશ ભારિત પદ્ધતિમાં દરેક વસ્તુઓ ખર્ચ સમયગાળાના પ્રારંભમાં સમાન વસ્તુઓના ભારિત સરેરાશ અને સમયગાળા દરમિયાન ખરીદિલી અથવા ઉત્પાદિત સમાન વસ્તુઓની કિંમતથી નક્કી કરવામાં આવે છે. સરેરાશની ગાણતરી સમયાંતર પર આધારિત હોઈ શકે અથવા તો જે તે અસ્તિત્વના સંજોગો પર આધારિત છે.

હિસાબી ધોરણો-૨ ને નીચેની પરિસ્થિતીમાં ગાણવામાં આવે છે.

- ચોખ્ખી ઉપજવા પાત્ર કિંમત અને ઈન્ફેન્ટરીના બધા નુકશાનની કોઈપણ ઘટતી જતી બાકી અથવા તો ખોટના સમગાળા દરમિયાન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
- કેટલીક ઈન્ફેન્ટરીઝને મિલકતો, પ્લાન્ટ અથવા સાધનોના ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે અન્ય મિલકતોમાં ફાળવવામાં આવેલી ઈન્ફેન્ટરીઝએ સંપત્તિના ઉપયોગી જીવન દરમ્યાન ખર્ચ તરીકે ઓળખાય છે.

હિસાબી ધોરણો -૧ માં ઈન્ફેન્ટરીઝને નીચે મુજબ બતાવવામાં આવે છે.

૧. ઈન્ફેન્ટરીઝને માપવા માટે જે નિતિ અને સૂત્ર અપવાનામાં આવ્યા છે તે દરેકને હિસાબી ધોરણો-૧ માં વિગતવાર દર્શાવ્યા છે.
૨. ઈન્ફેન્ટરીની કુલ નક્કી કરેલી રકમ અને તે રકમનું યોગ્ય રકમમાં વર્ગીકરણ
૩. એક વર્ષના સમયગાળા દરમ્યાન ખર્ચ તરીકે ઓળખાયેલી ઈન્ફેન્ટરીઝની સંખ્યા
૪. ઈન્ફેન્ટરીઝના વિવિધ વર્ગીકરણોમાં નક્કી કરવામાં આવેલી રકમો અને આ ઈન્ફેન્ટરીઝની ફેરફારોની ખર્ચાદા વિશેની માહિતી નાણાકીય નિયેદનનોના વપરાશકર્તાઓ માટે ઉપયોગી છે.
ઇન્ફેન્ટરીઝને સામાન્ય રીતે વેપારીઓ ઉત્પાદન પુરવઠો, સામગ્રી, તૈયાર માલ અને ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલ માલમાં વર્ગીકરણ કરવામાં આવે છે.
૫. કોઈપણ કંપનીના નફા કે નુકશાનના પત્રકમાં તે સમયગાળા દરમ્યાન ખર્ચ તરીકે ઓળખાયેલી ઈન્ફેન્ટરીઝની ખર્ચની કિંમતને દર્શાવવામાં આવે છે.

આ પદ્ધતિમાં કે પત્રકમાં કોઈપણ કંપની ખર્ચાઓની પ્રકૃતિને આધારે વર્ગીકરણનો ઉપયોગ કરી ખર્ચાઓની વિશ્લેષણ રજુ કરે છે. આવા કિરસામાં આ સમયગાળા માટે ઈન્ફેન્ટરીઝમાં ચોખા પરિવર્તનની રકમ સાથે કાચા માલ અને ઉપભોક્તા મજૂર ખર્ચ અને અન્ય ખર્ચાઓ માટેની એક કિંમત જાહેર કરે છે.

૩.૬ હિસાબી ધોરણ-૧ક

યંત્રો, મિલકતો અને સાધનો

૧. ઉદેશ:

આ ધોરણનો ઉદેશ મિલકત, યંત્રો અને સાધન સામગ્રી માટેની સારવારનું સૂચન માટે છે જેથી નાણાકીય પત્રકોના વપરાશકર્તાઓને એક વિશેષ માહિતી મળી શકે. નાણાકીય પત્રકોના વપરાશકર્તાઓ તેની મિલકતા, યંત્રો અને સાધનોમાં કરેલા રોકાયોમાં જો કોઈ ફેરફાર થયો હોય તો તેને જાહી શકે.

આ હિસાબી ધોરણના મુખ્ય મુદ્દાઓમાં એ સંપત્તિની ઓળખ તેની ધસારા કિંમત અને તેમના સંબંધિતમાં થતા નુકશાનને દ્યાનમાં લેવામાં આવે છે.

૨. કાર્યક્ષેત્ર:

આ હિસાબી ધોરણ એકાઉન્ટિંગમાં મિલકતો, ચંત્રો અને સાધનો માટે લાગુ પાડવામાં આવશે, સિવાય કે અન્ય હિસાબી ધોરણો જુદા-જુદા એકાઉન્ટિંગની સારવાર માટે જરૂરી હોય અથવા તો તેની પરવાનગી આપે.

૩. આ હિસાબી ધોરણ નીચેના કિસ્સાઓમાં લાગુ પડતું નથી:

- હિસાબી ધોરણ ૧૦૫ મુજબ વેચાણ માટે રાખવામાં આવેલી મિલકતો, સાધનો અને ચંત્રો તથા બિન ચાલુ મિલકતો અને બંધ થતા ઓપરેશન્સ
 - જૈવિક સંપત્તિ સિવાયના કૃષિ પ્રવૃત્તિથી સંબંધીત જૈવિક સંપત્તિ.
- આ હિસાબી ધોરણ કૃષિ પ્રવૃત્તિને લાગુ પડે છે પરંતુ તે તેના ઉપજમાં લાગુ પડતું નથી.
- સંશોધન અને મૂલ્યાંકન મિલકતોની માન્યતા અને માપણી માટે (હિસાબી ૧૦૯ અને ખનિજ સંસાધનોના મૂલ્યાંકન પ્રમાણે)
 - ખનિજ હકો અને ખનિજ અનાજ જેવા કે તેલ, કુદરતી ગેસ અને સમાન બિન-ઉત્પાદક સંસોધનો.

૪. અન્ય ભારતીય હિસાબી માનકોને આ હિસાબી ધોરણામાં જુદા-જુદા અલિગમ પર આધારિત મિલકત, ચંત્રો અને સાધનોની ઓળખની જરૂર પડે છે. દા.ત. હિસાબી ધોરણ ૧૭, ભાડા પહેલ મિલકતો પર જોખમ અને વળતરના સ્થળાંતરને આધારે ભાડા પહેલ મિલકત, સાધનો અને ચંત્રોનું મૂલ્યાંકન કરવા માટે એક સંસ્થાની કે અસ્ટિટ્યુન્નિ ધરાવતી પેઢીની જરૂરિયાત હોય છે. જો કે આવા કિસ્સાઓમાં અવમૂલ્યન સહિત, આ મિલકતો માટે એકાઉન્ટિંગ સારવારના અન્ય પાસાઓને આ માનક દ્વારા સૂચવવામાં આવે છે.

૫. હિસાબી ધોરણ ૪૦ અનુસાર મિલકતોમાં રોકાણ કરવા માટે કોઈ પેઢી કે કંપની આ હિસાબી ધોરણામાં ખર્ચ મોડેલનો ઉપયોગ કરશે.

૬. વ્યાખ્યા:

નીચેના શબ્દોનો ઉપયોગ આ ધોરણામાં ઉત્લેખિત અર્થ સાથે થાય છે.

જૈવિક સંપત્તિએ એક શુંગત પ્લાન્ટ છે જે

(૧) કૃષિ પેદાશોના ઉત્પાદન અથવા પુરખઠામાં ઉપયોગ થાય છે.

(૨) એક કરતા વધુ સમયગાળા માટે ઉત્પાદન કરી શકવાની આશા રાખવામાં આવે છે.

(૩) તે આકસ્મિક સંજોગોમાં બંગાર વેચાણ સિવાય કૃષિ પેદાશો તરીકે વેચવાની શક્યતા ધરાવે છે.

કોઈપણ મિલકતની સાચી કિંમત/સંચિત મૂલ્ય તેમાંથી સંભવિત નુકશાન અને ધસારાને બાદ કર્ચા પણી અંકિત/નક્કી થાય છે.

ખર્ચ: આ હિસાબી ધોરણ અનુસાર કોઈપણ મિલકતના સંપાદન, બાંધકામ કે તેને મેળવવા માટે રોકડ અથવા રોકડ સમકશની ચૂકવણી તેના મૂલ્ય અનુસાર કરવામાં આવે તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.

ધસારો: ધસારાની કિંમત એટલે એવો ખર્ચ જે મિલકતની કિંમતમાંથી બાદ કરવામાં આવે છે જેને ચૂકવવામાં આવતો નથી પરંતુ દર વર્ષે તે કિંમતથી મિલકતનું મૂલ્યાંકન અથવા તો તેની કિંમત ઘટતી જાય છે.

ધસારાને મિલકતોના અંદાજીત વર્ષ સાથે સરળી રીતે ફાળવણી કરીને ગણવામાં આવે છે.

એન્ટિટી વિશિષ્ટ મૂલ્ય: એન્ટિટી વિશિષ્ટ મૂલ્ય એટલે એ સંપત્તિના સતત ઉપયોગથી અને તેના ઉપયોગી શુંગના અંતે તેના નિકાલમાંથી ઊભા થતા રોકડ પ્રવાહનું મૂલ્ય છે અથવા તો જવાબદારીની ચૂકવણી કરતી વખતે સરભર થવાની અપેક્ષાનું મૂલ્ય છે.

વાજબી કિંમત: વાજબી કિંમત એટલે નક્કી કરેલી તારીખે બજાર સહભાગીઓ વચ્ચે મિલકતને વેચતા માટે અથવા તો જવાદારીની ચૂકવણી કરવા માટે નક્કી કરવામાં આવતી કિંમત.

નુકશાન/ખોટ: નુકશાન/ખોટની કિંમત એટલે એવી રકમ જે સંપત્તિની મૂળ કિંમત તેની વસ્તુલાત પાત્ર કિંમત કરતા વધારે હોય.

મિલકતો, સંપત્તિ અને યંત્રો એ દર્શય મિલકતો છે જે:

(૧) માલ અથવા સેવાઓના ઉત્પાદન અથવા પુરખામાં અન્ય લોકોને ભાડે આપવા માટે અથવા વહીવટી હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને

(૨) તે એક કરતાં વધુ સમયગાળા દરમ્યાન ઉપયોગી થશે તેવું અનુમાન કરવામાં આવે છે.

પુન:પ્રાપ્ય રકમ: પુન:પ્રાપ્ય કિંમત/રકમ એટલે કોઈપણ મિલકતને વેચવા માટે તેની વાજબી કિંમત તેની મૂળકિંમત કરતા વધારે હોય અને તે કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે.

બાકીનું મૂલ્ય: મિલકતોનું બાકીનું મૂલ્ય એટલે એની અંદાજીત રકમ જે મિલકતોના નિકાલમાંથી તેના નિકાલ અંદાજીત ખર્ચને બાદ કર્યા પછી પછી પ્રાપ્ત થાય છે.

મિલકતોનું અંદાજીત આચુષ્ય: કોઈ પણ મિલકતનું અંદાજીત આચુષ્ય એ,

(૧) તે કેટલા સમયગાળા દરમ્યાન ઉપયોગમાં આવશે અને,

(૨) તે મિલકતના ઉપયોગથી કંપનીના કેટલા એકમોનું ઉત્પાદન થશે. તેના આધારે નક્કી કરવામાં આવે છે.

૭. માન્યતા:

સંપત્તિ, યંત્રો અને સાધનોની કિંમતને મિલકત તરીકે ત્યારે જ માન્ય રાખવામાં આવશે જ્યારે

(૧) તે મિલકતો સાથે સંકળાયેલા ભાવિ આર્થિક લાભો અસ્તિત્વમાં આવશે અને તેનાથી પેઢીને લાભ થશે અને

(૨) અને તે મિલકતની કિંમત વિશ્વાસનીય રીતે માપવામાં આવી હોય.

- છુટા ઓજારો, સાધનો કે સર્વિસમાં વપરાતા ઓજારોને ત્યારે જ મિલકત તરીકે ગાણવામાં આવશે જ્યારે તેઓ હિસાબી ધોરણની વ્યાખ્યામાં બતાવેલા અર્થને અનુરૂપ હોય નહીં તો તેનો સમાવેસ ઇન્વેન્ટરીજ તરીકે કરવામાં આવશે.
- આ ધોરણ માન્યતા માટેના માપનના એકમનું સૂચન કરતું નથી એટલે કે મિલકત, યંત્રો અને સાધનોમાંથી શું વસ્તુ બને છે. આમ કોઈ કંપનીના વિશિષ્ટ સંજોગોમાં માન્યતા માપદંડ લાગુ કરવામાં ચુકાદો જરૂરી છે.
- કોઈપણ પેઢી આ માન્યતાના સિદ્ધાંત મુજબ તેની બધી સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રીનું મૂલ્યાંકન તેમાં થતા ખર્ચને ધ્યાનમાં રાખીને કરે છે. જેમકે આ સંપત્તિ, પ્લાન્ટ અને સાધનોને બનાવવા માટે ખરીદવામાં આવતી વસ્તુઓનો ખર્ચ અથવા તો તૈયાર થયા પછી તેમાં થતો કોઈ નયો ખર્ચ અથવા તો ઉમેરાનો ખર્ચ..

૮. પ્રારંભિક ખર્ચ:

મિલકતો, પ્લાન્ટ અને યંત્રોની વસ્તુઓને સલામતી અથવા પર્યાવરણીય પ્રક્રિયાઓ માટે મેળવવામાં આવે છે. આવી મિલકતો, પ્લાન્ટ કે સાધનોનું સંપાદન તેના ભાવિ આર્થિક લાભોને વધારવા માટે નહીં પરંતુ આવી સંપત્તિથી ભવિષ્યના કાયદા મેળવવા માટે કરવામાં આવે છે. આવા પ્રકારની મિલકતો, પ્લાન્ટ અને

સાધનોની વસ્તુને મિલકતો/સંપત્તિ તરીકે ભાન્યતા આપવામાં આવી છે કારણ કે, તેઓ સંબંધિત ઘટકોના ભાવિ આર્થિક લાભો પ્રાપ્ત કરવા માટે જરૂરી છે.

દા.ત. રસાયણિક ઉત્પાદક જોખમી ઉત્પાદન કરવા અને તેનો સંગ્રહ કરવા માટે નવી રસાયણિક સાચવણીની પ્રક્રિયા/પદ્ધતિને અપનાવશે જેનાથી પર્યાવરણને કોઈ હાનિ અથવા તો પર્યાવરણની આવશ્યકતાનું પાલન કરી શકાય.

જ્યારે રસાયણિક ઉત્પાદક નવી પ્રક્રિયા કે પદ્ધતિને અપનાવશે ત્યારે તેને એક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેના વિના કોઈપણ કંપની રસાયણોનું ઉત્પાદન અને વેચાણ કરવામાં અસર્મથ છે.

૬. અનુગ્રામી ખર્ચ:

માન્યતના સિદ્ધાંત મુજબ એ પઢી તેની મિલકત, પ્લાન્ટ અને સાધનની વસ્તુની વણન જથ્થામાં વસ્તુઓની ફૈનિક સેવાની કિંમતને ઓળખી શકાતી નથી. તેના બદલે આ ખર્ચને નફામાં કે નુકશાન તરીકે ઓળખાય છે. રોજુંદી સેવામાં ખર્ચ મુખ્યત્વે શ્રમ અને ઉપભોક્તાઓના ખર્ચમાં હોય છે અને તેમાં નાના ભાગોની મિલકત, પ્લાન્ટ અને સાધનોની વસ્તુની સમારકામ અને જાળવણી માટે વાર્ષિકવામાં આવે છે.

મિલકત, પ્લાન્ટ અને સાધનોની કેટલીક વસ્તુઓ અથવા ભાગોને નિયમિત અંતરાલોમાં ફેરબદલીની જરૂર પડી શકે છે. દા.ત. ભર્તૃમાં ઉપયોગમાં ચોક્કસ કલાકો પછી રિલેશનિંગની જરૂર પડી શકે છે અથવા વિમાનના ફન્નિયર જેમ કે બેછ્કો અને ગેલીઝને (વણાણના હલેંસા) ને તેના જીવનકાળ દરમાન ધારી વખત નદલવાની જરૂર પડી શકે છે. મિલકત, પ્લાન્ટ અને સાધનોની વસ્તુઓને વારંવાર ફેરબદલ કરવામાં આવે છે. હિસાબી ધોરણના ભાન્યતા અનુસાર આવી મિલકતો પ્લાન્ટ અને સાધનોના ભાગને બદલવા માટેની કિંમત નક્કી કરવામાં આવે છે જે તેના સ્થાનાંતરિત વણના જથ્થાને આધારે નક્કી થાય છે.

૭૦. ધસારો:

સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રીના ભાગોમાં કુલ કિંમતમાંથી ધસારાને અલગથી ધટાડવામાં આવે છે.

- એન્ટિટી તેની પ્રારંભિક શરૂઆતમાં મિલકતો, યંત્રો અને સાધનની દ્વેક વસ્તુઓની રકમની ફાળવણી અને તેના ધસારાની રકમને અલગથી ગણવામાં આવે છે. જેમ કે કોઈ એન્ટિટી મિલકત, પ્લાન્ટ અને સાધનસામગ્રીને ભાડા પછે રાખે છે અને જો તે તેમાં ભાગીદાર હોય તો તે વસ્તુનો ખર્ચ અને ધસારાને અલગથી ફાળવવામાં આવે છે.
- મિલકતો અને સાધનોની વસ્તુઓમાં તેનો મહત્વપૂર્ણ ભાગ ઉપયોગી જીવન અને ધસારો ગણવાની પદ્ધતિ છે.

ધસારાની કિંમત અને ધસારાનો સમયગાળો:

- કોઈપણ મિલકતની ધસારાપાત્ર રકમ તે મિલકતના અંદાજીત આયુષ્ય વર્ષના આધારે નક્કી કરવામાં આવે છે.
- કોઈપણ સંપત્તિનું ઉપયોગી જીવન એ મિલકતના અપેક્ષિત ઉપયોગને આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ પણ પેઢીના મિલકતોની સંચાલનની પોલીસીમાં ચોક્કસ સમય પછી અથવા તો ચોક્કસ પ્રમાણના ઉપયોગ પછી તે સંપત્તિનો નિકાલ કરવામાં આવે છે.
- જમીન અને ઇમારતો એ અલગ અલગ મિલકતો છે તેઓ એક સાથે હસ્તગત થાય ત્યારે પણ તેઓને અલગ અલગ રીતે ગણવામાં આવે છે. જમીનનું ઉપયોગી જીવન એ અમર્યાદિત છે તેથી તેની ઉપર ધસારો ગણવામાં આવતો નથી જ્યારે મકાન, ઇમારતોનું જીવન મર્યાદિત છે તેથી તેના ઉપર ધસારો ગણવામાં આવે છે.

- જો જમીનની કિંમતમાં વધારો થાય તો તેના ઉપર બાંધવામાં આવેલી ઈભારતો કે મકાન પર ગણવામાં આવતા ઘસારા પર તેની અસર થતી નથી.
- જો જમીનની કિંમતમાં કોઈ ઈભારત વિભેરી નાખવી, દુર કરવી અથવા તો પુનર્સ્થાપનની કિંમતમાં તેનો સમાવેશ થાય છે અને જમીનની સંપત્તિનો તે ભાગનો ખર્ચ, તે ખર્ચના લીધે મેળવેલા ફાયદાઓની અવધિથી અવગણવામાં આવે છે. ડેટલાક ડિસ્સામાં જમીનનું જીવન મર્યાદિત ઉપયોગ માટે થાય છે આવા ડિસ્સાઓમાં ઘસારાને એવી રીતે દ્વાનમાં લેવાય છે કે તેનાથી થયેલા લાભોને તે પ્રતિબિંબિત કરી શકે.

ઘસારાની પદ્ધતિ:

- ઘસારો ગણવાની પદ્ધતિએ મિલકતના વપરાશને દ્વાનમાં રાખી ભવિષ્યમાં થતા આર્થિક લાભોને દ્વાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.
- મિલકતો પર ગણવામાં આવતા ઘસારાની પદ્ધતિને ઓછામાં ઓછા દ્રેક નાણાકીય વર્ષના અંતે તેની સમીક્ષા તપાસણી કરવામાં આવે છે અને જો સંપત્તિમાં સમાવિષ્ટ ભાવી આર્થિક લાભોના અપેક્ષિત પદ્ધતિમાં જો નોંધપાત્ર ફેરફાર થયો હોય તો પદ્ધતિને પ્રતિબિંબિત કરવા બદલ તેની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. આ પ્રકારના ફેરફારને હિસાબી ધોરણ-૮ ની અનુસાર એકાઉન્ટિંગ અંદાજમાં ફેરફાર તરીકે ગણવામાં આવશે.
- મિલકતના અંદાજીત આયુષ્યને દ્વાનમાં રાખીને તેના ઉપર ઘસારો ગણવા માટેની અસંખ્ય પદ્ધતિઓને ફાળવવામાં આવેલી છે જેમ કે સીધી-લીટી પદ્ધતિ, ઘટતી જતી બાકીની પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ વગેરે એકમોનો સમાવેશ થાય છે.
- જો મિલકતના મૂલ્યમાં ફેરફાર ન થતો હોય તો સીધી-લીટીની પદ્ધતિનો ઉપયોગ થાય છે.
- જો મિલકતનું અંદાજીત આયુષ્યમાં સતત ઘટાડો થતો હોય તો ઘટતી જતી બાકીની પદ્ધતિથી ગણવામાં આવે છે.
- કોઈપણ પેઢીએ પદ્ધતિને પસંદ કરે છે જેનાથી આર્થિક લાભો પ્રતિબિંબિત થતા હોય. આવી પદ્ધતિ સતત સમયગાળાથી લાશુ કરવામાં આવે સિવાય કે તે ભાવિ આર્થિક ફાયદાને દ્વાનમાં રાખીને તેમાં ફેરફાર કરવામાં આવે.
- હિસાબી ધોરણ -૧ માં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે.
 1. શિર્ષક અને મિલકત, ચંત્રો અને સાધનસામગ્રી પરના નિયંત્રણોની માત્રા અને જવાબદારીની ચૂક્યવણી અથવા તો સુરક્ષા માટેની જામીનગીરી
 2. તેના નિર્માણ દરમ્યાન મિલકતો, ચંત્રો અને સાધનની વસ્તુઓની વહનની રકમમાં માન્ય ખર્ચોઓની રકમ
 3. મિલકત, પ્લાન્ટ અને સાધનોના સંપાદન કે ઉત્પાદન માટે કરારના વચનની રકમ અને
 4. જો નફા અને નુકસાનના નિવેદનમાં મિલકત, પ્લાન્ટ અને સાધનોની વસ્તુઓ જે ખોવાઈ ગયેલા, જોવાઈ ગયેલી અથવા તો ઉપાડેલી વસ્તુઓના વળતર માટેની રકમ જો અલગથી જાહેર ન થઈ હોય તો તેને નફા કે નુકસાનમાં સામેલ કરવામાં આવે છે.

પ્રકરણ - ૪
ગુણોત્તર વિશ્લેષણ

- ૪.૧ પ્રસ્તાવના
- ૪.૨ ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા કે ફાયદા
- ૪.૩ ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ
- ૪.૪ છિસાબી ગુણોત્તરોનું વર્ગીકરણ
- ૪.૫ દાખલા
- ૪.૬ સ્વાધ્યાય / વ્યાવહારિક

પ્રકરણ - ૪

ગુણોત્તર વિશ્લેષણ

૪.૧ પ્રસ્તાવના:

નાણાંકિય પત્રકો સ્વતંત્ર રીતે માર્ગદર્શન માટે ખાસ ઉપયોગી નથી, પરંતુ તેની જુદીજુદી વિગતો વર્ચેના આંતરસંબંધ નક્કી કરવામાં આવે તો તે કેટલીક ઉપયોગી માહિતી આપી શકે છે. આવા આંતરસંબંધ દર્શાવતા આંકડાને ગુણોત્તર કહેવામાં આવે છે.

“ગુણોત્તર એટલે કોઈપણ બે માહિતી વર્ચેનો આંકડાકીય સંબંધ”. નાણાંકિય પત્રકોમાંના જુદાજુદા આંકડાઓ વર્ચેનાં સંબંધનું ભાપ એટલે હિસાબી ગુણોત્તરો. દા.ત., શેરહોલ્ડરોના ભંડોળો પર કેટલું વળતર મળે છે તે જાણાવું હોય તો કંપનીના ચોખા નફાને (PAT) ને શેરહોલ્ડરોના ભંડોળો વડે ભાગવાથી આંકડા મળે તે તે હિસાબી ગુણોત્તર કહે છે.

ગુણોત્તરો દ્વારા અર્થધારણ:

હિસાબી ગુણોત્તરો ગણી કાઢ્યા પછી તેનું અર્થધારણ ડેવી રીતે કરવું તે પ્રશ્ન મહત્વનો છે. આ માટે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.

- (૧) આદર્શ ગુણોત્તરો સાથે તુલના: નાણાંકિય પત્રકો આધારીત ગણેલા ગુણોત્તર ને આધારે કોઈ અનુમાન બાંધી શકાય નહિ. આ માટે તેને પ્રચલિત માન્યતા મુજબના આદર્શ ગુણોત્તર સાથે સરખાવવો જોઈએ.
- (૨) પાછલા વર્ષમાં ગુણોત્તરો સાથે સરખામણી : શોધેલ ગુણોત્તરની કંપનીના પાછલા વર્ષના ગુણોત્તરો સાથે સરખામણી કરવામાં આવે તો પણ ગુણોત્તર સંતોષકારક છે કે કેમ તે જાણી શકાય.
- (૩) ધંધાની અન્ય પેઢીઓ સાથે તુલના: દે઱ેક ધંધામાં વિશેષ પરિસ્થિતિને કારણે તેના ગુણોત્તરો અન્ય ધંધાના ગુણોત્તરોથી થોડા જુદા પડે છે કે નહિ તે જાણવા તેને તે ધંધાની અન્ય પેઢીઓના ગુણોત્તરો સાથે સરખાવવો જોઈએ.

હિસાબી ગુણોત્તર

[A] નફાકારકતા:

	ગુણોત્તર	શોધવાનું સૂચન		શા માટે ઉપયોગી
(૧)	કાચા નફાનો ગુણોત્તર	કાચો નફો	x ૧૦૦	વેચાણ કિંમત યોગ્ય છે કે નહિ તે જાણવા તરીકી નફાકારકતા જાણવા સંચાલન ક્ષમતા (Operating efficiency) ની ભાપણી થઈ શકે.
		વેચાણ		
(૨)	ચોખ્ખો નફાનો ગુણોત્તર	ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરા બાદ)	x ૧૦૦	ધંધાની નફાકારકતા ભાપવા.
		વેચાણ		
(૩)	સંચાલન ગુણોત્તર	વેચાણ માલનો પડતર + સંચાલન ખર્ચ	x ૧૦૦	ધંધાના કુલ સંચાલન ખર્ચનું પ્રમાણ ભાપવા
		વેચાણ		

[B] ઉથલા કે ચલનદરના:

(૪)	સ્ટોકનો ચલનદર	વેચેલ માલની પડતર સરેરાશ સ્ટોક			વેચાણની કાર્યક્ષમતા જાણવા કેટલી ઝડપથી સ્ટોક વેચાઈ રહ્યો છે તે જાણવા.
(૫)	દેવાદાર ગુણોત્તર	દેવાદારો + લેણા હુંડો ઉધાર વેચાણ	x	વર્ણની કામગીરીના દિવસો	ઉધારણીમાં કેટલા દિવસો ભણે છે તે જાણવા.
		અથવા			
		દેવાદારો + લેણા હુંડો			
		સરેરાશ દૈનિક ઉધાર વેચાણ			

[C] રોકાણના સંદર્ભમાં નફાકારકતા :

(૬)	રોકેલી મૂડી પર વળતર	ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરા પહેલાનો) શેરમૂડી + અનામતો + લાંબાગાળાના દેવા – અવાસ્તાવિક મિલકતો	x	૧૦૦	દંધાની નફાકારકતા જાણવા.
(૭)	શેરદીઠ કમાણીનો દર	કરવેરા બાદનો નફો- પ્રેફ. ડિ.વિ. ઇક્સ્પ્રેસ શેરની સંખ્યા			શેરદીઠ કમાણીનો દર તથા નફાકારકતા જાણવા.
(૮)	શેરહોલ્ડરોના ભંડોળો પર વળતર	ચોખ્ખો નફો શેરમૂડી + અનામતો	x	૧૦૦	શેરહોલ્ડરોનાં દૃષ્ટિબિંદુથી નફાકારકતા જાણવા.

[D] મૂડી માળખાના:

(૯)	દેવાં-ઇક્સ્પ્રેસ ગુણોત્તર	લાંબા ગાળાના દેવા માલિકોના ભંડોળો	x	૧૦૦	માલિકીનાં ભંડોળોના પ્રમાણાં બહારના લાંબા ગાળાના દેવાનું પ્રમાણ જાણવા
-----	---------------------------	--------------------------------------	---	-----	--

[E] પ્રવાહિતા :

(૧૦)	ચાલુ ગુણોત્તર	ચાલુ મિલકતો ચાલુ દેવા			દંધાની પ્રવાહી પરિસ્થિતિ જાણવા-કાર્યશીલ મૂડીની પરિસ્થિતિ જાણવા.
(૧૧)	પ્રવાહી ગુણોત્તર	પ્રવાહી મિલકતો પ્રવાહી દેવા			પ્રવાહી પરિસ્થિતિનો વધુ સારો ખ્યાલ મેળવવા

૪.૨ ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા કે ફાયદા:

સૌપ્રથમ ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ કરવાની શક્ષાત બેન્કોએ નાણાંનું ધિરાણ કરતાં પહેલાં કંપનીઓની પ્રવાહિતાની સ્થિતિ અને નફાકારકતાની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે કરી હતી. ત્યારબાદ વિવિધ પક્ષકારોએ તેનો ઉપયોગ કરવાની શક્ષાત કરી. રોકાણકારો પણ હ્યે કંપનીમાં રોકાણ કરતાં પહેલાં તેના પ્રગટ થયેલા હિસાબો પરથી જુદા જુદા ગુણોત્તર ગણી કંપનીની સંદર્ભતા તથા નફાકારકતાનો ખ્યાલ મેળવવા પ્રયત્નો કરે છે. આમ, ગુણોત્તર વિશ્લેષણ અનેક પક્ષકારોને ઉપયોગી છે.

(૧) કાર્યક્ષમતા :

ધંધાની કાર્યક્ષમતા માપવા માટે વિવિધ ચલનદરના ગુણોત્તરો ખૂલ ઉપયોગી નિવડે છે. સ્ટોક ચલનદર પરથી વેચાણ કેટલાં ઝડપથી થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે છે. દેવાદારોના ગુણોત્તર પરથી ઉદ્ઘરાણીનો ખ્યાલ આવે છે. અને મિલકતોના ચલણદર પરથી મિલકતોનો ધંધામાં કેટલી કાર્યક્ષમતાથી ઉપયોગ થઈ રહ્યો છે. તેનો ખ્યાલ આવે છે.

(૨) આંતર પેઢી તુલના :

જ્યારે પોતાના ધંધાની ગુણોત્તરને બાકીની પેઢીઓ સાથે સરખાવવામાં આવે ત્યારે આપણો ધંધો બધા ધંધાની હરિફાઈમાં કયા સ્થાને છે તે ગુણોત્તર પરથી જાણી શકાય છે. પેઢીના એકલા ગુણોત્તરો ખાસ ઉપયોગી નથી. પરંતુ બીજા જોડે સરખાવવાથી ધંધાની પરિસ્થિતિ જાણવા મળે છે. ખાસ કરીને વેચાણ સાથે સંકળાયેલા આ બધા જ ગુણોત્તરો પરથી ધંધાની સફળતાનો ખ્યાલ સંચાલકોને આવે છે.

(૩) નફાકારતા :

જ્યારે આપણો ધંધાની નફાકારતા જાણાવી હોય ત્યારે નફાકારકતાના ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. કાચા નફાનો તથા ચોખના નફાનો ગુણોત્તર તથા રોકાણ પર વળતરના વિવિધ ગુણોત્તરો ધંધાનો નફાકારતાનો સારો ખ્યાલ આવે છે. આને આધારે સંચાલકો મેળેજરોની કાર્યક્ષમતાનો, રોકાણકારો ધંધાની સમગ્ર કાર્યક્ષમતાની તથા બેન્કો ધંધાની લોન પરત કરવાની શકૃતિનો ખ્યાલ મેળવી શકે છે.

(૪) પ્રવાહિતા :

ગુણોત્તર વિશ્લેષણની શક્ષાત જ પ્રવાહિતાના ગુણોત્તરોથી થઈ છે. પ્રવાહિતા ગુણોત્તરમાં ત્રણ મુખ્ય ગુણોત્તર આવે છે. જેમાં, ચાલુ ગુણોત્તર, પ્રવાહિતા ગુણોત્તર અને એસીડ - ક્સોટી ગુણોત્તર દ્વારા પેઢીને પોતાનાં ટુંકા ગાળાનાં દેવાં ચુકવવાનાં થાય ત્યારે સમયસર ચુકવી શકશે કે નહિ તેનો ખ્યાલ મળે છે. બેન્કો તથા ધંધાને નાણાં ધીરનાર અન્ય લેણાદારો આ ગુણોત્તરનો ઉપયોગ કરે છે.

(૫) અંદાજપત્રીય અંકુશ માટે ઉપયોગી :

જ્યારે ધંધામાં અંદાજપત્ર દ્વારા અંકુશની પદ્ધતિનો અભિન થતો હોય ત્યાં અંકુશ રાખવા અહેવાતો તૈથાર કરવામાં આવે છે. આવા અહેવાતોમાં વિવિધ પ્રકારના ગુણોત્તર રજુ કરવામાં આવાં અંદાજપત્ર પ્રમાણે કાર્ય થઈ રહ્યું કે નહિ તેનો ખ્યાલ મેળવવા પ્રયત્નો થાય છે.

(૬) વલણ દર્શાવતા ગુણોત્તરો:

જ્યારે પોતાના ધંધાના જ ત્રણ-પાંચ વર્ષના ગુણોત્તરોની સરખામણી કરવાથી દેક બાબતનું વલણ જાણી શકાય. જ્યારે કાચો નઝો અને ચોખના નફાનો સમગ્ર ધંધાનો સરેરાશ કરતાં ઓછો હોય, પરંતુ

જો છેલ્લાં થોડાં વર્ષમાં તેમાં સુધારો થઈ રહ્યો હોય તો તે આવકારદાયક વલણ છે. ગુણોત્તર વિશ્લેષણ પરથી જ તેનો ખ્યાલ આવે છે. તેથી ઊલટું પણ બની શકે.

૪.૩ ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ:

(૧) ફક્ત એકજ વર્ષના ગુણોત્તરોની મર્યાદા :

ગુણોત્તર વિશ્લેષણમાં ફક્ત એક જ વર્ષના નાણાંકીય પત્રકો પરથી જે પ્રમાણ અને ટકાવારી શોધવામાં આવતી હોય તેની ઉપયોગિતા સામાન્ય રીતે મર્યાદાઓ રહેવાની.

(૨) બીજા પરિબળોની અસર દ્યાનમાં લેવી :

કોઈપણ ધંધાનાં આર્થિક પરિણામો ઉપર બીજા અનેક પ્રકારના પરિબળો અસર કરે છે. દા.ત. ધંધાની પરિસ્થિતિ હરિઝાઈ, બીજા અનેક પરિબળો વગેરે.

(૩) ફક્ત એકજ ગુણોત્તર ગેરરસ્ટે દોરે છે :

કોઈપણ એકજ ગુણોત્તરની સરખામણીમાં બીજા અન્ય ગુણોત્તરને દ્યાનમાં લીધા સિવાય કોઈ અનુમાન બાંધવામાં આવે તો તે ગુણોત્તર ગેરરસ્ટે દોરે છે. તેનાથી ધંધાની આર્થિક પરિસ્થિતિનો વિચાર કરતાં પહેલાં બધાજ ગુણોત્તરોનો વિચાર કરવો જરૂરી છે.

(૪) ઐતિહાસિક આંકડાઓ પરથી ગણેલ ગુણોત્તરોની ઉપયોગિતાની મર્યાદા:

અનુમાન પરથી ભવિષ્ય માટે તૈયાર થયેલા ગુણોત્તરોને પ્રમાણ સંચાલકો માટે ખૂબજ પ્રમાણમાં ઉપયોગી હોય છે. અને ઐતિહાસિક પરિણામોના આધારે ગણેલા ગુણોત્તરોની ઉપયોગિતા મર્યાદિત છે.

(૫) સરખામણી કરતાં આધાર દ્યાનમાં લેવા જરૂરી :

જ્યારે કોઈપણ બે પેઢીના ગુણોત્તર પ્રમાણને સરખાવવામાં આવે ત્યારે તેને ચાદ રાખવું જરૂરી છે કે કે જુદી જુદી પ્રકારની પેઢીઓના જુદા જુદા આધારો લઈ હિસાબો તૈયાર કરવામાં આવે છે.

(૬) અમુક ગુણોત્તરને ચુસ્તપણે વળી રહેવાનું વલણ નુકસાનકારક :

કેટલીક પેઢીઓ અમુક ગુણોત્તરને ચુસ્તપણે વળગી રહેવાનું વલણ ધરાવે છે. દા.ત. ચાલુ ટેવાં કરતા ચાલુ મિલકતો બમણી હોવી જોઈએ. એવા પ્રમાણને ચુસ્તપણે વળગી રહેવાના ધંધાકીય એકમના નિર્ણયથી નશાકારક તકો જતી કરવી પડે છે.

૪.૪ હિસાબી ગુણોત્તરોનું વર્ગીકરણ:

હિસાબી ગુણોત્તરોનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે.

[અ] પ્રણાલિકાગત અથવા નાણાંકીય પત્રકોના પ્રકાર મુજબ વર્ગીકરણ અને

[બ] ગુણોત્તરોના સ્વક્રમ મુજબ વર્ગીકરણ

[અ] પ્રણાલિકાગત વર્ગીકરણ :

(૧) નશાનુકસાનના ગુણોત્તરો: નશા નુકસાન ખાતાની કોઈપણ બે વિગતોની સરખામણી કરવામાં આવે છે. દા.ત., ચોખા નશા અને વેચાણનો ગુણોત્તર.

- (२) પાકા સરવૈયાના ગુણોત્તરો: પાકું સરવૈયાની કોઈપણ બે વિગતોની સરખામણી કરવામાં આવે છે. દા.ત. ચાલુ મિલકતો અને ચાલુ દેવાંનો ગુણોત્તર.
- (૩) મિશ્ર ગુણોત્તર: જેમાં એક વિગત નફાળુકસાન ખાતાની અને બીજી વિગત પા.સ. ની એમ બે વરચેનો સંબંધ દર્શાવવામાં આવે છે. દા. ત. ભાલિકીનાં ભંડોળો પર વળતરનો દર (ચોખો નઝોને ભાલિકીનાં ભંડોળો)
- [બ] ગુણોત્તરોના સ્વસ્થ મુજબ વર્ગીકરણ:
- (૧) નફાકારકતાના ગુણોત્તરો: નાણાં રોકનાર માટે ખુબ મહત્વનો ગુણોત્તરો નફાકારકતાના ગુણોત્તરો છે.
- (૨) પ્રવાહિતા/તરલતાના ગુણોત્તરો: આ ગુણોત્તરો કંપનીની પ્રવાહી પરિસ્થિતિનો સારો ખ્યાલ આપે છે.
- (૩) મૂડી માળખાના ગુણોત્તરો: કંપનીનું મૂડી માળખું કદ્ય મૂડીનું બળેલું છે, તેમાં ભાલિકીની અને ઉદ્દીની મૂડીનું પ્રમાણ કેટલું છે તે દર્શાવિતા ગુણોત્તરોને લિયરેજના ગુણોત્તરો કહે છે. તે કંપનીના દેવાની પરિસ્થિતિ રજૂ કરે છે.
- (૪) પ્રવૃત્તિદર/ચલનદરના ગુણોત્તરો: કંપનીમાં રોકાયેલ જુદાં જુદાં સાધનોનો ઉપયોગ કેટલી કાર્યક્ષમતાથી થાય છે. તેનું સૂચન આ ગુણોત્તરો કહે છે.

નફાકારકતાના ગુણોત્તરો (Profitability Ratios):

[A] વેચાણાના સંદર્ભમાં નફાકારકતા દર્શાવતા ગુણોત્તરો (Profitability Ratios based on Sales)

- (૧) કાચાનફાનો ગુણોત્તર (Gross Profit Ratio) : વર્ષ દરમિયાન વેચાણાના પ્રમાણમાં કાચો નઝો કેટલો મળે છે તે આ ગુણોત્તર દર્શાવે છે. દા. ત. કુલ વેચાણ રૂ ૧૦૦૦૦૦ હોય અને કાચો નઝો રૂ ૨૫૦૦૦ હોય તો

$$\text{કાચા નફાનો ગુણોત્તર} = \frac{\text{કાચો નઝો}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{25000}{100000} \times 100$$

$$= 25\%$$

આ ગુણોત્તર નીચો હોય તો અસંતોષકારક ગણાય. તે નીચો હોવાનાં કારણો- (૧) વેચાણ પડતર ઊંચી હોય (૨) વાજબી ભાવે માલની ખરીદી થતી ન હોય (૩) મંદીને કારણો વે.ક્રિ. ઘટાડવી પડી હોય.

- (૨) ચોખાના નફાનો ગુણોત્તર (Net Profit Ratio) :

વેચાણમાંથી તમામ ખર્ચ બાદ કરતાં ધ્યાનાના ભાલિકો માટે કેટલો નઝો બાકી રહે છે. તે આ ગુણોત્તર દર્શાવે છે. આ ગુણોત્તર જેમ ઊંચો તેમ ધ્યાનાની પરિસ્થિતિ વધુ સારી ગણાય આ ગુણોત્તર વખતે નઝો કરવેરા બાદ જ (PAT) ધ્યાનમાં લેવાય છે. દા. ત., કુલ વેચાણ રૂ ૧૦૦૦૦૦ અને PAT રૂ ૨૦૦૦૦ હોય તો

$$\text{ચોખા નકાનો ગુણોત્તર} = \frac{\text{ચોખો નકો}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{20000}{100000} \times 100$$

$$= 20\%$$

આ ગુણોત્તર નીચો હોવાનાં કારણો: (૧) કાચા નકાનાં કારણો (૨) વહીવટી, વેચાણ અને વિતરણ ખર્ચમાં વધારો.

(૩) સંચાલન ગુણોત્તર (Operating Ratio) :

સંચાલનખર્ચમાં વહીવટી ખર્ચ, વેચાણ-વિતરણખર્ચ તથા વ્યાજ વટાવ જેવા નાણાકિય ખર્ચનો સમાવેશ થાય છે.

$$\text{વેચેલ માલની પડતર} = \text{શક્કો સ્ટોક} + \text{ખરીદી} + \text{ખરીદીના ખર્ચ} + \text{આખર સ્ટોક અથવા}$$

$$= \text{ચોખુ વેચાણ} - \text{કાચો નકો}$$

ધારો કે, વેચાણ શ્ર. 200000 છે, વેચાણ પડતર શ્ર. 120000 તથા સંચાલન ખર્ચ શ્ર. 30000 છે, તો

$$\text{સંચાલન ગુણોત્તર} = \frac{\text{વેચેલ માલની પડતર} + \text{સંચાલનના ખર્ચ}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{120000 + 30000}{200000} \times 100$$

$$= \frac{150000}{200000} \times 100$$

$$= 75\%$$

આ ગુણોત્તર જેમ નીચો તેમ સંતોષકારક ગણાય.

નોંધ: ચોપડીના તમામ દાખલા ગણાતી વખતે બેંકલોનનું વ્યાજ, ડિબેંચર વ્યાજ નાણાકિય ખર્ચ હોવાથી સંચાલન ખર્ચમાં ઉમેરવા.

(૪) ખર્ચ ગુણોત્તર (expense Ratio) :

દ્રેક વ્યક્તિગત ખર્ચનું વેચાણ સાથેનું પ્રમાણ જાણાવા ખર્ચ ગુણોત્તર શોધાય છે.

ડા.ત.,

$$\text{વહીવટી ખર્ચ ગુણોત્તર} = \frac{\text{વહીવટી ખર્ચ}}{\text{વેચાણ}} \times 100$$

$$\text{नाणाकीय भर्य गुणोत्तर} = \frac{\text{नाणाकीय भर्य}}{\text{वेचाणा}} \times 100$$

$$\text{वेचाणा वितरण भर्य गुणोत्तर} = \frac{\text{वेचाणा अने वितरण भर्य}}{\text{वेचाणा}} \times 100$$

वर्षोंवर्ष आवा गुणोत्तरो शोधवाथी कंपनीना भर्यनुं प्रभाणा वधी रह्युं छे के घटी रह्युं छे अने नकारकता पर तेनी शी असर थशे तेनो ख्याल आवे छे.

[B] रोकाणाना संदर्भमां नकारकता दर्शाविता गुणोत्तरो: (Profitability Ratios based on Investment)

(१) रोकेली मूँडी पर वगतरनो दर (Return on Capital employed)

$$\text{रोकेली मूँडी पर वगतरनो दर} = \frac{\text{EBIT}}{\text{रोकेली मूँडी}} \times 100$$

रोकेली मूँडी: ई. शेर मूँडी + प्रेफ. शेर मूँडी + अनामतो + न. नु. खातु(जमा बाडी) + डिवेंयर + लांबागाणानी लोन - अवास्तविक भिलकतो (डिवेंयर वटाप, प्राथमिक भर्य, बांयधरी कमिशन :)

EBIT : व्याज तेमज कर बाद करता पडेलानी आवक.

(२) शेरहोल्डरोना भंडोणा पर वगतरनो दर (Return on Shareholders' Funds) (Return on owners Funds or Return on Proprietors' funds.)

$$\text{शेरहोल्डरोना भंडोणा पर वगतरनो दर} = \frac{\text{योग्यो नक्षे}}{\text{शेर मूँडी} + \text{अनामतो} + \dots} \times 100$$

(३) शेर दीच कमाएरीनो दर (EPS – Earning Per Share)

$$\text{शेर दीच कमाएरीनो दर} = \frac{\text{योग्यो नक्षे (करवेरा बादनो)} - \text{प्रेफ. शेर डिविडन्ड}}{\text{इकलीटी शेरनी संख्या}} \times 100$$

उपरना तमाम गुणोत्तर जेम वधु तेम कंपनीनी रोकाणाना संदर्भमां नकारकता सारी गणाय.

प्रवाहिताना गुणोत्तरो (Liquidity Ratios):

(१) चालु गुणोत्तर (Current Ratio): लेणादारो अने बेंक भाटे आ गुणोत्तर वधु उपयोगी छे. आ गुणोत्तर जेम वधु तेम कंपनीनी प्रवाही परिस्थिति वधु सारी गणाय.

$$\text{चालु भिलकतो} \\ \text{चालु गुणोत्तर} = \frac{\text{चालु भिलकतो}}{\text{चालु देवां}}$$

चालु भिलकतो = आभरनो स्टोक + देवादारो + लेणी हँडी + रोकड बेलेन्स बेंक + अगाउथी चुकवेल भर्या + टूकागाणानो लोन घिराणा + टूकागाणाना कामयलाउं रोकाणो

ચાલુ દેવાં = લેણદારો + દેવી હુકી + બેંક ઓવર ફ્રાફ્ટ + ચુક. બાકી ખર્ચ + નહિ મંગાવેલ કિવિડ + સૂચિત ડિવિડન + કરવેરા જોગવાઈ
સામાન્ય રીતે આદર્શ ચાલુ ગુણોત્તર ૨ : ૧ હોય તો ધંધાની પ્રવાહી સ્થિતિ સારી ગણાય.

(૨) પ્રવાહી ગુણોત્તર (Liquid Ratios) :

$$\text{પ્રવાહી ગુણોત્તર} = \frac{\text{પ્રવાહી ભિલકતો}}{\text{પ્રવાહી દેવા}} = \frac{\text{ચાલુ ભિલકતો - સ્ટોક}}{\text{ચાલુ દેવા - બેંક ઓવર ફ્રાફ્ટ}}$$

આ ગુણોત્તર ૧ : ૧ હોય તો આદર્શ ગણાય.

(૩) એસીડ કસોટી/કડપી ગુણોત્તર (Acid Test/Quick Ratio)

$$\text{એસીડ કસોટી/કડપી ગુણોત્તર} = \frac{\text{કડપી ભિલકતો}}{\text{પ્રવાહી દેવા}} = \frac{\text{ચાલુ ભિલકતો-સ્ટોક-દેવાદારો}}{\text{ચાલુ દેવાં - બેંક ઓવર ફ્રાફ્ટ}}$$

સામાન્ય રીતે કડપી ગુણોત્તર ૧ : ૧ આદર્શ ગુણોત્તર માનવામાં આવે છે.

મૂકીમાળાના ગુણોત્તરો (Leverage Ratios)

(૧) માલિકી ગુણોત્તર (Proprietary Ratios) : ધંધામાં રોકાયેલા કુલ ભંડોળોમાં માલિકીના ભંડોળનું પ્રમાણ કેટલું છે તે આ ગુણોત્તર દર્શાવે છે.

$$\text{માલિકીના ભંડોળો} \\ \text{માલિકી ગુણોત્તર} = \frac{\text{કુલ જવાબદારી / ભિલકતો}}{\text{માલિકીના ભંડોળો}} \times 100$$

માલિકીના ભંડોળો = ઈ. શેર + પ્રે. શેર + અનામતો + ન. નુ. ખાતુ ની જમા બાકી - અવાસ્તવિક ભિલકતો

કુલ ભિલકતો / જવાબદારી = પા. સ.નો સરવાળો - અવાસ્તવિક ભિલકતો

આ ગુણોત્તર જેમ ઊંચો તેમ કંપનીની આર્થિક સ્થિતિ વધુ સંક્રમ, કારણ કે માલિકીની રકમ બાધ્યદેવાના પ્રમાણમાં વધુ છે. આ ગુણોત્તર નીચો હોય તો ઈક્વિટી પરના વેપારનો લાભ લઈ શકાય છે. આથી માલિકીના ભંડોળ અને બાધ્ય દેવાનું યોગ્ય પ્રમાણ જળવાવું જોઈએ.

(૨) દેવાં- ઈક્વિટી ગુણોત્તર (Debt – Equity Ratio):

ધંધામાં માલિકીના ભંડોળોના પ્રમાણમાં લાંબાગાળાનાં દેવાં કેટલાં છે તે જાણવા માટે ઉપયોગી છે.

$$\text{દેવાં - ઈક્વિટી ગુણોત્તર} = \frac{\text{લાંબાગાળાના દેવાં}}{\text{માલિકીના ભંડોળો}}$$

લાંબાગાળાના દેવાં = ડિબેન્ચર + લાંબાગાળાનું જાહેરદેવં + લાંબાગાળાની લોન

માલિકીના ભંડોળો = આગળ મુજબ

(૩) ગિયરીંગ ગુણોત્તર (Gearing Ratio) :

કંપનીની પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચરનું ઈક્વિટી શેરમૂડી સાથેનું પ્રમાણ દર્શાવે છે.

$$\text{ગિયરીંગ ગુણોત્તર} = \frac{\text{પ્રે. શેર મૂડી + ડિબેન્ચર}}{\text{ઇક્વિટી શેર મૂડી}}$$

આ ગુણોત્તર ઉંચો હોય તો ઇક્વિટી શેરમૂડી વધુ અસ્થિર ગણાય.

- (૪) લાંબાગાળાના ભંડોળ-કાયમી મિલકતોનો ગુણોત્તર (Long Term Funds to Fixed Assets) :

આ ગુણોત્તર કંપનીના લાંબાગાળાના ભંડોળ અને કાયમી મિલકતો વર્ચેનું પ્રમાણ દર્શાવે છે. સામાન્ય રીતે કંપનીની મૂડી અને લાંબાગાળાની લોનની મદદથીજ કાયમી મિલકતો જરીદવી જોઈએ. એટલેકે બંન્ને સરખા હોવા જોઈએ.

$$\text{લાંબાગાળાના ભંડોળ-કાયમી મિલકતોનો ગુણોત્તર} = \frac{\text{લાંબાગાળાના ભંડોળો}}{\text{કાયમી મિલકતો}}$$

લાંબાગાળાના ભંડોળો (રોકેલી મૂડી) = ઈ. શેર + પ્રે. શેર + અનામતો + ન. નુ. ખાતુ + ડિબેચર + લાંબાગાળાની લોન - આ. મિ. (પ્રાથમિક ખર્ચ + ડિબેચર વટાવ)

- (૫) વ્યાજ આવરણ ગુણોત્તર (Interest Coverage Ratio) :

વ્યાજના પ્રમાણમાં નફો કેટલો ગણો છે તે આ ગુણોત્તર સૂચયે છે. તેને વ્યાજ-કમાણી ગુણોત્તર પણ કહે છે.

$$\text{વ્યાજ આવરણ ગુણોત્તર} = \frac{\text{EBIT}}{\text{ડિબેચર અને લોનનું વ્યાજ}}$$

પ્રવૃત્તિદર / ઉથલા / ચલનદરના ગુણોત્તરો (Activity Ratio)

- (૧) સ્ટોક ચલનદર / સ્ટોક ગુણોત્તર (Stock / Inventory Turnover):

વર્ષ દરમિયાન સરેરાશ સ્ટોકનો ઊથલો (વેચાણ) કેટલીવાર થાય છે તે આ ગુણોત્તર દર્શાવે છે, વેચેલ માલની પડતારે સરેરાશ સ્ટોક વડે ભાગવાથી આ ગુણોત્તર મળે છે.

$$\text{સ્ટોક ચલનદર} = \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$\text{જ્યાં સરેરાશ સ્ટોક} = \frac{\text{શક્કો સ્ટોક} + \text{આખરનો સ્ટોક}}{2}$$

નોંધ: (૧) વેચેલ માલની પડતર ન આપી હોય તો અંશમાં વેચાણ લખવું (૨) શક્કો સ્ટોક ન આપ્યો હોય તો માત્ર આખર સ્ટોક લખવો.

આ ગુણોત્તર જેમ ઉંચો તેમ સંતોષકારક ગણાય.

- (૨) દેવાદાર ગુણોત્તર : (Debtors' Ratio) :

ઉધારવેચાણની રકમ કેટલા દિવસે વસુલ થાય છે તેનો ખ્યાલ આ ગુણોત્તર આપે છે.

$$\text{દેવાદાર ગુણોત્તર} = \frac{\text{દેવાદાર} + \text{લેણી હુંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 365$$

ધારો કે, ઉધાર વેચાણ જી ૭૩૦૦૦૦, કુલ દેવાદારો જી ૧૪૦૦૦૦ અને લોણીહુંકી જી ૪૦૦૦૦ છે.

$$= \frac{140000 + 40000}{730000} \times 354$$

$$= \frac{180000}{730000} \times 354$$

$$= 60 \text{ દિવસ}$$

આ ગુણોત્તર ઊંચો હોય તો અસંતોષકારક ગણાય, કંપનીની ઉધરાણીની નીતિ શિથિલ છે તેમ કહેવાય.

નોંધ: (૧) દાખલામાં ભાત્ર દેવાદારો જ આપ્યા હોય તો અંશમાં દેવાદારો જ લેવા (૨) વેચાણની સ્પષ્ટતા ન હોય તો વધુ વેચાણ ઉધાર સમજ્યું. (૩) દિવસો જે આપ્યા હોય તે લેવા, ન આપ્યા હોય તો તકપ લેવા.

(૩) દેવાદાર ચલનદાર (Debtor's Turnover) :

વર્ષમાં કેટલીવાર ઉધારવેચાણની ઉધરાણી મળે છે તેનું સૂચન કરે છે.

$$\text{ઉધાર વેચાણ} \\ \text{દેવાદાર ચલનદાર} = \frac{\text{સરેરાશ દેવાદારો}}{\text{શક્તિમાં દેવાદાર} + \text{આખરના દેવાદાર}}$$

$$\text{સરેરાશ દેવાદારો} = \frac{2}{\text{શક્તિમાં દેવાદાર} + \text{આખરના દેવાદાર}}$$

નોંધ: જો લોણીહુંકી આપી હોય તો તેનો સમાવેશ પણ દેવાદારો સાથે કરવો.

(૪) લેણદાર ગુણોત્તર : (Creditor's Ratio Velocity) :

ઉધાર ખરીદીના નાણા આપણો કેટલા દિવસે ચૂકવીએ છીએ તેની માહિતી લેણદાર ગુણોત્તર પરથી આવે છે. દા.ત., વર્ષના અંતે લેણદારો ૧૦૦૦૦, દેવી હુંકી ૨૦૦૦ હોય અને ઉધાર ખરીદી ૧૪૫૦૦૦ હોય તો લેણદાર ગુણોત્તર નીચે મુજબ શોધાશે.

$$\text{લેણદાર ગુણોત્તર} = \frac{\text{લેણદારો} + \text{દેવી હુંકી}}{\text{ઉધાર ખરીદી}} \times 354$$

$$= \frac{10000 + 2000}{145000} \times 354$$

$$= \frac{12000}{145000} \times 354$$

= ૩૦ દિવસ

$$\text{લેણાદાર ચલનદર} = \frac{\text{ઉધાર ખરીદી}}{\text{સરેરાશ લેણાદારો}}$$

(૪) કાયમી મિલકતોનો ચલનદર (Fixed Assets Turnover)

ધ૰્યાની કાર્યક્ષમતા તથા નફાકારકતા તપાસવા માટે વેચાણ સાથે કાયમી મિલકતોને સરખાવવામાં આવે છે. કાયમી મિલકતોમાં થયેલ રોકાણના પ્રમાણમાં વેચાણ જેમ વધુ હોય તેમ કાયમી મિલકતોનો ઘનિષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે. તેમ ગણાય.

વેચાણ

$$\text{કાયમી મિલકતોનો ચલન દર} = \frac{\text{વેચાણ}}{\text{કાયમી મિલકતો}}$$

(૫) કુલ મિલકતોનો ચલનદર (Total Assets Turnover)

કુલ મિલકતોના રોકાણ સામે વેચાણનું પ્રમાણ કેટલું છે તે આ ગુણોત્તર દરશવિ છે. કુલ મિલકતોનો કેટલી કાર્યક્ષમતાથી ઉપયોગ થઈ રહ્યો છે તેનો ઝ્યાલ આવે છે. આ ગુણોત્તર જેમ ઊંચો તેમ ધ૰્યાની વેચાણ કાર્યક્ષમતા વધુ છે એમ કહેવાય.

વેચાણ

$$\text{કુલ મિલકતોનો ચલનદર} = \frac{\text{વેચાણ}}{\text{કુલ મિલકતો}}$$

$$\text{કુલ મિલકતો} = \text{કાયમી મિલકતો} + \text{ચાલુ મિલકતો}$$

૪.૫ દાખલા

(૧) અશોક મિલ્સ લિ.નાં સંક્ષિપ્ત પાકાં સરવૈયાં નીચે મુજબ છે :

પાકાં સરવૈયા

દેવાં	૩૧-૦૩-'૦૪	૩૧-૦૩-'૦૫	મિલકતો	૩૧-૦૩-'૦૪	૩૧-૦૩-'૦૫
	₹	₹	કાયમી મિલકતો:	₹	₹
શેરમૂડી	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦	જમીન-મકાન	૫૦,૦૦૦	૫૦,૦૦૦
અનામતો	૬૦,૦૦૦	૧,૦૦,૦૦૦	પ્લાન્ટ-યંત્રો	૨,૦૦,૦૦૦	૧,૮૦,૦૦૦
૬% ડિલેન્ચર્સ	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦	ચાલું મિલકતો :		
ચાલુ જ્વાબદારીઓ:			સ્ટોક	૫૫,૦૦૦	૫૫,૦૦૦
લેણાદારો	૪૦,૦૦૦	૬૦,૦૦૦	દેવાદારો	૩૦,૦૦૦	૪૦,૦૦૦
કર્યેરાની જોગવાઈ	૨૦,૦૦૦	૧૦,૦૦૦	રોકડ	૧૫,૦૦૦	૩૪,૦૦૦
	૩,૫૦,૦૦૦	૩,૭૦,૦૦૦		૩,૫૦,૦૦૦	૩,૭૦,૦૦૦

વધારાની ભાહીતી: ૨૦૦૩-૦૪ ૨૦૦૪-૦૫

	₹	₹
વેચાણ	3,૬૫,૦૦૦	૨,૮૨,૦૦૦
કાચો નફો	૬૦,૦૦૦	૫૨,૦૦૦
ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરા પહેલાંનો) ૫૮,૦૦૦		૩૦,૦૦૦
તા. ૦૧-૦૪-૨૦૦૩નાં રોજ સ્ટોક ₹ ૪૫,૦૦૦નો હતો.		

નીચેના હિસાબી ગુણોત્તરોની ગણતરી કરો અને દરેક વિશે ટૂંકું વિશેચન કરો:

- (૧) ચાલુ ગુણોત્તર (૨) માલ ફેરબદલી (સ્ટોક) ગુણોત્તર
(૩) દેવાદારોનો ગુણોત્તર અને (૪) રોકેલી મૂડી પર વળતર.

જવાબઃ

(1) Current Ratio / ચાલુ ગુણોત્તર

ચાલુ ભિલકતો			ચાલુ દેવા		
	૨૦૦૪	૨૦૦૫		૨૦૦૪	૨૦૦૫
સ્ટોક	૫૫૦૦૦	૬૫૦૦૦	લેણદારો	૪૦૦૦૦	૫૦૦૦૦
દેવાદારો	૩૦૦૦૦	૪૦૦૦૦	કરવેરા	૨૦૦૦૦	૧૦૦૦૦
રોકેક	૧૫૦૦૦	૩૫૦૦૦	જોગવાઈ		
	૧૦૦૦૦૦૦	૧૪૦૦૦૦		૫૦૦૦૦	૭૦૦૦૦

$$\text{ચાલુ ગુણોત્તર} = \frac{\text{ચાલુ ભિલકતો}}{\text{ચાલુ દેવા}}$$

$$૨૦૦૩-૦૪ = \frac{૧૦૦૦૦}{૫૦૦૦૦} = ૧.૫૭ : ૧$$

$$૨૦૦૪-૦૫ = \frac{૧૪૦૦૦૦}{૭૦૦૦૦} = ૨ : ૧$$

ચાલુ ગુણોત્તર ચાલુ દેવા ચૂકવવા ભાગે ચાલુ ભિલકતો કેટલી છે તે સૂચયે છે. સામાન્ય રીતે આ ગુણોત્તર રઃ૧ હોય તો આદર્શ ગણાય. ગયા વર્ષે આ ગુણોત્તર સંતોષકારક ન હતો. પરંતુ ચાલુ વર્ષે તે સંતોષકારક છે. આ બાબત કંપનીની સ્થિતિમાં સુધારો સૂચયે છે.

(2) Stock Turnover / માલફેરબદલી (સ્ટોક) ગુણોત્તર :

$$= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$2003-2004 = \frac{275000}{50000}$$

= 5.5 વખત

$$2004-2005 = \frac{240000}{50000}$$

= 4 વખત

વેચેલ ભાલની પડતર =	વેચાણા - કચો નફો
2003-04 =	354000 - 60000 = 274000
2004-05 =	262000 - 52000 = 210000
સરેરાશ સ્ટોક =	શક્ખો સ્ટોક + આખર સ્ટોક 2
2003-04 =	45000+45000/2=45000
2004-05 =	45000+45000/2=45000

વર્ષ દરમયાન કેટલી વખત સ્ટોકનો ઉથલો થાય છે. તે સ્ટોક ચલનદર સૂચયે છે. વર્ષ 2003-04માં તે 5.5 વખત અને 2004-05માં તે 4 વખત થાય છે. જો કે આ અંગે સંતોષકારક અભિપ્રાય આપવો મુશ્કેલ છે. જો કે આ અંગે સંતોષકારક અભિપ્રાય આપવો મુશ્કેલ છે. તેનો આધાર આ જ ધંધાની અન્ય પેઢીઓની ગુણોત્તર, કંપનીના ભૂતકાળના ગુણોત્તર પર રહેલો છે.

(3) Debtors Ratio / દેવાદાર ગુણોત્તર :

$$= \frac{\text{દેવાદારો} + \text{લેણી}}{\text{હુંકી}} \times 365$$

$$2003-04 = \frac{30000}{354000} \times 365$$

= 30 દિવસ

$$2004-05 = \frac{40000}{262000} \times 365$$

= 50 દિવસ

દેવાદારો પાસેથી ઉધાર વેચાણના નાણા કેટલા ઝડપથી વસૂલ થાય છે તે આ ગુણોત્તર સૂચયે છે. ગયા વર્ષે તે ૩૦ દિવસ હતો, જે સંતોષકારક છે. પરંતુ ચાલુ વર્ષે તે ૫૦ દિવસ છે, જે યોગ્ય નથી. આથી તેના કારણો શોધી તપાસ કરી સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે.

(4) Debtors Turnover / દેવાદાર ચલનદર :

$$= \frac{\text{ઉધાર વેચાણ}}{\text{સરેરાશ દેવાદારો}}$$

$$003-04 = \frac{395000}{30000}$$

$$= 12.167 \text{ વખત}$$

$$2004-05 = \frac{262000}{40000}$$

$$= 6.3 \text{ વખત}$$

(5) Return on Capital Employed / રોકેલી મૂડી પર વળતરનો દર :

$$= \frac{\text{ચોખ્ખો નફો}}{\text{રોકાયેલી મૂડી}} \times 100$$

$$\text{રોકેલી મૂડી} = \text{મૂડી} + \text{અનામત} + \text{ડિબેન્ચર}$$

$$2003-04 = 100000 + 60000 + 100000 = 260000$$

$$2004-05 = 100000 + 100000 + 100000 = 300000$$

$$2003-04 = 48000/260000 = 20\%$$

$$2004-05 = 30000/300000 = 10\%$$

ધંધામાં રોકેલી મૂડી પર કેટલા ટકા વળતર મળે છે તે સૂચયે છે. ગયા વર્ષે તે ૨૦% મળ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે તે માત્ર ૧૦% જ મળ્યું છે. જે સંતોષકારક નથી.

(૨) નીચે દી દેસાઈ લિ.નું તા. ૩૧-૦૩-૨૦૦૫ના રોજનું પાંકું સરવૈયું આપ્યું છે.

જવાબદીઓ	₹	મિલકતો	₹
ઇક્સિટી શેરમૂડી	30,000	સાંચા અને યંત્રો	50,000
અનામતો	20,700	માલનો સ્ટોક	14,000
ડિબેન્ચર	30,000	દેવાદારો	3,400
લેણાદારો	5,000	લેણી હુંડીઓ	1,400
દેવી હુંડીઓ	2,000	રોકડ	7,700
	87,700		87,700

૨૦૦૪-૨૦૦૫નું કુલ વેચાણ ઝ 50,000; ચોખ્ખો નફો ઝ 12,000

ઉપરની વિગતો પરથી નીચેના ગુણોત્તરો ગણો અને તેઓ શું દર્શાવે છે તે સમજાવો. : (૧) ચાલુ ગુણોત્તર (૨) પ્રવાહિતા ગુણોત્તર (૩) દેવાદાર ગુણોત્તર (૪) ચોખા નક્ષાનો ગુણોત્તર.

જવાબ:

(1) Current Ratio / ચાલુ ગુણોત્તર:

$$= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\ = \frac{27500}{7000}$$

$$= 3.9 : 1$$

ચાલુ મિલકતો = સ્ટોક + દેવાદારો + લેણી હુંડી

$$= 15000 + 3500 + 1500 + 7000 = 27500$$

ચાલુ દેવા = દેવાદારો + લેણી હુંડી

$$= 5000 + 2000 = 7000$$

ચાલુ દેવા ચૂકવયા માટે ચાલુ મિલકતો 3.9 ગણી છે તેમાં સૂચયે છે. આદર્શ પ્રમાણ રહ્યા છે. વધારાની ચાલુ મિલકતોનું નફાકારક જામીનગિરીમાં રોકાણ કરવું જોઈએ.

(2) Liquidity Ratio / પ્રવાહિતા ગુણોત્તર:

$$= \frac{\text{પ્રવાહિતા મિલકતો}}{\text{પ્રવાહી દેવા}} \\ = \frac{127000}{7000} \\ = 1.81 : 1$$

પ્રવાહી મિલકતો = ચાલુ મિલકતો - સ્ટોક = 27500 - 15000 = 12700

પ્રવાહી દેવા = ચાલુ દેવા - બેંક ઓવર ફ્રાફ્ટ = 7000 - 0 = 7000

ધેંધાના પ્રવાહી દેવા તાત્કાલિક ચૂકવયાના થાય તો કંપની પસે પૂરતી પ્રવાહી મિલકતો છે કે કેમ તે સૂચયે છે. આદર્શ પ્રમાણ 1:1 છે. અહીં આ ગુણોત્તર સંતોષકારક જણાય છે.

(3) Debtor Ratio / દેવાદાર ગુણોત્તર :

$$= \frac{\text{દેવાદારો} + \text{લેણી હુંડી}}{\text{ઉદાર વેચાણ}} \times 35\%$$

$$= \frac{3500 + 1500}{50000} \times 35\%$$

= 30 દિવસ
ઉધારવેચાણની ઉધારાણી 30 દિવસમાં ભલે છે. તેમ સૂચવે છે. જે સંતોષકારક છે.

(4) Net Profit to Sales Ratio / ચોખા નફો ગુણોત્તર :

$$= \frac{\text{ચોખા નફો}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{12000}{50000} \times 100$$

$$= 20\%$$

વેચાણ પર 100 ઝપિયાએ 20 ઝપિયા ચોખા નફો ભલે છે. કંપનીના સંચાલન ખર્ચ પછી શેરહોલ્ડરો માટે 100 ઝપિયાએ 20 ઝપિયા વધે છે સંતોષકારક છે.

(3)	શ્રીનાથ કંપની નીચે મુજબની વિગતો આપે છે:	₹
	વેચાણ (40% રોકડ વેચાણ)	14,00,000
બાદ:	વેચાણ પડતર	<u>3,40,000</u>
	કાચો નફો	3,40,000
		₹
બાદ:	ઓફિસ ખર્ચ	1,24,000
	વેચાણ ખર્ચ	<u>1,24,000</u> <u>2,40,000</u>
		4,00,000
બાદ:	કરવેરા	<u>2,40,000</u>
	ચોખા નફો	<u>2,40,000</u>

પાકું સરવૈચું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
ઇક્સ્પોર્ટ શેરમૂડી	20,00,000	કાથમી મિલકતો	44,00,000
10%ની પ્રેફ. શેરમૂડી	20,00,000	સ્ટોક	1,74,000
અનામતો	11,00,000	દેવાદારો	3,40,000
10% ડિબેન્ચર	10,00,000	લેણીહૂંડીઓ	40,000
લેણાદારો	1,00,000	રોકડ	2,24,000
બેન્ક ઓપરફ્રાફ્ટ	1,50,000	અવાસ્તાવિક મિલકતો	1,00,000
દેવીહૂંડીઓ	45,000		
ચૂકુંઘવાના બાકી ખર્ચ	5,000		
	54,00,000		54,00,000

ઉપરની વિગતો ઉપરાંત શક્ષભાતનો સ્ટોક જ્ઞ ૩,૨૫,૦૦૦નો હતો. વર્ષના કામકાજના દિવસો ૩૬૦ લક્ષમાં લઈ નીચેના ગુણોત્તરો તૈયાર કરો અને કંપનીની સ્થિતિની ચર્ચા કરો:

- (૧) કાચા નફો ગુણોત્તર (૨) સ્ટોક ગુણોત્તર (૩) સંચાલન ગુણોત્તર (૪) ચાલુ ગુણોત્તર (૫) પ્રવાહી ગુણોત્તર (૬) દેવાદારનો ચલનદર (૭) ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર

(સૌ. ચુનિ. ટી. વાય. માર્ચ, ૨૦૦૦)

જવાબ:

- (1) **Gross Profit Ratio / કાચાનફો ગુણોત્તર:**

$$\begin{aligned} &= \frac{\text{કાચો નફો}}{\text{વેચાણ}} \times 100 \\ &= \frac{૭૫૦૦૦૦}{૧૫૦૦૦૦} \times 100 \\ &= ૫૦\% \end{aligned}$$

- (2) **Operating Ratio / સંચાલન ગુણોત્તર:**

$$\begin{aligned} &= \frac{\text{વેચેલ માલની પડતર} + \text{સંચાલન}}{\text{વેચાણ}} \times 100 \\ &= \frac{૭૫૦૦૦૦ +}{૨૫૦૦૦૦} \times 100 \\ &= \frac{૧૫૦૦૦૦૦}{૧૫૦૦૦૦} \\ &= ૬૬.૬૭\% \end{aligned}$$

- (3) **Stock Turnover Ratio / સ્ટોક ગુણોત્તર =**

$$\begin{aligned} &= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\ &= \frac{૭૫૦૦૦૦}{૨૫૦૦૦૦} \\ &= ૩ વખત \\ \text{સરેરાશ સ્ટોક} &= \frac{\text{શક્ષભાતનો સ્ટોક} + \text{આખરનો સ્ટોક}}{૨} \\ &= \frac{૩૨૫૦૦૦ + ૧૭૫૦૦૦}{૨} \end{aligned}$$

$$= 250000$$

(4) Current Ratio / ચાલુ ગુણોત્તર:

$$= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}}$$

$$= \frac{200000}{300000}$$

$$= 2.67 : 1$$

$$\begin{aligned} \text{ચાલુ મિલકતો} &= સ્ટોક + દેવાદારો + લેણીહુંડી + રોકડ \\ &= 174000 + 342000 + 40000 + 22500 = 200000 \\ \text{ચાલુ દેવા} &= લેણાદારો + બેંક ઓવર ફ્રાફ્ટ + દેવા હુંડી + ચુકવવાના બાકી ખર્ચ \\ &= 100000 + 140000 + 45000 + 5000 = 300000 \end{aligned}$$

(5) Liquid Ratio / પ્રવાહી ગુણોત્તર =

$$= \frac{\text{પ્રવાહી મિલકતો}}{\text{પ્રવાહી દેવા}}$$

$$= \frac{200000 + 174000}{300000 - 140000}$$

$$= 4.15 : 1$$

(6) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર =

$$= \frac{\text{દેવાદારો} + \text{લેણી}}{\frac{\text{હુંડી}}{\text{ઉધાર વેચાણ}}} \times 360$$

$$= \frac{340000 + 40000}{1400000 \times 50\%} \times 360$$

$$= 150 \text{ દિવસ}$$

(7) Rate of Return on net Capital Employed / રોકેલી મૂડી પર વળતરનો દર =

$$\begin{aligned}
 &= \frac{\text{EBIT}}{\text{રોકાયેલી મૂડી}} \times 100 \\
 &= \frac{5400000}{5000000} \times 100 \\
 &= 10.00 \%
 \end{aligned}$$

રોકાયેલી મૂડી = ઈક્વિટી શેર + પ્રેફ. શેર + અનામતો + ડિબેન્ચર + અવાસ્તવિક મિલકતો

$$\begin{aligned}
 &= 2000000 + 2000000 + 1100000 + 1000000 - 100000 \\
 &= 5000000
 \end{aligned}$$

(8) Rate of Return on Equity Shares / ઈક્વિટી શેર પર વળતરનો દર =

$$\begin{aligned}
 &\text{PAT} - \text{પ્રેફ. શેર} \\
 &= \frac{\text{ડિવિડન}}{\text{ઈક્વિટી શેર મૂડી}} \times 100 \\
 &= \frac{40000}{2000000} \times 100 \\
 &= 2.0 \%
 \end{aligned}$$

કંપનીની સ્થિતિની ચર્ચા:

કંપનીનો કાચા નફાનો ગુણોત્તર ૫૦ % જેટલો ઊંચો છે. સંચાલન ગુણોત્તર કક ૨/૩ % એટલેકે ચોખાનફાનો ગુણોત્તર ૩૩ ૧/૩ છે, જે સંતોષકારક છે. વર્ષમાં સ્ટોકનો ઉથલો ૩ વખત થાય છે. ચાલુ ગુણોત્તર ૨.૫૭ : ૧ છે, જે સારો છે. પ્રવાહી ગુણોત્તર ઘણો વધારે છે, જે યોગ્ય નથી. ટેવાદારો પાસેથી ઉઘરાએલીના નાણા ઘણા મોડા મળે છે, જે અસંતોષકારક છે. રોકેલી મૂડી પર માત્ર ૧૦% અને ઈક્વિટી શેર પર માત્ર ૨.૫ % જેટલું નીચું વળતર મળે છે, જે યોગ્ય નથી. એકંદરે કંપનીની સ્થિતિ ઘણી અસંતોષકારક જણાય છે.

(૪) પ્રણાવ પેપર મિલ્સ લિ.ના હિસાબી વિગતો નીચે પ્રમાણે મેળવી છે.

	₹
વેચાણા	30,00,000
વેચેલ માલની પડતર	<u>14,00,000</u>
	14,00,000
વહીવટી, વેચાણ અને નાણાંકીય ખર્ચ	<u>4,00,000</u>
	4,00,000
વેરા	<u>4,00,000</u>
ચોખ્ખો નફો	<u>4,00,000</u>

પાકું સરવૈયું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
૧૦%ની પ્રેફ. શેરમૂડી	૨૦,૦૦,૦૦૦	કાયમી મિલકતો	૫૫,૦૦,૦૦૦
ઇડિયટી શેરમૂડી	૨૦,૦૦,૦૦૦	સ્ટોક	૨,૦૦,૦૦૦
અનામત	૧૦,૦૦,૦૦૦	દેવાદારો	૩,૦૦,૦૦૦
૧૦% ડિલેન્ચર	૧૧,૦૦,૦૦૦	લેણી હુંડીઓ	૧,૦૦,૦૦૦
લેણદારો	૧,૫૦,૦૦૦	રોકડ	૨,૦૦,૦૦૦
બેન્ક ઓપરફ્રાન્ઝ	૧,૦૦,૦૦૦	અવાસ્તાવિક મિલકતો	૧,૦૦,૦૦૦
દેવી હુંડીઓ	૪૦,૦૦૦		
ચૂકવવાના બાકી ખર્ચ	૧૦,૦૦૦		
	૭૪,૦૦,૦૦૦		૭૪,૦૦,૦૦૦

શક્ષમાતનો સ્ટોક જ્ઞ ૩,૦૦,૦૦૦નો હતો. વર્ષના ૩૫૦ દિવસ ધારીને નીચેના ગુણોત્તરાની ગણતરી કરો. અને નાણાકીય સ્થિતિ પર ટૂંકું ગિવેદન આપો:

- (૧) કાચા નફાનો ગુણોત્તર (૨) સંચાલન ગુણોત્તર (૩) સ્ટોક ગુણોત્તર (૪) ચાલુ ગુણોત્તર (૫) પ્રવાહી ગુણોત્તર (૬) દેવાદાર ગુણોત્તર (૭) ચોખી રોકેલી મૂડી પર વળતરનો દર

(સૌ. યુનિ., ટી. વાય., એપ્રિલ, ૧૯૬૧)

જવાબ:

(1) Gross Profit Ratio / કાચા નફાનો ગુણોત્તર :

$$\begin{aligned}
 &= \frac{\text{કાચો નફો}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{૧૫૦૦૦૦૦}{૩૦૦૦૦૦} \times 100 \\
 &= ૫૦ \%
 \end{aligned}$$

(2) Operating Ratio / સંચાલન ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{વેચેલ ભાતની પડતર} + \text{સંચાલન}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{૧૫૦૦૦૦૦ +}{૩૦૦૦૦૦} \times 100 \\
 &= \frac{૫૦૦૦૦૦}{૩૦૦૦૦૦} \times 100 \\
 &= \frac{૨૦૦૦૦૦}{૩૦૦૦૦૦} \times 100 \\
 &= ૬૬.૬૭ \%
 \end{aligned}$$

(3) Stock Turn Over Rate / સ્ટોક ગુણોત્તર:

$$\begin{aligned}
 & \text{વેચેલ માલની} \\
 & = \frac{\text{પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 & = \frac{1400000}{250000} \\
 & = 5 \text{ વખત} \\
 & \text{શક્ષમાતનો સ્ટોક} + \text{આખરનો} \\
 \text{સરેરાશ સ્ટોક} & = \frac{\text{સ્ટોક}}{2} \\
 & = \frac{300000 + 200000}{2} \\
 & = 250000
 \end{aligned}$$

(4) Current Ratio / ચાલુ ગુણોત્તર:

$$\begin{aligned}
 & = \frac{\text{ચાલુ ભિલકતો}}{\text{ચાલુ દેવા}} \\
 & = \frac{200000}{300000} \\
 & = 2.57 : 1 \\
 \text{ચાલુ ભિલકતો} & = \text{સ્ટોક} + \text{દેવાદારો} + \text{લેણી હુંડી} + \text{રોકડ} \\
 & = 200000 + 300000 + 100000 + 200000 = 700000 \\
 \text{ચાલુ દેવા} & = \text{લેણાદારો} + \text{બેંક ઓવરફ્રાફ્ટ} + \text{દેવી હુંડી} + \text{ચૂક્યાના બાકી ખર્ચ} \\
 & = 140000 + 100000 + 40000 + 10000 = 300000
 \end{aligned}$$

(5) Liquid Ratio / પ્રવાહી ગુણોત્તર:

$$\begin{aligned}
 & = \frac{\text{પ્રવાહી ભિલકતો}}{\text{પ્રવાહી દેવા}} \\
 & = \frac{200000 - 200000}{300000 - 100000} \\
 & = 3 : 1
 \end{aligned}$$

(6) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{દેવાદારો} + \text{લેણીહુંકી}}{\text{ઉધાર વેચાણ}} \times 350 \\
 &= \frac{300000 + 100000}{3000000} \times 350 \\
 &= 48 \text{ દિવસ}
 \end{aligned}$$

(7) Rate of Return on net Capital Employed / રોકેટી મૂડી પર વળતરનો દર:

$$\begin{aligned}
 &= \frac{\text{EBIT}}{\text{રોકાયેલી મૂડી}} \times 100 \\
 &= \frac{1110000}{5000000} \times 100 \\
 &= 18.4\%
 \end{aligned}$$

રોકાયેલી મૂડી = ઈકિયટી શેર + પ્રેફ. શેર + અનામતો + ડિનેન્યર + અવાસ્તવિક ભિલકતો

$$\begin{aligned}
 &= 2000000 + 2000000 + 100000 + 1100000 - 100000 \\
 &= 5000000
 \end{aligned}$$

$$\text{EBIT} = 1000000 + 110000 = 1110000$$

(8) Rate of Return on Equity Shares / ઈકિયટી શેર પર વળતરનો દર:

$$\begin{aligned}
 &= \frac{\text{PAT} - \text{પ્રેફ. શેર}}{\text{ઈકિયટી શેર}} \times 100 \\
 &= \frac{400000 - 200000}{2000000} \times 100 \\
 &= 15\%
 \end{aligned}$$

(4) પરેશ લિમિટેડના ૨૦૦૪-૨૦૦૫ના વર્ષના વાર્ષિક હિસાબો નીચે મુજબ છે:

તા. ૩૧-૦૩-૨૦૦૫ના રોજ પૂરા થતા વર્ષનું સંક્ષિપ્ત નશાનુક્ષાન ખાતું:

₹	₹
કુલ વેચાણા-(કુલ વેચાણના ૨૫% રોકડ વેચાણ છે.)	૫,૦૦,૦૦૦

બાદ: વેચેલ માલની પડતર:

શાખા સ્ટોક		૫૦,૦૦૦
ઉમેરો ખરીદી		<u>૪,૦૦,૦૦૦</u>
		૪,૫૦,૦૦૦
બાદ: આખર સ્ટોક	<u>૭૦,૦૦૦</u>	૩,૮૦,૦૦૦
કાચો નષો		૨,૨૦,૦૦૦
બાદ: વહીવટી, વેચાણ અને નાણાકીય ખર્ચ	<u>૪૦,૦૦૦</u>	
૫૦% લેખે કરવેરા ગાણયા પહેલાંનો નષો	<u>૧,૮૦,૦૦૦</u>	

તા. ૩૧-૦૩-૨૦૦૫ના રોજનું પાકું સરવૈયું

ભંડોળની પ્રાપ્તિઃ ₹

(૧) માલિકી ભંડોળો:

(અ) ઇક્સિટી શેરમૂડી (દરેક શ્રી ૧૦૦નો)	૨,૦૦,૦૦૦
(બ) ૧૦% પ્રેફરન્સ શેરમૂડી	૧,૦૦,૦૦૦
(ક) અનામતો	<u>૫૦,૦૦૦</u> ૩,૫૦,૦૦૦

(૨) લોન ભંડોળો:

૧૩%નાં ડિલેન્ચર	<u>૧,૦૦,૦૦૦</u>
રોકેલી મૂડી	<u>૪,૫૦,૦૦૦</u>

ભંડોળનો ઉપયોગ:

(૧) કાચમી મિલકતો	૩,૭૫,૦૦૦
(૨) ચાલુ મિલકતો:	

સ્ટોક	૭૦,૦૦૦
દેવાદારો	૫૫,૦૦૦
લેણી હુંડી	૧૫,૦૦૦
રોકડ અને બેનક	<u>૧૦,૦૦૦</u>
	૧,૫૦,૦૦૦

બાદ : ચાલુ દેવાં :

લેણાદારો	૩૦,૦૦૦
દેવી હુંડી	૧૫,૦૦૦
પ્રોવિડન્ટ ફંડ	૫,૦૦૦

બેન્ક ઓવરડાફ્ટ	<u>૨૫,૦૦૦</u>
	<u>૭૫,૦૦૦</u>
	<u>૭૫,૦૦૦</u>
	<u>૪,૫૦,૦૦૦</u>

ઉપરની વિગતો પરથી નીચેના ગુણોત્તરોની ગણાતરી કરો અને પ્રથમ ચાર ગુણોત્તરોનું અર્થધટન કરો. (વર્ષના ૩૬૦ દિવસોને આધારે જક્ષી ગણાતરી કરો):

- (૧) દેવા ઈક્વિટી ગુણોત્તર (૨) દેવાદાર ગુણોત્તર (૩) પ્રવાહી ગુણોત્તર (૪) ચોખા નફાનો ગુણોત્તર (૫) રાકાયેલી મૂડી પર વળતરનો દર (૬) સ્ટોક ચલન દર (૮) શેરદીઠ કમાણી.

(૬.ગુ. યુનિ., ટી.વાચ., એપ્રિલ, ૧૯૯૧)

જવાબ:

- (1) Debt. Equity / દેવા-ઇક્વિટી ગુણોત્તર :

$$\begin{aligned} & \text{લાંબાગાળાના} \\ & = \frac{\text{દેવા}}{\text{માલિકીના} \\ & \quad \text{ભંડોળો}} \\ & = \frac{100000}{350000} \\ & = .0285 \end{aligned}$$

અર્થધટન: માલિકીનાં ભંડોળોના પ્રમાણમાં લાંબાગાળાના દેવા કેટલાં છે તે સૂચયે છે. અહીં શેરહોલ્ડરોના દરેક ઝ્યાંથી ઝ્યાંથી ૩૫૦૦૦ના ભંડોળીની ઝ્યાંથી ૩૫૦ લાંબાગાળાના દેવા દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. આ ગુણોત્તર સંતોષકારક છે. જો આ ગુણોત્તર ઊંચો હોય તો તે શેરહોલ્ડરો માટે ઈચ્છનીય નથી.

- (2) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર:

$$\begin{aligned} & \text{દેવાદારો} + \\ & = \frac{\text{લેણીહુંકી}}{\text{ઉધાર વેચાણ}} \times 350 \\ & = \frac{૫૫૦૦૦ + ૧૫૦૦૦}{૫૦૦૦૦૦ \times ૭૫\%} \times 350 \\ & = \frac{૭૦૦૦૦}{૪૫૦૦૦૦} \times 350 \\ & = ૫૬ દિવસ \end{aligned}$$

અર્થધટન: ઉધારવેચાણની ઉધરાણી કેટલા દીવસે પરત ભણે છે તે આ ગુણોત્તર સૂચયે છે. અહીં દેવાદારો પાસેથી ૫૬ દિવસે ઉધારવેચાણાના નાણાં પરત આવે છે. આ બાબત સંતોષકારક છે કે કેમ તે ધંધાના રીતરિવાજો પર આધાર રાખે છે.

(3) Liquid Ratio / પ્રવાહી ગુણોત્તર:

$$= \frac{\text{પ્રવાહી}}{\text{મિલકતો}} \\ = \frac{\text{પ્રવાહી ટેવા}}$$

$$= \frac{20000}{40000}$$

$$= 1.5 : 1$$

$$\begin{aligned} \text{પ્રવાહી મિલકતો} &= \text{ચાલુ મિલકતો} - \text{સ્ટોક} \\ &= 150000 - 7000 = 140000 \end{aligned}$$

$$\begin{aligned} \text{પ્રવાહી ટેવા} &= \text{ચાલુ ટેવા} - \text{બેંક ઓવર ફ્રાફ્ટ} \\ &= 75000 - 25000 = 50000 \end{aligned}$$

અર્થધારના: દંડધાના પ્રવાહી ટેવાના તાત્કાલિક ચૂકવયાનાં થાય તો તે ચૂકવયા કંપની પાસે પૂરતી પ્રવાહી મિલકતો છે કે કેમ તે સૂચયે છે. આ ગુણોત્તર 1 : 1 હોય તો આદર્શ ગણાય. અહીં તે સંતોષકારક છે. જો કે વધારાની પ્રવાહી મિલકતોનું નફાકારક જામીનગીરીઓમાં રોકાણ કરવું જોઈએ.

(4) Net Profit Ratio / ચોખાના નફાનો ગુણોત્તર:

$$\begin{aligned} &= \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100 \\ &= \frac{120000 - 60000}{500000} \times 100 \\ &= 14\% \end{aligned}$$

અર્થધારના: વેચાણના પ્રમાણમાં ચોખાના નફાનો કેટલો થાય છે. તે સૂચયે છે. દંડધાના સંચાલનના ખર્ચ્યા ચૂકવ્યા પછી શેરહોલ્ડરો માટે કેટલો નફા રહે છે તે દર્શાવ્યે છે. અહીં તે અસંતોષકારક જણાય છે.

(5) Rate of Return on Capital Employed / રોકેલી મૂડી પર વળતરનો દર:

$$\begin{aligned} &= \frac{\text{EBIT}}{\text{રોકાયેલી મૂડી}} \times 100 \\ &= \frac{163000}{450000} \times 100 \\ &= 36.22\% \end{aligned}$$

$$\text{રોકાયેલી મૂડી} = 450000$$

$$\text{EBIT} = \text{EBT} + \text{વ્યાજ} = 120000 + 13000 = 163000$$

(6) Stock Turnover Rate / સ્ટોક ચલનદર:

$$= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$= \frac{320000}{50000} \\ = 1.6:1$$

સરેરાશ સ્ટોક = $\frac{\text{શક્યમાત્રનો સ્ટોક + આખરનો સ્ટોક}}{2}$

$$= \frac{50000+70000}{2} \\ = 60,000$$

(7) Earning per share / શેર દીઠ કમાણી:

$$\text{PAT} - \text{પ્રેફ. શેર} \\ = \frac{\text{ડિવિડન્ડ}}{\text{ઇક્વિટી શેરની સંખ્યા}} \\ = \frac{60000-}{10000} \\ = \frac{2000}{2000} \\ = 40 રૂ$$

- (5) શ્રીનાથ મેન્યુફેસ્ટરિંગ કૂ. તિંની નાણીકીય ભાહિતી અને તેના ઉધોગના સરેરાશ ગુણોત્તરો તમોને પૂરા પાડવામાં આવેલા છે. નીચે દર્શાવિલ હિસાબી ગુણોત્તરોની ગણતરી કરો અને દરેક વિશે ટૂંકમાં તમારો અભિપ્રાય આપો:

તા. ૩૧મી માર્ચ, ૨૦૦૫ના રોજનું પાંકું સરવૈચું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
ઇક્વિટી શેર, દરેક રૂ 10નો	20,00,000	જમીન અને મકાન	16,00,000
૧૨ ટકાની પ્રેફરન્સ શેરમૂડી	5,00,000	મશીનરી	5,00,000
રાખી મૂકેલી કમાણી	3,00,000	ફન્નિચર	40,000
૧૫ ટકાના ડિબેન્ચર્સ	5,00,000	સ્ટોક	7,40,000
લેણદારો	5,00,000	દેવાદારો	5,00,000
દેવી હુંડીઓ	80,000	રોકડ અને બેન્ક	1,40,000
ચૂકવવાના બાકી ખર્ચ	20,000	અન્ય ચાલુ મિલકતો	1,00,000
નેન્ક ઓપરફ્રાષ્ટ	1,00,000	પ્રાથમિક ખર્ચ	50,000
	42,00,000		42,00,000

તા. ૩૧મી માર્ચ, ૨૦૦૫ના રોજ પૂરા થતાં વર્ષનું નફાનું પત્રક

	₹	₹
કુલ વેચાણ (જે પૈકી ૬૦ ટકા ઉધાર વેચાણ છે.)	૪૮,૦૦,૦૦૦	
બાદ : વેચેલ માલની પડતર	૨૮,૮૦,૦૦૦	
સંચાલન ખર્ચ	<u>૭,૮૦,૦૦૦</u>	<u>૩૫,૯૦,૦૦૦</u>
ચોખ્ખો નફો	૧૧,૪૦,૦૦૦	
બાદ : ૫૦ ટકા લેખે કરવેરા		<u>૫,૭૦,૦૦૦</u>
કરવેરા પછીનો ચોખ્ખો નફો		<u>૫,૭૦,૦૦૦</u>

વર્ષની શક્ખાતમાં ક્ષ ૫,૫૦,૦૦૦નો સ્ટોક હતો.

ઉદ્યોગના ગુણોત્તરો:

(૧) ચાલુ ગુણોત્તર	૨.૪
(૨) સ્ટોકનો ચલનદર	૪
(૩) દેવાદારોનો ગુણોત્તર (વર્ષના ૩૬૦ દિવસ ગણવાના છે)	૬૦
(૪) દેવા - ઇક્વિટી ગુણોત્તર	૨૦ ટકા
(૫) ચોખ્ખા નફાનો ગુણોત્તર	૧૦.૫ ટકા
(૬) માલિકીનાં બંદોળો પર વળતરનો દર	૧૮ ટકા

(ગુ. ચુનિ., ટી. વાચ., એપ્રિલ, ૧૯૯૫ - ફેસાર)

જવાબ:

(1) Current Ratio / ચાલુ ગુણોત્તર:

$$= \frac{\text{ચાલુ મિલક્તો}}{\text{ચાલુ દેવા}}$$

$$= \frac{૧૬૦૦૦૦૦}{૭૦૦૦૦૦}$$

$$= ૨.૨૮ : ૧$$

$$\text{ચાલુ મિલક્તો} = \text{સ્ટોક} + \text{દેવાદારો} + \text{રોકડ} + \text{બાકીની ચાલુ મિલક્તો$$

$$= ૭૫૦૦૦૦ + ૫૦૦૦૦૦ + ૧૫૦૦૦૦ + ૧૦૦૦૦૦$$

$$= ૧૬૦૦૦૦૦$$

$$\text{ચાલુ દેવા} = \text{લેણાદારો} + \text{દેવી હુંડી} + \text{ચૂકુવવાના બાકી ખર્ચ} + \text{બેંક ઓવરક્રાફ્ટ}$$

$$= ૫૦૦૦૦૦ + ૨૦૦૦૦ + ૨૦૦૦૦ + ૧૦૦૦૦૦$$

$$= ૭૦૦૦૦૦$$

અભિપ્રાય : ઉદ્ઘોગનો ગુણોત્તર ૨.૪ છે, જ્યારે કંપનીનો ગુણોત્તર ૨.૨૮ છે, જે સંતોષકારક છે., આદર્શ ગુણોત્તર ૨:૧ ગણાય.

(2) Stock Turn Over Rate / સ્ટોક ગુણોત્તર:

$$\begin{aligned}
 & \text{વેચેલ ભાલની} \\
 & = \frac{\text{પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 & = \frac{૫૬૮૦૦૦૦}{૫૫૦૦૦૦} \\
 & = ૧.૪૩ \text{ વખત} \\
 & \text{સરેરાશ સ્ટોક} = \frac{\text{શક્ખાતાનો સ્ટોક} + \text{આખરનો સ્ટોક}}{૨} \\
 & = \frac{૫૫૦૦૦૦ + ૭૫૦૦૦૦}{૨} \\
 & = ૬૦૦૦૦૦
 \end{aligned}$$

અભિપ્રાય: વર્ષ દરમ્યાન કંપનીનો વેચાણ લિથલો ૧.૪૩ વખત થાય છે. જ્યારે ઉદ્ઘોગમાં તે ૪ વખત થાય છે. માટે તે સંતોષકારક છે.

(3) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર:

$$\begin{aligned}
 & \text{દેવાદારો} + \\
 & = \frac{\text{લેણીહુંડી}}{\text{ઉદ્ઘાર વેચાણ}} \times ૩૬૦ \\
 & = \frac{૬૦૦૦૦૦}{૪૮૦૦૦૦૦ \times ૬૦\%} \times ૩૬૦ \\
 & = \frac{૬૦૦૦૦૦}{૪૩૨૦૦૦૦} \times ૩૬૦ \\
 & = ૫૦ દિવસ
 \end{aligned}$$

અભિપ્રાય: સમગ્ર ઉદ્ઘોગમાં ઉદ્ઘારવેચાણની ઉદ્ઘાણી ૫૦ દિવસે મળે છે, જ્યારે કંપનીમાં તે ૫૦ દિવસે મળે છે. એકદેરે સંતોષકારક છે.

(4) Debt. Equity / દેવા-ઇક્વિટી ગુણોત્તર :

$$= \frac{\text{લાંબાગાળાના દેવા}}{\text{માલિકીના ભંડોળો}}$$

$$\begin{aligned}
 & \frac{500000}{= 2600000 -} \\
 & \quad 50000 \\
 & = 0.21
 \end{aligned}$$

માલિકીના ભંડોળો = ઇડિયટી શેર + પ્રેફ. શેર + રાળો મુકેલી કમાણી - પ્રાથમિક કમાણી

અભિપ્રાય: સમગ્ર ઉદ્યોગના ગુણોત્તર (20%) કરતાં કંપનીનો ગુણોત્તર (21%) ઉંચો છે, જે સંતોષકારક છે.

(5) Net Profit Ratio / ચોખા નફાનો ગુણોત્તર:

$$\begin{aligned}
 & = \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100 \\
 & = \frac{570000}{4800000} \times 100 \\
 & = 11.87\%
 \end{aligned}$$

(6) Rate of Return on Proprietors Funds / માલિકીના ભંડોળો પર વળતરનો ગુણોત્તર:

$$\begin{aligned}
 & = \frac{\text{PAT}}{\text{માલિકીના ભંડોળો}} \times 100 \\
 & = \frac{570000}{2840000} \times 100 \\
 & = 20.00\%
 \end{aligned}$$

(7) શ્રી રામ લિ.નું તા. ૩૧-૦૩-૨૦૦૫ના રોજ પૂરી થતા વર્ષનું વેપાર તથા નફાનુક્સાન ખાતું અને તે રોજનું પાંકું સરવૈયું નીચે મુજબ છે.

વિગત	રકમ (શૌ)	વિગત	રકમ (શૌ)
શહેરી સ્ટોક	૮૦,૦૦૦	વેચાણ	૮,૫૦,૦૦૦
ખરીદી	૫,૪૫,૦૦૦	આખર સ્ટોક	૧,૪૮,૦૦૦
રેલવે નૂર	૧૪,૦૦૦		
જકાત	૧૦,૦૦૦		
કાચો નફો	૩,૪૦,૦૦૦		
	૮,૮૮,૦૦૦		૮,૮૮,૦૦૦
ઓફિસ ખર્ચો	૧,૪૦,૦૦૦	કાચો નફો	૩,૪૦,૦૦૦
વેચાણ - વિતરણ ખર્ચો	૩૦,૦૦૦	શેરના વેચાણ પર નફો	૮,૦૦૦
નાણાકીય ખર્ચો	૨૫,૦૦૦		
મિલકત વેચાણની ખોટ	૪,૦૦૦		
ચોખા નફો	૧,૫૦,૦૦૦		
	૩,૪૮,૦૦૦		૩,૪૮,૦૦૦

પાકું સરવૈયું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
ઇક્સ્પીટી શેરમૂડી	૨,૫૦,૦૦૦	જમીન અને મકાન	૧,૫૦,૦૦૦
સામાન્ય અનામતા	૬૦,૦૦૦	મશીનરી	૭૦,૦૦૦
નફાનુકસાન ખાતે	૪૦,૦૦૦	સ્ટોક	૧,૪૮,૦૦૦
કારીગર નફાભાગ ફંડ	૨૦,૦૦૦	દેણી હુંડી	૧૧,૦૦૦
પરચૂરણ લેણાદારો	૮૦,૦૦૦	દેવાદારો	૫૦,૦૦૦
દેવી હુંડી	૨૦,૦૦૦	રોકડ અને બેન્ક	૩૦,૦૦૦
બેન્ક ઓવરફ્રાફ્ટ	૧૦,૦૦૦		
	૪,૮૦,૦૦૦		૪,૮૦,૦૦૦

ઉપરની માહિતી પરથી નીચેના ગુણોત્તરો ગણો અને કોઈ પણ બે પર તમારું મંતવ્ય જણાવો:

- (૧) પ્રવાહી ગુણોત્તર (૨) સંચાલન ગુણોત્તર (૩) કાચા નફાનો ગુણોત્તર (૪)
સ્ટોક ઉિથલો

(ગુ. ચુનિ. ટી. વાય., માર્ચ, ૧૯૬૭; ઉ. ગુ. ચુ., ટી. વાય., માર્ચ, ૨૦૦૦)

જવાબ:

(1) Liquid Ratio / પ્રવાહી ગુણોત્તર:

$$\begin{aligned}
 & \frac{\text{પ્રવાહી}}{\text{મિલકતો}} \\
 & = \frac{૧૦૧૦૦૦}{૧૨૦૦૦૦} \\
 & = ૦.૮૪ : ૧
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{પ્રવાહી મિલકતો} & = \text{રોકડ} + \text{દેણી હુંડી} + \text{દેવાદારો} \\
 & = ૩૦૦૦૦ + ૧૧૦૦૦ + ૫૦૦૦૦
 \end{aligned}$$

$$= ૧૦૧૦૦૦$$

$$\begin{aligned}
 \text{પ્રવાહી દેવા} & = \text{લેણાદારો} + \text{દેવીહુંડી} + \text{કામદાર નફાભાગ ફંડ} \\
 & = ૮૦૦૦૦ + ૨૦૦૦૦ + ૨૦૦૦૦ \\
 & = ૧૨૦૦૦૦
 \end{aligned}$$

અભિપ્રાય : કંપનીની પ્રવાહી મિલકતો તેનાં પ્રવાહી દેવાં ચુકવવા પૂરતી છે કે કેમ તેનું સૂચન કરે છે. આ ગુણોત્તર ૧:૧ હોયો તો આદર્શ ગણાય. અહીં તો ૦.૮૪ : ૧ છે, જે અસંતોષકારક છે. કંપનીએ પ્રવાહી મિલકતોમાં વધારો કરવો જોઈએ, નહીં તો તાત્કાલિક ઉઘરાણી થાય તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાશે.

(2) **Operating Ratio / સંચાલન ગુણોત્તર:**

$$\begin{aligned}
 &= \frac{\text{વેચેલ ભાલની પડતર} + \text{સંચાલન ખર્ચ}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{510000 +}{165000} \times 100 \\
 &\quad \frac{85000}{85000} \\
 &= 82.34\%
 \end{aligned}$$

વેચેલ ભાલની પડતર = વેચાણ - કાચો નફો

$$= 85000 - 34000$$

$$= 51000$$

$$\begin{aligned}
 \text{સંચાલન ખર્ચ} &= \text{કાર્યાલયના ખર્ચ} + \text{વેચાણના ખર્ચ} + \text{નાણાંકીય ખર્ચ} \\
 &= 140000 + 30000 + 25000 \\
 &= 165000
 \end{aligned}$$

અભિપ્રાય: વેચાણના પ્રમાણમાં ધ્યાના કુલ સંચાલનખર્ચ કેટલા છે તે દરશાવે છે. અણી તે અસંતોષકારક જગ્યાય છે. જો કે માત્ર એક જ વર્ષમાં અને એકજ કંપનીના ગુણોત્તરને આધારે અભિપ્રાય આપવો મુશ્કેલ છે.

(3) **Gross Profit Ratio / કાચા નફોનો ગુણોત્તર:**

$$\begin{aligned}
 &= \frac{\text{કાચો નફો}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{340000}{850000} \times 100 \\
 &= 40\%
 \end{aligned}$$

(4) **Stock Turn Over Rate / સ્ટોક ઉથલો:**

$$\begin{aligned}
 &= \frac{\text{વેચેલ ભાલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 &= \frac{510000}{116500} \\
 &= 4.47 \text{ વખત}
 \end{aligned}$$

$$\begin{array}{c}
 \text{શક્ખો સ્ટોક + આખર} \\
 \text{સરેરાશ સ્ટોક} = \frac{\text{સ્ટોક}}{2} \\
 \\
 \text{= } \frac{60000 +}{146000} \\
 \\
 \text{= } \frac{}{2} \\
 \\
 \text{= } 116500
 \end{array}$$

(૮) રાધિકા લિ.નું તા. ૩૧-૦૩-૨૦૦૦ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

પાકું સરવૈયું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
ઇક્સ્પીટી શેરમૂડી	૨,૫૦,૦૦૦	કાયમી મિલકતો	૪,૮૦,૦૦૦
૧૦% ની પ્રેફ. શેર મૂડી	૧,૦૦,૦૦૦	સ્ટોક	૧,૧૨,૫૦૦
સામાન્ય અનામત	૧,૧૨,૫૦૦	દેવાદારો	૮૭,૫૦૦
૧૨% નાં ડિલેવર્સર્સ	૧,૫૦,૦૦૦	લેણી હુંડીઓ	૨૫,૦૦૦
બેન્ક ઓવરફ્રાફ્ટ	૨૫,૦૦૦	રોકડ સિલક	૪૫,૦૦૦
લેણાદારો	૧,૦૦,૦૦૦	પ્રાંથમિક ખર્ચ	૧૨,૫૦૦
દેવી હુંડી	૨૫,૦૦૦		
	૭,૬૨,૫૦૦		૭,૬૨,૫૦૦

વધારાની માહિતી:

(૧) કુલ વેચાણ જી ૬,૦૦,૦૦૦ (જેમાં રોકડ વેચાણ, ઉધાર વેચાણનો ૧/૫ ભાગ છે.)

(૨) વેચેલ માલની પડતર: જી ૫,૪૦,૦૦૦

(૩) ચોખ્ખો નષ્ટો (વ્યાજ અને કરવેરા પહેલાંનો) જી ૨,૪૩,૦૦૦ કરવેરાનો દર ૫૦% છે.

(૪) તા. ૧-૩-૧૯૯૯ના રોજ સ્ટોક જી ૧,૦૩,૫૦૦ હતો.

ઉપરની માહિતીને આધારે નીચેના ગુણોત્તરોની ગણતરી કરો. અને કૌંસ ()માં આપેલ આદર્શ ગુણોત્તરને આધારે દરેક ગુણોત્તર વિશે તમારો ટૂંકો અભિપ્રાય આપો.

જીજી જણાય ત્યાં વર્ષના ૩૦૦ દિવસો ધ્યાનમાં લેવા.

- | | |
|--------------------------------------|------------------------------------|
| (૧) ચાલુ ગુણોત્તર (૨ : ૧) | (૪) દેવાદાર ગુણોત્તર (૪૫ દિવસ) |
| (૨) પ્રવાહી ગુણોત્તર (૧.૨૫ : ૧) | (૫) સ્ટોક ચલનદર ગુણોત્તર (૫ વખત) |
| (૩) રોકલી મૂડી પર વળતર (૨૫%) છે. | (૬) મૂડી નિયર્ટિંગ ગુણોત્તર (૦.૭૫) |
| (૬. ગુ. ચુનિ. ટી.વાય., એપ્રિલ, ૨૦૦૧) | |

જવાબ:

(1) Current Ratio / ચાલુ ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\
 &= \frac{112500 + 7500 + 25000 + 45000}{25000 + 100000 + 25000} \\
 &= 1.8 : 1
 \end{aligned}$$

અભિપ્રાય: કંપનીનો ચાલુ ગુણોત્તર આદર્શ ગુણોત્તર કરતાં ઓછો છે, અસંતોષકારક છે.

(2) Liquid Ratio / પ્રવાહી ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{પ્રવાહી મિલકતો}}{\text{પ્રવાહી દેવા}} \\
 &= \frac{7500 + 45000 + 25000}{100000 + 25000} \\
 &= 1.25 : 1
 \end{aligned}$$

અભિપ્રાય: કંપનીનો ગુણોત્તર અબે આદર્શ ગુણોત્તર લગભગ સરખો છે. એકંદરે સંતોષકારક છે.

(3) Return on Capital Employed / રોકાયેલી મૂડી પર વળતરનો દર:

$$\begin{aligned}
 &= \frac{\text{EBIT}}{\text{રોકાયેલી} \times 100} \\
 &= \frac{243000}{500000} \times 100 \\
 &= 48.6\% \\
 \text{રોકાયેલી મૂડી} &= ઇક્વિટી શેર + પ્રેફ. શેર + સામાન્ય અનામત + ડિલેન્ચર - \\
 \text{પ્રાથમિક ખર્ચ} &= 250000 + 100000 + 112500 + 140000 - 125000 \\
 &= 500000
 \end{aligned}$$

અભિપ્રાય: આદર્શ ગુણોત્તર કરતા કંપનીનો ગુણોત્તર ઊંચો હોવાથી સંતોષકારક છે.

(4) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર:

$$\begin{aligned}
 & \frac{\text{દેવાદાર} +}{\text{લેખીહુંકી}} \times 300 \\
 & = \frac{67500}{600000 \times 4/5} \\
 & = 45 \text{ દિવસ}
 \end{aligned}$$

અભિપ્રાય: કંપનીનો ગુણોત્તર અને આદર્શ ગુણોત્તર બંને સરખા હોવાથી અકંદરે સંતોષકારક છે.

(5) Stock Turn Over Rate / સ્ટોક ઉથલો:

$$\begin{aligned}
 & \frac{\text{વ્યેલ માલની}}{\text{પડતર}} \\
 & = \frac{450000}{908000} \\
 & = 4 \text{ વખત}
 \end{aligned}$$

$$\begin{aligned}
 & \frac{\text{શક્ખો સ્ટોક} + \text{આખરનો}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 & = \frac{103400 + 112500}{2} \\
 & = 102950
 \end{aligned}$$

અભિપ્રાય: કંપનીનો ગુણોત્તર અને આદર્શ ગુણોત્તર બંને સરખા હોવાથી અકંદરે સંતોષકારક છે.

(e) બુક્ઝદેય કંપની તિ.નું તા. ૩૧-૦૩-૨૦૦૧ના રોજનું પાકું સરવૈયુઃ

પાકું સરવૈયું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
ઇડિયટી શેરમૂડી	૨૦,૦૦,૦૦૦	કાચભી મિલકતો	૧૫,૨૦,૦૦૦
અનામત અને વધારો	૧૦,૮૦,૦૦૦	કામચલાઉ રોકાણો	૧૦,૦૦,૦૦૦
૧૦% નાં ડિલેન્ચર્સ	૧૦,૦૦,૦૦૦	સ્ટોક	૭,૫૦,૦૦૦
લેણાદરો	૪,૫૦,૦૦૦	દેવાદરો	૮,૨૫,૦૦૦
દેવી હુંડી	૧,૫૦,૦૦૦	અગાઉથી ચૂકવેલ ખર્ચ	૧,૦૦,૦૦૦
ચૂકવવાના બાકી ખર્ચ	૧,૦૦,૦૦૦	અગાઉથી ચૂકવેલ આવકયેરો	૧૦,૦૦૦
પ્રોવિંડન્ટ ફંડ	૧,૮૦,૦૦૦	લેણીહુંડી	૩,૭૫,૦૦૦
કરવેરાની જોગવાઈ	૪૦,૦૦૦	બેન્ક સિલક	૪,૦૦,૦૦૦
	૫૦,૦૦,૦૦૦	બાંધદરી કમિશન	૨૦,૦૦૦
	૫૦,૦૦,૦૦૦		૫૦,૦૦,૦૦૦

વધારાની માહિતી:

- (૧) કાચો નફો - વેચાણા છ૦% છે.
- (૨) ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરા પહેલાંનો) રૂ. ૧૦,૦૦,૦૦૦ કરવેરાનો દર ૫૦% છે.
- (૩) રોકડ વેચાણા, ઉધાર વેચાણા ૨૫% છે.
- (૪) તા. ૧-૪-૨૦૦૦ના રોજ સ્ટોક રૂ. ૪,૫૦,૦૦૦.
- (૫) દેવાદાર પાસેથી ઉધરાએટી, ૧૦૮ દિવસે પરત મળે છે.

(વર્ષના ૩૬૦ દિવસ દ્વાનાં લેવા)

નીચેના ગુણોત્તરની ગણતરી કરો.

- | | |
|---------------------------|---------------------------|
| (૧) રોકાયેલી મૂડી પર વળતર | (૪) ચાલુ ગુણોત્તર |
| (૨) સ્ટોક ગુણોત્તર | (૫) ચોખ્ખા નફાનો ગુણોત્તર |
| (૩) માલિકી ગુણોત્તર | (૬) સંચાલન ગુણોત્તર |

(દ. ગુ. ચુનિ. ટી.વાય., એપ્રિલ, ૨૦૦૧)

જવાન:

(1) Rate of Return on Capital Employed / રોકેલી મૂડી પર વળતરનો દર:

$$\begin{aligned}
 &= \frac{\text{EBIT}}{\text{રોકાયેલી મૂડી}} \times 100 \\
 &= \frac{100000}{4050000} \times 100 \\
 &= 24.53\%
 \end{aligned}$$

રોકાયેલી મૂડી = ઇડિયટી શેર + પ્રેફ. શેર + ડિલેન્ચર - બાંધદરી કમિશન

$$= 2000000 + 1080000 + 1000000 - 20000$$

$$= 4050000$$

(2) Stock Turn Over Rate / સ્ટોક ગુણોત્તર:

વેચેલ માલની

$$= \frac{\text{પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$= \frac{3000000}{500000}$$

$$= 6 \text{ વખત}$$

વેચેલ માલની પડત = વેચાણ - કાચો નષ્ટો

$$= 4000000 - 40\% \text{ લેખે } 2000000$$

$$= 3000000$$

$$\text{સરેરાશ સ્ટોક} = 4500000 + 750000 / 2$$

$$= 500000$$

અર્થધટન: અહીં રોકડ વેચાણ ઉધારવેચાણના 25% છે. ઉધારણીનો સમયગાળો 108 દિવસનો છે. કાચો નષ્ટો વેચાણના 40% છે. માટે દેવાદાર ગુણોત્તરને આધારે ઉધારવેચાણ, ત્યાર પછી કુલ વેચાણ અને છેવેટે ઉધારમાલની પડતર શોધીશું.

(3) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર:

$$= \frac{\text{દેવાદારો} + \text{લેણીહુંકી}}{\text{ઉધાર વેચાણ}} \times 350$$

$$108 = \frac{825000 + 375000}{\text{ઉધાર વેચાણ}} \times 350$$

$$\text{ઉધાર વેચાણ} = \frac{1200000}{108} \times 350$$

$$= 3,4000000$$

$$\text{રોકડ વેચાણ} = 4000000 \times 25\%$$

$$= 1000000$$

$$\text{કુલવેચાણ} = 4000000 + 1000000$$

$$= 5000000$$

(4) Proprietary Ratio / માલિક ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{માલિકોના ભંડોળો}}{\text{કુલ વાસ્તવિક મિલકતો}} \times 100 \\
 &= \frac{2,00,000 +}{1,02,000} \times 100 \\
 &\quad \frac{4,00,000 - 2,0000}{4,00,000 - 2,0000} \\
 &= 51.45\%
 \end{aligned}$$

(5) Current Ratio / ચાલુ ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\
 &= \frac{34,50,000}{6,20,000} \\
 &= 3.75 : 1 \\
 \text{ચાલુ મિલકત} &= 10,00,000 + 7,40,000 + 2,24,000 + 1,00,000 + 10,000 + 3,74,000 + 4,00,000 & = 34,50,000 \\
 \text{ચાલુ દેવા} &= 8,40,000 + 1,40,000 + 1,00,000 + 1,20,000 + 40,000 & = 6,20,000
 \end{aligned}$$

(6) ચોમખો નફાનો ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{ચોમખો નફો}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{450000}{5000000} \times 100 \\
 &= 9\%
 \end{aligned}$$

PAT = EBIT - વ્યાજ - વેશ

$$\begin{aligned}
 &= 10,00,000 - 1,00,000 = 9,00,000 - \text{tax } 8,40,000 = 8,40,000
 \end{aligned}$$

(7) Operating Ratio /સંચાલન ગુણોત્તર:

$$= \frac{\text{વેચેલ ભાલની પડતર} + \text{સંચાલનના ખર્ચ}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{30,00,000+}{11,00,000} \times 100 \\ = \frac{41,00,000}{11,00,000} \times 100$$

$$= \frac{41,00,000}{11,00,000} \times 100$$

$$= 82\%$$

$$\begin{aligned} \text{સંચાલનના ખર્ચ} &= \text{ઓષ્ઠો નફો} - \text{EBIT} + \text{વ્યાજ} \\ &= 20,00,000 - 10,00,000 + 1,00,000 \\ &= 11,00,000 \end{aligned}$$

(૧૦) અંજના લિમિટેડનાં સંક્ષિપ્ત પાકાં સરવૈથા નીચે મુજબ છે.

દેવાં	૩૧-૩-૦૭ ₹	૩૧-૩-૦૮ ₹	મિલકતો	૩૧-૩-૦૭ ₹	૩૧-૩-૦૮ ₹
ઇક્વાટી શેર મૂડી	1,40,000	2,40,000	કાયમી મિલકતો	4,20,000	4,80,000
૧૦%ની પ્રેફ.	1,00,000	1,00,000	સ્ટોક	55,000	62,500
શેરમૂડી					
અનામતો	70,000	1,20,000	ટેવાદારો	70,000	40,000
૧૦%ના કિલેન્ચરો	1,40,000	1,40,000	રોકડ અને બેન્ક સિલક	10,000	7,500
બેન્ક ઓવરફ્રોઝ	50,000	30,000	અગાઉથી ચૂંખર્યા	5,000	10,000
લેણાદારો	40,000	45,000			
દેવીહૂંડીઓ	10,000	5,000			
	4,70,000	4,00,000		4,70,000	4,00,000

વધારાની ભાહિતી :

	૨૦૦૬-૦૭ ₹	૨૦૦૭-૦૮ ₹
કુલ વેચાણ (રોકડ વેચાણ ઉધાર વેચાણનો ૪/૫ ભાગ છે)	6,00,000	13,40,000
કાચો નફો	2,25,000	4,04,000

ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરા બાદ કર્યા પહેલાંનો કરવેરાનો દર 50% છે.)	1,46,000	2,84,000
તા. ૧-૪-૨૦૦૫નો રોજનો સ્ટોક	70,000	--

ઉપરની માહિતી પરથી બંને વર્ષ માટે નીચેના હિસાબી ગુણોત્તરો ગણો:

- (૧) ચોખ્ખા નફાનો ગુણોત્તર.
- (૨) સ્ટોક ગુણોત્તર.
- (૩) દેવાદાર ગુણોત્તર (વર્ષના 300 દિવસો ગણવાના છે.)
- (૪) ચાલુ ગુણોત્તર

(દ. ગુ. યુનિ..., ટી. વાય..., એપ્રિલ, ૧૯૯૩)

(૧)

$$\begin{aligned} \text{Net Profit Ratio} &= \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100 \\ / \text{ચોખ્ખાનફા ગુણોત્તર} &= \frac{72,000}{6,00,000} \times 100 \\ 2005-06 &= 12\% \\ 2007-08 &= \frac{1,34,000}{13,40,000} \times 100 \\ &= 10\% \end{aligned}$$

$$\begin{aligned} 2005-06 &= \frac{\text{EBIT}}{\text{PAT}} - \frac{\text{વ્યાજ}}{14,000} = 1,44,000 - \frac{50\% \text{ વેરા}}{72,000} = 72,000 \\ 2007-08 &= \frac{\text{EBIT}}{\text{PAT}} - \frac{\text{વ્યાજ}}{14,000} = 2,70,000 - \frac{50\% \text{ વેરા}}{1,34,000} = 1,34,000 \end{aligned}$$

(૨)

$$\begin{aligned} \text{Stock Turnover} &= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\ / \text{સ્ટોક ગુણોત્તર:} &= \frac{5,74,000}{5,40,000} = 10 \text{ (વખત)} \\ 2005-06 &= \frac{6,44,000}{6,74,000} = 12 \text{ (વખત)} \end{aligned}$$

$$\begin{aligned} \text{વેચેલ માલની પડતર} &= \text{વેચાણ} - \text{ચોખ્ખો નફો} \\ 2005-06 &= 6,00,000 - 2,24,000 = 5,74,000 \\ 2007-08 &= 13,40,000 - 8,04,000 = 6,44,000 \end{aligned}$$

$$\text{संरेशा स्टोक} = \frac{\text{शृङ्खले स्टोक} + \text{आवरण वाले स्टोक}}{2}$$

$$2005-06 = \frac{70,000 + 54,000}{2} = 62,000$$

$$2006-07 = \frac{54,000 + 62,000}{2} = 58,000$$

(3)

$$\text{Debtors Ratio / देवाधार गुणोत्तर : } = \frac{\text{देवाधारो + लेणीहंडी}}{\text{उधार वेचाणी}} \times 300$$

$$2005-06 = \frac{70,000}{5,00,000} \times 300$$

= 42 दिवस

$$2006-07 = \frac{50,000}{5,50,000} \times 300$$

= 20 दिवस

उधार वेचाणी:

$$2005-06 = 6,00,000 \times \frac{100}{120} = 5,00,000$$

$$2006-07 = 13,50,000 \times \frac{100}{120} = 9,50,000$$

(4)

$$\text{Current Ratio / चालु भिलकतो} = \frac{\text{चालु भिलकतो}}{\text{चालु देवा}}$$

$$2005-06 = \frac{54,000+70,000+10,000+4,000}{50,000+40,000+10,000}$$

$$= \frac{1,50,000}{1,00,000}$$

$$= \boxed{1.5 : 1}$$

$$2006-07 = \frac{62,500+50,000+7,500+10,000}{30,000+45,000+4,000}$$

$$= \frac{1,50,000}{60,000}$$

$$= \boxed{2:1}$$

अ. ८

(૧૧) વિપુલ લિમિટેડનાં તા. ૩૧-૩-૨૦૦૩ અને ૩૧-૩-૨૦૦૪ ના રોજના પાકા સરવૈયાં નીચે મુજબ છે.

દેવાં	૩૧-૩-૦૩ ₹	૩૧-૩-૦૪ ₹	મિલકતો	૩૧-૩-૦૩ ₹	૩૧-૩-૦૪ ₹
દોક ૩.૧૦૦ ના તેવા ઈ. શેર	૫,૦૦,૦૦૦	૬,૦૦,૦૦૦	કાયમી મિલકતો	૬,૨૫,૦૦૦	૧૧,૮૦,૦૦૦
સામાન્ય અનામત	૨,૦૦,૦૦૦	૩,૦૦,૦૦૦	સ્ટોક	૧,૦૦,૦૦૦	૧,૨૦,૦૦૦
ન.નુ.ખાતુ	૧,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	દેવાદારો	૪૦,૦૦૦	૧,૦૦,૦૦૦
૧૦%ના ડિઝેન્યરો	૨,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	લેણીહુંડીઓ	૫૦,૦૦૦	૮૦,૦૦૦
લેણાદારો	૧,૦૦,૦૦૦	૮૦,૦૦૦	રોકડ સિલક	૧,૨૦,૦૦૦	૧,૧૫,૦૦૦
દેવીહુંડીઓ	૫૦,૦૦૦	૭૦,૦૦૦	અગાઉથી ચૂં ખર્ચ	૫,૦૦૦	૫,૦૦૦
બેનક ઓપરક્રાફ્ટ	૧,૦૦,૦૦૦	૧,૫૦,૦૦૦			
	૧૨,૫૦,૦૦૦	૧૬,૦૦,૦૦૦		૧૨,૫૦,૦૦૦	૧૬,૦૦,૦૦૦

વધારાની માહિતી :

	૩૧-૩-૨૦૦૩ ₹	૩૧-૩-૨૦૦૪ ₹
કુલ વેચાણ (રોકડ વેચાણ ઉધાર વેચાણનો ૨/૫ ભાગ છે	૭,૦૦,૦૦૦	૧૦,૫૦,૦૦૦
કાચો નશો	૨,૫૦,૦૦૦	૪,૦૦,૦૦૦
ચોખ્ખો નશો (વ્યાજ અને કરવેરા પહેલાંનો, કરવેરાનો ૬૨ ૫૦% છે.)	૧,૫૦,૦૦૦	૨,૭૨,૦૦૦

તા. ૧-૪-૨૦૦૬ ના રોજનો સ્ટોક રૂ.૮૦,૦૦૦

ઉપરની માહિતી પરથી નીચેના ગુણોત્તરોની ગણતરી કરો અને પ્રથમ ત્રણ ગુણોત્તરોનું અર્થધટન કરો:

- (૧) ચોખ્ખા નક્ષાનો ગુણોત્તર.
- (૨) દેવાદાર ગુણોત્તર (વર્ષના ૩૫૦ દિવસો ગણવાના છે.)
- (૩) પ્રવાહી ગુણોત્તર
- (૪) સ્ટોક અલનદર
- (૫) શેરહોલ્ડરોનાં ભંડેળ પર વળતરનો દર.
- (૬) દેવાં-ઇકવીઠી ગુણોત્તર

(ગુ. ચુનિ..., ટી. વાચ..., માર્ચ, ૧૯૯૯)

જવાબ:- (૧)

$$\text{Net Profit Ratio} = \frac{\text{ચોખ્ખો નશે}}{\text{વેચાણ}} \times 100$$

$$\text{2005-06} = \frac{70,000}{7,00,000} \times 100$$

$$= 10\%$$

$$\text{2006-07} = \frac{1,25,000}{10,50,000} \times 100$$

$$= 12\%$$

$$\text{PAT} = \text{EBIT} - \text{વ્યાજ} = \text{EBT} - \text{વેરા 40\%}$$

$$2005-06 = 1,50,000 - 20,000 = 1,30,000 - 70,000 = 70,000$$

$$2006-07 = 2,72,000 - 20,000 = 2,52,000 - 1,25,000 = 1,25,000$$

અર્થાટન :- ધંધાની નફાકારકતાનો ખ્યાલ આપે છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તેમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે તે સંતોષકારક છે કેમ તે અંગે ચોક્કસ અભિપ્રાય આપવો મુશ્કેલ છે કારણ કે તેનો આધાર ઉદ્ઘોગની અન્ય પેઢીઓના ગુણોત્તરો તેમજ પેઢીના બૂતકાળના ગુણોત્તરો પર રહેલો છે.

$$\text{Debtors Ratio / દેવાદાર ગુણોત્તર : } = \frac{\text{દેવાદારો} + \text{લેણીહંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 350$$

$$\text{2005-06} = \frac{40,000 + 50,000}{4,00,000} \times 350$$

$$= \frac{1,00,000}{4,00,000} \times 350$$

$$= 72 \text{ દિવસ}$$

$$\text{2006-07} = \frac{1,00,000 + 120,000}{1,40,000} \times 350$$

$$= \frac{1,20,000}{1,40,000} \times 350$$

$$= 75 \text{ દિવસ}$$

ઉધાર વેચાણ ગણતરી:

$$2005-06 = 7,00,000 \times \frac{100}{140} = 5,00,000$$

$$2006-07 = 10,50,000 \times \frac{100}{140} = 7,50,000$$

અર્થધટન: દેવાદારો પાસેથી ઉધરાણીના નાણાં કેટલા દિવસે ભણે છે તે સૂચયે છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શાખની મુદ્દતમાં વધારો થયો છે, જે અસંતોષકારક છે. તેનાં કરણોની તપાસ કરી સુધારાત્મક પગલાં લેવાં જોઈએ.

(૩)

$$\begin{aligned}
 \text{Liquid Ratio / પ્રવાહી ગુણોત્તર} &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\
 2005-06 &= \frac{40,000 + 50,000 + 1,20,000 + 4,000}{1,00,000 + 40,000} \\
 &= \frac{2,24,000}{1,40,000} \\
 &= \boxed{1.6:1} \\
 2006-07 &= \frac{1,00,000 + 70,000 + 1,14,000 + 4,000}{80,000 + 70,000} \\
 &= \frac{3,00,000}{1,50,000} \\
 &= \boxed{2:1}
 \end{aligned}$$

અર્થધટન:- ધ્યાની પ્રવાહી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. આ ગુણોત્તર ૧:૧ હોય તો આદર્શ ગણાય. આ ગુણોત્તર ગયા વર્ષે ૧.૬:૧ અને ચાલુ વર્ષે ૨:૧ છે. આથી વધારાની પ્રવાહી મિલકતોનું નફાકારક જમીનગીરીમાં રોકાણ કરવું જોઈએ.

(૪)

$$\begin{aligned}
 \text{Stock Turnover Ratio /} &= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 \text{સ્ટોક ગુણોત્તર:} & \\
 2005-06 &= \frac{4,50,000}{60,000} = 4 \text{ વખત} \\
 2006-07 &= \frac{5,40,000}{1,10,000} = 5.61 \text{ વખત}
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{વેચેલ માલની પડતર} &= \text{વેચાણ} - \text{ચોખ્ખો નફો} \\
 2005-06 &= 7,00,000 - 2,50,000 = 4,50,000 \\
 2006-07 &= 10,40,000 - 4,00,000 = 6,40,000
 \end{aligned}$$

$$\text{સરેરાશ સ્ટોક} = \frac{\text{શરૂનો સ્ટોક} + \text{આખરનો સ્ટોક}}{2}$$

$$2005-06 = \frac{₹0,000 + ₹1,00,000}{2} = ₹50,000$$

$$2007-08 = \frac{₹1,00,000 + ₹1,20,000}{2} = ₹1,10,000$$

(4)

$$\text{Return on Shareholders Funds} / \text{શેરહોલ્ડરના ભંડોળ પર વળતરનો દર :} = \frac{\text{PAT}}{\text{શેર હોલ્ડરનાં ભંડોળ}} \times 100$$

$$2005-06 = \frac{₹50,000}{₹2,00,000} \times 100 \\ = 2.5\%$$

$$2007-08 = \frac{₹1,25,000}{₹1,00,000} \times 100 \\ = 12.5\%$$

$$\begin{aligned} \text{શેરહોલ્ડરના ભંડોળ} &= ઈકવીટી શેર + સામાન્ય અનામત + નફા નુકસાન ખાતું \\ 2005-06 &= ₹4,00,000 + ₹2,00,000 + ₹1,00,000 = ₹7,00,000 \\ 2007-08 &= ₹5,00,000 + ₹3,00,000 + ₹2,00,000 = ₹10,00,000 \end{aligned}$$

(5)

$$\text{Debtors Equity Ratio} / \text{દેવા ઈકવીટી ગુણોત્તર :} = \frac{\text{લાબાગાળાના દેવા}}{\text{માલિકી ભંડોળો}} \times 100$$

$$2005-06 = \frac{₹2,00,000}{₹2,00,000} \times 100 \\ = 25\%$$

$$2007-08 = \frac{₹2,00,000}{₹1,00,000} \times 100 \\ = 20.0\%$$

$$\begin{aligned} \text{માલિકીના ભંડોળ} &= ઈકવીટી શેર + સામાન્ય અનામત + નફા નુકસાન ખાતું \\ 2005-06 &= ₹4,00,000 + ₹2,00,000 + ₹1,00,000 = ₹7,00,000 \\ 2007-08 &= ₹5,00,000 + ₹3,00,000 + ₹2,00,000 = ₹10,00,000 \end{aligned}$$

(૧૨) લઘુ ક્રૈલાસ કંપની લિ. ના તા. ૩૧-૧૨-૦૨ અને તા. ૩૧-૧૨-૦૩ ના રોજનાં પાકાં સરવૈયા નીચે મુજબ છે:

અંજના લિમિટડનાં સંક્ષિપ્ત પાકાં સરવૈયા નીચે મુજબ છે.

દેવાં	૩૧-૧૨-૦૨ ₹	૩૧-૧૨-૦૩ ₹	મિલકતો	૩૧-૧૨-૦૨ ₹	૩૧-૧૨-૦૩ ₹
ઇક્વિટી શેર મૂડી	૨,૦૦,૦૦૦	૪,૦૦,૦૦૦	થંગો	૨,૮૦,૦૦૦	૪,૫૦,૦૦૦
સામાન્ય અનામત	૧૫,૦૦૦	૨૫,૦૦૦	સ્ટોક	૬૦,૦૦૦	૧,૧૦,૦૦૦
ન.નુ. ખાતુ	૮,૦૦૦	૪૦,૦૦૦	દેવાદારો	૨૫,૦૦૦	૮૦,૦૦૦
ડિલેન્ચર્સ	૬૦,૦૦૦	૬૦,૦૦૦	લેણીહંડી	૫,૦૦૦	૭,૫૦૦
તારણવાળી લોન	૧૦,૦૦૦	૧૦,૦૦૦	બેન્ક સિલક	૫૦,૦૦૦	૮૮,૫૦૦
લેણદારો	૧,૪૫,૦૦૦	૧,૭૯,૦૦૦	અગાઉથી ચૂં ખર્ચ	૩૦,૦૦૦	૧૪,૦૦૦
સૂચિત ડિવિડન્ડ	૧૦,૦૦૦	૨૦,૦૦૦	પ્રાથમિક ખર્ચ	૩,૦૦૦	૫,૦૦૦
કરવેશની જોગવાઈ	૪,૦૦૦	૪,૦૦૦			
	૪,૮૩,૦૦૦	૭,૫૫,૦૦૦		૪,૮૩,૦૦૦	૭,૫૫,૦૦૦

	૩૧-૧૨-૦૨ ₹	૩૧-૧૨-૦૩ ₹
વેચાણ (રોકડ ઉધાર રોકડ વેચાણથી ત્રણ ગણું છે	૨,૪૦,૦૦૦	૪,૨૦,૦૦૦
ખરીદી	૧,૭૦,૦૦૦	૩,૧૦,૦૦૦
ખરીદીના ખર્ચ	૧૦,૦૦૦	૨૫,૦૦૦
ઓફિસ ખર્ચ	૪૦,૦૦૦	૪૫,૦૦૦
વેચાણ વિતરણ ખર્ચ	૩૨,૦૦૦	૪૦,૦૦૦

તા. ૩૧-૧૨-૦૧ ના રોજ સ્ટોકની ચોપજે કિંમત રૂ. ૮૦,૦૦૦ હતી. જ્યારે તેની બજારકિંમત રૂ. ૭૦,૦૦૦ હતી.

ઉપરની માહિતીના આધારે નીચેના ગુણોત્તરો શોધો:

- (૧) કાચા નફાનો ગુણોત્તર
- (૨) ચોખખા નફાનો ગુણોત્તર.
- (૩) પ્રવાહી ગુણોત્તર.
- (૪) મૂડી પર વળતરનો ગુણોત્તર
- (૫) સ્ટોક ગુણોત્તર
- (૬) દેવાદાર ગુણોત્તર (વર્ષના ૩૬૦ દિવસો ગણવાના છે.)

(દ. ગુ. યુનિ..., ટી. વાય..., એપ્રિલ, ૧૯૯૯)

જવાબ:

નફા નુકસાનનું પત્રક

	૨૦૦૨	૨૦૦૩
વેચાણા: ઉધાર વેચાણ રોકડ વેચાણ	૧,૮૦,૦૦૦ <u>૫૦,૦૦૦</u>	૩,૧૫,૦૦૦ <u>૧,૦૫,૦૦૦</u>
(A)	૨,૪૦,૦૦૦	૪,૨૦,૦૦૦
વેચાણ પડતર:		
શરૂનો સ્ટોક	૭૦,૦૦૦	૬૦,૦૦૦
+ખરીદી	૧,૭૦,૦૦૦	૩,૧૦,૦૦૦
+ખરીદીના ખર્ચ	<u>૧૦,૦૦૦</u>	<u>૨૫,૦૦૦</u>
-આખરનો સ્ટોક	૨,૫૦,૦૦૦ <u>૬૦,૦૦૦</u>	૪,૨૫,૦૦૦ <u>૧,૧૦,૦૦૦</u>
(B)	૧,૯૦,૦૦૦	૩,૧૫,૦૦૦
કાચો નફો	(A-B)	૮૦,૦૦૦ <u>૪૦,૦૦૦</u>
-વહીવટી ખર્ચ	૪૦,૦૦૦ <u>૪૫,૦૦૦</u>	૫૦,૦૦૦ <u>૪૦,૦૦૦</u>
-વેચાણ વિતરણ ખર્ચ	૩૨,૦૦૦	૪૦,૦૦૦
EBIT	૮૦૦૦	૨૦,૦૦૦

(૧)

$$\text{Gross Profit Ratio} = \frac{\text{કાચો નફો}}{\text{વેચાણ}} \times 100$$

$$2002 = \frac{૮૦,૦૦૦}{૨,૪૦,૦૦૦} \times 100$$

$$= 33\frac{1}{3}\%$$

$$2003 = \frac{૧,૦૫,૦૦૦}{૪,૨૦,૦૦૦} \times 100$$

$$= 25\%$$

(૨)

$$\text{Net Profit Ratio} = \frac{\text{ચોખો નફો}}{\text{વેચાણ}} \times 100$$

$$2002 = \frac{૮,૦૦૦}{૨,૪૦,૦૦૦} \times 100$$

$$= 3 \frac{1}{3} \% \\ 2003 = \frac{20,000}{4,20,000} \times 100 \\ = 4.76\%$$

(3)

$$\text{Liquid Ratio / प्रवाही गुणोत्तर} = \frac{\text{प्रवाही भिलकतो}}{\text{प्रवाही देवा}}$$

$$2002 = \frac{24,000 + 4,000 + 40,000 + 30,000}{1,45,000 + 10,000 + 4,000} \\ = \frac{1,10,000}{1,59,000} \\ = 0.56 : 1 \\ 2003 = \frac{20,000 + 4,500 + 22,500 + 14,000}{1,75,000 + 20,000 + 4,000} \\ = \frac{1,60,000}{2,00,000} \\ = 0.84 : 1$$

(4)

$$\text{Return on Capital Employes} = \frac{\text{EBIT}}{\text{रोकायेती मूडी}} \times 100 \\ /\text{रोकेली मूडी पर वर्णनानुसार :}$$

$$2002 = \frac{4,000}{3,20,000} \times 100 \\ = 2.4\% \\ 2003 = \frac{20,000}{4,50,000} \times 100 \\ = 3.44\%$$

रोकायेती मूडी	=	इकवीटी शेर	+	सामान्य अनाभत	+	नक्षा गुक्सान आतु	+	डिबेन्यर	+	सलाभत लोन	-	प्राथमिक भर्या
2002-03	=	2,00,000 + 14,000 + 4,000 + 60,000 + 10,000 - 3000	=									3,20,000
2003-04	=	4,00,000 + 24,000 + 40,000 + 60,000 + 10,000 - 4000	=									4,50,000

(5)

$$\text{Stock Ratio / स्टेक गुणोत्तर:} = \frac{\text{देशेल मालनी पठतर}}{\text{सरेराशा स्टोक}} \\ 2002 = \frac{1,90,000}{20,000} = 2 \text{ वर्खत}$$

$$2003 = \frac{3,15,000}{1,00,000} = 3.15 \text{ વખત}$$

$$\text{સરેરાશ સ્ટોક} = \frac{\text{શરૂનો સ્ટોક} + \text{આખરનો સ્ટોક}}{2}$$

$$2002 = \frac{50,000 + 60,000}{2} = 50,000$$

$$2003 = \frac{60,000 + 1,10,000}{2} = 85,000$$

(૧૩) જમુના કંપની લિમિટેડનાં બે વર્ષનાં પાકાં સરવૈચા નીચે મુજબ છે:

પાકું સરવૈચા

દેવાં	૩૧-૦૩-૦૪ ₹	૩૧-૦૩-૦૫ ₹	મિલકતો	૩૧-૦૩-૦૪ ₹	૩૧-૦૩-૦૫ ₹
ઇકવીટી શેર મૂડી (દેક રૂ.૧૦૦ના)	૧,૦૦,૦૦૦	૧,૫૦,૦૦૦	જમીન-મકાન	૧,૦૦,૦૦૦	૬૦,૦૦૦
૧૦%ની પ્રેફ. શેરમૂડી	૫૦,૦૦૦	૫૦,૦૦૦	ચંગો	૬૦,૦૦૦	૬૦,૦૦૦
સામાન્ય અનામત	૩૦,૦૦૦	૩૦,૦૦૦	દેવાદારો	૫૩,૦૦૦	૩૦,૦૦૦
ન.નું. ખાતુ	૨૦,૦૦૦	--	લેણીહંડી	૨૦,૦૦૦	૧૨,૦૦૦
૧૨%નો ડિવેન્ચર્સ	૧,૦૦,૦૦૦	૫૦,૦૦૦	સ્ટોક	૭૫,૦૦૦	૬૦,૦૦૦
લેણાદારો	૩૦,૦૦૦	૩૫,૦૦૦	બેન્ક સિલક	૧૫,૦૦૦	૩૪,૦૦૦
ટેનીહંડી	૧૦,૦૦૦	૨૫,૦૦૦	રોકડ સિલક	૨,૦૦૦૦	૧૩,૦૦૦
બેન્ક ઓપરફ્રાન્ડ	૧૦,૦૦૦	૨૦,૦૦૦	ન.નુ.ખાતું	--	૧૦,૦૦૦
ખર્ચ ચૂં બાકી	૫,૦૦૦	૧૦,૦૦૦			
	૩,૫૫,૦૦૦	૩,૯૦,૦૦૦		૩,૫૫,૦૦૦	૩,૭૦,૦૦૦

	૨૦૦૩-૦૪ ₹	૨૦૦૪-૦૫ ₹
૧ વેચાણ	૩,૬૫,૦૦૦	૨,૧૬,૦૦૦
૨ વેચાણ માલની પડતર	૨,૧૬,૦૦૦	૧,૪૬,૦૦૦
૩ તા. ૧-૪-૨૦૦૩નો સ્ટોક	૭૧,૦૦૦	--
૪ ચોખ્ખો નકો (પ્રેફ. ડિવિડ પહેલાંનો)	૩૪,૦૦૦	૪૭,૫૦૦

ઉપરની માહિતીના પરથી નીચેના ગુણોત્તરો ગણો તથા તમારા અભિપ્રાય મુજબ ૨૦૦૨-૦૩ ની સરખામણીમાં કંપનીની સ્થિતિ ૨૦૦૪-૦૫માં સાનુકૂળ થઈ છે કે પ્રતિકૂળ થઈ છે તે જણાવો.

(૧) ચાલુ ગુણોત્તર (૨) પ્રવાહી ગુણોત્તર (૩) દેવાદાર ગુણોત્તર (વર્ષના ૩૫૫ દિવસો લેવા) (૪) કાચા નક્ષાનો ગુણોત્તર (૫) સ્ટોક ફેરબદલી દર (૬) શેરટીંટ કમાએટી

(સૌ. ચુનિ..., ટી. વાય..., એપ્રિલ, ૧૯૯૯)

જવાબ:-

$$\begin{aligned}
 \text{Current Ratio / ચાલુ મિલકતો} &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\
 2003-04 &= \frac{53,000 + 20,000 + 74,000 + 14,000 + 2000}{30,000 + 10,000 + 10,000 + 4,000} \\
 &= \frac{1,54,000}{54,000} \\
 &= \boxed{3:1} \\
 2004-05 &= \frac{30,000 + 12,000 + 60,000 + 34,000 + 13,000}{34,000 + 24,000 + 20,000 + 10,000} \\
 &= \frac{1,20,000}{60,000} \\
 &= \boxed{2 : 1}
 \end{aligned}$$

અભિપ્રાય: ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે સાનુકૂળ સ્થિતિ છે, કારણ કે ચાલુ વર્ષે આ ગુણોત્તર આદર્શ માપ 2:1 જેટલો છે.

(૨)

$$\begin{aligned}
 \text{Liquid Ratio / પ્રવાહી ગુણોત્તર} &= \frac{\text{પ્રવાહી મિલકતો}}{\text{પ્રવાહી દેવા}} \\
 2003-04 &= \frac{1,54,000 - 74,000}{54,000 - 10,000} \\
 &= \frac{60,000}{44,000} \\
 &= \boxed{2:1} \\
 2004-05 &= \frac{1,20,000 - 60,000}{60,000 - 20,000} \\
 &= \frac{60,000}{40,000} \\
 &= \boxed{1.5 : 1}
 \end{aligned}$$

અભિપ્રાય: ચાલુ વર્ષે સાનુળ પરિસ્થિતિ છે

(૩)

$$\begin{aligned}
 \text{Debtors Ratio /} \\
 \text{દેવાદાર ગુણોત્તર :} &= \frac{\text{દેવાદારો} + \text{લેખીહંડી}}{\text{ઉદ્યાર વેચાણ}} \times 354 \\
 2003-04 &= \frac{53,000 + 20,000}{3,54,000} \times 354 \\
 &= \frac{73,000}{3,54,000} \times 354
 \end{aligned}$$

$$\begin{aligned}
 &= 73 \text{ દિવસ} \\
 2003-04 &= \frac{30,000 + 12,000}{2,16,000} \times 354 \\
 &\quad \frac{42,000}{2,16,000} \times 354 \\
 &= 70 \text{ દિવસ}
 \end{aligned}$$

અભિપ્રાયઃ - ચાલુ વર્ષે સાનુકૂળ સ્થિતિ છે.

(૪)

$$\begin{aligned}
 \text{Gross Profit Ratio} &= \frac{\text{કાચો નફો}}{\text{વેચાણા}} \times 100 \\
 / \text{કાચાનફાનો ગુણોત્તર} & \\
 2003-04 &= \frac{1,45,000}{3,54,000} \times 100 \\
 &= 40\% \\
 2004-05 &= \frac{73,000}{2,16,000} \times 100 \\
 &= 33 \frac{1}{3}\%
 \end{aligned}$$

અભિપ્રાયઃ - ગાંધી વર્ષ કરતાં ચાલુ વર્ષ કાચા નફાના દરમાં ઘટાડો થયો હોવાથી પ્રતિકૂળ છે.

(૫)

$$\begin{aligned}
 \text{Stock Turnover Ratio} / &= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 \text{સ્ટોક ગુણોત્તર:} & \\
 2003-04 &= \frac{2,16,000}{73,000} = 3 \text{ વખત} \\
 2004-05 &= \frac{1,45,000}{82,500} = 1.77 \text{ વખત}
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{સરેરાશ સ્ટોક} &= \frac{\text{શરૂનો સ્ટોક} + \text{આખરનો સ્ટોક}}{2} \\
 2003-04 &= \frac{71,000 + 74,000}{2} = 73,000 \\
 2004-05 &= \frac{74,000 + 60,000}{2} = 82,500
 \end{aligned}$$

અભિપ્રાયઃ - ચાલુ વર્ષે પ્રતિકૂળ પરિસ્થિતિ છે.

(૬)

$$\text{શેરદીઠ કમાણી} = \frac{\text{PAT} - \text{પ્રેફ. શેર ડિવિડન્ડ}}{\text{ઈક્વિટી શેરની સંખ્યા}}$$

$$2003-04 = \frac{30,000}{1,000} = 3.30$$

$$2004-05 = \frac{42,400}{1,440} = 3.28.33$$

અભિપ્રાય :- ચાલુ વર્ષે પ્રતિકૂળ છે.

(૧૪) વિરલ લિમિટેડનાં તા. ૩૧-૩-૨૦૦૩ અને ૩૧-૩-૨૦૦૪ના રોજનાં પાકા સરવૈયા નીચે મુજબ છે.

દેવાં	૩૧-૩-૦૩ ₹	૩૧-૩-૦૪ ₹	મિલકતો	૩૧-૩-૦૩ ₹	૩૧-૩-૦૪ ₹
દરેક રૂ. ૧૦૦ નો તેવા ઇક્સિટી શેર	૪,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦	જમીન મકાન	૪,૦૦,૦૦૦	૪,૫૦,૦૦૦
દરેક રૂ. ૧૦૦ નો તેવા ૧૦% ના પ્રેફરન્સ શેર	૨,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	પ્લાન્ટ અને ચેંગ્રો	૩,૦૦,૦૦૦	૨,૫૦,૦૦૦
૧૦%ના ડિલેવ્ચર્યારો	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦	ફર્નિચર	૧,૦૦,૦૦૦	૮૦,૦૦૦
સામાન્ય અનામત	૧,૫૦,૦૦૦	૨,૦૦,૦૦૦	સ્ટોક	૧,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦
ન.ગુ. ખાતું	૫૦,૦૦૦	૧,૦૦,૦૦૦	દેવાદારો	૧,૫૦,૦૦૦	૩,૦૦,૦૦૦
લેણદારો	૭૫,૦૦૦	૧,૨૦,૦૦૦	લેણીહુંડીઓ	૨૦,૦૦૦	૪૦,૦૦૦
દેવી હુંડીઓ	૨૫,૦૦૦	૩૦,૦૦૦	રોકડ અને બેંક	૩૦,૦૦૦	૫૦,૦૦૦
બેંક ઓપરાફાસ્ટ	૧,૦૦,૦૦૦	૧,૫૦,૦૦૦		૧૧,૦૦,૦૦૦	૧૪,૦૦,૦૦૦
	૧૧,૦૦,૦૦૦	૧૪,૦૦,૦૦૦		૩૧-૩-૨૦૦૩	૩૧-૩-૨૦૦૪

વધારાની માહિતી :

	૩૧-૩-૨૦૦૩ ₹	૩૧-૩-૨૦૦૪ ₹
કુલ ખરીદી: (રોકડ ખરીદી ઉધાર ખરીદીનો ૨/૫ ભાગ છે)	૭,૦૦,૦૦૦	૮,૪૦,૦૦૦
ચોખ્ખો નથો: (વ્યાજ અને કટ્ટેરા પછીઓ, કટ્ટેરાનો દર ૫૦% છે.)	૮૫,૦૦૦	૧,૨૧,૫૦૦

ઉપરની માહિતી પરથી નીચેના હિસાબી ગુણોત્તરો જાણતારી કરો અને પ્રથમ બે ગુણોત્તરનું ટૂકમાં અર્થદાટન કરો:

(૧) ચાલુ ગુણોત્તર. (૨) રોકેટી મૂડી પર વળતરનો દર

(ગુ. ચુનિ..., ટી. વાય..., માર્ચ, ૨૦૦૦)

જવાબ:

(૧)

$$\text{Current Ratio / ચાલુ ગુણોત્તર} = \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}}$$

$$2002-03 = \frac{1,00,000 + 1,50,000 + 20,000 + 30,000}{75,000 + 25,000 + 1,00,000}$$

$$= \frac{3,00,000}{2,00,000}$$

$$= ૧.૫ : ૧$$

$$\begin{aligned}
 2003-04 &= \frac{2,00,000 + 3,00,000 + 80,000 + 50,000}{1,20,000 + 30,000 + 1,40,000} \\
 &= \frac{5,00,000}{3,00,000} \\
 &= \boxed{2 : 1}
 \end{aligned}$$

અર્થધટનઃ - ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આ ગુણોત્તર વધુ સંતોષકારક જણાય છે. દંધાની પ્રવાહી પરિસ્થિતિ જાણવા માટે ઉપયોગી છે.

(૨)

$$\begin{aligned}
 \text{Return on Capital Employes} &= \frac{\text{EBIT}}{\text{રોકાયેલી મૂડી}} \times 100 \\
 / \text{રોકાયેલી મૂડી પર વળતરનો દર} : & \\
 2002-03 &= \frac{1,20,000}{6,00,000} \times 100 \\
 &= 20 \% \\
 2003-04 &= \frac{2,43,000}{11,00,000} \times 100 \\
 &= 23 \%
 \end{aligned}$$

$$\text{EBIT} = \text{PAT} + \text{વ્યાજ} + \text{યેચા}$$

$$2002-03 = 14,000 + 10,000 + 14,000 = 1,20,000$$

$$2003-04 = 21,400 + 10,000 + 21,400 = 2,43,000$$

$$\text{રોકાયેલી મૂડી} = ઈકવીટી શેર + પ્રે. શેર + ડિબેન્ચર + સામાન્ય અનામત + નફા નુકસાન ખાતુ$$

$$2002-2003 = 4,00,000 + 2,00,000 + 1,00,000 + 1,40,000 + 40,000 = 6,00,000$$

$$2003-2004 = 5,00,000 + 2,00,000 + 1,00,000 + 2,00,000 + 1,00,000 = 11,00,000$$

(૧૫) એચ. આર. લિ. ના ૨૦૦૦ અને ૨૦૦૧ ના વર્ષના સંક્ષિપ્ત વાર્ષિક હિસાબો નીચે મુજબ છે.

આવકના પત્રકો

વિગત	વર્ષ ૨૦૦૦ (₹)		વર્ષ ૨૦૦૧ (₹)	
રોકાયેલી વેચાણ	30,000		32,000	
ઉધાર વેચાણ	<u>2,70,000</u>	3,00,000	<u>3,42,000</u>	3,74,000
<u>બાદ:</u>				
વેચેલ ભાલની પડતર		<u>2,35,000</u>		<u>2,62,000</u>
કાચો નફો		54,000		75,000
<u>બાદ: ખર્ચ:</u>				
ગોદામના ખર્ચ	13,000		14,000	
ટ્રોન્સપોર્ટ (હેર્ફેર ખર્ચ)	5,000		10,000	
વહીવટી	16,000		16,000	
વેચાણ	11,000		14,000	
ડિબેન્ચરનું વ્યાજ	--	46,000	<u>2,000</u>	46,000
ચોખ્ખો નફો		14,000		17,000

પાકું સરવૈયું

વિગત	વર્ષ ૨૦૦૦ (₹)	વર્ષ ૨૦૦૧ (₹)
કાચમી મિલકતો (ચોખી કિંમતે)		૩૦,૦૦૦
દેવાદારો	૫૦,૦૦૦	૮૨,૦૦૦
બેળકમાં રોકડ	૧૦,૦૦૦	૭,૦૦૦
સ્ટોક	<u>૬૦,૦૦૦</u>	<u>૮૪,૦૦૦</u>
લેણદારો:	૧,૨૦,૦૦૦	૧,૮૩,૦૦૦
કાર્યશીલ મૂડી	<u>૫૦,૦૦૦</u>	<u>૭૬,૦૦૦</u>
કુલ મિલકતો		૭૦,૦૦૦
શેર મૂડી		૭૫,૦૦૦
અનામત અને વધારો		૨૫,૦૦૦
ડિલેન્ચર્સ	--	૩૦,૦૦૦
	૧,૦૦,૦૦૦	૧,૪૭,૦૦૦

તમને જળાવવામાં આવે છે કે:

- (અ) ખરીદ કિમત આ સમયગાળા દરમિયાન એકસરખી રહી છે.
- (બ) તા. ૧-૧-૨૦૦૦ના રોજ સ્ટોક ૩.૪૦,૦૦૦
- (ક) તા. ૧-૧-૨૦૦૧ ના રોડ ડિલેન્ચર્સ બહાર પાડવામાં આવ્યાં હતાં અને તે જ દિવસે કાચમી મિલકતો ખરીદવામાં આવી હતી.

તમારે વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૧ માટે નીચેના ગુણોત્તર ગણાવાના છે.

- (૧) કાચા નફાનો ગુણોત્તર (૨) સંચાલન ગુણોત્તર (૩) ચોખા નફાનો ગુણોત્તર (૪) સ્ટોક ચલનદર
- (૫) દેવાદારોનો ગુણોત્તર

રોકાયેલ મૂડી અંગેના ગુણોત્તરો માટે વર્ષના અંતની મૂડીને ધ્યાનમાં રાખવાની છે. બે વર્ષના ગુણોત્તરમા આવેલા ફેરફારો માટે કારણો આપો. કરવેરા અવગાણો.

(ગુ. ચુ. ટી. વાય..., એપ્રિલ .., ૨૦૦૨)

જવાબ:

(૧)

$$\begin{aligned}
 \text{Gross Profit Ratio} &= \frac{\text{કાચો નફો}}{\text{વેચાણ}} \times 100 \\
 / \text{કાચાનફાનો ગુણોત્તર} &= \frac{૫૪,૦૦૦}{૩,૦૦,૦૦૦} \times 100 \\
 ૨૦૦૦ &= ૧૮\% \\
 &= ૧૧.૩૩\%
 \end{aligned}$$

$$\begin{aligned}
 ૨૦૦૧ &= \frac{૭૬,૦૦૦}{૩,૭૪,૦૦૦} \times 100 \\
 &= ૨૦.૩૨\%
 \end{aligned}$$

ફેસ્કારનું કારણ:- ૨૦૦૦ના વર્ષની સરખામણીમાં ૨૦૦૧માં વેચાણના પ્રમાણમાં વેચેલ માલની પડતર વધી છે. તેથી કાચા નફાનાં દરમાં ઘટાડો થયો છે.

(૨)

$$\text{Operating Ratio / સંચાલન ગુણોત્તર} = \frac{\text{વેચેલ માલની પડતર} + \text{સંચાલનના ખર્ચ}}{\text{વેચાણ}} \times 100$$

$$2000 = \frac{2,35,000 + 46,000}{3,00,000} \times 100$$

$$= \frac{2,81,000}{3,00,000} \times 100$$

$$= 67\%$$

$$2001 = \frac{2,64,000 + 46,000}{3,74,000} \times 100$$

$$= \frac{3,10,000}{3,74,000} \times 100$$

$$= 64.45\%$$

ફેસ્કારનું કારણ:- ૨૦૦૦ ની સરખામણીમાં ૨૦૦૧ માં વેચાણના પ્રમાણમાં કુલ સંચાલન ખર્ચ વધ્યા છે. તેથી ગુણોત્તર વધ્યો છે.

(૩)

$$\text{Net Profit Ratio} / \text{ચોખ્ખોનાનો ગુણોત્તર} = \frac{\text{ચોખ્ખો નફો}}{\text{વેચાણ}} \times 100$$

$$2000 = \frac{15,000}{3,00,000} \times 100$$

$$= 5\%$$

$$2001 = \frac{17,000}{3,74,000} \times 100$$

$$= 4.54\%$$

ફેસ્કારનું કારણ:- વેચાણના પ્રમાણનાં ધ૰્યાના કુલ ખર્ચ વધ્યા હોવાથી નફાનો ગુણોત્તર નીચે આવ્યો છે.

(૪)

$$\text{Stock Turnover Ratio / સ્ટોક ચલનદર} = \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$2000 = \frac{2,35,000}{40,000 + 50,000}$$

$$= \frac{2,35,000}{90,000} = 2.61 \text{ વખત}$$

$$\begin{aligned}
 2001 &= \frac{2,62,000}{50,000+18,000} \\
 &= \frac{2,62,000}{68,000} = 3.87 \text{ વખત}
 \end{aligned}$$

ફેફારનું કારણ:- ચાલુ પર્બે સરેરાશ સ્ટોક વધ્યો હોવાથી ગુણોત્તર ઘટ્યો છે.

(૫)

$$\begin{aligned}
 \text{Debtors Collection} &= \frac{\text{દેવાદારો} + \text{લેણીહંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 360 \\
 \text{Ratio / દેવાદાર ગુણોત્તર :} & \\
 2000 &= \frac{50,000}{2,70,000} \times 360 \\
 &= 57 \text{ દિવસ} \\
 2001 &= \frac{22,000}{3,42,000} \times 360 \\
 &= 25.32 \text{ દિવસ}
 \end{aligned}$$

ફેફારનું કારણ:- દેવાદાર ગુણોત્તર વધ્યો છે, કારણ કે વેચાણમાં વધારો કરવા શાખની મુદ્દત વધારવામાં આવી છે.

(૧૬) રાજ એન્ટરપ્રાઇઝ લિ. નાં સરવૈચા નીચે મુજબ છે:

દેવાં	૧૯૯૯-૦૦	૨૦૦૦-૦૧	મિલકતો	૧૯૯૯-૦૦	૨૦૦૦-૦૧
ઇકલીટી શેર મૂડી	૪૦,૦૦૦	૫૦,૦૦૦	મકાન	૩૦,૦૦૦	૫૦,૦૦૦
૧૦%ની પ્રેફ. શેરમૂડી	૨૦,૦૦૦	૨૦,૦૦૦	ફર્નિચર	૧૦,૦૦૦	૧૦,૦૦૦
સામાન્ય અનામત	૧૭,૨૦૦	૧૮,૨૦૦	ચંત્રો	૨૦,૦૦૦	૧૦,૦૦૦
૧૫%ના ડિલેન્ચરો	૨૦,૦૦૦	૨૦,૦૦૦	સ્ટોક	૧૦,૦૦૦	૧૫,૦૦૦
લેણાદારો	૧,૬૦૦	૨,૦૦૦	દેવાદારો	૩૦,૦૦૦	૨૫,૦૦૦
દેવીહંડીઓ	૮૦૦	૧,૨૦૦	લેણીહંડી	૨,૦૦૦	૩,૦૦૦
કારીગર નશા ભંડોળ	૨,૦૦૦	૧,૦૦૦	રોકડ	૪,૦૦૦	૫,૦૦૦
પ્રોવિન્ટ ફંડ	૧,૫૦૦	૮૦૦	પ્રાથમિક ખર્ચ	૨૦૦	૨૦૦
બેન્ક ઓવરફ્રાફ્ટ	૪,૦૦૦	૫,૦૦૦			
	૧,૦૬,૨૦૦	૧,૧૮,૨૦૦		૧,૦૬,૨૦૦	૧,૧૮,૨૦૦

અન્ય માહિતી:

	૧૯૯૯-૦૦	૨૦૦૦-૦૧
કુલ વેચાણ (રોકડ વેચાણ ઉધાર વેચાણનો ૩/૫ ભાગ જેટલું છે)	૧,૦૦,૦૦૦	૧,૨૫,૦૦૦
કાચો નશો	૨૦,૦૦૦	૩૦,૦૦૦
ચોખ્ખો નશો (વ્યાજ અને કરવેરા પહેલાંનો) (કરવેરાનો દર ૫૦% છે.)	૧૫,૦૦૦	૧૦,૦૦૦

ઉપરની વિગતો ઉપરથી બંને વર્ષનાં નીચેના ગુણોત્તરો શોધો. (વર્ષના ૩૫૦ દિવસ ગાળવા.)

(૧) ચાલુ ગુણોત્તર (૨) દેવાદાર ગુણોત્તર (૩) શેરહોલ્ડરો ભંડોળ પર વળતર (૪) ખર્ચ ગુણોત્તર (૫) સ્ટોક ઉઠાનાનો દર (૬) ચોખા નફાનો ગુણોત્તર

(ગુ. ચુનિ. ટી. વાય.,, એપ્રિલ.,, ૨૦૦૩)

જવાબ:

(૧)

$$\text{Current Ratio / ચાલુ ગુણોત્તર} = \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}}$$

$$1999-2000 = \frac{10,000 + 30,000 + 2000 + 8000}{1,500 + 200 + 2,000 + 1,500 + 8,000}$$

$$= \frac{49,000}{10,000}$$

$$= 4.9 : 1$$

$$2000-2001 = \frac{14,000 + 24,000 + 3,000 + 4,000}{2,000 + 1,200 + 1,000 + 200 + 4,000}$$

$$= \frac{45,200}{10,000}$$

$$= 4.5 : 1$$

(૨)

$$\text{Debtors Ratio / દેવાદાર ગુણોત્તર : } = \frac{\text{દેવાદારો} + \text{લેણીહંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 350$$

$$1999-2000 = \frac{30,000 + 2,000}{52,500} \times 350$$

$$= \frac{32,000}{52,500} \times 350$$

$$= 184 \text{ દિવસ}$$

$$2000-2001 = \frac{24,000 + 3,000}{78,125} \times 350$$

$$= \frac{27,000}{78,125} \times 350$$

$$= 126 \text{ દિવસ}$$

ઉધાર વેચાણ:

$$1999-2000 = 1,00,000 \times \frac{100}{150} = 52,500$$

$$2000-2001 = 1,25,000 \times \frac{100}{150} = 78,125$$

(3)

$$\text{Return on Shareholders Funds} = \frac{\text{PAT}}{\text{શેર હોલ્ડરનાં ભંડોળ}} \times 100$$

/શેરહોલ્ડરના ભંડોળ પર વળતરનો દર :

$$1999-2000 = \frac{5,000}{75,000} \times 100 \\ = 7.86\%$$

$$2000-2001 = \frac{3,400}{88,000} \times 100 \\ = 3.62\%$$

$$\text{PAT} = \text{EBIT} - \text{વ્યાજ} = \text{EBIT} - \text{વેરા}$$

$$1999-2000 = 14,000 - 3,000 = 12,000 - 5,000 = 5,000$$

$$2000-2001 = 10,000 - 3,000 = 7000 - 3,400 = 3,400$$

$$\text{શેર હોલ્ડરના ભંડોળ} = \text{ઇક્વિટી શેર} + \text{પ્રેફરન્સ શેર} + \text{સામાન્ય અનામત} - \text{પ્રાથમિક ખર્ચ}$$

$$1999-2000 = 40,000 + 20,000 + 15,200 - 200 = 75,000$$

$$2000-2001 = 50,000 + 20,000 + 18,200 - 200 = 88,000$$

(4)

$$\text{Expences Ratio / ખર્ચ ગુણોત્તર} = \frac{\text{ખર્ચ}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{\text{કાચો નફો} - \text{EBIT}}{\text{વેચાણ}} \times 100$$

$$1999-2000 = \frac{20,000 - 14,000}{1,00,000} \times 100 \\ = \frac{4,000}{1,00,000} \times 100 \\ = 4\%$$

$$2000-2001 = \frac{30,000 - 10,000}{1,25,000} \times 100 \\ = \frac{20,000}{1,25,000} \times 100 \\ = 16\%$$

(5)

$$\text{Stock Ratio / સ્ટોક ગુણોત્તર} = \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$1999-2000 = \frac{1,00,000 - 20,000}{10,000}$$

$$\begin{aligned}
 &= \frac{\text{₹}0,000}{\text{₹}10,000} = 0 \text{ વખત} \\
 2000-2001 &= \frac{\text{₹}1,24,000 - \text{₹}30,000}{\text{₹}10,000 + \text{₹}14,000} \\
 &= \frac{\text{₹}84,000 \times 2}{\text{₹}24,000} = 7.5 \text{ વખત}
 \end{aligned}$$

(૬)

$$\begin{aligned}
 \text{Net Profit Ratio} &= \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100 \\
 / \text{ચોખાનફા ગુણોત્તર} & \\
 1999-2000 &= \frac{\text{₹}5,000}{\text{₹}1,00,000} \times 100 \\
 &= 5\% \\
 2000-2001 &= \frac{\text{₹}3,400}{\text{₹}1,24,000} \times 100 \\
 &= 2.7\%
 \end{aligned}$$

(૧૭) નીચેની માહિતી એક ઉદ્યોગની બે કંપનીઓના નાણાકીય રેકોર્ડ પરથી લેવામાં આવી છે.

વિગત	રામ સિ. ₹	શ્વામ સિ. ₹
કુલ વેચાણ (જે પૈકી 20 % રોકડ વેચાણ છે)	₹6,00,000	₹6,75,000
વેચેલ ભાલની પડતર	₹5,00,000	₹5,11,000
સંચાલન ખર્ચ	₹4,000	₹1,240
ડિબેન્ચર વ્યાજ	₹4,000	₹6,000
આવકવેરો	50%	50%
ઇક્સિટી શેરમૂડી	₹4,40,000	₹5,20,000
10% પ્રેફ. શેરમૂડી	₹1,40,000	₹1,30,000
શાખી મૂકુલ કમાણી	₹60,000	₹1,04,000
નફા નુકસાન ખાતે	₹50,000	₹54,000
15% ના ડિબેન્ચર	₹3,00,000	₹2,50,000
લેણાદારો	₹1,20,000	₹61,000
દેવીહંડી	₹30,000	₹36,000
બેન્ક ઓપર ફ્રાફ્ટ	₹4,000	₹1,400
સ્થિર ભિલકતો	₹4,24,000	₹4,19,000
સ્ટોક	₹2,24,000	₹2,50,000
દેવાદારો	₹1,54,000	₹1,52,000
લેણીહંડી	₹14,000	₹16,400
રોકડ અને બેન્ક સિલક	₹45,000	₹2,000

ઉપરની માહિતી પરથી બંને કંપની માટે નીચેના ગુણોત્તરો ગણો અને દરેક વિશે ટૂંકમાં તમારો અભિપ્રાય આપો.
 (૧) ચોખખા નફાનો ગુણોત્તર (૨) પ્રવાહી ગુણોત્તર (૩) દેવાદારનો ગુણોત્તર (વર્ષના ૩૫૦ દિવસ ગણવાના
 છે) (૪) દેવાં ઈક્વિટી ગુણોત્તર

(ગુ., યુનિ., ટી. વાય.,, માર્ચ., ૧૯૯૬)

જવાબ:

નફા નુકસાનનું પત્રક

વિગત	રામ ₹	શ્યામ ₹
<u>વેચાણાઃ</u>		
રોકડ વેચાણ રૂ ૨૦%	૧,૮૦,૦૦૦	૧,૬૫,૦૦૦
ઉધાર વેચાણ રૂ ૮૦%	<u>૭,૨૦,૦૦૦</u>	<u>૭,૮૦,૦૦૦</u>
	૬,૦૦,૦૦૦	૬,૭૫,૦૦૦
-વેચાણ પડતર	<u>૬,૦૦,૦૦૦</u>	<u>૬,૧૧,૦૦૦</u>
કાચો નફો	૩,૦૦,૦૦૦	૩,૬૪,૦૦૦
-સંચાલન ખર્ચ	<u>૭૫,૦૦૦</u>	<u>૮૧,૨૫૦</u>
EBIT	૨,૨૫,૦૦૦	૨,૮૨,૭૫૦
-ડિબેન્ચર વ્યાજ	<u>૪૫,૦૦૦</u>	<u>૩૬,૦૦૦</u>
EBI	૧,૮૦,૦૦૦	૨,૪૩,૭૫૦
-વેરા ૫૦%	<u>૬૦,૦૦૦</u>	<u>૧,૨૧,૮૭૫</u>
PAT	૬૦,૦૦૦	૧,૨૧,૮૭૫

(૧)

$$\begin{aligned}
 \text{Net Profit Ratio} &= \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100 \\
 /ચોખખાનફા ગુણોત્તર &= \frac{૬૦,૦૦૦}{૬,૦૦,૦૦૦} \times 100 \\
 \text{રામ} &= ૧૦\% \\
 \text{શ્યામ} &= \frac{૧,૨૧,૮૭૫}{૬,૭૫,૦૦૦} \times 100 \\
 &= ૧૨.૫\%
 \end{aligned}$$

અભિપ્રાય:- વેચાણના પ્રમાણમાં ધંધાની નફાકારકતાનો ખ્યાલ આપે છે. શ્યામ લિ. માં નફાકારકતાનો દર ઊંચો છે.

(૨)

$$\begin{aligned}
 \text{Liquid Ratio /} &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\
 \text{પ્રવાહી ગુણોત્તર} &= \frac{1,55,000 + 14,000 + 45,000}{1,20,000 + 30,000} \\
 \text{રામ} &= \frac{2,24,000}{1,40,000} \\
 &= 1.4 : 1 \\
 \text{શયામ} &= \frac{1,52,400 + 16,400 + 42,000}{1,00,000 + 36,000} \\
 &= \frac{2,38,000}{1,36,000} \\
 &= 1.7 : 1
 \end{aligned}$$

અભિપ્રાય:- ધેંધાની પ્રવાહીતાનો ખ્યાલ આપે છે. બંને કંપનીના ગુણોત્તરો સંતોષકારક છે. આર્દ્ધ ગુણોત્તર ૧:૧ છે. ભાટે વધારાની પ્રવાહી મિલકતોનું નફાકારક જામીનગીરીમાં રોકાણ કરવું જોઈએ.

(૩)

$$\begin{aligned}
 \text{Debtors Ratio /} &= \frac{\text{દેવાદારો} + \text{લોએરીંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 360 \\
 \text{દેવાદાર ગુણોત્તર :} &= \frac{1,55,000 + 14,000}{1,20,000} \times 360 \\
 \text{રામ} &= \frac{1,80,000}{1,20,000} \times 360 \\
 &= 60 દિવસ \\
 \text{શયામ} &= \frac{1,52,400 + 16,400}{1,00,000} \times 360 \\
 &= \frac{1,72,000}{1,00,000} \times 360 \\
 &= 24 દિવસ
 \end{aligned}$$

અભિપ્રાય:- ઉધારવેચાણની ઉધરાણી કેટલા દિવસે મળે છે તેનું સૂચન કરે છે. જો કે બંને કંપનીના ગુણોત્તરો સંતોષકારક જાણાય છે.

(૪)

$$\begin{aligned}
 \text{Debt Equity Ratio /} &= \frac{\text{લાંબા ગાળાના દેવા}}{\text{માલિકીના ભંડેળ}} \times 100 \\
 \text{દેવા ઈન્ડિયસ્ટી ગુણોત્તર :} &= \frac{3,00,000}{4,50,000 + 1,40,000 + 60,000 + 50,000} \times 100
 \end{aligned}$$

$$= \frac{3,00,000}{5,40,000} \times 100 \\ = 55\%$$

$$\text{શ્વામ} = \frac{2,50,000}{5,20,000+1,30,000+1,04,000+54,000} \times 100 \\ = \frac{2,50,000}{8,14,000} \times 100 \\ = 31.75\%$$

અભિપ્રાય:- માલિકીનાં ભંડોળોના પ્રમાણમાં લાંબાગાળાનું દેવું કેટલું છે તે જાણવા ઉપયોગી છે. સંતોષકારક છે.

(૧૮) નીચેની માહિતી બે કંપનીઓના નાણાકીય હિસાબો પરથી લેવામાં આવી છે:

વિગત	પ્રિયા લિ. ₹	રીયા લિ. ₹
કાચો નફો	1,62,000	2,24,000
વેચેલ માલની પડતર	4,42,000	4,16,000
ચોખો નફો (કરવેરા પહેલાંનો)	54,000	1,02,400
ઇક્સિટી શેરમૂડી	2,00,000	1,50,000
અનામતો	50,400	1,28,200
પરચૂણા લેણાદારો	50,000	80,000
બોન્ક ઓવર ફ્રાફ્ટ	27,000	50,000
જમીન-મકાન	1,40,000	1,40,000
પ્લાન્ટ-યંત્રો	1,70,000	1,50,000
સ્ટોક (હેવટનો)	50,400	1,20,400
અગાઉથી ચૂકવેલ વીમો	400	500
પરચૂણા દેવાદારો	80,000	72,000
રોકડ	34,000	17,000
પ્રાથમિક ખર્ચ	400	2,200
10% ના ડિઝેન્યર્સ	1,50,000	1,32,000

કરવેરાનો દર 50% છે. પ્રિયા લિ. 25% વેચાણ રોકડથી કરે છે. જ્યારે રીય લિ. નું 50% વેચાણ ઉધાર છે.

ઉપરની માહિતી પરથી બંને કંપનીઓ માટે નીચેના હિસાબી ગુણોત્તરની ગણતરી કરો:

(૧) ચાલુ ગુણોત્તર (૨) સંચાલન ગુણોત્તર (૩) કુલ રોકડયેલી મૂડી પર વળતર (૪) દેવાદાર ગુણોત્તર (વર્ષના દિવસો 365) (૫) શેરહોલ્ડરોનાં ભંડોળ પર વળતરનો દર

(દ. ગુ. ચુનિ., ટી. વાય., એપ્રિલ., ૨૦૦૩)

જવાબ:

(૧)

$$\text{Current Ratio /ચાલુ ગુણોત્તર} = \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\ = \frac{\text{સ્ટોક} + \text{અગાઉથી ચૂ. વીમા} + \text{દેવાદારો} + \text{રોકડ}}{}$$

$$\begin{aligned}
 & \text{लेणदारो + बेनक ओवर फ्राईट} \\
 \text{प्रिया} & = \frac{50,500 + 500 + 70,000 + 34,000}{50,000 + 28,000} \\
 & = \frac{1,75,000}{78,000} \\
 & = \boxed{2 : 1} \\
 \text{रीया} & = \frac{1,20,400 + 500 + 72,000 + 17,000}{70,000 + 50,000} \\
 & = \frac{2,10,000}{1,40,000} \\
 & = \boxed{1.5 : 1}
 \end{aligned}$$

(2) संचालन गुणोत्तर

$$\begin{aligned}
 \text{Operating Ratio} & = \frac{\text{वेचेल भालनी पडतर} + \text{संचालनना खर्च}}{\text{वेचाणा}} \times 100 \\
 / \text{संचालन गुणोत्तर} & \\
 \text{प्रिया} & = \frac{4,48,000 + 1,28,000}{5,40,000} \times 100 \\
 & = 60 \% \\
 \text{रीया} & = \frac{4,16,000 + 1,21,500}{5,40,000} \times 100 \\
 & = 84 \%
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{संचालनना खर्च} & = \text{काचो नझे} - \text{EBIT} \\
 \text{प्रिया} & = 1,62,000 - 50,000 = 1,22,000 \\
 \text{रीया} & = 2,24,000 - 1,02,400 = 1,21,500
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{वेचाणा} & = \text{वेचेल भालनी पडतर} + \text{काचो नझे} \\
 \text{प्रिया} & = 4,48,000 + 1,62,000 = 5,40,000 \\
 \text{रीया} & = 4,16,000 + 2,24,000 = 5,40,000
 \end{aligned}$$

(3)

$$\begin{aligned}
 \text{Return on Capital Employes} & = \frac{\text{EBIT}}{\text{रोकाचेली भूऱी}} \times 100 \\
 / \text{रोकेली भूऱी पर वणतरनो दर} : & \\
 \text{प्रिया} & = \frac{50,000}{4,40,000} \times 100 \\
 & = 11.41 \% \\
 \text{रीया} & = \frac{1,15,500}{4,16,000} \times 100 \\
 & = 27.55 \%
 \end{aligned}$$

$$\begin{aligned} \text{EBIT} &= \text{EBT} + \text{व्याज} \\ \text{प्रिया} &= ₹8,000 + ₹6,000 = ₹14,000 \\ \text{रीया} &= ₹1,02,400 + ₹13,200 = ₹115,600 \end{aligned}$$

$$\begin{aligned} \text{रोकायेली भूमि} &= इक्विटी शेर + अनामत + डिबेन्चर - \text{प्राथमिक खर्च} \\ \text{प्रिया} &= ₹2,00,000 + ₹50,800 + ₹1,50,000 - ₹200 = ₹4,10,000 \\ \text{रीया} &= ₹1,50,000 + ₹1,28,200 + ₹13,200 - ₹200 = ₹4,18,000 \end{aligned}$$

(४) देवाधार गुणोत्तर (वर्षना दिवसो ३५०)

$$\begin{aligned} \text{Debtors Ratio /} &= \frac{\text{देवाधारो} + \text{लेणीहंडी}}{\text{उधार येचाणा}} \times 350 \\ \text{देवाधार गुणोत्तर :} & \\ \text{प्रिया} &= \frac{₹2,000}{₹4,10,000} \times 350 \\ &= 50 \text{ दिवस} \\ \text{रीया} &= \frac{₹2,000}{₹4,18,000} \times 350 \\ &= 50.4 \text{ दिवस} \end{aligned}$$

(५) शेरहोल्डर्स भंडोળ पर वर्णनानुसारे

$$\begin{aligned} \text{Return on Shareholders Funds} &= \frac{\text{PAT}}{\text{शेर होल्डर्स भंडोળ}} \times 100 \\ /\text{शेरहोल्डर्स भंडोળ पर वर्णनानुसारे :} & \\ \text{प्रिया} &= \frac{₹4,000 - ₹2,000}{₹2,00,000 + ₹50,000 - ₹200} \times 100 \\ &= \frac{32,000}{2,50,000} \times 100 \\ &= 12.8 \% \\ \text{रीया} &= \frac{₹1,02,400 - ₹1,200}{₹1,00,000 + ₹1,28,200 - ₹2,200} \times 100 \\ &= \frac{5,12,000}{2,79,000} \times 100 \\ &= 17.6 \% \end{aligned}$$

(६) राही लि. नां ता. ३१-३-२००३ ना नाणाकीय परिस्थिति दर्शावता पत्रको उपरथी नीचे जणावेसा गुणोत्तरानी गणातरी करो अने तेनी टूकमां समजूती आपो.

राही लिमिटेडनुं ता. ३१-३-२००३ ना रोजनुं पाँकुं सरवैयुं

जवाबदारी	₹	मिलकता	₹
शेरभूमि: इक्विटी शेर ₹30,000 शेर ₹3,100 नो तेवा पूरा भरपाई	30,00,000	स्थिर मिलकता	₹50,00,000

૧૦%ના ૨૦,૦૦૦ પ્રે. શેર દરેક રૂ.૧૦૦		આખર સ્ટોક	૫,૦૦,૦૦૦
ના પૂરા ભરપાઈ	૨૦,૦૦,૦૦૦	દેવાદારો	૮,૦૦,૦૦૦
સામાન્ય અનામત	૧૦,૦૦,૦૦૦	લોએરીહંડીઓ	૫૦,૦૦૦
નફા-નુકસાન ખાતુ	૫,૦૦,૦૦૦	રોકડ અને બેન્ક સિલક	૨,૮૦,૦૦૦
૧૦% ના ડિબેન્ચરો	૫,૦૦,૦૦૦	અવાસ્તવિક મિલકતો	૭૦,૦૦૦
બેન્ક ઓવરફ્રોફ્ટ	૮૦,૦૦૦		
લેણાદારો	૪,૨૦,૦૦૦		
અન્ય જવાબદારીઓ	૧,૦૦,૦૦૦		
	૭૭,૦૦,૦૦૦		૭૭,૦૦,૦૦૦

વધારાની માહિતી:

વેચાણ રૂ.૫૦,૦૦,૦૦૦, ખરીદી રૂ. ૩૫,૦૦,૦૦૦, સરેરાશ સ્ટોક રૂ.૩,૨૦,૦૦૦, વેચાણ વહીવઠી અને નાણાંકીય ખર્ચ રૂ. ૫,૦૦,૦૦૦, કરયેરાનો દર ૫૦% ગણો. વર્ષના ૩૬૦ દિવસ ગણવા.

- (૧) કાચા નફાનો ગુણોત્તર
- (૨) ચાલુ ગુણોત્તર
- (૩) દેવાદાર ગુણોત્તર
- (૪) સ્ટોક -ફેરબદલી દર
- (૫) સંચાલન ગુણોત્તર
- (૬) ચોખા નફાનો ગુણોત્તર

(ગુ. ચુણિ., વી. વાચ.,, એપ્રિલ.,, ૨૦૦૪)

જવાબ:

નફા નુકસાનનું પત્રક

વિગત	₹	₹
વેચાણ		૫,૦૦,૦૦૦
- વેચેલ માલની પડતર		
શરૂનો સ્ટોક (સરેરાશ સ્ટોક * ૨- આખર સ્ટોક)	૧,૪૦,૦૦૦	
(૩,૨૦,૦૦૦ X ૨ = ૬,૪૦,૦૦૦-૫,૦૦,૦૦૦		
+ ખરીદી	૩૫,૦૦,૦૦૦	
	૩૬,૪૦,૦૦૦	
- આખર માલ સ્ટોક	૫,૦૦,૦૦૦	૩૧,૪૦,૦૦૦
કાચો નફો		૨૮,૫૦,૦૦૦
- વહીવઠી અને નાણાંકીય ખર્ચ		૫,૦૦,૦૦૦
EBT		૨૩,૫૦,૦૦૦
-વેરા ૫૦%		૧૧,૩૦,૦૦૦
PAT		૧૧,૩૦,૦૦૦

(૧) કાચો નફોનો ગુણોત્તર:

$$\begin{aligned} \text{Gross Profit Ratio} &= \frac{\text{કાચો નફો}}{\text{વેચાણ}} \times 100 \\ / \text{કાચાનફોનો ગુણોત્તર} &= \frac{૨૮,૬૦,૦૦૦}{૫૦,૦૦,૦૦૦} \times 100 \\ &= ૪૭.૨૭\% \end{aligned}$$

(૨)

$$\begin{aligned} \text{Net Profit Ratio} &= \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100 \\ / \text{ચોખાનફો ગુણોત્તર} &= \frac{૧૧,૩૦,૦૦૦}{૫૦,૦૦,૦૦૦} \times 100 \\ &= ૨૨.૬૩\% \end{aligned}$$

(૩)

$$\begin{aligned} \text{Current Ratio / ચાલુ ગુણોત્તર} &= \frac{\text{ચાલુ ભિલકતો}}{\text{ચાલુ દેવા}} \\ ૨૦૦૬-૦૭ &= \frac{૫,૦૦,૦૦૦+૮,૦૦,૦૦૦+૫૦,૦૦+૨,૮૦,૦૦૦}{૮૦,૦૦૦+૪૨,૦૦૦+૧,૦૦,૦૦૦} \\ &= \frac{૧૬,૩૦,૦૦૦}{૯,૦૦,૦૦૦} \\ &= \boxed{૧.૮૨ : ૧} \end{aligned}$$

(૪)

$$\begin{aligned} \text{Debtors Ratio /} &= \frac{\text{દેવાદારો + લેણીહંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 350 \\ \text{દેવાદાર ગુણોત્તર :} &= \frac{૮૦,૦૦,૦૦૦+૫૦,૦૦૦}{૫૦,૦૦,૦૦૦} \times 350 \\ &= \frac{૧૩૦,૦૦૦}{૫૦,૦૦,૦૦૦} \times 350 \\ &= ૨૬ દિવસ \end{aligned}$$

(૫)

$$\begin{aligned} \text{Stock Turnover Ratio /} &= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\ \text{સ્ટોક ગુણોત્તર:} &= \frac{૩,૧૪,૦૦૦}{૩,૨૦,૦૦૦} = ૬.૮૧ \text{ વખત} \end{aligned}$$

(૯)

$$\begin{aligned}
 \text{Operating Ratio} &= \frac{\text{વેચેલ માલની પડતર} + \text{સંચાલનના ખર્ચ}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{31,40,000 + 5,00,000}{50,00,000} \times 100 \\
 &= \frac{3,74,000}{50,00,000} \times 100 \\
 &= 74.33\%
 \end{aligned}$$

(૨૦) કાનું લિ. ના તા. ૩૧-૧૨-૦૨ અને ૩૧-૧૨-૦૩ ના રોજ પાકા સરવૈયા તથા સંબંધિત વર્ષના વેપાર અને ન.નુ. ખાતાની વિગતો આપેલી છે. તેના પરથી નીચેના ગુણોત્તરો (બંને વર્ષ માટે) ગણિતે તેના વિશે તમારો અભિપ્રાય આપો:

- (૧) ચાલુ ગુણોત્તરો
- (૨) સ્ટોક ગુણોત્તરો
- (૩) કાચા નફાનો ગુણોત્તરો
- (૪) પ્રવાહી ગુણોત્તરો
- (૫) દેવાદાર ગુણોત્તરો (વર્ષના દિવસો ૩૦૦ ગણાવા)
- (૬) રોકાયેલી મૂડી પર વળતરનો દર

પાકાં સરવૈયાં

દિવાં	૨૦૦૨	૨૦૦૩	મિલકતો	૨૦૦૨	૨૦૦૩
ઈ. શેરમૂડી	૧,૦૦,૦૦૦	૧,૨૫,૦૦૦	જમીન-મકાન	૫૦,૦૦૦	૭૫,૦૦૦
સામાન્ય અનામત	૧૨,૫૦૦	૧૫,૦૦૦	પ્લાન્ટ-યંત્રો	૫૭,૫૦૦	૫૫,૦૦૦
ન.નુ. ખાતુ	૧૦,૦૦૦	૭,૫૦૦	સ્ટોક	૧૦,૦૦૦	૧૨,૫૦૦
લેણદારો	૫,૦૦૦	૫,૨૫૦	દેવાદારો	૭,૫૦૦	૧૦,૦૦૦
દેવીહંડી	૩,૭૫૦	૭,૫૦૦	રોકડ-બેંક	૫,૦૦૦	૭,૫૦૦
ખર્ચ ચૂ. બાકી	૧,૨૫૦	૩,૭૫૦	લેણીહંડી	૨,૫૦૦	૫,૦૦૦
બેન્ક ઓપરફ્રાન્ડ	૭,૫૦૦	૫,૦૦૦	પ્રાથમિક ખર્ચ	૭,૫૦૦	૫,૦૦૦
	૧,૪૦,૦૦૦	૧,૭૦,૦૦૦		૧,૪૦,૦૦૦	૧,૭૦,૦૦૦

વેપાર અને નફાનુક્સાન ખાતું

વિગત	૨૦૦૨	૨૦૦૩	વિગત	૨૦૦૨	૨૦૦૩
શરૂનો સ્ટોક	૫,૦૦૦	૧૦,૦૦૦	વેચાણ	૫૨,૫૦૦	૧,૧૨,૫૦૦
ખરીદી	૩૭,૫૦૦	૪૭,૫૦૦	આખર સ્ટોક	૧૦,૦૦૦	૧૨,૫૦૦
વહીવટી ખર્ચ	૭,૫૦૦	૧૦,૦૦૦			
વેચાણ ખર્ચ	૫,૦૦૦	૧૨,૫૦૦			
વિતરણ ખર્ચ	૨,૫૦૦	૧૦,૦૦૦			

ચોખણો નફો	૧૫,૦૦૦	૩૪,૦૦૦			
	૭૨,૫૦૦	૧,૨૫,૦૦૦		૭૨,૫૦૦	૧,૨૫,૦૦૦

જવાબ:

નફો-નુકશાન ખાતું

વિગત	૨૦૦૨	૨૦૦૩
યેચાણા [A]	૫૨૫૦૦૦	૧૧૨૫૦૦
- યેચાણા પરત	૫૦૦૦	૧૦૦૦૦
શરૂનો સ્ટોક	૩૭૫૦૦	૪૭૫૦૦
+ ખરીદી	૪૨૫૦૦	૫૭૫૦૦
- આખરનો સ્ટોક	૧૦૦૦૦	૧૨૫૦૦
વેચેલ માલની પડતર [B]	૩૨૫૦૦	૪૫૦૦૦
કાચો નફો [A] - [B]	૩૦૦૦૦	૫૭૫૦૦
યેચાણા વિતરણ ખર્ચ	૧૫૦૦૦	૩૨૫૦૦
EBIT	૧૫૦૦૦	૩૫૦૦૦

(૧) Current Ratio/ ચાલુ ગણોતર

$$\begin{aligned}
 &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દૈવા}} \\
 &= \frac{\text{સ્ટોક} + \text{દૈવાદારો} + \text{લેણીહુંકી}}{\text{લેણદારો} + \text{દેવીહુંકી} + \text{BOD} + \text{ચુક. બાકી} \\
 &\quad \text{ખર્ચ} \\
 2002 &= \frac{10000 + 7500 + 5000 + 2500}{5000 + 3750 + 1250 + 7500} \\
 &= \frac{25000}{22500} \\
 &= \underline{1.75:1} \\
 2003 &= \frac{12500 + 10000 + 7500 + 5000}{22500 + 7500 + 3750 + 4000} \\
 &= \frac{35000}{27500} \\
 &= \underline{1.25:1}
 \end{aligned}$$

(૨) Stock Turnover Ratio/ સ્ટોક ગણોતર:-

$$\begin{aligned}
 &= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 2002 &= \frac{32500}{32500} \times = \underline{3.2500} = 3.25 \text{ વખત}
 \end{aligned}$$

$$\begin{array}{r}
 \frac{5000 + 10000}{10000 + 12500} \times 2 = \frac{15000}{12500} \times 2 = 120\% = 12\text{ वर्ष}
 \end{array}$$

(३) Gross Profit Ratio/ काचानक्षनो गणोतरः-

$$\begin{array}{l}
 2002 = \frac{30000}{52500} \times 100 = 56\%
 \\
 2003 = \frac{57500}{112500} \times 100 = 50\%
 \end{array}$$

(४) Liquidity Ratio/ प्रवाही गणोतरः-

$$\begin{aligned}
 &= \frac{\text{प्रवाही भिलक्तो}}{\text{प्रवाही देवा}} \\
 &= \frac{\text{चालु भिलक्तो} - \text{स्टोक}}{\text{चालु देवा} - \text{बैंक ओपर फ्रांश}} \\
 2002 &= \frac{30000}{52500} \times 100 = 56\% \\
 2003 &= \frac{57500}{112500} \times 100 = 50\%
 \end{aligned}$$

(५) Debtors' Ratio/ देवादार गणोतरः-

$$\begin{aligned}
 &= \frac{\text{देवादारो} + \text{लेणीहूंडी}}{\text{उधार वेचाण}} \times 300 \\
 2002 &= \frac{1500 + 2500}{52500} \times 300 = \frac{10000}{52500} \times 300 = 56 \text{ दिवस} \\
 2003 &= \frac{10000 + 5000}{112500} \times 300 = \frac{15000}{112500} \times 300 = 40 \text{ दिवस}
 \end{aligned}$$

(६) Rate of Return on Capital employed/ रोकेती मूँडी पर वगतरनो दरः-

$$= \frac{\text{EBIT}}{\text{रोकायेती} \text{मूँडी}} \times 100$$

$$2002 = \frac{95000}{915000} \times 100 = 13.04\%$$

$$2003 = \frac{34000}{142500} \times 100 = 24.45\%$$

શેરાયેલી મૂડી = ઈકવીટી શેર + અનામત + નફા-નુકશાન ખાતુ - પ્રાથમિક ખર્ચ
 ૨૦૦૨ = ૧૦૦૦૦૦ + ૧૨૫૦૦ + ૧૦૦૦૦ - ૭૫૦૦ = ૧૧૫૦૦૦
 ૨૦૦૩ = ૧૨૫૦૦૦ + ૧૫૦૦૦ + ૭૫૦૦ - ૫૦૦૦ = ૧૪૨૫૦૦

(૨૧) દેવલ લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે:

પાકું સરવૈયું

દેવાં	૩૧-૦૩- ૨૦૦૪ ₹	૩૧-૦૩- ૨૦૦૩ ₹	મિલકતો	૩૧-૦૩- ૨૦૦૪ ₹	૩૧-૦૩- ૨૦૦૩ ₹
ઈકવીટી શેરમૂડી	૭૫૦૦૦૦	૬૦૦૦૦૦	મકાન	૭૫૦૦૦૦	૪૫૦૦૦૦
૧૦%ની પ્રેફ. શેરમૂડી	૩૦૦૦૦૦	૩૦૦૦૦૦	ચંન્ગો	૧૫૦૦૦૦	૩૦૦૦૦૦
અનામત બંડોળ	૨૭૩૦૦૦	૨૪૩૦૦૦	ફન્ચિર	૧૫૦૦૦૦	૧૫૦૦૦૦
૧૦%ના ડીનેચર	૩૦૦૦૦૦	૩૦૦૦૦૦	સ્ટોક	૨૨૫૦૦૦	૧૫૦૦૦૦
લેણાદારો	૩૦૦૦૦	૨૪૦૦૦	દેવાદારો	૩૭૫૦૦૦	૪૫૦૦૦૦
પ્રોવિન્ટ ફંડ	૩૦૦૦૦	૩૫૦૦૦	લેણીહૂંકીઓ	૪૫૦૦૦	૩૦૦૦૦
કરવેરાની	૧૫૦૦૦	૩૦૦૦૦	રોકડ અને બેંક	૭૫૦૦૦	૫૦૦૦૦
જોગવાઈ					
બેંક ઓપરફ્રાન્ડ	૭૫૦૦૦	૬૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૩૦૦૦	૩૦૦૦
	૧૭૭૩૦૦૦	૧૫૮૩૦૦૦		૧૭૭૩૦૦૦	૧૫૮૩૦૦૦

વધારાની માહિતી:

૨૦૦૩-૨૦૦૪ ૨૦૦૨-૨૦૦૩

	₹	₹
કુલ વેચાણ (રોકડ વેચાણ, ઉદ્યાર વેચાણનો ૩/૫ ભાગ છે.)	૧૮૭૫૦૦૦	૧૫૦૦૦૦૦
કાચો નફો	૪૫૦૦૦૦	૩૦૦૦૦૦
વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો	૪૮૫૦૦૦	૪૦૫૦૦૦
કરવેરાનો દર ૫૦% ધારો		
શરૂઆતનો સ્ટોક (૦૧-૦૪-૨૦૦૨)	---	૬૦૦૦૦
ઉપરની માહિતી પરથી નીચેના ગુણાતરોની ગણતરી કરો અને તેનું અર્થઘટન કરો.		
(૧) ચોખ્ખા નફાનો ગુણોત્તર (૨) સ્ટોક ગુણોત્તર (૩) પ્રવાહી ગુણોત્તર		

(ગુ. ચુનિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૫)

જવાબ:

(૧) Net Profit Ratio/ ચોખા નકાનો ગુણોત્તરઃ-

$$= \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100$$

$$2003-04 = \frac{210000}{1875000} \times 100 = 11.2\%$$

$$2002-03 = \frac{170000}{1500000} \times 100 = 12\%$$

$$\text{PAT} = \text{EBIT} - \text{વ્યાજ} - \text{EBT} - \text{વેશ}$$

$$2003-04 = 454000 - 45000 = 420000 - 210000 = 210000$$

$$2002-03 = 404000 - 45000 = 360000 - 180000 = 180000$$

અર્થાતના:- દેંધાની નકારકતાનો ખ્યાલ આપે છે. ચાલુ વર્ષે આ ગુણોત્તરમાં ઘટાડો નોંધાયો છે, જે સંતોષકારક નથી. જોકે આ અંગે કોઈ ચોક્ક અભિપ્રાય આપવો મુશ્કેલ છે. કારણકે તેનો આધાર દેંધાની અન્ય પેઢીઓના ગુણોત્તરો, કંપનીના ભૂતકાળના ગુણોત્તરો તેમજ આદર્શ ગુણોત્તરો પર રહેલો છે.

(૨) Stock Turnover Ratio/ સ્ટોક ગણોત્તરઃ-

$$= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$2003-04 = \frac{1875000 - 450000}{150000 + 225000} \times 2 = \frac{1425000}{187500} = 7.5 \text{ વખત}$$

$$2002-03 = \frac{1500000 - 300000}{60000 + 150000} \times 2 = \frac{1200000}{120000} = 10 \text{ વખત}$$

અર્થાતના:- તે વેચાણની કાર્યક્ષમતાનું સુચન કરે છે. આ ગુણોત્તર જેમ ઉંચો તેમ વધારે સંતોષકારક ગણાય. જોકે ચાલુ વર્ષે તેમાં ઘટાડો નોંધાયો છે. આથી તેના કારણોની તપાસ કરી સુધારાત્મક પગલાં સેવાં જોઈએ.

(૩) Liquidity Ratio/ પ્રવાહી ગણોત્તરઃ-

$$= \frac{\text{પ્રવાહી મિલકતો}}$$

$$= \text{પ્રવાહી દેવા}$$

$$= \frac{\text{દેવાદાકો} + \text{લેણીહંડી} + \text{રોકડ}}$$

$$= \text{લેણાદરો} + \text{PF} + \text{વેશ}$$

$$2003-04 = \frac{375000 + 45000 + 75000}{30000 + 30000 + 15000} = \frac{495000}{75000} = 5.5:1$$

$$2002-03 = \frac{450000 + 300000 + 90000}{24000 + 35000 + 30000} = \frac{840000}{60000} = 5:1$$

અર્થઘટના:- આ ગુણોત્તર ધંધાની પ્રવાહી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. આ ગુણોત્તર ૧:૧ હોય તો આદર્શ ગણાય. અહીં બંને વર્ષે આ ગુણોત્તર ધાણો ઉંચો છે, જે યોગ્ય નથી. આથી આવી વધારાની કાર્યશીલ મૂડીનું નફાકારક તકોમાં રોકાણ કરવું જોઈએ. નહીંતો એક બાજું ઉછીની મૂડી પર વ્યાજ ચુકવવું પડશે અને બીજી બાજું ધંધામાં આવી મૂડી બીનજરૂરી રોકાઈ રહેશે. પરિણામે ચોખા નફામાં ઘટાડો થશે.

(૨૨) આરતી લિમિટેડનાં તા. ૩૧-૦૩-૨૦૦૫ના રોજના પાકા સરવૈયાં અને અન્ય વધારાની ભાહિતી પરથી નીચેના ગુણોત્તરો શોધો:

(૧) સ્ટોક ટર્નઓવર ગુણોત્તર (૨) ચાલુ ગુણોત્તર (૩) પ્રવાહી ગુણોત્તર (૪) રોકાયેલી મૂડી પર વળતરનો દર (૫) ચોખા નફાનો ગુણોત્તર.

આરતી લિ. નું. તા. ૩૧-૦૩-૨૦૦૫ના રોજનું પાકું સરવૈયું

જવાબદારી	₹	ભિલકત-લેણાં	₹
ઇક્વિટી શેરમૂડી	૪૦૦૦૦૦	જમીન-મકાન	૨૫૦૦૦૦
સામાન્ય અનામત	૨૦૦૦૦૦	યંત્રો	૧૩૦૦૦૦
નફાનુકશાન ખાતુ	૧૭૦૦૦૦	કામચલાઉ રોકાણો	૨૭૦૦૦૦
૮%ના ડિલેન્યર	૨૫૦૦૦૦	સ્ટોક	૧૭૫૦૦૦
લેણાદારો	૧૦૦૦૦૦	દેવાદારો	૨૦૦૦૦૦
દેવીહૂંડી	૫૦૦૦૦	અગાઉથી ચુકવેલ ખર્ચ	૩૦૦૦૦
પ્રોવિડન્ટ ફંડ	૩૦૦૦૦	અગાઉથી ચુકવેલ આવકવેરો	૮૦૦૦૦
બેંક ઓવરફ્રાફ્ટ (દેના બેંકમાંથી)	૪૦૦૦૦	લેણીહૂંડી	૫૦૦૦૦
ચુકવવાના બાકી ખર્ચા	૧૦૦૦૦	રોકડ સિલક	૨૦૦૦૦
		બેંક ઓફ બરોડામાં સિલક	૪૦૦૦૦
		ડિબેચર વટાવ	૫૦૦૦
	૧૨૫૦૦૦૦		૧૨૫૦૦૦૦

વધારાની ભાહિતી:

- (૧) રોકડ વેચાણા, કુલ વેચાણના ૨૦% છે.
- (૨) તા. ૦૧-૦૪-૨૦૦૪ના રોજ સ્ટોક રૂ. ૧૨૫૦૦૦ છે.
- (૩) દેવાદાર ગુણોત્તર ૮૦ દિવસનો છે. વર્ષના દિવસો રૂક્ષો ગણાવા.
- (૪) કાચો નફો, વેચાણના ૪૦% છે.
- (૫) ચોખો નફો (વ્યાજ અને કરવેરા પહેલાનો) રૂ. ૨૫૦૦૦૦ છે.
- (૬) કરવેરાનો દર ૫૦% છે.

(સૌ. ચુનિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૫)

(૨૩) જવાબ:

નફા-નુકશાન ખાતું

વિગત	₹
વેચાણા	૧૨૫૦૦૦૦
- વેચાણ પડતર કાચો નફો	૭૫૦૦૦૦

કાચો નફો	400000
વહીવટી અને વેચાણ વિતરણના ખર્ચ	250000
EBIT	250000
વ્યાજ	20000
-વેરા 40%	230000
PAT	114000
	114000

(1)

$$\text{દેવાદાર ગુણોત્તર} = \frac{\text{દેવાદારો + લેણાદારો}}{\text{ઉધાર વેચાણ}} \times 350$$

$$= \frac{200000 + 50000}{\text{ઉધાર વેચાણ}} \times 350$$

$$\text{ઉધાર વેચાણ} = \frac{250000}{50} \times 350 = 1000000$$

$$\text{કુલ વેચાણ} = 1000000 \times \frac{100}{20} = 125000$$

$$\text{કુલ વેચાણ} = 125000 \times 20\% = 25000$$

$$\text{વેચેલ માલની પડતર} = \text{વેચાણ} - \text{કાચો નફો}$$

$$= 1250000 - 40\% [5,00,000] = 750000$$

(2)

$$\text{સ્ટોક ટર્નઓવર} = \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}}$$

$$= \frac{750000}{125000 + 175000} \times 2$$

$$= \frac{750000}{150000} = 5 \text{ વખત}$$

(3) Current Ratio:

$$\begin{aligned} \text{ચાલુ ગણોત્તર} &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\ &= \frac{270000 + 175000 + 200000 + 30000 + 20000 + 50000 + 200000}{+40000} \\ &= \frac{100000 + 50000 + 30000 + 40000 + 90000}{100000 + 50000 + 30000 + 40000 + 90000} \\ &= \underline{1.54000} \end{aligned}$$

$$= \frac{₹30000}{₹3 : ₹75 : ₹1}$$

(૪) Liquid Ratio:

$$\begin{aligned} \text{પ્રવાહી ગણોતર} &= \frac{\text{ચાલુ મિલકતો - સ્ટોક}}{\text{ચાલુ દેવા - બંક ઓવર ફ્રાફ્ટ}} \\ &= \frac{₹55000 - ₹175000}{₹30000 - ₹80000} \\ &= \frac{₹560000}{₹160000} \\ &= 3 : 53 : 1 \end{aligned}$$

(૫) Rate of Return on Capital Employed:

$$\begin{aligned} \text{રોકેલી મૂડી પર વળતરનો દર} &= \frac{\text{EBIT}}{\text{રોકાયેલ મૂડી}} \times 100 \\ &= \frac{₹250000}{₹1014000} \times 100 \\ &= 24.53\% \end{aligned}$$

(૬) Net Profit Ratio:

$$\begin{aligned} \text{ઓખખા નજાનો ગુણોતર} &= \frac{\text{ઓખખો નાની}}{\text{વેચાણ}} \times 100 \\ &= \frac{₹114000}{₹240000} \times 100 \\ &= 4.75\% \end{aligned}$$

(૨૩) બંટી લિમિટેડની તા. ૩૧-૧૨-૨૦૦૫ના રોજ પૂરા થતા વર્ષની નીચેની માહિતી મળે છે.

	₹
(૧) ઇકવીટી શેરમૂડી	500000
(૨) 10%ની પ્રેફરન્સ શેરમૂડી	250000
(૩) 10%ના ડિનેંચર્સ	75000
(૪) 10%ની લાંબાગાળાની લોન	50000
(૫) રાખી મુકેલી કમાણી	125000
(૬) ચાલુ મિલકતો	375000
(૭) કાયમી મિલકતો	775000
(૮) અવાસ્તવિક મિલકતો	250000

(૬)	શરૂઆતનો સ્ટોક	₹૨૫૦૦
(૧૦)	આખરનો સ્ટોક	૭૫૦૦૦
(૧૧)	ચોખ્ખો નફો (૫૦% કરવેયા બાદ કર્યા પછી)	૧૨૫૦૦૦

વધારાની માહિતી:

- (૧) ઉધાર વેચાણ, રોકડ વેચાણથી ઢોઢગાળું છે.
(૨) દેવાદારો અને લેણીહૂંડી, ચાલુ મિલકતોનો ૧/૩ હિસ્સો છે.
(૩) સ્ટોક ટર્નओવર ગુણોત્તર ૧૦ છે.
(૪) કાચા નફાનો ગુણોત્તર ૩૩% છે.
ઉપરની વિગતના આધારે નીચેના ગુણોત્તરોની ગણતરી કરો:
(૧) ચોખ્ખા નફાનો ગુણોત્તર
(૨) સંચાલન ગુણોત્તર
(૩) દેવાદાર ગુણોત્તર (વર્ધના દિવસો ૩૬૦ ગણવા)
(૪) રોકાયેલી મૂડી પર વળતરનો દર
(૫) શેરહોલ્ડરોના ભંડોળો પર વળતરનો દર

(સૌ.ચુનિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૯)

નફા-જુક્ષાન ખાતું

વિગત	₹
વેચાણ	૧૨૫૦૦૦૦
- વેચાણ પડતર કાચો નફો	૮૩૭૫૦૦
કાચો નફો	૪૧૨૫૦૦
સંચાલન ખર્ચ	૮૭૫૦૦
EBIT	૩૨૫૦૦૦
વ્યાજ (૫૦૦૦૦ + ૭૫૦૦૦ = ૧૨૫૦૦૦ × ૧૦%)	૧૨૫૦૦
-વેરા ૫૦%	૩૧૨૫૦૦
PAT	૧૨૫૦૦૦

(૧)

$$\text{સ્ટોકનો ગુણોત્તર} = \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{શરૂનો સ્ટોક} + \text{આખરનો સ્ટોક}} \times 2$$

$$10 = \frac{\text{વેચેલ માલની પડતર}}{૮૨૫૦૦ + ૭૫૦૦} \times 2$$

$$\text{વેચેલ માલની પડતર} = \frac{૧૬૭૫૦૦ \times 10}{2} = ૮૩૭૫૦૦$$

(૨) વેચાણ : વેચેલ માલની પડતર ૮૩૭૫૦૦ અને કાચા નફાનો દર ૩૩%, તેથી વેચેલ માલની પડતર ૬૭%

$$\text{વેચાણ} = ૮૩૭૫૦૦ \times \frac{૧૦૦}{૬૭} = ૧૨૫૦૦૦૦$$

રોકડ વેચાણ ૧, ઉધાર વેચાણ ૧.૫ તેથી કુલ વેચાણ ૨.૫

$$\text{રોકડ વેચાણ} = ૧૨૫૦૦૦૦ \times \frac{૧}{૨.૫} = ૫૦૦૦૦૦$$

$$\text{ઉધાર વેચાણ} = ૧૨૫૦૦૦૦ \times \frac{૧.૫}{૨.૫} = ૭૫૦૦૦૦$$

(૩) Net Profit Ratio / ચોખા નફાનો ગુણોત્તર:-

$$= \frac{\text{PAT}}{\text{વેચાણ}} \times 100 = \frac{૧૨૫૦૦૦}{૧૨૫૦૦૦૦} \times 100 = ૧૦\%$$

(૪) Operationg Ratio / સંચાલન ગુણોત્તર:-

$$\begin{aligned} &= \frac{\text{વેચેલ માલની પડતર} + \text{સંચાલનના ખર્ચ}}{\text{વેચાણ}} \times 100 \\ &= \frac{૮૩૭૫૦૦ + ૧૦૦૦૦૦}{૧૨૫૦૦૦૦} \times 100 \\ &= \frac{૯૩૭૫૦૦}{૧૨૫૦૦૦૦} \times 100 = ૭૫\% \end{aligned}$$

(૫) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર:-

$$\begin{aligned} &= \frac{\text{દેવાદારો} + \text{લેણીહૂંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 350 \\ &= \frac{૩૭૫૦૦૦ \times ૧/૩}{૭૫૦૦૦૦} \times 350 \\ &= \frac{૧૨૫૦૦૦}{૭૫૦૦૦૦} \times 350 = ૬૦ દિવસ \end{aligned}$$

(૬) Rate of Return on Capital Employed / રોકેલી મૂકી પર વળતરનો દર:-

$$\begin{aligned} &= \frac{\text{EBIT}}{\text{રોકાચેલી મૂકી}} \times 100 \\ &= \frac{૩૭૫૦૦૦}{૭૫૦૦૦૦} \times 100 \end{aligned}$$

$$\begin{array}{rcl} 674000 \\ = & 33.33\% \end{array}$$

(૨૪) વિનાયક લિમિટેડના સંક્ષિપ્ત પાકા સરવૈયા નીચે મુજબ છે.

પાકું સરવૈયું

દેવાં	૩૧-૦૩- ૨૦૦૪ ₹	૩૧-૦૩- ૨૦૦૫ ₹	મિલકતો	૩૧-૦૩- ૨૦૦૪ ₹	૩૧-૦૩- ૨૦૦૫ ₹
ઇક્વિટી શેરમૂડી	૪૦૦૦૦૦	૫૦૦૦૦૦	જમીન મકાન	૨૦૦૦૦૦	૨૫૦૦૦૦
૧૦%ની પ્રેફ. શેરમૂડી	૨૦૦૦૦૦	૨૦૦૦૦૦	પલાન્ટ અને ચંત્રો	૨૫૦૦૦૦	૩૦૦૦૦૦
નફાનુક્ષશાન ખાતું	૮૦૦૦૦	૧૫૦૦૦૦	ફન્ચિયર	૮૨૦૦૦	૧૦૮૦૦૦
સામાન્ય અનામત	૭૦૦૦૦	૧૨૦૦૦૦	રોકાણો	૧૨૦૦૦૦	૧૦૦૦૦૦
૧૨%ના ડીઝેચર	૧૦૦૦૦૦	૧૫૦૦૦૦	સ્ટોક	૧૦૦૦૦૦	૧૫૦૦૦૦
દેણાદારો	૮૪૦૦૦	૧૧૦૦૦૦	દેવાદારો	૮૦૦૦૦	૧૪૦૦૦૦
દેલીહંડી	૨૫૦૦૦	૩૦૦૦૦	લેણીહંડી	૩૦૦૦૦	૫૦૦૦૦
ચૂકવવાના બાકી ખર્ચ	૧૫૦૦૦	૨૦૦૦૦	રોકડ અને બેંક સિલક	૭૮૦૦૦	૧૩૮૦૦૦
પ્રોવિન્ટ ફંડ	૫૦૦૦૦	૭૦૦૦૦	અગાઉથી ચૂક. ખર્ચ બાંયધરી કમિશન	૩૫૦૦૦ ૫૦૦૦૦	૫૪૦૦૦ ૪૦૦૦૦
	૧૦૩૪૦૦૦	૧૩૪૦૦૦૦		૧૦૩૪૦૦૦	૧૩૪૦૦૦૦

વધારાની માહિતી:

	૨૦૦૩-૨૦૦૪ ₹	૨૦૦૪-૨૦૦૫ ₹
વેચાણ (જેમાં ઉધાર વેચાણ રોકડ વેચાણથી ત્રણ ગાણું છે.)	૮૦૦૦૦૦	૧૨૦૦૦૦૦
ચોખ્ખો નઝો (વ્યાજ અને કરવેરા પછીનો, કરવેરાનો દર ૫૦% છે.)	૮૪૦૦૦	૧૫૩૦૦૦

ઉપરની માહિતી પરથી નીચેના હિસાબી ગુણોત્તરોની ગણતરી કરો:

- (૧) ચાલુ ગુણોત્તર
- (૨) રોકાણેલી મૂડી પર વળતરનો દર
- (૩) દેવાં-ઇક્વિટી ગુણોત્તર
- (૪) દેવાદાર ગુણોત્તર (વર્ષના ૩૬૦ દિવસ ગણવા)

(ઉ.ગુ.યુ.નિ., ટી.વાય., માર્ચ ૨૦૦૬)

- (૧) Current Ratio / ચાલુ ગુણોત્તર:-

$$= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}}$$

$$2003-2004 = \frac{100000 + 600000 + 30000 + 72000 + 34000}{64000 + 24000 + 14000 + 40000}$$

$$= \frac{333000}{184000}$$

$$= 1.8:1$$

$$2004-2005 = \frac{150000 + 140000 + 500000 + 132000 + 48000}{110000 + 30000 + 200000 + 40000}$$

$$= \frac{552000}{230000}$$

$$= 2.4:1$$

(2) Rate of Return on Capital Employed / રોકેલી મૂડી પર વળતરનો દર:-

$$= \frac{\text{EBIT}}{\text{રોકાયેલી મૂડી}} \times 100$$

$$2003-2004 = \frac{200000}{600000} \times 100 = 25\%$$

$$2004-2005 = \frac{324000}{900000} \times 100 = 30\%$$

$$\text{EBIT} = \text{PAT} + \text{વેરા 50\%} + \text{વ્યાજ}$$

$$2003-2004 = 64000 + 64000 + 12000 = 200000$$

$$2004-2005 = 143000 + 143000 + 12000 = 324000$$

$$2003-2004 = 800000 + 200000 + 20000 + 70000 + 100000 - 40000 = 800000$$

$$2004-2005 = 400000 + 200000 + 140000 + 120000 + 140000 - 80000 = 900000$$

(3) Debt-Equity Ratio / દેવા-ઇકવીટી ગુણોત્તર:-

$$= \frac{\text{લાંબાગાળાના દેવા}}{\text{માલિકીના ભંડોળો}} \times 100$$

$$2003-2004 = \frac{100000}{50000} \times 100 = 14.26\%$$

$$2004-2005 = \frac{14000}{63000} \times 100 = 16.33\%$$

માલિકીના ભંડોળો = ઈ. શેર + પ્રેશ. શેર + ન. નુ. ખાતુ + સામાન્ય અનામત - બાંયધરી કમિશન

$$2003-2004 = 800000 + 200000 + 20000 + 70000 - 40000 = 900000$$

$$2004-2005 = 500000 + 200000 + 140000 + 120000 - 80000 = 630000$$

(4) Debtors' Ratio / દેવાદાર ગુણોત્તરઃ-

$$\text{Debtors' Ratio} = \frac{\text{દેવાદારો} + \text{લેણીહુંડી}}{\text{ઉધાર વેચાણ}} \times 350$$

2003-2004	=	$\frac{60000 + 30000}{500000} \times 350$
		$\frac{90000}{500000} \times 350 = 63 \text{ દિવસ}$
2004-2005	=	$\frac{140000 + 50000}{500000} \times 350$
		$\frac{190000}{500000} \times 350 = 133 \text{ દિવસ}$

ઉધાર વેચાણઃ

$$2003-2004 = 600000 \times 3/4 = 500000$$

$$2004-2005 = 600000 \times 3/4 = 450000$$

(5) દર્શન લિમિટેડનાં સંક્ષિપ્ત સરવૈયાં નીચે મુજબ છે:

પાકું સરવૈયું

દેવાં	31-03- 2004 ₹	31-03- 2005 ₹	મિલકતો	31-03- 2004 ₹	31-03- 2005 ₹
ઇકલીટી શેરમૂડી	300000	400000	જમીન મકાન	200000	250000
૧૦%ની પ્રેફ. શેરમૂડી	200000	250000	ચંત્રો	250000	260000
સામાન્ય અનામત	100000	125000	ફન્નિચર	51000	74000
નફાનુક્ષાન ખાતું	30000	35000	સ્ટોક	150000	180000
૧૨%ના ડીબેંચર	100000	100000	દેવાદારો	120000	140000
લેણદારો	10000	60000	લેણીહુંડી	30000	40000
દેવિહુંડી	20000	15000	રોકડ સિલક	24000	34000
સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ	50000	70000	અગાઉથી ચૂક. ખર્ચ	50000	70000
બેંક ઓવરડ્રાફ્ટ	10000	15000	પ્રાથમિક ખર્ચ	14000	10000
	600000	1100000		600000	1100000

વધારાની ભાહિતીઃ

	2003-2004 ₹	2004-2005 ₹
કુલ વેચાણ (રોકડ વેચાણ, ઉધાર વેચાણનો ૪/૫ ભાગ છે.)	530000	610000
કાચો નફો	252000	372500

વ्याज અને કરવેરા પહેલાનો નફો (કરવેરાનો દર ૫૦% છે.)	૨૫૦૨૫૦	૩૫૦૦૦૦
તા. ૦૧-૦૪-૨૦૦૩ના રોજનો સ્ટોક	૧૩૦૦૦૦	
ઉપરની માહિતી પરથી નીચેના ગુણોત્તરો ગણી પ્રથમ બે ગુણોત્તરોનું અર્થઘટન કરો:		
(૧) ચાલુ ગુણોત્તર (૨) સ્ટોક ગુણોત્તર (૩) દેવાદાર ગુણોત્તર (વર્ષના ૩૬૦ દિવસ ગણાવા)		
(ઉ.ગુ.યુનિ., ટી.વાચ., માર્ચ ૨૦૦૬)		

જવાબ:

(૧) Current Ratio / ચાલુ ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{ચાલુ મિલકતો}}{\text{ચાલુ દેવા}} \\
 2003-2004 &= \frac{140000 + 120000 + 30000 + 24000 + 40000}{60000 + 20000 + 50000 + 10000} \\
 &= \frac{374000}{170000} \\
 &= 2.2:1 \\
 2004-2005 &= \frac{160000 + 140000 + 40000 + 34000 + 70000}{60000 + 14000 + 70000 + 14000} \\
 &= \frac{474000}{160000} \\
 &= 2.9:1
 \end{aligned}$$

અર્થઘટન:- ધંધાની કાર્યશીલ મૂડીની પરિસ્થિતિ જાણાવા માટે ઉપયોગી છે. આદર્શ ગુણોત્તર ૨:૧ ગણાય. જીજા વર્ષે આ ગુણોત્તર સંતોષકારક જણાય છે.

(૨) Stock Ratio / સ્ટોક ગુણોત્તર:

$$\begin{aligned}
 &= \frac{\text{વેચેલ માલની પડતર}}{\text{સરેરાશ સ્ટોક}} \\
 &= \frac{\text{વેચાણ - કાચો નફો}}{\text{શરૂનો સ્ટોક}} \times 2 \\
 2003-2004 &= \frac{530000 - 252000}{130000 + 140000} \times 2 \\
 &= \frac{378000}{180000} = 2.1 \text{ વખત} \\
 2004-2005 &= \frac{490000 - 372500}{140000 + 180000} \times 2 \\
 &= \frac{117500}{320000} = 2.5 \text{ વખત}
 \end{aligned}$$

અર્થાદનઃ - વેચાણની કાર્યક્ષમતાનો ખ્યાલ આપે છે. આ અંગે ચોક્કસ અભિપ્રાય આપવો મુશ્કેલ છે. તેનો આધાર અન્ય કંપનીના ગુણોત્તર, ઉદ્યોગનો આદર્શ ગુણોત્તર તથા કંપનીના ભૂતકાળના ગુણોત્તર પર રહેલો છે.

(૪) **Debtors' Ratio / દેવાદાર ગુણોત્તર:**

$$\begin{aligned}
 &= \frac{\text{દેવાદાર} + \text{લેણીહુંડી}}{\text{ઉદ્યાર વેચાણ}} \times 350 \\
 2003-2004 &= \frac{120000 + 30000}{350000} \times 350 \\
 &= \frac{150000}{350000} \times 350 = 154 \text{ દિવસ} \\
 2004-2005 &= \frac{150000 + 80000}{850000} \times 350 \\
 &= \frac{160000}{850000} \times 350 = 152 \text{ દિવસ}
 \end{aligned}$$

ઉદ્યાર વેચાણ:

$$\begin{aligned}
 2003-2004 &= 530000 \times \frac{100}{120} = 340000 \\
 2004-2005 &= 810000 \times \frac{100}{120} = 840000
 \end{aligned}$$

૪.૬ સ્વાધ્યાય / વ્યાવહારિક

(૧) જ્યા લિમિટેડનાં સંક્ષિપ્ત પાકાં સરવૈયા નીચે મુજબ છે:

પાંકું સરવૈયું

જ્યાબદારીઓ	૩૧-૦૩- ૨૦૦૪ ₹	૩૧-૦૩- ૨૦૦૫ ₹	મિલકતો	૩૧-૦૩- ૨૦૦૪ ₹	૩૧-૦૩- ૨૦૦૫ ₹
ઇક્વિટી શેરમૂડી	૮૦૦૦૦૦	૧૧૦૦૦૦૦	કાયમી મિલકતો	૬૭૬૦૦૦	૧૦૬૬૦૦૦
અનામત અને વધારો	૪૧૦૦૦૦	૬૩૦૦૦૦	રોકાણો	૪૦૮૦૦૦	૪૮૪૦૦૦
૧૨%ના ડીનેચર્સ	૪૦૦૦૦૦	૫૦૦૦૦૦	સ્ટોક	૩૧૦૦૦૦	૨૬૦૦૦૦
લેણાદારો	૧૭૦૦૦૦	૧૮૫૦૦૦	દેવાદારો	૨૬૪૦૦૦	૩૪૦૦૦૦
દેવીહુંડી	૮૦૦૦૦	૪૫૦૦૦	અગા. ચૂક. ખર્ચ	૨૬૦૦૦	૩૪૦૦૦
સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ	૧૪૦૦૦૦	૪૦૦૦૦	લેણીહુંડીઓ રોકડ અને બેંક પ્રાથમિક ખર્ચ	૧૨૦૦૦૦	૧૪૦૦૦૦
	૨૦૦૦૦૦૦	૨૫૦૦૦૦૦		૨૦૦૦૦૦૦	૨૫૦૦૦૦૦

વધારાની માહિતી:

	૨૦૦૩-૨૦૦૪	૨૦૦૪-
	₹	₹
કુલ વેચાણ (રોકડ વેચાણ, ઉધાર વેચાણનો ૧/૪ ભાગ છે.)	૨૪૦૦૦૦૦	૩૦૦૦૦૦૦
કાચો નફો	૬૪૦૦૦૦	૬૦૦૦૦૦
ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો, કરવેરાનો દર ૫૦% છે.)	૩૨૦૦૦૦	૪૮૪૦૦૦

તારીખ ૧લી એપ્રિલ, ૨૦૦૩ના રોજ સ્ટોક રૂ. ૧૩૦૦૦૦નો છે.

ઉપરની માહિતી પરથી બંને વર્ષ માટે નીચેના હિસાબી ગુણોત્તરો શોધો:

- (૧) સ્ટોક ગુણોત્તર
- (૨) રોકાયેલી મૂડી પર વળતરનો દર
- (૩) દેવાદાર ગુણોત્તર

(ઉ.ગુ.ચુનિ., ટી.વાય., માર્ચ ૧૯૯૭)

(૨) સની લિ. નાં સંકિસ પાકાં સરવૈયાં નીચે મુજબ છે:

પાકું સરવૈયું

જવાબદારીઓ	૩૧-૦૩- ૨૦૦૦	૩૧-૦૩- ૨૦૦૧	મિલકતો	૩૧-૦૩- ૨૦૦૦	૩૧-૦૩- ૨૦૦૧
	₹	₹		₹	₹
ઇકવીટી શેરમૂડી (દરેક રૂ. ૧૦૦નો)	૫૦૦૦૦૦	૮૦૦૦૦૦	કાચમી મિલકતો	૬૦૦૦૦૦	૧૧૧૦૦૦૦
૧૦%ની પ્રેફરન્સ શેરમૂડી	૧૦૦૦૦૦	૧૦૦૦૦૦	સ્ટોક	૧૫૦૦૦૦	૧૮૦૦૦૦
નફા-નુકશાન ખાતું	૪૦૦૦૦	૫૦૦૦૦	દેવાદારો	૧૨૦૦૦૦	૧૩૦૦૦૦
અનામતો	૮૦૦૦૦	૯૦૦૦૦			
૧૦%ના ડીઝેન્ચર	૨૦૦૦૦૦	૨૫૦૦૦૦	લેણીહૂંકીઓ	૫૦૦૦	૧૫૦૦૦
કારીગર નફાભાગ ફંડ	૨૦૦૦૦	૧૦૦૦૦	અગા. ચૂક. ખર્ચ	૧૦૦૦૦	૫૦૦૦૦
બેંક ઓવરફ્રાન્ડ	૩૦૦૦૦	૫૦૦૦૦	રોકડ અને બેંક	૧૫૦૦૦	૧૦૦૦૦
લેણદારો	૧૦૫૦૦૦	૭૦૦૦૦			
દેવિહૂંકીઓ	૩૦૦૦૦	૪૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૨૦૦૦૦	૧૦૦૦૦
ચુકવયાના બાકી ખર્ચ	૧૫૦૦૦	૨૦૦૦૦			
	૧૨૨૦૦૦૦	૧૪૫૦૦૦૦		૧૨૨૦૦૦૦	૧૪૫૦૦૦૦

વધારાની માહિતી:

	૧૯૯૯-૨૦૦૦	૨૦૦૦-૨૦૦૧
	₹	₹
કુલ વેચાણ (રોકડ વેચાણ, ઉધાર વેચાણનો ૧/૫ ભાગ છે.)	૨૪૦૦૦૦૦	૩૫૦૦૦૦૦
કાચો નશો	૬૫૦૦૦૦	૧૨૮૦૦૦૦
ચોમખો નશો (વ્યાજ અને કરવેરા બાદ કર્યા પહેલાનો, કરવેરાનો દર ૫૦% છે.)	૩૮૦૦૦૦	૫૭૩૦૦૦

તા. ૦૧-૦૪-૧૯૯૯ના રોજ સ્ટોક રૂ. ૧૩૮૦૦૦

ઉપરની માહિતી પરથી બંને વર્ષ માટે નીચેના હિસાબી ગુણોત્તરો ગણો અને દરેક વિશે ટૂંકમાં તમારો અભિપ્રાય આપો:

(૧) ચોમખા નશનો ગુણોત્તર (૨) રોકાયેલી મૂડી પર વળતર (૩) દેવાદાર ગુણોત્તર (વર્ષના ૩૬૦ દિવસો ગણવાના છે.) (૪) સ્ટોક ગુણોત્તર (૫) ચાલુ ગુણોત્તર (૬) શેરદીદ કમાણી

(૬.ગુ.યુ.નિ., ટી.વાય., માર્ચ ૨૦૦૦)

(૩) પાયલ લિ. નાં. તા. ૩૧-૧૨-૧૯૯૯ તથા તા. ૩૧-૧૨-૨૦૦૦ના રોજનાં પાકા સરવૈયાં નીચે મુજબ છે:

પાકું સરવૈયું

દેવાં	૩૧-૦૩-૨૦૦૦ ₹	૩૧-૦૩-૨૦૦૧ ₹	મિલકત-દેખાં	૩૧-૦૩-૨૦૦૦ ₹	૩૧-૦૩-૨૦૦૧ ₹
ઇકવીટી શેરમૂડી	૪૦૦૦૦૦	૮૦૦૦૦૦	ચંત્રો	૫૫૦૦૦૦	૮૨૦૦૦૦
સામાન્ય અનામત	૩૦૦૦૦	૫૦૦૦૦	સ્ટોક	૧૮૦૦૦૦	૨૨૦૦૦૦
નશા-નુકશાન ખાતું	૧૬૦૦૦	૮૦૦૦૦	દેવાદારો	૫૦૦૦૦	૧૬૦૦૦૦
ડિલેંચર્સ	૧૮૦૦૦૦	૧૮૦૦૦૦	લેણીહંદી	૧૦૦૦૦	૧૪૦૦૦
તારણવાળી લોન	૨૦૦૦૦	૨૦૦૦૦	બેંક સિલક	૧૦૦૦૦૦	૧૭૭૦૦૦
લેણદારો	૨૮૨૦૦૦	૩૫૨૦૦૦	અ.ચુકવેલ ખર્ચ	૬૦૦૦૦	૨૮૦૦૦
સુચિત ડિવિડન્ડ	૨૦૦૦૦	૪૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૬૦૦૦	૧૦૦૦૦
કરવેરાની જોગવાઈ	૮૦૦૦	૮૦૦૦			
	૮૯૯૦૦૦	૧૫૩૦૦૦૦		૮૯૯૦૦૦	૧૫૩૦૦૦૦

વધારાની માહિતી:

	૩૧-૧૨-૧૯૯૯	૧૩-૧૨-૨૦૦૦
	₹	₹
વેચાણ (જેમાં ઉધાર વેચાણ રોકડ વેચાણથી ત્રણ ગણું છે.)	૪૮૦૦૦૦	૮૪૦૦૦૦
ખરીદી	૩૪૦૦૦૦	૫૨૦૦૦૦
ખરીદીના ખર્ચ	૨૦૦૦૦	૫૦૦૦૦
ઓફિસ ખર્ચ	૮૦૦૦૦	૮૦૦૦૦
વેચાણ વિતરણના ખર્ચ	૯૪૦૦૦	૮૦૦૦૦

તા. ૩૧-૧૨-૧૯૯૮ના રોજ સ્ટોકની કિંમત રૂ. ૧૫૦૦૦૦ હતી, જ્યારે તેની બજાર કિંમત રૂ. ૧૪૦૦૦૦ હતી.

ઉપરની માહિતીના આધારે નીચેના ગુણોત્તરો શોધો અને દરેકનું ટ્રૂકમાં અર્થાદન કરો:

- (૧) કાચા નફાનો ગુણોત્તર (૨) પ્રવાહી ગુણોત્તર (૩) રાકોચેલી મૂડી પર વળતરનો ગુણોત્તર (૪) દેવાદાર ગુણોત્તર (૫) સ્ટોક ગુણોત્તર

નોંધ:- વર્ષના દિવસો ૩૬૦ ગણો.

(ઉ.ગુ.ચુનિ., ટી.વાચ., એપ્રિલ ૨૦૦૩)

- (૪) નીચેની માહિતી સોના-રૂપા નામની બે કંપનીઓના રેકૉર્ડ પરથી લેવામાં આવી છે:

દેવાં	સોના લિ. ₹	રૂપા લિ. ₹	મિલકત-લેણાં	સોના લિ. ₹	રૂપા લિ. ₹
ઇકવીઠી શેરમૂડી	૧૦૦૦૦૦	૮૦૦૦૦	જમીન-મકાન	૮૦૦૦૦	૭૫૦૦૦
રાખી મુક્કેલી કમાણી	૨૪૮૦૦	૬૬૨૦૦	સાંચા-યંત્રો	૮૦૦૦૦	૮૦૦૦૦
૧૫%ના ડીઝેન્ચર્સ	૮૦૦૦૦	૬૬૦૦૦	સ્ટોક	૩૨૦૦૦	૮૦૦૦૦
લેણાદારો	૩૨૦૦૦	૪૦૦૦૦	દેવાદારો	૩૫૦૦૦	૩૦૦૦૦
દેવિહુંકીઓ	૩૦૦૦	૧૦૦૦૦	લેણીહુંકીઓ	૫૦૦૦	૫૦૦૦
બેંક ઓવરફ્રાફ્ટ	૯૦૦૦	૧૫૦૦૦	સ્ટોક	૧૬૦૦૦	૧૦૦૦૦
ચુક્કવાના બાકી ખર્ચ	૩૦૦૦	૫૦૦૦	પ્રાથમિક ખર્ચ	૮૦૦	૧૨૦૦
	૨૪૮૮૦૦	૨૮૨૨૦૦		૨૪૮૮૦૦	૨૮૨૨૦૦

વધારાની માહિતી:

	સોના લિ. ₹	રૂપા લિ. ₹
કુલ વેચાણ (૮૦% ઉધાર વેચાણ છે.)	૩૨૦૦૦૦	૩૨૦૦૦૦
વેચેલ માલની પડતર	૨૨૪૦૦૦	૨૦૮૦૦૦
ચોખ્ખો નફો (૫૦% લેખે કરવેરા બાદ)	૧૬૦૦૦	૨૫૬૦૦
ઉપરની માહિતી અને પાકા સરવૈચા પરથી બંને કંપની માટે નીચેના હિસાબી ગુણોત્તરો ગણો અને દરેક વિશે તમારો અભિપ્રાય આપો:		

- (૧) ચાલુ ગુણોત્તર (૨) સંચાલન ગુણોત્તર (૩) દેવાદાર ગુણોત્તર (વર્ષના ૩૬૫ દિવસ ગણવાના છે.)
(૪) શેરહોલ્ડરોના ભંડોળ પર વળતર દર (૫) કુલ રોકાચેલી મૂડી પર વળતરનો દર.

(ઉ.ગુ.ચુનિ., ટી.વાચ., એપ્રિલ ૨૦૦૪)

- (૫) શૈલ લિ. ના પાકા સરવૈચાં નીચે પ્રમાણે છે:

પાંકું સરવૈચાં

જવાબદારીઓ	૩૧-૦૩-૨૦૦૪ ₹	૩૧-૦૩-૨૦૦૩ ₹	મિલકતો	૩૧-૦૩-૨૦૦૪ ₹	૩૧-૦૩-૨૦૦૩ ₹
ઇકવીઠી શેર મૂડી અગામત અને	૭૫૦૦૦૦ ૩૪૮૦૦૦	૭૫૦૦૦૦ ૩૦૦૦૦૦	સ્થાયી મિલકતો બાદ : ઘસારો	૧૨૦૦૦૦૦ ૪૨૦૦૦૦	૬૦૦૦૦૦ ૩૦૦૦૦૦

વધારો					
લોન	300000	350000			500000
ચાલુ ટેવાં	327000	35000	રોકાણો	920000	60000
			સ્ટોક	350000	300000
			દેવાદારો	210000	140000
			રોકડ	50000	50000
			અન્ય ચાલુ મિલકતો	74000	74000
			પરચુરણ ખર્ચ	180000	210000
	1724000	1824000		1724000	1824000

૨૦૦૩-૨૦૦૪ના વર્ષ અંગેની અન્ય માહિતી નીચે મુજબ છે:

કુલ વેચાણ (જે પૈકી ૨૦% રોકડ વેચાણ છે)	1800000
વ્યાજ અને કરવેરા પહેલાનો નફો	740000
વ્યાજ	72000
કરવેરાની જોગવાઈ	180000
સૂચિત ડિવિડન	140000

ઉપરની માહિતી પરથી ૨૦૦૩-૨૦૦૪ના વર્ષ માટે નીચેના ગુણોત્તરોની ગણાતરી કરો:

- (૧) રોકાણેલી ભૂકી પર વળતરનો દર (૨) સ્ટોકની ફેરબદલી દર (૩) ચાલુ ગુણોત્તર (૪) પ્રવાહી ગુણોત્તર
(૫) દેવાદાર ગુણોત્તર (૬) ચોખા નશાનો ગુણોત્તર

(ગુ.યુનિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૧)

(૭) નમન લિ. નાં પાકા સરવૈયાં નીચે મુજબ છે:

પાંકું સરવૈયું

જવાબદારીઓ	૩૧-૦૩- ૨૦૦૩ ₹	૩૧-૦૩- ૨૦૦૪ ₹	મિલકતો	૩૧-૦૩- ૨૦૦૩ ₹	૩૧-૦૩- ૨૦૦૪ ₹
ઇક્વિટી શેરમૂડી	2000000	2740000	કાયમી મિલકતો	1420000	2740000
અનામત અને વધારો	1024000	1740000	રોકાણો	1000000	1200000
૧૨%ના ડીબેંચર્સ	1000000	1074000	સ્ટોક	740000	850000
લેણદારો	840000	820000	દેવાદારો	770000	760000
દેવીહૂકી	940000	70000	અગા. ચુક. ખર્ચ	104000	40000
ચુકવવાના બાકી	100000	20000	લેણીહૂકીઓ	374000	354000
ખર્ચ			રોકડ અને બેંક બાંયધરી દલાલી	800000	200000
પ્રોવિડન્ટ ફંડ	940000	64000		200000	40000
	4600000	5300000		4600000	5300000

વધારાની માહિતી:

	૨૦૦૨-૨૦૦૩ ₹	૨૦૦૩-૨૦૦૪ ₹
કુલ વેચાણ (રોકડ વેચાણ ઉધાર વેચાણનો ૧/૫ ભાગ છે.)	૪૫૦૦૦૦૦	૫૨૫૦૦૦૦
કાચો નફો	૧૮૦૦૦૦૦	૧૦૭૫૦૦૦
ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો કરવેરાનો દર ૫૦% છે.)	૮૦૦૦૦૦	૭૫૦૦૦૦

તારીખ ૦૧લી એપ્રિલ, ૨૦૦૨ના રોજ સ્ટોક રૂ. ૩૦૦૦૦૦ હતો. ઉપરની માહિતી ઉપરથી બંને વર્ષ માટે નીચેના હિસાબી ગુણોત્તરો શોધો અને ઊભાં પાકાં સરવૈયાં બનાવો.

(૧) રોકડબેલી નૂડી પર વળતરનો દર (૨) સ્ટોક ગુણોત્તર (૩) દેવાદાર ગુણોત્તર (૩૫૦ દિવસ) (૪) ચાલુ ગુણોત્તર

(ઉ.ગુ. ચુનિ., ટી.વાય., એપ્રિલ ૧૯૯૯)

પ્રકરણ - ૫
પાદડીનું મૂલ્યાંકન

- પ.૧ પ્રસ્તાવના
- પ.૨ પાદડીનો અર્થ
- પ.૩ પાદડીને અસર કરતા પરીબળો
- પ.૪ પાદડીના મૂલ્યાંકનની જરૂરીઆત શા માટે પડે છે?
- પ.૫ પાદડીના પ્રકાર
- પ.૬ સરેરાશ નફાની પદ્ધતિ
- પ.૭ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ
- પ.૮ અધિક નફાની પદ્ધતિ
- પ.૯ સ્વાધ્યાય

પ્રકટરણ - ૫

પાઘડીનું મૂલ્યાંકન

૫.૧ પ્રસ્તાવનાઃ

રોજબરોજના સંજોગો પ્રમાણે ધંધામાં ભાગીદારોને ભાગીદારી પેઢીનું પુર્જગઠન (નવું મૂલ્યાંકન) કરવું પડે છે. પુનઃગઠનમાં મિલકતો (સ્થિર અને અસ્થિર) અને દેવા (લાંબાગાળાના તથા ટૂંકાગાળાના)નું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકતો, દેવા, ભાગીદારી પેઢીની સાથે પુનઃમૂલ્યાંકનમાં પાઘડીની પણ નવી કિંમત નક્કી કરવાના સંજોગો ઉદ્દેશ્યે છે. (ધંધાને બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો જો પણ સમાવેશ થાય છે.) પાઘડીએ અદ્રશ્ય મિલકત છે જે ધંધાની આબદ્ધ, પ્રતિષ્ણા અને મોભાને જેમ બજારમાં દર્શાવવામાં આવે છે.

ધંધાની પેઢી પાસે મુખ્યરૂપે બે પ્રકારની મિલકતો હોય છે. (૧) ચાલુ મિલકતો (૨) બિનચાલુ મિલકતો.

- બિન ચાલુ મિલકતોમાં કાથમી મિલકતો, અદ્રશ્ય મિલકતો અને લાંબાગાળાના તથા ટૂંકાગાળાના રોકાણોનો સમાવેશ કરવામાં આવે છે. કાથમી મિલકતોમાં જમીન, મકાન, ચંત્રો, ફિનિચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તમામ મિલકતો દ્રશ્ય મિલકતો છે જેને જોઈ શકાય છે. બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો જેવી કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ તમામ અદ્રશ્ય મિલકતોને જોઈ શકાતી નથી. પરંતુ હકીકતમાં આ મિલકતોની બજાર કિંમત ઘણીવાર દ્રશ્ય મિલકતો કરતાં વધારે હોય છે. સમય જતા જેમ જેમ ધંધાની સાથે વધુ વ્યક્તિઓ જોડાય છે, ધંધાનું વિસ્તરણ થાય છે જેને કારણે ધંધાની પ્રતિષ્ણા, આબદ્ધ અને નફો કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે.
- ધંધાની પાઘડીની કિંમત ધંધાની પ્રતિષ્ણા, આબદ્ધ અને નફો કમાવાની શક્યતા ઉપરથી કરવામાં આવે છે. દેશેક ધંધાના સ્થાપકો સાહસથી, ખંતથી અને મહેનતથી નફો કમાય છે. તેઓની કાર્યક્ષમતા, આવડત અને કુનેહથી પોતાનો ધંધો ચલાવે છે અને ધંધાનું વિસ્તરણ કરે છે અને ધંધાને સારી, સુધ્ય અને સદ્યર પરિસ્થિતિમાં મુકે છે. સંસ્થાપકોની આ મહેનતનો લાભ ધંધાના વેચાણ સમે ધંધાના ખરીદનારને મળે છે. એટલે કે, ધંધો વેચનાર વ્યક્તિ આ પરિશ્રમ, મહેનત ને ધંધાની બજારમાં પ્રતિષ્ણાના વળતર રૂપે કિંમતની માંગણી કરે છે તે તે કિંમત પાઘડીની કિંમત બને છે.
- આજના હરીકાઈવાળા બજારમાં જો એક ધંધો પોતાના હરીઝો કરતાં વધારે સારો નફો પોતાની આવડત અને મહેનતથી કમાઈ શકે તો તે ધંધો પણ પાઘડી ધરાવે છે એમ કહી શકાય. પાઘડીને આપણો એક ઉદાહરણ તરીકે સમજુએ તો ધારો કે કોઈ માલિક પોતાનો ધંધો વેચવા માંગે છે અને તે સમયે ચોખ્ખી મિલકતોની કિંમત રૂ.૫૦,૦૦,૦૦૦ હોય અને વેચનાર વ્યક્તિ ધંધાની વેચાણ કિંમત રૂ. ૫૦,૦૦,૦૦૦ માંગે તો તે વધારાના રૂ. ૧૦,૦૦,૦૦૦ એ ધંધાની પાઘડીની રકમ છે તેમ કહેવાય છે.
- આમ, કહી શકાય કે પાઘડીની કિંમતની ગણતરી વખતે તમામ મિલકતો અને દેવાઓને દ્યાનમાં લેવામાં આવે છે. આથી પાઘડીની કિંમતની ગણતરી કરવી એ ખૂબજ જટીલ અને મુશ્કેલ ભર્યુ કામ છે.

પ.૨ પાઘડીનો અર્થ:

પાઘડી એ ધંધાની કિંમત જોઈ શકાય તેવી ખૂલ જ મહત્વની અદ્રશ્ય મિલકત છે, પાઘડીની કિંમતને સરળ રીતે આંકી શકાય તેમ નથી.

- જ્યારે કોઈપણ ધંધાનું સંપાદન કરવામાં આવે અથવા તો વેચાણ કરવામાં આવે ત્યારે ખરીદનાર વ્યક્તિ દ્વારા ધંધાના બજારકિંમત કરતા મિલકતોની વધારે કિંમત ચૂકવવામાં આવે છે. આ જે વધારાની કિંમત ચૂકવવામાં આવે છે તેને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે.
- સરળ ભાષામાં કહીએ તો પાઘડીએ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા ધરાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડીનો મુખ્ય આધાર ધંધાની નફો કમાવવાની ક્ષમતા ઉપર રહેલો છે. પાઘડીએ ધંધાની અદ્રશ્ય મિલકત છે. પાઘડી ધંધા સાથે અભિન્ન અંગ તરીકે જોડાયેલી છે. જે ધંધો પાઘડી ધરાવતો હોય તે ધંધા તરફ ગ્રાહકો વધુ આર્કષાય છે કારણકે એ બજારમાં ધંધાની પ્રતિષ્ઠા બતાવે છે.

પાઘડીની લાક્ષણિકતાઓ:

પાઘડીનો મુખ્યત્વે ધંધાની નફો કમાવવાની ક્ષમતા ઉપર રહેલો છે. પાઘડીએ ધંધાની અદ્રશ્ય મિલકત છે. પાઘડી ધંધા સાથે અભિન્ન અંગ તરીકે જોડાયેલી છે. જે ધંધો પાઘડી ધરાવતો હોય તે ધંધા તરફ ગ્રાહકો વધુ આર્કષાય છે કારણકે એ બજારમાં ધંધાની પ્રતિષ્ઠા બતાવે છે.

- (૧) પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. તેને જોઈ શકાતી નથી. પરંતુ પાઘડીએ કાલ્પનિક મિલકત છે.
- (૨) પાઘડીએ ધંધાની મૂલ્યવાન અભિન્ન અંગ છે. પાઘડીને ધંધાની અલગ દર્શાવવામાં આવતી નથી માટે પાઘડીને બીજી મિલકતો ની જેમ અલગથી વેચી શકાતી નથી. પાઘડીનું વેચાણ ત્યારે જ કરવામાં આવે જ્યારે ધંધાનું સંપાદન અથવા તો વેચાણ કરવામાં આવે.
- (૩) પાઘડીના મૂલ્યમાં સમયસર વધઘટ થતી રહે છે. પાઘડીની કિંમત ઉપર ઘણા બધા પરિબળો આંતરિક તથા બાહ્ય પરીબળો અસર કરે છે.
- (૪) પાઘડીની કિંમત ધંધાના નફા ઉપર આધારિત છે, તદ્વારાંત પાઘડીની કિંમત એ નક્કી કરનાર વ્યક્તિ ઉપર પણ રહેલી છે.
- (૫) પાઘડીએ ધંધા સાથે જોડાયેલ મિલકત છે, પાઘડીએ ધંધાની સ્વતંત્ર નથી.
- (૬) પાઘડીએ ધંધાની સ્થિર, અદ્રશ્ય મિલકત છે. તેને કાલ્પનિક મિલકત ત્યારે જ કહેવાય જ્યારે ધંધો નુકશાનમાં ચાલતો હોય, કારણકે જ્યારે ધંધો ખોટમાં હોય ત્યારે પાઘડીનું મૂલ્ય શુન્ય અથવા નહિવત હોય છે.

પ.૩ પાઘડીને અસર કરતા પરીબળો:

પાઘડી મુખ્યત્વે ધંધાની નફો કમાવવાની ક્ષમતા ઉપર રહેલી છે. કોઈપણ ધંધાનો મુખ્ય આધાર નફા ઉપર રહેલો છે. જો ધંધો સારો નફો કમાઈ શકે તો જ ધંધાનું વિસ્તરણ થઈ શકે અને બજારમાં લાંબાગાળા માટે ટકી શકે. જો ધંધો સતત ખોટમાં જતો હોય તો થોડા સમયના અંતે ધંધો બંધ કરવાની પરીસ્થિતિ ઉભી થાય છે. આમ, કટી શકાય કે જો કોઈ ધંધો ખોટ કરતો હોય તો ધંધાની પાઘડીનું મૂલ્ય શુન્ય છે અને તે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા પણ શુન્ય છે. ધંધાની પાઘડીને ફક્ત નફો જ નહીં પરંતુ ઘણા બધા બીજા આંતરીક અને બાહ્ય પરીબળો છે જે ધંધાની પાઘડી તથા આર્થિક પરિસ્થિતિને અસર કરે છે. આંતરિક પરીબળો એટલે એવા પરીબળો જે ધંધાની અંદર જ ઉદ્દેશ્યે છે અને ધંધાની પાઘડીને અસર કરે છે. આવા પરીબળો ઉપર ધંધો

નિયંત્રિત કરી શકે છે. પરંતુ, ધાણ બધા બાધ્ય પરીબળો છે જે ધંધાની બહાર ઉદ્ભવે છે જેને નિયંત્રણમાં રાખવા એ શક્ય નથી. પાઘડીને અસર કરતા પરીબળો નીચે પ્રમાણે છે.

(૧) **વ્યક્તિની આવડત, કળા અને કૌશલ્ય:** ધંધાના માલિકની આવડત, કળા અને કૌશલ્ય ધંધાની પાઘડીની કિંમતને અસર કરતું મુખ્ય અંતરીક પરીબળ છે. કોઈપણ ધંધામાં નજો કમાવવા, ધંધાનું વિસ્તરણ કરવા માટે તથા ધંધાને હરીજાઈવાળા બજારમાં ટકાવી રાખવા માટે વ્યક્તિગત આવડત, કુનેહ અને કૌશલ્ય ખુલ્લ જ જરૂરી છે. ધંધો ચલાવવાની કુશળતા અને આવડતને કારણે ધંધાના નજોમાં વધારો થાય છે અને સાથે-સાથે પાઘડીના મૂલ્યમાં પણ વધારો થાય છે. માટે કહી શકાય કે જેટલું ધંધાના માલિકની સંચાલન કરવાની કળા વધારે તેટલો જ ધંધાની નજો કરવાની ક્ષમતા વધારે અને તેટલી જ પાઘડીની કિંમત વધારે. જો ધંધાના માલિકમાં આવડત તથા સંચાલનની ઉદાપ હોય તો ધંધાના પાઘડીની કિંમતમાં ઘટાડો થાય છે અને લાંબાગાળે ધંધાની પ્રતિષ્ઠા બજારમાં શૂન્ય થઈ જાય છે.

(૨) **ધંધાની નિતી:** હંમેશા પાઘડીની કિંમત ફક્ત નજો ઉપર જ આધાર રાખે છે એવું નથી. ધારીવાર ધંધો નજો સારો કમાતી હોય પરંતુ તેની પાઘડીની કિંમત ઓછી હોય છે. બજારમાં ગ્રાહકો મુખ્યત્વે ધંધાને અસર કરે છે. જો કોઈપણ ધંધો ફક્ત નજો કમાવવાના હોતુથી ચલાવે અને અન્ય બાધ્ય માણસોને મુખ્યત્વે ગ્રાહક જોડે કોઈ સારા સંબંધો રાખતા ના હોય તો ત્વારે ટૂંકા સમય માટે ધંધો નજો તો કમાય શકે છે પરંતુ બજારમાં ગ્રાહક વર્ચ્યે પોતાની પ્રતિષ્ઠા જાળવી શકતો નથી. માટે પાઘડી ની ઊંચી કિંમત નજીવિ સાથે-સાથે બજારનો રાજ ગ્રાહક સાથેના સારા અને સુધ્ય સંબંધ ઉપર પણ આધારિત છે.

(૩) **સંચાલનની ડ્રપરેખા:** જો ધંધો મોટાપાયે વિસ્તરતો હોય અને સંચાલનથી ચાલતો હોય તો સંચાલનની અંદર સારા એવા કુશળ, મહેનતુ, કૌશલ્યવાળા કર્મચારીઓ હોવા જરૂરી છે. જો સંચાલનના માણસોમાં આ લક્ષણોની ઉદાપ હોય તો તેની સીધી અસર ધંધાની નજો કમાવવાની ક્ષમતા ઉપર પડે છે અને બજારમાં ધંધાની પ્રતિષ્ઠાનું ઘોવાણ થાય છે.

(૪) **ધંધાના માલિક, સંચાલનના કર્મચારીઓ સાથેના સંબંધો:** ધંધાની પ્રતિષ્ઠા એટલે કે પાઘડીનો આધાર નજો ઉપર રહેલો છે અને નજીવિનો આધાર મુખ્યત્વે ઉત્પાદનની ગુણવત્તા તથા અન્ય સેવાઓ પર રહેલો છે. જો ધંધાના ઉપલા લેવલે સંચાલનના સંબંધો નીચલા લેવલના કર્મચારીઓ સાથે સારા નહીં હોય તો કર્મચારીઓ ગુણવત્તાભર્યું ઉત્પાદન કરી શકશે નહીં જેની સીધી અસર વસ્તુના વેચાણ ઉપર થાય છે અને ઓછા પ્રમાણમાં વેચાણની સીધી અસર ધંધાના નજો અને પાઘડી ઉપર થાય છે. માટે જે કર્મચારીઓને સારું અને યોગ્ય વેતન તથા અન્ય સુવીધાઓ આપવામાં આવે અને સારા સંબંધો જાળવવામાં આવે તો પાઘડીની કિંમતમાં વધારો જોવા મળે છે.

(૫) **રોકાણકારોને વળતર:** મુખ્યત્વે જાહેર સાહસોની આર્થિક પરીસ્થિતિ અને મૂડીની જરૂરીઆત રોકાણકારો ઉપર રહેલી છે. જો ધંધો રોકાણકારોને તેમના રોકાણના બદલામાં સારું અને યોગ્ય વળતર આપે તો તેઓ વધારે ને વધારે રોકાણ કરશે જેના કારણે બજારમાં ધંધાના શેરની કિંમતમાં વધારો થશે અને તેને કારણે બજારમાં ધંધાની પ્રતિષ્ઠા અને આબરૂમાં વધારો જોવા મળશે. માટે પાઘડીની કિંમતનો આધાર ધંધા દ્વારા આપવામાં આવતા વળતર તથા રોકાણકારોમાં રસ ઉપર પણ રહેલો છે.

(૬) **ધંધાની જગ્યા:** ધંધાની જગ્યા પણ ધંધાની પાઘડીને અસર કરતું એક મહત્વનું પરીબળ છે. ધંધાની જગ્યા શહેર, શહેરી જગ્યાની નજીક અથવા ધંધાને યોગ્ય આપતા વાતાવરણમાં આવેલી હોય તો પાઘડીનું મૂલ્ય વધારે જોવા મળે છે. આનાથી પ્રતિકુળ પરીસ્થિતિમાં પાઘડીના મૂલ્યમાં ઘટાડો અથવા તો પાઘડીની કિંમત

નહીંવત જોવા મળે છે. દા.ત. ગુજરાતમાં પાટણના પટોળાનો ધંધો, સુરતમાં ટેક્ષટાઈલનો ધંધો, મુંબઈમાં આવેલ ચલચિત્ર ઉતારવા માટેના સ્ટુડીયો નો ધંધો વગેરે. આ ઉપર આપેલ જગ્યાઓ ઉપર ધંધાનું વેચાણ કરવામાં આવે તો પાઘડીનું મૂલ્ય ખૂબ જ વધારે જોવા મળે છે. માટે, જગ્યારે પણ નવો ધંધો શરૂ કરવામાં આવે ત્યારે ભવિષ્યમાં પાઘડીની મૂલ્યને દ્યાનમાં રાખીને ધંધાની જગ્યાની પસંદગી કરવી જોઈએ.

(૭) ધંધાનું જોખમ: જગ્યારે ધંધામાં જોખમનું પ્રમાણ વધારે હોય ત્યારે પાઘડીના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે અને જો ધંધામાં જોખમ ઓછું હોય તો બજારમાં પાઘડીના મૂલ્યમાં વધારો જોવા મળે છે.

(૮) અનુકૂળ કરારો: મોટા-ધંધાઓમાં અલગ-અલગ વ્યક્તિઓ અને અન્ય ધંધા જોડે વિવિધ પ્રકારના કરારો કરવામાં આવે છે. આવા કરારોમાં પરીણામ તરીકે જો નફો વધારે હોય તો પાઘડીની કિંમતમાં વધારો જોવા મળે છે અને કરારોમાં નફાનું પ્રમાણ ઓછું હોય તો પાઘડીની કિંમતમાં વૃદ્ધિ જોવા મળતી નથી.

(૯) ધંધાનો પ્રકાર: બજારમાં કરવામાં આવતા ધંધાના પ્રકાર પણ પાઘડીના મૂલ્યને અસર કરે છે. બજારમાં ધંધા ઢ્રારા વેચવામાં આવતી વસ્તુની ગુણવત્તા, વસ્તુની માંગ, વસ્તુનો પ્રકાર આહકોને અનુકૂળ હશે તો પાઘડીના મૂલ્યમાં વધારો જોવા મળે છે. જો બજારમાં રોજ-બરોજની જરૂરીઆતની વસ્તુઓ વેચવામાં આવેતો નફો એકસરખો અથવા નફામાં વધારો જોવા મળે છે અને પાઘડીના મૂલ્યમાં વૃદ્ધિ થાય છે. જો ધંધાનો પ્રકાર ફેશન કે મોઝશોખની વસ્તુઓ જેવી કે કપડા, મોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ સાધનો વગેરે વસ્તુઓની માંગ અને પસંદગીમાં વારંવાર બદલાવ જોવા મળે છે. માટે આવી વસ્તુનું વેચાણ પણ ઉપર-નીચે થાય છે અને નફો પણ સ્થિર રહેતો નથી. આવા પ્રકારના ધંધામાં પાઘડીના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે.

(૧૦) ધંધાની મુદ્દત: સામાન્ય રીતે બજારમાં એવા જ ધંધા લાંબાગાળા માટે ધંધો કરી શકે છે જે ધંધામાં લાંબાગાળાથી નફો કમાવવાની કુશળતા હોય છે. બજારમાં કોઈ ધંધો વર્ષોથી ચાલતો હોય એનો મતલબ એ ધંધામાં નફો કમાવાની ક્ષમતા છે અને ધંધાની પ્રતિષ્ઠા પણ છે. માટે આવા વર્ષોથી ચાલતા ધંધાઓની પાઘડીનું મૂલ્ય વધારે જોવા મળે છે. સામાન્ય રીતે કહેવાય છે કે જે ધંધાના ગ્રાહકો સાથે સંબંધો સારા એ જ ધંધો લાંબાગાળા સુધી બજારમાં ઉંભો રહી શકે છે.

(૧૧) નફાનું વલણાઃ ધંધાની નફો કમાવાની શક્તિ એ ખૂબ જ મહત્વની બાબત છે. જગ્યારે નફાના વલણામાં હક્કારાતમક રીતે વધારો જોવા મળે તેમ-તેમ ધંધાની ચોખ્ખી મિલકતોમાં પણ વધારો જોવા મળે છે. પાછલા વર્ષોમાં નફો સતત વધતો જોવા મળ્યો હોય તો તેની સીધી અસર ભવિષ્યના નફો ઉપર પડે છે, કારણકે ધંધા સાથે જોડાયેલા જુના ગ્રાહકો.

(૧૨) પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ: કોઈપણ ધંધા પાસે પોતાના પેટન્ટસ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ હોય તો તેનાથી પણ તે ધંધો સારો નફો કમાઈ શકે છે. માટે જગ્યારે ધંધાનું વેચાણ કરવામાં આવે અને ત્યારે અદ્રશ્ય મિલકતોનો લાભ લાંબા સમય માટે હોય તો પાઘડીના મૂલ્યમાં વધારો જોવા મળે છે. દા.ત. સેમસંગ કંપનીના મોબાઇલ, ટાઇટન કંપનીના ઘડીયાળ, વુલ્ફેન્ડ, રેડ્ચીફિન, બાટા કંપનીના ચાપ્પલ અને બુટ, પારલેજુ ના બીસ્કીટ વગેરે આ તમામ કંપનીઓ પાસે લાંબા સમયની ઊંચી કિંમતવાળી અદ્રશ્ય મિલકતો છે. માટે આ કંપનીને પાઘડીનું મૂલ્ય પણ અત્યારના બજારમાં ખૂબ જ વધારે છે, અને જો આ અદ્રશ્ય મિલકતોનો સમય પૂરો થવા આવે તો સાથે-સાથે પાઘડીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળે છે.

(૧૩) ધંધાની વસ્તુઓની ગુણવત્તાઃ ધંધા ઢ્રારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓ જો ખૂબ જ વધારે ગુણવત્તાવાળી હોય તો જે-તે ધંધાનું નામ બજારમાં ખૂબ જ ઉપરના લેવલ ઉપર હોય છે. અને તેની પાઘડીની

કિંમત પણ ખૂબ જ ડિંચી હોય છે. દા.ત. એપલ કંપનીના મોબાઇલ, ડોમીનોડના પીડ્રા, એમ.આર.એફ. કંપની ના ટાયરો વગેરે કંપીની ની પાદડીની કિંમત ખૂબ જ વધારે હોય છે.

(૧૪) સરકારી નિતી-નિયમો: જો ધંધો કરવાના સરકારી નિતી-નિયમો ખૂબ જ જટીલ અને અવગાડભર્યા હોય તો ધંધો કરવો ખૂબ જ મુશ્કેલ છે અને આવા પ્રકારનાં ધંધાઓ નફો કમાઈ શકતા નથી અને પાદડીની કિંમત ઓછી હોય છે. માટે સરકાર લોકોને ધંધો કરવા છુટ આપે તો સારા પ્રમાણમાં નફો કમાઈ શકે છે અને પાદડીના મૂલ્યમાં વૃદ્ધિ જોવા મળે છે.

(૧૫) સરકારી સંરક્ષણાઃ જે વસ્તુઓનું ધંધા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તે વસ્તુઓને સરકારનું સંરક્ષણ અને સારો સાથ-સહકાર મળી શકે તેવા ધંધાની પાદડીનું મૂલ્ય વધારે હોય છે.

(૧૬) ધંધામાં મૂડીનું પ્રમાણાઃ જે ધંધામાં માલિકીનું મૂડીનું પ્રણામ વધારે હોય તે ધંધાને વળતરરૂપે વધુ વ્યાજ ચુકવવું પડતું નથી. માટે નફાના પ્રમાણમાં વધારો જોવા મળે છે અને પાદડીનાં મૂલ્યમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. પરંતુ જો ધંધામાં માલિકીની મૂડી કરતા દેવાવાળી મૂડી વધારે હોય તો તેમાં વળતરરૂપે વ્યાજ ફરજીયાત ચુકવવું પડે છે અને તેને કારણે પાદડીનું મૂલ્ય ઘટે છે.

(૧૭) અન્ય પરીબળોઃ ઉપર આપેલા પરીબળો સિવાય પણ ધાણાખણા પરીબળો જે ધંધાને તથા ધંધાના પાદડીની કિંમતને અસર કરે છે. જેવાકે ગ્રાહકોનું વલણ, કરની સરકારી નિતીઓ, રાજકીય સ્થિરતા, હકારાતમક બજારનું વલણ, ઉત્પાદન કરવાની ગુમસ રીતો, દેશની પરીસ્થિતિ અને કેટલાક કુદરતી પરીબળો જે ધંધાની પાદડીની રકમને અસર કરે છે.

૫.૪ પાદડીના મૂલ્યાંકનની જરૂરીયાત શા માટે પડે પડે છે?

પાદડી એ ધંધાની ખૂબ જ અનિવાર્ય અન્દ્રશ્ય ભિલકત છે. આ ભિલકતને જોઈ શકતી નથી. પરંતુ તેનું મૂલ્ય દ્રશ્ય ભિલકતો કરતા પણ વધારે હોય છે. સામાન્ય રીતે જો ધંધો વ્યવસ્થિત અને સારા પ્રમાણમાં ચાલતો હોય તો પાદડીના મૂલ્યાંકનની જરૂરીયાત પડતી નથી. પરંતુ નીચે આપેલા સંજોગો ઉદભયે તો પાદડીનું મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે.

(A) એકાંકી માલિકીવાળા ધંધામાં પાદડીનું મૂલ્યાંકનઃ

જો વ્યક્તિ પોતે એકલો જ પોતાના ધંધાનું સંચાલન કરતો હોય ત્યારે નીચેના સંજોગોમાં પાદડીનું મૂલ્યાંકન જરૂરી છે.

- (૧) જો ધંધો બીજા કોઈ વ્યક્તિને વેચવામાં આવે
- (૨) ધંધામાં બીજો કોઈ વ્યક્તિને ઉમેરવામાં આવે અને
- (૩) એકાંકી માલિકીના ધંધાનું કંપનીમાં ઝપાંતર કરવામાં આવે

(B) ભાગીદારી પેઢીમાં પાદડીનું મૂલ્યાંકન: જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને ભાગીદારી પેઢી ચલાવતા હોય ત્યારે નીચેના સંજોગો ઉદભયે ત્યારે પાદડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

- (૧) જ્યારે ભાગીદારી પેઢીમાં નફો-નુકશાન વહેંચણીના પ્રમાણમાં બદલાવ કરવામાં આવે ત્યારે
- (૨) જ્યારે નવા ભાગીદારને ધંધામાં પ્રવેશ આપવામાં આવે ત્યારે
- (૩) જ્યારે કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીમાંથી નિવૃત્ત થાય ત્યારે
- (૪) જ્યારે ભાગીદારી પેઢીમાં મૂલ્ય થાય ત્યારે
- (૫) જ્યારે ભાગીદારી પેઢીનું વેચાણ કરવામાં આવે
- (૬) જ્યારે એક ભાગીદારી પેઢી બીજી કોઈ ભાગીદારી પેઢી સાથે જોડાણ કરે ત્યારે અને

- (૭) જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન ખૂબ જ અનિવાર્ય છે.
- (C) કંપનીઓમાં પાઘડીનું મૂલ્યાંકન: જ્યારે નીચે પ્રમાણે સંજોગો ઉદભવે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન જરૂરી છે.
- (૧) જ્યારે એક કંપનીનું બીજુ કંપની સાથે જોડાણ કરવામાં આવે ત્યારે
 - (૨) જ્યારે એક કંપની દ્વારા બીજુ કંપનીને ખરીદી લેવામાં આવે ત્યારે
 - (૩) જ્યારે ભૂતકાળમાં પાઘડીની કિંમત માંડી વાળી હોય અને તેજ કિંમતે પાઘડીની કિંમત કંપનીના ચોપડે દર્શાવવાની હોય ત્યારે
 - (૪) જ્યારે કંપનીના શેરનું અલગ-અલગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે

૫.૫ પાઘડીના પ્રકાર:

પાઘડીએ ધંધાની પ્રતિષ્ઠા છે. પાઘડી બજારમાં ગ્રાહકોને ધંધા તરફ આકર્ષે છે. પાઘડીએ બજારમાં ધંધો સારુ જ્યાતનામ ધરાવતો હોય તેનો આ એક કિંમતી લાભ છે. દરેક ધંધાની અલગ-અલગ પ્રકારની પાઘડી હોય છે. અને દરેક ધંધાની માલિકો પોતાની આવડત અને નફાને આધારે પાઘડીની કિંમતને નક્કી કરે છે. પાઘડીના ઘણાં બધા પ્રકારો છે. પરંતુ નીચે આપેલા પ્રકારો મુજબ છે.

(૧) (Dog) ડોગ પાઘડી:

જેમ આપણે જાણીએ છીએ કુતરુ એ પોતાના માલિકને ખૂબ જ વફાદાર પ્રાણી છે. તેવી જ રીતે પાઘડી પણ ધંધાને તથા ધંધાના માલિકને ખૂબ જ વફાદાર મિલકત છે. પાઘડીએ જગ્યા કરતાં અને ઉપસ્થિત કરતાં પણ વધારે સારી રીતે જોડાયેલી મિલકત છે. બજારમાં ઘણા બધા ધંધા એવા આવેલાં છે જે સંપૂર્ણ રીતે ફક્ત ધંધાના માલિકી ઉપર આધાર રાખતા હોય છે. આવા ધંધાની પાઘડીને ડોગ પાઘડી કહેવાથ છે. ઘણા બધા ગ્રાહકો એવા હોય છે જે ધંધા સાથે પોતાના માલિકની આવડત, કુશળતા અને જ્ઞાન ને કારણે જાડોયેલા હોય છે. દા.ત. વકીલો, ઇજનેરો, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ડૉક્ટરો વગેરે. આવા પ્રકારની પાઘડીને બીજા વ્યક્તિને આપવી કે વેચવી એ અશક્ય બાબત છે.

(૨) (Rabbit) રેબીટ પાઘડી:

પાઘડી એ એક સસલાની જેમ ખૂબ જ નીકરતાથી જોડાયેલી મિલકત છે. જેમ એક સસલુ પોતાના માલિક સાથે ખૂબ જ સનેહથી જાડાયેલું હોય છે. તેમ પાઘડી પણ ધંધાના માલિક તથા ધંધા સાથે જોડાયેલી હોય છે. માટે જ્યારે પાઘડીને એક જગ્યાએથી બીજુ જગ્યાએ વેચવામાં આવે ત્યારે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જય છે. કારણે આ પ્રકારની પાઘડી નજીકથી ધંધા સાથે જોડાયેલી હોય છે. માટે જ્યારે જગ્યા બદલવામાં આવે ત્યારે પાઘડીની મૂલ્યાં ઘણી વાક ઘટાડો પણ જોવા મળે છે. દા.ત. મુંબઈમાં આવેલ શુટીગના સ્ટુડીયો જો તેને બીજુ જગ્યાએ લઈ જવામાં આવે તો તેને નવું વાતાવરણ અનુકૂળ આવતું નથી. કારણે આ પ્રકારનો ધંધો ભારતમાં ત્યાંજ વધારે વિકસીત છે.

(૩) (CAT) કેટ પાઘડી:

આપણે જાણીએ છીએ એમ બીલાડીને તેના માલિક કરતા પોતાની રહેવાની જગ્યા વધારે વ્હાલી હોય છે. જે પાઘડી ધંધાના માલિક કરતા વધારે ધંધાને વધારે વફાદાર હોય તેને કેટ પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા ધંધા બજારમાં એવા હોય છે જેની પાઘડીની કિંમત ફક્ત જગ્યા ને કારણે જ હોય છે. જો ધંધાની જગ્યા બદલાઈ જાય તો તે ધંધાની પાઘડીની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. જેમ બીલાડી પોતાના માલિક

રહેણાણ માટે બીજુ જગ્યાએ જાય છતાં એ ત્યાં જ રહે છે. એવી જ રીતે ધંધાના ગ્રાહકો ધંધાનો ભાલિક ભલે બદલાય પણ વસ્તુની ખરીદી પોતાની જુની જગ્યાએથી જ કરે છે, કારણેકે એ જગ્યાએ એવું વાતાવરણ તીખુ થયેલું હોય છે જે ગ્રાહકને તે જગ્યા માટે આકર્ષે છે. આવા પ્રકારની પાદડીનું મૂલ્ય હંમેશા વધારે હોય છે. દા.ત. વદ્ધભ વિધાનગરમાં શિક્ષણ. જો અહીંની શાળા-કોલેજો બીજુ જગ્યાએ લઈ જવામાં આવે તો શાળા-કોલેજોનું પાદડીનું મૂલ્ય વદ્ધભવિધાનગરની સરખામણીએ ઘટે છે.

(૪) (RAT) રેટ પાદડી:

એક ઉંદર કચારેય પણ એક જગ્યાએ ટકી શકતો નથી તે આમ-તેમ હંમેશા ફર્યા જ કરે છે. તેમ જ જો ધંધો વારંવાર આમ-તેમ બદલાયા કરે તો આવી પાદડીને રેટ પાદડી કહે છે. જો ધંધાની પાદડીનું મૂલ્ય વારંવાર બદલાતું હોય તો તે ધંધાની પાદડીની બજારમાં કોઈ કિંમત ઉપજતી નથી. કારણેકે આવા પ્રકારના ધંધાઓ વારંવાર ધંધાનું સ્થાન, પ્રકાર વારંવરા બદલતા હોય છે. માટે ધંધો સ્થિર રહેતો નથી અને નફો પણ સ્થિર રહેતો નથી અને પાદડીનું મૂલ્ય પણ સ્થિર રહેતું નથી.

પ.ક સરેરાશ નફાની પદ્ધતિ:

આ પદ્ધતિ હેઠળલ પાછલાં વર્ષોનો સરેરાશ નફાના આધાર પર પાદડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

પાદડી : સરેરાશ નફો × ખરીદીના વર્ષ

ઉદાહરણ (૧):

દેવી, દિવ્યા અને ભાવના એક પેઢીના ભાગીદારો છે. તેઓ સરજે હિસ્સે નફો-નુકશાન વહેંચતા હતા. અમુક વર્ષો થતાં પાદડીની ગાળતરી કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારના કરાર મુજબ છેલ્ખાં પાંચ વર્ષના સરેરાશ નફાની ત્રણવર્ષની ખરીદીને આધારે પાદડીની કિંમત શોધો.

જવાબ:

વર્ષ	નફો
૨૦૧૩	૨૦૦૦
૨૦૧૪	૩૦૦૦
૨૦૧૫	૧૦૦૦
૨૦૧૬	૮૦૦૦
૨૦૧૭	૫૦૦૦
કુલ નફો =	૧૬૦૦૦

$$\text{સરેરાશ નફો} = \frac{\text{કુલ નફો}}{\text{કુલ વર્ષ}} = \frac{૧૬૦૦૦}{૫} = ૩. ૩૮૦૦$$

$$\text{પાદડી} = \text{સરેરાશ નફો} \times \text{ખરીદીના વર્ષ} = ૩૮૦૦ \times ૩ = \boxed{૩. ૧૧૪૦૦}$$

ઉદાહરણ (૨) :

ચિંતન, વીરલ અને મુક્તાનંદ એક પેઢીના ભાગીદારો છે. તેઓ ૩:૨:૧ માં નફો નુકશાન વહેંચે છે. નીચે આપેલી માહિતી પરથી પાદડીની કિંમત તેના ખરીદીના ૩ વર્ષને આધારે નક્કી કરવાની છે.

વર્ષ	નફો/ખોટ
૧	૩. ૨૦૦૦૦

२	₹. २४०००
३	₹. २५०००
४	(₹. १०००० जोट)
५	₹. ३००००

જવાબ:

$$\text{સરેરાશ નક્ષો} = \frac{\text{કુલ નક્ષો}}{\text{કુલ વર્ષ}}$$

$$= \frac{६००००}{५} = ₹. १२०००$$

$$\text{પાદડી} = \text{સરેરાશ નક્ષો} \times \text{જરીદીના વર્ષ}$$

$$= ₹. १२००० \times 3$$

$$= ₹. ३६०००$$

૫.૭ ભારિત સરેરાશ નક્ષાની પદ્ધતિ:

જ્યારે કંપનીનો સરેરાશ નક્ષો અમુક વધોથી સતત વધતો હોય ત્યારે સાચી સરેરાશ પદ્ધતિથી પાદડીની કિંમત નક્કી કરવામાં આવતી નથી પરંતુ તે સમયે પાદડીની કિંમત ભારિત સરેરાશ પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે.

ઉદાહરણ (૩):

તા. ૩૧-૦૩-૨૦૧૪ના રોજ પટેલ કંપનીનો ધંધો વાય.એમ.ડી. કંપની લિમિટેડ ખરીદવા માંગે છે. તેના માટે પાદડીની કિંમત ૪ વર્ષના આધારે નક્કી કરવી.

વર્ષ:	૨૦૧૦	૨૦૧૧	૨૦૧૨	૨૦૧૩	૨૦૧૪
નક્ષો:	૪૦૦૦૦	૫૦૦૦૦	૭૦૦૦૦	૬૦૦૦૦	૧૦૫૦૦૦

જવાબ:

વર્ષ	નક્ષો	ભાર	ભારિત નક્ષો
૨૦૧૦	૪૦૦૦૦	૧	૪૦૦૦૦
૨૦૧૧	૫૦૦૦૦	૨	૧૦૦૦૦૦
૨૦૧૨	૭૦૦૦૦	૩	૨૧૦૦૦૦
૨૦૧૩	૬૦૦૦૦	૪	૩૬૦૦૦૦
૨૦૧૪	૧૦૫૦૦૦	૫	૫૨૫૦૦૦
		કુલ ભાર = ૧૫	કુલ ભારિત નક્ષો = ૧૨૩૫૦૦૦

$$\text{કુલ સરેરાશ નક્ષો} = \frac{\text{કુલ ભારિત નક્ષો}}{\text{કુલ ભાર}}$$

$$= \frac{1234000}{14}$$

$$= \boxed{3. 82333.33}$$

પાધડી = સરેરાશ ભારિત નફો × ખરીદીના ખર્ચ
 = 82333.33 × 4
 = રૂ. 329333.33

ઉદાહરણ (૪):

તા. ૩૧-૦૩-૨૦૧૫ના રોજ ચિરાયુ, નારાયણ અને અંકિતની પેઢીનો નફો આપેલ છે. તે માહિતી પરથી ખરીદીના ૪ વર્ષને આધારે પાધડીની કિંમત નક્કી કરો.

વર્ષ:	૨૦૧૧	૨૦૧૨	૨૦૧૩	૨૦૧૪	૨૦૧૫
નફો:	૮૦૦૦૦	૬૦૦૦૦	૬૫૦૦૦	૧૦૨૦૦૦	૧૦૪૦૦૦

જવાબ:

વર્ષ	નફો	ભાર	ભારિત નફો
૨૦૧૧	૮૦૦૦૦	૧	૮૦૦૦૦
૨૦૧૨	૬૦૦૦૦	૨	૧૮૦૦૦૦
૨૦૧૩	૬૫૦૦૦	૩	૨૮૮૦૦૦
૨૦૧૪	૧૦૨૦૦૦	૪	૪૦૮૦૦૦
૨૦૧૫	૧૦૪૦૦૦	૫	૫૨૦૦૦૦
		કુલ ભાર = ૧૫	કુલ ભારિત નફો = ૧૪૭૬૦૦૦

સરેરાશ ભારિત નફો = $\frac{\text{કુલ ભારિત નફો}}{\text{કુલ ભાર}}$
 = $\frac{1476000}{15}$
 = $\boxed{રૂ. 98400}$

પાધડી = સરેરાશ ભારિત નફો × ખરીદીના ખર્ચ
 = ૯૮૪૦૦ × ૪
 = રૂ. 3૯૩૬૦૦

૫.૮ અધિક નફાની પદ્ધતિ:

અગાઉ દરવિલ પદ્ધતિ ફક્ત ધંધાના સરેરાશ/ચોખા નફાની ગણતરી પર આધાર રાખે છે જ્યારે આ પદ્ધતિ ધંધાના વધારાના એટલે કે અધિક નફો (Super Profit) ઉપર ધ્યાન રાખે છે.

અર્થ:

ધંધામાં મૂડી રોકવાથી પેઢીને જે નફો થાય છે તેને સામાન્ય રીતે ચોખ્ખો નફો કે સરેરાશ નફો ગણવામાં આવે છે. પરંતુ જ્યારે એટલી મૂડી બીજા ધંધામાં રોકવામાં આવે અને પહેલાની પેઢી કરતા વધુ નફો કમાઈ આપે ત્યારે તેને અધિક નફો કે વિશેષ નફો ગણવામાં આવે છે.

અધિક નફો એટલે એક પેઢીનાં સામાન્ય નફો અને એના અપેક્ષિત (ધારેલા) નફો વચ્ચેનો તફાવત

અધિક નફો = સામાન્ય નફો (સરેરાશ) - અપેક્ષિત નફો

પાદડીની કિંમત:

જ્યારે ધંધાના ચોખ્ખા નફભાંથી અપેક્ષિત નફો બાદ કરવામાં આવે ત્યારે અધિક નફો મળે છે. આટલો સરખો જ અધિક નફો નવી પેઢીને કમાતા જેટલા વર્ષ લાગે તેના વકે ગુણવામાં આવે છે અને જે કિંમત મળે તેને પાદડીની કિંમત તરીકે નક્કી કરવામાં આવે છે.

અધિક નફાની પદ્ધતિ મુજબ પાદડીની કિંમત શોધવાના જરૂરી પગલાઃ

- (૧) ધંધામાં રોકાયેલી મૂડી (કુલ મિલકતો - કુલ દેવા)
- (૨) અપેક્ષિત વળતરનો દર
- (૩) સરેરાશ ચોખ્ખો નફો
- (૪) અધિક નફો = સરેરાશ નફો - અપેક્ષિત નફો
- (૫) પાદડી = અધિક નફો × અમુક વર્ષ

ઉદાહરણ (૫):

મનન અને મંથનની પેઢીની પાઘડીની ગાળતરી કરવાની છે. જે માટે નીચેની માહિતી આપવામાં આવે છે.

- ભવિષ્યનો સરેરાશ નક્કો = રૂ. ૧૦૦૦૦૦
- ધંધામાં રોકાયેલી મૂડી = રૂ. ૫૦૦૦૦૦
- સામાન્ય અપેક્ષિત વળતર દર = ૧૦%
- ભાગીદારોનું મેહનતાણું = ૨૫૦૦૦ (વાર્ષિક)
- કરવેરાને અવગાણો.

ઉપરની વિગતો પરથી અધિક નફાથી પાંચ ગાળી પાઘડી શોધો.

જવાબ:

(૧)	રોકાયેલી મૂડી	૫૦૦૦૦૦
(૨)	રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતર (૧૦%)	૫૦૦૦૦
(૩)	સરેરાશ ચોખ્ઝો નક્કો = - ભાગીદારોનું મેહનતાણું =	૧૦૦૦૦૦ <u>૨૫૦૦૦</u> ૭૫૦૦૦
(૪)	અધિક નક્કો	= સરેરાશ નક્કો - અપેક્ષિત નક્કો = ૭૫૦૦૦ - ૫૦૦૦૦ = રૂ. ૨૫૦૦૦
(૫)	પાઘડી	= અધિકનક્કો × ૫ = ૨૫૦૦૦ × ૫ = રૂ. ૧૨૫૦૦૦

ઉદાહરણ (૬):

રેખા લિ. ગું પાકુ સરવૈચ્યું નીચે મુજબ હતું.

૩૧-૦૩-૨૦૧૮ના રોજનું પાકુ સરવૈચ્યુ

મૂડી-દેવાં	₹	મિલકત-લેખાં	₹
ઇકલીટી શેર મૂડી (દરેક ૧૦નો)	૯૦૦૦૦	પાઘડી	૫૦૦૦૦
અનામતો	૧૦૦૦૦	પ્લાન્ટ	૫૦૦૦૦
સેણાદારો	૨૫૦૦૦	ફર્નિચર	૨૫૦૦
દેવી હુંકી	૧૦૦૦૦	સ્ટોક	૪૦૦૦૦
ચૂકુવવાના બાકી ખર્ચ	૨૫૦૦	દેવાદારો	૨૦૦૦૦
		અગાઉથી ચૂકુવેલ ખર્ચ	૧૫૦૦
		રોકડ અને બેંક	૮૫૦૦
	૧૩૭૫૦૦		૧૩૭૫૦૦

વધારાની માહિતી:

- (૧) મિલકતોનું પુનઃ મૂલ્યાંકન નીચે પ્રમાણે કરવું.
 પ્લાન્ટ - ૫૫૦૦૦ સ્ટોક - ૪૩૫૦૦ ફર્નિચર - ૩૦૦૦ દેવાદારો - ૧૮૦૦૦
- (૨) છેષા ત્રણ વર્ષના અંતે કરવેશા પછીનો નફો અને ઉપયોગમાં લેવા યોગ્ય ભાર નીચે મુજબ છે.

વર્ષ	નફો	ભાર
૨૦૧૬	૧૫૦૦૦	૧
૨૦૧૭	૧૬૫૦૦	૨
૨૦૧૮	૧૫૫૦	૩

- (૩) આવા પ્રકારમાં ઘંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતરનો દર ૧૦% છે.
 અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીને આધારે પાદડીની કિંમત નક્કી કરવાની છે. ભૂતકાળમાં છેષા ત્રણ વર્ષના નફાની ભારિત નફાની ભારિત સરેરાશ નફાને દ્યાનમાં લઈને અધિક નફો ગણવાનો છે.

જવાબ:

- (૧) રોકાયેલી મૂડી:

મિલકતો

પ્લાન્ટ	- ૫૫૦૦૦
ફર્નિચર	- ૩૦૦૦
સ્ટોક	- ૪૩૫૦૦
દેવાદારો	- ૧૮૦૦૦
અગાઉથી ચૂકવેલ ખર્ચ	- ૧૫૦૦
રોકડ અને બેન્ક	- <u>૮૫૦૦</u>
	૧૨૮૫૦૦

બાદ: દેવા:

લેણાદારો	- ૨૫૦૦૦
દેવી હુંડી	- ૧૦૦૦૦
બાકી ખર્ચ	- <u>૨૫૦૦</u>
	૩૭૫૦૦

$$\text{ચોખ્ખી મિલકતો} = \text{રોકાયેલી મૂડી} = રૂ. ૧૨૦૦૦$$

$$\begin{aligned}
 (૨) \quad \text{અપેક્ષિત નફો} &= \text{રોકાયેલી મૂડી} \times \text{અપેક્ષિત નફાનો દર} \\
 &= ૧૨૦૦૦ \times 10\% \\
 &= રૂ. ૧૨૦૦
 \end{aligned}$$

- (૩) સરેરાશ નફો

વર્ષ	નફો	ભાર	ભારિત નફો
૨૦૧૬	૧૫૦૦૦	૧	૧૫૦૦૦
૨૦૧૭	૧૬૫૦૦	૨	૩૩૦૦૦
૨૦૧૮	૧૫૫૦૦	૩	૪૬૫૦૦
		કુલ ભાર = રૂ	કુલ ભારિત નફો = ૧૪૫૦૦

	સરેરાશ નફો	= ₹૪૫૦૦ / ૬
		= ₹. ૧૫૭૫૦
(૪)	અધિક નફો	= સરેરાશ નફો - અપેક્ષિત નફો
		= ૧૫૭૫૦ - ₹૨૦૦
		= ₹. ૧૩૭૫૦
(૫)	પાઘડી	= અધિક નફો × ૩
		= ₹૧૩૭૫૦ × ૩
		= ₹. ૪૧૨૫૦

ઉદાહરણ (૭):

પૂજા લિમિટેડનું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજનું પાકુ સરવૈયુ નીચે મુજબ છે.

મૂડી-દેવાં	₹	મિલ્કટ-લેણાં	₹
દરેક ₹.૧૦નો એક એવા ભરપાઈ થયેલા		પાઘડી	₹૨૨૪૦૦
ઇક્વિટી શેર	૩૨૦૦૦૦	મકાન	₹૮૬૦૦૦
પ્રેફરન્સ શેર (૧૦%)	૮૦૦૦૦	- ઘસારો	₹૪૦૦૦
અનામત અને વધારો	૮૯૦૦૦	યંત્રો	૮૮૬૦૦૦
૧૦%ના ડીવેચર્સ	૧૬૦૦૦૦	- ઘસારો	૫૬૦૦૦
લેણાદારો	૫૪૦૦૦	ફર્નિચર	૨૪૦૦૦
દેવીહંડી	૨૪૦૦૦	- ઘસારો	૪૦૦૦
કરવેરાની જોગવાઈ	૨૪૦૦	રોકાણો	
કારીગરન નફાભાગ ભંડોળ	૧૨૦૦૦	ગૌણા કંપનીના	
પ્રોવિડન્ડ ફંડ	૨૦૦૦૦	૧૦%ના રોકાણો	૨૦૦૦૦
		(દાર્શનિક કિંમત ₹૦૦૦૦	
		વ્યાજ કરમુક્ત છે.) ₹૮૦૦૦	૮૦૦૦
		દેવાદારો	
		- ધાલખાઈ અનામત _____	૮૨૮૦૦
		લેણીહંડી	૪૦૦૦૦
		સ્ટોક	૫૫૫૦૦
		રોકડ અને બેન્ક	૧૬૦૦૦
		અગાઉથી ચૂકવેલ ખર્ચ	૧૬૦૦
		કિલેન્ચર પર વટાવ	૧૬૦૦
	₹૦૦૦૦૦૦		₹૦૦૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) મકાન અને યંત્રોની હાલની બજાર કિંમત ₹૬૦૦૦૦૦ અને ₹૧૮૦૦૦૦ નક્કી થયેલ છે.
- (૨) આ કંપની જેવો ધંધો કરતા અને ૨૦% લેઝે ડિવિડન્ડ આપતી કંપનીના શેર બજારભાવ, તેની વસુલ કરતી કિંમત કરતા બે ગણા છે.
- (૩) ૫૦% લેઝે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો કંપનીનો છેદા ચાર વર્ષનો નફો આ મુજબ છે.

રૂ. ૧૪૦૮૦૦, રૂ. ૧૫૩૬૦૦, રૂ. ૧૪૭૨૦૦, રૂ. ૧૬૦૦૦૦

- (૪) ઉપરની વિગતો દ્વારાનાં લઈને તમારે કંપનીની પાદારીની કિંમત તેના અધિક નફાની ચાર વર્ષની ખરીદીને આધારે ગણવાની છે.

જવાબ:

- (૧) રોકાયેલી મૂડી:

મિલકતો	₹	દેવાં	₹
મકાન	૩૬૦૦૦૦	ડિબેંચર	૧૬૦૦૦૦
ચંત્રો	૨૦૮૦૦૦	લેણાદરો	૬૪૦૦૦
ફન્નિચર	૨૦૦૦૦	દેવીહંડી	૨૪૦૦૦
રોકાણો (ગૌણા)	૨૦૦૦૦	કરવેરાની જોગવાઈ	૨૪૦૦૦
દેવાદરો	૮૨૮૦૦	કારીગર નફાભાગ	૧૨૦૦૦
લેણીહંડી	૪૦૦૦૦	પ્રોવિસન્ડ ફંડ	૨૦૦૦૦
સ્ટોક	૭૫૬૦૦		
રોકડ	૧૬૦૦૦		
અગાઉથી ચુકવેલ ખર્ચ	૧૬૦૦૦		
	૮૨૪૦૦૦		

$$\text{કુલ મિલકતો} = ૮૨૪૦૦૦$$

$$- \text{ બાદ : દેવા} = ૩૦૪૦૦૦$$

$$\text{ચોખ્ખી મિલકતો} = ૫૨૦૦૦૦$$

$$\text{બાદ પ્રેફ. શેર} = ૮૦૦૦૦$$

$$\text{રોકાયેલી મૂડી} = ૪૪૦૦૦૦$$

$$(2) \text{ અપેક્ષિત વળતર} = \text{રોકાયેલી મૂડી} \times \text{વળતર} \\ = ૪૪૦૦૦૦ \times ૧૦\% \\ = રૂ. ૪૪૦૦૦$$

$$(3) \text{ સરેરાશ નફો} = \frac{૧૪૦૮૦૦ + ૧૫૩૬૦૦ + ૧૪૭૨૦૦ + ૧૬૦૦૦૦}{૪} \\ = \frac{૫૦૧૫૦૦}{૪}$$

$$= \frac{૫૦૧૫૦૦}{૪}$$

$$= રૂ. ૧૨૫૪૦૦$$

$$\text{બાદ : રોકાણોનું વ્યાજ} = ૬૦૦૦$$

$$રૂ. ૧૨૫૪૦૦$$

$$\text{બાદ : ૫૦\% લેખે કર} = ૭૨૨૦૦$$

જ્રારૂરી

આદ : પ્રેફરન્સ ડિવિડન્ડ = ₹૧૦૦૦

રૂ. ₹૫૪૨૦૦

$$\begin{aligned}
 (૪) \text{ અધિક નશો} &= \text{સરેરાશ નશો} - \text{અપેક્ષિત નશો} \\
 &= ₹૫૪૨૦૦ - ₹૪૪૦૦૦ \\
 &= રૂ. ₹૨૦૨૦૦
 \end{aligned}$$

$$\begin{aligned}
 (૫) \text{ પાધડી} &= \text{અધિક નશો} \times ૪ \\
 &= ₹૨૦૨૦૦ \times ૪ \\
 &= રૂ. ₹૮૦૮૦૦
 \end{aligned}$$

ઉદાહરણ (૮):

તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ મુક્તાનંદ અને વીરલ તિ. નું પાકુ સરવૈયુ નીચે મુજબ છે.

મૂડી - ટેવાં	₹	મિલ્કટ-લોણાં	₹
ઇકવીટી શેર	૭૫૦૦૦૦	જમીન મકાન	૧૫૦૦૦૦૦
૧૦% પ્રેફ. મૂડી	૭૫૦૦૦૦	થંત્રો	૬૦૦૦૦૦
સામાન્ય અનામત	૫૦૦૦૦૦	ફન્નિચર	૨૭૦૦૦૦
ડિવિડન્ડ અનામત	૧૫૦૦૦૦	૧૦% સરકારી જામીનગીરીમાં	
ડિવિડન્ડ પરતનિધિ	૧૫૦૦૦૦	રોકાણો (કરમુકત)	
કારીગર નફાભાગ ભંડોળ	૨૨૫૦૦૦	(મૂળ કિંમત ₹૧૫૦૦૦૦)	૧૩૫૦૦૦
કારીગર વળતર અકસ્માત	૭૫૦૦	ડિબેંચર પરત નિધિના રોકાણો	
૧૨%ના ડિબેંચર	૩૦૦૦૦૦	(દંધાકીય)	૧૫૦૦૦૦
ઘસારા ફેડ:		સ્ટોક	૩૦૦૦૦૦
જમીન મકાન	૨૨૫૦૦૦	દેવાદારો	૧૫૦૦૦૦
ફન્નિચર	૭૫૦૦૦	રોકડ સિલક	૩૦૦૦૦
થંત્રો	૭૫૦૦૦	પ્રાથમિક ખર્ચ	૩૧૫૦૦૦
લેણાદારો	૩૭૫૦૦૦		
	૩૭૫૦૦૦૦		૩૭૫૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) જમીન અને મકાનની બજારકિંમત રૂ. ₹૨૨૫૦૦૦૦ ગણાવી.
- (૨) થંત્રોની બજારકિંમત રૂ. ₹૫૦૦૦૦ ગણાવી.
- (૩) ૫૦% સ્ટોકની ૧૦% બજારકિંમત ઓછી છે.
- (૪) અંદાજીત નશાનો દર ૧૦% છે.
- (૫) છેલ્લા ત્રણ વર્ષનો ૫૦% કરવેરા પહેલાનો નશો નીચે મુજબ છે.

વર્ષ	નફો
૨૦૧૪-૧૫	૫૦૦૦૦૦
૨૦૧૫-૧૬	૮૨૫૦૦૦
૨૦૧૬-૧૭	૧૧૪૦૦૦૦

ઉપરની વિગતો પરથી અધિક નફાની ત્રણવર્ષની ખરીદીના આધારે ગણાતરી કરો.

જવાબ:

(૧) રોકયેલી મૂડી = કુલ ભિલકતો - કુલ દેવા

ભિલકતો	₹	દેવા	₹
જમીન મકાન	૨૨૫૦૦૦૦	કારીગર નફા ભાગ	૨૨૫૦૦૦
ચંત્રો	૭૫૦૦૦૦	૧૨%ના ડીબેંચર	૩૦૦૦૦૦
ફળાંચર	૧૮૫૦૦૦	લેણાદારો	૩૭૫૦૦૦
૧૦%ના ડીબેંચર પરત			૬૦૦૦૦૦
ના રોકાણો	૧૫૦૦૦૦		
સ્ટોક	૨૮૫૦૦૦		
દેવાદારો	૧૫૦૦૦૦		
રોકડ સિલક	૩૦૦૦૦		
	૩૮૧૦૦૦૦		

$$\begin{aligned}
 \text{ચોખ્ખી ભિલકતો} &= ૩૮૧૦૦૦૦ \\
 - \text{ દેવા} &= \underline{૬૦૦૦૦૦} \\
 &= \underline{\underline{૨૧૫૦૦૦૦}} \\
 \text{પ્રેફ. મૂડી} &= \underline{૭૫૦૦૦૦} \\
 &= \underline{\underline{૨૧૬૦૦૦૦}}
 \end{aligned}$$

$$\begin{aligned}
 (2) \quad \text{અપેક્ષિત નફો} &= \text{રોકયેલી મૂડી} \times \text{અંદાજીત નફાનો દર} \\
 &= ૨૧૬૦૦૦૦ \times ૧૦\% \\
 &= \underline{\underline{૨૧૬૦૦૦૦}}
 \end{aligned}$$

(3) ભારિત સરેરાશ નફો

વર્ષ	નફો	ભાર	ભારિત નફો
૨૦૧૪-૧૫	૫૦૦૦૦૦	૧	૫૦૦૦૦૦
૨૦૧૫-૧૬	૮૨૫૦૦૦	૨	૧૬૫૦૦૦૦
૨૦૧૬-૧૭	૧૧૪૦૦૦૦	૩	૩૪૨૦૦૦૦
		કુલ ભાર = ૬	કુલ ભારિત નફો = ૫૬૭૦૦૦૦

$$\text{ભારિત સરેરાશ નફો} = \frac{\text{કુલ ભારિત નફો}}{\text{કુલ ભાર}}$$

$$\begin{aligned}
 & = \frac{450000}{5} \\
 & = \text{₹. } 90000
 \end{aligned}$$

ભારિત નફો	= ₹90000
- બીજા ધંધાકીય રોકાણો નું વ્યાજ	<u>140000</u> $(140000 \times 10\%)$
	₹30000
- કરવેરાની જોગવાઈ (50%)	<u>70000</u>
	₹70000
- પ્રેફરન્સ શેર ડિવિડન્ડ	<u>70000</u>
	₹70000

(૪) અધિક નફો = સરેરાશ નફો - અપેક્ષિત નફો
 = ₹300000 - ₹150000
 = ₹. 150000

(૫) પાધડી = અધિક નફો \times ખરીદીના વર્ષ
 = ₹150000 \times 3
 = ₹. 450000

ઉદાહરણ (૬): મૌલિક ટ્રેડીંગ કંપની લિ. નું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પાકુ સરવૈચુ નીચે પ્રમાણે હતું.

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
ભરપાઈ થયેલી મૂડીઃ		પાધડી	150000
૫૦૦૦૦ શેર દરેક ₹. ૧૦નો		જમીન મકાન	૧૨૦૦૦૦
ભરપાઈ થયેલ	૫૦૦૦૦૦	પ્લાન્ટ-મશીનરી	૨૦૦૦૦૦
બેંક ઓપરફ્રાફ્ટ	૧૧૫૦૦૦	સ્ટોક	૨૦૦૦૦૦
લેણાદારો	૧૮૧૦૦૦	દેવાદારો	૨૦૦૦૦૦
કરવેરાની જોગવાઈ	૩૦૦૦૦	- ધા. અમાભત	<u>૨૦૦૦૦</u>
નફોનુકશાન ફાળવણી	૧૧૪૦૦૦	બેંક સિલક	૧૦૦૦૦૦
	<u>૮૫૦૦૦૦</u>		<u>૮૫૦૦૦૦</u>

વધારાની માહિતી:

- (૧) કંપનીએ પોતાનો ધંધો ₹. ૫૦૦૦૦૦ની ભરપાઈ થયેલી મૂડીથી શરૂ કર્યો હતો.
- (૨) છેદા પાંચ વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો નફો-નુકશાન નીચે પ્રમાણે હતા.

વર્ષ	નફો
૨૦૧૨-૧૩	(૪૦૦૦૦)
૨૦૧૩-૧૪	૮૮૦૦૦
૨૦૧૪-૧૫	૧૨૩૦૦૦

૨૦૧૫-૧૬	૧૧૫૦૦૦
૨૦૧૬-૧૭	૧૩૦૦૦૦

- (૩) વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન કંપનીમાં લાંબો સમય હડતાળ ચાતી હતી.
- (૪) આવકયેરા ૫૦% દરે ચુકવવો પડે તેમ છે.
- (૫) રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% છે. જમીન મકાનની હાલની બજાર કિંમત રૂ. ૨૪૦૦૦૦ છે. આ કિંમતના આધારે ઘસારો રૂ. ૨૦૦૦૦ દ્યાનમાં લેવો પડશે.
- (૬) હવે પણીના પાંચ વર્ષ દરમિયાન કંપનીને થયેલ કરાર અનુસાર માલસામાનના ખર્ચમાં રૂ. ૬૦૦૦૦ની વાર્ષિક બચત થાય તેમ છે.
ઉપરની વિગતોને દ્યાનમાં લઈને તમારે કંપનીની પાદારીની કિંમત તેના અધિકનફાની ગણવાની ખરીદીને આધારે ગણવાની છે.

નોંધ:

- (૧) અહીં પાંચ વર્ષ માટે કંપનીનો નફો/ખોટ આપ્યા છે. પરંતુ તે લાંબો સમય હડતાળ ચાતી હતી તેથી તે વર્ષનો કંપનીનો નફો કે ખોટ અસામાન્ય ગણવાય અને તેને કંપનીના સરેરાશ નફો ગણતાં દ્યાનમાં લેવાશે નહીં. તેથી ફક્ત છેદા ચાર વર્ષના નફાને સરેરાશ ગણવાશે.
- (૨) જમીન મકાનની હાલની કિંમતને આધારે રૂ. ૨૦૦૦૦ ઘસારો ગણવાનો છે. તેથી સરેરાશ નફો ગણતા તે બાદ થશે.
- (૩) કંપનીને પાંચ વર્ષ દરમિયાન માલસામાનના ખર્ચમાં રૂ. ૬૦૦૦૦નો ફાયદો થશે તેથી સરેરાશ નફો ગણતા આ રકમ તેમાં ઉમેરાશે.

જવાબ:

- (૧) રોકાયેલી મૂડીની ગણતરી:

મિલકતો	₹	દેવા	₹
જમીન મકાન	૨૪૦૦૦૦	લેણાદારો	૧૮૧૦૦૦
પ્લાનટ મશીનરી	૨૦૦૦૦૦	કરવેરાની જોગવાઈ	૩૬૦૦૦
સ્ટોક	૨૦૦૦૦૦	બેંક ઓપરફ્રાફ્ટ	૧૧૫૦૦૦
દેવાદારો	૧૮૦૦૦૦		૩૩૬૦૦૦
બેંક	૧૦૦૦૦૦		
	૮૨૦૦૦૦		

રોકાયેલી મૂડી = કુલ મિલકતો - કુલ દેવા
= ૮૨૦૦૦૦ રૂ. ૩૩૬૦૦૦
= રૂ. ૫૮૪૦૦૦

(૨) અપેક્ષિત નફો = રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર
= ૫૮૪૦૦૦ × ૧૦%
= રૂ. ૫૮૪૦૦

(3)

$$\text{સરેરાશ નફો} = \frac{66000 + 123000 + 115000 + 130000}{4}$$

$$= રૂ. 114250$$

$$- \quad \text{વધારાનો ઘસારો \qquad \qquad 20000}$$

$$+ \text{ માલસમાનમાં બચત \qquad \qquad \underline{50000}}$$

$$154250$$

$$\text{બાદ : } 50\% \text{ કર \qquad \qquad \underline{77125}}$$

$$\text{સરેરાશ નફો \qquad \qquad \underline{77125}}$$

$$(4) \quad \text{અધિકનફો} = \text{સરેરાશ નફો} - \text{અપેક્ષિત નફો}$$

$$= 77125 - 48400$$

$$= રૂ. 18725$$

$$(5) \quad \text{પાયડી} = \text{અધિકનફો} \times 3$$

$$= 18725 \times 3$$

$$= રૂ. 56175$$

ઉદાહરણ (૧૦):

નીચેની વિગતો પરથી છેક્ષા ત્રણ વર્ષના અધિક નફાની રૂ વર્ષની ખરીદીના આધારે પાયડીની ગણતરી કરો.

મૂડી-ટેવાં	₹	મિલકત-લેણાં	₹
૫% પ્રેફ. શેર મૂડી	૨૦૦૦૦૦	સ્થિર મિલકતો	૭૨૦૦૦૦
ઇક્વિટી શેર મૂડી	૬૦૦૦૦૦	ચાલુ મિલકતો	૩૦૦૦૦૦
સામાન્ય અનામત	૫૦૦૦૦	રોકાણો:	
નફાનુકશાન ખાતુ	૮૦૦૦૦	દંધાકીય	૮૦૦૦૦
કરવેરા જોગવાઈ	૪૦૦૦૦	બીન દંધાકીય	૧૬૦૦૦
કાચભી મિલકતો પર ઘસારો	૩૦૦૦૦	અવાસ્તવિક મિલકતો	૮૪૦૦૦
પ્રોવિડન્ડ ફંડ	૫૦૦૦૦		
અન્ય ચાલુ જવાબદારીઓ	૧૪૦૦૦૦		
	૧૨૦૦૦૦૦		૧૨૦૦૦૦૦

અન્ય માહિતી: (કંપનીની કુલ મિલકતો નીચે મુજબ છે.)

- (૧) સ્થિર મિલકતો કુલ મિલકતોના ૫૦% છે.
- (૨) ચાલુ મિલકતો કુલ મિલકતોના ૨૫% છે.
- (૩) રોકાણો કુલ મિલકતના ૮% છે.
- (૪) અવાસ્તવિક મિલકતો કુલ મિલકતોના ૭% છે.
- (૫) કુલ મિલકતોના ૮% રોકાણોમાં રૂ. ૧૬૦૦૦ બિનદંધાકીય રોકાણો છે.
- (૬) સ્થિર મિલકતોની બજાર કિંમત ચોપકેક્ઝિમત કરતા ૧૦% વધુ છે. જ્યારે ચાલુ મિલકતોની બજાર કિંમત કરતાં રૂ. ૩૦૦૦૦ વધુ છે.

- (૭) રોકાણો પર વળતરનો દર ૧૦% છે.
 (૮) છેદાં ત્રણાં વર્ષનો કુલ નફો (૫૦% કરવેરા પહેલા) ૩. ૧૫૦૦૦૦૦
 સામાન્ય અપેક્ષિત વળતરનો દર ૧૫%
 રોકાયેલી મૂડી પર જોખમનો દર ૫%

(સ.પ.ચુ., ૨૦૧૨)

જવાબ:

(૧)	રોકાયેલી મૂડી:-	
	કુલ મિલકતો:	
	કાથમી મિલકતો (૭૨૦૦૦૦ - ૩૦૦૦૦ (ઘસારો)) = ૫૬૦૦૦૦ + ૧૦% વધારો)	૭૫૬૦૦૦
	ચાલુ મિલકતો (૩૦૦૦૦૦ + ૩૦૦૦૦)	૩૩૦૦૦૦
	રોકાણો	૮૦૦૦૦
		૩. ૧૧૬૦૦૦

બાદ:કુલ જવાબદારી	
કરવેરાની જોગવાઈ	૪૦૦૦૦
પ્રો. ફેડ	૫૦૦૦૦
અન્ય ચાલુ જવાબદારી	૧૪૦૦૦૦
	૨૪૦૦૦૦
	૮૨૬૦૦૦
- ૫% પ્રેફરન્સ મૂડી	૨૦૦૦૦૦
રોકાયેલી મૂડી	૩. ૭૨૬૦૦૦

(૨) અપેક્ષિત નફો = રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર
 = ૭૨૬૦૦૦ × ૨૦%
 = ૩. ૧૪૫૦૦૦

(૩)

$$\text{સરેરાશ ભારિત નફો} = \frac{\text{કુલ નફો}}{\text{કુલ વર્ષ}} = \frac{૧૫૦૦૦૦૦}{૩} = ૫૦૦૦૦૦$$

કરવેરા પહેલાનો નફો	= ૫૦૦૦૦૦
- ૫૦% કરવેરાની જોગવાઈ	= ૨૫૦૦૦૦૦
	૨૫૦૦૦૦
- દંધાકીય રોકાણોનું વ્યાજ (૧૫૦૦૦૦ × ૧૦%)	૧૬૦૦
- ૫૦% કરવેરા	૮૦૦
	૮૦૦
	૨૪૮૨૦૦
- પ્રેફરન્સ શેર ડિવિડન	૧૨૦૦૦
	૧૨૦૦૦
	૨૩૭૨૦૦

(૪) અધિક નફો = સરેરાશ ભારિત નફો - અપેક્ષિત નફો
 = ૨૩૭૨૦૦ - ૧૪૫૮૦૦
 = ૩. ૮૧૪૦૦

$$\begin{aligned}
 (4) \quad \text{પાદડી} &= \text{અધિક નફો} \times \text{ખરીદીના વર્ષ} \\
 &= ₹ १४०० \times ४ \\
 &= ₹. ३६५०००
 \end{aligned}$$

ઉદાહરણ (૧૧):

બાદલ લિ. નું તા. ૩૧-૦૩-૨૦૦૩નું પાકુ સરવૈયુ નીચે મુજબ છે.

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
૫૦૦ ઇકલીટી શેર દરેક		પાદડી	૧૪૦૦૦
રૂ. ૧૦૦નો પૂરો ભરાયેલા	૧૫૦૦૦૦	કાયમી મિલકતો	૨૮૦૦૦૦
૧૦%ના રૂ૦૦ પ્રે. શેર રૂ.૧૦૦ ના		રોકાણો (બિનધંધાકીય)	
પૂરા ભરાયેલ	૮૦૦૦૦	(૧૦% સરકારી લોન દાર્શનિક	
અનામત અને વધારો	૧૨૫૦૦૦	કિંમત રૂ. ૩૦૦૦૦ બ્યાજ મુક્ત)	૨૫૦૦૦
૮%ના ડિઝેન્યર	૫૦૦૦૦	ચાલુ મિલકતો	૧૦૦૦૦૦
લેણાદારો	૨૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૧૫૦૦૦
કાર્યીગર નફાભાગ ભંડોળ	૫૦૦૦	ડિઝેન્યર વટાવ	૫૦૦૦
કરવેરાની જોગવાઈ	૧૦૦૦૦		
	૪૪૦૦૦૦		૪૪૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) કાયમી મિલકતોની હાલની બજાર કિંમત રૂ. ૧૮૫૦૦૦ છે. જ્યારે બાકીની મિલકતોની ચોપડે દરશવિલ કિંમત લેવાની છે.
- (૨) અપેક્ષિત ડિવિડન્ડનો દર ૧૦% છે.
- (૩) ૫૦% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો કંપનીનો છેદ્ધા ચાર વર્ષનો નફો નીચે મુજબ છે.
રૂ. ૭૨૪૦૦, રૂ. ૭૪૮૦૦, રૂ. ૭૦૬૦૦, રૂ. ૮૩૦૦૦

તમારે કંપનીની પાદડીની કિંમત તેના અધિક નફાની ચાર વર્ષની આધારે ગણાવાની છે.

(સ.પ.યુ., ૨૦૧૭)

જવાબ:

(૧) રોકાયેલી મૂડી:	
કાયમી મિલકતો	૧૮૫૦૦૦
ચાલુ મિલકતો	<u>૧૦૦૦૦૦૦</u>
	૨૮૫૦૦૦
- બાદ: જવાબદારી	
૮%ના ડિઝેન્યર	૫૦૦૦૦
લેણાદારો	૨૦૦૦૦
કા.ન.ભાગ ભંડોળ	૫૦૦૦
કરવેરા જોગવાઈ	<u>૧૦૦૦૦</u>
	૮૫૦૦૦
ચોખ્ખી મિલકતો	<u>૨૦૦૦૦૦</u>

	- પ્રેફરન્સ શેરમૂડી	<u>₹0000</u>
	રોકાયેલી મૂડી	₹. १२००००
(૨)	અપેક્ષિત નફો	= રોકાયેલી મૂડી × અંદાજુક નફો
		= ₹ १२०००० × ૧૦%
		= ₹. ૧૨૦૦૦૦
(૩)		
	સરેરાશ નફો = $\frac{\text{કુલ નફો}}{\text{કુલ વર્ષ}} = \frac{72400 + 74800 + 70500 + 73000}{4} =$	₹. ૭૫૨૦૦

	સરેરાશ નફો	૭૫૨૦૦
	- બિનદુંધાકીય રોકાણોનું વ્યાજ (૩૦૦૦૦ × ૧૦%)	<u>૩૦૦૦</u>
	સરેરાશ નફો (કરવેરા પહેલાનો)	૭૨૨૦૦
	- ૫૦% કરવેરાની જોગવાઈ	<u>૩૬૧૦૦</u>
		૩૬૧૦૦
	- પ્રેફરન્સ શેરમૂડી	<u>૮૦૦૦</u>
	સરેરાશ નફો	૨૮૧૦૦
(૪)	અધિક નફો	= સરેરાશ નફો - અપેક્ષિત નફો
		= ૨૮૧૦૦ - ૧૨૦૦૦
		= ₹. ૧૬૧૦૦
(૫)	પાઘડી	= અધિક નફો × ખરીદીના વર્ષ
		= ૧૬૧૦૦ × ૪
		= ₹. ૬૪૪૦૦

ઉદાહરણ (૧૨):

નમન અને દર્શાન લિ. નું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજનું પાકુ સરવૈયુ નીચે મુજબ છે.

મૂડી-દેવાં	₹	મિલકત-લોણાં	₹
₹. ૧૦૦નો એક એવા ૪૦૦૦ ૧૦%ના પ્રેફરન્સ શેર	૪૦૦૦૦૦	મકાન મૂળ કિંમત	૫૨૦૦૦૦
₹. ૧૦નો એક એવા ૧૬૦૦૦૦ ઇકવીઠી શેર સામાન્ય અનામત	૧૬૦૦૦૦૦	ફર્નિચર મૂળ કિંમત	૪૦૦૦૦
<u>નફો-નુકશાન ખાતે:</u>		સ્ટોક	૧૮૦૦૦૦૦
૨૦૧૫-૧૬: ૩૨૦૦૦૦		૫%ની સરકારી જામીનગીરી (દાર્શનિક કિંમત ૧૬૦૦૦૦૦ વ્યાજ મુક્ત છે)	૧૫૨૦૦૦૦
૨૦૧૬-૧૭: <u>૧૭૨૦૦૦૦</u>	૨૦૪૦૦૦૦	દેવાદારો ૧૦૦૦૦૦૦	
<u>ઘસારા ફક્ત:</u>		- ધા. અનામત <u>૮૦૦૦૦</u>	૮૦૦૦૦
મકાન <u>૮૦૦૦૦</u>		લોણીહુંકી	૪૦૦૦૦
રોકાણો <u>૧૪૦૦૦૦</u>	૧૪૦૦૦૦	રોકડ અને બેંક	૧૪૦૦૦૦

લેણાદરો	૧૪૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૨૦૦૦૦
	૫૦૦૦૦૦૦		૫૦૦૦૦૦૦

નીચેની મહિતીને ધ્યાનમાં લઈને તમારે પાદડીની કિંમત તેના અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીને આધારે ગણવાની છે.

- (૧) મકાનની આજે ઉપજ કિંમત રૂ. ૬૦૦૦૦૦ ગણાય.
- (૨) આજ પ્રકારનો ધંધો કરતી કંપનીઓ તેમના શેરની બજાર કિંમત પર ૨૦% નફો કરે છે.
- (૩) છેદા ત્રણ વર્ષના નફા વાર્ષિક રૂ. ૧૨૦૦૦૦ લેખે વધી રહ્યો છે.
- (૪) ૨૦૧૫-૧૭નો નફો ઉપર જણાવેલ છે તે કરવેરા પહેલાનો છે. કરવેરાનો દર ૫૦% ગણો.
- (૫) સરેરશ નફાની ગણતરી માટે ભાર ૧,૨,૩ આપવાનો છે.

જવાબ:

$$(1) \text{ રોકાયેલી મૂડી} = \text{કુલ ભિલકતો} - \text{કુલ દેવા}$$

કુલ ભિલકતો	₹	કુલ દેવા	₹
મકાન	૬૦૦૦૦૦	લેણાદરો	૧૪૦૦૦૦
ફન્નીચર	૪૦૦૦૦	કરવેરાની જોગવાઈ	
સ્ટોક	૧૮૦૦૦૦૦	(ચા.વ.નો નફો રૂ. ૧૭૨૦૦૦૦ના ૫૦%)	૮૬૦૦૦૦
દેવાદરો	૬૨૦૦૦૦		
લેણીહૂંડી	૪૦૦૦૦		
શેકડ-બેંક	૧૪૦૦૦૦		
	૩૮૪૦૦૦૦		૧૦૦૦૦૦૦

$$\text{ચોખ્ખી ભિલકતો} = ૩૮૪૦૦૦૦ - ૧૦૦૦૦૦૦$$

$$= ૩૮૪૦૦૦૦ - ૧૦૦૦૦૦૦$$

$$= ૨૪૪૦૦૦૦$$

$$- \text{બાદ : પ્રે.શેર મૂડી} = ૪૦૦૦૦૦$$

$$(2) \text{ અપેક્ષિત નફો} = \text{રોકાયેલી મૂડી} \times \text{અપેક્ષિત વળતરનો દર}$$

$$= ૨૪૪૦૦૦૦ \times ૨૦\% = રૂ. ૪૮૦૦૦૦$$

$$(3) \text{ સરેરશ નફો}$$

વર્ષ	નફો	ભાર	ભારિત નફો
૨૦૧૪-૧૫	૧૪૮૦૦૦૦	૧	૧૪૮૦૦૦૦
૨૦૧૫-૧૬	૧૫૦૦૦૦૦	૨	૩૦૦૦૦૦
૨૦૧૬-૧૭	૧૭૨૦૦૦૦	૩	૫૧૬૦૦૦
		કુલ ભાર = ૬	કુલ ભારિત નફો = ૬૮૪૦૦૦૦

$$\text{સરેરાશ નકો} = \frac{\text{ભારિત નકો}}{\text{કુલ નકો}} = \frac{₹ ८००००}{૫} = ₹. ૧૬૦૦૦૦$$

સરેરાશ નકો	₹ १६૦૦૦૦
બાદ: બિનદંધાકીય રોકાણોનું	
વ્યાજ (કર મુક્ત)	₹ ૦૦૦૦
	₹ ૧૫૬૦૦૦૦
બાદ: કરવેરા (૫૦%)	₹ ૭૮૦૦૦૦
	₹ ૭૮૦૦૦૦
બાદ: પ્રેફરન્સ ડીવીડન્ડ	₹ ૪૦૦૦૦
સરેરાશ નકો	₹ ૭૪૦૦૦૦

- (૪) અધિક નકો = સરેરાશ નકો - અપેક્ષિત નકો
= ₹ ૭૪૦૦૦૦ - ₹ ૮૮૦૦૦૦
= ₹. ૨૫૨૦૦૦
- (૫) પાદડી = અધિક નકો × ૩
= ₹ ૨૫૨૦૦૦ × ૩
= ₹. ૭૫૬૦૦૦

ઉદાહરણ (૧૩):

પાયલ અને કલ્પના લિમિટેડનો મહેતા લિમિટેડમાં સમાવેશ કરવાનો છે. બે કંપનીઓએ એવું નક્કી કર્યું છે કે પાદડીની કિંમત દ્વારાના ૩ વર્ષના અધિકનફાળી સરેરાશથી ગાળવી. કંપનીના નવા બોર્ડ ઓફ ડાયરેક્ટરને તેમની સેવાની કિંમત ₹. ૨૫૦૦ વાર્ષિક લેખે આપવામાં આવશે. (કુલ બે ડાયરેક્ટર્સ)
નીચેની માહિતી પરથી પાદડીની રકમ નક્કી કરો.

વિગત	રૂ.
૫૦૦ કર્ચના કચુભુલેટીવ પ્રેફરન્સ શેર દરેક ₹. ૧૦૦નો	૫૦૦૦૦
૨૦૦૦ ઈક્વિટી શેર દરેક ₹. ૧૦૦નો	૨૦૦૦૦૦
નક્કા-ગુંજશાન ખાતુ (જમા)	૧૫૦૦૦
સામાન્ય અનામંત	૧૦૦૦૦
અન્ય દેવા	૨૩૦૦૦
પ્રોવિડન્ડ ફંડ	૨૦૦૦
છેદા ચાર વર્ષનો નકો (૫૦% કરવેરા પહેલાનો)	૩૨૦૦૦૦
સામાન્ય અપેક્ષિત દર	૮%
દ્વારામાં રોકાયેલ મૂડી પર જોખમનો દર	૨%

અવાસ્તાવિક મિલકતો કુલ મિલકતોના ૧૦% હતી જ્યારે કાયમી મિલકતો કુલ મિલકતોના ૮૦% હતી. કાયમી મિલકતોની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં ૨૦% વધુ છે. જ્યારે ચાલુ મિલકતો ₹. ૩૦૦૦ જેટલી વધુ આંકડામાં આવી છે.

જવાબ:

કુલ મિલકતો આપી નથી જે શોધવા સૌપ્રથમ પાકુ સરવૈયું બનાવવું પડે.

પાકુ સરવૈયું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
પ્રેફરન્સ શેર મૂડી	૫૦૦૦૦	કુલ મિલકતો:	
ઇકવીટી શેર મૂડી	૨૦૦૦૦૦	કાયમી મિલકતો (૮૦%)	૨૪૦૦૦૦
સામાન્ય અનામત	૧૦૦૦૦	ચાલુ મિલકતો	૩૦૦૦૦
નફા-નુકશાન ખાતુ	૧૫૦૦૦	અવાસ્તવિક મિલકતો	૩૦૦૦૦
અન્ય દેવા	૨૩૦૦૦		
પ્રોવિડન્ડ ફંડ	૨૦૦૦		
	૩૦૦૦૦૦		૩૦૦૦૦૦

પાદકીની ગણતરી:

(૧) ઘંધામાં રોકાયેલી મૂડીઃ

કાયમી મિલકતો	૨૪૦૦૦૦
+ વધારો (૩૦%)	<u>૮૮૦૦૦૨૮૮૦૦૦</u>
ચાલુ મિલકતો	૩૦૦૦૦
- વધારે આક્ષેલ	<u>૩૦૦૦ ૨૭૦૦૦</u>
બાદ:	
દેવા	૨૩૦૦૦
પ્રોવિડન્ડ ફંડ	<u>૨૦૦૦</u>
	૨૫૦૦૦

ચોખી મિલકતો **૨૬૦૦૦૦**

બાદ: પ્રેફરન્સ શેર મૂડી **૫૦૦૦૦**
રોકાયેલી મૂડી **૩. ૨૪૦૦૦૦**

$$\begin{aligned}
 (2) \quad \text{અપેક્ષિત નફો} &= \text{રોકાયેલી મૂડી} \times \text{અપેક્ષિત વળતરનો દર} \\
 &= ૨૪૦૦૦૦ \times ૧૦\% \\
 &= ૩. ૨૪૦૦૦
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{નોંધ:-} \quad \text{અપેક્ષિત વળતરનો દર} &= \text{વળતરનો દર} + \text{જોખમનો દર} \\
 &= ૮\% + ૨\% \\
 &= ૧૦\%
 \end{aligned}$$

(3)

$$\begin{aligned}
 \text{સરેરાશ નફો} &= \frac{\text{ચાર વર્ષનો કુલ}}{\text{નફો}} = \frac{૩૨૦૦૦૦}{૪} \\
 &= ૩. ૮૦૦૦૦
 \end{aligned}$$

$$\text{બાદ: ડિરિક્ટ ફી} (૨ \times ૨૫૦૦) = ૫૦૦૦$$

૭૫૦૦૦

$$\text{બાદ: કરયેરાની જોગવાઈ (૫૦\%)} = ૩૭૫૦૦$$

બાદ: પ્રેફરન્સ ડીવીડન્ડ	37500
સરેરાશ નષ્ટો	<u>3000</u>
	= રૂ. 34500

(૪) અધિક નષ્ટો	= સરેરાશ નષ્ટો - અપેક્ષિત નષ્ટો
	= 34500 - 24000
	= રૂ. 10500

(૫) પાધડી	= અધિક નષ્ટો × 3
	= 10500 × 3
	= રૂ. 31500

ઉદાહરણ (૧૪):

કરન લિમિટેડનું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

પાકું સરવૈયું

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
દરેક રૂ. 10નો તેવા ઇક્વાટી શેર		પાધડી	30000
પૂરા ભરપાઈ થયેલ	500000	જમીન મકાન	404000
દરેક રૂ. 10નો તેવા 10% પ્રેફરન્ડસ		- ઘસારો	<u>20000</u>
શેર પૂરા ભરપાઈ થયેલ	490000	યંત્રો	562000
સામાન્ય અનામત	150000	- ઘસારો	<u>115000</u>
નષ્ટા-નુકશાન ખાતું	20000	ફર્નિચર	40000
12%ના ડીબેંચર	500000	- ઘસારો	<u>10000</u>
લેણાદરો	322000	રોકાણો:	
ટેવીહૂંડી	15000	પ્રોવીડન્ડ ફંડમાં	20000
પ્રોવીડન્ડ ફંડ	20000	10%ના ડીબેંચર	
ચૂકવવાના બાકી ખર્ચો	5000	(દાર્શનિક કિંમત 200000 વ્યાજ કરાત્ર છે)	250000
		સ્ટોક	304000
		દેવાદારો	480000
		ઘા. અનામત (૬)	48000
		લેણીહૂંડી	22000
		રોકડ અને બેંક	48000
		અગાઉથી ચૂકવેલ ખર્ચો	12000
		પ્રાથમિક ખર્ચો	5000
	2160000		2160000

વધારાની માહિતી:

(૧) જમીન અને મકાન તથા યંત્રોની હાલની બજાર કિંમત અનુક્રમે રૂ. 575000 તથા રૂ. 432000 છે.

- (2) અપેક્ષિત વળતરનો દર ૧૫% છે.
 (3) ૫૦% લેખે કર બાદ કર્વા પણીનો કંપનીનો છેદા અણ વર્ષનો નફો તથા ઉપયોગમાં લેવાના યોગ્ય ભાર નીચે મુજબ છે.

વર્ષ	નફો	ભાર
૧	૧૬૦૪૦૦	૧
૨	૧૬૮૮૦૦	૨
૩	૧૭૭૬૦૦	૩

ઉપરની વિગતો દ્વારાનમાં લઈને છેદા અણ વર્ષના નફાની ભારિત સરેરાશ દ્વારાનમાં લઈને ચાર વર્ષની ખરીદીના આધારે તમારે પાદારીની કિંમત આંકડાની છે.

જવાબ:

રાકોચાલી મૂડી = મિલકતો - જવાબદારીઓ

મિલકતો:

જમીન મકાન	૫૭૬૦૦૦
ચંત્રો	૪૩૨૦૦૦
ફર્નિચર	૩૦૦૦૦
પ્રો. ફંડના રોકાણો	૮૦૦૦૦
સ્ટોક	૩૦૪૦૦૦
દૈવાદારો	૪૫૨૦૦૦
લેણીહુંકી	૮૮૦૦૦
રોકડ	૪૮૦૦૦
અગાઉથી ચૂકવેલ ખર્ચ	૧૨૦૦૦
	રૂ. ૨૦૨૨૦૦૦

બાદ: દેવા:

ડીવેચર	૫૦૦૦૦૦
લેણાદારો	૩૮૮૦૦૦
દેવીહુંકી	૧૬૦૦૦
પ્રો. ફંડ	૮૦૦૦૦
ચૂકવવાના બાકી ખર્ચ	૫૦૦૦
	રૂ. ૬૬૦૦૦૦

$$\text{ચોખી મિલકતો} = ૨૦૨૨૦૦૦ - ૬૬૦૦૦૦$$

$$= રૂ. ૧૦૩૨૦૦૦$$

$$- \text{પ્રેફરન્સ શેર} = \frac{૪૬૦૦૦૦}{૫૭૨૦૦૦}$$

$$(2) \quad \text{અપેક્ષિત નફો} = \text{રોકાચેલી મૂડી} \times \text{અપેક્ષિત વળતરનો દર} = ૫૭૨૦૦૦ \times ૧૫\% = રૂ. ૮૫૮૦૦$$

(3) સરેરાશ નફો (કરબાદ)

નફો	ભાર	ભારિત નફો
૧૫૦૪૦૦	૧	૧૫૦૪૦૦
૧૬૮૮૦૦	૨	૩૩૭૬૦૦
૧૬૭૯૦૦	૩	૫૮૨૯૦૦

કુલ ભાર = ૫ કુલ ભારિત નફો = ૧૦૬૦૮૦૦

સરેરાશ નફો

સરેરાશ નફો	૧૦૬૦૮૦૦	
=	૫	રૂ. ૧૮૧૬૦૦

બાદ: ડિઝેન્યર વ્યાજ

(૨૦૦૦૦ × ૧૦%) ૨૦૦૦૦ (૫૦% કર બાદ)	<u>૧૦૦૦૦</u>
	૧૭૧૬૦૦

બાદ: પ્રેફરન્સ ડિલીડન્ડ

નફો	<u>૪૭૦૦૦</u>
	૧૨૫૮૦૦

(4) અધિક નફો = સરેરાશ નફો - અપેક્ષિત નફો

$$= ૧૨૫૮૦૦ - ૮૫૮૦૦ = રૂ. ૪૦૦૦૦$$

(5) પાધડી = અધિક નફો × ૪ = ૪૦૦૦૦ × ૪ = રૂ. ૧૬૦૦૦૦

ઉદાહરણ (૧૬):

નીચેની માહિતી એમ.આર.એફ. લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે.

(૧) સરેરાશ રોકાયેલી મૂડી = ૧૨૫૨૫૦

(૨) અપેક્ષિત વળતરનો દર = ૧૦%

(૩) છેદ્ધા ચાર વર્ષનો ચોપદો નફો

વર્ષ	નફો
૨૦૦૪	૩૨૫૦૦
૨૦૦૫	૪૨૦૦૦
૨૦૦૬	૩૫૫૦
૨૦૦૭	૪૯૪૦૦

હિસાબી ચકાસણી કરતા નીચે મુજબના મુદ્દા દયાનમાં આવ્યાં.

(૧) વર્ષ ૨૦૦૫ નો નફો આગથી નાશ પામેલ રૂ. ૫૦૦૦ના કારણે ઘટ્યો હતો.

(૨) વર્ષ ૨૦૦૬ના નફામાં બિનદ્યાદ્યાકીય રોકાયોના વ્યાજ રૂ. ૧૦૦૦નો સમાવેશ થાય છે.

(૩) તા. ૦૧-૦૭-૨૦૦૬ના રોજ પ્લાન્ટમાં રૂ. ૨૦૦૦૦ના ખર્ચો મોટાપાયા પર સમારકામ કરવામાં આવ્યું હતું જેને હિસાબોમાં મહેસૂલી ખર્ચ ગણવામાં આવ્યો હતો. પાધડી માટે આ ખર્ચને મૂડીખર્ચ ગણવાનો છે.

પ્લાન્ટ પર ઘટતી જતી બાકીની રીતે વાર્ષિક ૧૦% લેખે ઘસારાની જોગવાઈ કરવામાં આવે છે.

(૪) સ્ટોક વીમા પ્રિમીયમ રૂ. ૫૦૦ તથા સંચાલકોના મહેનતાણા રૂ. ૧૨૦૦૦ની જોગવાઈ કરવાની છે.

(સ.પ.યુ., ૨૦૦૮)

જવાબ:

વિગત	૨૦૦૪	૨૦૦૫	૨૦૦૬	૨૦૦૭
કુલ નફો	૩૨૫૦૦	૪૨૦૦૦	૩૫૫૦૦	૪૮૪૦૦
+ અનિયમીત ખર્ચ (આગથી નાશ પામેલ)	---	૫૦૦૦	---	---
- લિનાંધાકીય રોકાણોનું વ્યાજ	૩૨૫૦૦	૪૭૦૦૦	૩૫૫૦૦	૪૮૪૦૦
- સંચાલકોનું મહેનતાણું	---	---	૧૦૦૦	---
- સ્ટોક વીમા પ્રિમીયમ	-૧૨૦૦૦	-૧૨૦૦૦	-૧૨૦૦૦	-૧૨૦૦૦
+ સમારકામ	-૫૦૦	-૫૦૦	-૫૦૦	-૫૦૦
- ઘસારો	---	---	-૨૦૦૦૦	---
	---	---	-૧૦૦૦	-૧૬૦૦
	૨૦૦૦૦	૩૪૫૦૦	૪૧૦૦૦	૩૪૦૦૦

ઘસારો:- પ્લાન્ટ (૦૧-૦૭ થી ૩૧-૦૩)

$$૨૦૦૬: \quad ૨૦૦૦૦ \times \frac{૬}{૧૨} \times \frac{૧૦}{૧૦૦} = \text{રૂ. } ૧૦૦૦ \quad (૧)$$

$$\begin{aligned} ૨૦૦૭: & (૨) \quad ૨૦૦૦૦ \\ & - \quad \underline{\underline{૧૦૦૦}} \\ & \quad ૧૬૦૦૦ \\ & - \quad ૧૬૦૦ \quad \text{ઘસારો} \end{aligned}$$

$$\begin{aligned} (૧) \quad \text{રોકાણેલી મૂડી & = ૧૨૯૨૫૦ \quad (૨) \quad \text{અપેક્ષિત નફો} & = ૧૨૯૨૫૦ \times ૧૦\% \\ (૩) \quad \text{સરેરાશ} & \end{aligned}$$

$$\begin{aligned} \text{સરેરાશ} & \quad \text{કુલ} \\ \text{નફો} & = \frac{\text{કુલ વર્ષ}}{\text{કુલ વર્ષ}} = \frac{૨૦૦૦૦ + ૩૪૫૦૦ + ૪૧૦૦૦ + ૧૩૦૫૦૦}{૪} = \frac{૩૪૦૦૦}{૪} = \boxed{\text{રૂ. } ૩૨૯૨૫} \\ (૪) \quad \text{અધિક નફો} & = \text{સરેરાશ નફો} - \text{અપેક્ષિત નફો} = ૩૨૯૨૫ - ૧૨૯૨૫ = \boxed{\text{રૂ. } ૨૦૦૦૦} \\ (૫) \quad \text{પાધડી} & = \text{અધિક નફો} \times \text{ખરીદીના વર્ષ} \\ & = ૨૦૦૦૦ \times ૩ = \boxed{\text{રૂ. } ૬૦૦૦૦} \end{aligned}$$

ઉદાહરણ (૧૭):

શ્યામ લિમિટેડનું તા. ૩૧-૧૨-૧૯૯૮ના રોજનું પાકુ સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
દરેક રૂ. ૧૦૦નો એવા ૧૦%ના		સ્થિર મિલકતો	૭૦૦૦૦૦
પ્રેકરન્સ શેર	૨૦૦૦૦૦	ચાલુ મિલકતો	૨૫૦૦૦૦
દરેક રૂ. ૧૦૦નો એવા ૫૦૦૦		અદ્વશ્ય મિલકતો	૫૦૦૦૦
ઇકલીટી શેર	૫૦૦૦૦૦		
સામાન્ય અનામત	૧૦૦૦૦૦		
નફો-નુકશાન ખાતુ	૮૦૦૦૦		
પ્રોવીન્સ ફંડ	૩૦૦૦૦		
દેવા	૬૦૦૦૦		
	૧૦૦૦૦૦૦૦		૧૦૦૦૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) સ્થિર મિલકતોની બજાર કિંમત રૂ. ૮૨૫૦૦૦ અને ચાલુ મિલકતોની બજાર કિંમત રૂ. ૨૭૫૦૦૦ આંકડામાં આવેલી છે.
- (૨) આ કંપની જેવો ઘંધો કરતી અને ૨૦% લેખે ડિવિડન્ડ આપતી કંપનીના શેરની બજાર કિંમત તેની વસુલ આવેલી રકમ કરતા બે ગણી છે.
- (૩) કંપનીનો છેદ્ધા ત્રણ વર્ષનો નફો અને ભાર નીચે પ્રમાણો છે.

વર્ષ	નફો	ભાર
૧૯૯૭	૭૨૫૦૦૦	૧
૧૯૯૮	૧૩૨૦૦૦	૨
૧૯૯૯	૧૫૩૮૦૦	૩

નફો તપાસતા નીચે પ્રમાણોની માહિતી મળી:

- (૧) સંચાલ ખર્ચ માટે રૂ. ૨૦૦૦ ઉધારવાના છે.
- (૨) ૧૯૯૭ના વર્ષમાં આગાથી નાશ પામેલ માટે રૂ. ૫૦૦૦ ઘટેલ છે.
- (૩) ૧૯૯૭ના વર્ષમાં છેવટના સ્ટોકની કિંમત રૂ. ૨૦૦૦ વધુ આંકડામાં આવેલી છે.
- (૪) તા. ૧લી જુલાઈ ૧૯૯૮ના રોજ પલાન્ટને મોટા પાણ્યા પર સમારકામ કરવામાં આવ્યું હતું જેનો રૂ. ૧૦૦૦૦ ખર્ચ કરેલ હતા જે મહેસૂલી ખર્ચ ખાતે ઉધારવામાં આવ્યો હતો. આ રકમ મૂડીખર્ચ ગણવાની છે. ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ ૨૦% લેખે ઘસારાનો હવાલો નાખવાનો છે. પાદ્ધકીની કિંમત નફાની ત્રણ વર્ષની ખરીદીના ધોરણે શોધો.

(સ.પ.યુ., ૨૦૦૩)

જવાબ:

(૧) રોકાયેલી મૂડી:

સ્થિર મિલકતો	૮૨૫૦૦૦
ચાલુ મિલકતો	૨૭૫૦૦૦
- જવાબદારીઓ:	
દેવા	૬૦૦૦૦
પ્રો. ફંડ	૩૦૦૦૦
- પ્રેફરન્સ શેરમૂડી	
રોકાયેલી મૂડી	રૂ. ૭૮૦૦૦૦

$$\begin{aligned}
 (2) \quad \text{અપેક્ષિત નફો} &= \text{રોકાયેલી મૂડી} \times \text{અપેક્ષિત વળતરનો દર} \\
 &= ૭૮૦૦૦૦ \times ૧૦\% \\
 &= રૂ. ૭૮૦૦૦
 \end{aligned}$$

$$\text{નોંધ: } \text{અપેક્ષિત વળતરનો દર} = \frac{\text{ડિવિડન્ડ નો દર}}{\text{બજાર કિંમતનો આધાર}} = \frac{૨૦}{૨} = ૧૦\%$$

(3) सरेराश नक्षे:

विवर	१९६७	१९६८	१९६९
नक्षे	१२५०००	१३२०००	१४३८००
- संचालक खर्च	(२०००)	(२०००)	(२०००)
+ स्टोक बलवाथी (असामान्य खर्च)	५०००	---	---
- आखरना स्टोकनुं वधु मुत्यांकन	---	२०००	---
+ भोटा पाचे समारकाम खर्च	---	१००००	---
- प्लान्ट पर घसारो	---	१०००	९८००
(१०००० × २०/१०० × ६/१२)			
(८००० × २०/१००)			
नक्षे	१२५०००	१४१०००	१५००००

वर्ष	नक्षे	भार	भारित नक्षे
१९६७	१२५०००	१	१२५०००
१९६८	१४१०००	२	२८२०००
१९६९	१५००००	३	४५००००
		कुल भार = ६	कुल भारित नक्षे = ८५८०००

$$\text{भारित सरेराश नक्षे } \frac{८५८०००}{६} = ₹. १४३०००$$

$$- \text{प्रेफरेन्स शेर डिविडन्ड } \frac{२००००}{३. १२३०००}$$

$$(4) \text{ अधिक नक्षे} = \text{भारित सरेराश नक्षे} - \text{अपेक्षित नक्षे}$$

$$= १२३००० - ७८०००$$

$$= ₹. ४५०००$$

$$(5) \text{ पाठडी} = \text{अधिक नक्षे} \times \text{भरीटीना वर्षो}$$

$$= ४५००० \times ३$$

$$= ₹. १३५०००$$

नोंद्यः

प्लान्ट पर घसारो	= १००००
प्रथम (६ महिनाना)	
बाद:	
१०००० × ६/१२ × २०/१००	१०००
बीजा वर्धना शळमां बाकी	८०००
घसारो	
बाद: (८००० × २०%)	१६००

ઉદાહરણ (૧૮):

જીચે પંડિત લીમિટેડના ધંધાની વિગતો આપી છે. આ કંપનીનો ધંધો કેશવ લીમિટેડ ખરીદી લેવાનો છે. તમારે જીચેની માહિતી દ્યાનમાં લઈ પાછાડી અધિક નફાની બે વર્ષની ખરીદીના આધારે ગણવાની છે.

વિગત	₹.
રૂ. ૧૦૦નો એક એવા ૩૦૦૦ના ૧૦%ના પ્રેફરન્સ શેર સંપૂર્ણ ભરપાઈ થયેલા	૩૦૦૦૦૦
રૂ. ૧૦૦નો એક એવા ૧૦૦૦૦ ઇકવીટી શેર સંપૂર્ણ ભરપાઈ થયેલા	૧૦૦૦૦૦૦
અનામત અને વધારો	૧૦૦૦૦૦
ચાલુ દેવા	૧૦૦૦૦૦
કરવેશની જોગવાઈ	૫૦૦૦
ઘસારા ઇંડ (સ્થિર મિલકતો)	૧૦૦૦૦

પંડિત લીમિટેડના કિરેકટરને રૂ. ૫૦૦૦ વાર્ષિક મહેનતાણું આપવાનું છે જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. છેદ્ધા ચાર વર્ષનો કુલ નફો (૫૦% આવક વેરા ગણવા પહેલાનો) રૂ. ૨૮૦૦૦૦૦ હતો. બજારમાં રોકાણો પર વ્યાજ ૮% છે. જ્યારે જોખમની મૂડી પર વળતરનો દર ૨% છે. કુલ મિલકતોની વહેંચાણી જીચે મુજબ છે.

(૧) કાયમી મિલકતો કુલ મિલકતોના ૭૦% છે.

(૨) ચાલુ મિલકતો કુલ મિલકતોના ૨૦% છે.

(૩) રોકાણો કુલ મિલકતના ૫% છે જેમાં બિનદંધાકીય ૫૦% છે.

(૪) અવાસ્તવિક મિલકતો કુલ મિલકતના ૫% પ્રમાણે છે.

કાયમી મિલકતોની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતા ૧૦% વધારે છે. જ્યારે ચાલુ મિલકતોની ચોપડે કિંમત રૂ. ૧૦૦૦૦ વધારે ગણવામાં આવી છે. અવાસ્તવિક મિલકતો રૂ. ૫૦૦૦ વધારે ગણવામાં આવી છે. રોકાણો ઉપર વ્યાજ મળે છે અને આ વ્યાજ કરપાત્ર છે. (સ.પ.ચુ., ૨૦૦૦)

જવાબ:

પાંકું સરવૈચું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
૧૦% પ્રેફરન્સ શેરમૂડી	૩૦૦૦૦૦	સ્થિર મિલકતો	૧૧૨૦૦૦૦
ઇકવીટી શેરમૂડી	૧૦૦૦૦૦૦	ચાલુ મિલકતો	૩૨૦૦૦૦
અનામત વધારો	૧૦૦૦૦૦	રોકાણો (૫%)	
ચાલુ જવાબદારીઓ	૧૦૦૦૦૦	ધંધાકીય	૪૦૦૦૦
કરવેશની જોગવાઈ	૫૦૦૦૦	- બિનદંધાકીય	૪૦૦૦૦
ઘસારા ઇંડ (સ્થિર)	૫૦૦૦૦	અવાસ્તવિક મિલકતો	૮૦૦૦૦
	<u>૧૫૦૦૦૦૦</u>		<u>૧૫૦૦૦૦૦</u>

(૧) રોકાણેલી મૂડી = કુલ મિલકતો - કુલ દેવા

- સ્થિર મિલકતો ($1120000 \times 10\% 112000$) ૧૨૩૨૦૦૦

($1120000 + 112000$)

- ચાલુ મિલકતો ૩૧૦૦૦૦

- ધેંધાકીય રોકાણો ૪૦૦૦૦
૧૫૮૨૦૦૦

બાદ: કુલ જવાબદીઓ:

ચાતુ જવાબદીઓ	<u>૧૦૦૦૦૦</u>
કરવેરા જોગવાઈ	<u>૫૦૦૦૦</u>
ચોખ્ખી ભિલકતો	<u>૧૪૩૨૦૦૦</u>
- પ્રેફરન્સ શેર મૂડી	<u>૩૦૦૦૦૦</u>
રોકાયેલી મૂડી	<u>૧૧૩૨૦૦૦</u>

(૨) અપેક્ષિત નફો = રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર
= $૧૧૩૨૦૦૦ \times ૧૦\% (૮\% + ૨\%)$ = રૂ. ૧૧૩૨૦૦

(૩)

સરેરાશ	<u>કુલ નફો</u>	<u>૨૮૦૦૦૦૦</u>
નફો =	<u>કુલ વર્ષ</u>	<u>૪</u>

બાદ: ડિરિક્ટરનો પગાર	<u>૧૦૦૦૦</u>
સ. નફો (કરવેરા પહેલાનો):	<u>૬૦૦૦૦</u>
- ૫૦% કરવેરા	<u>૩૪૫૦૦૦</u>
	<u>૩૪૫૦૦૦</u>

- બિનધેંધાકીય રોકાણોનું વ્યાજ

(૪૦૦૦૦ × ૧૦%)	<u>૪૦૦૦</u>
૫૦% કરવેરા	<u>૨૦૦૦</u>
	<u>૨૦૦૦</u>
ગ્ર. શેર ડીવીડન્ડ	<u>૩૦૦૦૦</u>
	<u>૩૧૩૦૦૦</u>

(૪) અધિક નફો = સરેરાશ નફો - અપેક્ષિત નફો
= $૩૧૩૦૦૦ - ૧૧૩૨૦૦$
= રૂ. ૧૬૯૮૦૦

(૫) પાઘડી = ૧૬૯૮૦૦×૨
= રૂ. ૩૩૯૬૦૦

- (૧) પાઘડી એટલે શું? પાઘડીને અસર કરતાં પરીબળો જણાવો.
- (૨) પાઘડીનાં મૂલ્યાંકનની જરૂરીયાત કયારે પડે છે?
- (૩) ટૂંકનોંધ લખો.
 ૧. સરેરાશ નફાની પક્ષતિ
 ૨. અધિક નફાની પક્ષતિ
- (૪) પાઘડીની મુખ્ય લાક્ષણિકતાઓ વર્ણવો.
- (૫) પાઘડીના પ્રકારો જણાવો.

દાખલાઓ

- (૧) નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત ૩ વર્ષના ખરીદીને આધારે નક્કી કરો.

વર્ષ	નફો
૨૦૦૦	૫૦૦૦
૨૦૦૧	૫૦૦૦
૨૦૦૨	૩૦૦૦
૨૦૦૩	(૨૦૦૦)
૨૦૦૪	૨૫૦૦

- (૨) નીચેની વિગતો પરથી ધંધાની રોકાયેલી મૂડી શોધો.

વિગતો	રૂ.	વિગતો	રૂ.
જમીન - મકાન	૮૨૫૦૦	દેવાદારો	૪૫૦૦૦
પ્લાન્ટ	૫૦૦૦૦	દેણીહુંડી	૫૦૦
સ્ટોક	૫૦૦૦૦	કરવેરોની જોગવાઈ	૩૬૦૦૦
લેણદારો	૩૭૫૦૦	પ્રોવિડન્ડ ફંડ	૧૦૦૦
બેન્ક સિલક	૮૦૦૦	નફાનુક્ષાન ખાતું (જમા)	૧૦૦૦૦
પ્રાથમિક ખર્ચ	૫૦૦૦	૫% સરકારી બોન્ડ (કરમુકત)	૫૦૦૦
લેણીહુંડી	૭૫૦૦		

- (૩) શ્રી ચેહર કંપનીનો છેદ્ધા ચાર વર્ષનો નફો ત્રણ વર્ષની ખરીદીના આધારે આપેલ છે. તેના પરથી પાઘડીનું મૂલ્યાંકન કરો.

૨૦૧૪	૧૦૧૦૦
૨૦૧૫	૧૨૪૦૦
૨૦૧૬	૧૦૦૦૦
૨૦૧૭	૧૫૦૦૦

૨૦૧૫ માં પેઢીને ભોગપાવા પર સમારકામ ખર્ચ રૂ. ૩,૦૦૦ થયેલ છે તે મહેસૂલી ખર્ચ ગાણોલો પરંતુ પાઘડી માટે તેને મૂડીખર્ચ ગણવાનું નક્કી થયું છે. સંચાલન ખર્ચ માટે દર વર્ષ ૨,૪૦૦ ઉદારવાના છે.

(૪) શ્રી દત લિ. તા. ૩૧-૩-૧૮ ના રોજનું પાકું સરવૈયું

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
૨૦૦૦ ઈ. શેર દરેકના રૂ.૧૦૦પૂરા ભરાયેલા	૨૦૦૦૦૦	પાઘડી	૧૮૦૦૦
૧૦%ના ૧૦૦૦ પ્રે. શેર રૂ. ૧૦૦ નો એક અવાં પૂરા ભરાયેલા	૧૦૦૦૦૦	જમીન અને મકાન	૧૪૦૦૦૦
સા. અનામત	૧૫૦૦૦૦	બંત્રો	૧૪૦૦૦૦
૧૦ % ના ડિલેન્ચરો	૫૦૦૦૦	રોકાણો (૧૫% ની સરકારી લોન (દાર્શનિક કિંમત ૪૦,૦૦૦) બ્યાજ કરમુકત છે	૩૬૦૦૦
લેણાદારો	૨૫૦૦૦	દેવાદારો	૪૦૦૦૦
કારીગર નફા ભાગ ભંડોળ	૮૦૦૦	સ્ટોક	૭૦૦૦૦
કરવેરાની જોગવાઈ	૧૫૦૦૦	રોકડ સિલક પ્રાથમિક ખર્ચાઓ	૬૦૦૦૦ ૪૪૦૦૦
	૫૫૮૦૦૦		૫૫૮૦૦૦

વધારીની માહિતી:

- જમીન અને મકાનની બજાર કિંમત રૂ.૧૯૦૦૦૦ છે. બંત્રોની બજાર કિંમત રૂ.૧૨૦૦૦૦ છે અને બાડીની મિલકતો ચોપડે દર્શાવેલ રકમ પ્રમાણે લેવાની છે.
- અપેક્ષિત ડિવિડનો દર ૧૨% છે.
- ૫૦ % લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો કંપનીનો છેદ્ધા ચાર વર્ષનો નફો આ મુજબ છે.

વર્ષ	નફો
૨૦૧૭-૧૮	૮૦૦૦
૨૦૧૯-૧૭	૮૪૦૦૦
૨૦૧૮-૧૯	૭૫૦૦૦
૨૦૧૪-૧૫	૭૦૦૦૦

- પાઘડીની કિંમતની ગણતરી અધિક નફાની ચાર વર્ષની ખરીદીના આધારે કરવાની છે.

(૫) ગુજરાત કંપની લિ. તા. ૩૧-૩-૨૦૧૮ ના રોજનું પાકું સરવૈયું :

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
૧૫% ના પ્રેક. શેરમૂડી	૧૫૦૦૦૦	જમીન અને મકાન	૫૨૦૦૦૦
ઇ. શેરમૂડી	૭૨૦૦૦૦	ફર્નિચર	૧૫૦૦૦૦
લેણાદારો	૨૦૦૦૦૦	દેવાદારો	૧૨૦૦૦૦
પ્રો. ફંડ	૨૭૦૦૦	રોકડ સિલક	૨૫૦૦૦૦
લેઝીફુંડી	૧૩૦૦૦	નફા-નુકશાન ખાતુ	૭૦૦૦૦

	૧૧૧૦૦૦૦	૧૧૧૦૦૦૦
--	---------	---------

વધારાની માહિતી:

૧. જમની અને મકાનની કિંમતમાં ૫% વધારો તથા ફર્નિચરની કિંમતનાં ૧૦% નો ઘટાડો કરવો.
 ૨. ડિવિડન વહેચાતા પહેલાનો સરેરાશ વાર્ષિક નફો રૂ. ૧૨૦૦૦૦ છે.
 ૩. અપેક્ષિત વળતરનો દર ૧૪% છે
- ઉપરની માહિતી ઉપરથી મૂડીકૃત અધિક નફાની પદ્ધતિથી પાદડીની કિંમત શોધો.

(૬) એમ લિ. નું તા. ૩૧-૩-૧૯૯૮ ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	₹	મિલકત-લેણાં	₹
૧,૫૦૦ ઈ. શેર દરેક રૂ. ૧૦૦નો પૂરા ભરાયેલા ૧૦%ના ૮૦૦ પ્રેફરન્સ શેર રૂ. ૧૦૦ના પૂરા ભરાયેલા અનામત અને વધારો	૧૫૦૦૦૦૦	પાદડી	૧૪૦૦૦
	૮૦૦૦૦	કાથમી મિલકતો	૨૮૦૦૦૦
	૧૨૫૦૦૦	રોકાણો (૧૦%ની સરકારી લોન)(દાર્શનિક કિંમત રૂ. ૩૦,૦૦૦) (વ્યાજ કરમુકત છે)	૨૫૦૦૦
૮%ના ડિનેન્યર લેણાદારો કારીગર નફાભાગ બંડોળ કરવેરાની જોગવાઈ	૫૦૦૦૦ ૨૦૦૦૦ ૫૦૦૦	ચાલુ મિલકતો પ્રાથમિક ખર્ચ ડિનેન્યર વટાવ	૧૦૦૦૦૦ ૧૫૦૦૦ ૫૦૦૦
	૪૪૦૦૦૦		૪૪૦૦૦૦

વધારાની માહિતી:

૧. કાયમી મિલકતોની છાલની બજાર કિંમત રૂ. ૧૮૫૦૦૦ છે. જ્યારે બાકીની મિલકતો ચોપડે દશવિંશ કિંમતે લેવાની છે.
૨. અપેક્ષિત ડિવિડનનો દર ૧૦ % છે.
૩. ૫૦% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો કંપનીનો છેદા ચાર વર્ષનો નફો આ મુજબ છે.
૪. રૂ. ૭૨૪૦૦, રૂ. ૭૪૮૦૦, રૂ. ૭૦૬૦૦ અને રૂ. ૮૩૦૦૦

તમારે કંપનીની પાદડીની કિંમત તેના અધિક નફાના ચાર વર્ષની ખરીદીને આધારે ગણવાની છે.

(ગુ. ચુનિ..., ટી. વાય..., એપ્રિલ, ૨૦૦૧)

(૭) દી પથલ લિમિટનું તા. ૩૧-૧૨-૧૯૯૪ ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

મૂડી-ટેવાં	₹	મિલકત-લેણાં	₹
શેરમૂડી:		પાદડી	૨૮૦૦૦

ઇકવીટી શેર, દરેક રૂ. ૧૦૦ના પૂરા ભરાયેલા	૪૦૦૦૦૦	મકાન	૩૦૦૦૦૦
૧૦%ના પ્રેફરન્સ શેર, દરેક રૂ. ૧૦૦ના		મશીનરી	૩૪૦૦૦૦
પૂરા ભરાયેલા	૧૦૦૦૦૦		
અનામતો	૧૦૦૦૦૦	૧૦%ના પરમાત્મા લિ. ના ડિબેન્ચર (વ્યાજ કરપાત્ર છે)	૫૦૦૦૦
શેર પ્રિમિયમ	૨૦૦૦૦	દેવાદારો	૮૫૦૦૦
૧૫%ના ડિબેન્ચર	૨૦૦૦૦૦	-દા. અનામત	૬૦૦૦૦
લેણદારો	૮૦૦૦૦	લેણીહંડીઓ	૭૬૦૦૦
દેવીહંડીઓ	૨૦૦૦૦	સ્ટેક	૬૦૦૦૦
કરવેરાની જોગવાઈ	૪૦૦૦૦	રોકડ અને બેન્ક સિલક	૧૨૦૦૦
કામદાર નફાભાગ ભંડોળ	૩૦૦૦૦	અગાઉથી ચૂકવેલ ખર્ચ	૨૦૦૦
		ડિબેન્ચર વટાવ	૨૦૦૦
	૧૦૦૦૦૦૦		૧૦૦૦૦૦૦

નીચેની વિગતો દ્વારાનમાં લઈ તમારે કંપનીની પાદારીની કિંમત તેના અધિક નફાની ચાર વર્ષની ખરીદીને આધારે ગણવાની છે.

- ૧) મકાન અને ચંત્રોની હાલની બજાર કિંમત અનુકૂળે રૂ. ૫૦૦૦૦૦ અને રૂ. ૨૬૦૦૦૦ આંકડામાં આવી છે.
અને બાકીની ભિલકતો ચોપકે દરાવેલ કિંમતે લેવાની છે.
- ૨) આ કંપની જેવો જ ધંધો કરતી અને ૩૦% લેખે કિવિડન્ડ આપતી કંપનીના શેરનો બજાર ભાવ તેની વસૂલ કિંમત કરતમા ત્રણ ગણો છે.
- ૩) ૫૦% લેખે કરની જોગવાઈ કર્યા પછી કંપનીનો છેષા ચાર વર્ષનો વહેચાણીપાત્ર નફો નીચે મુજબ છે.

વર્ષ	નફો
૧૯૯૧	૮૮૦૦૦
૧૯૯૨	૮૯૦૦૦
૧૯૯૩	૮૨૦૦૦
૧૯૯૪	૧૦૦૦૦૦

(ઉ. ગુ. ચુનિ.., ટી. વાય.., એપ્રિલ, ૧૯૯૫)

(૮) દી સુદામા લિ. નું તા. ૩૧-૩-૨૦૦૦ ના રોજનું પાંકું સરવૈયું નીચે મુજબ છે.

મૂકી-દેવાં	₹	ભિલકત-લેણાં	₹
૩,૦૦૦, ૧૨%ના પ્રેફ. શેર દરેક રૂ. ૧૦૦નો તેવા	૩૦૦૦૦૦	પાદારી	૧૦૦૦૦૦
૮,૦૦૦ ઈ. શેર દરેક રૂ. ૧૦૦નો એક તેવા	૮૦૦૦૦૦	જમીન-મકાન ચંત્રો રોકાણો:	૬૦૦૦૦૦

શેર પ્રિમિયમ	૧૦૦૦૦૦	૧૦%ના બંસી લિ. ના ડિલેન્ચર્સ	
નફા-નુકશાન ખાતું	૧૦૫૦૦૦	(મૂ.ક્ર. ર. ૧૦૦૦૦૦)	૧૫૦૦૦૦
સામાન્ય અનામત	૩૦૦૦૦૦	૧૫%ના બંસી લિ.ના ડિલેન્ચર્સ	
૧૦%ના ડિલેન્ચર્સ	૨૦૦૦૦૦	(ર.૧૦૦૦૦૦)	૮૦૦૦૦
કામદાર નફાભાગ ભડોળ	૪૦૦૦૦	સ્ટોક	૩૦૦૦૦૦
લેણદારો	૧૭૦૦૦૦	દેવાદારો	૧૮૦૦૦૦
પ્રોવિઝન ફંડ	૧૫૦૦૦૦	-ધા. અનામત	૧૦૦૦૦
<u>સુચિત ડિવિડન:</u>		રોકડ/બોન્ડ	૮૦૦૦૦
પ્રે. શેર	૩૬૦૦૦	અગાઉથી ચૂકવેલ ખર્ચ	૩૦૦૦૦
ઇ. શેર	૧૦૪૦૦૦	પ્રાથમિક ખર્ચ	૩૦૦૦૦
	૧૪૦૦૦૦		
	૨૩૫૦૦૦૦		૨૩૫૦૦૦૦

દી નરસિંહ લિ. આ કંપનીનો ધંધો ખરીદવા માગે છે. જે માટે નીચેની માહિતી ધ્યાનમાં લઈને પાછડીની ગાણતરી કરવાની છે.

- (૧) જમીન-મકાનની હાલની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં બે ગણી છે.
- (૨) યંત્રો ઉપર ૨૦% ઘસારો જરૂરી છે.
- (૩) સ્ટોકમાં ર. ૪૦૦૦૦ ના સ્ટોકનું કાંઈ ઊપજે તેમ નથી.
- (૪) તમામ દેવાદારો સધ્યર છે.
- (૫) કંપનીનો છેષા ત્રણ વર્ષનો ૫૦% લેખે આવકયેશે ગણ્યાં પહેલાનો નફો નીચે મુજબ હતો. ભારિત સરેરાશ ગણો:

વર્ષ	રૂ.
૧૯૯૭-૧૯૯૮	૮૦૦૦૦૦
૧૯૯૮-૧૯૯૯	૧૨૦૦૦૦૦
૧૯૯૯-૨૦૦૦	૧૪૦૦૦૦૦

- (૬) અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.
- (૭) પાછડીની કિંમત અધિક નફાથી ત્રણ વર્ષની ખરીદી જેટલી ગાણવાની છે.

(ગુ. ચુનિ..., ટી. વાય..., એપ્રિલ .., ૨૦૦૩)

- (૮) રાકેશ લિમિટેડનું તા. ૩૧મી માર્ચ, ૨૦૦૦ ના રોજનું પાંકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
દરેક ર.૧૦૦નો તેવા ૨૦૦૦ ૧૦%ના		સ્થાતી મિલકતો	૭૦૦૦૦૦
પ્રેફરન્સ શેર	૨૦૦૦૦૦		
દરેક ર.૧૦૦નો તેવા ૫૦૦૦ ઇ. શેર	૫૦૦૦૦૦	ચાતુ મિલકતો	૨૫૦૦૦૦
સામાન્ય અનામત	૧૦૦૦૦૦	અદ્રશ્ય મિલકતો	૫૦૦૦૦
નફા-નુકશાન ખાતું	૮૦૦૦૦		
પ્રોવિઝન ફંડ	૩૦૦૦૦		
અન્ય દેવા	૬૦૦૦૦		
	૧૦૦૦૦૦૦		૧૦૦૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) સ્થાયી મિલકતો અને ચાલુ મિલકતોની છાલની બજાર કિંમત અનુક્રમે રૂ. ૮,૨૫,૦૦૦ અને રૂ. ૨,૭૫,૦૦૦ આંકડામાં આવી છે.
- (૨) આ કંપનીના જેવો જ ધંધો કરતી અને ૨૦% લેખ ડિવિડન્ડ આપતી કંપનીના શેરના બજારભાવ તેની વસ્તુલ રકમ કરતાં બે ગણા છે.
- (૩) કંપનીનો છેક્ષણ ત્રણ વર્ષનો નઝો નીચે પ્રમાણે છે.

૧૯૯૭-૯૮ રૂ. ૧૨૫૦૦૦, ૧૯૯૮-૧૯૯૯ રૂ. ૧૩૨૦૦૦, ૧૯૯૯-૨૦૦૦ રૂ. ૧૫૩૮૦૦

નઝો તપાસતા આ માહિતી મળે છે:

- (અ) સંચાલન ખર્ચ માટે રૂ. ૨૦૦૦ ઉધારવાના છે.
- (બ) ૧૯૯૭-૯૮ ના વર્ષમાં નઝો આગામી નાશ પામેલ ભાલ માટે રૂ. ૫૦૦૦ ઘટેલ છે.
- (ક) ૬૭-૬૮ ના વર્ષમાં આખર સ્ટોકમી કિંમત રૂ. ૨૦૦૦ વધુ આંકડામાં આવી છે.
- (દ) તા. ૧૮૮ ઓક્ટો. ૧૯૯૮ ના રોજ પ્લાન્ટમે મોટા પાચા પર સમારકામ કરવામાં આવ્યું હતું. અને રૂ. ૧૦૦૦૦ ખર્ચથી હતાં, જે મહેસૂલી ખર્ચ ખાતે ઉધારવામાં આવ્યા હતાં. આ રકમ મૂડી ખર્ચ ગણવાની છે. ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ વાર્ષિક ૨૦% લેખ ઘસારા નો હવાલો નાંખવાનો છે. નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે તમારે કંપનીની પાઘડીની કિંમત ગણવાની છે. આ માટે ચોગ્ય ભાર નીચે મુજબ આપવામાં આવ્યો છે.

૧૯૯૭-૯૮ : ૧ ૧૯૯૮-૯૯: ૨

૧૯૯૯-૨૦૦૦: ૩

(સ. ગુ. યુનિ..., ટી. વાય..., એપ્રિલ, ૧૯૯૯)

- (૧૦) નીચે આપેલી માહિતીના આધારે પાઘડીની કિંમત તેના પાંચ વર્ષનાં સરેરાશ નફાને દ્યાનમાં લઈને કરવાની છે.

વર્ષ	નઝો
૨૦૦૬	૬૦૦૦
૨૦૦૭	૧૦૦૦૦
૨૦૦૮	૧૨૦૦૦
૨૦૦૯	૧૫૦૦૦
૨૦૧૦	૧૮૦૦૦

- (૧૧) મહેતા અને પંક્ચા લિમિટેડનું તા. ૩૧-૧૨-૨૦૧૭ ના રોજનું પાકુ સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
ઇ. શેર દરેક રૂ. ૧૦નો	૩૦૦૦૦૦	પાઘડી	૧૫૦૦૦
૧૦%ના પ્રે. શેર	૨૫૦૦૦૦	જમીન-મકાન	૨૩૦૦૦૦
સામાન્ય અનામત	૬૦૦૦૦૦	મશીનરી	૪૪૦૦૦૦
નફાનુક્સાન ખાતું:		શેકાણો:	
૧-૧-૧૭ ના રોજ બાકી <u>૪૦૦૦</u>		પ્રોવિડન્ડ ફંડમાં	<u>૪૫૦૦૦</u>
૫૦% ના દરે વેરો કાપતા		શિવમ લી. ના ૧૨%ના ડિલેન્યર	
અગાઉનો ૨૦૧૭નો નઝો <u>૨૪૦૦૦૦</u>	૨૪૪૦૦૦	(દારશનીક કિંમત રૂ. ૮૦૦૦૦	

१२%ના ડિલેન્ચર	૨૮૦૦૦૦	વ્યાજ કરપાત્ર)	<u>૮૫૦૦૦</u>	૧૩૦૦૦૦
લેણદારો	૧૭૦૦૦૦	સ્ટેક		૨૩૦૦૦૦
દેવીહંડી	૧૬૦૦૦	લેણીહંડી		૫૦૦૦૦
પ્રોવિલ્નટ ફંડ	૪૫૦૦૦	દેવાદારો		૨૭૦૦૦૦
ચૂક્ખવધાના બાકી ખર્ચ	૫૦૦૦	રોકડ અને બેનક		૨૪૦૦૦
		અગાઉથી ચૂક્ખવેલ ખર્ચ		૭૦૦૦
		પ્રાથમિક ખર્ચ		૪૦૦૦
	<u>૧૪૦૦૦૦૦</u>			<u>૧૪૦૦૦૦૦</u>

વધારાની ભાહિતી:

- જમીન મકાનની હાલની કિંમત રૂ.૩૪૨૫૦૦ છે. જ્યારે બાકીની મિલકતો ચોપડે કિંમતે લેવાની છે.
- અપેક્ષિત વળતરનો દર ૧૨% છે.
- ૫૦%લેખે કરવેરાની જોગવાઈ પહેલાનો નશો નીચે મુજબ છે.

વર્ષ	નફો
૧	૧૮૦૦૦૦
૨	૧૬૦૦૦૦
૩	૧૨૦૦૦૦

ઉપરની વિગતો પરથી ચાર વર્ષની ખરીદીના આધારે પાદારી શોધો.

(ગુ. ચુનિ., ટી.વાય..., એપ્રિલ, ૧૯૯૫)

(૧૨) જબેશ કંપની લિ. નું તા. ૩૧-૦૩-૨૦૧૮ના રોજનું પાકુ સરવેચું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
૩૦૦૦૦ ઈ. શેર રૂ. ૧૦નો એક		પાદારી	૫૦૦૦૦
એવા પૂરા ભારયેલા	૩૦૦૦૦૦	જમીન અને મકાન	૨૬૦૦૦૦
સા. અનામત	૨૦૦૦૦૦	યંત્રો	૫૦૦૦૦
૧૫%ના ડીબેંચરો	૧૦૦૦૦૦	રોકાણો	૧૮૦૦૦૦
લેણદારો	૨૦૦૦૦	(બ.કિ. રૂ.૧૫૦૦૦૦)	
લેણીહંડી	૧૦૦૦૦	દેવાદારો	૩૦૦૦૦
		ડીબેંચર વટાવ	૨૦૦૦૦
	<u>૫૩૦૦૦૦</u>		<u>૫૩૦૦૦૦</u>

વધારાની ભાહિતી:

- જમીન અને મકાનની કિંમતમાં ૧૦%નો વધારો તથા યંત્રોની કિંમતમાં ૫%નો ઘટાડો કરવો.
- પાદારીની કિંમત રૂ. ૫૧૦૦૦ છે.
- કંપનીનો ૫૦% કરબાદ પહેલાનો કુલ નશો રૂ. ૫૫૦૦૦૦ અને અપેક્ષિત વળતરનો દર ૧૫% છે.
- સરેરાશ ચોખા નકાની મૂડીકરણની પદ્ધતિએ પાદારીની ગણતરી કરો.

(૧૩) મેહુલ બ્રદર્સનું તા.૩૧-૧૨-૧૯૯૨ના રોજનું પાકુ સરવૈયું નીચે મુજબ હતું.
પાકુ સરવૈયું

મૂડી-દેવાં	₹	મિલકત-દેણાં	₹
મૂડી	૨૦૦૦૦૦	પાદડી	૪૦૦૦૦
નફા-નુકશાન ખાતુ	૫૨૦૦૦	પ્લાન્ટ મશીનરી	૮૦૦૦૦
બેક લોન	૪૦૦૦૦	મકાન	૪૦૦૦૦
લેણદારો	૫૦૦૦૦	સરકારી જામીનગીરીઓ	૪૫૦૦૦
દેવીહૂંડી	૩૦૦૦૦	તૈયાર માલ સ્ટોક	૩૦૦૦૦
ચૂકવવાના બાકી ખર્ચ	૨૦૦૦૦	ચાલુ કામ	૩૦૦૦૦
મકાન ઘસારા ભંડોળ	૫૦૦૦	દેવાદારો	૧૨૪૦૦૦
પ્રોવિડન્ડ ફંડ	૧૩૦૦૦	બાદ : ઘા. અના.	૪૦૦૦
		લેણીહૂંડી	૨૦૦૦૦
		રોકડ	૧૦૦૦૦
		અગાઉથી ચૂકવેલ ખર્ચ	૫૦૦૦
	૪૨૦૦૦૦		૪૨૦૦૦૦

અન્ય વિગતો:

- (૧) પ્લાન્ટ મશીનરીની બજારરક્ખિત ૨૦% વધુ છે.
- (૨) અપેક્ષિત વળતરણો દર ૧૨% છે.
- (૩) પેઢીનો છેદા ત્રણ વર્ષનો નફો નીચે મુજબ છે.

વર્ષ	₹	ભાર
૧૯૯૦	૫૨૦૦૦	૧
૧૯૯૧	૪૦૦૦૦	૨
૧૯૯૨	૫૨૦૦૦	૩

હિસાનો તપાસતાં માલુમ પડ્યું કે:

- (૧) મેહુલનું વાર્ષિક વાજબી મહેનતાણું રૂ. ૮૦૦૦ નફાની ગણતરીમાં દ્યાનમાં લીધું નથી.
- (૨) ૧૯૯૦માં આખરના સ્ટોકની કિંમત રૂ. ૪૦૦૦ વધુ ગણવામાં આવેલ છે.
- (૩) ૧૯૯૧માં ચંત્ર વેચાણનો નફો રૂ. ૨૦૦૦ થયો હતો. જે નફા-નુકશાન ખાતે જમા કર્યો હતો.
- (૪) તા. ૦૧-૦૭-૧૯૯૧ના રોજ પ્લાન્ટના રિપેરીંગ માટે રૂ. ૧૦૦૦૦ ખર્ચ કર્યો હતો, જે મહેસુલી ખર્ચ તરીકે ગણોલ છે. ખેડેખર મૂડીખર્ચ ગણવાનો છે. પ્લાન્ટ પર વાર્ષિક ૧૦% લેખે ઘટ્ટી જતી બાકીની રીતે ઘસારો ગણાય છે. અધિક નફાથી ચાર ગણી પેઢીની પાદડીની ગણતરી કરો.

(ઉ.ગુ.ચુનિ., ટી.વા.ચ, એપ્રિલ-૧૯૯૩)

(૧૪) માધવી લિમિટેડની નીચેની વિગતો પરથી અધિક નજીબી પાંચ વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો:

	વિગતો	₹
(૧)	રૂ. ૧૦૦નો એક એવા ૧૦૦૦૦ ઇકવીટી શેર	૧૦૦૦૦૦૦
(૨)	રૂ. ૧૦૦નો એક એવા ૩૦૦૦ પ્રેફરન્સ શેર ૧૦%ના	૩૦૦૦૦૦
(૩)	નજીબુક્શાન ખાતું (જમા)	૫૮૦૦૦
(૪)	સામાન્ય અનામત	૫૨૦૦૦
(૫)	લેણદારો	૧૨૫૦૦૦
(૬)	ટેલીફોની	૪૫૦૦૦
(૭)	પ્રોવિલન્ડ ફંડ	૮૦૦૦૦
(૮)	છેદ્યા ચાર વર્ષનો કુલ નફો રૂ. ૧૮૦૦૦૦૦ છે. (૫૦% લેખે આવકયેદો ગણાયા પહેલાનો)	
(૯)	રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% લેખે છે. ધંધામાંથી કુલ મિલકતોની વહેંચણી નીચે પ્રમાણો છે:	
	કાયમી મિલકતો - કુલ મિલકતોના ૭૦%	
	ચાતુ મિલકતો - કુલ મિલકતોના ૨૫%	
	આવાસ્તવિક મિલકતો - કુલ મિલકતોના ૫%	

કાયમી મિલકતોની બજાર કિંમત તેમની ચોપડા કિંમત કરતાં ૩૦% વધારે છે. જ્યારે ચાતુ મિલકતોની ચોપડે કિંમત રૂ. ૨૫૫૦૦ વધારે ગણવાની છે.

(દ.ગુ.ચુનિ., એસ.વા.ચ, માર્ચ-૧૯૯૯)

(૧૫) અમર કં. લિ. ની નીચેની વિગતો પરથી નજીબી મૂડીકરણાની રીતે પાઘડી ગણો.

(૧) ધંધાની મિલકતો અને દેવાં નીચે મુજબ છે.

વિગતો	ચોપડે કિંમત	બજાર કિંમત
રોકાણો:	₹	₹
પ્રો. ફંડ સામેનાં રોકાણો	૧૦૦૦૦	૧૦૦૦૦
૧૦%ના પ્રિયા લિ. ના ડીઝેન્યર	૧૦૦૦૦૦	૬૦૦૦૦
ગૌણા કંપનીના શેર	૧૫૦૦૦૦	૧૩૦૦૦૦
અન્ય મિલકતો	૧૦૦૦૦૦૦	૮૫૦૦૦૦
લેણદારો	૨૫૦૦૦૦	---
પાઘડી	૫૦૦૦૦	---

(૨) ૫૦% લેખે કરબાદ કર્યા પછીનો કંપનીનો છેદ્યાં પાંચ વર્ષનો સરેરાશ નફો રૂ. ૪૫૦૦૦ છે.

(૩) ઉપરનો નફો રોકાણો પરના વ્યાજ સહિતનો છે.

(૪) આવા જ પ્રકારના ધંધામાં રોકાયેલા મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% ગણાય છે.

(દ.ગુ.ચુનિ., ટી.વા.ચ, માર્ચ-૨૦૦૪)

(૧૬)

(અ) ગુલાલટીમલની પેઢીનો સરેરાશ વાર્ષિક નફો (કરવેરા બાદ) રૂ. ૧૪૪૦૦૦૦ હોય અને અધિક નજીબાના ત્રણ વર્ષની ખરીદીને આધારે ગણાયેલ આ પેઢીની પાઘડીની કિંમત રૂ. ૭૨૦૦૦૦ હોય અને આ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૨૦% હોય તો પેઢીમાં રોકાયેલી મૂડી શોધો.

- (બ) ટોપીદાસની પેઢીની કુલ મિલકતોની કિમત રૂ. ૪૪૦૦૦૦૦ આવી છે. જ્યારે તેનાં કુલ દેવાં રૂ. ૧૨૦૦૦૦૦ છે. સરેરાશ નજો (કરયેરા બાદનો) રૂ.૫૦૦૦૦૦ છે અને આર્થિક નજીની ત્રણ વર્ષની ખરીદીના આધારે ગણાયેલી આ પેઢીની પાઘડીની કિમત રૂ. ૩૬૦૦૦૦ છે. આ પેઢીમાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર શોધો.
- (ક) શ્રી ચોટીદાસની પેઢીની નીચે મુજબની માહિતી મળેલ છે.
- | | | |
|-----|---|-----------|
| (૧) | કુલ મિલકતો | ₹ ૪૩૦૦૦૦૦ |
| (૨) | કુલ દેવાં | ₹ ૭૦૦૦૦૦ |
| (૩) | ૧૦%ની પ્રેફ. શેરમૂડી | ₹ ૪૦૦૦૦૦ |
| (૪) | ડિવિડન્ડ વહેંચાયા પહેલાંનો સરેરાશ વાર્ષિક નજો | ₹ ૫૫૦૦૦૦ |
| (૫) | અપેક્ષિત વળતરનો દર ૧૫% | |
- ઉપરની વિગતો પરથી અધિક નજીના મૂડીકરણની પક્ષતિથી પાઘડી શોધો.
(સૌ.ચુનિ., ટી.વા.ચ, માર્ચ-૨૦૦૫)

(૧૭) ભારત લિ. નું. તા. ૩૧-૦૩-૨૦૦૨નું પાકુ સરવૈયું નીચે આપેલું છે.

મૂડી-દેવાં	₹	મિલકત-સેણાં	₹
૧૨%ની પ્રેફરન્સ શેરમૂડી	૧૨૦૦૦૦	કાયમી મિલકતો	૪૫૦૦૦૦
ઇક્સ્પીટી શેર મૂડી	૫૧૦૦૦૦	રોકડ	૫૦૦૦૦
લેણદારો	૧૮૦૦૦૦	અન્ય ચાલુ મિલકતો	૨૨૫૦૦૦
		બાયધરી કમિશન	૧૫૦૦૦
		નજી-નુકશાન ખાતું	૫૦૦૦૦
	૮૧૦૦૦૦		૮૧૦૦૦૦

અન્ય માહિતી:

- (૧) કાયમી મિલકતોની બજાર કિમત ૧૦% ઓછી છે, જ્યારે અન્ય ચાલુ મિલકતોની બજાર કિમત ૧૨% વધારે છે.
- (૨) અપેક્ષિત વળતરનો દર ૧૫% છે.
- (૩) ડિવિડન્ડ વહેંચાયેલા પહેલાંનો સરેરાશ વાર્ષિક નજો રૂ. ૮૨૩૫૦ છે.
- ઉપરની વિગતો પરથી મૂડીકૃત અધિક નજીની રીતે પાઘડી શોધો.

(સૌ.ચુનિ., એસ.વાચ., એપ્રિલ ૨૦૦૦, ૨૦૦૩ અને ૨૦૦૭)
(ઉ.ગુ.ચુનિ., ટી.વાચ., એપ્રિલ ૨૦૦૭-દશગણી રકમ)

(૧૮) નિમિષા અને સુધીર ભાગીદારીમાં દંધો કરે છે. તેમના ભાગીદારી કરારમાં એવી જોગવાઈ છે કે પાઘડીની કિમત અધિકનજીની પાંચ વર્ષની ખરીદી જેટલી ગણાવી.

૩૧-૧૨-૨૦૧૭ના રોજનું પાકુ સરવૈયું

મૂડી-દેવાં	₹	મિલકત-સેણાં	₹
મૂડી ખાતાઃ		મશીનરી	૩૫૦૦૦
નિમિષાઃ	૧૬૦૦૦૦	ફર્નિચર	૧૦૦૦૦
સુધીરઃ	૮૦૦૦૦	સ્ટોક	૭૦૦૦૦
	૨૪૦૦૦૦		

લોન	૧૦૦૦૦૦	દેવાદારો	૨૬૦૦૦૦	
લેણદારો	૫૦૦૦૦	- જોગવાઈ	૧૦૦૦૦	૨૮૦૦૦૦
		રોકડ અને બેંક		૪૦૦૦
	૪૦૦૦૦૦			૪૦૦૦૦૦

ઉપરના પાકા સરવૈયાની સ્થિતિ રોકાયેલી મૂડીનો સાચો ખ્યાલ આવે છે કિંબાય કે ઘાલખાદ અનામતની જોગવાઈ રૂ. ૪૦૦૦ જેટલી ઓછી અને મશીનરીની બજાર કિંમત રૂ. ૪૦૦૦૦ છે. છેદ્ધા પાંચ વર્ષની પેઢીના નફાની પરિસ્થિતિ નીચે પ્રમાણે છે.

નફાની રક્તો ભાગીદારીની મૂડી પર વ્યાજ અને ભાગીદારી પેઢીના કર્મચારીનું વેતન બાદ કર્યા પહેલાનો છે.

વર્ષ	નફો	વર્ષ	નફો
૨૦૧૩	૧૮૦૦૦૦	૨૦૧૬	૧૧૦૦૦૦
૨૦૧૪	૧૪૪૦૦૦	૨૦૧૭	૧૦૦૦૦૦
૨૦૧૫	૧૩૪૦૦૦		

આવા ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% છે. ભાગીદારોનું વાજબી વેતન દરેક ભાગીદાર માટે રૂ. ૧૦૦૦ માસિક ગણી શકાય.

નોંધ: સરેરાશ નફો ભારિત પદ્ધતિથી શોધો.

(૧૬) પ્રિયા લીભિટિની નીચે આપેલી વિગતો પરથી ત્રણ વર્ષના અધિક નફાની ખરીદી પર આધારિત કંપનીનું પાદારીનું મૂલ્યાંકન આંકવાનું છે.

- (૧) ભરપાઈ થયેલી મૂડી
 - રૂ. ૧૦નો એક એવા પૂરા ભરાયેલ શેર - ૫૦૦૦
 - ૮%ના પ્રેફરન્સ શેર મૂડી રૂ. ૩૦૦૦૦૦
- (૨) સામાન્ય અનામત અને વધારો રૂ. ૩૭૫૦૦૦
- (૩) કંપનીની કુલ મિલકતોમાં ૭૦% કાયમી
 - (૭.૫% રોકાણો, ૨૦% ચાલુ મિલકતો એ બાકીની અવાસ્તવિક મિલકતોનો સમાવેશ થાય છે.)
- (૪) કાયમી મિલકતોનું વર્તમાન મૂલ્ય ચોપડે દશાવિલ મૂલ્ય કરતાં ૧૦% વધુ છે જ્યારે ચાલુ મિલકતોનું વર્તમાન મૂલ્ય ચોપડે દશાવિલ મૂલ્ય કરતાં ૩૨૦૦૦ ઓછું છે.
- (૫) અડધા રોકાણો ૧૦% કરપાત્ર સરકારી જામીનગીરીમાં છે જ્યારે બધા જ રોકાણોનો બજારભાવ તેની ચોપડે કિંમત કરતાં ૨૦% વધુ છે.
- (૬) ૫૦% કરવેરા પછીનો સરેરાશ નફો રૂ. ૧૮૪૦૦૦ છે.
- (૭) આવા જ પ્રકારના ધંધામાં રોકાયેલ અને સરેરાશ ૩૦% ડિવિડન ચૂકવતી કંપનીઓના શેરનો તેની ભરપાઈ થયેલી કિંમતના ત્રણ ગણી છે.
- (૮) અંકિત કંપની લીભિટિના છેદ્ધા નફાની લગતી માહિતી પરથી અધિક નફાની પાંચ વર્ષની ખરીદીની આધારે પાદારીની કિંમત નક્કી કરો.

વર્ષ	ચોખ્ખો નફો	કરવેરા	સામાન્ય અનામત	ડિરેક્ટરોની ફી
૨૦૦૩	૫૦૦૦૦	૨૫૦૦૦	૫૦૦૦	૭૫૦૦
૨૦૦૪	૧૫૦૦૦૦	૩૫૦૦૦	૧૦૦૦૦	૫૦૦૦

૨૦૦૫	૧૦૦૦૦૦	૫૦૦૦૦	૧૫૦૦૦	૧૦૦૦૦
૨૦૦૬	૨૦૦૦૦૦	૭૦૦૦૦	૨૦૦૦૦	૧૨૫૦૦૦
૨૦૦૭	૨૫૦૦૦૦	૧૦૦૦૦૦	૨૫૦૦૦	૧૫૦૦૦

વધારાની માહિતી:

- (૧) ચોખ્ખો નકો ડિરેક્ટરોની ફી દ્વારાનાં લીધા પહેલાનો છે. ડિરેક્ટરોની ફી છેદ્ધા વર્ષના આધારે ગણવાની છે.
- (૨) કંપનીએ ૫૦૦૦૦૦ ની સ્થિર મિલકતો પર ૧૦% લેખે ઘસારો કાચ્યો નથી.
- (૩) હવે નજામાંથી ૫૦% લેખે કરવેરાની જોગવાઈ કરવાની છે.
- (૪) કંપનીએ રૂ. ૧૦૦નો એક એવા ૫%ના રૂ. ૧૫૦૦૦૦ના કયુભ્યુલેટીવ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે.
- (૫) ધંધામાં રોકાયેલી મૂડી રૂ૫૦૦૦૦ ની છે.
- (૬) ઇક્વિટી શેર પર સામાન્ય અપેક્ષિત નજાનો દર ૬% છે. (સ.પ.યુ., ૨૦૦૬)

(૨૦) રાધા લિમિટેડનું તા. ૩૧-૦૩-૨૦૦૨ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

પાકું સરવૈયું

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
ઇક્વિટી શેર મૂડી		જમીન અને મકાન	૧૫૦૦૦૦૦
(દ્રેક રૂ. ૧૦નો એક એવા ૨૦૦૦૦૦ રૂ. શેર પૂરા વસુલ)	૨૦૦૦૦૦૦	ચંત્રો	૧૦૦૦૦૦૦
૧૦%ની પ્રફરન્સ શેરમૂડી		ચાલુ મિલકતો	૮૫૦૦૦૦
(૫૦૦૦૦ પ્રે. શેર દ્રેક રૂ.૧૦નો પૂરા ભરપાઈ)	૫૦૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૫૦૦૦૦
સામાન્ય અનામત	૪૦૦૦૦૦		
નજા-નુકશાન ખાતું	૩૦૦૦૦૦		
લેણાદારો	૨૦૦૦૦૦		
	૩૫૦૦૦૦૦		૩૫૦૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) જમીન અને મકાન, ચંત્રો તથા ચાલુ મિલકતોની હાલની બજાર કિંમત અનુક્રમે રૂ. ૨૦૦૦૦૦૦૦, રૂ. ૧૦૦૦૦૦ અને રૂ. ૬૦૦૦૦૦ છે.
- (૨) આ કંપનીના જેવો જ ધંધો કરતી અને ૧૫% ડિવિડન્ડ આપતી કંપનીના ઇક્વિટી શેરનો બજાર ભાવ તેની વસુલ રકમ કરતા ને ગણો છે.
- (૩) ૫૦% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો છેદ્ધા ગ્રાન્ડ વર્ષનો નજો અને ઉપયોગમાં લેવાનો ચોગ્ય ભાર નીચે મુજબ છે.

વર્ષ	નકો (₹)	ભાર
૧૯૯૯-૨૦૦૦	૫૦૦૦૦૦	૧
૨૦૦૦-૨૦૦૧	૫૭૫૦૦૦	૨
૨૦૦૧-૨૦૦૨	૬૫૦૦૦૦	૩

ઉપરની માહિતી પરથી અધિક નજાની ૩ વર્ષની ખરીદીના આધારે પાદારીની કિંમત શોધો.

(ગુ.યુ.નિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૨)

(૨૧) પુલકિત લિ. ના ધ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે છે.

(૧) સરેરાશ રોકાયેલી મૂડી રૂ. ૪૦૦૦૦૦

(૨) છેદ્ધાં ચાર વર્ષનો નફો નીચે મુજબ હતો.

$$૧૮૮૭નો નફો = ૧૮૮૮નો નફો + ૨૦\% = ૮૦૦૦૦$$

$$૧૮૮૮નો નફો = ૧૮૮૭નો નફો + ૫૦\%$$

$$૧૮૮૭નો નફો = ૧૮૮૪ નફો + ૩૫\%$$

(૩) નફો તપાસતા નીચેની માહિતી મળે છે:

(અ) સંચાલન ખર્ચ, વાર્ષિક ખર્ચ રૂ. ૪૦૦૦૦ની નોંધ થઈ નથી.

(બ) ૧૮૮૪ાં ચંત્રો વેચતાં થયેલ નફો રૂ. ૨૮૦૦ હતો.

(ક) ૧૮૮૭નાં આખર સ્ટોકની કિંમત રૂ. ૨૦૦૦ વધુ આંકવામાં આવી હતી.

(દ) તા. ૦૧-૦૧-૧૮૮૮ના રોજ રૂ. ૨૦૦૦૦ના ૧૦%ના ડિઝેનર, ૫%ના વટાવે બણાર પાડવા હતા, જે પાંચ વર્ષના અંતે પરત કરવાનાં હતા. ડિઝેનર વટાવની પૂરેપૂરી રકમ નફ-નુકશાન ખાતે ઉધારી હતી.

(ઇ) તા. ૦૧-૦૧-૧૮૮૭ના રોજ કોમ્પ્યુટર ગોઠવવાની ચૂકવેલ મજૂરીના રૂ. ૪૦૦૦ મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર્યા હતા, જે ખરેખર મૂડીખર્ચ ગણવાનો છે. ચંત્રો પર વાર્ષિક ૧૦% લેખ ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવામાં આવે છે.

(૪) આ પ્રકારનો ધ્યાનો કરતી કંપનીનો સામાન્ય ડીવીડન્ડનો દર ૩૫% છે. અને તેના રૂ. ૧૦ના ઇક્વીટી શેરની બજાર કિંમત રૂ. ૩૦ છે.

અધિક નફાની પાંચ વર્ષની ખરીદી જેટલી પાદારીની કિંમત શોધો. સરેરાશ નફો ગણતાં નફાનું વલણ ગણતરીમાં લેવાનું નથી.

(ઓ.ગુ.ચુનિ., ટી.વાય., એપ્રિલ ૧૮૮૮, દ.ગ.ચુનિ., ટી.વાય., એપ્રિલ ૧૮૮૭)

(૨૨) ભૂમિકા લિમિટેડના તા. ૩૧-૦૩-૨૦૦૪ના રોજમું સરવૈચું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ	મિલકત-લોણાં	રૂ
ભરાયેલી મૂડીઃ		પાદારી	૧૦૦૦૦૦
ઇ. શેર દરેક રૂ. ૧૦૦નો ઓક એવા	૫૦૦૦૦૦	કાયમી મિલકતો	૫૦૦૦૦૦
પૂરા ભરાયેલ		રોકાણો	૨૫૦૦૦૦
સામાન્ય અનામત	૩૦૦૦૦૦	(બ.ક્રિ. રૂ. ૧૫૦૦૦૦)	
પુનઃમુલ્યાંકન અનામત	૧૦૦૦૦૦	ચાલુ મિલકતો (રૂ. ૧૦૦૦૦૦૦ની	૩૦૦૦૦૦
૧૦%ના ડિઝેનર્સ	૨૦૦૦૦૦	બેંક સિલક સહિત)	
લેણાદો	૧૦૦૦૦૦	ડિઝેનર વટાવ	૨૦૦૦૦
	૧૨૦૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૩૦૦૦૦
			૧૨૦૦૦૦૦

ચોપડે દશાવિલ પાદારી તેની વાસ્તવિક કિંમતના ૮૦% છે.

ચોપડે દશાવિલ કાયમી મિલકતો તેની બજાર કિંમતે છે, જે તેની મૂળ કિંમત કરતાં ૨૫% વધુ છે, જ્યારે ચાલુ મિલકતોની બજારકિંમત ૧૦% ઓછી છે.

કંપનીનો છેદ્ધાં પાંચ વર્ષનો ઉપ્યુક્ત લેખ કરવેશ પહેલાનો કુલ નફો રૂ. ૧૦૦૦૦૦૦ છે અને અપેક્ષિત વળતરનો દર ૧૩% છે.

સરેરાશ ચોપડા નફાના મૂડીકરણની પદ્ધતિએ પાદારીની ગણતરી કરો.

(ગુ.ચુનિ., ટી.વાય., માર્ચ ૨૦૦૫)

(૨૩) માગયા મુજબ જવાબો આપો.

- (૧) જે એક પેઢીનો સરેરાશ ચોખ્ખો નફો (કરવેરા બાદ) રૂ. ૧૪૦૦૦૦ હોય અને અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીને આધારે, ગણાયેલી આ પેઢીની પાઘડીની કિંમત રૂ. ૧૨૦૦૦૦ હોય અને આ જાતના ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% હોય તો પેઢીમાં રોકાયેલી મૂડી શોધો.
- (૨) એક પેઢીમાં રોકાયેલી મૂડી રૂ. ૧૫૦૦૦૦ છે. આ પેઢીનો વાર્ષિક સરેરાશ નફો રૂ. ૮૦૦૦ છે. રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૮% છે. આ પેઢીની પાઘડીની કિંમતની ગણતરી કરો.
- (૩) પેઢીની કુલ મિલકતોની કિંમત રૂ. ૮૨૭૩૪૨ અંકવાંામાં આવી છે જ્યારે કુલ દેવા રૂ. ૨૭૩૪૨ના છે. સરેરાશ ચોખ્ખો નફો (કરવેરા બાદ) રૂ. ૧૩૮૦૦૦ છે. અને અધિક નફાની બે વર્ષની ખરીદીને આધારે ગણાયેલી આ પેઢીની પાઘડીની કિંમત રૂ. ૬૦૦૦૦ છે.

(ગુ.યુનિ., ટી.વાય., માર્ચ ૧૯૮૭, સૌ.યુનિ., એસ.વાય., માર્ચ ૧૯૮૮)

(૨૪) અંજના લિ. નું તા. ૩૧-૦૩-૧૯૮૪ના રોજનું પાકુ સરવૈચુ નીચે મુજબ છે.

મૂડી-દેવાં	₹	મિલકત-લેણાં	₹
૧૦% કચુ. પ્રેફ. રોરમૂડી	૩૦૦૦૦૦	પાઘડી	૧૦૦૦૦૦
ઇક્વિટી શેરમૂડી	૭૦૦૦૦૦	મકાન (મૂળ કિંમત)	૭૦૦૦૦૦
સામાન્ય અનામત	૫૦૦૦૦૦	ચંત્રો (મૂળ કિંમત)	૮૦૦૦૦૦
૧૫%ના ડીલોંચર	૪૦૦૦૦૦	૧૦%ના કરપાત્ર રોકાણો	
લેણદારો	૧૫૦૦૦૦	(દાર્શનિક કિંમત રૂ.૧૦૦૦૦૦ છે)	૧૨૦૦૦૦
દેવીહૂંડી	૫૦૦૦૦	ગૌણ કંપનીના શેરો	૧૦૦૦૦૦
ચૂકવવાના બાકી ખર્ચ	૧૦૦૦૦	સ્ટોક	૨૮૦૦૦૦
કરવેરીની જોગવાઈ	૨૦૦૦૦૦	દેવાદારો	૨૦૦૦૦૦
કર્મચારી અક. વળતર ભંડોળ	૨૦૦૦૦	- ધા. અનામત	૧૦૦૦૦
કર્મચારી નફાભાગ ભંડોળ	૭૦૦૦૦	રોકડ અને બેંક સિલક	૮૦૦૦૦
ઘસારા ભંડોળ:		અગાઉથી ચૂકવેલ ખર્ચ	૩૦૦૦૦
મકાન	૫૦૦૦૦	જહેરાત ઉપલક ખાતું	૧૫૦૦૦૦
ચંત્રો	૧૦૦૦૦૦		
	૧૫૦૦૦૦		૨૫૫૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) મકાનની હાલની બજાર કિંમત રૂ. ૬૦૦૦૦૦ છે. જ્યારે બાકીની મિલકતો ચોપડે દર્શાવેલ કિંમતે લેવાની છે.
 - (૨) અંજના લિ. જે જાતનો ધંધો કરે છે તે ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% ગણાય છે.
 - (૩) ગયા વર્ષ સુધીની આવકવેરાની આકાણી પૂરી થયેલી છે અને તે અંગે કોઈ જવાબદારી બાકી રહેતી નથી. કરવેરીની જોગવાઈ ચાલુ વર્ષના નફાના ૫૦% લેખે કરવામાં આવે છે.
 - (૪) છેદ્ધા ત્રણ વર્ષથી કંપનીનો કરવેરા પહેલાનો નફો દર વર્ષે રૂ. ૬૦૦૦૦ જેટલો વધે છે.
- છેદ્ધા ત્રણ વર્ષના ભારિત સરેરાશ અધિક નફાના આધારે, પાઘડીનું મૂલ્ય ત્રણ વર્ષની કિંમતે ગણો.

(ઉ.ગુ.યુનિ., ટી.વાય., એપ્રિલ ૧૯૮૪)

પ્રકારણ - ૯
શેરનું મૂલ્યાંકન

- ૭.૧ પ્રસ્તાવના
- ૭.૨ શેર મૂલ્યાંકનને અસર કરતાં પરીબળો
- ૭.૩ કેવાં સંજોગોમાં શેરનું મૂલ્યાંકન ખુબજ જરૂરી છે?
- ૭.૪ શેરના પ્રકારો અને તેનું મૂલ્યાંકન
- ૭.૫ શેર મૂલ્યાંકનની પદ્ધતિઓ
- ૭.૬ શેરની આંતરીક મૂલ્યાંકનની પદ્ધતિ
- ૭.૭ - ઉપજના ધોરણો શેરનું મૂલ્યાંકન
- ૭.૮ - વ્યાજબાઈ કિમતની પદ્ધતિ
- ૭.૯ સ્વાધ્યાય

પ્રકરણ - ૫
શેરનું મૂલ્યાંકન

ક.૧ પ્રસ્તાવના:

શેરનું મૂલ્યાંકન મોટેભાગે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ કંપનીમાં માળખામાં બંધારણમાં મોટા ફેરફારો થવાનાં હોય દાખલા તરીકે કંપનીનું વેચાણ, કંપની બંધ કરવામાં આવે અથવા રોક કંપનીનું બીજુ કંપની સાથે જોડાણ કરવામાં આવે વગેરે. આવા સંજોગોમાં શેરનું મૂલ્યાંકન કરવુંએ ખૂબ જ મહત્વની બાબત બની જાય છે. મૂલ્યાંકન દરમિયાન શેરની કિંમત કેટલી આંકડી તે નક્કી કરવામાં આવે છે.

બજારમાં ઘણાં બધા પરીબળો છે આંતરીક તથા બાધ્ય જે શેરની કિંમતને અસર કરતાં જોવા મળે છે શેરના મૂલ્યાંકન કરતી વખતે આ દરેક પરિબળોને દ્યાનમાં રાખવા ખૂબજ જરૂરી છે. ફક્ત શેરની કિંમત પરથી કંપનીની નાણાંકીય પરિસ્થિતિ આંકડી એ ઘણીવખત ખૂબ જ મોટી મુશ્કેલી સર્જ શકે છે. તેના માટે આંતરીક પરીબળો જેવા કે સંચાલન, કામદારો, કંપનીના વિધિ વિભાગો તથા બાધ્ય પરીબળો જેવાં કે રાજકીય પરીબળો, બજારના પરીબળો, ટેકનોલોજી, ગ્રાહકો, બેન્કો, રોકાણકારો વગેરેને દ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે.

ઘણીવખત ખાતી કંપનીના શેરનો ભાવ બજારમાં સારો છે તેવું દ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવામાં આવે તો તે ભવિષ્યમાં ખૂબ જ મોટી નાણાંકીય સમસ્યા ઉભી કરી શકે છે. કારણકે ઘણાં બધા બાધ્ય પરીબળો છે કે જે કંપનીના શેરને અસર કરે છે.

જેમ આપણે જાણીએ છીએ કે દરેક કંપની પોતાના શેરની નોંધણી શેરબજારમાં કરાવતી નથી અથવા ઘણી બધી કંપનીના શેરનું બજારમાં ખરીદ વેચાણ થતું નથી આવા સંજોગોમાં શેરનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી કામ બની જાય છે. આવા સંજોગોમાં શેરનું મૂલ્યાંકન બજારના ભાવે અથવા બીજુ અન્ય કોઈ પદ્ધતિના બદલે નામાના મૂળસિદ્ધાંતો દ્વારા કરવામાં આવે તો ખૂબજ સારુ અને સચોટ પરિણામ મેળવી શકાય છે.

કંપની ધારા ૨૦૧૩, પ્રમાણે ખાનગી કંપનીઓને બજારમાં શેરના ખરીદ વેચાણ કરવાની છૂટ આપવામાં આવી નથી, જેથી બજારમાં ખાનગી કંપનીના શેરનો ભાવ નક્કી કરવો એ અસંભવ બાબત છે, માટે જ્યારે ખાનગી કંપનીના શેરનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે તમામ આંતરીક તથા બાધ્ય પરીબળો દ્યાનમાં રાખીને કરવું જોઈએ.

આમ, આપણે એમ કહી શકીએ કે શેરના મૂલ્યાંકન નો પ્રરૂ એ ખૂબ જ અધ્યરો અને જટીલ ભરેલો છે.

ક.૨ શેર મૂલ્યાંકનને અસર કરતાં પરીબળો:

આપણે ઉપર જોયું કે શેરના મૂલ્યાંકનનો પ્રરૂ એ ખૂબ જ જટીલ અને ગુંચવાડા ભરેલો છે, શેરનું મૂલ્યાંકન ફક્ત બજાર ભાવે કરવું એ ખૂબજ મોટો ભૂલ ભરેલો નિર્ણય ગણી શકાય. કારણ કે શેરના મૂલ્યને ઘણાં બધાં પરીબળો અસર કરે છે, જેવા કે

૧. આંતરીક પરીબળો

૨. બાધ્ય પરીબળો

૧. આંતરીક પરીબળો:

શેરના મૂલ્યને અસર કરતાં આંતરીક પરીબળો એટલે એવાં પરિબળો જે કંપનીના અંદર જ ઉદ્ભવે છે અને તેની અસર ઉભી કરે છે. આ પરીબળો એવાં પરીબળો છે જેના પર કંપની સારુ સંચાલન કરીને તેના પર કાલુ મેળવી શકે છે. શેરના મૂલ્યાંકનને અસર કરતાં આંતરીક પરીબળો નીચે મુજબના છે.

- ૧) પાદડી: પાદડીને ધંધામાં ખુલજ મોટું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે પાદડીનું મૂલ્યએ હકીકતમાં ધંધાની નજી કમાવવાની શક્તિ પર રહેલું છે. એટલે એમ માનીને ચાલવામાં આવે છે કે ધંધાની પાદડીનું મૂલ્ય વધારે એ ધંધાની નજી કમાવવાની ક્ષમતા ખુલજ વધારે છે. અને જે કંપની સારો નજી મેળવે છે તે કંપની પોતાના રોકાણકારોને સારુ વળતર આપે છે, જેથી આવા રચનાત્મક સંજોગોમાં શેરનું મૂલ્યાંકન વધુ ગણાય છે અને સહેલી રીતે કરી શકાય છે.
- ૨) સંચાલનવી ઇપરેખા: સંચાલનવી ઇપરેખા ખુલજ મોટી રીતે શેરનાં મૂલ્યાંકનને અસર કરે છે. તો ધંધાના સંચાલનમાં ભાગોલા કુશળતા અનુભવવાળા લોકો કામ કરતાં હશે તો તે શેરના મૂલ્ય ઉપર હકારાત્મક અસર પાડે છે. અને આનાથી વિરુદ્ધ જો કંપનીમાં બિનઅનુભવી અને કાર્યશરીલ ભાગાસોની તંત્ત્રી હશે તો તે શેરના મૂલ્ય ઉપર નકારાત્મક અસર પાડે છે અને સાથે-સાથે કંપનીના નામનું પણ બજારમાં ઘોવાણ થાય છે.
- ૩) કંપનીના આંતરીક સંબંધો: જો કંપનીના ઉપરના સ્તરના મેનેજરો, મદ્ય સ્તરનાં કર્મચારીઓ તથા નીચલાં સ્તરાએ કામ કરતા ભાગાસો જોડે સારા હકારાત્મક અને રચનાત્મક સંબંધો હશે તો તેના પરીણામો કંપનીના શેરના મૂલ્યની પણ વૃદ્ધી થાય છે પરંતુ જો કંપનીના આંતરીક સંબંધો નકારાત્મક હશે તો તેનાં કારણે કંપનીમાં કર્મચારીઓ દ્વારા હડતાળના પ્રશ્નનો ઉભાં થાય છે. જેના કારણે કંપનીનો નજી ઘટે છે સાથે સાથે શેરનું મૂલ્ય પણ ઘટે છે.
- ૪) આર્થિક પરિસ્થિતિ: કંપનીની આર્થિક પરિસ્થિતિએ ખુલજ મહત્વનું અને સીધી રીતે શેરનાં મૂલ્યાંકનને અસર કરતું પરીબળ છે. કંપનીની અનામતો, ફંડ, ડિવિડન નિતી શેરની કિંમત ઉપર સીધી અસર કરે છે. જેટલી કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી તેટલું જ વળતર કંપની વધારે કભાય છે અને બજારમાં શેરનાં ભાવ વધે છે. જેમ-જેમ કંપનીનું રોકાણનું વળતર ઘટતું જાય છે તેમ તેમ કંપનીના શેરનું મૂલ્ય બજારમાં ઘટતું જાય છે.
- ૫) કંપનીની બજાર નિતી: જો બજારમાં કંપની ધંધો ફક્ત ને ફક્ત નજી કમાવવાના હેતુથી કરતી હોયથો તેની અસર ગ્રાહકો ઉપર નકારાત્મક પડે છે જેનાથી લાંબાગાળે કંપનીનો નજી ધટ્ટો જાય છે અને શેરની કિંમત ઘટે છે. જો કંપની બજારમાં નજી કમાવવાની સાથે સાથે સમાજને જરૂરી કાર્યમાં પણ પોતાનો ભાગ ભજયે તો તેની હકારાત્મક અસર બજાર પર થાય છે અને આવી નિતીથી ગ્રાહકો વધુ ને વધુ કંપનીની વસ્તુઓને ખરીદે છે જેથી સીધી અસર નજી ઉપર થાય છે અને અંતે શેરનું મૂલ્ય પણ વધે છે.
- ૨. બાધ્ય પરીબળો:**
- શેરના મૂલ્યને અસર કરતાં બાધ્ય પરીબળો એ કંપનીની બહાર ઉદ્ભબે છે અને તેની અસર ઉલ્લી કરે છે આ એવા પરિબળો છે જેના ઉપર કંપની કાબુ મેળવી શકતી નથી કંપનીના શેરના કિંમતને અસર કરતાં બાધ્ય પરીબળો નીચે મુજબના છે.
- ૧) બજારમાં શેરનું ખરીદ વેચાણા: જો શેરનાં બજારમાં કંપનીના શેર ખરીદનારની સંખ્યા વધુ અને વેચાનારની સંખ્યા ઓછી હોય તો કંપનીના શેરની કિંમત બજારમાં વધે છે. અને બજારમાં કંપનીના શેર ખરીદનારની સંખ્યા વધુ હોય તો કંપનીના શેરનું મૂલ્ય બજારમાં ઘટે છે.
- ૨) બજારમાં બેંકનો વ્યાજદર: જો બજારમાં આવેલી બેંકો ગ્રાહકોને તેમની થાપણો અને બચત ઉપર વ્યાજનો દર વધારે આપે તો આવા સંજોગોમાં ગ્રાહકો ના એંકિય સુરક્ષા અને નજાને દ્યાને લઈ બેંકોમાં વધુ રોકાણ કરે છે જેથી શેરની કિંમત ઘટે છે અને બેંકો આની વિરુદ્ધ દિશામાં કામ કરે તો ગ્રાહકો પોતાનું રોકાણ શેરમાં કરવા માટે વધુ આકષ્ય છે અને જેથી શેરની કિંમત વધે છે.
- ૩) રાજકીય પરિસ્થિતિ: દેશની રાજકીય પરિસ્થિતિ પણ શેરના મૂલ્યને અસર કરે છે. જો કોઈ એવો રાજકીય પક્ષ સત્તામાં આવે છે જે ઔદ્ઘોગિક વૃદ્ધીના વિરોધમાં હોય, ઔદ્ઘોગિક બદલાવ કરતાં અલગ વિચારસરણી ઘરાપતી હોય તો આવા સંજોગોમાં ઔદ્ઘોગિક વિકાસ દરમાં ઘટાડો થાય છે અને શેરની કિંમતમાં પણ ઘટાડો થાય છે. માટે જો ઔદ્ઘોગિક વિકાસના વિચારધારાવાળો રાજકીય પક્ષ સત્તામાં આવે તો દેશના વિકાસમાં

ઉધોગોનું મહત્વ વધે છે સાથે-સાથે રોકાણકારો કંપનીઓમાં રોકાણ કરવા માટે આકર્ષય છે અને અંતે પરીણામે શેરની કિંમત વધે છે.

૪) રોકાણકારોની વિચારસરણી: દેશના લોકો દ્વારા કરવામાં આવતી બચત અને રોકાણકારોની વિચારસરણી પણ એક ખુબજ મહત્વનું પરીબળ છે. જો બચત ઘણી બધી હોય પરંતુ તેઓ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર પોતાનું રોકાણ કરવા માંગતા હોત તો આવા સમયે બેંક બચત અને બેંક થાપણોમાં વધારો થાય છે જેની સીધી અસર શેરની કિંમત ઉપર જોવા મળે છે. અને રોકાણકારો વધુ વળતરના હેતુથી જોખમ લઈને પોતાની બચતનું શેરમાં રોકાણ કરે, તો શેરની કિંમતમાં આપો-આપ વધારો જોવા મળે છે.

૫) સરકારી નિતી નિયમો: સરકારી નિતી-નિયમો પણ એક ખુબ જ મહત્વનું પરીબળ છે કે શેરના મૂલ્ય પર અસર કરે છે. સરકાર દ્વારા વધારે કર ઉધરાવવામાં આવે, વારંવાર ઔદ્યોગિક નિતીઓમાં બદલાય, આચાત-નિકાસની નિતીઓમાં બદલાય વગેરેને કારણો રોકાણકારો ઔદ્યોગિક રોકાણ તરફ આકર્ષિતા નથી પરંતુ એ સરકારની નિતી ઉધોગોને રક્ષણ આપવાની હોય અને ઓછો કર ઉધરાવવાની હોય તો રોકાણકારો ઉધોગો તરફ આકર્ષય છે અને અંતે શેરની કિંમતમાં વૃદ્ધિ જોવા મળે છે.

૬) સરકારનો ઔદ્યોગિક વિકાસમાં ફાળો: સરકારનો ઔદ્યોગિક વિકાસમાં ફાળો શેરની કિંમતને અસર કર્તું મહત્વનું પરીબળ છે. ખાસ કરીને નાના અને મદ્યયમ કંડના ઉધોગોને સરકાર આર્થિક સહાય પુરી પાડે અને અન્ય સાધનો પણ પુરી પાડે તો ઉધોગોની નાણાંકીય પરિસ્થિતિ સુધેરે છે જેની સીધી અસર શેરની કિંમત ઉપર થાય છે અને અને શેરની કિંમતમાં વધારો જોવા મળે છે અને બીજી બાજુ જો સરકાર કોઈપણ પ્રકારનો આર્થિક તથા અન્ય સહયોગ ન આપે તો ઘણી વખત ઉધોગોમાં નાણાંકીય કટોકટીની અસર વતર્ય છે જેને કારણે શેરની કિંમતમાં ઘટાડો જોવા મળે છે.

૭) બજારનું વેપારી ચક: બજારમાં વેપારી ચકએ ઉપર નીચે કર્યા કરે છે જે શેરની કિંમતને અસર કરે છે જો બજારમાં તેજુની પરીસ્થિતી જોવા મળે તો શરેની કિંમતમાં પણ આપો-આપ વધારો થાય છે અને જો બજારમાં મંદીની પરીસ્થિતી ઉદ્ભવેતો શેરની કિંમતમાં પણ ઘટાડો જોવા મળે છે આમ, શેરની કિંમતમાં પણ બજારમાં ચાલતી તેજુ અને મંદીની પરીસ્થિતી ઉપર આધાર રાખે છે.

૮) રોકાણકારો દ્વારા લેવામાં આવતાં પગલાં: શેરની કિંમતને દ્યાનમાં રાખીને રોકાણકારો દ્વારા લેવામાં આવતાં વિવિધ પગલાં જેવાકે પોતાના પૈસાનું રોકાણ મ્યુચ્યુલ ફંડમાં કરે, બેન્કોમાં થાપણ મુકે, સોનાના દાગીના ખરીદ અથવા તો સ્થીર મીલ્કટો ખરીટ તો તેની નકારાત્મક અસર શેરની કિંમત ઉપર જોવા મળે છે. પરંતુ જો રોકાણકારો જોખમ ઉઠાવીને પોતાનું રોકાણ શેરમાં કરે તો તેની હકારાત્મક અસર શેરની કિંમત પર જોવા મળે છે.

૯) આંતરરાષ્ટ્રીય રોકાણોની પરિસ્થિતિ: આજનાં આ હરીફાઇપાળા સમયમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોનું દેશોમાં રોકાણ ખુબજ મહત્વનો ભાગ ભજ્યે છે જો દેશમાં આંતરરાષ્ટ્રીય રોકાણોમાં વધારો જોવા મળે છે તો શેરની કિંમતમાં વધારો જોવા મળે છે અને જો આંતરરાષ્ટ્રીય રોકાણોમાં ઘટાડો જોવા મળે તો તેની સીધી નકારાત્મક અસર શેરની કિંમતમાં જોવા મળે છે.

ક.૩ કેવાં સંજોગોમાં શેરનું મૂલ્યાંકન ખુબજ જરૂરી છે?

કંપનીમાં ઘણાં બધાં સંજોગો ઉદ્ભવે જેનાં કારણોસર શેરનું મૂલ્યાંકન ખુબ જ જરૂરી બની જાય છે. કંપની નીચેના સંજોગમાં શેરનું મૂલ્યાંકન કરે છે.

- ૧) રોકાણકારોને કંપનીના શેરના રોકાણમાં બિલકુલ રસ ન હોયતો તેવા સંજોગોમાં કંપનીના શેરોનું ખરીદ-વેચાણ વધેતે માટે શેરનું મૂલ્યાંકન જરૂરી છે.
- ૨) જયારે કંપની પોતાનો ધંધો બીજુ કંપનીને વેચાણ કરી દે છે ત્યારે શેરની કિંમત નક્કી કરવામાં આવે છે.

- ૩) જયારે બે અથવા બેથી વધારે કંપનીઓ પોતાના ધંધાનો સમાવેશ કરે ત્યારે શેરનું મૂલ્યાંકન જરૂરી છે.
- ૪) જયારે કંપનીને લોનની જરૂરીયાત હોય ત્યારે શેરનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
- ૫) જયારે કોઈની ફી ચૂકવણી હોય ત્યારે શેરનું મૂલ્યાંકલ કરવામાં આવે છે.
- ૬) જયારે પ્રેફરન્સ શેરનું દીક્ષિયટી શેરમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે શેરનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
- ૭) જયારે કંપનીની મિલકતોનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે આવા સંજોગોમાં શેરનું મૂલ્યાંકન જરૂરી છે.

૫.૪ શેરના પ્રકારો અને તેનું મૂલ્યાંકન :

શેરના મુખ્યત્વે બે પ્રકારો છે. ૧) દીક્ષિયટી શેર ૨) પ્રેફરન્સ શેર

૧) દીક્ષિયટી શેર: જયારે પણ શેરનું મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને દીક્ષિયટી શેરના મૂલ્યાંકન કરતી વખતે ખુબજ જટીલ પ્રક્રો સર્જાય છે. કારણ કે કંપની ધારા મુજબ દીક્ષિયટી શેર હોલ્ડર કંપનીના સાચા અર્થમાં માલિકો છે. તેઓની કંપનીમાં વધુ નજો ઉદ્ભવે તો વધારે ડિવિડન મળવાના હકો મળેલાં છે. એટલે કે જો કંપનીના નકારામાં વધારો ઘટાડો થાય તેમ તેમને આપવામાં આવતા ડીવીડનમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે અને તેના કારણે દીક્ષિયટી શેરનો ભાવ બજારમાં બદલાયા કરે છે. તેથી જ દીક્ષિયટી શેરના મૂલ્યાંકનના સમયે કંપનીઓને ખુબજ મુશ્કેલીનો સામનો ફરવો પડે છે.

૨) પ્રેફરન્સ શેર: પ્રેફરન્સ શેર એટલે પસંદગીના શેર કંપની ધારા મુજબ પ્રેફરન્સ શેર ઘરાવતાં શેર હોલ્ડરોને દીક્ષિયટી શેર ધારકો જેવાં કોઈપણ પ્રકારના હકકો આપવામાં આવતાં નથી. પ્રેફરન્સ શેર હોલ્ડરોને બે પ્રકારના હકકો આપવામાં આવેલા છે. ૧) દીક્ષિયટી શેર હોલ્ડર કરતાં પહેલા ડિવિડન મેળવવાનો હકક તથા ૨) કંપની પોતાનો ધંધો બંધ કરે, વેચાણ કરે અથવા બીજી કંપની સાથે જોડાય ત્યારે તેઓને પોતાની રોકેલી મૂડી પરત મેળવવાનો પ્રથમ અધિકાર આપવામાં આવે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપવામાં આવતું ડિવિડન એ નક્કી કરેલા ડિવિડના દર જેટલુંજ આપવામાં આવે છે. નજાની વધુ - ઘટ સાથે તેમને ડિવિડનમાં કોઈ ફેરફાર થતો નથી માટે પ્રેફરન્સ શેરની કિમતમાં પણ બજારમાં કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળતો નથી. જેથી જયારે પણ શેરનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે પ્રેફરન્સ શેરનું મૂલ્યાંકન એકદમ સરળ રીતે કરી શકાય છે.

શેરનું મૂલ્યાંકન એટલે શું?

સામાન્ય ભાષામાં કહીએ તો શેરનું મૂલ્યાંકન એટલે શેરની નવી કિમત શોધવી. આ શેરનું સંપૂર્ણ મૂલ્યાંકન એક વિશ્લેષક ક્રારા ધંધાના સંચાલન, ધંધાની મિલકતો, બજાર કિમતે તથા દેવાઓને દ્યાનમાં રાખીને કરવામાં આવે છે. શેરના મૂલ્યાંકન ધારી બધી રીતે કરી શકાય છે, જેવી કે આંતરીક કિમત, શેરની ઉપજના ધોરણ અને વ્યાજની કિમતથી શેરનું નંબું સાચું મૂલ્ય જાણી શકાય છે.

૫.૫ શેર મૂલ્યાંકનની પદ્ધતિઓ:

શેર મૂલ્યાંકનની મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે.

- ૧) શેરની આંતરીક મૂલ્યાંકનની પદ્ધતિ (Intrinsic Value Method)
- ૨) શેરની ઉપજના ધોરણે મૂલ્યાંકન (Share Valuation on Yield Basis)
- ૩) વ્યાજની કિમતની પદ્ધતિ (Fair Value Method)

૫.૬ શેરની આંતરીક મૂલ્યાંકનની પદ્ધતિ:

આ પદ્ધતિને પાકા-સરવૈચાની પદ્ધતિ અથવા એસેટ-લેકીંગ અથવા દીક્ષિયટી શેરની મૂલ્યાંકનની પાયાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં હમેશા રોકાણકારોના રોકાણોની સલામતી જળવાય

રહે તેની ઉપર વધુ ભાર મુકવામાં આવે છે. આ પદ્ધતિમાં શેરની આંતરીક કિમત જાણવા માટે ધંધાની ચોખ્ખી મિલકતોને શેરની સંખ્યા વડે ભાગવામાં આવે છે. અહીંથા આ પદ્ધતિમાં શેરનું મૂલ્યાંકન કરતા પહેલા ધંધાની ચોખ્ખી મિલકતોનું મૂલ્યાંકન કરતું પણ ખૂબ જ જરૂરી બાબત છે.

શેરની આંતરીક મૂલ્યાંકનની પદ્ધતિમાં ચોખ્ખી મિલકતો ગણતી વખતે દ્વાનમાં રાખવાની જરૂરી બાબતો:

ચોખ્ખી મિલકતોની ગણતરી વખતે નીચે આપેલી બાબતોનું દ્વાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે:

૧) તમામ બિન લોંધાયેલી મિલકતો અને જવાબદારીઓની નોંધણી: આ પદ્ધતિ પ્રમાણે શેરનું આંતરીક મૂલ્યાંકન કરતાં પહેલાં ધંધામાં બિનનોંધાયેલી મિલકતો અને જવાબદારીઓનું ચોપડામાં નોંધણી કરવાની ખૂબ જ જરૂરી છે. જો તમામ મિલકતો અને દેવાની ચોપડે નોંધ કરવામાં ન આવે તો ધંધાની સાચી ચોખ્ખી મિલકતોની કિમત જાણી શકાતી નથી અને જેણી સીધી અસર શેરના મૂલ્યાંકન પર થાય છે.

૨) ધાલખાદ અનામત તથા ધસારાની ગણતરી કરવી: શેરના આંતરીક મૂલ્યાંકનની પદ્ધતિમાં ચોખ્ખી મિલકતોની ગણતરી માટે ધાલખાદ તથા ધસારાની જોગવાઈઓને પણ દ્વાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ ચોખ્ખી મિલકતોની ગણતરી કરવામાં આવે ત્યારે રસ્થીર મિલકતોમાંથી ધસારો તથા દેવાનોમાંથી ધાલખાદ અનામતને બાદ કરવા ખુબજ જરૂરી છે. જેથી ધંધાની ચોખ્ખી મિલકતોની સાચી કિમત જાણી શકાય. જો આમ કરવામાં ન આવે તો મિલકતોની કિમત વધારે દેખાઈ આવે છે જેણી અસર શેરના મૂલ્યાંકનની કિમત પર થાય છે.

૩) અવાસ્તવિક મિલકતો:

ધંધાની અવાસ્તવિક મિલકતો જેવી કે શેર અને ડિબેન્ચર બહાર પાડતી વખતે આપવામાં આવતો વટાય, નફા-નુકશાનની ઉધાર બાકી એટલે કે ખોટ, પ્રાથમિક ખર્ચ, ધંધાના જાહેરત માટેનાં ખર્ચ વગેરેને પાકા સરવૈચામાં દરશિવલામાં આવે છે. હીકિતમાં આ તમામ મિલકતોનું વેચાણ થઈ શકતું નથી અને જો કરવામાં આવે તો કોઈપણ પ્રકારના નાણાં ઉપજતા નથી. આથી, જ્યારે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવામાં આવે ત્યારે અવાસ્તવિક મિલકતો દ્વાનમાં લેવામાં આવતી નથી.

૪) અસ્થિર મિલકતોનું મૂલ્યાંકન બજાર કિમતે કરવું: અસ્થિર મિલકતો એટલે કે એવી મિલકતો જેણી કિમત એક સરખી રહેતી નથી, તેની કિમત અવારનવાર બદલાયા કરે છે દા.ત. રોકડ, સ્ટોક વગેરે. તેથી જ્યારે પણ શેરનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે ચોખ્ખી મિલકતોની ગણતરી વખતે અસ્થિર મિલકતોનું મૂલ્યાંકન તેની બજાર કિમતે કરવું જોઈએ જેથી તેણી કિમતનું સાચું મૂલ્યાંકન થઈ શકે.

૫) પાઘડીની ગણતરી: પાઘડીએ ધંધાની પ્રતિષ્ઠાનું એક પ્રતિક છે. એટલેકે જ્યારે શેરનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે પાઘડીની ગણતરી ખૂબ જ જરૂરી છે. જો પાઘડીની કિમત ધંધાના ચોપડે દરશિવલ ન હોય છતાં પણ બજારમાં ધંધાના પતિષ્ઠાની મૂલ્ય ઉપજતી હોય તો પાઘડીની કિમતની ગણતરી કરી તેનો ચોખ્ખી મિલકતની ગણતરીમાં સમાવેશ કરવો જોઈએ.

૬) તમામ દેવાઓને બાદ કરવું:

શેરની આંતરીક મૂલ્યાંકન વખતે કરવામાં આવતી ચોખ્ખી મિલકતો ગણતરીમાં લાંબા તથા ટુકાંગાળામાં તમામ દેવાઓને દ્વાનમાં રાખી બાદ કરવાં જરૂરી છે. જેમ કે લેણાદારો, દેલીહૂંડી ચૂકુવવાના બાકી ખર્ચ અગાઉથી મળેલી આવકો, લાંબા ટુકાંગાળાની લોન, ડિબેન્ચર દરેક પ્રકારની જોગવાઈઓ, પ્રેફરન્સ શેરનું ડિવિડન તથા પ્રેફરન્સ શેરની મુડી, નહીં નોંધાયેલા દેવાદારો વગેરેને કુલ મિલકતોમાંથી બાદ કરવામાં આવે છે.

૭) ધંધાના અનામત ભંડોળો: ધંધાની અનામત ભંડોળમાં સંચિત નફો, સામાન્ય અનામત, મૂડી અનામત, વગેરેનો સમાવેશ થાય છે. આવા અનામત/ભંડોળ સામે કોઈપણ પ્રકારની ચૂકુવવાની જવાબદારીઓ હોતી નથી. ચોખ્ખી મિલકતોની ગણતરી કરતી વખતે આવા તમામ પ્રકારનાં ભંડોળો દ્વાને લેવાતા નથી. બીજા શબ્દોમાં કહિયે તો આવા ભંડોળો ચોખ્ખી મિલકતની ગણતરી વખત બાદ કરવા નહીં.

૮) પસંદગીના શેરધારકોની મૂડી તથા ડિવિડન:

જ્યારે પણ ધંધાનું વેચાણ કરવામાં આવે, બીજા જોકે સંયોજન કરવામાં આવે અથવા તો ધંધાનું વિસર્જન કરવામાં આવે ત્યારે કંપની ધારા મુજબ પસંદગીના શેરધારકોને પોતાનું ડિવિડન તથા મૂડી મેળવવાનો પ્રથમ અધિકાર છે. તદુંપરાંત જો કયુભ્યુલીટીવ પ્રેફરન્સ શેર ધારકો હોય તો તેઓને પાછળાં વર્ષનું ચડેલું ડિવિડન પણ મેળવવાનો પ્રથમ અધિકાર હોય છે. માટે જ્યારે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવામાં આવે ત્યારે ચોખ્ખી મિલકતોમાંથી પ્રેફરન્સ મૂડી તથા ડીવીડન બાદ કરવામાં આવે છે.

શેરની આંતરીક મૂલ્યાંકનની પદ્ધતિ હેઠળ શેરની કિંમતની ગણતરી કરવાનું સૂત્ર નીચે મુજબ છે.

શેરની આંતરીક કિંમત =	ચોખ્ખી મિલકતો
	(ઓર્ડિનરી) / ઇડિયટી શેરની સંખ્યા

જ્યારે ચોખ્ખી મિલકતો = કુલ મિલકતો-તમામ બાહ્ય દેવા

કુલ મિલકતોમાં નીચે દર્શાવેલ અસ્ક્રયામતોનો સમાવેશ થાય છે.

- પાદડીની કિંમતનું મૂલ્યાંકન
- તમામ સ્થિર મિલકતોનું બજાર કિંમતે મૂલ્યાંકન
- તમામ અસ્થિર મિલકતોનું બજાર કિંમતે મૂલ્યાંકન
- તમામ બિન-નોંધાયેલ સ્થિર તથા અસ્થિર મિલકતોની નોંધણી.
- તમામ જોગવાઈઓ તથા ધારાની ગણતરી.
- તમામ અસ્થાયી મિલકતોને દ્યાનમાં ન લેવી.

ઉદાહરણ. ૧૧:- વિરાજ કંપની લિમિટેડનું તા. ૩૧/૦૩/૨૦૧૮નારોજનું પાંકું-સરવૈયું નીચે પ્રમાણેનું હતું.

મૂડી-દેવાં	કૃ.	મિલકત-દેવાં	કૃ.
શેર મૂડી		જમીન અને મકાન	૨૦,૦૦,૦૦૦
રૂ. ૧૫ના એક એવાં		ચંત્રો	૧૦,૦૦,૦૦૦
૨,૦૦,૦૦૦ ઇડિયટી શેર	૩૦,૦૦,૦૦૦	ફર્નિચર	૮,૦૦,૦૦૦
રૂ. ૨૦ના એક એવાં		દેવાદારો	૨,૦૦,૦૦૦
૨૦,૦૦૦ના ૧૦%ના		સ્ટોક	૩,૦૦,૦૦૦
કન્વરટીબલ પ્રેફરન્સશેર	૪,૦૦,૦૦૦	રોકડ	૫૦,૦૦૦
સામાન્ય અનામત	૮,૦૦,૦૦૦		
પ્રોવિડન્ટ ફંડ	૫૦,૦૦૦		
લેણદારો	૧,૦૦,૦૦૦		
	૪૩,૫૦,૦૦૦		૪૩,૫૦,૦૦૦

વધારાની માહિતી:

૧. જમીન અને મકાનની કિંમતમાં ૧૦%નો વધારો કરવો.
૨. ફર્નિચરની કિંમતમાં ૧૦%નો વધારો કરવો.
૩. ચંત્રની કિંમતમાં ૫%નો વધારો કરવો.

૪. ધંધાની પાદડીની કિંમતમાં ચોપડે દરાવિલ નથી, પરંતુ શેરની મૂલ્યાંકન સમયે તેને ધ્યાનમાં લેવી. પાદડીના મૂલ્યાંકન છેદાં અણ વર્ષના સરાસરી નફા જેટલી ગણવાની છે અને ધંધાનો છેદાં અણ વર્ષનો ચોખ્ખો નફો રૂ.૪,૫૦,૦૦૦ છે.

ઉપર આપેલી માહિતી પરથી શેરની આંતરીક કિંમત શોધો.

જવાબ:

જયારે પણ શેરનું મૂલ્યાંકન શેરની આંતરીક કિંમતની પદ્ધતિએ કરવાનું હોય ત્યારે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવી ખુબ જ જરૂરી છે. શેરની આંતરીક કિંમત નીચે પ્રમાણે ગણવામાં આવે છે.

શેરની આંતરીક કિંમત = $\frac{\text{ચોખ્ખી મિલકતો}}{(\text{ઓડીનરી})/\text{ઇક્વિટી શેરની સંખ્યા}}$

૪૧,૨૦,૦૦૦

૨,૦૦,૦૦૦

શેરની આંતરીક કિંમત = રૂ. ૨૦.૫

જયાં, ચોખ્ખી મિલકતો એટલે કે,

ચોખ્ખી મિલકતો = કુલ મિલકતો-બાબુ દેવા.

= રૂ.૭૦,૦૦૦-૫,૫૦,૦૦૦

કંપનીના ઓડીનરી/ઇક્વિટી = રૂ. ૪૧,૨૦,૦૦૦

શેરધારકોને ભાગે આવતી

ચોખ્ખી મિલકતો એટલેકે,

પાદડી(નોંધ:-૧) ૧,૫૦,૦૦૦

જમીન અને મકાન ૨૨,૦૦,૦૦૦

ચંત્રો ૧૦,૫૦,૦૦૦

ફર્નિચર ૭,૨૦,૦૦૦

દેવાદારો ૨,૦૦,૦૦૦

સ્ટોક ૩,૦૦,૦૦૦

રોકડ ૫૦,૦૦૦

કુલ મિલકતો = રૂ.૭૦,૦૦૦

નોંધ:- ૧ પાદડીની ગણતરી.

અહીં પાદડીની કિંમતનું મૂલ્યાંકન છેદા. અણ વર્ષના આપેલાં સરાસરી નફાને આધારે કરવાની છે.

ધંધાનો કુલ છેલાં અણ વર્ષનો કુલ ચોખ્ખો નફો રૂ.૪,૫૦,૦૦૦/-

પાદડીની કિંમત = $\frac{\text{છેદાં અણ વર્ષનો ચોખ્ખો નફો}}{\text{કુલ વર્ષ}}$

= $\frac{૪૫૦૦૦૦}{3}$

પાધડીની કિંમત = રૂ. ૧,૫૦,૦૦૦

કુલ બાધ દેવાં એટલે કે

પ્રેફરન્સ શેરની મૂડી રૂ. ૦૦,૦૦૦

લેણાદારો રૂ. ૦૦,૦૦૦

પ્રોવિડન્ટ ફંડ રૂ. ૦૦૦

કુલ દેવા = રૂ. ૧,૫૦,૦૦૦

ઉદા ૨: મંથન કંપની લીમિટેડનું તા. ૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું આપેલ છે. તેની ઉપરથી કંપનીની શેરની આંતરીક કિંમત શોધો.

મંથન કંપનીનું તા. ૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
શેર મૂડી		પાધડી	૮૦,૦૦૦
૧૦%ના ૫૦,૦૦૦ પ્રેફરન્સશેર દરેક શેરનો ભાવ રૂ. ૧૦	૫,૦૦,૦૦૦	જમીન અને મકાન	૧૮,૫૦,૦૦૦
૩,૦૦,૦૦૦ ઇક્વિટી શેર દરેક શેરનો ભાવ રૂ. ૧૦	૩૦,૦૦,૦૦૦	ચંત્રો	૨,૩૦,૦૦૦
અનામતો	૩,૦૦,૦૦૦	ફર્નિચર	૧૦,૦૦,૦૦૦
૨૦% ડિબેન્ચર	૨,૦૦,૦૦૦	લેણાદારો	૪,૦૦,૦૦૦
લેણાદારો	૫૦,૦૦૦	સ્ટોક	૩,૦૦,૦૦૦
પ્રોવિડન્ટ ફંડ	૩૦,૦૦૦	રોકડ સિલ્ક	૨૨૦૦૦૦
	૪૦,૮૦,૦૦૦		૪૦,૮૦,૦૦૦

વધારાની માહિતી:

૧. જમીન અને મકાનની બજાર કિંમત રૂ. ૨૦,૦૦,૦૦૦ છે.
૨. ચંત્રની કિંમતમાં ૧૦%નો વધારો કરવો.
૩. ફર્નિચરની કિંમતમાં ૫%નો ઘટાડો કરવો.
૪. ઘંધાની પાધડીની કિંમત અધિક નકારી ચારગાણી ગણવાની છે. ઘંધાનો સરેરાશ વાર્ષિક નશો કરવેરો બાદ કર્યા બાદનો રૂ. ૫,૭૦,૦૦૦ છે, તો રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૨% છે.

જવાબ:

- સૌ પ્રથમ અહીં પાધડીની ગાણતરી કરીશું કારણકે પાધડીની નવી કિંમત ગણવાની છે અને જુની કિંમત એટલે કે પાકાસરવૈયામાં આપેલી કિંમતને ર૭૮ કરવાની છે.
- ઘંધાની ચોખ્ખી મિલકતો

જમીન અને મકાન રૂ. ૨૦,૦૦,૦૦૦

ચંત્રો રૂ. ૨,૪૩,૦૦૦

ફર્નિચર રૂ. ૧૦,૦૦,૦૦૦

લેણાદારો રૂ. ૪,૦૦,૦૦૦

સ્ટોક	3,00,000
રોકડ	<u>2,20,000</u>
કુલ મિલકતો	= રૂ. ૪૧,૨૩,૦૦૦
- દેવા 20%ના ડીભેન્ચર	2,00,000
- લેણાદારો	50,000
- પ્રોવિડન્ડ ફંડ	<u>30,000</u>
ચોખ્ખી મિલકતો	<u>37,43,000</u>
-પ્રેફરન્સ શેરમૂડી	<u>5,00,000</u>
કુલ રોકાયેલી મૂડી	રૂ. 33,43,000
કુલ અપેક્ષિત નફો = રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર	
	= 33,43,000 × 12/100
	= રૂ. 4,01,100.

અધિક નફો = સરેરાશ નફો - અપેક્ષિત નફો

$$= 5,20,000 - 4,01,100 \\ = રૂ. ૧,૧૮,૯૪૦$$

પાધડી = અધિક નફો × ૪	સરેરાશ નફો = ૫,૭૦,૦૦૦
= ૧,૧૮,૯૪૦ × ૪	- પ્રેફરન્સ ડિવિડન્ડ = ૫૦,૦૦૦
પાધડી = ૪,૭૪,૫૬૦	સરેરાશ નફો = ૫,૨૦,૦૦૦

- હવે, શેરની કિંમતની આંતરીક ગણાતરી,	
ચોખ્ખી મિલકતો (રોકાયેલી મૂડી)	33,43,000
+ પાધડીની નવી કિંમત	<u>૪,૭૪,૫૬૦</u>
કુલ ચોખ્ખી મિલકતો	38,૧૭,૫૬૦

$$\text{ઇક્સિટી શેરનું આંતરીક મૂલ્ય} = \frac{\text{ચોખ્ખી મિલકતો}}{\text{ઇક્સિટી શેરની સંખ્યા}}$$

$$= \frac{38,17,560}{300000} \\ = રૂ. ૧૨.૭૩$$

ઉદા 3: કિરણ કંપની લીમીટેડનું તા.31/03/2018ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબનું છે.

કિરણ કંપનીનું તા.31/03/2018ના રોજનું પાકું સરવૈયું.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-સેણાં	રૂ.
૪૦૦૦ એવાં રૂ.૧૦૦નો એક એવા		જમીન અને મકાન	૨,૫૨,૦૦૦
૧૦% કયુમ્યુલીટીવ પ્રેફરન્સ શેર	૪,૦૦,૦૦૦	ચંત્રો	૪,૦૩,૦૦૦
૧૦,૦૦૦, એવાં રૂ.૫૦નો એક એવાં		દેવાદારો	૨,૦૦,૦૦૦
ઇક્સિટી શેર	૫,૦૦,૦૦૦	સ્ટોક	૧,૦૦,૦૦૦

૧૦%ના ડીનેન્યરો	૧,૦૦,૦૦૦	રોકડ અને બેન્ક સિલ્ક	૫૦,૦૦૦
લેણાદારો	૨૦,૦૦૦	અસ્થીર મિલકતો	૨૫,૦૦૦
ધસારા ફડ			
જમીન અને ભકાન	૨,૦૦૦		
ચંત્રો	૩,૦૦૦		
ચૂકુવલાના બાકી ખર્ચ	૫૦૦૦		
	૧૦,૩૦,૦૦૦		૧૦,૩૦,૦૦૦

વધારાની માહિતી:

૧. ધંધાની પાધડીની ગણાતરી છેદાં પાંચ વર્ષના સરેરાશ આધારે ત્રણ વર્ષની ખરીદી જેટલી ગણાવી. ધંધાને કરબાદ છેદાં પાંચ વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે રૂ. ૪૦,૦૦૦, રૂ. ૬૦,૦૦૦, રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૮૦,૦૦૦ છે.
૨. પ્રેફરન્સ શેર ધારકોને છેદાં બે વર્ષનું શેર ડિવિડન્ડ આપવાનું બાકી છે.

જવાબ:

- અહીં સૌ પ્રથમ પાધડીની કિંમત પાકા-સરવૈયામાં દર્શાવેલ નથી, જેથી સૌ પ્રથમ પાધડીની કિંમતની ગણાતરી નિયે મુજબ છે.

અહીં પાધડીની કિંમત છેદાં પાંચ વર્ષના આપેલા વાર્ષિક નફાને આધારે કરવાની છે.

$$\begin{aligned} \text{- છેદાં પાંચ વર્ષનો વાર્ષિક નફો} &= ૪૦,૦૦૦+૬૦,૦૦૦+૫૦,૦૦૦+૮૦,૦૦૦+૮૫,૦૦૦ \\ &= રૂ. ૩,૧૫,૦૦૦ \end{aligned}$$

$$\text{કુલ સરેરાશ નફો} = \frac{૩૧૫૦૦૦}{૫}$$

$$= રૂ. ૬૩,૦૦૦$$

અહીં પાચાની ગણાતરી ત્રણ વર્ષની ખરીદીના આધારે કરવાની છે.

$$\text{પાધડી} = રૂ. ૬૩,૦૦૦ \times ૩ = રૂ. ૧,૮૯,૦૦૦$$

હવે, આપણે ચોખ્ખી મિલકતોની ગણાતરી કરીશું.

$$\text{જમીન અને ભકાન} = ૨,૫૨,૦૦૦$$

$$\text{- ધસારો} = ૨,૦૦૦ \quad ૨,૫૦,૦૦૦$$

$$\text{ચંત્રો} = ૪,૦૩,૦૦૦$$

$$\text{- ધસારા} = ૩,૦૦૦ \quad ૪,૦૦,૦૦૦$$

$$\text{પાધડી} = ૧,૮૯,૦૦૦$$

$$\text{દેવાદારો} = ૨,૦૦,૦૦૦$$

$$\text{સ્ટોક} = ૧,૦૦,૦૦૦$$

$$\text{રોકડ અને બેન્ક સિલ્ક} = ૫૦,૦૦૦$$

$$\text{કુલ મિલકતો} = રૂ. ૧૧,૮૯,૦૦૦$$

બાદ - દેવાં

ઉદા ૪: શ્રી નારાયણ કંપની લીમિટેડનું તા.૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાંકું સરવૈયું નીચે મુજબનું છે. નીચે આપેતી ભાહિતી ઉપરથી શેરની નવી આંતરીક કિંમત શોધો.

શ્રી નારાયણ કંપની લીમિટેડનું તા.3૧/૦૩/૨૦૧૮ના રોજનું પાકું સરવૈયં

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
શેર મૂડી ૧૦,૦૦૦ એવાં રૂ. ૧૦૦નો એક એવાં ૧૦%ના પ્રેક્રન્સ શેર ૫,૦૦,૦૦૦ એવાં રૂ. ૧૦નો એક એવાં	૧૦,૦૦,૦૦૦	જમીન અને મકાન ચંત્રો (બજાર ડિમ્બત ૧૧,૦૦,૦૦૦)	૩૫,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦
ઓડીનરી શેર અનામતો	૫૦,૦૦,૦૦૦ ૩,૦૦,૦૦૦	ફર્નિચર રોકાણો	૫,૦૦,૦૦૦ ૩,૦૦,૦૦૦
નફા-નુકશાન ખાતું ૧૦%ના ડીલેન્ચરો	૨,૦૦,૦૦૦ ૫,૦૦,૦૦૦	પાદદી દેવાદારો	૨,૦૦,૦૦૦ ૭,૦૦,૦૦૦
લેણાદારો ચૂકુપવાના બાકી ખર્ચાઓ	૧,૦૦,૦૦૦ ૫૦,૦૦૦	સ્ટોક રોકડ સિલક	૫,૦૦,૦૦૦ ૩,૦૦,૦૦૦
ઘસારા બંડોળ		શેર વટાવ	૫૫,૦૦૦
ચંત્રો	૫,૦૦૦		
ફર્નિચર	૧૦,૦૦૦		
	૭૯,૫૫,૦૦૦		૭૯,૫૫,૦૦૦

વધારાની માહિતી:

- જમીન અને મકાનની કિંમતમાં ૫%નો વધારો કરવો.
 - ધેંધાની પાદડીની ગણતરી છેદાં પાંચ વર્ષના સરેરાશ અધિક નફાથી ગણ વર્ષની ખરીદીના આધારે કર્તાની છે. ધેંધામા રોકાયેલી ભડી પર અપેક્ષિત વળતાનો દર ૩% છે.

વार्षिक नकाशी माहिती:

वर्ष	नक्षे (₹.)	भार
૨૦૧૭-૧૮	૨,૦૦,૦૦૦	૧
૨૦૧૬-૧૭	૩,૦૦,૦૦૦	૨
૨૦૧૫-૧૬	૨,૫૦,૦૦૦	૩
૨૦૧૪-૧૫	૩,૫૦,૦૦૦	૪
૨૦૧૩-૧૪	૧,૫૦,૦૦૦	૫

- ઉપરની આપેલી વાર્ષિક નકાશી રકમમાં રૂ. ૩૦,૦૦૦ રોકાણમાંથી મળતાં વળતરના છે.

૩. પ્રેફરન્સ શેરધારકોને છેદ્યાં ૧ વર્ષનું ડિવિડન આપવાનું બાકી છે.

૪. દેવાદારો ઉપર ૧૦% ધાતખાદ તથા ૫% ધાતખાદ અનામત ગણાવી.

જવાબ:

→ ૧. અહીં પાકા સરવૈચામાં આપેલી પાદકીની રકમને દ્વારાનમાં ન લેતાં નવી પાદકીની કિંમતની ગણતરી કરીશું.

પાદકીની ગણતરી:

વર्ष	નક્ષે- રોકાણોનું વ્યાજ	બાકી નક્ષે × ભાર	ભારિત નક્ષે
૨૦૧૭-૧૮	૨,૦૦,૦૦૦-૩૦,૦૦૦	૧,૭૦,૦૦૦× ૧	૧,૭૦,૦૦૦
૨૦૧૬-૧૭	૩,૦૦,૦૦૦-૩૦,૦૦૦	૨,૭૦,૦૦૦× ૨	૫,૪૦,૦૦૦
૨૦૧૫-૧૬	૨,૫૦,૦૦૦-૩૦,૦૦૦	૨,૨૦,૦૦૦× ૩	૬,૬૦,૦૦૦
૨૦૧૪-૧૫	૩,૫૦,૦૦૦-૩૦,૦૦૦	૩,૨૦,૦૦૦× ૪	૧૨,૮૦,૦૦૦
૨૦૧૩-૧૪	૧,૫૦,૦૦૦-૩૦,૦૦૦	૧,૨૦,૦૦૦× ૫	૬,૦૦,૦૦૦
		કુલ ભાર = ૧૫	કુલ ભારિત નક્ષે = ૩૨,૪૦,૦૦૦

$$\text{ભારિત સરેરાશ નક્ષે} = \frac{\text{કુલ ભારિત નક્ષે}}{\text{કુલ ભાર}}$$

$$= \frac{32,40,000}{15}$$

$$= રૂ. ૨,૧૬,૬૬૭$$

$$\text{અપેક્ષિત વળતર} = \text{ચોખ્ખી મિલકતો} \times \text{અપેક્ષિત વળતરનો દર}$$

$$= ૫૮,૩૮,૫૦૦ \times ૩/૧૦૦$$

$$= રૂ. ૧,૭૮,૧૫૫$$

$$\text{અધિક નક્ષે} = \text{સરેરાશ નક્ષે} - \text{અપેક્ષિત નક્ષે}$$

$$= ૨,૧૬,૬૬૭ - ૧,૭૮,૧૫૫$$

$$= રૂ. ૩૮,૫૧૨$$

$$\text{પાદકી} = \text{અધિક નક્ષે} \times \text{ખરીદીના વર્ષો$$

$$= ૩૮,૫૧૨ \times ૩$$

$$= રૂ. ૧,૧૫,૫૩૬$$

→ २. ચોખ્ખી ભિલકતો

જમીન અને મકાન		34,00,000
યંત્રો		11,00,000
ફાર્મિચર	5,00,000	
- ધસારો	10,000	4,60,000
દેવાદારો	7,00,000	
-ધાલખાદ	70,000	
=	5,30,000	
-5% ધાલખાદ અનામત	31,400	4,68,400
સ્ટોક		4,00,000
રોકડ સિલક		3,00,000
	કુલ ભિલકતો	46,38,400
બાદ દેવા		
-10%ના ડીબેન્ચર્સ		4,00,000
લેણાદારો		1,00,000
બાકી ખર્ચાઓ		50,000
ચોખ્ખી ભિલકતો(રોકાણેલી મૂડી)		46,38,400

→ ३. શેરની આંતરીક મૂલ્યની ગણાતરી:

ચોખ્ખી ભિલકતો	3.46,38,400
+ પાધકી	3. 1,14,535
+ રોકાણો	
(બિન-અનામત)	3. 3,00,000
= કુલચોખ્ખી ભિલકતો	3. 53,54,035

$$\begin{aligned} \rightarrow 4. \text{ શેરની આંતરીક કિંમત} &= \frac{\text{ચોખ્ખી ભિલકતો}}{\text{ઇક્ષીયી શેરની સંખ્યા}} \\ &= \frac{53,54,035}{5,00,000} \\ &= 3. 12.71 \end{aligned}$$

૫.૭ પદ્ધતિઃ૨ ઉપજના ધોરણો શેરનું મૂલ્યાંકન

- શેર મૂલ્યાંકનની ઉપજનાં ધોરણો મૂલ્યાંકનની પદ્ધતીમાં રોકાણાકારોના રોકાણોની સલામતી ઉપર વધારે ભાર આપવામાં આવે છે કારણકે જ્યારે રોકાણાકારો પોતાની મૂડીનું શેરમાં રોકાણ કરે છે ત્યારે હમેશા તેઓ તેમના રોકાણની સલામતી ઈચ્છતા હોય છે. એક વખત શેરધારકોને ડિવિડનના શ્રેષ્ઠમાં વળતર આછું આપો તો ચાલે પરંતુ તેઓના રોકાણની સલામતી ખૂબ જ જરૂરી છે.
- શેર આંતરીક મૂલ્યાંકનની પદ્ધતીમાં રોકાણાકારો તેઓના રોકાણનું વધુમાં વધુ વળતર મળે તેવી આશા રાખે છે, અને તે વળતર તેમને ડિવિડન, બોનસ શેર અને હક્કોના ઝપમાં મળે છે. કારણકે આ પદ્ધતી મુજબ જેમ-જેમ વળતરનો દર વધારે તેમ શેરની કિંમતમાં પણ વધારો થાય છે. આ

પદ્ધતિ હેઠળ શેર મૂલ્યાંકનની ગણતરી, અપેક્ષિત વળતરના દર સાથે સામાન્ય વળતરના દર ની સરખામણી કરીને કરવામાં આવે છે.

→ સામાન્ય રીતે શેરના મૂલ્યાંકન માટે આ પદ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ મળી આવતી શેરની કિંમતને બજાર કિંમત પણ કહેવામાં આવે છે.

શેરના મૂલ્યાંકન વખતે દ્યાનમાં રાખવાના મુદ્દાઃ

1. પ્રેફરન્સ ડિવિડન્ડ: જ્યારે પણ શેરનું મૂલ્યાંકન ઉપજના ધોરણે કરવામાં આવે ત્યારે જો કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો પ્રેફરન્સ શેરધારકોને મળતાં ડિવિડન્ડને નફામણી બાદ કરવું જોઈએ.
2. નફાની વહેંચાણી: જ્યારે પણ વળતર આપવા નફાની ગણતરી કરવામાં આવે ત્યારે તમામ બીજા પાસાઓને દ્યાનમાં રાખીને ડિવિડન્ડ વહેંચાણ માટેનો નફો નકકી કરવી જોઈએ. વિવિધ પ્રકારની અનામતો જેવી કે સામાન્ય અનામત, ઘસારાની જોગવાઈઓ વગેરેને દ્યાનમાં રાખીને જ નફાની ડિવિડન્ડની ગણતરીને દ્યાનમાં લેવી જોઈએ.
3. સરેરાશ નફાને જ દ્યાનમાં લેવાં: જ્યારે પણ નફાની ગણતરી કરવામાં આવે ત્યારે ફક્ત ચાલુ વર્ષે કે પાછલાં વર્ષને દ્યાનમાં ન લેતાં છેદ્યાં ચાર થી પાંચ વર્ષના સરેરાશ નફાને દ્યાનમાં લેવા જોઈએ કારણકે જો ફક્ત એક જ વર્ષના નફાને દ્યાનમાં લઈને ભવિષ્યનો નિર્ણય લેવામાં આવે તો ઘણીવાર મુશ્કેલી પેદા કરી શકે છે. અને જો નફો ખુલ જ વધારે વધ્ય-ઘટ થતો હોય તો સાત કે તેથી વધારે વર્ષનો સરેરાશ નફો દ્યાનમાં લેવો જોઈએ જેથી સાચી આર્થિક પરિસ્થિતિ જાણી શકાય.
4. ધંધામાં થતા વિવિધ ફેરફારોઃ:- જ્યારે પણ કંપનીમાં કોઈપણ નિર્ણય લેવામાં આવે ત્યારે ભવિષ્યને દ્યાનમાં રાખીને લેવામાં આવે છે. માટે જ્યારે પણ ભવિષ્યના નફાની એક સામાન્ય રકમનો નિર્ણય લેવામાં આવે ત્યારે પાછલાં વર્ષના નફાને દ્યાનમાં લેવામાં આવે છે. માટે જ્યારે પણ પાછલાં વર્ષનો નફો લેવામાં આવે ત્યારે ધંધામાં થયેલા વિવિધ ફેરફારો જેવાંકે ઉત્પાદનનો ખર્ચ, પગારો, ઘસારાની પદ્ધતિ વગેરે મુદ્દાઓને દ્યાનમાં રાખવા જરૂરી છે.

શેરની ઉપજ કિંમત શોધવા માટે નીચે પ્રમાણેનું સૂત્ર ઉપયોગ કરવામાં આવે છે.

$$1) \text{ બજાર કિંમત} = \frac{\text{ડિવિડન્ડનો દર}(ટકામાં)\% \times \text{શેર દીઠ વસૂલવામાં આવેલી રકમ}}{\text{અપેક્ષિત વળતરનો દર}(ટકામાં)\%$$

$$2) \text{ ડિવિડન્ડનો દર} = \frac{\text{દીક્ષિટી શેરધારકોનો નફો}}{\text{કુલ ભરપાઈ થયેલી ઈ.શેર મૂડી}} \times 100$$

ઉદા પદ્ધતિ કંપની લીભિટેકની તા. ૩૧/૦૩/૨૦૧૮ના રોજની માહિતી નીચે પ્રમાણેની છે. આપેલ માહિતી પરથી શેરની બજાર કિંમત શોધો.

૧)	૪૦,૦૦૦ દીક્ષિટી શેર(રૂ.૧૦૦નો એક એવા રૂ. ૮૦ ભરપાઈ)	રૂ. ૩૨,૦૦,૦૦૦
૨)	સરેરાશ વાર્ષિક નફો (કર પહેલાંનો)	રૂ. ૫,૪૦,૦૦૦
૩)	સા.અનામત આતે લઈ જવાની રકમ	રૂ. ૧,૦૦,૦૦૦
૪)	કરવેરાની જોગવાઈ	રૂ. ૫૦,૦૦૦
૫)	અપેક્ષિત વળતરનો દર	૧૨%

અહીં શેરની બજાર કિંમત શોધવા માટે સૌપ્રથમ દીક્ષિટી શેરધારકોનો નફો તથા ડિવિડન્ડનો દર નકકી કરીશું.

જવાબ:

- ૧) દીક્ષિટી શેરધારકોનો નફો
 સરેરાશ નફો (કરબાદ પહેલાંનો) રૂ.૫,૪૦,૦૦૦
 - કરયેરાની જોગવાઈ રૂ.૫૦,૦૦૦
 = કરયેરો બાદ કર્યા બાદનો નફો રૂ.૪,૮૦,૦૦૦
 - સા.અનામત આતે લઈ જવાની રકમ રૂ.૧,૦૦,૦૦૦

 - પ્રે. ડિવિડન્ડ રૂ.૪,૮૦,૦૦૦
 = ઈ.શેરધારકોનો નફો રૂ.૪,૮૦,૦૦૦
- ૨) ડિવિડન્ડનો દર = ઈ.શેરધારકોનો નફો $\times \frac{૧૦૦}{કુલ ભરપાઈ થયેલો ઈ.શેરમૂડી}$
 $= \frac{૪,૮૦,૦૦૦ \times ૧૦૦}{૩૨,૦૦,૦૦૦}$
 $= ૧૫ \%$
- ૩) બજારની કિંમત = $\frac{\text{ડિવિડન્ડનો દર} \times \text{શેરીઠ ભરપાઈ થયેલી મૂડી}}{\text{અપેક્ષિત વળતરનો દર}}$
- $= \frac{૧૫ \times ૮૦}{૧૨}$
-
- $= રૂ. ૧૦૦$

ઉદા.૫ થિંટન કંપની લિમિટેડની ભરપાયેલ શેરમૂડીની થયેલી રકમ રૂ.૩૦,૦૦,૦૦૦ છે. જે રૂ.૨૦નો એક એવા ૧,૫૦,૦૦૦ ઈ.શેરોની બનેલી કે કંપનીઓ પાછલા વર્ષના થયેલા નફાને દ્વારાનું રાખીને અવિષ્યમાં કરબાદ કર્યાનો પહેલો નફો રૂ.૧૨,૦૦,૦૦૦ થશે એવી ધારણાં કરવામાં આવી છે. કંપની જેમાંથી રૂ.૫૦,૦૦૦ દર વર્ષ સા.અનામતમાં લઈ જશે. કંપનીએ કરની જોગવાઈ મુજબ રૂ.૫૦,૦૦૦ કરી છે જ્યારે અપેક્ષિત વળતરનો દર ૧૫% છે. કંપનીની શેર મૂડીમાં ઈ.શેર મૂડી ઉપરાંત ૧૦,૦૦૦ એવાં ૧૦%ના કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એકનો ભાવ રૂ.૧૦૦ છે. ઉપરની આપેલી માહિતી ઉપરથી શેરની નવી બજાર કિંમત શોધો.

→ અહીં ફક્ત કંપનીનો નફો તથા અપેક્ષિત વળતરનો દર આપેલ છે, માટે શેરનું મૂલ્યાંકન ઉપજના ધોરણે કરયું.

૧. સરેરાશ નફો(કર પહેલાનો) રૂ.૧૨,૦૦,૦૦૦
 - કર રૂ. ૫૦,૦૦૦
 = કર બાદ કર્યા બાદનો નફો રૂ.૧૧,૫૦,૦૦૦
 - સા.અનામત ખાતે લઈ જવાની રકમ રૂ. ૫૦,૦૦૦
 - પ્રેફરન્સ શેર ડિવિડન્ડ રૂ. ૧,૦૦,૦૦૦
 = ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય તેવો નફો રૂ. ૧૦,૦૦,૦૦૦

૨. અહીં કંપનીની કુલ શેર મૂડી રૂ. ૩૦,૦૦,૦૦૦ જેના પર કંપની રૂ. ૧૦,૦૦,૦૦૦ વહેંચશે માટે ડિવિડન્ડનો દર શોધી શકાય.

$$\text{ડિવિડનનો દર} = \frac{\text{કુલ વહેચવા પાત્ર નફો} \times 100}{\text{કુલ ઈ.શેર મૂડી}}$$

$$= \frac{10,00,000 \times 100}{30,00,000}$$

$$= 33.33 \% \text{ ડિવિડન આપી શકાય.}$$

અહીં આપેલ અપેક્ષિત વળતરના દર પ્રમાણે

→ માટે, એવું કહી શકાય જો કંપની રૂ. 100 નફો કમાય તો ઈ.શેરધારકો રૂ. 15 શેરદીઠના ડિવિડનની આશા રાખી શકે છે.

→ માટે શેરની બજાર કિંમત નીચે આપેલ બે પદ્ધતિથી શોધી શકાય
ડિવિડન શેરનો ભાવ જો સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો

$$15 \quad 100$$

$$33.33 ? \quad \text{અથવા}$$

$$= \frac{100 \times 33.33}{15}$$

$$\text{બજાર કિંમત} = \frac{\text{ડિવિડનનો દર} \times \text{શેરદીઠ ભરપાયેલ થયેલી મૂડી}}{\text{અપેક્ષિત વળતરનો દર}}$$

$$\text{શેરની બજાર કિંમત} = \text{રૂ. } 222.2$$

$$= \frac{33.33 \times 100}{15}$$

$$\text{શેરની બજાર કિંમત} = \text{રૂ. } 222.2$$

ઉદા.૭ શ્રી રંગ કંપની નું તા. ૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપેલી માહિતી ઉપરથી શેરના મૂલ્યાંકન કરી શેરની બજાર કિંમત શોધો.

શ્રી રંગ કંપનીનું તા. ૩૧/૦૩/૨૦૧૮ ના શેરનું પાકું સરવૈયું.

મૂડી-દેવાં	ઝ	અલકાત-સેણાં	ઝ
શેરમૂડી:			
10,000 ઈ.શેર એવા ઝીઠીનો એક		જમીન અને મકાન	5,00,000
શેર(શેરની ભરપાઈ રકમ ઝીઠી)	6,00,000	કાર્બિચર	3,40,000
1000 10%ના પ્રેફરન્સ શેર એવા ઝીઠીનો		ચંત્રો	2,00,000
એક શેર(શેરની ભરપાઈ રકમ ઝીઠી)	20,000	દેવાદારો	40,000
સા.અનામતા	2,00,000	સ્ટોક	40,000
લેણદારો	40,000	શેરક સિલક	90,000
પ્રોવિડન ઝીઠી	20,000		
	12,40,000		12,40,000

→ કરબાદ કર્યા પહેલાનો કંપનીનો વાર્ષિક નફો રૂ. 4,64,000નાને અપેક્ષિત વળતરનો દર 10% છે. કંપનીએ કરયેશાની જોગવાઈ રૂ. 50,000 કરી છે.

→ અહીં આપણે સૌ પ્રથમ ડિવિડનનો દર શોધીશું, તેના માટે ઈ.શેરધારકોને નફો શોધવો જરૂરી છે.

૧) ઈ.શેરધારકોનો નફો:-

$$\text{સરેરાશ નફો(કરબાદ પહેલાનો)} \quad 3.4,64,000$$

$$- 52 \quad 3.50,000$$

$$= \text{કરબાદ કર્યા બાદનો નફો} \quad 3.4,35,000$$

$$- \text{સા.અનામત ખાતે લઈ જવાની રકમ} \quad 3.2,00,000$$

$$2,34,000$$

- प्रे. डिविडन्स	₹,000
= इ.शेरधारकोनो नक्षे	₹.२,२७,०००

→ अहीं उपर गणातरी प्रभाणे प्रे.शेरधारकोने ₹.८,०००(₹०,०००×१०/१००)जे डिविडन्स आपवामां आवी छे कारणाके प्रे. शेरधारकोचे शेरना पूरेपूरा ₹. कंपनीने आप्यां नस्थी.

$$2) \text{ डिविडन्सो दर} = \frac{\text{इ.शेरधारकोनो नक्षे}}{\text{कुल भरपाई थयेल इ.शेर मूडी}} \times १०० = \frac{२,२७,००० \times १००}{८,००,०००} = २५.२२\%$$

$$3) \text{ बजार किंमत} = \frac{\text{डिविडन्सो दर} \times \frac{\text{कुल भरपाई थयेल शेर दीठ इ.शेरमूडी}}{\text{अपेक्षित वणतरनो दर}}}{= \frac{२५.२२ \times ८०}{१०}} = ₹. २२५.६८$$

५.८. पद्धति ३. व्याजबी किंमत पद्धति

शेरनुं मूल्यांकनः धणांबद्धा विघ्लेखको उपरनी बे पद्धतिओ जेवा के शेरनुं मूल्यांकन आतरीक किंमतथी अने शेरनुं मूल्यांकन उपरना धोरणो न करतां तेओ एक बीजु पद्धति व्याजबी किंमतथी शेरनुं मूल्यांकन करे छे आ पद्धतिमां शेरनी आंतरिक अने उपजना धोरणे शेरनुं मूल्यांकन बने पद्धतिओनो सरेश काढी शेरनी किंमत शोधवामां आवे छे. आपणे उपरनी पद्धतिथी जोयुं के कंपनीनी चोभ्यी भिलकतो वघारे होवा छतां डिविडन्सो दर ओछो होय छे.माटे इ.शेरधारकोने वहेचवामां आवतां नकानुं धोरणा नीचे होय छे. आवा समये बने पद्धतिओनां शेरनी मूल्यांकन वर्खते खुबज भोटो तश्वापत जोवा भने छे. आवा समये एक त्रीजो रस्तो काढवामां आवे छे के शेरनुं व्याजबी किंमतनी मूल्यांकन जो के आ पद्धतिनुं कोई महत्व नस्थी अने तेनो उपयोग पाणा वघारे प्रभाणामां करवामां आवतो नस्थी.

$$\text{शेरनी व्याजबी किंमत} = \frac{\text{शेरनी आंतरीक किंमत} + \text{शेरनी बजार किंमत}}{२}$$

उदा.८ श्री माझ्ती कंपनीनी ता.३१/०३/२०१८ना रोज एक शेरनी आंतरीक किंमत ₹.१५० छे. ज्यारे शेरनी बजार किंमत ₹.२४० छे. आपेली माहिती उपरथी शेरनी व्याजबी किंमत शोधो.

$$\begin{aligned} \text{शेरनी व्याजबी किंमत} &= \frac{\text{शेरनी आंतरीक किंमत} + \text{शेरनी बजार किंमत}}{२} \\ &= \frac{१५० + २४०}{२} \\ &= ३९०/२ = ₹. १९५ \end{aligned}$$

उदा.९० पायल कंपनीनुं ता.३१/०३/२०१८ना रोजनुं पाँच-सरवैसुं नीचे प्रभाणे छे, आपेल माहिती उपरथी शेरनुं मूल्यांकन व्याजबी किंमतथी करो.

मूडी-देवां	₹.	भिलकत-लेणां	₹.
३.१००नो एक एवा २००० इ.शेर दीठ(भरपाई थयेल शेर दीठ रकम ₹. ६०)	१,८०,०००	जग्मीन अने भकान	१,००,०००
३.१००नो एक एवा १० % ना १०००		पाईडी	५०,०००
प्रे.शेर	१,००,०००	यंत्रो	८०,०००
		फर्निचर	५०,०००

સા.અનામત	૫૦,૦૦૦	રોકાણો:	
૧૫%ના ડીબેન્ચરો	૮૦,૦૦૦	ગૌણ કંપનીના રૂ.૩૦,૦૦૦	
લેણાદારો	૨૦,૦૦૦	૧૦%ના મનજ કંપનીના	
પ્રોવિલન્ક ફંડ	૧૦,૦૦૦	ડીબેન્ચર દાર્શનીક કર્મભત	
દેવી હુંડી	૫,૦૦૦	(રૂ.૧૦,૦૦૦/- વ્યાજ	
ચૂકુવવાના બાકી ખર્ચાઓ	૫,૦૦૦	કરપાત્ર) રૂ.૦૦૦	૩૮,૦૦૦
		દેવાદારો	૪૧,૦૦૦
		સ્ટોક	૪૦,૦૦૦
		રોકડ સિલક	૩૦,૦૦૦
	૪,૫૦,૦૦૦		૪,૫૦,૦૦૦

વધારાની માહિતી:

- ૧) જમીન અને મકાન કિંમતમાં ૧૦%નો વધારો કરવો.
- ૨) ચંત્રોની કિંમતમાં ૫%નો ઘટાડો કરવો.
- ૩) ફર્નિચરની કિંમત રૂ.૫૦,૦૦૦ આંકવી.
- ૪) કંપનીના સરેરાશ વાર્ષિક નફો (૫૦% કરવેશ અગાઉનો રૂ.૨,૦૦,૦૦૦ છે.)
- ૫) ધંધામાં અપેક્ષિત વળતરનો દર ૧૨% ગણાય છે.
- ૬) કંપનીના પાદઢીની રકમ અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીની આધારે કરવાની છે.

જવાબ:

→ અહીં સૌ પ્રથમ પાદઢીની ગણાતરી કરીશુઃ-

- ૧) પાદઢીની ગણાતરી

૧.૧) મિલકતો:-	જમીન અને મકાન	૧,૧૦,૦૦૦
	ચંત્રો	૭૫,૦૦૦
	ફર્નિચર	૫૦,૦૦૦
	રોકાણો(ગૌણ કંપનીના શેર)	૩૦,૦૦૦
	સ્ટોક	૪૦,૦૦૦
	દેવાદારો	૪૧,૦૦૦
	રોકડ સિલક	૩૦,૦૦૦
	= કુલ મિલકતો	રૂ. ૪,૦૭,૦૦૦

બાદ: દેવા:-

૧૫%ના ડીબેન્ચરો	૮૦,૦૦૦
પ્રો. ફંડ	૧૦,૦૦૦
દેવી હુંડી	૫,૦૦૦
ચૂ. બાકી ખર્ચ	૫,૦૦૦
= કુલ દેવા	રૂ. ૧૦૦,૦૦૦

= ચોખ્ખી મિલકતો	૩,૦૭,૦૦૦
- પ્રેફરન્સ શેર મૂડી	૧,૦૦,૦૦૦
ચોખ્ખી મિલકતો	
(ઇ.શેરધારકો માટે)	રૂ. ૨,૦૭,૦૦૦

$$\begin{aligned}
 1.2) \text{ અપેક્ષિત વળતરનો દર} &= \text{ચોખ્ખી મિલકતો} \times \text{અપેક્ષિત વળતરનો દર} \\
 &= 2,07,000 \times 10/100 \\
 &= \text{₹. } 20,700
 \end{aligned}$$

1.3) સરેરાશ નફો

સરેરાશ નફો	₹. 2,00,000
- કરબાદ(50%)	<u>₹. 1,00,000</u>
કરબાદનો નફો	<u>₹. 1,00,000</u>

- 10% બાદ મનન કંપનીના ડિબેન્ચર	₹. 1,000
- વ્યાજ કરપાત્ર 50%	500
	<u>₹. 500</u>
- પ્રે. શેર ડિવિડન્ડ	₹. 66,400
= ઈ. શેરધારકો માટેનો સરેરાશ નફો	₹. 10,000
	<u>₹. 76,400</u>

1.4) અધિક નફો = સરેરાશ નફો - અપેક્ષિત વળતરનો દર

$$= ₹6,400 - 20,700$$

$$= \text{₹. } 48,200$$

1.5) પાઘડી = સરેરાશ નફો \times 3

$$= ₹6,200 \times 3$$

$$= \text{₹. } 2,05,400$$

2) શેર મૂલ્યાંકનની ગણતરી

અ) શેરના મૂલ્યાંકનની આંતરીક ગણતરી :-

પાઘડી માટેની ચોખ્ખી મિલકતો	₹. 2,07,000
+ પાઘડી	20,700
+ બિન ધંધાકીય રોકાણો	
(મનન કંપનીના ડિબેન્ચર)	6,000
- કુલ ચોખ્ખી મિલકતો	<u>₹. 22,400</u>

શેરનું આંતરીક મૂલ્ય = ચોખ્ખી મિલકતો

$$\begin{aligned}
 &\text{ઇ. શેરની સંખ્યા} \\
 &= \frac{\text{₹. } 22,400}{2,000} \\
 &= \text{₹. } 11.2
 \end{aligned}$$

3) શેરની બજાર ડિમતા:-

સરેરાશ નફો	₹. 2,00,000
- કર 50% લેખે	1,00,000
	<u>1,00,000</u>
- પ્રે. શેર ડિવિડન્ડ	10,000
= ઈ. શેરધારકોને વહેંચવા	<u>₹. 60,000</u>
યોગ્ય નફો	

$$\begin{aligned}\rightarrow \text{કિવિડનો દર} &= \frac{\text{સરેરાશ નફો} \times 100}{\text{કુલ ભરપાઈ થયેલી}} \\ &= \frac{60,000 \times 100}{1,80,000} \\ &= 50\%\end{aligned}$$

$$\begin{aligned}\rightarrow \text{બજાર કિંમત} &= \frac{\text{કિવિડનો દર} \times 100}{\text{અપેક્ષિત વળતરનો દર}} \\ &= \frac{50}{100} \times 100 \\ &= રૂ. 500.\end{aligned}$$

૪) શેરની વ્યાજબી કિંમત = $\frac{\text{શેરની આંતરીક કિંમત} + \text{શેરની બજાર કીંમત}}{2}$

$$\begin{aligned}&= \frac{211.2 + 500}{2} \\ &= \frac{711.2}{2} \\ &= રૂ. 355.6\end{aligned}$$

ઉદા.૧૧ તા.૩૧/૦૩/૨૦૦૨નું કોમલ લીમીટેડનું પાકુ-સરવૈચું નીચે મુજબનું હતું.
કોમલ લી. નું તા.૩૧/૦૩/૨૦૦૨ના રોજનું પાકુ-સરવૈચું.

મૂકી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
રૂ. ૧૦નો એક ઓવાં ૨૦૦૦૦૦ ઈ. શેર	૨૦,૦૦,૦૦૦	જમીન અને મકાન	૫,૦૦,૦૦૦
સા.અનામત	૧૦,૦૦,૦૦૦	યંત્રો	૨૦,૦૦,૦૦૦
૧૨%ના ડિલેન્યરો	૫,૦૦,૦૦૦	ફિનિચર	૨,૦૦,૦૦૦
લેણાદારો	૫,૦૦,૦૦૦	સ્ટોક	૨,૦૦,૦૦૦
		દેવાદારો	૨,૦૦,૦૦૦
		બેંક સિલક	૩,૦૦,૦૦૦
	૪૦,૦૦,૦૦૦		૪૦,૦૦,૦૦૦

વધારાની માહિતી:

- ૧) દરેક સ્થિર મિલકતની બજાર કિંમત બમણી ગણાવી.
- ૨) કંપનીના પાધડીની રૂ. ૧૧,૦૦,૦૦૦ ગણાવી.
- ૩) છેદા ત્રણ વર્ષનો કરવેરા પછીનો સરેરાશ નફો રૂ. ૧૨,૦૦,૦૦૦ છે.
- ૪) અપેક્ષિત વળતરનો દર ૧૦% ગણાય છે.
- ૫) કંપની છેદા ત્રણ વર્ષની ૨૫% નફાની રકમ સા.અનામત ખાતે લઈ જાય છે.

ઉપરની માહિતી પરથી શેરની વ્યાજબી કિંમત શોધો.

(સ.પ.થ ૨૦૦૨)

જવાબ:

અહિં, શેરની વ્યાજબી કિંમત શોધવા માટે સૌ પ્રથમ શેરની આંતરીક તથા બજાર કિંમત શોધીશું.

૧) શેરની આંતરીક કિંમતની ગણાતરી

૩.

મિલકતો:-

પાદડી	૧૧,૦૦,૦૦૦
જમીન અને મકાન	૧૦,૦૦,૦૦૦
ચંત્રો	૪૦,૦૦,૦૦૦
ફર્નિચર	૪,૦૦,૦૦૦
સ્ટોક	૧૫,૦૦,૦૦૦
દેવાદારો	૨,૦૦,૦૦૦
બેન્ક સિલક	<u>૩,૦૦,૦૦૦</u>
= કુલ મિલકતો	<u>૮૬,૦૦,૦૦૦</u>

દેવા

૧૨%ના ડાબેન્ચરો	૫,૦૦,૦૦૦
લેણાદારો	<u>૫,૦૦,૦૦૦</u>
= ચોખ્ખી મિલકતો	<u>૭૫,૦૦,૦૦૦</u>
- પ્રે.શેર મૂડી	--
= ઈ.શેરધારકોની ચોખ્ખી મિલકતો	૭૫,૦૦,૦૦૦

$$\text{શેરની આંતરીક કિંમત} = \frac{\text{ઈ. ચોખ્ખી મિલકતો}}{\text{શેરની સંખ્યા}} = \frac{૭૫,૦૦,૦૦૦}{૨૦૦૦૦૦} = ૩.૩૮$$

૨) શેરની બજાર કિંમત

→ સરેરાશ નંદા (કરવેરા બાદ પછીનો)	૧૨,૦૦,૦૦૦
- સા.અનામત આતે લઇ જવાની રકમ ૨૫%	૩,૦૦,૦૦૦
(૧૨૦૦૦૦૦ × ૨૫/૧૦૦)	
- પ્રે.શેર ડિવિડન	--
= ઈ. શેરધારકોનો નફો	૩.૬,૦૦,૦૦૦

$$\rightarrow \text{ડિવિડનનો દર} = \frac{\text{ઈ. શેરધારકોનો નફો} \times ૧૦૦}{\text{કુલ ભરપાદ થયેલી રકમ ઈ. શેરમૂડી}} = \frac{૬,૦૦,૦૦૦ \times ૧૦૦}{૨૦,૦૦,૦૦૦} = ૪૫\%$$

$$\rightarrow \text{બજાર કિંમત} = \frac{\text{ડિવિડનનો દર} \times \text{શેર દીઠ ભરપાદ થયેલી ઈ. શેરમૂડી}}{\text{અપેક્ષિત વળતરનો દર}} = \frac{૪૫ \times ૧૦}{૧૦}$$

= રૂ. ૪૫.

$$\rightarrow \text{શેરની વ્યાજબી કિંમત} = \frac{\text{શેરની આંતરીક કિંમત} + \text{શેરની બ. કિ.}}{2} = \frac{38+45}{2} = \frac{83}{2} = \text{રૂ. ૪૧.૫}$$

ઉદા.૧૨ એસ.કે. લીમિટેડનું તા.૩૧/૦૩/૨૦૦૭ના રોજનું પાંકું-સરવૈયું નીચે પ્રમાણે છે. શેરની બજાર કિંમત શોધો.

એસ.કે. લીમિટેડનું તા.૩૧/૦૩/૨૦૦૭ના રોજનું પાંકું-સરવૈયું.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
રૂ.૧૦નો એક એવા ૧૨,૦૦૦		કાયમી મિલકતો	૨૫,૦૦,૦૦૦
ઇ.શેર દીઠ	૧૨,૦૦,૦૦૦		
૧૦ % પ્રે.શેરમૂડી (મ્ખી૧૦નો એક એવા ૮૦૦૦ શેર)	૮,૦૦,૦૦૦	૧૨%ના ડીબેન્ચર પરતનિધીના રોકાણો (બિન-ધ્યાકીય રોકાણો)	૨,૦૦,૦૦૦
સા.અનામત	૧,૪૦,૦૦૦	૧૦%ના સરકારી જામીનગીરીના રોકાણો (બજાર કિંમત	૧,૦૦,૦૦૦
ન.નુ ખાતું	૩,૦૦,૦૦૦	૧,૮૦,૦૦૦)	
ડિવિડનક પરતનિધી ખાતું	૨,૦૦,૦૦૦	સ્ટોક	૩,૦૦,૦૦૦
૧૨%ના ડીબેન્ચરો	૩,૦૦,૦૦૦	દેવાદારો	૩,૦૦,૦૦૦
લેણદારો	૩,૨૦,૦૦૦	રોકડ	૧,૦૦,૦૦૦
કરવેરા જોગવાઈ	૩,૦૦,૦૦૦	ડિલે. વટાવ	૪૦,૦૦૦
	૩૫,૬૦,૦૦૦		૩૫,૬૦,૦૦૦

વધારાની માહિતી:

- ૧) સ્થિર મિલકતોની કિંમત રૂ.૨૮,૦૦,૦૦૦ છે.
- ૨) અપેક્ષિત વળતરનો દર ૧૫% ગણાય છે.
- ૩) છેદા ત્રણ વર્ષના ભારીત સરેરાશ નફાને આધારે પાધડીની ગણતરી કરવી.
- ૪) અધિક નફાની ગણતરી ચાર વર્ષની ખરીદીની આધારે કરવી.
- ૫) ૫૦% કરવેરા બાદળો નફો નીચે મુજબ છે.

વર્ષ	નફો (રૂ.)	ભાર
૨૦૦૪	૩,૮૩,૫૦૦	૧
૨૦૦૫	૪,૧૫,૦૦૦	૨
૨૦૦૬	૪,૭૫,૫૦૦	૩

(સ.પ.યુ ૨૦૦૮)

- ૬) બન્ને રોકાણોનું વ્યાજ કરપાત્ર છે.

જવાબ:

→ સૌ પ્રથમ અહીં શેરની આંતરીક કિંમત તથા બજાર કિંમતની ગણતરી કરીશું, તેના માટે સૌ પ્રથમ પાધડીની ગણતરી કરીશું.

❖ પાધડીનું મૂલ્યાંકન

* રોકાણેલી મૂડી

મિલકતો	
સ્થીર મિલકતો	૨૮,૦૦,૦૦૦
૧૦% સરકારી જામીનગીરીના રોકાણો	૨,૦૦,૦૦૦
સ્ટોક	૩,૨૦,૦૦૦
ટેવાદારો	૩,૦૦,૦૦૦
શે. બેંક સિલક	૧,૦૦,૦૦૦
= કુલ મિલકતો	રૂ. ૩૭,૨૦,૦૦૦

- દૈવાં	
૧૨%ના ડીબેન્ચરો	૩,૦૦,૦૦૦
લેણાદારો	૩,૨૦,૦૦૦
કરવેરાની જોગવાઈ	૩,૦૦,૦૦૦
	રૂ. ૯,૨૦,૦૦૦
= ચોખણી મિલકતો(શે.મૂડી)	રૂ. ૨૮,૦૦,૦૦૦

$$\begin{aligned}
 * \quad \text{અપેક્ષિત નફો} &= \text{શેર મૂડી} \times \text{અપેક્ષિત વળતરનો દર} \\
 &= ૨૮,૦૦,૦૦૦ \times ૧૫\% \\
 &= રૂ. ૩,૦૦,૦૦૦
 \end{aligned}$$

❖ સરેરાશ નફો

વર્ષ	નફો (રૂ.)	ભાર	ભારિત નફો
૨૦૦૪	૩૮૩૫૦૦	૧	૩૮૩૫૦૦
૨૦૦૫	૪૧૫૦૦૦	૨	૮૩૦૦૦૦
૨૦૦૬	૪૭૫૫૦૦	૩	૧૪૨૬૫૦૦
		કુલ ભાર = ૬	કુલ ભારિત નફો = રૂ. ૪૮,૮૦,૦૦૦

$$\text{ભારિત સરેરાશ નફો} = \frac{\text{કુલ ભારિત નફો}}{\text{કુલ ભાર}} = \frac{રૂ. ૪૮,૮૦,૦૦૦}{૬} = રૂ. ૪,૮૦,૦૦૦$$

ભારિત સરેરાશ નફો કરવેરા પછીનો રૂ. ૪,૮૦,૦૦૦

- બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ ૧૦,૦૦૦/-

(૧૦૦૦૦૦ × ૧૦/૧૦૦)

$$\begin{aligned}
 - ૫૦\% \text{ કરબાદ} &\quad ૫,૦૦૦ \quad ૫,૦૦૦ \\
 &\quad ૪,૩૪,૦૦૦ \\
 - \text{પ્રે.ડિવિડન} &\quad ૮૦,૦૦૦ \\
 = \text{ભારિત સરેરાશ નફો} &\quad \hline
 &\quad રૂ. ૩,૫૪,૦૦૦
 \end{aligned}$$

અધિક નફો = ભારિત સરેરાશ નફો - અપેક્ષિત નફો

$$= ૩,૫૪,૦૦૦ - ૩,૦૦,૦૦૦$$

$$= રૂ. ૫૪,૦૦૦$$

$$\begin{aligned}
 \text{पाधडी} &= \text{अधिक नक्षे} \times \text{खरीदीना पर्याप्त} \\
 &= ५५००० \times ४ \\
 &= ₹. २,२०,०००
 \end{aligned}$$

शेरनुं भूत्यांकन

१.	ई. धारकोनी चोम्ही भिलकत	
	रोकायेली भूटी	२८,००,०००
	+ पाधडी	२२००००
	+ जीन घंघाकीय रोकाणो	१८००००
	ई. धारकोनी चोम्ही भिलकत	३२,००,०००
२.	आंतरीक किंमत	= ई. धारकोनी चोम्ही भिलकत
		इकायटी शेरनी संभवा
		= ₹३२,००,०००
		—————— १,२०,०००

$$= ₹. २६.६७$$

३.	बजार किंमत(नक्षाने आधारे)	
	भा. स. नक्षे	४,४०,०००
	- सा. अनामत खाते	-----
	प्रे. शेर डिविडन्ड	८०,०००
	ई. धारकोनो नक्षे	३,८०,०००

$$\begin{aligned}
 \text{डिविडन्डनो दर} &= \frac{\text{ई.क. धारकोनो नक्षे} \times १००}{\text{कुल भरायेली भूटी}} \\
 &= \frac{३६००० \times १००}{१२००००}
 \end{aligned}$$

$$= 30\%$$

$$\begin{aligned}
 ४. \quad \text{बजार किंमत} &= \frac{\text{डिविडन्ड दर} \times \text{शेर टीच भरायेली रकम}}{\text{अपेक्षित दर}} \\
 &= \frac{30 \times १००}{१५}
 \end{aligned}$$

$$= ₹. २०$$

$$\begin{aligned}
 \text{शेरनी व्याजभी किंमत} &= \frac{\text{शेरनी आंतरिक} + \text{शेरनी बजार किंमत}}{२} \\
 &= \frac{२६.६७ + २०}{२} \\
 &= ₹. २३.३३५
 \end{aligned}$$

ઉદા.૧૩ શ્રી નંદ લિમિટેડનું તા.૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાકું-સરવૈયું નીચે મુકવાનું છે. આપેલી માહિતી ઉપરથી શેરનું મૂલ્યાંકન આ શેરની આંતરીક કિંમત અને બજાર કિંમતથી કરો.
શ્રી નંદ લિમિટેડનું તા.૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાકું-સરવૈયું.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
શેર મૂડી:			
રૂ.૧૦૦ને એક એવા ૧૦,૦૦૦		પાદડી	૮૫,૦૦૦
ઇ.શેર (પૂરા ભરાયેલ)	૧૦,૦૦,૦૦૦		
રૂ.૧૫નો એક એવા ૧૫,૦૦૦		જમીન અને મકાન	૫,૫૦,૦૦૦
ઇ.શેર (રૂ.૧૨ ભરપાઈ)	૧૮,૦૦,૦૦૦		
રૂ.૨૦નો એક એવા ૫,૦૦૦		યંત્રો	૨,૫૫,૦૦૦
ઇ.શેર (રૂ.૧૫ ભરપાઈ)	૭૫,૦૦૦	સ્ટોક	૩,૦૦,૦૦૦
સા.અનામત	૮૦,૦૦૦	દેવાદારો	૧,૩૦,૦૦૦
ન.નું ખાતું	૪૦,૦૦૦	રોકડ સિલક	૩૫,૦૦૦
લેણાદારો	૫૦,૦૦૦	અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ	૪૦,૦૦૦
ચૂંબકી ખર્ચાઓ	૧૫,૦૦૦	પ્રાથમિક ખર્ચાઓ	૫૦,૦૦૦
<u>ધસારા-બંડોળ</u>			
જમીન અને મકાન ૧૦,૦૦૦			
યંત્રો	૧૫,૦૦૦		
	૨૫,૦૦૦		
	<u>૧૪,૫૫,૦૦૦</u>		<u>૧૪,૫૫,૦૦૦</u>

વધારાની માહિતી:

- ૧) દંધાની પાદડીની નવી કિંમત રૂ.૧,૨૦,૦૦૦ નકકી કરવામાં આવી.
- ૨) રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૨% છે.
- ૩) જમીન અને મકાનની કિંમતમાં ૨૦%નો વધારો કરવો.
- ૪) રૂ.૩૫,૫૦૦નો કંપની સામેનો દાવો મંજૂર રાખવામાં આવે છે.
- ૫) દેવાદારો પર ૧૦% ધા.અનામત ગાણાવી.
- ૬) કંપનીને છેલ્સાં ૪ વર્ષનો ચોખ્ખો નફો નીચે પ્રમાણે છે.

૨૦૧૭-૧૮ રૂ.૧,૫૦,૫૦૦

૨૦૧૫-૧૬ રૂ.૧૫,૦૦૦

૨૦૧૫-૧૬ રૂ.૬૫,૦૦૦

૨૦૧૪-૧૫ રૂ.૧,૦૫,૦૦૦

→ નફો પેડી ૮% દર વર્ષ સા.અનામત ખાતે લઈ જવામાં આવે છે.

જવાબ : સૌ પ્રથમ આપણે શેરની આંતરીક કિંમતની ગણતરી માટે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીશું.

→ અહીં સૌ પ્રથમ બાકી ન ભરાયેલી શેર મૂડી મેળવી લીધી છે. એમ ગણતરી કરીને તેને ચોખ્ખી મિલકતોમાં ઉમેરીશું.

અ) ચોખ્ખી મિલકતો :-

મિલકતો

પાદડી

૧,૨૦,૦૦૦

જમીન અને મકાન

૫,૫૦,૦૦૦

યંત્રો

૨,૫૫,૦૦૦

-ધસારો	૧૫,૦૦૦	૨,૫૦,૦૦૦
સ્ટોક		૩,૦૦,૦૦૦
દેવાદારો	૧૩૦૦૦૦	
-ધા.અનામત	૧૩૦૦૦	૧૧૭૦૦૦
રોકડ સિલક		૩૪૦૦૦
અગાઉથી ચૂકુવેલ ખર્ચી		૪૦૦૦૦
=કુલ મિલકતો		<u>૧૫,૨૨,૦૦૦</u>
- દેવા		
લેણદારો		૫૦,૦૦૦
ચૂબાકી ખર્ચાઓ		૧૫,૦૦૦
દાવો		૩૫,૫૦૦
= કુલ દેવા		<u>૧૦૦૫૦૦</u>
=ચોખ્ખી મિલકતો		૧૪,૨૧,૫૦૦
+ બાકી હમા નહી ભરાયેલ રકમ		
મૂડી		
ઇ.શેર અ ૧૫૦૦૦ × ૩	= ૪૫૦૦૦	
ઇ.શેર બ ૫૦૦૦ × ૫	= ૧૫૦૦૦	૫૦,૦૦૦
= કુલ ચોખ્ખી મિલકતો		૧૪,૮૧,૫૦૦
→ અહીં તમામ શેર ભરપાયેલ ગાણયાં છે માટે શેરની સંખ્યા (૧૦૦૦૦+૧૫૦૦૦+૫૦૦૦) ૩૦૦૦૦ થશે.		
શેરની આંતરીક કિંમત	= <u>કુલ ચોખ્ખી મિલકતો</u> શેરની સંખ્યા	
	= <u>૧૪૮૧૫૦૦</u> ૩૦૦૦૦	
	= ૪૮૮.૩૮	

અહીં;

- અ. ઇ.શેરની આંતરીક કિંમત ૪૮૮.૩૮ ગણાશે.
- બ. ઇ.શેરની આંતરીક કિંમત (૪૮૮.૩૮-૩) ૧૬૮.૩૮ ગણાશે.
- ક. ઇ.શેરની આંતરીક કિંમત (૪૮૮.૩૮-૫) ૩૧૭.૬૮ ગણાશે.
(નોંધ:શેર અ પૂરેપૂરા ભરપાયેલ થયેલ છે, જ્યારે બાકીના શેરનાં હમા બાકી છે.)

બ) શેરની બજાર કિંમત

વર્ષ	નફો
૨૦૧૭-૧૮	૧૬૦૫૦૦
-ધા.અનામત	૧૩૦૦૦
-દાવો	૩૪૫૦૦
૨૦૧૬-૧૭	૧૧૫૦૦૦
૨૦૧૫-૧૬	૬૫૦૦૦
૨૦૧૪-૧૫	૧૦૫૦૦૦
	<u>૩,૪,૨૭,૦૦૦</u>

(નોંધ:દાવો મંજૂર ૨૦૧૭-૧૮માં હોવાથી નફો ઘટશે.)

સરેરાશ નફો	=	<u>₹, २७,०००</u>
		<u>४</u>
	=	<u>₹. ६,०८,७५०</u>
-સા.અનામત ખાતે લઈ જવાની રકમ		<u>८५४०</u>
($10\% \text{ of } 6,08,750 \times 18/100$)		<u>—</u>
કુલ ચોખો સરેરાશ નફો		<u>₹८२९०</u>

$$\begin{aligned} \text{ડિવિડન્ડનો દર} &= \frac{\text{સરેરાશ નફો} \times 100}{\text{ભરપાયેલ થયેલી મૂડી}} \\ &= \frac{6,08,750 \times 100}{12,54,000} \\ &= 4.83\% \end{aligned}$$

(અહીં ભરપાયેલ થયેલ મૂડી $10,00,000 + 1,80,000 + 70,000$) ₹ 12,54,000 છે.

$$\begin{aligned} \text{અ. ઈ.શેરની બજાર કિંમત} &= \frac{\text{ડિવિડન્ડનો દર} \times \text{શેર દીઠ ભરપાયેલ થયેલ રકમ}}{\text{અપેક્ષિત વળતરનો દર}} \\ &= \frac{4.83 \times 100}{12} \\ &= ₹ 45.25 \end{aligned}$$

$$\begin{aligned} \text{બ. ઈ.શેરની બ. કિંમત} &= \frac{4.83 \times 12}{12} \\ &= ₹ 4.83 \end{aligned}$$

$$\begin{aligned} \text{ક. ઈ.શેરની બજાર કિંમત} &= \frac{4.83 \times 14}{12} \\ &= ₹ 6.76 \end{aligned}$$

ઉદા. ૧૪ વિયેક લિ.નું તા.૩૧/૩/૨૦૦૭ના રોજનું પાકું-સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	ગ્રિલક્ટ-લેણાં	રૂ.
૧૦%ના કચુ. પ્રેફ શેર	5,00,000	જમીન અને મકાન	5,00,000
(દરેક ₹ ૧૦નો ઇકવિટી શેર(દરેક ₹ ૧૦નો)જેના પર શેર દીઠ ૩.૮ વસુલ થયા છે.)	૮,૦૦,૦૦૦	પ્લાન્ટ અને મશીનરી	૧૨,૦૦,૦૦૦
સા.અનામત	5,00,000	ફર્નિચર	1,40,000
૧૨%ના ડીલેન્ચર્સી	5,00,000	સ્ટોક	4,00,000
લેણાદારો	8,00,000	દેવાદારો	2,00,000
		બેન્ક સિલક	1,40,000
		લેણી હૂંડી	1,00,000
		પ્રાથમિક ખર્ચ	1,00,000
	<u>28,00,000</u>		<u>28,00,000</u>

વધારાની માહિતી:

- ૧) કંપનીની મિલકતોની વર્તમાન કિંમત બમણી ગણવી.
- ૨) કંપનીની પાધડીની કિંમત છેદા ત્રણ વર્ષના સરેરાશ અધિક નજીથી ત્રણ ગણી ગણવાની છે.
- ૩) ૫૦% લેખે કરવેરા બાદ કર્યા પછીના છેદા ત્રણ વર્ષનો સરેરાશ નશો રૂ.૫,૦૦,૦૦૦/-.
- ૪) છેદા ત્રણ વર્ષથી, કરવેરા બાદ કર્યા પછીના નજીના ૨૫% કંપની દર વર્ષ પોતાના સામાન્ય અનામત ખાતે લઈ જાય છે.
- ૫) કંપનીના ધંધા જેવા અન્ય ધંધામાં અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.

→ ઉપરની માહિતી પરથી કંપનીના ઘિંદિયાં શેરની વ્યાજબી કિંમત શોધી કાઢો.

(સૌ. ચુનિ. એસ.વાય એપ્રીલ ૨૦૦૨)

જવાબ:

→ અહીં આપણે સૌ પ્રથમ શેરની આંતરીક કિંમત માટે રોકાયેલી મૂડી, ચોખ્ખી મિલકતો તથા પાધડીની ગણતરી કરીશું.

૧) મિલકતો:-

જમીન અને ભકાન	૧૦,૦૦,૦૦૦
પ્લાન્ટ મશીનરી	૨૪,૦૦,૦૦૦
ફિનિચર	૩,૦૦,૦૦૦
સ્ટોક	૮,૦૦,૦૦૦
દેવાદારો	૨,૦૦,૦૦૦
લેન્ક સિલક	૧,૫૦,૦૦૦
લેણી હુંડી	૧,૦૦,૦૦૦
કુલ મિલકતો	<u>૪૮,૫૦,૦૦૦</u>

બાદ - દેવા

૧૨% ના ડીલેન્ચરો	૫,૦૦,૦૦૦
લેણાદારો	૪,૦૦,૦૦૦
= ચોખ્ખી મિલકતો	૮૦,૫૦,૦૦૦
-પ્રો. શેર મૂડી	૫,૦૦,૦૦૦
= રોકાયેલી મૂડી	<u>૩૫,૫૦,૦૦૦</u>

$$\begin{aligned} ૨) અપેક્ષિત નશો &= રોકાયેલી મૂડી \times અપેક્ષિત વળતરનો દર \\ &= ૩૫,૫૦,૦૦૦ \times ૧૦/૧૦૦ \\ &= રૂ. ૩,૫૫,૦૦૦ \end{aligned}$$

$$\begin{aligned} ૩) સરેરાશ નશો &= ૩,૫,૦૦,૦૦૦ \\ - પ્રો. ડિવિડન્સ &\quad ૫૦,૦૦૦ \\ = કુલ ચોખ્ખો નશો &= ૩,૪,૫૦,૦૦૦ \end{aligned}$$

$$\begin{aligned} ૪) અધિક નશો &= કુલ સરેરાશ નશો - અધિક નશો \\ &= ૪,૫૦,૦૦૦ - ૩,૫૫,૦૦૦ \\ &= રૂ. ૧૫,૦૦૦ \end{aligned}$$

૫) પાદડી = અધિક નફો \times ખરીદીના વધો

$$= 1,64,000 \times 3$$

$$= ₹. 4,84,000$$

૬) શેરની આંતરીક કિંમત =
$$\frac{\text{કુલ ચોખ્ખી મિલકતો}}{\text{ઇ. શેરની સંખ્યા}}$$

$$= \frac{₹ 1,34,000}{100000}$$

$$= ₹. 1.34$$

→ માટે, અહીં ચોખ્ખી મિલકતો,
 રોકાયેલી મૂડી 34,40,000
 + પાદડી 4,84,000
 = કુલ ચોખ્ખી મિલકતો ₹. 41,34,000

૭) શેરની બજાર કિંમત

સરેરાશ નફો	₹ 5,00,000
- સા.અનામત ખાતે લઈ જવાની રકમ(₹ 5,00,000 \times 25/100)	₹ 1,25,000
	<hr/>
- પ્રે. ડિવિડન(500000 \times 10%)	₹ 4,50,000
= ઇ.શેરધારકોનો નફો	<hr/>
	50,000
	<hr/>
	₹. 4,00,000

→ ડિવિડનનો દર =
$$\frac{\text{સરેરાશ નફો} \times 100}{\text{ભરપાયેલ થયેલ ઇ.શેરમૂડી}}$$

$$= \frac{4,00,000 \times 100}{4,00,000}$$

$$= 40 \%$$

→ બજાર કિંમત =
$$\frac{\text{ડિવિડનનો દર} \times \text{શેર દીઠ ભરપાયેલ થયેલી ઇ.શેરમૂડી}}{\text{અપેક્ષિત વળતરનો દર}}$$

$$= \frac{40 \times 4}{10}$$

$$= ₹. 40.$$

૮) શેરની વ્યાજબી કિંમત =
$$\frac{\text{શેરની આંતરીક કિંમત} + \text{શેરની બજાર કિંમત}}{2}$$

$$= \frac{₹ 1.34 + 40}{2}$$

$$= \frac{41.34}{2}$$

$$= ₹ 20.67$$

ઉદા.૧૫ આણંદ કંપની લિમિટેડનું તા.૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાંકું-સરવૈયું નીચે પ્રમાણે છે. આપેલ માહિતી ઉપરથી શેરની વ્યાજની કિંમત શોધો.

આણંદ કંપનીનું તા.૩૧/૦૩/૨૦૧૮ના રોજનું પાંકું-સરવૈયું.

મૂડી-દેવાં	રૂ.	ભિલકત-લેણાં	રૂ.
રૂ.૧૦૦નો એક એવાં ૫,૦૦૦		જમીન અને મકાન	૪,૨૫,૦૦૦
ઇ.શેર	૫,૦૦,૦૦૦	ફર્નિચરો	૧,૫૫,૦૦૦
રૂ.૧૦૦નો એક એવાં ૧૦%ના ૧૦૦૦ પ્રે.શેર	૧,૦૦,૦૦૦	રોકાણો	૩૪,૦૦૦
સા.અનામત	૪૫,૦૦૦	દેવાદારો	૨૫,૦૦૦
લેણદારો	૮૫,૦૦૦	રોકડ સિલક	૧,૦૦,૦૦૦
દેવી હુંડી	૨૫,૦૦૦	લેણી હુંડી	૨૫,૦૦૦
પ્રો.ફંડ	૩૫,૦૦૦	પ્રાથમિક ખર્ચાઓ	૩૫,૦૦૦
	૮૦૦,૦૦૦		૮૦૦,૦૦૦

વધારાની માહિતી:

- ૧) જમીન અને મકાનની કિંમતમાં ૨૫%નો વધારો.
- ૨) ફર્નિચરોની કિંમતમાં ૨૦%નો વધારો કરવો.
- ૩) રોકાણોની નવી બજાર કિંમત રૂ.૫૫,૦૦૦/- છે.
- ૪) અપેક્ષિત વળતરનો દર ૧૫% છે.
- ૫) દેવાદારો ઉપર રૂ.૫,૦૦૦ ધાતખાદ અને ૫% ધાતખાદ અનામત ગણવી.
- ૬) પાધડીની કિંમત રૂ.૭૫,૦૦૦ આંકવી.
- ૭) સરેરાશ નશો રૂ.૧,૨૫,૦૦૦ ડિવિડન પહેલાનો છે.

જવાબ:

→ સૌ પ્રથમ અહિં ચોખ્ખી ભિલકતોની ગણતરી કરીશું.

૧) ભિલકતો:-

જમીન અને મકાન	૪,૨૫,૦૦૦	
+ વધારો(૪,૨૫,૦૦૦×૨૫/૧૦૦)	૧,૦૬,૨૫૦	૫,૩૧,૨૫૦
ફર્નિચર		૧,૫૫,૦૦૦
+ વધારો(૧,૫૫,૦૦૦×૨૦/૧૦૦)	૩૧,૦૦૦	૧,૮૬,૦૦૦
દેવાદારો	૨૫,૦૦૦	
- ધાતખાદ	૫,૦૦૦	
	૨૦,૦૦૦	
- ધા.અનામત ૫%	૧,૦૦૦	૧૬,૦૦૦
રોકડ સિલક		૧,૦૦,૦૦૦
લેણી હુંડી		૨૫,૦૦૦
=કુલ ભિલકતો		રૂ. ૮,૬૧,૨૫૦
બાદ:		
દેવાદારો	૮૫,૦૦૦	
દેવીહુંડી	૨૫,૦૦૦	

प्रो.फंड	34,000	1,44,000
-प्रे.शेरमूडी		= 7,09,250
=पाठी सिवायनी चोभारी भिलकतो/रोकायेली मूडी		1,00,000
		3.5,09,250

2) अपेक्षित नक्षे = रोकायेली मूडी × अपेक्षित वर्गतरनो दर
 $= 5,09,250 \times 15/100$
 $= 3.60,637.5$

3) सरेराशा नक्षे

-प्रे.डिविडन (1,00,000×10/100)	3.1,25,000
= कुल सरेराशा नक्षे	10,000
	3.1,15,000

4) शेरनी आंतरीक किंमतनी गणातरी:

चोभारी भिलकतो	3.5,09,250
+ पाठी	75,000
+ रोकाणो(बजार किंमत)	55,000
=चोभारी भिलकतो	3.7,45,250

$$\rightarrow \text{शेरनी आंतरीक किंमत} = \frac{\text{कुल चोभारी भिलकतो}}{\text{ई.शेरनी संख्या}}$$
 $= \frac{3,745,250}{5,000}$
 $= 3.149.25$

5) ई.शेरनी बजार किंमत

$$\rightarrow \text{डिविडनो दर} = \frac{\text{कुल सरेराशा नक्षे} \times 100}{\text{भरपायेल थयेली कुल ई.शेरमूडी}}$$
 $= \frac{1,15,000}{5,00,000}$
 $= 23 \%$

$$\rightarrow \text{बजार किंमत} = \frac{\text{डिविडनो दर} \times \text{शेरदीच ई.शेरनी भरपायेल थयेल मूडी}}{\text{अपेक्षित वर्गतरनो दर}}$$
 $= \frac{23 \times 100}{15}$
 $= 3.143.33$

6) व्याजबी किंमत = $\frac{\text{शेरनी आंतरीक किंमत} + \text{व्याजबी किंमत}}{2}$

 $= \frac{149.25 + 143.33}{2}$
 $= \frac{302.58}{2}$
 $= 3.149.26$

ઉદા.૧૬ નારાયણ લી.ઓ/૦૩/૨૦૦૪ના રોજનું પાકું-સરવૈચું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ	મિલકત-લેણાં	રૂ
રૂ.૧૦નો એક ઓવા એક ૧૨%		સ્થિર મિલકતો	૧૦૦૦૦૦૦
પ્રેફ. શેર મૂડી	૪,૦૦,૦૦૦	રોકાણો	૩૦૦૦૦૦
ઇ.શેર મૂડી (રૂ.૧૦નો એક, રૂ.૮ ભરાયેલ)	૮,૦૦,૦૦૦		
સા.અનામત	૧૦૦૦૦૦	ચાલુ મિલકતો	૪,૩૦,૦૦૦
ન.નુ ખાતુ	૧૦૦૦૦૦	પ્રા.ખર્ચ	૨૦૦૦૦
કર્મચારી વળતર ભંડોળ	૨૫૦૦૦		
કર્મચારી નફાભાગ ભંડોળ	૧૫૦૦૦		
પ્રો.ફંડ	૧૦૦૦૦૦		
લેણાદારો	૧૧૦૦૦૦		
કરવેરા જોગવાઈ	૧૫૦૦૦૦		
	૧૭૫૦૦૦૦		૧૭૫૦૦૦૦

વધારાની ભાહિતી:

- ૧) સ્થિર મિલકતોની ચોખ્ખી કિંમતખરીદ કિંમત કરતાં કરતાં ૨૦% ઓછી છે.
- ૨) કુલ રોકાણોમાંથી ૭૦% બિનદ્યાકીય રોકાણો બધાજ રોકાણો ખ.કિ ચો.કિ કરતાં ૨૦% વધુ છે.
- ૩) કર્મચારી અકસ્માતનો દાવો રૂ.૫૦૦૦ બાકી છે.
- ૪) વર્ષ ૨૦૦૪ માટે પ્રેફ. શેર પર ડિવિડન્ડ ચૂકવાચું નથી.
- ૫) છેલ્લા ત્રણ વર્ષનો કરવેરા પણીનો સરેરાશ નઝો રૂ. ૧,૮૭,૫૫૦ છે.
- ૬) અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.
- ૭) કંપની છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ સરેરાશ કરવેરા પણીના નફાના ૨૦% અનામત ખાતે લદ્ય જાય છે.
- ૮) અધિક નફાની જ વર્ષની ખરીદીના આધારે પાદઠીની ગણાતરી કરો.

ઉપરની વિગતો પરથી વ્યાજબી કિંમત શોધો.

(સ.પ.યુ ૨૦૦૫)

૩૦૦૦૦૦(કુલ રોકાણો)

૩૦ % દંડાકીય	૭૦% બિનદ્યાકીય
ચો.કિ ૬૦,૦૦૦	૨૧૦૦૦૦
+ ૨૦% વધુ ૧૮,૦૦૦	૪૨૦૦૦
ખ.કિ ૧,૦૮,૦૦૦	૨,૫૨,૦૦૦

* પાદઠીનું મૂલ્યાંકન:

૧) રોકાયેલી મૂડી	
કુલ મિલકતો	૧૨,૫૦,૦૦૦
સ્થિર મિલકતો	૧,૦૮,૦૦૦
+ દંડાકીય રોકાણો	૪,૩૦,૦૦૦
+ ચાલુ મિલકતો	૧૭,૮૮,૦૦૦

બાદ	<u>કુલ જવાબદારી</u>	
	પ્રો.ફંડ	1,00,000
	કરવેરા જોગવાઈ	1,50,000
	લેણાદારો	1,10,000
	કર્મચારી અકસ્માત દાવો	4,000
	કર્મચારી નફાભાગ મંડોળ	14,000
		3,40,000
	ચો.મિલકત	14,04,000
	-પ્રેફ. શેર મૂડી	4,00,000
	(4000000×12%) બાકી ડિવિડન	48,000
	રોકાયેલી મૂડી	<u>6,50,000</u>
૨)	અપેક્ષિત નફો = રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર	
	= 6,50,000×10%	
	= 3. 65,000	
૩)	સરેરાશ કરવેરા પછીનો નફો:	18,750
	-બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ	
	(210000×15%)	31,500
	-50% કરવેરો	15,750
		<u>15,750</u>
	-પ્રેફ. શેર ડિવિડન (4000000×12%)	48,000
	=સ.ક નફો	
		<u>1,72,000</u>
૪)	અધિક નફો = સ.ક નફો - અપેક્ષિત નફો	1,24,000
	= 12,40,000 - 65,000	
	= 28,000	
૫)	પાધકી = અધિક નફો × ખરીદીના વર્ષો	
	= 28,000 × 4 વર્ષ	
	= 1,12,000	

નોંધ:- ખરીદ કિમત 20% વધુ છે.

ધારો કે ખરીદ કિમત	100
-ધટાડો 20%	20
ચો.કી	<u>80</u>

ચોખી કિમત	બજાર કિમત
80	100
100000	?
= 3. 1,25,000	

➤ શેરનું મૂલ્યાંકન
આંતરીક કિમત(ચો. મિલકતના આધારે)

१)	ઇ.ધારકોની ચોખ્ખી મિલકત	
	રોકાયેલી મૂડી	₹, ૫૦,૦૦૦
	+ પાદડી	૧,૧૨,૦૦૦
	+ બિન ઘંધાકીય રોકાણો	૨,૫૨,૦૦૦
	= ઇ.ધારકોની ચોખ્ખી મિલકત	₹ ૧૩,૨૪,૦૦૦

૨) આંતરીક કિંમત = $\frac{\text{ઇ.ધારકોની ચોખ્ખી મિલકત}}{\text{ઇક્વિટી શેરની સંખ્યા}}$

$$= \frac{1,32,4000}{1000000}$$

$$= રૂ. ૧૩.૨૪$$

* બજાર કિંમત નફાના આધારે

૧) ઇક્વિટી ધારકોનો નફો

સ.ક. નફો(કરવેરા પછીનો)

૧,૮૭,૭૫૦

-સા.અનામત ખાતે લઈ રહતા(૧૮૭૭૫૦ × ૨૦%)

૩૭,૫૫૦

૧,૫૦,૨૦૦

-પ્રેક. શેર ડિવિડન(૪૦૦૦૦૦ × ૧૨%)

૪૮,૦૦૦

= ઇક્વિટી ધારકોનો નફો

૧,૦૨,૨૦૦

૨) ડિવિડનનો દર = $\frac{\text{ઇક્વિટી ધારકોનો નફો} \times 100}{\text{ભરાયેલ મૂડી}}$

$$= \frac{1,02,200 \times 100}{1,000,000}$$

$$= ૧૨.૭૫%$$

૩) બજાર કિંમત = $\frac{\text{ડિવિડનનો દર} \times \text{શેર દીઠ ભરાયેલ રકમ}}{\text{અપેક્ષિત વળતરનો દર}}$

$$= \frac{12.75 \times ૮}{૧૦}$$

$$= રૂ. ૧૦.૨૨$$

૪) શેરની વ્યાજબી કિંમત = $\frac{\text{શેરની આંતરીક કિંમત} + \text{શેરની બજાર કિંમત}}{૨}$

$$= \frac{13.24 + 10.22}{2}$$

$$= રૂ. ૧૧.૭૩$$

ઉદા.૧૮ કેશાવ લીમિટેડનું તા.૩૧/૦૩/૨૦૦૫નાં રોજનું પાકું-સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
અ). પ્રકારના ૪૦૦૦૦ ઈ.શેર	૪૦૦૦૦૦	પાધડી	૧૩૦૦૦૦
(રૂ.૧૦ નો એક સંપૂર્ણ ભરપાઈ)		મકાન	૧૬૦૦૦૦
બ). પ્રકારના ૪૦૦૦૦ ઈ.શેર	૩૨૦૦૦૦	યંત્રો	૨૦૦૦૦૦
(રૂ.૧૦ નો એક ૮ ભરપાઈ)		સ્ટોક	૪૦૦૦૦૦
ક). પ્રકારના ૨૦૦૦૦ ઈ.શેર	૧૨૦૦૦૦	દેવાદારો	૩૦૦૦૦૦
(રૂ.૧૦ નો એક ૩. ૫ ભરપાઈ)		રોકડ	૩૫૦૦૦
સા. અનામત ખાતું	૧૪૦૦૦૦	અગાઉથી ચુકવેલ વિમો	૫૦૦૦
નફા-નુકશાન ખાતું	૫૦૦૦૦	પ્રાથમિક ખર્ચાઓ	૬૦૦૦
લેણાદારો	૧૦૦૦૦૦		
બેંક ઓપર ફ્રાફ્ટ	૩૦૦૦૦		
ચૂકવવાના બાકી ખર્ચા	૨૦૦૦૦		
ઘસારા ભંડોળ			
મકાન	૧૦૦૦૦		
યંત્રો	૪૦૦૦૦		
	૫૦૦૦૦		
	<u>૧૨,૪૦,૦૦૦</u>		<u>૧૨,૪૦,૦૦૦</u>

વધારાની માહિતી:

- ૧) કંપનીની પાધડી ૧,૬૦,૦૦૦ રૂ. ગણવામાં આવી છે.
- ૨) દેવાદારો પર ધોલખાદ અનામત ૨૦૦૦૦ જોગવાઈ.
- ૩) અપેક્ષિત વળતરનો દર ૧૦% રાખવો.
- ૪) છેદાં ત્રણ વર્ષનો નહો અનુક્રમે રૂ. ૨,૦૦,૦૦૦, રૂ. ૨,૫૦,૦૦૦, રૂ. ૨,૪૧,૦૦૦ છે. જેમાંથી ૨૦% રકમ સા. અનામત ખાતે લઈ જવી.
- ૫) મકાનની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ ગણવી અને રૂ. ૫૧,૦૦૦ દાવો ચૂ.પાત્ર ગણેલ છે.

૧) આંતરીક કિંમત(ચો.મિલકત)

ઇક. ધારકોની ચો.મિ.

પાધડી	૧,૬૦,૦૦૦
મકાન	૨,૦૦,૦૦૦
યંત્રો(૨૦૦૦૦૦ બાદ ઘસારા)	૧,૬૦,૦૦૦
સ્ટોક	૪,૦૦,૦૦૦
અ.ચૂ.વિમો	૫,૦૦૦
રોકડ	૩૫,૦૦૦
દેવાદારો	<u>૨,૮૦,૦૦૦</u>
	<u>રૂ.૧૨,૪૧,૦૦૦</u>

બાદ:કુલ જવાબદારીઓ

લેણાદારો	૧૦૦૦૦૦
બેંક ઓપર ફ્રાફ્ટ	૩૦૦૦૦
ચૂ.બાકી ખર્ચા	૨૦૦૦૦

ચુ.પાત્ર દાવાની રકમ	૫૧૦૦૦	૨,૦૯,૦૦૦
ચો.મિ.		૧૦૪૦૦૦૦

Add: કુલ નહી ભરાયેલી શેર મૂડી

$$અ = ૧૦-૮ = ૨ \times ૪૦૦૦૦ = ૮૦૦૦૦$$

$$ક = ૧૦-૬ = ૪ \times ૪૦૦૦૦ = ૮૦૦૦૦$$

$$\text{ઇક. શેર ધારકોની ચો.મિ. } ૧,૨૦,૦૦૦૦$$

$$\text{આંતરીક કિંમત} = \frac{\text{ઇક. ધારકોની ચો.મિ}}{\text{ઇક. શેરની સંખ્યા}}$$

$$= \frac{૧૨૦૦૦૦૦}{૪૦૦૦૦+૪૦૦૦૦+૨૦૦૦૦}$$

$$= \frac{૧૨૦૦૦૦૦}{૧૦૦૦૦૦}$$

$$= ૧.૨$$

$$અ = ૧.૨$$

$$અ = (૧.૨ - ૮) ૧૦ = ૩.$$

$$ક = (૧.૨ - ૪) ૮ = ૩.$$

* બજાર કિંમત (નિષાના આધારે)

૧) ધારકોનો નફો

$$\text{સરેરાશ નફો} = \frac{૨,૦૦,૦૦૦ + ૨,૫૦,૦૦૦ + ૨૪,૧૦,૦૦૦}{૩ \text{ વર્ષ}}$$

$$= ૭૦૧૦૦૦ / ૩$$

$$\text{ચો. નફો} = ૨૩૩૬૬૭$$

$$\text{સા.અનામત ખાતે (૨૦\%)} = \frac{૪૯૭૩૩}{૧૮૫૬૩૪}$$

$$\text{પ્રે. શેર ડિવિડન} = --$$

$$\text{ઇક. ધારકોનો નફો} = ૧૮૫૬૩૪$$

૨) ડિવિડનનો દર:

$$= \frac{\text{ઇક. ધારકોનો નફો} \times ૧૦૦}{\text{કુલ ભરાયેલ ઇક. મૂડી}}$$

$$= \frac{૧૮૫૬૩૪}{૮,૪૦,૦૦૦} \times ૧૦૦$$

$$= ૨૨.૨૫ \%$$

$$\begin{aligned}
 3) બજાર કિંમત &= \frac{\text{ડિવિડનનો દર} \times \text{શેર દીઠ ભરાયેલ રકમ}}{\text{અપેક્ષિત વળતરનો દર}} \\
 &= \frac{22.25 \times 10}{10} \\
 &= 22.25 \%
 \end{aligned}$$

$$ઈ = \frac{22.25 \times 8}{10} = રૂ. 17.8$$

$$ઈ = \frac{22.25 \times 5}{10} = રૂ. 13.25$$

* શેરની વ્યાજની કિંમત = શેરની આંતરીક કિંમત + શેરની બજાર કિંમત

$$= \frac{12 + 22.25}{2}$$

$$= રૂ. 17.12$$

$$બ = \frac{10 + 17.8}{2} = રૂ. 13.9$$

$$ક = \frac{8 + 13.25}{2} = રૂ. 10.52$$

ઉદા. ૧૮ મુખ્ય લિમિટેડ તા. ૩૧/૦૩/૨૦૧૮ના રોજની શેર મૂડી અંકોની માહિતી નીચે મુજબની છે. આપેલી માહિતી ઉપરથી શેરની વ્યાજની કિંમત શોધો.

- ૧) રૂ. ૧૦૦નો એક-એવાં ૫,૦૦૦ ૧૦%ના કચુભૂલીટીવ પ્રે.શેર પૂરેપૂરા ભરાયેલ.
- ૨) રૂ. ૧૦૦નો એક-એવાં ૫,૦૦૦ ૧૫%ના નોન- કચુભૂલીટીવ પ્રે.શેર(પૂરે પૂરા ભરાયેલ)આ શેર ધારકોને ઈ.શેર મૂડી પર ૧૦% લેખે ડિવિડન આપ્યાં બાદ વધતા નફા પૈકી ૨% બીજું વધારાનો ડિવિડન મેળવવાનો હક્ક છે.
- ૩) રૂ. ૧૦૦નો એક-એવાં ૭,૦૦૦ ઈ.શેર(પૂરે પૂરા ભરાયેલ)
- ૪) કંપનીની મિલકતો રૂ ૨૦,૦૦,૦૦૦ છે અને કંપનીના દૈવા રૂ. ૧,૨૦,૦૦૦ છે. વર્ષ ૨૦૧૭-૧૮નો ૫૦% કર બાદ કર્યા બાદનો નફો રૂ ૫,૦૦,૦૦૦ છે. કંપનીએ બજે પ્રકારનાં શેરધારકોને આગલાં વર્ષ ડિવિડન આપ્યું નથી.
- ૫) કંપની દર વર્ષ નફામાંથી ૨૫% રકમ સા. અનામત ખાતે લઈ જવાનું નક્કી કર્યું છે.

→ ૧. અહીં સૌ પ્રથમ શેરની આંતરીક કિંમતની ગણતરી કરીશું.

મિલકતો	૨૦,૦૦,૦૦૦
- દૈવા	૧,૨૦,૦૦૦
= ચોખ્યા મિલકતો	૩,૧૮,૮૦,૦૦૦
- કચુભૂલીટીવ પ્રે.શેર મૂડી	૫,૦૦,૦૦૦

+ બે વર્ષનું ડિવિડન્ડ (૫,૦૦,૦૦૦ × ૧૦ / ૧૦૦ × ૨ વર્ષ) ૧,૦૦,૦૦૦ ૫,૦૦,૦૦૦

સ્ટેપ: ૧ અહીં સૌ પ્રથમ શેરની આંતરીક કિંમત ગણીશું.

ચોખી મિલકતો	<u>૨૦,૦૦,૦૦૦</u>
- દૈવા:	<u>૧૨૦૦૦૦</u>
	<u>૧૮,૮૦,૦૦૦</u>

- કયુભ્યુલેટીવ પ્રે.શેર મૂડી (૫૦૦૦૦૦ + ૧૦૦૦૦૦)	<u>૫૦૦૦૦૦</u>
+ બે વર્ષનું ડિવિડન્ડ (૫૦૦૦૦૦ × ૧૦ / ૧૦૦ × ૨ વર્ષ)	<u>૧૨,૪૦,૦૦૦</u>

- નોન-કયુભ્યુલેટીવ પ્રે.શેર મૂડી (૫,૦૦,૦૦૦ + (શેરનું ડિવિડન્ડ))	<u>૬૦,૦૦૦</u>
+ (૨% વધારાનું ડિવિડન્ડ) ઈડિયટી શેરધારકોની ચોખી મિલકતો.	<u>૧૨૦૦૦</u>
	<u>૭૦૨૦૦૦</u>
	<u>૫,૭૮,૦૦૦</u>

ઇ. શેરની આંતરીક કિંમત = ચોખી મિલકતો = ૫૭૮૦૦૦ = ૮૨.૫૭ %
શેરની સંખ્યા ૭૦૦૦

૨) બજાર કિંમતની ગણતરી:

વર્ષ = ૨૦૧૭-૧૮નો સરેરાશ નશે	<u>૫૦૦૦૦૦</u>
- સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ (૫૦૦૦૦૦ × ૨૫ / ૧૦૦)	<u>૧૨૫૦૦૦</u>
- કયુ. પ્રે. શેર પર બે વર્ષનું ડિવિડન્ડ	<u>૧૦૦૦૦૦</u>
- નોન કયુભ્યુલેટીવ શેરનું ચાલુ વર્ષનું ડિવિડન્ડ	<u>૬૦૦૦૦</u>
- ઇ.શેર પર ૧૦%નું ડિવિડન્ડ	<u>૭૦,૦૦૦</u>
સરેરાશ નશે	<u>૧૧૫૦૦૦</u>
- નોન કયુ પ્રે.શેર ને ૨% વધારાનું ડિવિડન્ડ (૫૦૦૦૦૦ × ૨ / ૧૦૦)	<u>૧૨૦૦૦</u>
કુલ ચોખો નશે	<u>૧૦૩૦૦૦</u>

ડિવિડન્ડનો દર = કુલ ચોખો સરેરાશ નશે × ૧૦૦
ઇ.શેરમૂડી ભરપાયેલ થયેલ
= ૧૦૩૦૦૦ × ૧૦૦
૭૦૦૦૦૦
= ૧૪.૭૧ %

બજાર કિંમત = ડિવિડન્ડનો દર × શેરદિં ભરપાયેલ થયેલી રકમ
અપેક્ષિત વળતરનો દર
= ૧૪.૭૧ × ૧૦૦ = ૧૪૦૭ રૂ.
૧૫

3) ઈ.શેરની વ્યાજબી કિંમત = આંતરીક કિંમત + બજાર કિંમત

$$= \frac{12.47 + 68.07}{2} = \frac{81.54}{2} = ₹. 40.72$$

નોંધ: અહીં કયુભ્યુલેટીવ પ્રે.શેરદારકોને દેસેપ વર્ષ ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે. માટે ચાલુ વર્ષ તેમને પાછલાં વર્ષનું પણ ડિવિડન્ડ આપવામાં આવ્યું છે. જ્યારે નોન-કયુભ્યુલેટીવ પ્રેફરન્ડ શેરદારકોને આવો કોઈ અધિકાર નથી. માટે તેમને ફક્ત(ચાલુ વર્ષનું)આખું ડિવિડન્ડ આપવામાં આવ્યું છે, પરંતુ ઉપર આપેલ માહિતી મુજબ તેઓને સરેરાશ નફામાંથી 2% વધારે ડિવિડન્ડ આપવામાં આવ્યું છે.

ઉદા.૨૧ શયામ લી.નું પાકુ-સરવૈયું નીચે મુજબનું છે.

મૂડી-ટેવાં	₹.	મિલકત-લોળાં	₹.
અ પ્રકારના ઈ.શેર ₹.૧૦ નો એક (સંપૂર્ણ ભરાયેલ)	૫૦૦૦૦૦	પાધી	૭૫,૦૦૦
બ પ્રકારના ઈ.શેર ₹.૧૦ નો એક (૩.૫ ભરાયેલ)	૪૦૦૦૦૦	જમીન અને મકાન	૭,૦૦,૦૦૦
૧૦% પ્રે.શેરમૂડી ₹.૧૦૦નો એક શેર સા.અનામત	૨૦૦૦૦૦	યંત્રો	૮,૨૦,૦૦૦
નફા-નુકશાન ખાતું	૫૦૦૦૦	ફર્નિચર	૮૦,૦૦૦
૧૨%ના ડીબેન્ચરો	૩૦૦૦૦૦	૧૦%ના ડીબેન્ચરો(બિન- ધંધાકીય) કરપાત્ર (મૂળ કિંમત ઝ.૧,૦૦,૦૦૦)	૧,૨૦,૦૦૦
લેણાદારો	૫૦૦૦૦	સ્ટોક	૫૦,૦૦૦
લેણીહૂઠી	૪૦૦૦૦	દેવાદારો	
બેંક ઓવર ફ્રાફ્ટ	૨૫,૦૦૦	-ધા.અનામત ૧,૦૫,૦૦૦	૬૦,૦૦૦
ધસારો		રોકડ બેંક સિલક ૧૫,૦૦૦	૩૦,૦૦૦
જમીન અને મકાન ૭૦,૦૦૦			
યંત્રો	૬૦,૦૦૦		
ફર્નિચર	૨૦,૦૦૦		
	૧૬,૫૫,૦૦૦		૧૬,૫૫,૦૦૦

વધારાની માહિતી:

- 1) જમીન અને મકાનની કિંમતમાં ₹. ૧,૨૦,૦૦૦ વધારો કરવો.
- 2) યંત્રોની બજાર કિંમત ₹.૭,૦૦,૦૦૦ છે.
- 3) સ્ટોકની ચોપકે કિંમત બજાર કિંમત કરતાં ₹.૧૦,૦૦૦ ઓછી છે.
- 4) પાધીની કિંમત ₹.૧,૦૦,૦૦૦ ગાણવી.
- 5) છેલ્લા ગણ વર્ષનો ૫૦% કરબાદ પહેલાંનો કુલ નફો ₹.૧૨,૦૦,૦૦૦ છે.
- 6) અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.

જવાબ:

ઈ.શેર ધારકોની

* ચોખી મિલકતો

જમીન મકાન	૮,૨૦,૦૦૦
યંત્રો	૭,૦૦,૦૦૦
સ્ટોક	૬૦,૦૦૦
ફર્નિચર	૬૦,૦૦૦

પાધડી	1,00,000
બિન-ધંધાકીય રોકાણો	1,20,000
દેવાદારો	60,000
રોકડ બેંક	30,000
	<u>16,80,000</u>

દેવાં

૧૨%ના ડીબેનચર	3,60,000
લેણાદારો	50,000
લેણીહૂંડી	40,000
બેંક ઓવર ફ્રાફ્ટ	25000
	<u>4,25,000</u>

ચોખ્ખી મિલકતો	15,45,000
- પ્રે.શેરમૂડી	2,00,000
	<u>13,45,000</u>
+ નાણી ભરપાઈ થયેલ મૂડી	4,00,000
	<u>17,45,000</u>

$$2) \text{ આંતરીક કિંમત} = \frac{\text{ચોખ્ખી મિલકત}}{\text{કુલ ઈ.શેરની સંખ્યા}} \\ = \frac{17,45,000}{50,000}$$

$$\text{અ} = 26.25$$

$$\text{બ} = 26.25 - 4 = 24.25$$

* ઉપજ મૂલ્યની ગણતરી :

૧) છેદા ત્રણ વર્ષનો નશો	12,0,000
- (૫૦%) કરબાદ	5,00,000
	<u>5,00,000</u>

-બાદ બિન-ધંધાકીય રોકાણોનું વ્યાજ

$$(1,00,000 \times 10\%) = 10,000$$

કરપાત્ર - ૫૦૦૦	<u>4000</u>
	4,64,000

$$-પ્રેફ. શેર કીવીડન 20,000$$

$$\text{ઇ.શેરના કાળે આવતો નશો} = 5,75,000$$

$$\text{કિવિડનનો દર} = \frac{\text{ઇ.શેરનો નશો} \times 100}{\text{ભરાયેલી ઈ.મૂડી}} \\ = \frac{575000 \times 100}{14,00,000}$$

$$= 41.07 \%$$

$$\text{બજાર કિંમત} = \frac{\text{ડિવિડનનો દર} \times \text{શેર દીઠ થયેલ શેરની કિંમત}}{\text{અપેક્ષિત વળતરનો દર}}$$

$$\text{અ. શેર} = \frac{41.07 \times 10}{10}$$

$$= 3. 41.07$$

$$\text{બ. શેર} = \frac{41.07 \times 15}{10}$$

$$= 3.20.54$$

$$3) \text{ શેરની વ્યાજબી કિંમત} = \frac{\text{શેરની આંતરીક કિંમત} + \text{શેરની બજાર કિંમત}}{2}$$

$$\text{અ.} = \frac{26.25 + 41.07}{2} = 3. 46.76$$

$$\text{બ.} = \frac{24.25 + 20.54}{2} = 3. 24.52$$

૫.૬ સ્વાધ્યાય

૧) શેરનું મૂલ્યાંકન એટલે શું? શેર મૂલ્યાંકનને અલગ કરતાં પરીબળો જણાવો.

(ગુજ. ચુનિ. એપ્રીલ ૧૯૭૭, સૌ ચુનિ. ૨૦૦૫.)

૨) શેરની આંતરીક કિંમત, બજાર કિંમત અને વ્યાજબી કિંમત પર નોંધ લખો.

(ગુજ. ચુનિ. એપ્રીલ ૧૯૭૪, ગુજ. ચુનિ. ટી.વાય માર્ચ ૨૦૦૫)

૩) શેર મૂલ્યાંકન એટલે શું? શેરનું મૂલ્યાંકન કયાં સંજોગોમાં કરવું જરૂરી છે અને શા માટે?

(ગુજ. ચુનિ. ૧૯૭૮, એપ્રીલ ૧૯૭૪)

૪) શેરની આંતરીક કિંમત પર ટૂંકનોંધ લખો.

૫) શેરની કિંમતનું ઉપજથી પદ્ધતિએ મૂલ્યાંકન પર ટૂંકનોંધ લખો.

દા.૧ એક કંપનીની નીચેની માહિતી ઉપરથી પૂર્ણ ભરાયેલા ઈક્વિટી શેરનું આંતરીક મૂલ્ય અને બજાર મૂલ્ય શોધો.

	રૂ.
૧. પાદકારી ગણતરી માટે ચોખી મિલકતો	૨૨,૦૦,૦૦૦
૨. ૧૫%ની પ્રેફરન્સ શેર મૂડી	૪,૦૦,૦૦૦
૩. ઈક્વિટી શેર મૂડી(ભરપાઈ થયેલ)	૫,૫૦,૦૦૦
૪. ઈક્વિટી શેર મૂડી ઉપર બાકી હસા:	
૫,૦૦૦ ઈ.શેર ઉપર રૂ. ૨૫ લેખે	૧,૫૦,૦૦૦
૪,૦૦૦ ઈ.શેર ઉપર રૂ. ૫૦ લેખે	૨,૦૦,૦૦૦
૫. સામાન્ય અનામત	
૨,૫૦,૦૦૦/-	
૬. ૪૦% લેખે આવકયેશે ગણયાં પછીનો છેદા વર્ષનો નફો	૫,૪૦,૦૦૦
૭. છેદા ત્રણ વર્ષથી દર વર્ષથી દર વર્ષે રૂ.૫૦,૦૦૦ નફો વધે છે.	

૮. અપેક્ષિત વળતરનો દર ૧૨% ગણાય.

૯. બિન ધંધાકીય રોકાણો

૧,૨૦,૦૦૦/-

૧૦. પાદ્ધડીની કિંમત અધિક નફાથી ત્રણ ગણી ગણવાની છે.(ગુજ. યુનિ.ટી.વાચ, એપ્રીલ ૨૦૦૩)

દા.૨ ગુજરાત સ્ટીલ કંપની લિ.ના તા.૩૧ માર્ચ ૨૦૦૪ના પાકા સરવૈચામંથી નીચેના આંકડાઓ તારવલામાં આવ્યાં છે.

શેરમૂડી:

૮%ના પ્રેફરન્સ શેર દરેક રૂ.૧૦૦નો તેવા	રૂ. ૩,૦૦,૦૦૦
૧૦,૦૦૦ ડાઇલિટી શેર દરેક રૂ.૧૦નો તેવા	૫૦,૦૦૦
રૂ. ૫ ભરપાઈ થયેલ	૫૦,૦૦૦
૧૦,૦૦૦ ડાઇલિટી શેર દરેક રૂ.૧૦નો તેવા	૨૫,૦૦૦
રૂ. ૨.૫૦ ભરપાઈ થયેલ	૨૫,૦૦૦
૧૦,૦૦૦ ડાઇલિટી શેર દરેક રૂ.૧૦નો તેવા	૧,૦૦,૦૦૦
પૂર્ણ ભરપાઈ થયેલ	૪,૭૫,૦૦૦

અનામત અને વધારો:

સા.અનામત	રૂ. ૨,૦૦,૦૦૦
નફાનુકશાન ખાતું	૫૦,૦૦૦
	૪,૨૫,૦૦૦

અન્ય માહિતી:

- તા.૩૧મી માર્ચ, ૨૦૦૪ના રોજ મિલકતોના પુનઃમૂલ્યાંકન કરતાં જાણવા મળ્યું કે તેમનું મૂલ્ય એકંદરે રૂ. ૭૫,૦૦૦ વધુ આંકવામાં આવ્યું હતું.
- કંપનીના આઠિકલ્સ ઓફ એસોસિએશનમાં એવી જોગવાઈ છે કે કંપનીના વિસર્જન વખતે જો કોઈ વધારો રહે તો પ્રેફરન્સ શેર હોલ્ડરો વધારાના ૧૦% મેળવયા દાવો કરી શકશે. તમારે પ્રેફરન્સ શેર તેમજ ડાઇલિટી શેરની આંતરીક કિંમત શોધવાની છે.

(દ.ગુ. યુનિ., ટી.વાચ., માર્ચ ૨૦૦૪)

દા.૩ દી રીલાયન્સ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડનું પાકું સરવૈચું નીચે આપેલ છે.

મૂડી-ટેવાં	રૂ	મિલકત-લોણાં	રૂ
દરેક રૂ.૨૫૦ નો તેવા પૂરૈપૂરા ભરપાઈ થયેલા રૂ.૮૦૦ શેર અનામત બંડોળ કાર્બિગરોના બચત ખાતે પ્રોવિડન્ડ ફંડ ખાતે ઘસારા બંડોળ ખાતે નફાનુકશાન ખાતું લેણાદારો	૨૨,૦૦,૦૦૦ ૮,૨૪,૦૦૦ ૨,૨૭,૦૦૦ ૫૪,૦૦૦ ૪,૬૩,૦૦૦ ૩૮,૮૬,૦૦૦ ૩૬,૧૨,૦૦૦	જમીન(મૂળ કિંમતે) મકાન(મૂળ કિંમતે) ચંત્રો (મૂળ કિંમતે) ફર્નિચર વગેરે (મૂળ કિંમતે) દ્વાદામાં સ્ટોક(બજાર કિંમતે) કિલેચર ખર્ચ દેવાદારો રોકાણો(બજાર કિંમત) રોકડ અને બીજુ બાકીઓ	૨,૨૧,૦૦૦ ૧૧,૭૩,૦૦૦ ૨૦,૫૮,૦૦૦ ૫,૦૦૦ ૨૫,૦૦,૦૦૦ ૨૫,૦૦૦ ૩,૩૫,૦૦૦ ૧૭,૦૦,૦૦૦ ૩૧,૪૮,૦૦૦

૧,૧૨,૬૬,૦૦૦

૧,૧૨,૬૬,૦૦૦

ખરેખર ઘસારા કરતાં ઘસારા ફંડની રકમ રૂ.૫૪,૦૦૦ વધુ છે. શેરની આંતરીક કિંમત શોધી કાઢો.

(સૌ. ચુણિ., એસ.વાય માર્ચ ૧૯૮૮)

દા.૪ રાજન લિ.નું તા. ૩૧/૦૩/૨૦૦૪ના રોજગારનું પાકું સરવૈચું નીચે મુજબ છે. તે તથા અન્ય માહિતી પરથી પાદારીનું મૂલ્યાંકન કરી શેરની આંતરીક કિંમત શોધો.

મૂડી-દેવાં	રૂ	મિલકત-લેણાં	રૂ
૬%ના પ્રેફરન્સ શેર દરેક		પાદારી	૮૧,૦૦૦
રૂ.૧૦૦ પૂરા ભરાયેલા	૫,૦૦,૦૦૦	જમીન-મકાન	૧૨,૬૬,૦૦૦
ઈક્સ્પીટી શેર દરેક		સ્ટોક	૨,૦૬,૦૦૦
રૂ.૧૦૦ પૂરા ભરાયેલા	૭,૦૦,૦૦૦	દેવાદારો	૧,૦૦,૦૦૦
રૂ.૧૦૦ શેર દીઠ		રોકડ સિલક	૫૦,૦૦૦
રૂ.૫૦ ભરાયેલા	૧,૫૦,૦૦૦	બેન્ક સિલક	૩,૦૦,૦૦૦
૫%ના ડિબેન્ચર્સ	૧,૦૦,૦૦૦	૧૦%ની સરકારી જામીનગારી	૧,૦૦,૦૦૦
લેણદારો	૫૦,૧૦૦	પ્રાથમિક ખર્ચ	૮૪,૦૦૦
કરવેરાની જોગવાઈ	૩,૦૦,૦૦૦		
સા.અનામત	૩,૫૪,૬૦૦		
પ્રેફ.સૂચિત ડિવિડન	૪૫,૦૦૦		
	૨૨,૦૦,૦૦૦		૨૨,૦૦,૦૦૦

- ૧) જમીન-મકાનની કિંમત રૂ.૧૫,૦૦,૦૦૦ અને બાકીની મિલકતોની ચોપડા કિંમત ગણાવી.
- ૨) છેલ્ણાં ચાર વર્ષની કંપનીનો કરવેરા પહેલાંનો નશો દર વર્ષે રૂ.૧,૨૦,૦૦૦ જોટલો વધે છે.
- ૩) ૨૦૦૩-૨૦૦૪ સુધીની આવકવેરાની આકારણી પૂરી થયેલી છે. તે અંગે કઇ જવાબદારી નથી. કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષે નફાના ૫૦% લેખે કરવામાં આવી છે.
- ૪) પાદારીનું મૂલ્યાંકન અધિક નફાથી બે વર્ષની ખરીદી જેટલી કરવી.
- ૫) ૫૦% ડીવીડન આપતાં શેરની બજાર કિંમત તેની ભરપાઈ થયેલી રકમ કરતાં ત્રણ ગણી છે.

(દ.શુણિ., એસ.વાય એપ્રિલ ૨૦૦૬)

દા.૫ સોનલ લિમિટેડનું તા. ૩૧/૦૩/૧૯૮૭ના રોજગારનું પાકું સરવૈચું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ	મિલકત-લેણાં	રૂ
ઈક્સ્પીટી શેર મૂડી દરેક રૂ.૧૦નો ઓક એપો (રૂ.૮ ભરપાઈ)	૪,૮૦,૦૦૦	પાદારી	૩૫,૦૦૦
૧૨% પ્રેફરન્સ શેર મૂડી	૪,૦૦,૦૦૦	મકાન	૪,૮૦,૦૦૦
સામાજય અનામત	૪,૬૨,૦૦૦	યંત્રો	૪,૯૦,૦૦૦
નશો નુકશાન ખાતું	૧,૭૦,૦૦૦	રોકાણો:ગૌણ કંપની શેર	૬૦,૦૦૦
૧૨%ના ડિબેન્ચરો	૩,૦૦,૦૦૦	રચના લિ.ના ડિબેન્ચરો (૧૨% ના દાશનીક કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ વ્યાજ કરપાત્ર છે.)	
લેણદારો	૨,૮૦,૦૦૦	સ્ટોક	૧,૮૦,૦૦૦
દેલીહુંકીઓ	૧૦,૦૦૦	દેવદારો	૪,૫૦,૦૦૦
પ્રોવિડન ફંડ	૪૮,૦૦૦	-ધા.અનામત	૪૦,૦૦૦
ચૂકુલયાના બાકી	૭,૦૦૦	લેણી હુંકીઓ	૩૦,૦૦૦
ઘસારા ફંડ:		રોકડ/બેન્ક	૪૦,૦૦૦
યંત્રો	૧૦,૦૦૦		૪૮,૦૦૦

મકાન	<u>30,000</u>	૪૦,૦૦૦	અગાઉથી ચૂક્યેલ ખર્ચ જાહેરાત ઉપલક ખાતું	૧૮,૦૦૦
		<u>૨૨,૨૮,૦૦૦</u>		૪૭,૦૦૦

વધારાની માહિતી:

- ૧) માનવની હાલની કિંમત રૂ.૫,૦૦,૦૦૦ છે, જ્યારે બાકીની ભિલકતો ચોપડે કિંમતો દર્શાવાની છે.
૨) અપેક્ષિત વળતરણો એ ૧૨% છે.
૩) ૫૦% લેખે કરવેરા જોગવાઈ કર્યા પહેલાનો પાછલા ત્રણ વર્ષનો નફો નીચે મુજબ છે:

તા.3૧/૦૩/૧૯૬૭નો નિક્ષે

તા.3૧/૦૩/૧૯૯૫નો નષ્ટી

તા.૩૧/૦૩/૧૯૮૫નો જરૂરી

ઉપરની વિગતો પરથી છેક્ષાં ત્રણ વર્ષના ભારિત સરેરાશ નજ્ઞાને આધારે કંપનીના અધિક નજ્ઞાની પાંચ વર્ષની ખરીદીને આધારે પાદ્ધઠીની કિંમત ગણો અને ઇન્ડિયટી શેર(અંશત)ની આંતરીક કિંમત શોધો.

(ઓ.ગુ.યુ., ટી.વાય., એપ્રિલ ૧૯૯૮)

દા.૫ એક કંપનીની શેર મુક્કી નીચે મુજબ છે.

૮,૦૦૦ 'બ' ઇક્વિટી શેર દરેક રૂ.૧૦૦નો શેર દીઠું. ૭૦ ભરપાઈ રૂ.૫૦,૦૦૦

૮,૦૦૦ 'ક' ઇક્વિટી શેર દરેક રૂ.૧૦૦નો શેર દીઠું રૂ.૫૦ ભરપાઈ ૪,૮૦,૦૦૦

= વસત આવેલી ફુલ મુડી

સામાજિક અવામત 9,20,000

લેણદરો ૪,૪૦,૦૦૦

30,00,00

કંપનીનો કર બાધનો સરેરાશ નફો રૂ.૨,૭૮,૨૦૦ અંડાજેલ છે. આ પ્રકારાના ધ્યામાં અપેક્ષિત વળતરનો દર ૧૦% છે. ઉપરની વિગત પરથી ૧) ચોખ્ખી ભિલકતની પક્ષતિએ અને (૨)ઉપજના ધોરણે શેરણું મૂલ્યાંકન કરો. (દ.ગુ. ચુનિ., એસ.વાય., એપ્રિલ, ૨૦૦૭)

(દ.ગ્ર. યુનિ., એસ.વાય., એપ્રિલ, ૨૦૦૭)

૮.૭ દે કંપનીઓ ‘અ’ અને ‘દ્ય’ શેર મૂડીની રૂચના(ગોઠવાણી) સિવાયની બધી જ બાબતો ઉપરાંત મિલકતો, જવાબદારી અને અનામતો બાબતમાં ચોકકસ રીતે એકસરખી હોવાનું અનુમાન કરવામાં આવેલ છે. દરેક કંપનીની શેર મૂડી રૂ.૧,૧૦,૦૦૦ જે રૂ.૫૦નો એક એવા પૂરા ભરપાઈ થયેલ શેરની બળેલી છે. જે નીચે મજબુત છે.

‘अ’	₹.	‘इ’	₹.
२,००० ८% प्रेफ. शेर्स	१,००,०००	२०० ८% प्रेफ. शेर्स	१०,०००
२०० इक्विटी शेर्स	१०,०००	२,००० इक्विटी शेर्स	१,००,०००

આ કંપનીઓની ઇક્વિટી ઉપર ૧૦% સામાન્ય વળતરની અપેક્ષા રાખવામાં આવે છે.

આ કંપનીઓનો નક્કો અને વહેંચાણી નીચે મજબ છે.

ਛੇਲਾਂ ਪੰਜ 3,20,000

આલ વર્ષ 3.E.400

બત્રે કંપનીઓની આપેલાં વર્ષો માટેની ધક્કિયી શેરની બજાર કિંમત નક્કી કરો અને શેરની કિંમત અંગે ટીકાતમુક ચર્ચા કરો. ઉપર આપેલ વિગતો દ્વારાનાં લો. પરંતુ અન્ય બાબતો અવગાયો.

(દ.ગૃ. યુનિ., ટી.વાય., એપ્રિલ, ૧૯૬૪)

દા.૮ પ્રિયંકા લિમિટેડનું તા.૩૧/૦૩/૨૦૦૪ના રોજનું પાંકું સરવૈચું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ભરાયેલ મૂડી:		કાચમી મિલકતો	૧૦,૦૦૦૦
‘અ’ ઇ.શોરો દરેક રૂ.૧૦૦નો પૂરા ભરાયેલ	૫,૦૦,૦૦૦	ચાલુ મિલકતો (રૂ.૧,૦૦,૦૦૦ની બેન્ક સિલક)	૫,૦૦,૦૦૦
‘બ’ ઇ.શોરો દરેક રૂ.૧૦૦નો રૂ. જ્પ લેખે ભરાયેલ	૩,૦૦,૦૦૦		
સા.અનામત	૪,૦૦,૦૦૦		
લેણાદારો	૩,૦૦,૦૦૦		
	૧૫,૦૦,૦૦૦		૧૫,૦૦,૦૦૦

વધારાની માહિતી:

કંપનીની બધી જ મિલકતોની બજાર કિંમત ૨૦% વધુ છે.

કંપનીનો ઉપરાંત લેખેના કરવેરા પદ્ધીનો સરેરાશ નફો રૂ.૧,૮૦,૦૦૦ છે જ્યારે અપેક્ષિત વળતરનો દર ૧૦% ગણવો. બંને પ્રકારના શેરોની આંતરીક મૂલ્યની પહૃતિએ તેમજ ઉપજના ધોરણે કિંમત શોધો.

(ગુ. ચુનિ., ટી.વાય., માર્ચ ૨૦૦૪)

દા.૯ એક કંપનીનું પાંકું સરવૈચું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ઇડિયટી શેરમૂડી દરેક રૂ.૧૦૦નો ટેવા	૨,૦૦,૦૦૦	સ્થિર મિલકતો	૨,૫૦,૦૦૦
૮% ની પ્રેફ. શેરમૂડી	૧,૦૦,૦૦૦	ચાલુ મિલકતો	૧,૦૦,૦૦૦
લેણાદારો	૨૫,૦૦૦		
દેવીહૂંડી	૨૫,૦૦૦		
	૩,૫૦,૦૦૦		૩,૫૦,૦૦૦

વધારાની માહિતી:

સ્થિર મિલકતોની બજાર કિંમત ૧૦% વધુ અને ચાલુ મિલકતોની બજાર કિંમત ૫% ઓછી છે.

છેલ્ખાં પાંચ વર્ષનો સરેરાશ નફો રૂ.૪૨,૦૦૦ છે. અપેક્ષિત વળતરનો દર ૧૦% છે. પાદડીનું મૂલ્યાંકન ત્રણ વર્ષના અધિક નફાની ખરીદીને આધારે કરો અને ઇડિયટી શેરની આંતરીક તેમજ ઉપજની પદ્ધતિથી કિંમત શોધો.

(સૌ. ચુનિ., એફ.વાય., એપ્રિલ ૧૯૯૯)

દા.૧૦ (અ) નીચેની માહિતી પરથી શેરની બજાર કિંમત શોધો:

	રૂ.
(૧) ૧૦,૦૦૦ ઓર્ડરનરી શેર રૂ. ૧૦નો એક એવા શેર દીઠ રૂ. ૮ લેખે ભરપાદ મૂડી	૮૦,૦૦૦
(૨) સરેરાશ વાર્ષિક નફો	૧૬,૦૦૦
(૩) કરવેરા જોગવાદ	૨,૦૦૦
(૪) અપેક્ષિત વળતર દર	૧૨%

(બ) મધુ લિ.ના તા. ૩૧/૦૩/૨૦૦૭ના રોજના નીચેના પામા સરવૈયા પરથી તેના ઇક્વિટી શેરનું આંતરીક મૂલ્ય શોધો.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ઇક્વિટી શેરમૂડી દરેક રૂ.૧૦૦નો તેવા શેર	૨,૦૦,૦૦૦	જમીન અને મકાન	૨,૦૦,૦૦૦
સા.અનાભત	૧,૦૦,૦૦૦	ફર્નિચર	૨૦,૦૦૦
નફા નુકશાન ખાતું	૧,૦૦,૦૦૦	થંત્રો	૧,૨૦,૦૦૦
લેણાદારો	૮૦,૦૦૦	સ્ટોક	૮૦,૦૦૦
બેન્ક ઓવરફ્રાફ્ટ	૨૦,૦૦૦	દેવાદારો	૨૦,૦૦૦
	૫,૦૦,૦૦૦	રોકડ	૨૦,૦૦૦
		પ્રાથમિક ખર્ચ	૨૫,૦૦૦
		ડિબેન્ચર પટાવ	૧૫,૦૦૦
	૫,૦૦,૦૦૦		૫,૦૦,૦૦૦

વધારાની માહિતી:

તા.૩૧/૦૩/૨૦૦૭ના રોજ જમીન અને મકાનનું પુનઃમૂલ્યાંકન રૂ.૩,૦૦,૦૦૦ અને પાદડીની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ કરેલ છે.
(સૌ. ચુનિ., એફ.વાય., એપ્રિલ ૧૯૯૫)

દા.૧૧ સ્માર્ટ લિમિટેડનું તા.૩૧/૧૨/૨૦૦૩ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ઇક્વિટી શેરમૂડી (રૂ.૧૦૦)	૫,૦૦,૦૦૦	જમીન અને મકાન	૩,૨૦,૦૦૦
૧૦%ની પ્રેફ. શેરમૂડી	૨,૦૦,૦૦૦	મશીનરી	૩,૩૦,૦૦૦
અનાભત અને વધારો	૪,૮૦,૦૦૦	મોટર કાર	૧,૦૦,૦૦૦
કારીગર નફાભાગ ભંડોળ	૫૦,૦૦૦	ફર્નિચર	૮૦,૦૦૦
લેણાદારો	૮૦,૦૦૦	૧૦%ના રોકાણો	૨,૦૦,૦૦૦
પ્રોવિડન્ડ ફંડ	૭૦,૦૦૦	સ્ટોક	૧,૫૦,૦૦૦
બેન્ક ઓવરફ્રાફ્ટ	૧,૦૦,૦૦૦	દેવાદારો	૧,૫૦,૦૦૦
ઘસારા ફંડ:		રોકડ-બેન્ક	૧,૬૦,૦૦૦
જમીન અને મકાન	૨૦,૦૦૦	પ્રાથમિક ખર્ચ	૧૦,૦૦૦
મશીનરી	૩૦,૦૦૦		
	૫૦,૦૦૦		
	૧૫,૪૦,૦૦૦		૧૫,૪૦,૦૦૦

વધારાની માહિતી:

- ૧) જમીન-મકાન અને મશીનરી બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ આંકવાની છે.
- ૨) ૧૦%ના રોકાણો પૈકી ૫૦% ધંધાકીય રોકાણો છે. બાકીનાં બિનધંધાકીય છે, જેમાં દર વર્ષે ૧લી જુલાઈએ રૂ.૨૦,૦૦૦નો વધારો થતો આવ્યો છે. બિનધંધાકીય રોકાણોની કિંમત વીસ ટકા વધુ આંકવાની છે.
- ૩) જમીન-મકાન અને મશીનરીની વધેલી કિંમત પર પાદડી અને શેર મૂલ્યાંકનના હેતુ માટે ઘસારો ધ્યાનમાં લેવાતો નથી.
- ૪) છેદાં ૪ વર્ષનો ૫૦% કરવેરા બાદ નફો નીચે મુજબ છે.

વર્ષ	નફો (રૂ.)
૨૦૦૦	૧,૧૧,૫૦૦

૨૦૦૧	૧,૪૬,૦૦૦
૨૦૦૨	૧,૫૨,૧૫૦
૨૦૦૩	૧,૭૩,૨૮૫

- ૫) રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.
- ૬) ૨૦૦૧માં વર્ષની શરુઆતમાં એક મશીનરી(ચોપડા કિંમત રૂ ૩૦,૦૦૦)જેને રૂ.૩૦,૦૦૦માં વેચવામાં આવી હતી. આ ભૂલ હજુ સુધી સુધારવામાં આવી નથી. ધસારો ૧૦% વાસ્તિક ઘટતી જતી બાકીની રીતે ગણેલ છે.
- ૭) અધિક નફાની ત્રણ ગણી પાદડી ગણવાની છે. ઈડિયટી શેરનું વ્યાજબી મૂલ્ય શોધો.

(દ.ગુ.યુનિ.,એસ.વાય.,એપ્રિલ ૨૦૦૪)

દા.૧૨ અયોધ્યા લિમિટેડનું પાંચ સરવૈયું તા.૩૧/૦૩/૨૦૦૪ના રોજ નીચે મુજબ છે:

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
૫૦૦૦ ઈડિયટી શેર દરેક		પાદડી	૧,૨૫,૦૦૦
રૂ.૧૦૦, શેરદીઠ રૂ.૫૦ ભરપાઈ	૨,૫૦,૦૦૦	જમીન અને મકાન	૩,૭૫,૦૦૦
૩૦,૦૦૦ ઈડિયટી શેર દરેક	૩,૦૦,૦૦૦	થંત્રો	૩,૫૦,૦૦૦
રૂ.૧૦નો		રોકાણો:	
૧૦%ની પ્રેફ મૂડી	૨,૦૦,૦૦૦	ગૌણ કંપનીના શેર રૂ.૫,૦૦૦	૧,૪૦,૦૦૦
અનામત અને વધારો	૧૬૦૦૦૦	૧૨% નાં પ્રો.ફંડનાં રોકાણો	૧૫,૦૦૦
૧૦%નાં ડીનેન્યર્સ	૧,૨૫,૦૦૦	૧૦%ના સરકારી બોન્ડ	૫૦,૦૦૦
લેણાદારો	૪૮,૦૦૦	દેવાદારો	૭૫,૦૦૦
પ્રો. ફંડ	૧૫,૦૦૦	-ધા.અનામત	૩,૦૦૦
ધસારા ફંડ:		સ્ટોક	૮૮,૫૦૦
જમીન અને મકાન રૂ.૫૦૦		રોકડ સિલક	૩૦,૦૦૦
મશીનરી	૫૨,૫૦૦	પ્રાથમિક ખર્ચ	૨૮,૫૦૦
કામદાર અકસ્માત વળ. ફંડ	૧૦૦૦		
	૧૨,૨૦,૦૦૦		૧૨,૨૦,૦૦૦

વધારાની માહિતી:

- જમીન-મકાનની હાલની બજાર કિંમત રૂ. રૂ. ૪,૫૦,૦૦૦ છે.
- ગૌણ કંપનીના શેર પર રૂ. ૭,૫૦૦ ડિવિડન મળ્યું.
- અયોધ્યા લિ. નો છેકાં ત્રણ વર્ષનો ૫૦% કર બાદ સરેરાશ નશે રૂ. ૧,૧૨,૦૦૦ છે.
- રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.
- પાદડીની કિંમત તેના અધિક નફાના બે વર્ષની ખરીદી જેટલી ગણવાની છે.
ઉપરની વિગતો પરથી ઈડિયટી શેરની આંતરીક કિંમત તેમજ બજાર કિંમત શોધો.

(દ.ગુ.યુનિ.,એસ.વાય.,એપ્રિલ ૨૦૦૪)

દા. ૩૧/૦૩/૨૦૦૪ના રોજનું લંબોટીયા કંપની લિ.નું પાંચ સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ઈડિયટી શેરમૂડી દરેક રૂ.૧૦૦ના		જમીન અને મકાન	૨૦,૦૦૦૦
પૂરા ભરપાઈ શેર	૫૦,૦૦,૦૦૦	પ્લાન્ટ મશીનરી	૩૦,૦૦,૦૦૦
રૂ.૧૦૦ના શેર	૧૦,૦૦,૦૦૦	ફર્નિચર	૨,૦૦,૦૦૦

સા.અનામત	૪,૦૦,૦૦૦	સ્ટોક	૧૦,૦૦,૦૦૦
નફા-નુકશાન ખાતુ	૨,૦૦,૦૦૦	દેવાદારો	૮,૦૦,૦૦૦
૧૫%ના ડિબેન્ચર	૫,૦૦,૦૦૦	લેણદારો	૫,૦૦,૦૦૦
લેણદારો	૭,૦૦,૦૦૦	રોકડ અને બેન્ક સિલક	૪,૦૦,૦૦૦
દેવી હૂડીઓ	૨,૦૦,૦૦૦	પ્રાથમિક ખર્ચ	૧,૦૦,૦૦૦
	૮૦,૦૦,૦૦૦		૮૦,૦૦,૦૦૦

વધારાની માહિતી:

- ૧) જમીન અને મકાનની કિંમત ૨૫% અને સ્ટોકની કિંમતમાં ૨૦% વધારો કરવો.
- ૨) પ્લાન્ટ અને મશીનરીની બજારકિંમત રૂ.૨૮,૦૦,૦૦૦ છે.
- ૩) કંપનીનો સરેરાશ વાર્ષિક નફો. ૫૦% લેખે કરયેરા પહેલાંનો રૂ.૩૨,૦૦,૦૦૦ છે.
- ૪) આ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર વળતરનો દર ૧૫% છે.
- ૫) કંપનીની પાધડીની કિંમત તેના અધિક નફાના બે વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. ઉપરની વિગત પરથી ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત શોધો. (સૌ. ચુનિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૫)

દા.૧૪ જાસ્તીન લિ.નું તા. ૩૧/૦૩/૨૦૦૭ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ	મિલકત-લેણાં	રૂ
દરેક રૂ.૧૦ના તેવાં ઈ.શેર	૨૦,૦૦,૦૦૦	જમીન-મકાન	૫,૦૦,૦૦૦
સા.અનામત	૧૦,૦૦,૦૦૦	પ્લાન્ટ-ચંત્રો	૨૦,૦૦,૦૦૦
૧૨%ના ડિબેન્ચરો	૫,૦૦,૦૦૦	ફર્નિચર	૨,૦૦,૦૦૦
લેણદારો	૫,૦૦,૦૦૦	સ્ટોક	૮,૦૦,૦૦૦
		દેવાદારો	૨,૦૦,૦૦૦
		બેન્ક સિલક	૩,૦૦,૦૦૦
	૪૦,૦૦,૦૦૦		૪૦,૦૦,૦૦૦

વધારાની માહિતી:

- ૧) કંપનીની મિલકતોની વર્તમાન કિંમત બે ગણી ગણવી.
- ૨) કંપનીની પાધડીનું મૂલ્ય છેદાં ત્રણ વર્ષના સરેરાશ અધિક નફાથી બે ગણું આંકડું.
- ૩) કંપનીનો છેદાં ત્રણ વર્ષનો નફો અનુક્રમે રૂ.૧૨,૦૦,૦૦૦, રૂ.૧૨,૦૦,૦૦૦ અને રૂ.૧૨,૦૦,૦૦૦ હતો.
- ૪) કંપનીના ધંધાનો અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.
- ૫) છેદાં ત્રણ વર્ષથી કંપની દર ૧૦% રૂપે કમાયેલ નફા પૈકી ૨૫% રકમ સા.અનામત ખાતે લઈ જાય છે અને બાકીની રકમ શેર હોલ્ડરોને ડિવિડન તરીકે વહેંચે છે.
ઉપરની માહિતીના આધારે કંપનીના શેરોનું ૧) આંતરીક મૂલ્ય ૨) સરેરાશ ઉપજના ઘોરણે મૂલ્ય અને ૩)વ્યાજબી મૂલ્ય શોધો. (ગુ.ચુનિ., ટી.વાય., એપ્રિલ ૧૯૯૩)

દા.૧૫ હરિઓભ કંપની લિ.નું તા. ૩૧/૦૩/૨૦૦૨ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ	મિલકત-લેણાં	રૂ
૧૦%ના પ્રેફરન્સ શેર	૫,૦૦,૦૦૦	પાધડી	૨,૫૦,૦૦૦
‘અ’ ઇક્વિટી શેર ૧૦,૦૦૦		જમીન-મકાન	૭,૫૦,૦૦૦
		ચંત્રો	૭,૦૦,૦૦૦

દરેક રૂ.૧૦૦ નો શેરટીઓ રૂ.૪૦		રોકાણો:	
ભરપાઈ	૪,૦૦,૦૦૦	ગૌણા કંપનીના શેર	૧,૫૦,૦૦૦
'બ' ઇક્વિટી શેર દરેક રૂ.૧૦નો	૬,૦૦,૦૦૦	૧૨%ના પ્રો.ફંડના રોકાણો	૩૦,૦૦૦
પૂર્ણ ભરપાઈ	૩,૬૨,૦૦૦	૧૦%ની સરકારી જામીનગીરી	
અનામત અને વધારો	૨,૫૦,૦૦૦	(દા.કી ૧,૦૦,૦૦૦)	૬૦,૦૦૦
૧૦%ના ડિલેન્ચર	૧,૩૫,૦૦૦	દેવાદારો ૧,૬૦,૦૦૦	
ચાલુ જવાબદારી		-દા.અનામત ૧૦,૦૦૦	૧,૫૦,૦૦૦
ધસારા ફંડ:		સ્ટોક	૨,૦૦,૦૦૦
જામીન-મકાન ૭૫,૦૦૦		રોકડ નફો	૬૦,૦૦૦
યંત્રો ૧,૦૫,૦૦૦	૧,૮૦,૦૦૦	જાહેરાત ઉપલક નફો	૪૭,૦૦૦
	૨૪,૨૭,૦૦૦		૨૪,૨૭,૦૦૦

વધારાની માહિતી:

- જામીન-મકાનની બજાર કિંમત તેની ચોપકે કિંમત કરતાં વધુ ૨૦% વધુ છે.
- ગૌણા કંપનીના શેર રૂ.૨૫,૦૦૦ ડિવિડન મળ્યું છે.
- છેદાં ૪ વર્ષનો નફો નીચે મુજબ છે, જે ૫૦% કરવેશાને આધીન છે.

૧૯૯૮-૧૯૯૯	૪,૦૦,૦૦૦
૧૯૯૯-૨૦૦૦	૪,૫૦,૦૦૦
૨૦૦૦-૨૦૦૧	૬,૦૦,૦૦૦
૨૦૦૧-૨૦૦૨	૬,૫૦,૦૦૦

- અપેક્ષિત વળતરનો દર ૧૫% છે.
 - પાદારી અધિક નફાથી ત્રણ ગણી ગણવાની છે.
 - કંપનીની પ્રણાલીકા છે કે કરબાદ નફાના ૨૦% સામાન્ય અનામત ખાતે લઈ જાય છે.
- ઉપરની વિગતો પરથી કંપનીના ઇક્વિટી શેરોની આંતરીક કિંમત અને બજાર કિંમત શોધો.

(દ.ગુ.ચુણિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૨)

દા.૧૬ ગજાનન કંપની લિ.નું તા. ૩૧/૧૨/૧૯૯૭ના રોજનું પારું સરવૈનું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
શેર મૂડી:		કાયમી મિલકતો	૨,૫૦,૦૦૦
ઇક્વિટી શેર દરેક રૂ. ૧૦ નો		રોકાણો:	
૧,૨૦,૦૦૦ બાદ: બાકી હસા		૧૨%ના ડિલેન્ચર	
છેદા હસાના રૂ. ૩ લેખે ૩,૦૦૦	૧,૧૭,૦૦૦	પરતનિધી રોકાણો	૨૦,૦૦૦
૧૦ ટકાની પ્રે.શેરમૂડી	૮૦,૦૦૦	૧૦%ની સરકારી જામીનગીરી	
અનામત અને વધારો:		(બજારકિંમત રૂ.૧૨,૦૦૦)	૧૦,૦૦૦
નફા નુકશાન ખાતુ	૩૦,૦૦૦	ચાલુ મિલકતો:	
ડિલેન્ચર પરત નિધી	૨૦,૦૦૦	સ્ટોક	૩૨,૦૦૦
તારણ વાળી લોન:		દેવાદારો	૩૦,૦૦૦
૧૨%ના ડિલેન્ચર્સ	૩૦,૦૦૦	રોકડ બેન્ક	૧૦,૦૦૦

<u>ચાતુ ટેવાં જોગવાઈઓ:</u>		કિનેન્યર વટાવ	
લેણાદરો	32,000		1,000
કરવેરાની જોગવાઈ	30,000		
	3,43,000		3,43,000

વધારાની માહિતી:

૧. કાથમી મિલકતોની હાલની બજારક્રિમત 3.૨,૮૦,૦૦૦ છે.
૨. ૫૦% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પછીનો છેદાં ત્રણ વર્ષનો નશો નીચે મુજબ છે.

વર્ષ	નશો
૧૯૯૧	૩૮,૩૫૦
૧૯૯૨	૪૫,૦૦૦
૧૯૯૩	૪૭,૧૦૦

૩. આ જાતના ધ્યાભાં રોકાએલી મૂડી પર સામાન્ય અપેક્ષિત વળતરનો દર ૧૫% ગણાય છે.
૪. સને ૧૯૯૨ની શરૂઆતમાં એક થંત્ર(ચોપડે કિમત રૂ.૧૧૦,૦૦૦) રૂ.૮૦૦૦માં વેચવામાં આવે આવેલ. થંત્ર વેચાણની ઉપજ ભૂલથી નશા-નુકશાન ખાતે જમા કરવામાં આવેલ. આ ભૂલ અત્યાર સુધી સુધી રવામાં આવી નથી. થંત્રો પર વાર્ષિક ૧૦% લેખે ઘટતી જતી બાકીની રીતે ધસારો ગણવામાં આવે છે.
૫. પાદડી અને શેરના મૂલ્યાંકન માટે કાથમી મિલકતો ની કિમતમાં થયેલ વધારા પર ધસારો ધ્યાને લેવામાં આવતો નથી.
૬. પાદડી વર્ષના ભારીત સરેરાશ નશાના આધારે કંપનીના અધિક નશાની ચાર વર્ષની ખરીદીને આધારે તમારે કંપનીની પાદડીની કિમત ગણવાની છે.
ઉપરની વિગત પરથી, દરેક અંશાં: વસૂલ અને સંપૂર્ણ વસૂલ ઈક્વિટી શેરની આંતરીક કિમત અને બજાર કિમત શોધો.

(ગુ.યુનિ., ટી.વાય., એપ્રિલ ૧૯૯૪)

દા.૧૭ દ્વારા લિમિટેડની નીચે આપેલી માહિતીને આધારે તેના ઈક્વિટી શેરની વ્યાજબી કિમત શોધો.

૧. ચોખ્જી મિલકતો રૂ.૨,૫૦,૦૦૦
૨. ૫૦% લેખે કરવેરા બાદ કર્યા પહેલાંનો સરેરાશ નશો રૂ.૧૪૦૦૦૦
૩. ઉપરોક્ત સરેરાશ નશાભાં બિન-વેપારી રોકાએલો ઉપર મળેલ રૂ૨૦,૦૦૦ના વ્યાજનો સમાવેશ થાય છે.
૪. અંદાજુ વળતરનો સામાન્ય દર ૨૦%
૫. કંપનીની ઈક્વિટી શેર મૂડી તેની ૧૦% ની પ્રેફરન્સ શેરમૂડી કરતાં બમણી છે.
૬. ઈક્વિટી શેરની દાર્શનિક કિમત રૂ. ૧૦
૭. ઈક્વિટી શેરની આંતરીક કિમત રૂ. ૧૨.૫૦

(ગુ.યુનિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૭)

દા.૧૮ નીચે આપેલ માહિતી ઉપરથી ફાલ્ગુની લિમિટેડના ઈક્વિટી શેરની વ્યાજબી કિમતની ગણતરી કરો.

૧. ભરાયેલ ઈક્વિટી શેર મૂડી(રૂ. ૧૦૦નો શેર) ૩. ૬,૦૦,૦૦૦
૨. ચોખ્જી મિલકતો ૩.૮,૦૦,૦૦૦
૩. ૪૦% લેખે કરવેરા પહેલાંનો વાર્ષિક સરેરાશ નશો ૩.૧,૫૦,૦૦૦
૪. અપેક્ષિત વળતરનો દર ૧૦%

(ગુ.યુનિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૯)

દા.૧૯ સ્નેહલ લિમિટેડની નીચે આપેલી વિગતો પરથી બંને પ્રકારના ઈક્વિટી શેરની વ્યાજબી કિંમત ગણો.
 ૮,૦૦૦ ૧૦ ટકાના પ્રે.શેર દરેક રૂ. ૧૦૦નો રૂ. ૫૦ લેખે ભરપાઈ.
 ૧૦,૦૦૦ ઈક્વિટી શેર દરેક રૂ.૧૦૦નો શેરટીઠ રૂ.૮૦ ભરપાઈ.
 ૫,૦૦૦ ઈક્વિટી શેર દરેક રૂ.૧૦૦નો પૂરે પૂરા ભરપાઈ.
 વધારામાં કંપની ના ચોપડે રૂ.૧,૦૦,૦૦૦ની અનામતો છે અને કોઈ અવાસ્તવીક મિલકતો કે ટુંકા ગાળાની જવાબદારીઓ નથી.
 જેપણ કુલ મિલકતોની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં ૨૦% વધારે છે જ્યારે પજ મિલકતોની હાલની કિંમત ૨૦% ઓછી અંકાય છે. બાકીની મિલકતોમાં ૧૦ ટકાના બિનદુંધાકીય રોકાણો (મૂળ કીમત રૂ. ૧,૮૦,૦૦૦) નો સમાવેશ થાય છે, જેની બજાર કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ છે.
 કંપનીની ૧૧ ટકાના રૂ.૨,૦૦,૦૦૦નાં ડીલેન્ચર્સ પર વ્યાજ અને કરવેરા(કરવેરાનો દર ૫૦%) ગણ્યા પહેલાંની સરેરાશ વાર્ષિક કમાણી રૂ.૪,૫૦,૦૦૦ જેટલી છે.
 આ પ્રકારના ઘંધામાં અપેક્ષિત વળતર ૧૦ ટકા ગણાય છે. પાદઢીનું મૂલ્ય અધિક નફાની મૂડીકૃત રકમ જેટલું છે.

(દ.ગુ.યુનિ., ટી.વાચ., એપ્રિલ ૨૦૦૭)

દા.૨૦ સ્વીટી લિમિટેડનું તા. ૩૧/૦૩/૨૦૦૫ના રોજનું સરવૈયું નીચે મુજબ હતું.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ભરાયેલ મૂડી	૨૪,૦૦,૦૦૦	પાદઢી	૨,૦૦,૦૦૦
ઇ.શોરો દરેક રૂ.૧૦૦ના પૂરા ભરાયેલા	૮,૦૦,૦૦૦	કાયભી મિલકતો	૩૨,૦૦,૦૦૦
૧૦%ના પ્રેફરન્સ શોરો દરેક રૂ.૧૦૦ પૂરા	૮,૦૦,૦૦૦	રોકાણો	૩,૬૦,૦૦૦
ભરાયેલ	૫,૩૦,૦૦૦	ચાલુ મિલકતો	૧૦,૮૫,૦૦૦
સા.અનામત	૭,૫૦,૦૦૦	પ્રાથમિક ખર્ચ	૧,૬૫,૦૦૦
ચાલુ જવાબદારીઓ	૩,૩૦,૦૦૦		
	૫૦,૧૦,૦૦૦		૫૦,૧૦,૦૦૦

વધારાની માહિતી:

- કાયભી મિલકતોની બજાર કિંમત રૂ.૪૦,૦૦,૦૦૦ છે.
- ચાલુ મિલકતોમાં રૂ.૩,૬૫,૦૦૦ની કિંમતના સ્ટોકનો સમાવેશ થયેલ છે, જે ૧૫% વધુ કિંમતે ગણાયેલ છે.
- રોકાણોમાં રૂ. ૨,૭૦,૦૦૦ની ૧૦% સરકારી જામીનગીરીઓનો સમાવેશ થાય છે જે ૧૦%ના વટાવે ખરીદવામાં આવી હતી.
- કંપનીનો ૫૦% લેખે કરવેરા ગણ્યા પણીનો વાર્ષિક સરેરાશ નકો રૂ.૫,૪૦,૦૦૦ છે.
- અપેક્ષિત વળતરનો દર ૧૦% ગણાવો.
- પાદઢીની કિંમત અધિક નફાથી બે વર્ષની ખરીદી જેટલી ગણાવાની છે.

(ગુ.યુનિ., ટી.વાચ., એપ્રિલ ૨૦૦૬)

દા.૨૧ તા. ૩૧/૦૩/૨૦૦૪ના રોજગાર આશિષ લિમિટેડનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

મૂડી-દેવાં	કુ	મિલકત-લેણાં	કુ
૧૦,૦૦૦ ૮%ના પ્રેફ. શેર દરેક		મકાન મૂળ કિંમતે	
રૂ.૧૦નો પૂર્ણ પૂર્ણ ભરપાઈ થયેલ	૧,૦૦,૦૦૦	(બજાર કિમત રૂ. ૩,૫૦,૦૦૦)	૫૦,૦૦૦
૪૦,૦૦૦ ઈ.શેરો દરેક ૧૦નો		ફર્નિચર પડતર કિમતે	
પૂરેપૂરો ભરપાઈ થયેલ	૪,૦૦,૦૦૦	(બજાર કિમત રૂ. ૩,૦૦૦)	૧૦,૦૦૦
અનામત ભંડોળ	૧,૩૭,૦૦૦	આખરનો સ્ટોક	૪,૫૦,૦૦૦
મકાન અને ઘસારા ભંડોળ	૧૦,૦૦૦	૪%ના રોકાણો (બિનધંધાકીય રોકાણો	૩,૮૦,૦૦૦
રોકાણ વધધટ ફંડ	૪૫,૦૦૦	જેની દર્શાનિક કિમત રૂ.૪,૦૦,૦૦૦)	
નફાનુકશાન ખાતે:		દેવાદારો 3,૦૦,૦૦૦	૨,૮૦,૦૦૦
૧-૪-૨૦૦૩ની બાકી ૮૦,૦૦૦		-ધા.અ. ૨૦,૦૦૦	
+૨૦૦૪નો નફો ૪,૩૦,૦૦૦	૫,૧૦,૦૦૦	બેન્ક સિલ્ક	૫૦,૦૦૦
પશ્યૂએ લેણાદારો	૪૮,૦૦૦	પ્રાથમિક ખર્ચ	૧૦,૦૦૦
	૧૨,૫૦,૦૦૦		૧૨,૫૦,૦૦૦

पद्मासनी भाषितीः

- છેદ્ધાં ત્રણ વર્ષનો નક્કો દરેક વર્ષે રૂ.૪૫,૦૦૦ના વાર્ષિક વધારાથી વધે છે.
 - અધિક નજીબી ત્રણ વર્ષની ખરીદીને આધારે પાદહડી ગણવાની છે.
 - કરવેરાનો દર ૫૦% છે. ૨૦૦૩-૨૦૦૪નો નક્કો કરવેરા બાદ કર્યા પહેલાંનો છે.
 - કંપની દર વર્ષે કર બાદ નજીબાના ૨૦% રકમ સા.અનામત ખાતે લઈ જાય છે.
 - અપેક્ષિત વળતરનો દર ૧૫% છે.

ઇકિયટી શેરની વ્યાજબી કિંમત નકકી કરો. (ગુ.યુનિ., ટી.વાય., માર્ચ ૨૦૦૦, ૨૦૦૪)

દા.૨૨ ધાર્મિક લિમિટેડનું બું તા. ૩૧/૦૩/૨૦૦૪ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

વધારાની માહિતી:

૧. આવા જ પ્રકારનો ઘંધો કરતી અને ૪૦% લેખે ડિવિડન્ડ આપતી કંપનીનો શેરનો ભાવ તેની વસૂલ કરતાં ચાર ગણો છે.
 ૨. કંપનીનો ૫૦% લેખે કરબાદ કર્યા પહેલાંનો સરેરાશ વાર્ષિક નફો રૂ.૪,૦૩,૨૦૦ છે.
 ૩. કંપનીની પાધડીની કિંમત રૂ.૧,૦૮,૪૪૦ આંકવામાઃ આવી છે.
 ૪. ભકાનની પાધડીની બજારકિંમત રૂ.૧૦,૨૫,૨૮૦ છે.
- ઉપરની વિગતો પરથી કંપનીની ઈક્વિટી શેરની વ્યાજબી કિંમત શોધી કાઢો.

(૬.ગુ.યુનિ., એસ.વાય., એપ્રિલ ૨૦૦૫)

દા.૨૩ હાઇક સિમિટેકનું નું તા. ૩૧/૦૩/૨૦૦૫ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ઈક્વિટી શેર દરેક રૂ.૧૦૦નો એક એવા	૮,૦૦,૦૦૦	પાધડી	૫૦,૦૦૦
૩,૦૦૦ ૧૦%ના પ્રેફ. શેર દરેક રૂ.૧૦૦નો	૩,૦૦,૦૦૦	જમીન-મકાન ૫,૦૦,૦૦૦ - ધસારો ૬૦,૦૦૦	૫,૪૦,૦૦૦
સા.અનામત	૧,૫૦,૦૦૦	પ્લાન્ટ-મશીનરી ૭,૫૦,૦૦૦ -ધસારો ૧,૦૦,૦૦૦	૭,૫૦,૦૦૦
નફાનુક્ષણ ખાતું	૫૦,૦૦૦	અન્ય કાયમી	
૧૫%ના ડીબેન્ચર્સ	૨,૫૦,૦૦૦	મિલકડો ૧,૦૦,૦૦૦ -ધસારો ૨૫,૦૦૦	૭૫,૦૦૦
		રોકાણો: ગૌણકિંપનીનાશેર ૩૦,૦૦૦ ૧૫ ટકાના ડીબેન્ચર નિલોક લી. નાં(દાર્શનિક કિંમત ૮૫,૦૦૦ વ્યાજ કરપાત્ર છે.) ૬૦,૦૦૦	૧,૨૦,૦૦૦
લેણાદારો	૭૦,૦૦૦	સ્ટોક	૮૦,૦૦૦
બેન્ક ઓવરફ્રાફ્ટ	૩૦,૦૦૦	ટેવાદારો ૧,૧૦,૦૦૦ -ધા.અનામત ૫,૦૦૦	૧,૦૫,૦૦૦
	૧૦,૦૦૦	રોકડ	૩૧,૦૦૦
		પ્રાથમિક ખર્ચ	૮,૦૦૦
	૧૮,૭૦,૦૦૦		૧૮,૭૦,૦૦૦

વધારાની માહિતી:

૧. જમીન-મકાનની હાલની કિંમત બજાર કિંમત રૂ.૫,૫૬,૫૦૦ છે.
૨. કંપનીનો સરેરાશ વાર્ષિક નફો(૫૦ ટકા કરવેઠે બાદ કર્યા બાદ કર્યા પહેલાનો)રૂ.૩,૫૦,૦૦૦.
૩. આ જ પ્રકારના ઘંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦ ટકા ગણાય છે.
૪. કંપનીની પાધડીની કિંમત રૂ.૧,૨૦,૦૦૦ આંકવામાં આવી છે.

ઉપરની વિગતો પરથી ઈક્વિટી શેરની વ્યાજબી કિંમત શોધો. (૬.ગુ.યુનિ., એસ.વાય., એપ્રિલ ૨૦૦૬)

દા.૨૪ ચંક્ર સિમિટેકનું નું તા. ૩૧/૦૩/૨૦૦૨ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ઈક્વિટી શેર મૂડી (દરેક રૂ.૧૦નો એક એવા રૂ.૫૦,૦૦૦ ઈ.શેર પૂરા ભરપાછ)	૫,૦૦,૦૦૦	જમીન-મકાન	૪,૦૦,૦૦૦

૧૦%ની પ્રેફ. શેરમૂડી (દરેક રૂ.૧૦નો એક અનામત અને વધારો)	3,00,000	ફર્નિચર	૧,૫૦,૦૦૦
અનામત અને વધારો	૨,૦૦,૦૦૦	રોકાણો	૧,૦૦,૦૦૦
૧૦%નાં ડીલેન્યર્સ	૧,૦૦,૦૦૦	સ્ટોક	
લેણાદારો	૧,૫૦,૦૦૦	દેવાદારો	૮૦,૦૦૦
ખર્ચો ચૂકવવાના બાકી	૫૦,૦૦૦	લેણીહુંડી	૫૦,૦૦૦
		રોકડ અને બેન્ક સિલઙ	૩૦,૦૦૦
		પ્રાથમિક ખર્ચ	૨૦,૦૦૦
	૧૪,૦૦,૦૦૦		૧૪,૦૦,૦૦૦

વધારાની માહિતી:

- જમીન-મકાન, પ્લાનટ-યંત્રો અને સ્ટોક ની હાલની કિંમત બજાર કિંમત અનુક્રમે રૂ.૫,૦૦,૦૦૦, રૂ.૪,૦૦,૦૦૦ અને રૂ.૧,૫૦,૦૦૦ છે.
- કંપનીનો સરેરાશ વાર્ષિક નફો(૫૦ ટકા કરયેશે બાદ કર્યા પહેલાનો) રૂ.૨,૭૫,૦૦૦.
- આ જ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૨ ટકા ગણાય છે.
- આ કંપનીની પાદઢીની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ આંકવામાં આવી છે.

ઉપરની વિગતો પરથી ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત શોધો. (ગુ.યુ.નિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૨)
દા.૨૪ લઘુક્ષેલાશ કંપની લિમિટેડનું નું તા. ૩૧/૦૩/૨૦૦૦ના રોજનું પાંકું સરવૈચું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
ઇક્વિટી શેર મૂડી (દરેક રૂ.૧૦૦)	૧૦,૦૦,૦૦૦	જમીન-મકાન	૪,૦૦,૦૦૦
સા.અનામત	૨,૫૦,૦૦૦	યંત્રો	૪,૫૦,૦૦૦
અનામત અને વધારો	૨,૫૦,૦૦૦	મોટર કાર	૨૫,૦૦૦
નફો-નુકશાન ખાતું	૨,૫૦,૦૦૦	ફર્નિચર	૨૫,૦૦૦
લેણાદારો	૫,૦૦,૦૦૦	૨૦%નાં રોકાણો	૫૦,૦૦૦
		સ્ટોક	૭,૨૫,૦૦૦
		દેવાદારો	૨,૦૦,૦૦૦
		બેન્ક સિલઙ	૧,૦૫,૦૦૦
		પ્રાથમિક ખર્ચ	૨૦,૦૦૦
	૨૦,૦૦,૦૦૦		૨૦,૦૦,૦૦૦

વધારાની માહિતી:

- મકાન અને યંત્રોની કિંમત અનુક્રમે રૂ.૬,૦૦,૦૦૦ અને રૂ.૫,૨૦,૦૦૦ આંકવાની છે.
 - બધાં રોકાણો તેની કિંમત કરતાં ૯૦ ટકા વધુ આંકવાના છે.
 - મકાન અને યંત્રોની વધેલી કિંમત પર, પાદઢીની મૂલ્યાંકનના હેતુ માટે ઘસારો દ્યાનમાં લેવાનો નથી.
 - ૫૦ % કર બાદ નફો નીચે પ્રમાણે છે.
- | | | | |
|------|-------------|------|-------------|
| ૧૬૬૭ | રૂ.૩,૦૫,૦૦૦ | ૧૬૬૮ | રૂ.૪,૨૪,૦૦૦ |
| ૧૬૬૮ | રૂ.૩,૮૪,૦૦૦ | ૨૦૦૦ | રૂ.૫,૦૪,૦૦૦ |
- આવા જ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૨૦% (કર બાદ) છે.
 - વર્ષ ૧૬૬૮માં યંત્રો(ચોપડા કિંમત રૂ.૨૦,૦૦૦)જે રૂ.૨૦,૦૦૦માં વેચવામાં આવ્યા હતા. પરંતુ તેની ઉપજ ખોટી રીતે નફો-નુકશાન ખાતે જમા કરવામાં આવી હતી. આ ભૂલ હજુ સુધી સુધારવામાં આવી નથી. ઘસારો ૧૦% લેજે સીધી લીટીની પદ્ધતીએ ગણવામાં આવે છે.

- જ. પાદડીની કિંમત છેલાં ચાર વર્ષના ભારીત સરેરાશ નજ્ઞાને આધારે આધિક નજ્ઞાની ત્રણ વર્ષની ખરીદીના આધારે ગણવાની છે.
 ૮. ઇક્વિટી શેરનું વ્યાજબી મૂલ્ય શોધો.

(દ.ગુ.યુ.નિ., ટી.વાય., એપ્રિલ ૨૦૦૧)

દા.૨૬ તા. ૩૧/૧૨/૧૯૯૯ના રોજનું સત્યમ લી.નું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
દરેક રૂ.૧૦નો તેવા પૂરા ભરાયેલા ઇક્વિટી શેર	૫,૦૦,૦૦૦	પાદડી	૭૫,૦૦૦
દરેક રૂ.૧૦નો તેવા રૂ. ૫ ભરાયેલા ઇક્વિટી શેર	૪,૦૦,૦૦૦	જમીન અને મકાન ચંત્રો	૭,૦૦,૦૦૦
દરેક રૂ.૧૦નો તેવા ૧૦ ટકાના પૂરા ભરાયેલા પ્રેફ. શેર	૨,૦૦,૦૦૦	અન્ય મિલકતો	૮૦,૦૦૦
અનામત અને વધારો	૧,૦૦,૦૦૦	માધવ લી.નાં ૧૦%નાં ડીબેન્ચર (દાર્શનિક કિંમત રૂ. ૧,૦૦,૦૦૦)	૧,૨૦,૦૦૦
નજ્ઞા-નુકશાન ખાતું	૫૦,૦૦૦	સ્ટોક	૫૦,૦૦૦
૧૨%નાં ડીબેન્ચર્સ	૩,૦૦,૦૦૦	દેવાદારો ૧,૦૫,૦૦૦	
લેણદારો	૫૦,૦૦૦	બાદદા. અનામત ૧૫,૦૦૦	૬૦,૦૦૦
હેવી હૃદીઓ	૪૦,૦૦૦	રોકડ અને બેન્ક	૨૦,૦૦૦
બેન્ક ઓપરટ્રાઇટ	૨૫,૦૦૦		
ઘસારા ફંડ			
જમીન-મકાન	૭૦,૦૦૦		
ચંત્રો	૬૦,૦૦૦		
અન્ય મિલકતો	૨૦,૦૦૦		
	૧૮૦,૦૦૦		
	૧૬,૫૫,૦૦૦		૧૬,૫૫,૦૦૦

વધારાની માહિતી:

- જમીન અને મકાનની ઘસારા બાદ કિંમતમાં રૂ.૧,૨૦,૦૦૦ વધારો થયો છે.
 - ચંત્રોની હાલની કિંમત રૂ.૭,૦૦,૦૦૦ છે.
 - સ્ટોકની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં રૂ.૧૦,૦૦૦ ઓછી છે.
 - કંપનીની પાદડીની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ ગણવાની છે.
 - કંપનીનો ત્રણ વર્ષનો ૫૦% વેરો કપાતાં અગાઉનો કુલ નજ્ઞો રૂ.૧૨,૦૦,૦૦૦ છે.
 - આ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર ૧૦% ગણાય છે.
- ઉપરની વિગત પરથી કંપનીના ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત શોધો.

(ગુ.યુ.નિ., ટી.વાય., માર્ચ ૧૯૯૭)

દા.૨૭ માધવી લી.નું તા. ૩૧/૧૨/૧૯૯૯ના રોજનું સત્યમ લી.નું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-દેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
રૂ.૧૦નો એક એવા પૂરોપૂરા ભરપાઈ થયેલા ઇક્વિટી શેર	૫,૦૦,૦૦૦	પાદડી કાયમી મિલકતો	૭૫,૦૦૦
રૂ.૧૦૦નો એક એવા ૧,૫૦૦ ૧૨%ના પ્રે.શેર	૧,૫૦,૦૦૦	રોકાણો ધંધાકીય	૪૫,૦૦૦
			૧,૭૫,૦૦૦

મૂડી-અનામત	૧,૦૦,૦૦૦	બિન-દંધાકીય	૭૫,૦૦૦
સા.અનામતો	૭૦,૦૦૦	ચાલુ મિલકત	૪૦,૦૦૦ ૦૦૦</td
નફા-નુકશાન ખાતું	૧,૩૦,૦૦૦	પ્રાથમિક ખર્ચો	૪૦,૦૦૦
લેણાદારો	૧,૪૦,૦૦૦		
દેવી હુદીઓ	૭૦,૦૦૦		
પ્રોવિડન્ડ ફંડ	૪૦,૦૦૦		
	૧૨,૦૦,૦૦૦		૧૨,૦૦,૦૦૦

વધારાની ભાહિતી:

૧. કાચમી મિલકતોની બજાર કિંમત, ચોપડે કિંમત કરતાં ૩૩.૫% વધુ છે.
૨. રોકાણોમાં દંધાકીય રોકાણોને તેમની ચોપડે કિંમત કરતાં ૨૦% વધુ કિંમતે આંકવાળા છે. અને બજે પ્રકારના રોકાણો પર વાર્ષિક ૧૨%ના દરે કરપાત્ર ડિવિડન્ડ મળે છે.
૩. પાઘડીની કિંમત અધિક નફાથી બે વર્ષની ખરીદી જેટલી ગણવાળી છે.
૪. કંપનીનો છેલ્ખાં ત્રણ વર્ષનો સરેરાશ નફો (૫૦% કરપેરા બાદ કર્ચા પણીનો) રૂ.૧,૮૦,૦૦૦ છે.
૫. આ પ્રકારના દંધામાં અપેક્ષિત વળતરનો દર ૧૦% ગણવાય છે.

ઉપરની વિગત પરથી કંપનીના ઇન્ડિયટી શેરની વ્યાજની કિંમત શોધો.

(ઉ.ગુ.ચુનિ., ટી.વાય., માર્ચ ૧૯૭૭)

ડા.૨૮ કીરણ લી.નું તા. ૩૧/૧૨/૨૦૦૦ના રોજનું પાંકું સરવૈયું નીચે મુજબ છે.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
૨૦૦૦ ૫% પ્રે.શેર ૧૦૦નો એક	૨,૦૦,૦૦૦	જમીન અને મકાન	૫,૦૦,૦૦૦
૫૦૦૦ ઈ.શેર રૂ.૧૦૦નો ૧	૫,૦૦,૦૦૦	સ્ટોક	૨,૫૦,૦૦૦
સા.અનામત	૫૦,૦૦૦	પ્રા.ખર્ચ	૫૦,૦૦૦
ભંડોળ(સ્થિર મિલકતો પર)	૩૦,૦૦૦		
લેણાદારો	૨૦,૦૦૦		
	૮,૦૦,૦૦૦		૮,૦૦,૦૦૦

વધારાની ભાહિતી:

જમીન-મકાનની બજાર કિંમત રૂ.૫,૦૦,૦૦૦ ગણવી સ્ટોકની બજાર કિંમત ૨,૦૦,૦૦૦ ગણવી.

ઉપરની વિગતો પરથી શેરની આંતરી કિંમત શોધો.

(સ.પ.ચુનિ., ૨૦૦૧)

ડા.૩૦ તા. ૩૧/૦૩/૨૦૧૮ના રોજ રાધવ કંપની લી.નું પાંકું સરવૈયું નીચે મુજબ હતું.

મૂડી-ટેવાં	રૂ.	મિલકત-લેણાં	રૂ.
રૂ.૧૦૦નો એક એવાં ઈ.શેર	૪૦,૦૦,૦૦૦	જમીન-મકાન	૧૦,૦૦,૦૦૦
સા.અનામત	૨૦,૦૦,૦૦૦	ચંત્રો	૪૦,૦૦,૦૦૦
૫%નાં ડીઝેન્ચર્સ	૧૦,૦૦,૦૦૦	ફિનિચર	૪,૦૦,૦૦૦
લેણાદારો	૧૦,૦૦,૦૦૦	સ્ટોક	૧૬,૦૦,૦૦૦
	૮૦,૦૦,૦૦૦	ટેવાદારો	૪,૦૦,૦૦૦
		બેન્ક સિલ્ક	૫,૦૦,૦૦૦
			૮૦,૦૦,૦૦૦

વધારાની માહિતી:

૧. દ્વેક ભિલકતોની કિંમત બજાર કિંમત કરતા બમણી ગણવી.
૨. કંપનીની પાધડી રૂ.૨૨,૦૦,૦૦૦ ગણવી.
૩. છેલાં ત્રણ વર્ષનો કરવેરા પદ્ધીનો સરેરાશ નફો રૂ.૨૪,૦૦,૦૦૦ છે.
૪. અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.
૫. કંપની છેલાં ત્રણ વર્ષની નફાની ૨૫% રકમ સા.અનામત ખાતે લઈ જાય છે.
ઉપરની માહિતી ઉપરથી શેરની આંતરીક વ્યાજબી કિંમત શોધો.

દા.૩૧ નીચેની વિગતો ઉપરથી ઈ.શેરની બજાર કિંમત શોધો.

૧. ૪,૦૦૦ ઈ. શેર (રૂ. ૧૦૦નો એક એવાં રૂ. ૮૦ ભરપાઈ) રૂ. ૩,૨૦,૦૦૦
૨. સરેરાશ વાર્ષિક નફો (કરવેરા પહેલાંનો) રૂ. ૬૪,૦૦૦
૩. સા.અનામત ખાતે લઈ જવાની રકમ રૂ.૧૦,૦૦૦
૪. કરવેરાની જોગવાઈ રૂ. ૬,૦૦૦
૫. અપેક્ષિત વળતરનો દર ૧૨% છે.

(સ.પ.યુનિ., ૨૦૦૨)

-----*****-----

પ્રકરણ - ૭

આગના દાવાના હિસાબો

૭.૧ પ્રસ્તાવના

૭.૨ નાશ પામેલ સ્ટોકના દાવા

૭.૩ સરેરાશ કલમ

૭.૪ પારિયાનિક નુકશાન પોલિસી / નફા-નુકશાનની પોલિસી

પ્રકરણ - ૭

આગના દાવાના હિસાબો

૭.૧ પ્રસ્તાવનાઃ

ધેંધા સાથે બે શબ્દો જોડાયેલા છે. ૧) નફો ૨) જોખમ. નફો મેળવવા વિવિધ જોખમો ઉઠાવવા તૈયાર રહેવું પડે છે. જે પૈકી કેટલાંક જોખમો સામે રક્ષણ મેળવી શકાય છે. આ રક્ષણ (કવચ) પુંરુષ પાડવાનું કામ વીમા કંપની કરે છે. ધેંધામાં અકસ્માત, તથા અન્ય કારણોસર આગ લાગે તો માલસામાન, સ્થિરામિલકતો (કાચભી મિલકતો) જેવી કે યંત્રો તથા ફર્નિચરને નુકશાન થાય છે, તેમજ વેપાર તથા ઉત્પાદન પ્રક્રિયા પણ ખોરંબે પડતાં ભોટાપાયે આણિક નુકશાન ભોગવવું પડે છે. પરંતુ જો તેની સામે આગનો વીમો લીધો હોયથો વીમા કંપની નક્કી કરેલ પ્રિમીયમ અને શરતોના આધારે આગથી થયેલ નુકશાન ભરપાઈ કરી આપે છે. આ નુકશાનની રકમ વીમા કંપની પાસેથી વસુલ કરવા વીમા કંપની સમક્ષ દાવા રજૂ કરવા પડે છે, જેને આગના દાવા કહેવામાં આવે છે. - આગના દાવા ત્રણ પ્રકારે વીમા કંપની સમક્ષ રજૂ કરવામાં આવે છે.

- (અ) ફક્ત માલસામાન કે સ્ટોકના દાવા
- (બ) પારિમાણિક નુકશાનના દાવા
- (ક) કાચભી મિલકતોના દાવા.

૭.૨ નાશ પામેલ સ્ટોકના દાવાઃ

- (૧) સૌ પ્રથમ આગ લાગ્યા તારીખે ગોડાઉનમાં સ્ટોક કેટલો છે, તે નીચેની પદ્ધતિનો ઉપયોગ કરી શોધો.

શરૂઆતનો સ્ટોક	---	વેચેલ માલની મુલ કિંમત(વેચાણ)	---
+ આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી	---	બાદ	
	*	કાચોનફો	---
- વેચેલ માલની મુલકિંમત	*	વેચેલ માલની મુલ કિંમત	*
આખર સ્ટોક	*		

- (૨) કાચા નફાનો દર શોધો:-

જો દાખલામાં આગ લાગ્યા તારીખની અગાઉની એક વર્ષના જરૂરી બધાજ અંકડા આપ્યા હોય તો તેને આધારે આ દર શોધાય અને તે આગ લાગ્યા તારીખના વર્ષને લાગુ પડે.	જો દાખલામાં આગ લાગ્યા તારીખની અગાઉના ત્રણ કે તેથી વધુ વર્ષના અંકડા આપ્યા હોય તો દરેક વર્ષનો નફાનો દર શોધી (નફાનાં વધુ દરથી હોય તો) સરેરાશ કાચા નફાનો દર શોધો.
--	---

- (૩) આગ લાગ્યા તારીખ સુધીનું (મેમોરેન્ડમ) વેપાર ખાતું તૈયાર કરો.

- (૪) આગ લાગ્યા તારીખે જે સ્ટોક મળે તેના અધારે નીચેની પ્રમાણે દાવાની રકમ શોધો.

વિગત	રકમ
આગમાં બળી ગયેલ માલની કિંમત	---
-આગથી બચાવેલો માલ ની બજારમાં પ્રાપ્ય મુલ્ય	---
	*
+ આગ બુઝાવવાના ખર્ચ કર્યા	---
આગના દાવાની રકમ	*

૭.૩ સરેરાશ કલમ:

વીમો ઉત્તરાવનાર પોતાની મિલકતનો ત્રણ રીતે વીમો ઉત્તરાવી શકે છે.

- (૧) મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉત્તરાવો.
- (૨) મિલકતની કિંમત કરતાં વધુ રકમનો વીમો ઉત્તરાવો.
- (૩) મિલકતની કિંમત જેટલી જ રકમનો વીમો ઉત્તરાવો.

ઉપરોક્ત ત્રણ પૈકી સરેરાશ કલમનો ઉપયોગ ફક્ત પ્રથમ કેસ એટલે કે જ્યારે મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉત્તરાવવામાં આવ્યો હોય ત્યારે જ થાય છે. બાકીના બંને કેસમાં સરેરાશ કલમ લાગુ પડતી નથી. દા.ત.: એક મિલકતની કિંમત ૨૫,૦૦૦/- રૂ. હે, જેના પર ૧૫૦૦૦/- રૂ.નો વીમો ઉત્તરાવવામાં આવે છે. હવે જો આગ લાગવાથી ઉપરોક્ત મિલકત પૂરેપૂરી બળી જાયતો, વીમા કંપની પૂરેપૂરી રકમ નહીં ચુકવે પરંતુ પ્રમાણાસર રકમ ચુકવશે. જેની ગણતરી સરેરાશ કલમ મુજબ નીચે પ્રમાણે કરવામાં આવે છે.

$$\text{દાવાની રકમ} = \frac{\text{ખરેખર નુકશાન} \times \text{વીમા પોલીસીની રકમ}}{\text{મિલકતની કુલ કિંમત}}$$

$$= \frac{\text{રૂ. } ૨૫,૦૦૦ \times \text{ રૂ. } ૧૫,૦૦૦}{\text{રૂ. } ૨૫,૦૦૦}$$

$$= \text{રૂ. } ૧૫,૦૦૦$$

હવે ધારો કે ઉપરોક્ત મિલકતને આગથી ફક્ત રૂ.૮૦૦૦ નું નુકશાન થાય તો એ સંજોગોમાં વીમા કંપની રૂ. ૪૮૦૦/- ચુકવશે. જેની આમનોંધ આ પ્રમાણે થાય.

$\frac{૮૦૦૦ \times ૧૫૦૦૦}{૨૫૦૦૦}$	આમનોંધ વીમા કંપની ખાતે રૂ. આગથી થયેલ નુકશાન ખાતે રૂ. તે આગથી બળી ગયેલ ખાતે રૂ.	૪૮૦૦
$= ૪૮૦૦$		૪૮૦૦

સ્ટોકના નુકશાનના દાખલાઓ:

- (૧) તારીખ: ૩૧-૦૩-૨૦૧૭ની રાત્રે આગ લાગવાથી વિજય લી. ના મકાનનો મોટો ભાગ નાશ પામ્યો. રૂ. ૮૮૦૦૦ કિંમતનો સ્ટોક અને ચોપડા બચાવી લેવામાં આવ્યા. કંપનીનો છેષા ૫ વર્ષના વેચાણ પર કાચા નફાનો દર ૨૦ % જેટલો હતો.

તારીખ: ૦૧-૦૧-૨૦૧૭ના રોજ સ્ટોકની કિંમત ૪,૦૦,૦૦૦ હતી. તારીખ: ૦૧-૦૧-૨૦૧૭ થી ૩૧-૦૩-૨૦૧૭ સુધીનું વેચાણ ૫,૪૦,૦૦૦ હતું તથા તેજ સમયગાળાની ખરીદી રૂ. ૩,૨૦,૦૦૦ અને ઉત્પાદક મજૂરી રૂ. ૧,૦૦,૦૦૦ હતી. વીમા કંપની સમકષ મૂકવાના થતા સ્ટોકના દાવાનું પત્રક તૈયાર કરો.

- સૌપ્રથમ આગ લાગ્યા તારીખ સુધીનું કાચું વેપાર ખાતું બનાવીને આગ લાગ્યા તારીખે બળી ગયેલ સ્ટોકની કિંમત શોધીશું.

તારીખ: ૦૧-૦૧-૨૦૧૭ થી ૩૧-૦૩-૨૦૧૭ સુધીનું કાચુ વેપાર ખાતુ.

૬.

જ.

વિગત	રકમ	વિગત	રકમ
શરૂઆતનો સ્ટોક	૪,૦૦,૦૦૦	વેચાણ	૫,૪૦,૦૦૦
ખરીદી	૩,૨૦,૦૦૦		
ઉત્પાદક મજૂરી	૧,૦૦,૦૦૦		
કાચો નફો		આખર સ્ટોક	૩,૮૮,૦૦૦
૫,૪૦,૦૦૦ \times ૨૦/૧૦	૧,૦૮,૦૦૦		
	૬,૨૮,૦૦૦		૬,૨૮,૦૦૦

આગના દાવાની રકમ:

આખર સ્ટોક (આગ લાગ્યા તારીખે) ૩૧-૦૩-૨૦૧૭ના રોજ = ઝ. ૩,૮૮,૦૦૦

બાદ:- આગથી બચાવેલ માલ - ઝ. ૮૮,૦૦૦

આગના દાવાની રકમ ઝ. ૩,૦૦,૦૦૦

(૨) ૧૦ મી જુન, ૨૦૧૭ના રોજ મેસર્સ આણંદ બ્રધર્સના મકાનમાં આગ લાગી, જેમાં મોટાભાગનો સ્ટોક આગથી નાશ પામ્યો અને બચાવેલ સ્ટોકની કિંમત ૧,૦૮,૦૦૦ હતી. હિસાબી ચોપડા પરથી નીચેની માહિતી પ્રાપ્ત થઈ શકી.

- (૧) ૩૧ મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ આખર સ્ટોક ઝ. ૪,૧૭,૫૦૦ હતો.
- (૨) ૦૧-૦૧-૨૦૧૭ થી ૧૦-૦૬-૨૦૧૭ સુધીની ખરીદી ઝ. ૫,૫૦,૦૦૦ની હતી અને તેજ સમય દરમિયાનનું વેચાણ ઝ. ૭,૭૦,૦૦૦ હતુ.
- (૩) પાછળા ત્રણ વર્ષનો વેચાણ પર કાચા નફોનો સરેશાશ દર ૨૫% હતો.
- (૪) સ્ટોક અંગે ઝ. ૩,૭૫,૦૦૦નો વીમો લેવામાં આવ્યો હતા.

દાવાની ગાણતરી કરો.

તારીખ ૦૧-૦૧-૨૦૧૭ થી ૧૦-૦૬-૨૦૧૭ સુધીનું કાચુ વેપાર ખાતુ

૭.

જ.

વિગત	રકમ	વિગત	રકમ
શરૂઆતનો સ્ટોક	૪,૧૭,૫૦૦	વેચાણ	૭,૭૦,૦૦૦
ખરીદી	૫,૫૦,૦૦૦		
કાચો નફો		આખર સ્ટોક	૪,૦૦,૦૦૦
૭,૭૦,૦૦૦ \times ૨૫/૧૦૦	૧,૯૨,૫૦૦		
	૧૧,૭૦,૦૦૦		૧૧,૭૦,૦૦૦

(નોંધ : અહીં મિલકતની કિંમત સ્ટોકની કિંમત ઝ. ૪,૦૦,૦૦૦ છે, જ્યારે વીમો કિંમત ફક્ત ઝ. ૩,૭૫,૦૦૦નો લીધેલ છે. જેથી સરેરાશ કલમ લાગુ પડશે.)

દાવાની

તારીખ: ૧૦-૦૬-૨૦૧૭ના રોજ આખર સ્ટોક	ઝ. ૪,૦૦,૦૦૦
આગથી બચાવેલ સ્ટોક	ઝ. ૧,૦૮,૦૦૦
નાશ પામેલ માલ	ઝ. ૨,૯૨,૦૦૦
સરેરાશ કલમ = ૨,૯૨,૦૦૦ X ૩,૭૫,૦૦૦ = ૨,૭૩,૭૫૦	
	૪,૦૦,૦૦૦

સામાન્ય અને અસામાન્ય સ્ટોકનો દાખલો:

નોંધ : જ્યારે દાખલામાં બંને સ્ટોકની માહિતી અલગ આપેલ હોય ત્યારે કાચું વેપાર ખાતું બનાવતી વખતે સામાન્ય અને અસામાન્ય માલ બંને પ્રકારના ખાતાં બનાવવા પડશે.

(૩) તારીખ: ૧૫-૧૨-૨૦૧૭ના રોજ નરેશ ટ્રેડર્સનું મકાન આગથી બળી ગયું અને બચેલા રેકર્ડમાંથી નીચેની માહિતી પ્રાપ્ત થઈ શકી.

સ્ટોક (મુણ કિંમત), તારીખ: ૦૧-૦૧-૨૦૧૫	૩,૫૭,૫૦૦
સ્ટોક (મુણ કિંમત), તારીખ: ૩૧-૧૨-૨૦૧૫	૩,૬૮,૦૦૦
ખરીદ બાદ પરત (૩૧-૧૨-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષની)	૧૬,૬૦,૦૦૦
વેચાણ બાદ પરત (૩૧-૧૨-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષની)	૨૪,૩૫,૦૦૦
ખરીદ બાદ પરત (૦૧-૦૧-૨૦૧૭ થી ૧૫-૧૨-૨૦૧૭ સુધી)	૮,૧૦,૦૦૦
વેચાણ બાદ પરત (૦૧-૦૧-૨૦૧૭ થી ૧૫-૧૨-૨૦૧૭ સુધી)	૧૧,૫૫,૦૦૦

તારીખ: ૩૧-૧૨-૨૦૧૫ના રોજ પાકા સરવૈચા માટે સ્ટોકની કિંમત આંકઠી વખતે કેટલોક માલ, જેની મુણ કિંમત ઝ. ૩૪,૫૦૦ છે, જેનું બરાબર વેચાણ ન થતું હોવાથી ઝ. ૧૧,૫૦૦ લખી વાળવામાં આવ્યા હતા. માલનો આ થોડો ભાગ જેની મુણ કિંમત ઝ. ૧૭,૨૫૦ હતી, તેને માચ્ય ૨૦૧૭માં ઝ. ૧,૨૫૦ના નુકશાને વેચવામાં આવ્યો હતો. બાકીના સ્ટોક હવે તેની મુણ કિંમતે આંકઠવામાં આવે છે. ઉપરોક્ત અપવાદ સિવાય કાચા નફાનો દર આખા ગોળા માટે એક સરખો રહ્યો છે. આગથી બચેલ માલની કિંમત ઝ. ૨૮,૦૦૦ હતી. દાવાની રકમ શોધો.

તારીખ ૩૧-૧૨-૨૦૧૫ ના રોજ પૂરા થતા વર્ષનું કાચું વેપાર ખાતું

૬.

જ.

વિગત	રકમ	વિગત	રકમ
શરૂઆતનો સ્ટોક	૩,૫૭,૫૦૦	વેચાણ બાદ પરત	૨૪,૩૫,૦૦૦
ખરીદી બાદ પરત	૧૬,૬૦,૦૦૦	આખર સ્ટોક + લખી વાળેલ	૩૬૮૦૦૦ ૧૧,૫૦૦
કાચો નફો	૪,૮૭,૦૦૦		૪,૦૮,૫૦૦
	૨૮,૪૪,૫૦૦		૨૮,૪૪,૫૦૦

* તારીખ: ૩૧-૧૨-૨૦૧૫ના રોજ આખર સ્ટોકની કિંમત અંકતા ઝ. ૧૧,૫૦૦ લખી વાળવામાં આવેલા, જેને આખર સ્ટોકમાં ઉમેરવા પડે.

વેચાણ પર કાચા નકોનો દર:-

૨૪,૩૫,૦૦૦	૪,૮૭,૦૦૦	$\frac{4,87,000 \times 100}{24,35,000} = 20\%$
૧૦૦	?	૨૪,૩૫,૦૦૦

હવે આગ લાગ્યા તારીખ સુધીનું વેપાર ખાતું બનાવવું.

તારીખ: ૧૫-૧૨-૨૦૧૭ સુધીનું કાચું વેપાર ખાતું.

વિગત	સામાન્ય	અસામાન્ય	કુલ	વિગત	સામાન્ય	અસામાન્ય	કુલ
શરૂઆતનો સ્ટોક (૪,૦૮,૫૦૦ - ૩૪,૫૦૦)	૩,૭૫,૦૦૦	૩૪,૫૦૦	૪,૦૯,૫૦૦	વેચાણ બાદ પરત (૧૫,૦૦૦ + ૧૧,૪૦,૦૦૦)	૧૧,૪૦,૦૦૦	૧૫,૦૦૦	૧૧,૫૫,૦૦૦
ખરીદી બાદ પરત	૮,૧૦,૦૦૦	---	૮,૧૦,૦૦૦	કાચી ખોટ	---	૧,૨૫૦	૧,૨૫૦
કાચો નકો (૧૧,૪૦,૦૦૦ X ૨૦/૧૦૦)	૨,૨૮,૦૦૦	---	૨,૨૮,૦૦૦	આખર સ્ટોક ?	૨,૭૩,૦૦૦	---	---
	૧૪,૧૩,૦૦૦	૩૪,૫૦૦	૧૪,૪૭,૫૦૦		૧૪,૧૩,૦૦૦	૩૪,૫૦૦	૧૪,૫૭,૫૦૦

* બગડેલ માલ પૈકી ઝ. ૧૭,૨૫૦ ના મુલ કિંમતના માલ

બાદ: ખોટ ઝ. ૧,૨૫૦

વેચાણ કિંમત ઝ. ૧૫,૦૦૦

* તારીખ: ૧૫-૧૨-૨૦૧૭ના રોજ સ્ટોક ઝ. ૨,૬૦,૨૫૦

બાદ: આગથી બચેલ માલ ઝ. ૨૬,૦૦૦

દાવાની રકમ ઝ. ૨,૫૧,૨૫૦

૭.૪ પારિણામિક નુકશાન પોલિસી / નકો નુકશાનની પોલિસી:

ધ્યાભાં આગ લાગે ત્યારે માત્ર ભાલસામાન, મિલકતો કે સ્ટોકને જ નુકશાન થયા તેવું નથી, પરંતુ સાથે સાથે આગ લાગવાથી કેટલાંક સમય સુધી ધંધો ખોરવાઈ જાય છે, જેના પરિણામે તે સમયગાળા દરમિયાન વેચાણમાં ઘટાડો થાય છે. જે કમશા: નકોના ઘટાડામાં પરિણામે છે. આવા પ્રકારના નુકશાનને આગથી થચેલ પારિણામિક નુકશાન અથવા તે નકોમાં નુકશાન કહે છે. ટુકમાં જેટલો સમય ધંધો બંધ રહે તેટલા સમય પૂરતાં વિવિધ સ્થિર ખર્ચાઓ તો ચૂકવવા જ પડે છે અને બીજુ બાજું વેચાણ દર ઘટે છે આજે પારિણામિક નુકશાન કહવાય, જેની સામે કંપનીઓ નકોના નુકશાનનો વીમો ઉત્તરાયે છે.

પારિણામિક નુકશાનના દાવાની ગણાતરી કરતી વખતે દયાનમાં રાખવાના મુદ્દા.

(૧) સૌપ્રથમ ગુમાવેલ વેચાણ શોધો:-

ગુમાવેલ વેચાણ:-

પાછલા વર્ષનું બાંધદરી સમયનું વેચાણ (પ્રમાણિત વેચાણ)	---
(-) બાદ:- ખોરપાઈ ગયેલ સમયનું વેચાણ (બાંધદરી) સમયનું ખરેખર વેચાણ	---
ગુમાવેલ વેચાણ	*

નોંધ : ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે જો ગચ્છા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વધદાટ થઈ હોય તો તેને દ્યાનમાં લેવી.

(૨) વેચાણ પર નફાની નીચેની બે ટકાવારીઓ શોધો.

$$2.1 \quad \frac{\text{પાછલા નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો + સ્થિર ખર્ચ} {\text{પાછલા નાણાકીય વર્ષનું વેચાણ} } \times 100$$

$$2.2 \quad \frac{\text{વિમાની રકમ}}{\text{આગ લાગ્યા તારીખ પહેલાના ૧૨ માસનું વેચાણ}} \times 100$$

(૩) દાવાની રકમ = ગુમાવેલ વેચાણ \times ટકાવારી

(૨.૧ અથવા ૨.૨ પૈકી બેમાંથી જે ઓછી હોય તે)

દાખલા છારા સમજુદ્દી:-

એક કારખાનામાં આગ લાગી નીચની વિગતો પ્રાસ થઈ શકી. જેના આધારે દાવાની રકમ શોધો.

(૧)	ગુમાવેલ વેચાણ	રૂ. ૫૦,૦૦૦
(૨)	પાછલા હિસાબી વર્ષનું વેચાણ	રૂ. ૨,૦૦,૦૦૦
(૩)	પાછલા વર્ષનો ચોખ્ખો નફો	રૂ. ૩૨,૦૦૦
(૪)	પાછલા વર્ષના (હિસાબી વર્ષના) સ્થિર ખર્ચાઓ	રૂ. ૮૦,૦૦૦
(૫)	આગ લાગ્યા તારીખે પુરા થતા ૧૨ માસનું વેચાણ	રૂ. ૪,૦૦,૦૦૦
(૬)	વીમા પોલિસીની રકમ	રૂ. ૭૨,૦૦૦
(૭)	આગ બુકાવવાના ખર્ચ	રૂ. ૧,૨૦૦

જવાબ:

(અ) ગુમાવેલ વેચાણ રૂ. ૫૦,૦૦૦

(ઇ) વેચાણ પર નફાની ટકાવારી

$$\begin{aligned} B.1 &= \frac{\text{પાછલા નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો + સ્થિર ખર્ચ} {\text{પાછલા નાણાકીય વર્ષનું વેચાણ} } \times 100 \\ &= \frac{32,000 + 8000 \times 100}{2,00,000} \\ &= \frac{40,000 \times 100}{2,00,000} \end{aligned}$$

= ૨૦%

$$\begin{aligned} \text{B.2} &= \frac{\text{વીમાની રકમ}}{\text{આગ લાગ્યા તારીખે પૂરા થતા ૧૨ માસનું વેચાણ}} \times ૧૦૦ \\ &= \frac{૭૨,૦૦૦ \times ૧૦૦}{૪,૦૦,૦૦૦} \\ &= ૧૮\% \end{aligned}$$

(દ) દાવાની રકમ

$$\begin{aligned} &= ગુમાવેલ વેચાણ X વેચાણ પર નફાની ટકાવારી (B.1 / B.2 માંથી જે ઓછી હોય તે) \\ &= ૫૦,૦૦૦ \times ૧૮ / ૧૦૦ = ૯૦,૮૦૦ \\ &+ આગ બુકાવવાના ખર્ચ માટે \underline{૧,૨૦૦} \\ &\quad \text{કુલ દાવાની રકમ} \quad \underline{\underline{૯૨,૦૦૦}} \end{aligned}$$

નોંધ:- નફાની ટકાવારી અને વેચાણની ટકાવારીમાં થયેલ ફેરફારનો દાખલો.

દાખલા નં. ૨

શ્રીમતી પ્રિયંકાએ પોતાની ધંધાની નફાના નુકશાનની રૂ. ૫,૧૮,૦૦૦ની પોલિસી લીધી. તેમનું હિસાબી વર્ષ ૩૧ ડિસેમ્બર, ના રોજ પુરું થાય છે. નીચે આપવામાં આવેલ માહિતીના આધારે વીમા કંપની સમક્ષ રજૂ કરવાનું નફા-નુકશાન દર્શાવિતું પત્રક તૈયાર કરો:

- (૧) આગ લાગ્યા તારીખ: ૦૧-૦૫-૨૦૧૭
 (૨) બાંધદરી સમયનો ગાળો ૪ માસ
 (૩) છેદાં નાણાકીય વર્ષનો ચોખ્ખો નફી રૂ. ૩,૫૦,૦૦૦
 (૪) વીમો ઉત્તરાવેલ સ્થિર ખર્ચ રૂ. ૭,૫૦,૦૦૦
 (૫) તારીખ ૩૦મી એપ્રિલ, ૩૧મી ઓગષ્ઠ અને ૩૧મી ડિસેમ્બરના રોજ પૂરા થતા ચાર (૪) માસના વેચાણનાં આંકડા અનુક્રમે નીચે મુજબ હતા.
 (અ) ૨૦૧૬ : રૂ. ૧૮,૭૫,૦૦૦, રૂ. ૨૨,૫૦,૦૦૦, રૂ. ૮,૭૫,૦૦૦
 (દ) ૨૦૧૭ : રૂ. ૧૫,૦૦,૦૦૦, રૂ. ૩,૭૫,૦૦૦
 (૬) ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭ના વર્ષમાં વેચાણમાં ૨૦% નો ઘટાડો થશે. અને ૨૦૧૭ના વર્ષની સરખામણીમાં ૨૦૧૭ના વર્ષમાં નફાના દરમાં ૨% નો ઘટાડો થશે.

બાંધદરી સમય (ચાલુ વર્ષનો)

આગ લાગ્યા તારીખ:	૦૧-૦૫-૨૦૧૭
+ બાંધદરી સમય	૪ માસ
૦૧-૦૫-૨૦૧૭ થી ૩૧-૦૮-૨૦૧૭ (ચાલુ વર્ષનો) ૦૧-૦૯-૨૦૧૭	

૦૧-૦૫-૨૦૧૬ થી ૩૧-૦૮-૨૦૧૬ (ગયા વર્ષનો)

(અ) ગુમાવેલ વેચાણ

પાછલા વર્ષના બાંયદરી સમયનું વેચાણ (૦૧-૦૫-૨૦૧૬ થી ૩૧-૦૮-૨૦૧૬)	૨૨,૫૦,૦૦૦
- ૨૦% ઘટાડો	૪,૫૦,૦૦૦
બાદ; ચાલુ વર્ષના બાંયદરી સમયનું વેચાણ (૦૧-૦૫-૨૦૧૭ થી ૩૧-૦૮-૨૦૧૭)	૩,૭૫,૦૦૦
ગુમાવેલ વેચાણ	૧૪,૨૫,૦૦૦

(ઈ) વેચાણ પર નકારી ટકાવારીઓ

$$\begin{aligned}
 \text{B.1} &= \frac{\text{પાછલા નાણાકીય વર્ષનો ચાખ્યો નક્ષો + સ્થિર ખર્ચ }{ \text{પાછલા નાણાકીય વર્ષનું વેચાણ} } \times 100 \\
 &= \frac{3,૫૦,૦૦૦ + ૭,૫૦,૦૦૦ \times ૧૦૦}{4૦,૦૦,૦૦૦} \\
 &= \frac{૧૧,૦૦,૦૦૦ \times ૧૦૦}{4૦,૦૦,૦૦૦} \\
 &= ૨૨\%
 \end{aligned}$$

પાછલા નાણાકીય વર્ષનું વેચાણ / ૦૧-૦૧-૨૦૧૬ થી ૩૧-૧૨-૨૦૧૬

૦૧-૦૧-૨૦૧૬ થી ૩૦-૦૪-૨૦૧૬	૧૮,૭૫,૦૦૦
+ ૦૧-૦૫-૨૦૧૬ થી ૩૧-૦૮-૨૦૧૬	૨૨,૫૦,૦૦૦
+ ૦૧-૦૯-૨૦૧૬ થી ૩૧-૧૨-૨૦૧૬	૮,૭૫,૦૦૦
	૫૦,૦૦,૦૦૦

$$= ૨૨\% - ૨\% ઘટાડો = ૨૦\%$$

$$\begin{aligned}
 \text{B.2} &= \frac{\text{વીમાની રકમ}}{\text{આગ લાગ્યા તારીખે પુરા થતા ૧૨ માસનું વેચાણ}} \times 100 \\
 &= \frac{૫,૧૮,૦૦૦ \times ૧૦૦}{૩૭,૦૦,૦૦૦} \\
 &= ૧૪\%
 \end{aligned}$$

➤ આગ લાગ્યા તારીખના પહેલાના ૧૨ માસનું વેચાણ:

૦૧-૦૫-૨૦૧૭ સુધીનું એટલેકે (૦૧-૦૫-૨૦૧૬ થી ૩૦-૦૪-૨૦૧૭ સુધીનો સમય)		
૦૧-૦૫-૨૦૧૬ થી ૩૧-૦૮-૨૦૧૬	=	૨૨,૫૦,૦૦૦
૦૧-૦૯-૨૦૧૬ થી ૩૧-૧૨-૨૦૧૬	+	૮,૭૫,૦૦૦

૦૧-૦૧-૨૦૧૭ થી ૩૦-૦૪-૨૦૧૭	+	૧૫,૦૦,૦૦૦
૦૧-૦૪-૨૦૧૬ થી ૩૦-૦૪-૨૦૧૭ સુધીનું વેચાણ		૪૬,૨૫,૦૦૦
- (૨૦% નો ઘટાડો (વેચાણમાં)		૯,૨૫,૦૦૦
		૩૭,૦૦,૦૦૦

(દ) ગુમાવેલ વેચાણ - ૧૪,૨૫,૦૦૦

(B.1 /B.2 માંથી જે ઓછી હોય તે) ૧૪%

દાવાની રકમ = ગુમાવેલ વેચાણ x ઓછી ટકાવારી

= $14,25,000 \times 14/100$

= ૧,૬૬,૫૦૦

પ્રકરણ - ૮

જનરલ (સામાન્ય) ઇન્સ્યુરન્સ કંપનીઓના હિસાબો

- ૮.૧ પ્રાસ્તાવિક
- ૮.૨ વીમો એટલે શું?
- ૮.૩ વીમો કેવી રીતે કામ કરે છે?
- ૮.૪ વીમાના પ્રકાર
- ૮.૫ ભારતમાં સામાન્ય વીમા કંપનીઓ
- ૮.૬ જીવન વીમો અને સમાન્ય વીમા વચ્ચે તફાવત
- ૮.૭ વીમા કરાર
- ૮.૮ સામાન્ય વીમો લેવાની વિધિ
- ૮.૯ આચારસંહિતા
- ૮.૧૦ પુનઃ વીમો
- ૮.૧૧ મહેસુલી ખાતુ
- ૮.૧૨ ઉદાહરણ
- ૮.૧૩ સ્વાધ્યાય

પ્રકરણ - ૮

જનરલ (સામાન્ય) ઇન્સ્ટ્રુન્ઝન્સ કંપનીઓના હિસાબા

૮.૧ પ્રાસ્તાવિક :-

આજના આ આધુનિક યુગમાં માનવીએ જીવનમાં અનેક જોખમોનો સામનો કરવો પડે છે. આ જોખમોથી થતા આર્થિક નુકશાન સામે વીમો અને વીમા કંપની રક્ષણ આપે છે. મનુષ્ય પોતાના જોખમોના નુકશાન માટે સલામત રહેવા માંગે છે અને તે માટે વીમાનો ઉપયોગ જોખમોથી થતું આર્થિક નુકશાન ની ભરપાઈ કરવા માટે કરે છે.

માનવીએ પોતાના જીવનમાં અનેક જોખમોનો સામનો કરવાનો હોય છે. જેમકે માલમિલકતનું નુકશાન, મૃત્યુ, માલસામાન ચોરીથી, માલમિલકત આગમાં બળી જવી, દરિયાઈ તોફાનમાં માલનું નુકશાન થવું, મોટર અક્સમાત વગેરે જોખમો સામાન્ય છે. પરંતુ આ બધા સામે માનવી પોતાની જાતને સુરક્ષિત કરવા માટે તે વીમો લેવા માટે પ્રેરણ છે.

૮.૨ વીમો એટલે શું?

વીમો એ વીમા કંપની (ઇન્સ્ટ્રોર) અને પોલીસિ ધારક (ઇન્સ્ટ્રોક) વચ્ચેનો કારાર છે. ચોક્કસ ચુકવણી (પ્રીમીયમ) ની બદલીમાં વીમા કંપની વીમો ઉત્તરાવનારને ચોક્કસ ઘટના બનવા પર ચોક્કસ માત્રાની રકમ ચુકવવા માટે બંધાય છે.

આમ વીમો એટલે બીજું કઈ જ નહીં પરંતુ જોખમને અન્યને સોપવાની પ્રક્રિયા જેમાં જે વ્યક્તિ વીમો ઉત્તરાવે છે તે તેમના જોખમો વીમા કંપનીને તબક્કિલ કરે છે જે માટે તેમણે ચોક્કસ ચુકવણી (પ્રીમીયમ) કરવી પડે છે.

દ્વારાન રાખો :-

વીમો જે માટે ઉત્તરાવ્યો હોય તે ઘટનાને બનતી અટકાવી શકાતો નથી. વીમા હેઠળની ઘટના બનવાને પરિણામે થતા નુકશાન સામે તે માત્ર વળતર પુરુ પાડી શકે છે.

૮.૩ વીમો કેવી રીતે કામ કરે છે?

વીમો જોખમોથી થતા આર્થિક નુકશાનની ભરપાઈ કરી આપે છે. એટલે વીમો આર્થિક નુકશાન સામે રક્ષણ આપે છે. ઘણા વ્યક્તિઓ વીમો લે છે અને વીમા કંપની વીમો ઉત્તરાવાના બદલામાં નુકશાનનું વળતર આપે છે. આ નુકશાન દેણેને થતું નથી, પણ એમાંથી જે વ્યક્તિને નુકશાન થાય છે તેમને વીમા કંપની પ્રીમીયમની રકમમાંથી આર્થિક નુકશાન ભરપાઈ કરી આપે છે. આમ વીમા કંપની ઘણા વ્યક્તિઓ વચ્ચે જોખમો વહેંચી નાખે છે કે જેથી કોઈ એક વ્યક્તિને ભારે જોખમ સહન કરવું પડતું નથી.

૮.૪ વીમાના પ્રકાર :-

સામાન્ય રીતે વીમાના બે પ્રકાર પાડી શકાય.

- (અ) જીંદગીનો વીમો:- જીંદગીમાં મરણ પછી કે નક્કી કરેલ મુદ્દત પૂરી થતા વીમાની રકમ ચુકવવી જ પડે છે એટલે વર્ષને અંતે જ્યારે વીમા કંપનીઓ જ્યારે ચોપડા બંધ કરે ત્યારે બધી પોલિસીનું જોખમ ચાલુ હોય એટલે જીંદગીના વીમામાં નંબો શોધી કાઢવાનું મુશ્કેલ છે.

(બ) સામાન્ય વીમો :-

નોન-લાઈફ ઇન્સચુરન્સ માર્કેટ



શાયર (આગ) ઇન્સચુરન્સ - મરીન (સમૃદ્ધ) ઇન્સચુરન્સ - અન્ય



મોટર ઇન્સચુરન્સ - પ્રોપર્ટી ઇન્સચુરન્સ - લાયાબિલિટી ઇન્સચુરન્સ - હેલ્થ ઇન્સચુરન્સ - ટ્રાવેલ ઇન્સચુરન્સ
સામાન્ય વીમો એક વર્ષની મુદતનો હોય એટલે એક વર્ષ પુરુ થાય અને જો વીમો ઉતારનારને કઈ નુકશાન ન થાય તો વીમા કંપનીને એ પોલીસી પેટે કઈ રકમ ચુકવવાની હોતી નથી એટલે વર્ષ પુરુ થાય ત્યારે જો બધા જ વીમાની મુદત પૂરી થઈ ગઈ હોય તો વીમા કંપનીને ભવિષ્યમાં કોઈ જવાબદારી રહેતી નથી અને તે પોતાના ઘંધાનો નફો સહેલાઈથી જાણી શકે છે.

૮.૫ ભારતમાં સામાન્ય વીમા કંપનીઓ :

ઇન્ડ્યૂઝિન્ડિયા ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

ઓરીએન્ટલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

ચુનાઈટ ઇન્ડિયા ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

એસ.બી.આઈ. જનરલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

રિલાયન્સ જનરલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

તાતા એચાઈજી જનરલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

આઈ.સી.આઈ.સી.આઈ. લોભાર્ડ જનરલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

ઇક્ષ્ટો ટોક્યો જનરલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

નેશનલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

એગ્રીક્લ્યુર ઇન્સચુરન્સ કંપની ઓફ ઇન્ડિયા

એલ. એન્ડ ટી. જનરલ ઇન્સચુરન્સ કંપની લિમિટેડ

૮.૬ જીવન વીમો અને સામાન્ય વીમા વચ્ચે તફાવત :-

	જીવન વીમો	સામાન્ય વીમો
૧	જીવન વીમો માનવી પોતાના જીવનના જોખમો માટે લે છે.	સામાન્ય વીમો માનવી આગ, સમૃદ્ધ, મોટર, પ્રોપર્ટી, લાયાબિલિટી, હેલ્થ ઇન્સચુરન્સ, ટ્રાવેલ વગેરેના જોખમ માટે લે છે.
૨	જીવન વીમાના જોખમ નિશ્ચિત છે, કારણકે વહેલા કે પછી મૃત્યુ તો થવાનું જ છે.	સામાન્ય વીમાના જોખમ અનિશ્ચિત છે. એક વર્ષમાં નુકશાન ન થાય તો વીમા કંપનીએ કશું ચુકવવું પડતું નથી.
૩	જીવન વીમાને બાંહેદરીનો કરાર કહી શકાય. આમાં નુકશાન વળતરના સિંક્રિંતનો ઉપયોગ થતો નથી.	સામાન્ય વીમો નુકશાન વળતરનો કરાર છે. આમાં નુકશાન જેટલાં જ નાણાં ચુકવવાનાં છે.
૪	જીવન વીમા પોલિસી ગમે ત્યારે બંધ	સામાન્ય વીમા પોલિસી ગમે ત્યારે બંધ કરાવી

	કરાવી શકાય છે અથવા શરણ કરી શકાય છે.	શકાય નહિ.
૫	જીવન વીમા પોલિસીમાં અલ્પ વીમો અને અતિલીમાના પ્રક્રિયા ઉભા થતા નથી. જેટલી રકમનો વીમો ઉત્તરાંધો હોય તેટલી રકમ વીમા કંપનીએ ચૂકવવી પડે છે.	સામાન્ય વીમા આગના કે દરિયાઈ વીમામાં અલ્પવીમો અને અતિલીમાના પ્રક્રિયા ઉભા થાય છે.
૬	જીવન વીમામાં રક્ષણ તથા ફરજીયાત બચત બંને તત્વો છે.	સામાન્ય વીમો ફક્ત જોખમો સામે રક્ષણ આપે છે.
૭	જીવન વીમો લાંબી મુદ્દનો હોય છે.	સામાન્ય વીમો એક વર્ષની મુદ્દનો હોય છે.
૮	જીવન વીમામાં ઊંભર વધવા સાથે જોખમ વધતું જાય છે છતાં પ્રિમિયમમાં ફેરફાર કરી શકતો નથી.	સામાન્ય વીમામાં જોખમો વધતા પ્રિમિયમના દર બદલાય છે.
૯	જીવન વીમામાં પ્રિમિયમ ના ભર્યું હોય તો પણ વીમો ફરી ચાલુ કરાવી શકાય.	સામાન્ય વીમામાં મુદ્દટે પ્રિમિયમ ના ભર્યું હોય તો વીમો આપોઆપ બંધ થઈ જાય છે.

૮.૭ વીમા કરાર :-

વીમામાં કરારમાં સમજૂતી સંકળાયેલી હોય છે, જેમાં વીમા કંપની પ્રીમીયમના બદલામાં ચોક્કસ પ્રકારના જોખમો સામે નાણાકીય સંરક્ષણ પ્રદાન કરવા સંમત થાય છે. કરાર સમજૂતી વીમા પોલીસીનું સ્વરૂપ ગ્રહણ કરે છે. ભારતીય કરાર ધારા, ૧૮૪૨ની જોગવાઈઓ વીમા કરારો સમગ્ર ભારતમાં તમામ કરારોનું સંચાલન કરે છે.

૮.૮ સામાન્ય વીમો લેવાની વિધિ :-

૧૮૫૯માં જીવન વીમાનો દંધો કરનાર કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તેજ રીતે તા. ૧૩-૦૫-૧૮૭૧થી ભારતમાં સામાન્ય વીમાનો દંધો કરતી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સામાન્ય વીમો કોપોરેશન ઓફ ઇન્ડિયા (General Insurance Corporation of India) નામના કોપોરેશનની સ્થાપના (જીવન વીમા કોપોરેશનની માફક) તા. ૦૧-૦૧-૧૯૭૩થી કરવામાં આવી છે. આ સામાન્ય વીમા કોપોરેશન ભારતમાં ચાર ઝોન દ્વારા વહીવટ ચલાયે છે. આ ચાર ઝોન કોલક્ટા, મુંબઈ, દિલ્હી અને ચેનાઈમાં સ્થિત છે.

કંપની દ્વારા નિયુક્ત એજન્ટ દ્વારા પ્રપોર્ટ દરખાસ્ત પત્રક ભરીને મોકલવું પડે છે. જેમાં વીમો લેનારનું નામ, સરનામુ, વીમા વસ્તુનો પ્રકાર, જોખમનો પ્રકાર, વીમા વસ્તુની કિંમત, પોલીસીની રકમ વગેરે દર્શાવવામાં આવે છે. પછી વીમા કંપની જયારે એ દરખાસ્તનો સ્વીકાર કરે અને વીમો લેનારને જાળાવે ત્યારે જાળાવ્યા મુજબ પ્રીમીયમની રકમ વીમો લેનાર ભરી દે છે અને વીમો કરાર અસ્તિત્વમાં આવે છે તે સામે કામચલાઉ કવર નોટ વીમો ઉત્તરાવનારે કોપોરેશન આપે છે અને એ કરારના આખરી સ્વરૂપ પોલિસી આપે છે.

વીમા જોખમથી વીમા વસ્તુને નુકશાન થાય ત્યારે તે કોપોરેશનને જાળાવવું પડે છે અને તે સાથે દાવાનું પત્રક ભરવું પડે છે. કંપનીનો અધિકારી તેની તપાસ કરે છે અને તપાસના અંતે નુકશાનના વળતર રૂપે પૂરૈપરી કે પ્રમાણસર રકમ (દાવાની રકમ) મંજૂર કરે છે અને તેને આધારે કંપની દાવાની રકમ વીમો લેનારને મોકલી આપે છે.

૮.૯ આચારસંહિતા :-

જનરલ ઇન્સ્ટોરન્સ કાઉન્સિલની વહીવટી સમિતિએ સામાન્ય વીમાનો ધંધો કરતી બદીજ કંપનીઓ માટે આચારસંહિતા ઘડી કાઢી છે જેથી વીમાના ધંધામાં ઉચાધોરણો જળવાઈ રહે.

સામાન્ય વીમાનો ધંધો કરતી દરેક કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેનું પાલન કરવાની બાંહેદરી આપવી પડે છે.

આચારસંહિતાના મુખ્ય નિયમો નીચે મુજબ છે.

- (૧) દરેક પ્રકારના વીમા અંગે બાકી જોખમ માટેનું અનામત રાખવું પડે છે. આ અનામત આગ અને પરચુરણ વીમાના ધંધામાં ચોખ્ખા પ્રીમીયમની આવકના ૫૦% જેટલું હોવું જોઈએ, જ્યારે દરિયાદી વીમાના ધંધામાં ચોખ્ખી પ્રીમીયમની આવકના ૧૦૦% જેટલું હોવું જોઈએ.
- (૨) દરેક કંપનીએ પોતના દેવા કરતા મિલકતો વધુ રાજવી જોઈએ આ વધારો ૩. ૫ લાખ કે ચોખ્ખી પ્રીમીયમની આવકના ૧૦% જેટલા(બે માંથી જે વધુ હોય તે)હોવો જોઈએ. આ વધારાને લધુતામ સલામતી ગાળો કહેવામાં આવે છે.
- (૩) દાવાઓ, કમિશન અને રૂપિયા પચાસથી વધુના ખર્ચ ફક્ત કોસ ચેક અને ઓર્ડર ચેકથી ચૂકવવા.
- (૪) પ્રીમીયમની રકમ જોખમ શરૂ થાય તે પહેલા જ મળી જવી જોઈએ, સિવાય કે પ્રીમીયમ અંગે બેંક ગેરંટી આપી હોય અથવા વીમો લેનારે તે અંગે પૂર્તી ડિપોઝિટ મૂકી હોય.
- (૫) વીમા કંપનીનો મહેસૂલી ખાતામાં વહીવટી ખર્ચની વિગતો નીચે મુજબ અલગ-અલગ બતાવવી: ડિરેક્ટરની ફી, પગાર, ગ્રેજ્યુઇટી, પ્રોવિલન્ટ ફંડ, મુસાફરી ખર્ચ, તાર અને ટપાલ ખર્ચ, મનોરંજન ખર્ચ, હેડ ઓફિસનો ખર્ચ, કાનુની ખર્ચ, ડિરેક્ટરને આપેલું કમિશન, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી અને ઇપામણી ખર્ચ.

૮.૧૦ પુનઃવીમો :-

એક વીમા કંપનીએ લીધેલ જોખમ ખૂબ વધુ પડતું જણાય ત્યારે વીમો કંપની પોતે લીધેલ વીમાના થોડા ભાગનું જોખમ ઓછું કરવા બીજુ વીમા કંપની સાથે જોખમ વહેચી લે ત્યારે પુનઃવીમાનો કરાર થયો ગણાય છે.

પુનઃવીમો એ મૂળ વીમાદાર અને પ્રથમ વીમા કંપની વરચેના સંબંધને અસર કરતો નથી. એટલે જો નુકશાન થાય તો વીમાવસ્તુના માલિકે પ્રથમ વીમા કંપની પાસે જ પૂરી રકમ વસૂલ કરવાની રહે છે. તે બીજુ વીમા કંપની પાસે જઈ શકતો નથી. પરંતુ પ્રથમ વીમા કંપની દાવાની રકમ ચૂકવાઈ પછી બીજુ વીમા કંપની પાસે પ્રમાણસર વળતાર મેળવી શકે છે.

પ્રથમ વીમા કંપની માટે પુનઃવીમાનું પ્રીમીયમ આવકનો ઘટાડો છે. કારણેકે તેણે પુનઃવીમો લેનાર બીજુ વીમા કંપનીને પ્રીમીયમ આપવું પડે છે. એટલે પ્રથમ કંપની પોતાના મહેસૂલી ખાતાની જમા બાજુ મળે પ્રીમીયમાંથી પુનઃવીમાનું પ્રીમીયમ બાદ બતાયે છે. પુનઃવીમા પર કમિશન પ્રથમ કંપનીને મળે છે એટલે તે કમિશન તેની આવક ગણાય છે.

બીજુ કંપની માટે પુનઃવીમાનું પ્રીમીયમ આવક છે. જ્યારે પુનઃવીમાનું કમિશન તેણે આપવું પડે છે. એટલે તેનો ખર્ચ છે. એક જ કંપની પુનઃવીમો આપે પણ ખરી અને સ્વીકારે પણ ખરી. એટલે તે કંપનીને પુનઃવીમાનું પ્રીમીયમ મળે પણ ખરુ અને તેણે પુનઃવીમાનું પ્રીમીયમ ચુકવવું પણ પડે. તે જ રીતે પુનઃવીમા પરનું પ્રીમીયમ મળે તો તેના પર કમિશન ચુકવવું પડે અને પુનઃવીમા પરનું પ્રીમીયમ ચુકવવું પડે તો તેના પર કમિશન મળે પણ ખરુ.

૮.૧૧ મહેસૂલી ખાતુ :-

જુદા જુદા પ્રકારના વીમાનો ધંધો કરતી કંપનીએ દરેક પ્રકારના ધંધા માટે જુદું મહેસુલી ખાતું બનાવાનું હોય છે. સામાન્ય વીમા અંગેનું મહેસુલી ખાતું તે વિભાગનું નફાનુક્ષણ ખાતું છે. આ ખાતામાં ચાલુ વર્ષના ખર્ચ અને ચાલુ વર્ષની આવક લખવામાં આવે છે. વીમાના કાયદામાં સામાન્ય વીમા કંપનીના મહેસુલી ફોર્મ B-RA નીચે મુજબ આપવામાં આવ્યું છે.

ફોર્મ B-RA (મહેસુલી ખાતાનો નમૂનો)

.....વિમા કં. લિ. નું તા. ૩૧મી માર્ચ, ૨૦..... ના રોજ પૂરા થતા વર્ષનું મહેસુલી ખાતુ (..... વિભાગ)

વિગતો	પરિશીષ્ટ	ચાલુ વર્ષ (ઝ.)	પાછલા વર્ષ (ઝ.)
૧. કમાયેલ પ્રીમીયમ (ચોખ્જું)	૧		
૨. અન્ય (વિગતો જણાવવી)			
૩. બાકી જોખમ માટેની જોગવાઈઓમાં ફેરફાર			
૪. વ્યાજ, ડિપિડન્ડ, બાહું (કુલ)			
કુલ (અ)			
૧. ચૂક્યેલ દાવાઓ (ચોખા)	૨		
૨. કમિશન	૩		
૩. વીમાના ધંધાને લગતા કામગીરી (વહીવટી) ખર્ચ	૪		
૪. અન્ય (વિગતો જણાવવી)			
કુલ (બ)			
કામગીરી નફો- આગાના વિમા નો દરિયાઈ / સામાન્ય વિમા નો (અ-બ)			

પરિશીષ્ટના નમૂના :-

પરિશીષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખ્જું)

વિગત	(ઝ.)
મળેલ પ્રીમીયમ	
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	
પ્રીમીયમ બાકી ૩૧-૧૨-૨૦૧૭	
(-) આપેલ પુનઃવીમા પ્રીમીયમ	
પ્રીમીયમ બાકી ૩૧-૧૨-૨૦૧૯	
ચોખ્જું પ્રીમીયમ	
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે	
વર્ષની આખર બાકી	
પ્રીમીયમના ૫૦%	
(+) વધારાનું અનામત	
(-) વર્ષની શરૂઆતની બાકીઓ	
બાકી જોખમ માટેનું અનામત	

(+) વધારાનું અનામત		
કુલ કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખું)		

પરિશિષ્ટ-૨ ચૂકવેલ દાવાઓ (ચોખ્ખા)

વિગત	(ઝ.)
ચૂકવેલ દાવાઓ (ચોખ્ખા)	
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના	
(-) રિ-ઇન્સયુરન્સ વસુલાત	
(-) ચૂકવવાના બાકી ૩૧-૦૩-૨૦૧૮ના	
કાનુની ખર્ચ	
કુલ ચૂકવેલ દાવાઓ (ચોખ્ખા)	

પરિશિષ્ટ-૩ કમિશન

વિગત	(ઝ.)
કમિશન	
(+) સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	
(-) આપેલ પુનઃવીમા પર કમિશન	
કુલ કમિશન	

પરિશિષ્ટ-૪ વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ

વિગત	(ઝ.)
વહીવટી ખર્ચ	
(+) આગ બુકવવાનો ખર્ચ	
ઓડિટ ફી	
સ્ટાફનોપગાર	
સ્ટેશનરી, તાર- ટપાલ વગેરે	
સામાન્ય વહીવટી ખર્ચ	
કુલ	

ફોર્મ B-PL (નક્ષા-નુકશાન ખાતાનો નમુનો)

૩૧મી માર્ચ, ૨૦.....ના રોજ પૂરા થતા વર્ષનું નક્ષા-નુકશાન ખાતુ

વિગતો	(૩.)
૧. કામગીરી નક્ષો/(ખોટ): (અ) આગનો વીમો (બ) દરિયાઈ વીમો (ક) પસ્તુરણ વીમો	
૨. રોકાણોની આવક: (અ) વ્યાજ, ડિવિડન અને ભાડું (કુલ) (બ) રોકાણો વેચાણ પર નક્ષો બાદ: રોકાણો વેચાણ પર ખોટ	
૩. અન્ય આવકો: (વિગતો જણાવવી) કુલ (અ)	
૪. જોગવાઈઓ (કરવેરા સિવાયની) (અ) રોકાણોના મૂલ્યમાં ઘટાડા માટે (બ) અન્ય (વિગતો જણાવવી)	
૫. અન્ય ખર્ચો: (અ) વીમાના ધંધા સિવાયના ખર્ચ (બ) અન્ય (વિગતો જણાવવી) કુલ (બ)	
કરવેરા પહેલાનો નક્ષો	
કરવેરાની જોગવાઈ	
કરવેરા બાદનો નક્ષો	
બાદ: સંકટ માટેનું અનામત	
ફાળવણી માટે ભળી શકતો નક્ષો	
નક્ષાની ફાળવણી: (અ) વર્ષ દરમિયાન ચૂકવેલ વચ્ચગાળાનું ડિવિડન (બ) સૂચિત આખરી ડિવિડન (ક) ડિવિડન વહેંચણી પરનો ટેક્ષ (દ) કોઈપણ અનામત ખાતે કે અન્ય ખાતે કેરબદલી કરેલ રકમ	
પાછલા વર્ષમાંથી આગળ લાવેલ નક્ષો/ખોટ બાકી પાકા સરવૈચામાં લઈ ગયેલ બાકી.	

૮.૧૨ ઉદાહરણો

પ્ર.૧ ઘી વિધાનગર જનર ઇન્સયુરન્સ કેં. લિ. ના આગ વિભાગનું મહેસૂલી ખાતું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ નીચે મુજબ વિગતો દ્વારાનમાં લીધા વિના રૂ.૧૦૦૦૦૦૦૦નો નફો બતાવે છે.

	વિગત	રૂ.
(૧)	પ્રીમીયમના મળવાના બાકી	૧૪૦૦૦૦
(૨)	પુનઃવીમાની બાકી વસુલાત	૧૨૦૦૦૦
(૩)	જમીનગારી પર ચઢેલું વ્યાજ (ખર્ચ બાદ)	૮૦૦૦૦
(૪)	એજન્ટનું બાકી કનિશાન	૫૦૦૦૦
(૫)	પ્રીમીયમના ઘટાડા પેટે આપેલ બોનસ	૪૦૦૦૦
(૬)	રજુ થયેલ, પણ નહીં ચુકવેલ દાવાઓ	૧૮૦૦૦૦

ઉપરની વિગતો નોંધ્યા પછી નફો પર શી અસર થશે તે જણાવો.

જવાબ-૧

	વિગત	રૂ.	રૂ.
મહેસૂલી ખાતા પ્રમાણે નફો			૧૦૦૦૦૦૦
(+) ઉમેરો			
વ્યાજ		૮૦૦૦૦	
બાકી પ્રીમીયમ		૧૪૦૦૦૦	
પુનઃવીમાની બાકી વસુલાત		૧૨૦૦૦૦	
પ્રીમીયમ (બોનસના ઘટાડા પેટે આપેલ)		૪૦૦૦૦	૩૮૦૦૦૦
			૧૩૮૦૦૦૦
(-) બાદ			
નહિ ચુકવેલ દાવાઓ		૧૮૦૦૦૦	
એજન્ટનું બાકી કનિશાન		૫૦૦૦૦	
બોનસ (પ્રીમીયમના ઘટાડા પેટે)		૪૦૦૦૦	
બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર		૬૦૦૦૦	૩૭૦૦૦૦
રૂ. ૧૮૦૦૦૦ @ ૫૦%			
	સુધેરેલ નફો		૧૦૧૦૦૦૦

પ્ર. ૨ દી આણંદ જનરલ ઇન્સ્યુરન્સ કૂં. લિ. ની તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ આગના વીમા વિભાગની નીચે મુજબની વિગતો હતી.

વિગતો	રૂ.
બાકી જોખમ માટેનું અનામત (તા. ૩૧-૦૩-૨૦૧૮)	૨૫૦૦૦૦
વધારાનું અનામત (તા. ૩૧-૦૩-૨૦૧૮)	૫૦૦૦૦
ચૂક્યેલ દાવાઓ	૩૦૪૦૦૦
ચૂક્યવાના બાકી દાવાઓ:	
તા. ૩૧-૦૩-૨૦૧૮ના રોજ	૩૨૫૦૦
તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ	૪૫૦૦૦
વહીવટી ખર્ચ (આમાં ચૂક્યેલ દાવાઓ અંગેના કાનુની ખર્ચના રૂ. ૧૫૦૦૦ નો સમાવેશ થાય છે.)	૧૪૦૦૦૦
આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૩૭૫૦૦
પુનઃવીમાના દાવાઓમાંથી મળેલ રકમ	૧૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમાના દાવા	૧૫૦૦૦
મળેલ પ્રીમીયમ	૫૪૦૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ (ગ્રોસ)	૩૨૨૯૦
ઉપરની રકમ પર ઈન્કમ ટેક્ષ	૩૨૯૦
રોકાણોના વેચાણ પર થયેલ નફી	૫૫૦૦
કમિશન	૭૫૦૦૦
સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦

વર્ષ દરમિયાન મળેલ પ્રીમીયમની આવકના ૫૦% બાકી જોખમ માટે અનામત રાખો અને બીજુ વધારાનું અનામત રૂ. ૫૦૦૦૦ રાખો. ઉપરની વિગતો પરથી આગના વિમું મહેસુલી ખાતુ પ્રણાલિકાગત પક્ષતિ પ્રમાણે તથા ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ-૨

(પ્રણાલિકાગત પદ્ધતિ)

દી આણંદ જનરલ ઇન્સ્યુરન્સ કૂં. લિ. ના ચોપડામાં

તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું આગના વિમું મહેસુલી ખાતુ

વિગતો	રૂ.	વિગતો	રૂ.
ચૂક્યેલ દાવાઓ	૩૦૪૦૦૦	વર્ષની શરૂઆતની બાકીઓ	
(-) પુનઃવીમાના પેટે મળેલ રકમ	૧૦૦૦૦	બાકી જોખમ માટેનું અનામત	૨૫૦૦૦૦
	૨૯૪૦૦૦	(+) વધારાનું અનામત	૫૦૦૦૦ ૩૦૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાના દાવા	૧૫૦૦૦	મળેલ પ્રીમીયમ	૫૪૦૦૦૦
(+) કાનુની ખર્ચ	૧૫૦૦૦	(-) આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૩૭૫૦૦
	૩૨૪૦૦૦		૫૦૨૫૦૦

(-) ચૂકવવાના બાકી તા. ૩૧-૦૩-૨૦૧૫ના	૩૨૫૦૦		(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦	૫૨૨૫૦૦
(+) ચાલુ વર્ષના બાકી તા. ૩૧-૦૩-૨૦૧૭ના	૪૫૦૦૦	૩૩૭૫૦૦	વ્યાજ અને ડિવિડન્ડ	૩૨૨૫૦	
વહીવટી ખર્ચ	૧૪૦૦૦૦		(-) ઇન્કમ ટેક્શ	૩૨૫૦	૨૬૦૦૦
(-) કાનુની ખર્ચ	૧૫૦૦૦	૧૨૫૦૦૦	રોકાણોના વેચાણ પર થયેલ નફો		૫૫૦૦
કમિશન		૭૫૦૦૦			
નફો-નુકશાન ખાતુ (નફો)		૭૨૫૦			
વર્ષની આજરણી બાકીઓ					
બાકી જોખમ માટેનું અનામત પ્રીમીયમના ૫૦%	૨૬૧૨૫૦				
(+) વધારાનું અનામત	૫૦૦૦૦	૩૧૧૨૫૦			
		૮૫૭૦૦૦			૮૫૭૦૦૦

(ઉભા સ્વરૂપે)

દી આણંદ જનરલ ઇન્સયુરન્સ કૂં. લિ. નું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું મહેસુલી ખાતુ
(આગ વિભાગ)

વિગત	પરિશિષ્ટ	(૩.)
કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખુ)	૧	૫૧૧૨૫૦
રોકાણોના વેચાણ પર થયેલ નફો		૫૫૦૦
વ્યાજ અને ડિવિડન્ડ		૩૨૨૫૦
(-) ઇન્કમટેક્શ		૩૨૫૦
કુલ (અ)		૫૪૫૭૫૦
ચૂકવેલ દાવાઓ (ચોખ્ખુ)	૨	૩૩૭૫૦૦
કમિશન	૩	૭૫૦૦૦
વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ	૪	૧૨૫૦૦૦
કુલ (બ)		૫૩૮૫૦૦
કામગીરી નફો-નુકશાન ખાતે (અ-બ)		૭૨૫૦

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખુ)

મળેલ પ્રીમીયમ	૫૪૦૦૦૦	
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦	
	૫૫૦૦૦૦	
(-) આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૩૭૫૦૦	

ચોખ્ખુ પ્રીમીયમ		પ્રેરણ ૫૦૦
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે		
વર્ષની આજર બાકી		
પ્રીમીયમના ૫૦%	૨૭૧૨૫૦	
(+) વધારાનું અનામત	૫૦૦૦૦	
	૩૧૧૨૫૦	
(-) વર્ષની શરૂઆતની બાકીઓ		
બાકી જોખમ માટેનું અનામત	૨૫૦૦૦૦	
(+) વધારાનું અનામત	૫૦૦૦૦	
	૩૦૦૦૦૦	૧૧૨૫૦
કુલ કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખુ)		૫૧૧૨૫૦

પરિશિષ્ટ-૨ ચૂકવેલ દાવાઓ (ચોખા)

ચૂકવેલ દાવાઓ (ચોખા)		પ્રેરણ ૫૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાના દાવા	૧૫૦૦૦	
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના	૪૫૦૦૦	
(+) કાનુની ખર્ચ	૧૫૦૦૦	
	૭૫૦૦૦	૩૮૦૦૦૦
(-) પુનઃવીમા પેટે ભળેલ રમક	૧૦૦૦૦	
(-) ચૂકવવાના બાકી ૩૧-૦૩-૨૦૧૯ના	૩૨૫૦૦	
કુલ ચૂકવેલ દાવાઓ (ચોખા)	૪૨૫૦૦	૩૩૭૫૦૦

પરિશિષ્ટ-૩ કમિશન

કમિશન		પ્રેરણ ૫૦૦
-------	--	------------

પરિશિષ્ટ-૪ વીમાના દંડાને લગતા કામગીરી ખર્ચ

વહીવટી ખર્ચ	પ્રેરણ ૫૦૦	
(-) કાનુની ખર્ચ	૧૫૦૦૦	૧૨૫૦૦૦

પ્ર.૩ ન્યુ ઇન્ડિયા ઇન્સયરન્સ કં. લિ. તા. ૩૧મી માર્ચ, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની પોતાના આગ હિસાબ અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે.

વિગતો	રૂ.
તા. ૩૧-૦૩-૨૦૧૫ના રોજ બાકી જોખમ માટે અનામત	૩૨૦૦૦૦
બાકી દાવા અંગેની જવાબદારી:	
તા. ૩૧-૦૩-૨૦૧૫	૪૦૦૦૦
તા. ૩૧-૦૩-૨૦૧૭	૫૦૦૦૦
આગ લુકાવવાનો ખર્ચ	૪૦૦૦
ચૂક્ખેલ દાવા	૨૮૦૦૦૦
પુનઃવીમા પ્રીમીયમ	૧૮૦૦૦
પુનઃવીમાના મખ્યા	૫૦૦૦
મળેલ પ્રીમીયમ	૭૨૦૦૦૦
સીધા વેપાર પર કમિશન	૧૦૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	૬૦૦૦
આપેલ પુનઃવીમા પર કમિશન	૫૦૦૦
વ્યાજ અને ડિવિડન	૫૦૦૦૦
ઉપરની આવક પર કપાયેલ કર	૨૮૦૦૦
રોકાણોના વેચાણ પર નફો	૭૦૦૦
તા. ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજનું વધારાનું અનામત	૨૪૦૦૦૦

વહીવટી ખર્ચ રૂ. ૧૮૦૦૦૦ અને કાનુની ખર્ચ રૂ. ૭૦૦૦ છે. વધારાનું અનામત, પ્રીમીયમ બાદ પુનઃવીમાના ૧૦%થી વધારવાનું છે. બાકી જોખમ માટેનું અનામત પ્રીમીયમ બાદ પુનઃવામાના ૫૦% જેટલું રાખવાનું છે.

ઉપરની વિગતો પરથી આગાના વિમું મહેસુલી ખાતુ ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ-૩:

(ઉભા સ્વરૂપે)

ન્યુ ઇન્ડિયા ઇન્સયરન્સ કં. લિ. નું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું મહેસુલી ખાતુ (આગ વિભાગ)

વિગત	પરિશિષ્ટ	(રૂ.)
કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખુ)	૧	૫૦૦૮૦૦
રોકાણોના વેચાણ પર થખેલ નફો		૭૦૦૦
વ્યાજ અને ડિવિડન		૫૦૦૦૦
(-) ઇન્કમટેક્ષ		૨૮૦૦૦
કુલ (અ)		૫૩૮૮૦૦
ચૂક્ખેલ દાવાઓ (ચોખ્ખા)	૨	૨૬૪૦૦૦
કમિશન	૩	૧૦૪૦૦૦
વીમાના ઘંધાને લગતા કામગીરી ખર્ચ	૪	૧૮૪૦૦૦
કાનુની ખર્ચ		૭૦૦૦
કુલ (બ)		૫૮૬૦૦૦
કામગીરી નફો નુકશાન ખાતે (અ-બ)		૫૦૮૦૦

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખુ)

મળેલ પ્રીમીયમ	૭૨૦૦૦૦	
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૧૮૦૦૦	
ચોખુ પ્રીમીયમ		૭૦૨૦૦૦
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે		
વર્ષની આખર બાકી		
પ્રીમીયમના ૫૦%	૩૫૧૦૦૦	
(+) વધારાનું અનામત	૩૧૦૨૦૦	
	૫૬૧૨૦૦	
(-) વર્ષની શરૂઆતની બાકીઓ		
બાકી જોખમ માટેનું અનામત	૩૨૦૦૦૦	
(+) વધારાનું અનામત	૨૪૦૦૦૦	
	૫૬૦૦૦૦	૧૦૧૨૦૦
કુલ કમાયેલ પ્રીમીયમ (ચોખુ)		૫૦૦૮૦૦

પરિશિષ્ટ-૨ ચૂક્યેલ દાવાઓ (ચોખા)

ચૂક્યેલ દાવાઓ (ચોખા)		૨૮૦૦૦૦
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના		૫૦૦૦૦
		૩૪૦૦૦૦
(-) પુનઃવીમાન પેટે મળેલ રકમ		૫૦૦૦
(-) ચૂક્યવાના બાકી ૩૧-૦૩-૨૦૧૫ના		૪૦૦૦૦
કુલ ચૂક્યેલ દાવાઓ (ચોખા)		૨૬૪૦૦૦

પરિશિષ્ટ-૩ કમિશન

કમિશન		૧૦૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન		૬૦૦૦
(-) આપેલ પુનઃવીમા પર કમિશન		૫૦૦૦
કુલ કમિશન		૯૦૪૦૦૦

પરિશિષ્ટ-૪ વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ

વહીવટી ખર્ચ		૧૮૦૦૦૦
(+) આગ બુકાવવાનો ખર્ચ		૪૦૦૦
કુલ		૧૮૪૦૦૦

પ્ર.૪ (SPU-March-૨૦૧૮)

નીચેની વિગતો પરથી નીમો ઈન્સ્યુરન્સ કે. લિ. નું આગના વિભાગ માટે મહેસુલી ખાતું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષ માટે તैયાર કરો.

	વિગતો	રૂ.
(૧)	ભાવિ જોખમ માટેનું અનામત (૦૧-૦૪-૨૦૧૬)	૧૦૭૫૦૦૦
	વધારાનું અનામત (૦૧-૦૪-૨૦૧૬)	૧૨૫૦૦૦
(૨)	મળેલ પ્રીમીયમ	૨૪૬૦૦૦૦
(૩)	ચૂકવવાના બાકી દાવાઓ:	
	૦૧-૦૪-૨૦૧૬	૧૦૦૦૦
	૩૧-૦૩-૨૦૧૭	૨૦૦૦૦
(૪)	ચૂકવેલ દાવાઓ	૮૦૦૦૦૦
(૫)	આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦
(૬)	વસુલાત	૫૦૦૦૦
(૭)	સ્વીકારેલ પુનઃવીમા દાવા	૧૫૦૦૦
(૮)	સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૩૦૦૦૦
(૯)	કમિશન સીધા ધંધા પર	૨૧૦૦૦૦
(૧૦)	કમિશન સ્વીકારેલ પુનઃવીમા પર	૫૦૦૦૦
(૧૧)	કમિશન આપેલ પુનઃવીમા પર	૨૦૦૦૦
(૧૨)	કાનુની ખર્ચા (રૂ. ૨૫૦૦૦ દાવા અંગે)	૩૫૦૦૦
(૧૩)	વહીવટી ખર્ચા	૫૦૦૦૦૦
(૧૪)	અન્ય આવક	૧૫૦૦૦૦
(૧૫)	અન્ય ખર્ચા	૪૦૦૦૦

ભાવિ જોખમનું અનામત આચારસંહિતા મુજબ રાખવાનું છે, જ્યારે વધારાનું અનામત ચોખા પ્રીમીયમના ૧% જેટલું ઘટાડવાનું છે.

જવાબ-૪:

(પ્રણાલિકાગત પદ્ધતિ)

નીમો ઈન્સ્યુરન્સ કે. લિ. ના ચોપડામાં

તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું આગના વીમાનું મહેસુલી ખાતું

ઉધાર

જમા

વિગતો	રૂ.	રૂ.	વિગતો	રૂ.	રૂ.
દાવાઓ			વર્ષની શરૂઆતની બાકીઓ		
ચૂકવેલ	૮૦૦૦૦૦		બાકી જોખમ માટેનું અનામત	૧૦૭૫૦૦૦	
(-) ચૂકવવાના બાકી ૩૧-૦૩-૨૦૧૬ના	૧૦૦૦૦		(+) વધારાનું અનામત	૧૨૫૦૦૦	૧૨૦૦૦૦૦
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના	૨૦૦૦૦		મળેલ પ્રીમીયમ		
	૮૧૦૦૦૦		સીધા ધંધા	૨૪૬૦૦૦૦	

(+) સ્વીકારેલ	૧૫૦૦૦		(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૩૦૦૦૦	
(-) વસુલાત	૫૦૦૦૦		(-) આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦	૨૫૦૦૦૦૦
	૭૭૫૦૦૦		અન્ય આવકો		૧૫૦૦૦૦
(+) કાનુની ખર્ચ	૨૫૦૦૦	૮૦૦૦૦૦			
કમિશન					
સીધા ધંધા	૨૧૦૦૦૦				
(+) સ્વીકારેલ	૫૦૦૦૦				
	૨૭૦૦૦૦૦				
(-) આપેલ	૨૦૦૦૦	૨૫૦૦૦૦			
વહીવટી ખર્ચ		૫૦૦૦૦૦			
કાનુની ખર્ચ		૧૦૦૦૦			
અન્ય ખર્ચ		૪૦૦૦૦			
બાકી જોખમ માટેનું					
અનામત					
પ્રીમીયમના ૫૦%	૧૨૫૦૦૦૦				
(+) વધારાનું અનામત	૧૦૦૦૦૦	૧૩૪૦૦૦૦			
નફો		૮૦૦૦૦૦			
	૩૮૫૦૦૦૦				૩૮૫૦૦૦૦

(ઉભા સ્વરૂપે)

નીમો ઈન્સયુરન્સ કૂ. લિ. ના ચોપડામાં

તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું મહેસુલી ખાતુ (આગ વિભાગ)

વિગત	પરિશિષ્ટ	(ઝ.)
કમાચેલ પ્રીમીયમ (ચોખુ)	૧	૨૫૦૦૦૦૦
(-) અનામત માટે હવાલો		૧૫૦૦૦૦
વ્યાજ અને ડિવિડન		-----
અન્ય આવકો		૧૫૦૦૦૦
કુલ (અ)		૨૫૦૦૦૦૦
ચૂક્ખેલ દાવાઓ (ચોખા)	૨	૮૦૦૦૦૦
કમિશન	૩	૨૫૦૦૦૦
વહીવટી ખર્ચ	૪	૫૦૦૦૦૦
અન્ય ખર્ચ		૪૦૦૦૦
કાનુની ખર્ચ		૧૦૦૦૦
કુલ (બ)		૧૭૦૦૦૦૦
કામગીરી નફો-નુકશાન ખાતે (અ-બ)		૮૦૦૦૦૦

અનામત માટે હવાલો:

શરૂઆતની બાકીઓ: $(1074000 + 124000) = 1200000$

આખરની બાકીઓ: $(1240000 + 100000) = 1340000$

હવાલો (-140000)

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખુ)

પ્રીમીયમ	
સીધા ધંધા	૨૪૦૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	30000
	૨૫૩૦૦૦૦
(-) આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦
ચોખુ પ્રીમીયમ	૨૫૦૦૦૦૦

પરિશિષ્ટ-૨ ચૂક્યેલ દાવાઓ (ચોખા)

ચૂક્યેલ દાવાઓ	૮૦૦૦૦૦
(-) ચૂક્યાવાના બાકી ૩૧-૦૩-૨૦૧૫ના	૧૦૦૦૦
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના	૨૦૦૦૦
	૮૧૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાના	૧૫૦૦૦
	૮૨૫૦૦૦
(-) આપેલ પુનઃવીમાના પેટે	૫૦૦૦૦
	૭૭૫૦૦૦
(+) કાનુની ખર્ચા	૨૫૦૦૦
કુલ ચૂક્યેલ દાવાઓ (ચોખા)	૮૦૦૦૦૦

પરિશિષ્ટ-૩ કમિશન

સીધા ધંધા	૨૧૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાનું	૫૦૦૦૦
	૨૭૦૦૦૦
(-) આપેલ પુનઃવીમાનું	૨૦૦૦૦
	૨૫૦૦૦૦

પરિશિષ્ટ-૪ વહીવટી ખર્ચા

વહીવટી ખર્ચા	૫૦૦૦૦૦
--------------	--------

પ્ર.૫ (SPU-March-૨૦૧૮)

ચોકસી ઇન્સયુરન્સ કે. લિ. તા. ૩૧મી માર્ચ, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની પોતાના સમુક્ર ધંધા અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે. મહેસુલી ખાતું તૈયાર કરો.

	વિગતો	સીધા ધંધા અંગે રૂ.	પુનઃવીમા અંગે રૂ.
(૧)	દાવાઓ		
	ચૂકવેલ	૧૧૦૦૦૦૦	૩૦૦૦૦૦
	મળેલ	-----	૨૦૦૦૦૦
(૨)	પ્રીમીયમ		
	મળેલ	૪૦૦૦૦૦૦	૭૦૦૦૦૦૦
	ચૂકવેલ	-----	૨૦૦૦૦૦
(૩)	કમિશન		
	ચૂકવેલ	૪૬૨૦૦	૧૩૦૦૦
	મળેલ	-----	૨૫૦૦૦
	અન્ય માહિતી		
(૪)	વહીવઠી ખર્ચ		૩૩૪૦૦૦
(૫)	વ્યાજ અને ડિવિડન		
	ગ્રોસ		૧૦૦૦૦૦
	ટી.ડી.એસ.		૧૦%
(૬)	અન્ય આવક		૧૦૦૦૦
(૭)	અન્ય ખર્ચ		૧૬૦૦૦
(૮)	ભાવિ જોખમ માટેનું અનામત (૦૧-૦૪-૨૦૧૯)		૩૪૦૦૦૦૦
	વધારાનું અનામત (૦૧-૦૪-૨૦૧૯)		૩૪૦૦૦૦

ભાવિ બાકી જોખમ માટેનું અનામત ચોખા પ્રીમીયમના ૧૦૦% જેટલું રાખવાનું છે જ્યારે વધારાનું અનામત ચોખા પ્રીમીયમના ૧૦% જેટલું રાખવાનું છે.

જવાબ-૫: (પ્રણાલિકાગત પદ્ધતિ)

ચોકસી ઇન્સયુરન્સ કે. લિ.

તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું સમુક્ર ધંધાનું મહેસુલી ખાતું

વિગતો		રૂ.	વિગતો		રૂ.
દાવાઓ			વર્ષની શરૂઆતની બાકીઓ		
સીધા ધંધા	૧૧૦૦૦૦૦		બાકી જોખમ માટેનું અનામત	૩૪૦૦૦૦૦	
(+) સ્વીકારેલ	૩૦૦૦૦૦		(+) વધારાનું અનામત	૩૪૦૦૦૦	૩૮૪૦૦૦૦
	૧૪૦૦૦૦૦		મળેલ પ્રીમીયમ		
(-) આપેલ	૨૦૦૦૦૦	૧૨૦૦૦૦૦	સીધા ધંધા	૪૦૦૦૦૦૦	
કમિશન			(+) સ્વીકારેલ	૭૦૦૦૦૦	

सीधा धंधा	₹५२०००			₹७०००००	
(+) स्वीकारेल	₹३०००		(-) आपेल	₹०००००	₹४०००००
	₹४५०००		व्याज अने डिविडन्ड		
(-) आपेल	₹५०००	₹५०००००	ओस	₹१०००००	
वहीवटी खर्चा		₹३४०००	(-) टी.डी.ओ.एस.	₹१००००	₹०००००
अन्य खर्चा		₹१५०००	अन्य आवकी		₹१००००
बाकी जोखम माटेनुं					
अनामत					
प्रीभीयमना १००%	₹४०००००				
(+) वधारानुं	₹४००००	₹६५००००			
अनामत					
नक्षे		₹१५०००००			
कुल		₹४५००००	कुल		₹४५००००

(उभा स्वरूपे)

चोकसी इन्स्युरन्स कं. लि.

ता. ३१-०३-२०१७ના રોજ પુરા થતા વર્ષનું સમુદ્ધ ધંધાનું મહેસુલી ખાતુ

વિગત	પરિશિષ્ટ	(ઝ.)
કુમારેલ પ્રીભીયમ (ચોખ્ખુ)	१	₹४०००००
(-) અનામત માટે હવાલો		₹१०००००
व्यાજ અને ડિવિડન્ડ		-----
ଓસ		₹१०००००
(-) ટી.ડી.ଓ.એ.સ.		₹०००००
અન્ય આવકી		₹१००००
કુલ (અ)		₹४०००००
ચૂકવેલ દાવાઓ (ચોખ્ખા)	૨	₹१२०००००
કુમિશન	૩	₹४००००
વહીવટી ખર્ચા	૪	₹३४०००
અન્ય ખર્ચા		₹१५०००
કુલ (બ)		₹२००००००
કામગીરી નક્ષે નક્ષા-નુકશાન ખાતે (અ-બ)		₹१५०००००

અનામત માટે હવાલો

શરૂઆતની બાકીઓ: $(3400000 + 340000) = 3740000$

આજરની બાકીઓ: $(4000000 + 400000) = 4400000$
હવાલો (-1100000)

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખુ)

પ્રીમીયમ	
સીધા ધંધા	૪૦૦૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૭૦૦૦૦૦
	૪૭૦૦૦૦૦
(-) આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦૦
ચોખુ પ્રીમીયમ	૪૫૦૦૦૦૦

પરિશિષ્ટ-૨ ચૂક્યેલ દાવાઓ (ચોખા)

સીધા ધંધા	૧૧૦૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાના	૩૦૦૦૦૦
	૧૪૦૦૦૦૦
(-) આપેલ પુનઃવીમાના પેટે	૨૦૦૦૦૦
	૧૨૦૦૦૦૦

પરિશિષ્ટ-૩ કમિશન

સીધા ધંધા	૪૫૨૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાનું	૧૩૦૦૦
	૪૭૫૦૦૦
(-) આપેલ પુનઃવીમાનું	૨૫૦૦૦
	૪૫૦૦૦૦૦

પરિશિષ્ટ-૪ વહીવટી ખર્ચ

વહીવટી ખર્ચ	૩૩૪૦૦૦
-------------	--------

પ્ર.૬ ઓરિએન્ટલ ઈન્સયરન્સ કે. લિ. તા. ૩૧મી માર્ચ, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની પોતાના સમુદ્ર વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે.

વિગતો	રૂ.
તા. ૩૧-૦૩-૨૦૧૫ના બાકી જોખમ માટે અનામત	૩૩૭૫૦૦
બાકી દાવા અંગેની જવાબદારી:	
તા. ૩૧-૦૩-૨૦૧૫	૨૪૩૭૫
તા. ૩૧-૦૩-૨૦૧૭	૩૩૭૫૦

ચૂક્યેલ દાવા	૨૪૦૦૦૦
પુનઃવીમા પ્રીમીયમ	૬૦૦૦
પુનઃવીમાના મળ્યા	૪૫૦૦
મળેલ પ્રીમીયમ	૩૭૦૦૦૦
સીધા વેપાર પર કમિશન	૫૮૫૦૦
સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	૩૨૫૦૦
આપેલ પુનઃવીમા પર કમિશન	૩૫૦૦૦
વ્યાજ અને ડિવિડન	૨૪૦૦૦
ઉપરની આવક પર કપાયેલ કર	૮૫૦૦
રોકાણોના વેચાણ પર નફો	૪૧૨૫૦
તા. ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજનું વધારાનું અનામત	૩૭૫૦૦

વહીવટી ખર્ચ રૂ. ૬૦૦૦૦ અને કાનુની ખર્ચ રૂ. ૩૫૦૦ છે. વધારાનું અનામત, પ્રીમીયમ બાદ પુનઃવીમાના ૧૦%થી વધારવાનું છે. બાકી જોખમ માટેનું અનામત પ્રીમીયમ બાદ પુનઃવીમાના ૧૦૦% જેટલું રાખવાનું છે.

ઉપરની વિગતો પરથી સમુક્ષ વિમું મહેસુલી ખાતું ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ-ક્ર:

(ઉભા સ્વરૂપે)

ઓફિસિએન્ટલ ઇન્સિયુરન્સ કૂ. લિ. નું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું
મહેસુલી ખાતું (સમુક્ષ વિભાગ)

વિગત	પરિશિષ્ટ	(રૂ.)
કમાયેલ પ્રીમીયમ (ચોખ્યુ)	૧	૩૦૨૪૦૦
રાકોણોના વેચાણ પર થયેલ નફો		૪૧૨૫૦
વ્યાજ અને ડિવિડન		૨૪૦૦૦
(-) ઇન્કમટેક્ષ		૮૫૦૦
કુલ (અ)		૩૪૬૧૫૦
ચૂક્યેલ દાવાઓ (ચોખ્યા)	૨	૨૪૪૮૭૫
કમિશન	૩	૫૭૦૦૦
વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ	૪	૬૦૦૦૦
કાનુની ખર્ચ		૩૫૦૦
કુલ (બ)		૩૬૫૩૭૫
કામગીરી નફો નફો-નુકશાન ખાતે (અ-બ)		૩૯૨૨૫

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખ્યુ)

મળેલ પ્રીમીયમ		350000
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ		€000
ચોખ્યુ પ્રીમીયમ		341000
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે		
વર્ષની આખરની બાકી		
પ્રીમીયમના ૧૦૦%	341000	
(+) વધારાનું અનામત	72500	
	423500	
(-) વર્ષની શરૂઆતની બાકીઓ		
બાકી જોખમ માટેનું અનામત	337400	
(+) વધારાનું અનામત	37400	
	374000	42900
કુલ કમાયેલ પ્રીમીયમ (ચોખ્યુ)		302400

પરિશિષ્ટ-૨ ચૂક્યેલ દાવાઓ (ચોખા)

ચૂક્યેલ દાવાઓ (ચોખા)	240000	
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના	33740	
	33740	273740
(-) પુનઃવીમા પેટે મળેલ રકમ		4500
(-) ચૂક્યવાના બાકી ૩૧-૦૩-૨૦૧૫ના		24374
કુલ ચૂક્યેલ દાવાઓ (ચોખા)		244274

પરિશિષ્ટ-૩ કમિશન

કમિશન	46400	
(+) સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	32400	€2000
(-) આપેલ પુનઃવીમા પર કમિશન		34000
કુલ કમિશન		47000

પરિશિષ્ટ-૪ વહીવટી ખર્ચ

વહીવટી ખર્ચ		€0000
-------------	--	-------

પ્ર.૭ બરોડા ઈન્સયરન્સ કં. લિ. તા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૭ પુરા થતા વર્ષની આગ વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે.

વિગતો	રૂ.
તા.૩૧-૧૨-૨૦૧૬ રોજ ભાવિ જોખમોનું અનામત	૩૫૦૦૦૦
વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા	૨૦૦૦૦૦
દાવા અંગે બાકી જવાબદારી:	
તા.૩૧-૧૨-૨૦૧૬	૨૫૦૦૦
તા.૩૧-૧૨-૨૦૧૭	૪૦૦૦૦
મળેલ પ્રીમીયમ	૫૦૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૭૫૦૦૦
આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૫૦૦૦૦
રિ-ઈન્સયરન્સ વસુલાત	૩૦૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ	૨૫૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્ષ	૩૦%
અન્ય આવક	૧૦૦૦૦
કમિશન	૩૪૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા કમિશન	૧૪૦૦૦
આપેલ પુનઃવીમા કમિશન	૧૦૦૦૦

અન્ય માહિતી:

- (૧) વધારાનું અનામત ભાવિ જોખમના અનામતના ૫૦% દર વર્ષે રાખવામાં આયે છે.
- (૨) વહીવટી ખર્ચ ₹. ૩૦૦૦૦, ફાનુની ખર્ચ ₹ ૧૨૦૦૦ છે.
- (૩) પ્રીમીયમના બાકી દેણા નીચે પ્રમાણે છે.

૩૧-૧૨-૨૦૧૬ - રૂ. ૭૫૦૦૦

૩૧-૧૨-૨૦૧૭ - રૂ. ૫૦૦૦૦

ઉપરની વિગતો પરથી આગના વીમાનું મહેસુલી ખાતુ ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ-૭:

(ઉભા સ્વરૂપે)

બરોડા ઈન્સયરન્સ કં. લિ. નું તા.૩૧-૧૨-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું
મહેસુલી ખાતુ (આગ વિભાગ)

વિગત	પરિશિષ્ટ	(રૂ.)
કમાયેલ પ્રીમીયમ (ચોખ્યુ)	૧	૫૭૫૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ		૨૫૦૦૦
(-) ઈન્કમટેક્ષ		૭૫૦૦
અન્ય આવકો		૧૦૦૦૦
કુલ (અ)		૭૦૨૫૦૦

ચૂકવેલ દાવાઓ (ચોખા)	૨		૧૯૭૦૦૦
કમિશન	૩		૪૦૦૦૦
વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ	૪		૩૦૦૦૦
કુલ (બ)			૨૫૭૦૦૦
કામગીરી નફો નફા-જુકશાન ખાતે (અ-બ)			૪૩૫૫૦૦

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખુ)

મળેલ પ્રીમીયમ	૫૦૦૦૦૦	
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૭૫૦૦૦	
પ્રીમીયમ બાકી ૩૧-૧૨-૨૦૧૭	૫૦૦૦૦	૭૨૫૦૦૦
(-) આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૫૦૦૦૦	
પ્રીમીયમ બાકી ૩૧-૧૨-૨૦૧૯	૭૫૦૦૦	૧૨૫૦૦૦
ચોખુ પ્રીમીયમ		૫૦૦૦૦૦
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે		
વર્ષની આખર બાકી		
પ્રીમીયમના ૫૦%	૩૦૦૦૦૦	
(+) વધારાનું અનામત	૧૫૦૦૦૦	
	૪૫૦૦૦૦	
(-) વર્ષની શરૂઆતની બાકીઓ		
બાકી જોખમ માટેનું અનામત	૩૪૦૦૦૦	
(+) વધારાનું અનામત	૧૭૫૦૦૦	
	૫૨૫૦૦૦	૭૫૦૦૦
કુલ કમાયેલ પ્રીમીયમ (ચોખુ)		૫૭૫૦૦૦

પરિશિષ્ટ-૨ ચૂકવેલ દાવાઓ (ચોખા)

ચૂકવેલ દાવાઓ (ચોખા)	૨૦૦૦૦૦	
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના	૪૦૦૦૦	
	૨૪૦૦૦૦	
(-) રી-ઇન્સયુરન્સ વસુલાત	૩૦૦૦૦	
(-) ચૂકવાના બાકી ૩૧-૦૩-૨૦૧૯ના	૨૫૦૦૦	
	૫૫૦૦૦	૧૮૫૦૦૦
કાનુની ખર્ચ		૧૨૦૦૦
કુલ ચૂકવેલ દાવાઓ (ચોખા)		૧૯૭૦૦૦

પરિશિષ્ટ-૩ કમિશન

કમિશન	34000	
(+) સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	14000	40000
(-) આપેલ પુનઃવીમા પર કમિશન		10000
કુલ કમિશન		40000

પરિશિષ્ટ-૪ વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ

વહીવટી ખર્ચ		30000
-------------	--	-------

પ્ર.૮ સુરત ઈંડિયન્સ કોર્પોરેશન લિ.ટા. ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની સમુદ્ર વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે.

વિગતો	રૂ.
તા.૩૧-૧૨-૨૦૧૬ રોજ ભાવિ જોખમોનું અનામત	૪૫૦૦૦૦
વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા	૧૫૦૦૦૦
દાવા અંગે બાકી જવાબદારી:	
તા.૩૧-૧૨-૨૦૧૬	30000
તા.૩૧-૧૨-૨૦૧૭	૨૦૦૦૦
મળેલ પ્રીમીયમ	૪૦૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૫૦૦૦૦
આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૪૦૦૦૦
રિ-ઇંડિયન્સ વસુલાત	૨૫૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ	૨૦૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્ષ	30%
અન્ય આવક	૧૨૫૦૦
કમિશન	૩૨૫૦૦
સ્વીકારેલ પુનઃવીમા કમિશન	૧૦૦૦૦
આપેલ પુનઃવીમા કમિશન	૮૦૦૦

અન્ય માહિતી:

- (૧) વધારાનું અનામત ભાવિ જોખમના અનામતના ૫૦% દર વર્ષે રાખવામાં આવે છે.
- (૨) વહીવટી ખર્ચ રૂ. ૨૦૦૦૦, કાનુની ખર્ચ રૂ. ૮૦૦૦ છે.
- (૩) પ્રીમીયમના બાકી લેણા નીચે પ્રમાણે છે.

૩૧-૧૨-૨૦૧૬ - રૂ. ૨૦૦૦૦

૩૧-૧૨-૨૦૧૭ - રૂ. ૧૦૦૦૦

ઉપરની માહિતી પરથી સમુદ્રના વિમું મહેસુલી ખાતુ ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ-૮:

(ઉભા સ્વરૂપે)

સુરત ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન લિ. નં. તા. ૩૧-૧૨-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષનું
મહેસુલી ખાતુ (સમુદ્ર વિભાગ)

વિગત	પરિણિષ્ટ		(૩.)
કમાચેલ પ્રીમીયમ (ચોખ્જુ)	૧		૪૭૫૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ		૨૦૦૦૦	
(-) ઈંકમટેક્સ		૫૦૦૦	૧૪૦૦૦
અન્ય આવક			૧૨૫૦૦
કુલ (અ)			૫૦૧૫૦૦
ચૂકવેલ દાવાઓ (ચોખ્જા)	૨		૧૨૩૦૦૦
કમિશન	૩		૩૪૫૦૦
વીમાના દંધાને લગતા કામગીરી ખર્ચ	૪		૨૦૦૦૦
કુલ (બ)			૧૭૭૫૦૦
કામગીરી નફો નફા-નુકશાન ખાતે (અ-બ)			૩૨૪૦૦૦

પરિણિષ્ટ-૧ કમાચેલ પ્રીમીયમ (ચોખ્જુ)

મળેલ પ્રીમીયમ	૪૦૦૦૦૦	
(+) સ્લીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૫૦૦૦૦	
પ્રીમીયમ બાકી ૩૧-૧૨-૨૦૧૭	૧૦૦૦૦	૪૫૦૦૦૦
(-) આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૪૦૦૦૦	
પ્રીમીયમ બાકી ૩૧-૧૨-૨૦૧૬	૨૦૦૦૦	૫૦૦૦૦
ચોખ્જુ પ્રીમીયમ		૪૦૦૦૦૦
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે		
વર્ષની આખર બાકી		
પ્રીમીયમના ૫૦%	૪૦૦૦૦૦	
(+) વધારાનું અનામત	૨૦૦૦૦૦	
	૫૦૦૦૦૦	
(-) વર્ષની શરૂઆતની બાકીઓ		
બાકી જોખમ માટેનું અનામત	૪૫૦૦૦૦	
(+) વધારાનું અનામત	૨૨૫૦૦૦	
	૫૭૫૦૦૦	૭૫૦૦૦
કુલ કમાચેલ પ્રીમીયમ (ચોખ્જું)		૪૭૫૦૦૦

પરિશિષ્ટ-૨ ચૂક્યેલ દાવાઓ (ચોખા)

ચૂક્યેલ દાવાઓ (ચોખા)	૧૫૦૦૦૦	
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૧૨-૨૦૧૭ના	૨૦૦૦૦	
	૧૭૦૦૦૦	
(-) રિ-ઇન્સયુરન્સ વસુલાત	૨૫૦૦૦	
(-) ચૂક્યવાના બાકી ૩૧-૧૨-૨૦૧૯ના	૩૦૦૦૦	
	૫૫૦૦૦	૧૧૫૦૦૦
કાનુની ખર્ચ		૮૦૦૦
કુલ ચૂક્યેલ દાવાઓ (ચોખા)		૧૨૩૦૦૦

પરિશિષ્ટ-૩ કમિશન

કમિશન	૩૨૫૦૦	
(+) સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	૧૦૦૦૦	૪૨૫૦૦
(-) આપેલ પુનઃવીમા પર કમિશન		૮૦૦૦
કુલ કમિશન		૩૪૫૦૦

પરિશિષ્ટ-૪ વીમાના દંડાને લગતા કામગીરી ખર્ચ

વહીવટી ખર્ચ		૨૦૦૦૦
-------------	--	-------

પ.૬ જ્યુ ઇન્ડિયા ઇન્સયુરન્સ કૂ. ના આગાના વિમ્બી બે વર્ષની ખાતાવહી માંથી નીચેની બાકીઓ મળી છે.

વિગતો	તા.૩૧-૦૩-૨૦૧૯ના રોજ પુરા થતા વર્ષ અંગેની	તા.૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષ અંગેની
	રૂ	રૂ
મળેલ પ્રીમીયમ	૨૨૦૦૦૦	૨૪૦૦૦૦
આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૫૦૦૦૦	૮૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૨૦૦૦૦	૪૦૦૦૦
ચૂક્યેલ દાવા	૩૪૦૦૦	૫૪૦૦૦
પુનઃવીમા વસુલાત	૪૦૦૦	૮૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પર ચૂક્યેલ દાવા	૫૦૦	૬૦૦
કમિશન સીધા દંડા પર	૬૦૦૦	૧૨૦૦૦
કમિશન સ્વીકારેલ પુનઃવીમા પર	૩૦૦૦	૫૦૦૦
કમિશન આપેલ પુનઃવીમા પર	૮૮૦૦	૬૫૦૦

સ્થિર ભિલક્તો પર ઘસારો	૫૧૦૦	૬૩૦૦
ઓડીટ ફી	૨૦૦૦	૨૦૦૦
સ્ટાફને પગાર	૫૦૦૦૦	૫૪૦૦૦
સ્ટેશનરી, તાર-ટપાલ વગેરે	૧૮૫૦૦	૨૩૦૦૦
સામાજ્ય વહીવહી ખર્ચ	૫૨૦૦	૬૦૦૦
ઘાલખાદ	૧૫૦૦	૬૦૦૦
મોટર વેચાણ પર નફો	૨૪૦૦	-----
ફર્નિચર વેચાણ પર નુકશાન	-----	૮૦૦
પ્રીમીયમમાં ઘટાડા રૂપે આપેલ બોનસ	૪૦૦૦	-----

અન્ય માહિતી:

- (૧) તા. ૩૧-૦૩-૨૦૧૫, તા. ૩૧-૦૩-૨૦૧૬ અને તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ ચૂકવવાના બાકી દાવાની રકમ અનુક્ત રૂ. ૩૧૩૭૦૦, રૂ. ૧૭૬૦૦ અને રૂ. ૨૨૨૨૦ હતી.
- (૨) તા. ૩૧-૦૩-૨૦૧૫ના રોજ બાકી જોખમ અંગારું અનામત રૂ. ૫૪૦૦૦ અને વધારાનું અનામત રૂ. ૫૪૦૦ હતું.
- (૩) બાકી જોખમ સામે અનામત જે તે વર્ષના ચોખા પ્રીમીયમના ૫૦% લેખે રાખવાનું અને વધારાનું અનામત તેના ૫% લેખે રાખવાનું છે.

ઉપરની વિગતો પરથી તા. ૩૧-૦૩-૨૦૧૬ અને તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષો અંગેનાં આગ વિભાગના મહેસુલી ખાતાં તૈયાર કરો.

જવાબ-દ:

(ઉભા સ્વરૂપે)

ન્યુ ઇન્ડિયા ઇન્સયુરન્સ કૂં. નું મહેસુલી ખાતુ (આગ વિભાગ)

વિગત	પરિશિષ્ટ	૩૧-૦૩-૨૦૧૬	૩૧-૦૩-૨૦૧૭
		રૂ.	રૂ.
કમાયેલ પ્રીમીયમ (ચોખુ)	૧	૧૫૧૪૦૦	૧૮૬૦૦૦
મોટર વેચાણ પર નફો		૨૪૦૦	
કુલ (અ)		૧૫૩૮૦૦	૧૮૬૦૦૦
ચૂકવેલ દાવાઓ (ચોખા)	૨	૩૪૭૦૦	૫૧૨૨૦
કમિશન	૩	૩૫૦૦	૭૪૦૦
વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ	૪	૭૬૮૦૦	૮૮૦૦૦
સ્થિર ભિલક્તો પર ઘસારો		૫૧૦૦	૬૩૦૦
ઘાલખાદ		૧૫૦૦	૬૦૦૦
ફર્નિચરના વેચાણ પર નુકશાન		-----	૮૦૦
પ્રીમીયમમાં ઘટાડા રૂપે આપેલ બોનસ		૪૦૦૦	-----
કુલ (બ)		૧૨૫૩૦૦	૧૭૨૭૨૦
કામગીરી નફો-નુકશાન ખાતે (અ-બ)		૨૮૫૦૦	૧૫૨૮૦

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખું)

વિગતો	૩૧-૦૩-૨૦૧૬ રૂ.	૩૧-૦૩-૨૦૧૭ રૂ.
મળેલ પ્રીમીયમ	૨૨૦૦૦૦	૨૪૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૨૦૦૦૦	૪૦૦૦૦
	૨૪૦૦૦૦	૨૮૦૦૦૦
(-) આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૫૦૦૦૦	૮૦૦૦૦
ચોખું પ્રીમીયમ	૧૮૦૦૦૦	૨૦૦૦૦૦
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે		
(-) વર્ષની આખર બાકી ૩૧-૦૩-૨૦૧૬ અને ૩૧-૦૩-૨૦૧૭ના પ્રીમીયમના ૫૦%	૬૦૦૦૦	૧૦૦૦૦૦
(+) વધારાનું અનામત	૬૦૦૦	૧૦૦૦૦
	(૬૦૦૦૦)	(૧૧૦૦૦૦)
(-) વર્ષની શરૂની બાકી ૩૧-૦૩-૨૦૧૬ અને ૩૧-૦૩-૨૦૧૭ના બાકી જોખમ માટેનું	૫૪૦૦૦	૬૦૦૦૦
અનામત		
(+) વધારાનું અનામત	૫૪૦૦	૬૦૦૦
	(૭૦,૪૦૦)	(૬૦૦૦૦)
કુલ કમાયેલ પ્રીમીયમ (ચોખું)	૧૫૧૪૦૦	૧૮૬૦૦૦

પરિશિષ્ટ-૨ ચૂક્યેલ દાવાઓ (ચોખા)

વિગતો	૩૧-૦૩-૨૦૧૬ રૂ.	૩૧-૦૩-૨૦૧૭ રૂ.
ચૂક્યેલ દાવાઓ (ચોખા)	૩૪૦૦૦	૫૪૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમા પર	૫૦૦	૬૦૦
(+) ચાલુ વર્ષના બાકી ૩૧-૦૩-૨૦૧૭ના	૧૭૬૦૦	૨૨૨૨૦
	૫૨૪૦૦	૮૭૧૨૦
(-) રિ-ઇન્સયુરન્સ પસુલાત	૪૦૦૦	૮૦૦૦
(-) ચુકવાના બાકી (૩૧-૦૩-૨૦૧૬ના)	૧૩૭૦૦	૧૭૬૦૦
કુલ ચૂક્યેલ દાવાઓ (ચોખા)	૩૪૭૦૦	૫૧૨૨૦

પરિશિષ્ટ-૩ કમિશન

વિગતો	૩૧-૦૩-૨૦૧૬ રૂ.	૩૧-૦૩-૨૦૧૭ રૂ.
કમિશન	૬૦૦૦	૧૨૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	૩૦૦૦	૫૦૦૦
	૧૨૦૦૦	૧૭૦૦૦
(-) આપેલ પુનઃવીમા પર કમિશન	૮૮૦૦	૮૫૦૦
કુલ કમિશન	૩૨૦૦	૭૪૦૦

પરિશીષ-૪ વીમાના દંડાને લગતા કામગીરી ખર્ચ

વિગતો	૩૧-૦૩-૨૦૧૬		૩૧-૦૩-૨૦૧૭	
	રૂ.	રૂ.	રૂ.	રૂ.
ઓડીટ ફી		૨૦૦૦		૨૦૦૦
સ્ટાફને પગાર		૫૦૦૦૦		૫૪૦૦૦
સ્ટેશનરી, તાર-ટપાલ વગેરે		૧૮૯૦૦		૨૩૦૦૦
સામાન્ય વહીવટી ખર્ચ		૫૨૦૦		૬૦૦૦
કુલ		૭૯૮૦૦		૮૮૦૦૦

પ્ર.૧૦ તા.૩૧-૦૩-૨૦૧૭ના રોજની આપેલી માહિતી ઉપરથી હિંમતનગર ઇન્સયુરન્સ કે. લિ. નું આગ વિભાગનું મહેસુલી ખાતું તૈયાર કરો.

		સીધા દંડા અંગે	પુનઃવીમા અંગે
		રૂ.	રૂ.
(૧)	પ્રીમીયમો: મળેલ	૧૦૦૦૦૦૦૦	૮૨૦૦૦૦
	મળવાનું બાકી: શરૂઆતનું : (તા. ૦૧-૦૪-૨૦૧૬)	૫૦૦૦૦૦	૮૦૦૦૦
	આખરનું: (તા. ૩૧-૦૩-૨૦૧૭)	૧૦૦૦૦૦૦	૧૦૦૦૦૦
	ચુક્કેલ:		૧૦૦૦૦૦૦
	ચુક્કવવાનું બાકી: શરૂઆતનું : (તા. ૦૧-૦૪-૨૦૧૬)		૧૦૦૦૦૦
	આખરનું: (તા. ૩૧-૦૩-૨૦૧૭)		૧૪૦૦૦૦
(૨)	દાવા : ચુક્કેલ	૫૪૦૦૦૦૦	૮૦૦૦૦૦
	ચુક્કવવાનું બાકી: શરૂઆતનું : (તા. ૦૧-૦૪-૨૦૧૬)	૮૦૦૦૦૦	૫૦૦૦૦
	આખરનું: (તા. ૩૧-૦૩-૨૦૧૭)	૧૨૦૦૦૦૦	૮૦૦૦૦
	મળેલ:		૫૦૦૦૦૦
	મળવાનું બાકી: શરૂઆતનું : (તા. ૦૧-૦૪-૨૦૧૬)		૮૦૦૦૦
	આખરનું: (તા. ૩૧-૦૩-૨૦૧૭)		૫૦૦૦૦
(૩)	કમિશન: ચુક્કેલ : સીધા દંડા પર	૩૦૦૦૦૦	
	સ્વીકારેલ પુનઃવીમા પર		૪૪૦૦૦
	મળેલ: આપેલ પુનઃવીમા પર		૫૦૦૦૦
(૪)	અન્ય ખર્ચ અને આવકો:		
	પગાર રૂ. ૩૨૦૦૦૦, બાકું આવકેરો રૂ. ૮૦૦૦૦, છપામણી અને સ્ટેશનરી રૂ. ૨૪૦૦૦, ઘાલખાદ રૂ. ૧૬૦૦૦, કાલુની ખર્ચ રૂ. ૫૦૦૦૦ (તેમાં રૂ. ૪૦૦૦૦ દાવાની પતાવટ અંગેના છે.) આવકેરો રૂ. ૫૦૦૦૦૦, વ્યાજ, ડિવિડન અને ભાડું (મળેલ) ચોખ્ખું રૂ. ૧૦૦૦૦૦.		
(૫)	બાકી જોખમ સામેનું અનામત : ૦૧-૦૪-૨૦૧૬		૪૦૦૦૦૦૦
	વધારાનું અનામત : તા. ૦૧-૦૪-૨૦૧૬		૪૦૦૦૦૦૦
(૬)	ભંડોળ તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ વર્ષના ચોખા પ્રીમીયમના ૫૦% બાકી જોખમ સામે અનામત રાખવાનું છે અને ચોખા પ્રીમીયમના ૫% વધારાનું અનામત રાખવાનું છે.		

જવાબ-૧૦:

(ઉભા સ્વરૂપે)

હિંમતનગર ઈન્સયરન્સ કં. લિ. નું મહેસુલી ખાતુ (આગ વિભાગ)

વિગતો	પરિશિષ્ટ	રૂ.
કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખું)	૧	૮૦૦૦૦૦૦
મોટર વેચાણ પર નફો		૧૦૦૦૦૦
કુલ (અ)		૬૦૬૦૦૦૦
ચૂક્યેલ દાવાઓ (ચોખ્ખા)	૨	૭૦૮૦૦૦૦
કમિશન	૩	૨૬૪૦૦૦
વીમા ધંધાને લગતા કામગીરી ખર્ચ	૪	૪૪૪૦૦૦
અન્ય: ધાલખાદ		૧૫૦૦૦
આવકવેરો		૫૦૦૦૦૦
કુલ (બ)		૮૪૩૪૦૦૦
કામગીરી નફો નફા-નુકશાન ખાતે (અ-બ)		૫૫૫૦૦૦

પરિશિષ્ટ-૧ કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખું)

વિગતો		
પ્રીમીયમ સીધા ધંધાથી		૧૦૦૦૦૦૦૦
(+) બાકી ચાલુ વર્ષ		૧૦૦૦૦૦૦
		૧૧૦૦૦૦૦૦
(-) પાછલા વર્ષનું બાકી		૫૦૦૦૦૦
		૧૦૪૦૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૮૨૦૦૦૦	
(+) બાકી ચાલુ વર્ષ	૧૦૦૦૦૦૦	
		૮૨૦૦૦૦૦
(-) પાછલા વર્ષનું બાકી	૮૦૦૦૦૦	૮૪૦૦૦૦
		૧૧૨૪૦૦૦૦
(-) આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૧૦૦૦૦૦૦	
(+) બાકી ચાલુ વર્ષ	૧૪૦૦૦૦૦	
		૧૧૪૦૦૦૦૦
(-) પાછલા વર્ષનું બાકી	૧૦૦૦૦૦૦	૧૦૪૦૦૦૦૦
		૧૦૨૦૦૦૦૦૦
(-) હવાલો બાકી જોખમ માટેનું અનામત માટે		
વર્ષની આખરની બાકી		
પ્રીમીયમના ૫૦%	૫૧૦૦૦૦૦૦	
(+) વધારાનું અનામત (૫%)	૫૧૦૦૦૦૦	
		૫૬૧૦૦૦૦૦
(-) વર્ષની શરૂઆતની બાકી		

બાકી જોખમ માટેનું અનામત	રૂ000000	
(+) વધારાનું અનામત	રૂ00000	
	રૂ400000	૧૨૧૦૦૦૦
કુલ કમાયેલ પ્રીમીયમ (ચોખ્ખું)		રૂ૮૦૦૦૦૦

પરિશિષ્ટ-૨ ચૂક્યેલ દાવાઓ (ચોખ્ખા)

વિગતો	રૂ.	રૂ.
ચૂક્યેલ દાવાઓ સીધા ધંધાથી		રૂ400000
(+) બાકી ચાલુ વર્ષ		૧૨૦૦૦૦૦
		૭૫૦૦૦૦૦
(-) પાછલા વર્ષનું બાકી	રૂ00000	
		રૂ૮૦૦૦૦૦
(+) સ્વીકારેલ પુનઃવીમા પર	રૂ00000	
(+) ચાલુ વર્ષના બાકી	રૂ0000	
(-) પાછલા વર્ષનું બાકી	રૂ0000	રૂ૮૦૦૦૦
(-) આપેલ પુનઃવીમા પર	રૂ00000	
(-) ચાલુ વર્ષના બાકી	રૂ0000	
		૫૫૦૦૦૦
(-) પાછલા વર્ષનું બાકી	રૂ0000	રૂ૮૦૦૦૦
		રૂ૮૦૪૦૦૦૦
(+) કાનુની ખર્ચ		રૂ0000
કુલ ચૂક્યેલ દાવાઓ (ચોખ્ખા)		રૂ૮૦૮૦૦૦૦

પરિશિષ્ટ-૩ કમિશન

વિગતો	રૂ.
કમિશન	રૂ300000
(+) સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	રૂ૪૦૦૦
	રૂ૩૪૪૦૦૦
(-) આપેલ પુનઃવીમા પર કમિશન	રૂ00000
કુલ કમિશન	રૂ૮૦૪૦૦૦

પરિશિષ્ટ-૪ વીમાના ધંધાને લગતા કામગીરી ખર્ચ

વિગતો	રૂ.
પગાર	રૂ350000
ભાડું આવકયેરા	રૂ00000
છપામણી અને સ્ટેશનરી	રૂ૪૦૦૦૦
કાનુની ખર્ચ	રૂ00000
કુલ	રૂ૪૪૪૦૦૦

૮.૧૩ સ્વાધ્યાય - વ્યવહારિક પ્રક્રિયા

પ્ર.૧ દી સુરત જનરલ ઇન્સયરન્સ કૂં. લિ. ના આગ વિભાગનું મહેસુલી ખાતું તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ નીચેની વિગતો દ્વારામાં લીધા વિના રૂ. ૨૫૦૦૦૦નો નશે બતાવે છે.

	વિગત	રૂ.
(૧)	પ્રીમીયમના મળવાના બાકી	૩૫૦૦૦
(૨)	પુનઃવીમાની બાકી વસુલાત	૩૦૦૦૦
(૩)	જામીનગીરી પર ચઢેલુ વ્યાજ (ખર્ચ બાદ)	૨૦૦૦૦
(૪)	એજન્ટનું બાકી કમિશન	૧૫૦૦૦
(૫)	પ્રીમીયમના ઘટાડા પેટે આપેલ બોનસ	૧૦૦૦૦
(૬)	ચૂજુ થયેલ, પણ નહિ ચુકવેલ દાવાઓ	૪૫૦૦૦

ઉપરની વિગતો નોંધ્યા પછી નશે પર શી અસર થશે તે જણાવો.

જવાબ: સુધારેલ નશે રૂ. ૨૫૨૫૦૦, બાકી જોખમો માટેનું અનામત વધારવાના પ્રીમીયમ પર રૂ. ૪૫૦૦૦ ૫ ૫૦% રૂ. ૨૨૫૦૦.

પ્ર.૨ દી મુંબદી જનરલ ઇન્સયરન્સ કૂં. લિ. ની તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ આગના વીમા વિભાગની નીચે મુજબની વિગતો હતી.

	વિગતો	રૂ.
બાકી જોખમ માટેનું અનામત (તા. ૩૧-૦૩-૨૦૧૬)		૧૨૫૦૦૦
વધારાનું અનામત (તા. ૩૧-૦૩-૨૦૧૬)		૨૫૦૦૦
ચૂકવેલ દાવાઓ		૧૫૨૫૦૦
ચૂકવવાના બાકી દાવાઓ:		
તા. ૩૧-૦૩-૨૦૧૬ના રોજ		૧૫૨૫૦
તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ		૨૨૫૦૦
વહીવટી ખર્ચ (આમાં ચૂકવેલ દાવાઓ અંગેના કાનુની ખર્ચના રૂ. ૭૫૦૦નો સમાવેશ થાય છે.)		૭૦૦૦૦
આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ		૧૮૭૫૦
પુનઃવીમાના દાવાઓમાંથી મળેલ રકમ		૫૦૦૦
સ્વીકારેલ પુનઃવીમાના દાવા		૭૫૦૦
મળેલ પ્રીમીયમ		૨૭૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ (ઓસ)		૧૬૧૩૦
ઉપરની રકમ પર ઈન્કમટેક્ષ		૧૫૩૦
રોકાણોના વેચાણ પર થયેલ નશે		૨૭૫૦
કમિશન		૩૮૦૦૦
સ્વીકારેલ પુનઃવીમાનું પ્રીમીયમ		૧૦૦૦૦

વર્ષ દરમિયાન મળેલ પ્રીમીયમની આવકના ૫૦% બાકી જોખમ માટે અનામત રાખો અને બીજુ વધારાનું અનામત રૂ. ૫૦૦૦ રાખો. ઉપરની વિગતો પરથી આગના વીમાનું મહેસુલી ખાતુ પ્રણાલિકાગત પદ્ધતિ પ્રમાણે તથા ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ: નઝે મહેસુલી ખાતુ રૂ.૩૫૨૫, બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર રૂ. ૧૩૦૯૨૫ અને વધારાનું અનામત રૂ. ૨૫૦૦૦.

પ્ર.૩ ન્યુ ઇન્ડિયા ઇન્સયુરન્સ કં. લિ. તા. ૩૧મી માર્ચ, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની પોતાના આગ વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે.

વિગતો	રૂ.
તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ બાકી જોખમ માટે અનામત	૧૫૦૦૦૦
બાકી દેવા અંગેની જવાબદારી:	
તા. ૩૧-૦૩-૨૦૧૭	૨૦૦૦૦
તા. ૩૧-૦૩-૨૦૧૭	૩૦૦૦૦
આગ બુકાવવાનો ખર્ચ	૨૦૦૦
ચૂકવેલ દાવા	૧૪૦૦૦૦
પુનઃવીમા પ્રીમીયમ	૬૦૦૦
પુનઃવીમાના મજબૂતી	૩૦૦૦
મળેલ પ્રીમીયમ	૩૫૦૦૦૦
સીધા વેપાર પર કમિશન	૫૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	૪૫૦૦
આપેલ પુનઃવીમા પર કમિશન	૨૫૦૦
વ્યાજ અને ડિવિડન	૩૦૦૦૦
ઉપરની આવક પર કપાયેલ કર	૧૪૦૦૦
રોકાણોના વેચાણ પર નઝે	૩૪૦૦
તા. ૩૧ માર્ચ, ૨૦૧૭ના રોજનું વધારાનું અનામત	૧૨૦૦૦૦

વહીવટી ખર્ચ રૂ. ૬૦૦૦૦ અને કાનુની ખર્ચ રૂ. ૩૫૦૦ છે. વધારાનું અનામત, પ્રીમીયમ બાદ પુનઃવીમાના ૧૦%થી વધારવાનું છે. બાકી જોખમ માટેનું અનામત પ્રીમીયમ બાદ પુનઃવીમાના ૫૦% જેટલું રાખવાનું છે.

ઉપરની વિગતો પરથી આગના વિમાનું મહેસુલી ખાતુ ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ: નઝે મહેસુલી ખાતુ રૂ.૨૫૪૦૦, બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર રૂ. ૧૭૫૫૦૦ અને વધારાનું અનામત રૂ. ૧૫૫૧૦૦.

પ્ર.૪ નીચેની વિગતો પરથી કોટક ઇન્સયુરન્સ કું લિ. નું આગામા વિભાગ માટે મહેસુલી ખાતું તા. ૩૧-૦૩-૨૦૧૭નો રોજ પુરા થતા વર્ષ માટે તૈયાર કરો.

	વિગતો	રૂ.
(૧)	ભાવિ જોખમ માટેનું અનામત (૦૧-૦૪-૨૦૧૬)	૫૩૭૫૦૦
	વધારાનું અનામત (૦૧-૦૪-૨૦૧૬)	૫૨૫૦૦
(૨)	મળેલ પ્રીમીયમ	૧૨૪૫૦૦૦
(૩)	ચૂકવવાના બાકી દાવાઓ:	
	૦૧-૦૪-૨૦૧૬	૫૦૦૦
	૩૧-૦૩-૨૦૧૭	૧૦૦૦૦
(૪)	ચૂકવેલ દાવાઓ	૪૦૦૦૦૦
(૫)	આપેલ પુનઃવીમાનું પ્રીમીયમ	૧૦૦૦૦
(૬)	વસુલાત	૨૫૦૦૦
(૭)	સ્વીકારેલ પુનઃવીમા દાવા	૭૫૦૦
(૮)	સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૧૫૦૦૦
(૯)	કમિશન સીધા ધંધા પર	૧૦૫૦૦૦
(૧૦)	કમિશન સ્વીકારેલ પુનઃવીમા પર	૩૦૦૦૦
(૧૧)	કમિશન આપેલ પુનઃવીમા પર	૧૦૦૦૦
(૧૨)	કાનુની ખર્ચ (રૂ. ૨૫૦૦૦ દાવા અંગે)	૧૭૫૦૦
(૧૩)	વહીવટી ખર્ચ	૩૦૦૦૦૦
(૧૪)	અન્ય આવક	૭૫૦૦૦
(૧૫)	અન્ય ખર્ચ	૨૦૦૦૦

ભાવિ જોખમનું અનામત આચારસંહિતા મુજબ રાખવાનું છે. જ્યારે વધારાનું અનામત ચોખા પ્રીમીયમના ૧% જેટલું ઘટાડવાનું છે.

જવાબ: નશો મહેસુલી ખાતુ રૂ.૪૦૦૦૦૦, બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર રૂ. ૫૨૫૦૦૦ અને વધારાનું અનામત રૂ. ૫૦૦૦૦.

પ્ર.૫ વિપ્રો ઇન્ડસ્ટ્રિયર્સ કં. લિ. તા. ઉભી માર્ચ, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની પોતાના સમુદ્ર ધંધા અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે. મહેસુલી ખાતુ તૈયાર કરો.

	વિગતો	સીધા ધંધા અંગે રૂ.	પુનઃવીમા અંગે રૂ.
(૧)	દાવાઓ		
	ચૂકવેલ	૫૫૦૦૦૦	૧૫૦૦૦૦
	મળેલ	-----	૧૦૦૦૦૦
(૨)	પ્રીમીયમ		
	મળેલ	૨૦૦૦૦૦૦	૩૪૦૦૦૦
	ચૂકવેલ	-----	૧૦૦૦૦૦
(૩)	કમિશન		
	ચૂકવેલ	૨૩૧૦૦૦	૬૫૦૦
	મળેલ	-----	૧૨૫૦૦
	અન્ય માહિતી		
(૪)	વહીવટી ખર્ચ		૧૫૭૦૦૦
(૫)	વ્યાજ અને ડિવિડન્ડ		
	ગ્રોસ	૫૦૦૦૦	
	ટી.ડી.એસ. (કર્ણા)		૧૦%
(૬)	અન્ય આવક		૫૦૦૦
(૭)	અન્ય ખર્ચ		૮૦૦૦
(૮)	ભાવિ જોખમ માટેનું અનામત (૦૧-૦૪-૨૦૧૬)		૧૭૫૦૦૦૦
	વધારાનું અનામત (૦૧-૦૪-૨૦૧૬)		૧૭૫૦૦૦

ભાવિ બાકી જોખમ માટેનું અનામત ચોખા પ્રીમીયમના ૧૦૦% જેટલુ રાખવાનું છે જ્યારે વધારાનું અનામત ચોખા પ્રીમીયમના ૧૦% જેટલુ રાખવાનું છે.

જવાબ: નશો મહેસુલી ખાતુ રૂ.૧૭૫૦૦૦૦, બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર રૂ. ૨૨૫૦૦૦૦ અને વધારાનું અનામત રૂ. ૨૨૫૦૦૦.

અનામત માટે હવાલો:

શરૂઆતની બાકીઓ: $(1750000 + 175000) =$ ૧૯૨૫૦૦૦

આખરની બાકીઓ: $(2250000 + 225000) =$ ૨૪૭૫૦૦૦

હવાલો (-450000)

પ્ર.૫ શિલાયન્સ ઓરિએન્ટલ ઇન્ડસ્ટ્રીઝ કે. લિ. તા. ત૧મી માર્ચ, ૨૦૧૭ના રોજ પુરા થતી વર્ષની પોતાના સમૃદ્ધ વિભાગ અંગેની ભાહિતી નીચે મુજબ રજુ કરે છે.

વિગતો	રૂ.
તા. ૩૧-૦૩-૨૦૧૫ના રોજ બાકી જોખમ માટે અનામત	૧૯૮૭૫૦
બાકી દાવા અંગેની જવાબદારી:	
તા. ૩૧-૦૩-૨૦૧૬	૧૨૧૮૮
તા. ૩૧-૦૩-૨૦૧૭	૧૯૮૭૫
ચૂક્યેલ દાવા	૧૨૦૦૦૦
પુનઃવીમા પ્રીમીયમ	૪૫૦૦
પુનઃવીમાના મહ્યા	૯૨૫૦
મળેલ પ્રીમીયમ	૧૮૦૦૦૦
સીધા વેપાર પર કમિશન	૨૮૭૫૦
સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન	૧૫૨૫૦
આપેલ પુનઃવીમા પર કમિશન	૧૭૫૦૦
વ્યાજ અને ડિવિડન્ડ	૧૨૦૦૦
ઉપરની આવક પર કપાચેલ કર	૪૨૫૦
રોકાણોના વેચાણ પર નકો	૨૦૯૨૫
તા. ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજનું વધારાનું અનામત	૧૮૭૫૦

વહીવટી ખર્ચ રૂ. ૪૫૦૦૦ અને કાનુની ખર્ચ રૂ. ૧૭૫૦ છે. વધારાનું અનામત, પ્રીમીયમ બાદ પુનઃવીમાના ૧૦%થી વધારાનું છે. બાકી જોખમ માટેનું અનામત પ્રીમીયમ બાદ પુનઃવીમાના ૧૦૦% જેટલું રાખવાનું છે. ઉપરની વિગતો પરથી સમૃદ્ધના વિમાનું મહેસુલી ખાતું ઉલા સ્વરૂપે તૈયાર કો.

જવાબ: નકો મહેસુલી ખાતું રૂ. ૧૮૧૧૩, બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર રૂ. ૧૭૫૫૦ અને વધારાનું અનામત રૂ. ૩૫૩૦૦.

પ્ર.૭ તાતા ઈંડિયન્સ કે. લિ. ટા. અમૃતી ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની આગ વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે રજૂ કરે છે.

વિગતો	રૂ.
તા. ૩૧-૧૨-૨૦૧૭ના રોજ બાકી જોખમ માટે અનામત	૧૭૫૦૦૦
વર્ષ દરમિયાન ચૂક્યેલ દાવા	૧૦૦૦૦૦
બાકી દાવા અંગેની જવાબદારી:	
તા. ૩૧-૧૨-૨૦૧૭	૧૨૫૦૦
તા. ૩૧-૧૨-૨૦૧૮	૨૦૦૦૦
મળેલ પ્રીમીયમ	૩૦૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૩૭૫૦૦
આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૨૫૦૦૦
રિ-ઇંડિયન્સ વસુલાત	૧૫૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ	૧૨૫૦૦
વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્શ	૩૦%
અન્ય આપક	૫૦૦૦
કમિશન	૧૭૫૦૦
સ્વીકારેલ પુનઃવીમા કમિશન	૭૫૦૦
આપેલ પુનઃવીમા કમિશન	૫૦૦૦

અન્ય માહિતી:

- (૧) વધારાનું અનામત ભાવિ જોખમના અનામતના ૫૦% દર વર્ષે રાખવામાં આવે છે.
- (૨) વહીવટી ખર્ચ રૂ. ૧૫૦૦૦, કાનુની ખર્ચ રૂ. ૫૦૦૦ છે.
- (૩) પ્રીમીયમના બાકી લેણા નીચે પ્રમાણે છે.

તા. ૩૧-૧૨-૨૦૧૭ - રૂ. ૭૫૦૦

તા. ૩૧-૧૨-૨૦૧૮ - રૂ. ૨૫૦૦૦

ઉપરની વિગતો પરથી આગના વિમું ભણેસુલી ખાતુ ઉલા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ: નશો ભણેસુલી ખાતુ રૂ. ૨૧૭૭૫૦, બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર રૂ. ૧૫૦૦૦૦ અને વધારાનું અનામત રૂ. ૭૫૦૦૦.

પ્ર.૮ બજાજ ઇન્સયુરન્સ કં. લિ. ટા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષની સમૃદ્ધ વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે રજુ કરે છે.

વિગતો	રૂ.
ટા. ૩૧-૧૨-૨૦૧૯ના રોજ બાકી જોખમ માટે અનામત	૨૨૫૦૦૦
વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા	૭૫૦૦૦
દાવા અંગે બાકી જવાબદારી:	
ટા. ૩૧-૧૨-૨૦૧૯	૧૫૦૦૦
ટા. ૩૧-૧૨-૨૦૧૭	૧૦૦૦૦
મળેલ પ્રીમીયમ	૨૦૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૨૫૦૦૦
આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૨૦૦૦૦
રિ-ઇન્સ્યુરન્સ વસુલાત	૧૨૫૦૦
વ્યાજ અને ડિવિડન્ડ	૧૦૦૦૦
વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્શ	30%
અન્ય આપક	૫૨૫૦
કમિશન	૧૫૨૫૦
સ્વીકારેલ પુનઃવીમા કમિશન	૫૦૦૦
આપેલ પુનઃવીમા કમિશન	૪૦૦૦

અન્ય માહિતી:

- (૧) વધારાનું અનામત ભાવિ જોખમના અનામતના ૫૦% દર વર્ષે રાખવામાં આવે છે.
- (૨) વહીવટી ખર્ચ રૂ. ૧૦૦૦૦, કાનુની ખર્ચ રૂ. ૪૦૦૦ છે.
- (૩) પ્રીમીયમના બાકી લેણા નીચે પ્રમાણે છે.

ટા. ૩૧-૧૨-૨૦૧૯ - રૂ. ૧૦૦૦૦

ટા. ૩૧-૧૨-૨૦૧૭ - રૂ. ૫૦૦૦

ઉપરની વિગતો પરથી સમૃદ્ધના વિમું મહેસુલી ખાતુ ઉભા સ્વરૂપે તૈયાર કરો.

જવાબ: નશો મહેસુલી ખાતુ રૂ.૧૫૨૦૦૦, બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર રૂ. ૨૦૦૦૦૦ અને વધારાનું અનામત રૂ. ૧૦૦૦૦૦.

પ્ર.૬ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કૂ. ના આગના વિમળી બે વર્ષની ખાતાવહી માંથી નીચેની બાકીઓ મળી છે.

વિગત	તા. ૩૧-૦૩-૨૦૧૫ના રોજ પુરા થતા વર્ષ અંગેની રૂ.	તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષ અંગેની રૂ.
મળેલ પ્રીમીયમ	૫૫૦૦૦	૫૦૦૦૦
આપેલ પુનઃવીમા પ્રીમીયમ	૧૫૦૦૦	૨૦૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પ્રીમીયમ	૫૦૦૦	૧૦૦૦૦
ચુક્કયેલ દાવા	૮૫૦૦	૧૫૦૦૦
પુનઃવીમા વસુલાત	૧૦૦૦	૨૦૦૦
સ્વીકારેલ પુનઃવીમા પર ચુક્કયેલ દાવા	૧૨૫	૨૨૫
કમિશન સીધા ધંધા પર	૨૨૫૦	૩૦૦૦
કમિશન સ્વીકારેલ પુનઃવીમા પર	૭૫૦	૨૫૦૦
કમિશન આપેલ પુનઃવીમા પર	૨૨૦૦	૨૪૦૦
સ્થિર મિલકતો પર ઘસારો	૧૨૭૫	૧૫૭૫
ઓડીટ ફી	૫૦૦	૫૦૦
સ્ટાફને પગાર	૧૨૫૦૦	૧૩૫૦૦
સ્ટેશનરી, તાર-ટપાલ વગેરે	૪૫૫૦	૫૭૫૦
સામાન્ય વહીવટી ખર્ચ	૧૫૫૦	૨૨૫૦
ઘાલખાદ	૩૭૫	૨૨૫૦
મોટર વેચાણ પર નફો	૫૦૦	-----
ફર્નિચરના વેચાણ પર નુકશાન	-----	૨૦૦
પ્રીમીયમમાં ઘટાડા રૂપે આપેલ બોનસ	૧૦૦૦	-----

અન્ય માહિતી:

- (૧) તા. ૩૧-૦૩-૨૦૧૫, તા. ૩૧-૦૩-૨૦૧૬ અને તા. ૩૧-૦૩-૨૦૧૭ ના રોજ ચુક્કવણાના બાકી દાવાની રકમ અનુક્રમે રૂ.૩૪૨૫, રૂ. ૪૪૫ અને રૂ.૫૫૫ હતી.
- (૨) તા. ૩૧-૦૩-૨૦૧૫ના રોજ બાકી જોખમ અંગેનું અનામત રૂ. ૧૫૦૦૦ અને વધારાનું અનામત રૂ. ૧૫૦૦ હતું.
- (૩) બાકી જોખમ સામે અનામત જે તે વર્ષના ચોખમા પ્રીમીયમના ૫૦% લેખે રાખવાનું છે અને વધારાનું અનામત તેના ૫% લેખે રાખવાનું છે.

ઉપરની વિગતો પરથી તા. ૩૧-૦૩-૨૦૧૫ અને ૩૧-૦૩-૨૦૧૭ના રોજ પુરા થતા વર્ષો અંગેના આગ વિભાગના મહેસુલી ખાતા તૈયાર કરો.

જવાબ: નફો મહેસુલી ખાતું તા. ૩૧-૦૩-૨૦૧૫ રૂ. ૭૧૨૫ અને ૩૧-૦૩-૨૦૧૭ રૂ. ૪૦૭૦.
 બાકી જોખમ માટેનું અનામત વધારાના પ્રીમીયમ પર
 તા. ૩૧-૦૩-૨૦૧૫ રૂ. ૨૨૫૦૦ અને વધારાનું અનામત રૂ. ૨૨૫૦.
 તા. ૩૧-૦૩-૨૦૧૭ રૂ. ૨૫૦૦૦ અને વધારાનું અનામત રૂ. ૨૫૦૦.

પ્ર.૧૦ તા.૩૧-૦૩-૨૦૧૭ના રોજની આપેતી વિગતો ઉપરથી હિંમત ઈન્સ્યુરન્સ કે. લિ. નું આગ વિભાગનું મહેસુલી ખાતુ તૈયાર કરો.

	વિગત	સીધા ધંધા અંગે રૂ.	પુનઃવીમા અંગે રૂ.
(૧)	પ્રીમીયમો: મળેલ મળવાનું બાકી : શરૂઆતનું (તા. ૦૧-૦૪-૨૦૧૬) આખરનું: (તા.૩૧-૦૩-૨૦૧૭)	૨૫૦૦૦૦૦ ૧૫૦૦૦૦ ૨૫૦૦૦૦	૨૦૫૦૦૦ ૨૦૦૦૦ ૨૫૦૦૦
	ચૂક્યેલઃ ચૂક્યવાનું બાકી: શરૂઆતનું: (તા. ૦૧-૦૪-૨૦૧૬) આખરનું: (તા.૩૧-૦૩-૨૦૧૭)		૨૫૦૦૦૦ ૨૫૦૦૦ ૩૫૦૦૦
(૨)	દાવા: ચૂક્યેલ ચૂક્યવાનું બાકી: શરૂઆતનું: (તા. ૦૧-૦૪-૨૦૧૬) આખરનું: (તા.૩૧-૦૩-૨૦૧૭)	૧૫૦૦૦૦૦ ૨૦૦૦૦૦ ૩૦૦૦૦૦	૨૦૦૦૦૦ ૧૫૦૦૦ ૨૦૦૦૦
	મળેલ: મળવાનું બાકી : શરૂઆતનું: (તા. ૦૧-૦૪-૨૦૧૬) આખરનું: (તા.૩૧-૦૩-૨૦૧૭)		૧૫૦૦૦૦ ૨૦૦૦૦ ૧૫૦૦૦
(૩)	કમિશન: ચૂક્યેલ: સીધા ધંધા પર સ્વીકારેલ પુનઃવીમા પર મળેલ: આપેલ પુનઃવીમા પર	૭૫૦૦૦ ૧૧૦૦૦ ૧૨૫૦૦	
(૪)	અન્ય ખર્ચ અને આવકો: પગાર રૂ. ૮૦૦૦૦, ભાડુ. રૂ. ૨૦૦૦૦, છપામણી અને સ્ટેશનરી રૂ. ૫૦૦૦, ધારાખાંડ રૂ. ૪૦૦૦, કાનુંની ખર્ચ રૂ. ૧૫૦૦૦ (તેમાં રૂ. ૧૦૦૦૦ દાવાની પતાવટ અંગેના છે.) આવક્યેરો રૂ. ૧૫૦૦૦૦, પ્યાજ, ડિવિડન અને ભાડું (મળેલ) ચોખ્યુ રૂ. ૨૫૦૦૦.		
(૫)	બાકી જોખમ સામેનું અનામત: તા. ૦૧-૦૪-૨૦૧૬	૧૦૦૦૦૦ ૦	૧૦૦૦૦૦
	વધારાનું અનામત : તા. ૦૧-૦૪-૨૦૧૬		૧૦૦૦૦૦
(૬)	બંદોળ તા. ૩૧-૦૩-૨૦૧૭ના રોજ વર્ષના ચોખ્યા પ્રીમીયમના ૫૦% બાકી જોખમ સામે અનામત રાજ્યવાનું છે અને ચોખ્યા પ્રીમીયમના ૫% વધારાનું અનામત રાજ્યવાનું છે.		

જવાબ: નકો મહેસુલી ખાતુ રૂ.૩૨૮૦૦૦, બાકી જોખમ ભાટેનું અનામત વધારાના પ્રીમીયમ પર
રૂ. ૧૨૭૫૦૦ અને વધારાનું અનામત રૂ. ૧૮૭૫૦૦.